

પ્રથમ વર્ષ બી. કોમ.  
**BCECON105**  
ભાગ-૧

# એકમલકી અર્થશાસ્ત્ર





## એકમલક્ષી અર્થશાસ્ત્ર

---

એકમ : 1

ધંધાકીય અર્થશાસ્ત્રનો પરિચય અને મૂળભૂત ઘ્યાલો

1-42

---

એકમ : 2

માંગની સ્થિતિ સ્થાપકતા અને વપરાશનું વર્તન

43-121

---

એકમ-3

ઉત્પાદન અને ઉત્પાદન વિધેય

122-144

---

એકમ-4

ખર્ચ રેખાઓ તથા પુરવઠાનો નિયમ

145-168

---

લેખન :	ડૉ. હિનાબેન પટેલ ડૉ. બિનાબેન પટેલ	પ્રિન્સીપાલ, મણીબેન એમ.પી. શાહ મહિલા આર્ટસ કોલેજ, કડી. આસિસ્ટન્ટ પ્રોફેસર, GLS કોલેજ, અમદાવાદ.
પરામર્શક(વિષય) :	ડૉ. હિનાબેન પટેલ ડૉ. પલ્લવી વ્યાસ	પ્રિન્સીપાલ, મણીબેન એમ.પી. શાહ મહિલા આર્ટસ કોલેજ, કડી. આસિસ્ટન્ટ પ્રોફેસર એન્ડ હેડ ઓફ ઇકોનોમિક ડીપાર્ટમેન્ટ, પ્રિ. એમ.સી. શાહ કોમર્સ કોલેજ, અમદાવાદ.
પરામર્શક(ભાષા) :	ડૉ. જાગૃતિ મેહતા ડૉ. પ્રવીણ પટેલ	આસિસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાતી, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ. આસિસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાતી, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ.
સંયોજક :	પ્રો. (ડૉ.) મનોજ શાહ	પ્રોફેસર & નિયામક, સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ.
પ્રકાશક :	ડૉ. ભાવિન ત્રિવેદી	કાર્યકારી કુલસચિવ, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ-382481.

આવૃત્તિ : જૂન 2020 પ્રથમ આવૃત્તિ (નવો અભ્યાસક્રમ)

ISBN No :

#### સર્વાધિકાર સુરક્ષિત

આ પાઠ્યપુસ્તક ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ઉપક્રમે વિદ્યાર્થીલક્ષી સ્વઅધ્યયન હેતુથી; ફૂરવતી શિક્ષણના ઉકેશને કેન્દ્રમાં રાખી તૈયાર કરવામાં આવેલ છે. જેના સર્વાધિકાર સુરક્ષિત છે. આ અભ્યાસ-સામગ્રીનો કોઈપણ સ્વરૂપમાં ધંધાધારી ઉપયોગ કરતાં પહેલાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની લેખિત પરવાનગી લેવાની રહેશે.

## : રૂપરેખા :

- 1.1 પ્રસ્તાવના
- 1.2 અર્થશાસ્ત્રની વ્યાખ્યા
- 1.3 ધંધાકીય અર્થશાસ્ત્રનાં લક્ષણો
- 1.4 ઉત્પાદનનાં સાધનો
- 1.5 અર્થતંત્રની મૂળભૂત સમસ્યાઓ
- 1.6 ઉત્પાદન શક્યતા વક
- 1.7 આર્થિક પદ્ધતિઓ અને સંસાધનોની ફાળવણી
- 1.8 આર્થિક પદ્ધતિઓમાં સંસાધનોની ફાળવણી
- 1.9 પાયાનાં ઘણાલો
- 1.10 સારાંશ
- 1.11 ચાવીરૂપ શબ્દો
- 1.12 સ્વાધ્યાય

**1.1 પ્રસ્તાવના :**

ધંધાકીય અર્થશાસ્ત્ર એ સંસાધનોની અછતની વચ્ચે વસ્તુ અને સેવાઓનાં ઉત્પાદન અને વપરાશમાં ગ્રાહકો, પેઢીઓ વગેરેનો અભ્યાસ છે. ધંધાકીય અર્થશાસ્ત્ર એ તેના ઇચ્છિત લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે મયોદિત સાધનોનું આયોજન અને ફાળવણી કઈ રીતે કરવી તે દર્શાવે છે. ધંધાકીય અર્થશાસ્ત્ર એ નિષ્ણય લેવા માટેનું અર્થશાસ્ત્ર છે. ધંધાકીય સમસ્યાઓ અને તેના નિરાકરણની પદ્ધતિઓ પ્રસ્તુત કરતી વખતે નિયોજકો આર્થિક કાયદાઓ અને સિક્ષાંતો લાગુ પાડે છે. ધંધાકીય અર્થશાસ્ત્રની એક “વિશેષ શાખા” છે. જે અમૃત આર્થિક સિક્ષાંત અને મેનેજરી આ પ્રેક્ટિસ વચ્ચેનાં અંતરને દૂર કરે છે. નિયોજકોને ધંધાકીય સમસ્યાઓ હલ કરવા માટે અર્થશાસ્ત્રના સિક્ષાંતો, વિભાવનાઓ અને સાધનો ઉપયોગી છે.

**1.2 અર્થશાસ્ત્રની વ્યાખ્યા :-**

અર્થશાસ્ત્ર શબ્દનો સાંદ્રો અર્થ છે ‘અર્થ’ નું શાસ્ત્ર, અર્થશાસ્ત્ર સમાજમાં રહેતા સામાન્ય મજૂબ્યના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે. સમાજની પરિસ્થિતિ સતત બદલાતી રહેતી હોવાથી

તે મુજબ માનવીનું વર્તન પણ બદલાય છે. આથી અર્થશાસ્ત્રનું કાર્ય સતત બદલતું જાય છે. અર્થશાસ્ત્રની જુદા જુદા સમયે જે વ્યાખ્યાઓ પ્રાપ્ત થઈ તે સમજીએ.

### એડમ સિમથની વ્યાખ્યા :-

1776માં એડમ સિમથે સૌ પ્રથમ તેમના પ્રકાશિત પુસ્તક “ An Enquiry in to the Nature and Courses of Wealth of Nations ” માં અર્થશાસ્ત્રને સંપત્તિનાં શાસ્ત્ર તરીકે દર્શાવ્યું. તેઓનાં મતે “ ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પત્ત થયેલ ભૌતિક સંપત્તિનું ઉત્પાદન-વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર ”

### પ્રો. જે. એસ. મિલ :-

ઇંગ્લેન્ડનાં અર્થશાસ્ત્રી જે. એસ. મિલના મતે “ અર્થશાસ્ત્ર સંપત્તિનું સ્વરૂપ તેમજ તેની ઉત્પાદન અને વહેંચણીની સમજૂતી આપતું શાસ્ત્ર છે.”

### પ્રો. આલ્ફેડ માર્શલ :-

પ્રો. આલ્ફેડ માર્શલે તેમના પુસ્તક “ ગ્રાન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ ”માં અર્થશાસ્ત્રની વ્યાખ્યા રજૂ કરી છે. “ અર્થશાસ્ત્ર માનવીના સામાન્ય જીવન વ્યવહારનો અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર વ્યક્તિ તેમજ સમાજની તે પ્રવૃત્તિઓનું અધ્યયન કરે છે જે માનવ સુખનાં ભૌતિક સાધનોની પ્રાપ્તિ અને વપરાશ સાથે ગાઢ રીતે સંકળાયેલી છે.”

### પ્રો. એ. સી. પીગુ :-

“ આપણા અભ્યાસનું ક્ષેત્ર સમાજ કલ્યાણના તે ભાગ પૂરતું મયાર્દિત છે કે જે નાણાં વડે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માપી શકાય છે.”

### પ્રો. લાયોનલ રોબિન્સ :-

પ્રો. રોબિન્સે 1931માં પ્રકાશિત થયેલાં તેમનાં પુસ્તક “ Nature and significance of Economic Science ”માં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતાં જ્ઞાનાં છે કે અર્થશાસ્ત્ર એ “ અધિતતું શાસ્ત્ર છે ” અર્થશાસ્ત્ર એ વાસ્તવદર્શી શાસ્ત્ર છે તેમજ તે મનુષ્યનાં આર્થિક વર્તનને તપાસે છે. તે મુજબ રોબિન્સે નીચે મુજબ અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે. “ અર્થશાસ્ત્ર એ એવું શાસ્ત્ર કે વિજ્ઞાન છે જે અમયાર્દિત જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા મયાર્દિત સાધનોનાં સંદર્ભમાં માનવ વર્તણુંકનો અભ્યાસ કરે છે.”

## 1.3 ધંધાકીય અર્થશાસ્ત્રનાં લક્ષણો :-

### (i) અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે :-

અંગ્રેજીમાં scienceનો અર્થ વિજ્ઞાન કે શાસ્ત્ર થાય છે. વિજ્ઞાન એટલે પદ્ધતિસરનું જ્ઞાન જેમાં કાર્ય કારણનો સંબંધ દર્શાવવામાં આવે છે. જેમાં કોઈ એક જ ઘટના નહિ પરંતુ અનેક ઘટનાઓ સમજાવવામાં આવે છે. જેના આધારે નિયમો શોધવામાં આવે છે. નિયમોના આધારે આગાહી કરવામાં આવે છે. જેમ વિજ્ઞાન જડ પદાર્થોનો અભ્યાસ કરે છે તે જ રીતે અર્થશાસ્ત્ર માનવીના વર્તનનો, પેઢીનો, ઉદ્યોગનો વગેરેનો અભ્યાસ કરે છે. તેને અસર કરતાં પરિબળોને ચકાસે છે.

(ii) અર્થશાસ્ત્ર કલા છે :-

અર્થશાસ્ત્ર એક સામાજિકશાસ્ત્ર કે વિજ્ઞાન છે સાથે સાથે અર્થશાસ્ત્ર એક કલા પણ છે. આદર્શલક્ષી કે વાસ્તવલક્ષી વિજ્ઞાનમાં શું હોવું જોઈએ ? તે સમજાવવામાં આવે છે. જ્યારે આર્થિક નીતિઓ કે વ્યૂહરચનાના અમલની બાબતમાં અર્થશાસ્ત્ર કલા છે.

(iii) અર્થશાસ્ત્ર આદર્શલક્ષી વિજ્ઞાન છે :-

આદર્શલક્ષી વિજ્ઞાન તરીકે અર્થશાસ્ત્ર માનવીનાં આર્થિક વર્તનો અને તેના દ્વારા મહત્તમ સંતોષ કે કલ્યાણ અંગેનો અભ્યાસ કરે છે. આદર્શલક્ષી વિજ્ઞાન એક પ્રકારનું ધ્યેયલક્ષી વિજ્ઞાન છે. જેમાં આર્થિક ધ્યેયો અને તે ધ્યેયોને પ્રાપ્ત કરવા માટેની નીતિઓનો સમાવેશ થાય છે. અર્થતંત્રમાં કયા પ્રકારની નીતિ અપનાવવી, નીતિની ગરીબ અને ધનિક વર્ગ પર શું અસરો કરશે ? ગરીબોનાં કલ્યાણને ધ્યાનમાં રાખી આવકની વહેંચણી કેવી રીતે કરવી વગેરે બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે.

(iv) અર્થશાસ્ત્ર વાસ્તવલક્ષી વિજ્ઞાન છે :-

અર્થશાસ્ત્ર આર્થિક એકમો અને તેમની વચ્ચેનાં અંતર સંબંધોનો અભ્યાસ કરે છે અને ભાવે આગાહી માટે સહાયરૂપ થાય તેવા મોદેલની રચના કરે છે. વાસ્તવલક્ષી અર્થશાસ્ત્ર હકીકતોનું નિરીક્ષણ અને પૃથ્યકરણ કરે છે તેમજ કોઈ એક ધારણાના નૈતિક ફલિતાર્થો કે સાધ્યો પ્રત્યે તટસ્થ રહે છે. જેમાં સારા નરસાં પરિણામો સાથે કોઈ સંબંધ દર્શાવવામાં આવતો નથી.

(v) ધંધાકીય અર્થશાસ્ત્રમાં સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો પણ ઉપયોગ કરવામાં આવે છે :-

અર્થતંત્રમાં વેપારચકો, રાખ્યીય આવકની ગણતરી, વિદેશ વેપાર, રાજ્યના કરવેરા, ઇજારાશાહી જેવાં બાબુ પરિબળો પર પેઢીનો અંકુશ હોતો નથી. આવા પરિબળો સાથે સમાયોજન સાધવા માટે નિયોજકોને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું જ્ઞાન જેમ વધુ તેમ ધંધાકીય ક્ષેત્રે વધુ સફળતા પ્રાપ્ત કરી શકે છે.

---

#### 1.4 ઉત્પાદનનાં સાધનો :-

● ઉત્પાદનનો અર્થ :-

માનવ જરૂરિયાતોને પહોંચી વળવા માનવસર્જિત તેમજ કુદરતી રીતે પ્રાપ્ત મય્યાદિત સાધનોનો એવી રીતે ઉપયોગ કરવામાં આવે છે જેથી લોકોની જરૂરિયાતો સંતોષી શકાય છે. આવા મય્યાદિત સાધનો દ્વારા ચીજવસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. ઉત્પાદનનો અર્થ સમજવામાં નીચેની બાબતો મહત્વની છે.

(i) પદાર્થનું રૂપાંતર :-

સામાન્ય રીતે “ઉત્પાદન એટલે કોઈ નવી સ્થૂળ વસ્તુ કે પદાર્થનું સર્જન” પરંતુ મોટા ભાગની વસ્તુઓનું માનવી પોતે સર્જન કરી શકતો નથી. પરંતુ તેનું રૂપાંતર કરે છે. જેમકે, કુંભાર માટીમાંથી માટલું, કોડિયું કે રસોઈનાં વાસણ બનાવે છે તો માટીનાં રૂપમાં બદલાવ કરવાથી તેનો તુલ્લીગુણ પણ બદલાય છે. આમ; અહીં ઉત્પાદન એટલે સ્વરૂપ તુલ્લીગુણનું સર્જન તેવો અર્થ થાય.

(ii) પદાર્થનું સ્થળાંતર :-

વસ્તુ કે પદાર્થનું સ્થળાંતર કરવામાં આવે તો પણ તેનું મહત્વ બદલાય છે. જેમ ખેતરમાં અનાજ પકવવામાં આવે છે તે અનાજ અન્ય શહેરમાં જઈ વેચવામાં આવે તો અનાજનો તુલ્લીગુણ તેના ખેતર કરતાં શહરેમાં જરૂરિયાત વાળા લોકો પાસે અનાજ પહોંચાડવાથી તુલ્લીગુણ વધારે એટલે કે છતવાળી જગ્યાએથી અછતવાળી જગ્યાએ વસ્તુઓ લઈ જવાથી વસ્તુમાં ઉમેરાતો તુલ્લીગુણ સ્થળ તુલ્લીગુણ છે. આમ, ઉત્પાદન એટલે સ્થળ તુલ્લીગુણનું સર્જન.

(iii) પદાર્થનું સમયાંતર :-

કોઈપણ વસ્તુને બનાવવાની શરૂઆતથી બજારમાં વેચાણ કરવા સુધીનો સમય લાગતો હોય છે. તદુપરાંત ઉત્પાદિત વસ્તુને જરૂરિયાતની સમય પહેલાં ઉત્પાદિત કરી તેને સાચવી રાખવામાં આવે છે. અને જ્યારે જરૂર પડે ત્યારે બજારમાં વેચીને નફો કમાવાય છે. દા.ત. ઉનનાં સ્વેટર કે શાલ કે અન્ય ગરમ કપડાંઓનું ઉત્પાદન કરનાર ઉનમાંથી તે વસ્તુઓ બનાવે ત્યારે શહરેમાં વેપારીઓ શિયાળાની સિઝન ન હોય તો પણ ઓછા આવે ખરીદી કરી તેનો જથ્થો સાચવી રાખે છે અને શિયાળામાં તેનું વેચાણ કરે છે. આ પણ એક જાતની ઉત્પાદન પ્રક્રિયા છે અને તેને સમય તુલ્લીગુણ કહેવામાં આવે છે.

(iv) આર્થિક ચીજોનું ઉત્પાદન :-

વસ્તુનું સ્વરૂપ કે સ્થળ કે સમય બદલાવાની કિયા બધાં જ સંજોગોમાં ઉત્પાદન નથી ગણાતી જે વસ્તુની છત હોય તેવી વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તો તેને અર્થશાસ્ત્રની ભાષામાં ઉત્પાદન ન કહેવાય. પરંતુ જેની અછત હોય જેનું વપરાશ મૂલ્ય હોય, જેને પ્રામ કરવા માટે આર્થિક પ્રવૃત્તિ કરવી પડતી હોય, જેનું વિનિમય મૂલ્ય હોય એટલે કે તે વસ્તુને પ્રામ કરવા ખર્ચ કરવો પડતો હોય તેને ઉત્પાદન કહે છે.

(v) આર્થિક ઉદ્દેશ મહત્વનો :-

ઉત્પાદક દ્વારા જે વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે, તે હંમેશા ઉત્પાદન ન કહેવાય. એટલે કે માત્ર સેવાની ભાવનાથી ઉત્પાદન કરવામાં આવે તો તે ઉત્પાદન ન કહેવાય.

પરંતુ જેની પાછળ આર્થિક કમાણીની ભાવના કે હેતુ હોય તેને જ ઉત્પાદન કહેવાય.

જેમકે, ડૉક્ટર કોઈ દર્દને તપાસવાની ફી ન લે તો તે ઉત્પાદન ન કહેવાય, પણ જો એ ફી વસૂલે તો તે ઉત્પાદન કહેવાય. આમ, જે પ્રવૃત્તિ આર્થિક હેતુ વાળી હોય તે જ ઉત્પાદન સાથે સંબંધ ધરાવે છે.

#### (vi) સમાજની કુલ કલ્યાણમાં વધારો :-

જેના દ્વારા લોકોનાં કલ્યાણમાં વધારો થાય તેને ઉત્પાદન કહેવાય. જેમકે; જ્યારે રસાયણિક ફેક્ટરીઓ ઉત્પાદનક્રિયા દરમ્યાન જેરી રસાયણવાળું પાણી નદી કે તળાવમાં નિકાલ કરે છે ત્યારે ફેક્ટરીના માલિકને તો ઉત્પાદિત વસ્તુનાં વેચાણથી નફો પ્રામ થાય છે. પરંતુ નદી કે તળાવનું પ્રદૂષિત પાણી વાપરવાથી લોકોનાં સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે. એટલે કે તેમાં અન્ય લોકોનું કલ્યાણ વધતું નથી. આથી અહીં નિયોજકો કે ઉત્પાદકો દ્વારા થયેલ ઉત્પાદન કે ઉત્પાદકીય ન કહેવાય.

ટૂંકમાં “ઉત્પાદન એટલે આર્થિક ઉકેશથી આર્થિક વસ્તુ કે સેવાઓનું રૂપાંતર, સ્થળાંતર અને સમયાંતર કે જેના લીધે સમાજની કુલ સુખાકારીમાં વધારો થાય”

#### ● ઉત્પાદનનાં સાધનો :-

જે સાધનો ઉત્પાદન કાર્યમાં સહાયરૂપ થાય છે તેવા સાધનોને ઉત્પાદનનાં સાધનો કહે છે. અર્થશાસ્ત્રમાં ઉત્પાદનને કુલ ચાર સાધનોમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. (1) જમીન (2) મૂડી (3) શ્રમ (4) નિયોજન શક્તિ.

જમીન અને શ્રમ પ્રાથમિક સાધનો છે. જમીન કુદરતી રીતે પ્રામ થયેલ છે. જ્યારે શ્રમ માનવ શ્રમ છે. આમ; કુદરત અને માનવનાં સહયોગથી ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે. શરૂઆતમાં જમીન અને શ્રમ આ બે સાધનો વડે જ ઉત્પાદન થતું. જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ માનવીએ પોતાના શ્રમ વડે વસ્તુઓની સાથે સાથે મૂડી સાધનો પણ બનાવવાનું શરૂ કર્યું. અને આ રીતે ઉત્પાદનમાં મૂડીનો પ્રવેશ થયો. મૂડી એ માનવ સર્જિત સાધન છે. વર્તમાન આધુનિક યુગમાં ઉત્પાદનનું ચોથું મહત્વનું સાધન છે નિયોજન શક્તિ. ઉત્પાદનનાં સાધનો જમીન, મૂડી અને શ્રમ આ ત્રણ સાધનોનું સંકલન કરી ઉત્પાદનમાં વ્યવસ્થિતતા લાવવાનું કામ નિયોજકર્યું છે.

ઉપરોક્ત ચારેય સાધનોને આપણે વિગતવાર સમજીએ.

#### 1) જમીન :-

અર્થ :- સામાન્ય રીતે આપણે પૃથ્વીની સપાઠી, જેના પર મકાનો બાંધવામાં આવે છે, કે ખેતરો કે ફેક્ટરીઓ જેના પર હોય તેને જમીન કહીએ છીએ. પરંતુ અર્થશાસ્ત્રની ભાષામાં જમીનનો અર્થ જુદો “ આવકનું સર્જન કરવા માટે અંકુશમાં આવી શકે અને ઉપયોગમાં લઈ શકાતી કુદરતી સંપત્તિને જમીન કહે છે.”

એટલે કે પૃથ્વીની સપાઠીની ઉપર તેમજ નીચે આવેલ નદીઓ, તળાવો, જંગલો, પર્વતો, રણ, ખેતરો, કોલસો, ઘનીજ, ગેસ, પાણી આ તમામ જમીન છે. સૂર્ય પ્રકાશ, હવા વગેરે કુદરતી સંપત્તિ છે પરંતુ માનવનો તેના પર અંકુશ હોતો નથી. આથી કહી શકાય કે ઉત્પાદન કાર્યમાં લઈ શકાતી સમગ્ર કુદરતી સંપત્તિ જમીન છે.

### ● જમીનનાં લક્ષણો :-

#### 1. કુદરતી બાધાઓ :-

જમીન કુદરત દ્વારા માનવીને મળેલી કુદરતી બાધાઓ છે. જેનાં સર્જન માટે મનુષ્યે કોઈ ખર્ચ કરવો પડતો નથી. જેમકે, અનાજ પકવવા ખેતરનું ઉત્પાદન કરવું પડતું નથી, કે તેના માટે કોઈ ખર્ચ કરવું પડતું નથી. ખેતર કુદરતી રીતે પ્રાપ્ત છે. જ્યારે અનાજ ઉત્પાદન કરી શકાય તેવી જમીન શોધવાનું કામ મનુષ્યનું છે.

#### 2. અંકુશમાં આવી શકે તેવી સંપત્તિ :-

બધી જ કુદરતી સંપત્તિ જમીન નથી. પરંતુ જે કુદરતી સંપત્તિ માનવીનાં અંકુશમાં આવી શકે જેને માનવી પોતાની જરૂરિયાત મુજબ ઉપયોગમાં લઈ શકે તે જમીન છે.

#### 3. સ્થિર પુરવઠો :-

જમીન કુદરતી સંપત્તિ છે, આથી માનવી વધુ ઉત્પાદન કરવા માટે જમીનનું પ્રમાણ વધારી શકતો નથી. જેટલી પ્રાપ્ત જમીન છે તેનો જ વિવેકપૂર્વક ઉપયોગ કરી ઉત્પાદન કરે છે.

#### 4. અગતિશીલ સાધન :-

મૂડી સાધનો, વસ્તુઓ, યંત્રો વગેરેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે એટલે કે ગતિશીલ છે. પરંતુ જમીનને કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાતી નથી. એટલે કે અગતિશીલ છે. જો કે; તેનો એક ઉપયોગનાં બદલે બીજો ઉપયોગ કરી શકાય છે.

#### 5. વિવિધતા :-

જમીન દરેક પ્રદેશમાં કે અલગ અલગ જગ્યાએ જુદા જુદા પ્રકારની છે. ક્યાંક ફળજ્વર્પ જમીન, ક્યાંક રણ વિસ્તાર, પર્વતાળ વિસ્તાર જોવા મળે છે. કેટલીક જમીન સ્થાનની રીતે ખૂબ મહત્વની હોય છે.

#### 6. ઘટતી ઉત્પાદકતા :-

જમીનની જેમ જેમ વપરાશ થાય તેમ તેમ તેની યોગ્ય સંભાળ રાખવામાં ન આવે તો ફળજ્વર્પતા ઘટે છે. જેથી ઉત્પાદન પણ ઘટતું જાય છે.

- જમીનનું મહત્વ :-

- (1) લોકોનું અસ્તિત્વ : માનવીની પ્રાથમિક જરૂરીયાતો રોટી, કપડાં અને મકાન તેમજ રોજિંદા વ્યવહારો માટે જમીન ખૂબજ મહત્વની છે.
- (2) ખેતીની પ્રગતિ : જમીન વગર ખેતી અશક્ય છે. અનાજ - પાણીની જરૂરીયાતો પૂર્ણ કરવાં, તેનું ઉત્પાદન કરવા જમીન ખૂબજ મહત્વની છે.
- (3) ઔદ્યોગિક વિકાસ : ઉદ્યોગોમાં ખેત ઉત્પાદક વસ્તુઓ, બળતણ - ઈંધણ, ઘનીજ પદાર્થો, કાચો માલ વગેરે જેવી જરૂરી વસ્તુઓ જમીનમાંથી જ પ્રાપ્ત થાય છે.
- (4) વાહનોનો આધાર : બસ, ટ્રેન, કાર વગેરે જેવા વાહનો જો રસ્તા ન હોય તો કઈ રીતે ચાલી શકે? જમીન હોય તો જ રસ્તા હોય. તો જ વાહનો ચાલી શકે.

- (2) મૂડી :-

- અર્થ :-

સામાન્ય રીતે આપણે ધરેણાં, ઝવેરાત, મિલકત, મકાન વગેરેને મૂડી તરીકે ઓળખીએ છીએ.

પરંતુ અર્થશાસ્ત્રમાં “ મૂડી એટલે માનવીએ કુદરતી સાધનોનો ઉપયોગ કરીને બનાવેલી કોઈપણ વસ્તુ, જે બીજી વસ્તુઓનાં ઉત્પાદનમાં સહાયરૂપ થાય ”

મૂડી એ માનવસર્જિત સાધન છે. અને ઉત્પાદન કાર્યમાં ઉપયોગી છે. એટલે કે જે માનવસર્જિત ન હોય તેમજ ઉત્પાદકાર્યમાં ઉપયોગી ન હોય તો તેને મૂડી ન કહેવાય. જેમકે; આપણે બેંકમાં ધરેણાં, પૈસા અને મૂકી રાખ્યાં હોય, મકાન બનાવી ખાલી મૂકી રાખ્યું હોય તો તેને મૂડી ન કહેવાય.

એટલે કે જેનું રૂપાંતર તૈયાર માલ કરવામાં સહાયરૂપ સાધનો કોલસો, ઘનીજ, બળતણ, ઈંધણ, યંત્ર સામગ્રી વગેરે મૂડી કહેવાય.

- મૂડીનાં લક્ષણો :-

1. માનવ સર્જિત : મૂડી એ કુદરત અને માનવ શ્રમનાં સંયોજન અને પ્રયત્નોથી સર્જિત સાધન છે.
2. ઉત્પાદન માટે ઉપયોગ : માનવસર્જિત તમામ વસ્તુઓ મૂડી ન કહેવાય. પરંતુ જે વસ્તુનો કે યંત્રોનો કે સાધનનો ઉપયોગ ઉત્પાદન ક્ષેત્રમાં થતો હોય તેને જ મૂડી કહેવાય.
3. ગતિશીલ : મૂડી સાધનો જેવા કે વાહનો, યંત્રો વગેરે એક સ્થળોથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે. એટલે કે મૂડી જમીનની જેમ અગતિશીલ નથી. મૂડી ગતિશીલ સાધન છે. કેટલીક મૂડી અગતિશીલ હોય છે જેમકે; ફેક્ટરી, મિલ વગેરે.
4. ત્યાગ કે બચતનું પરિણામ : મૂડીનો આધાર બચત ઉપર છે. એટલે કે મૂડી સર્જન માટે બચત જરૂરી છે. બચત એ ત્યાગનું પરિણામ છે. જો વ્યક્તિ વધુ કામ કરી વધુ બચત કરે તો મૂડી દ્વારા અનેકગણું ઉત્પાદન પ્રાપ્ત કરી શકે છે.

5. કિયાશીલ બચતા : બધી જ બચતો મૂડી ન ગણી શકાય. જે બચતો ઉત્પાદન કાર્યમાં વપરાશમાં લેવાય તેવી બચતોને જ મૂડી કહી શકાય. જેમકે; ખેડૂત દ્વારા અનાજ ઉત્પાદન કરવામાં આવે અને તે સ્વવપરાશ માટે જ રાખી મૂકે તો તે મૂડી ન કહેવાય. પરંતુ તેનો ઉપયોગ વધારાના અનાજનાં ઉત્પાદન માટે કરે તો તેને મૂડી કહી શકાય.
6. વાસ્તવિક થાપણા : રોકડનાણું મૂડી નથી પણ યંત્રો, વાહનો વગેરે મૂડી છે. જે પેસા ઉત્પાદનના ઉપયોગમાં લેવામાં આવે તો તેને મૂડી કહે છે. પેસા વડે વાસ્તવિક થાપણો મેળવવામાં આવે તે મૂડી છે. જેમકે; પેસા દ્વારા યંત્રો, ઓજારો વગેરે ખરીદવામાં આવે તો એ રીતે પેસા મૂડી છે.
7. ઉત્પાદન માટે મદદરૂપ : મૂડી અનેકગણા ઉત્પાદન માટે મદદરૂપ થાય છે. કોઈ એક વ્યક્તિ દ્વારા ઉત્પાદન કરવામાં આવે તો ઉત્પાદન ઓછું થાય પરંતુ જો વ્યક્તિ યંત્ર વડે ઉત્પાદન કરે તો ઓછા સમયમાં ઝડપથી વધુ ઉત્પાદન કરી શકે છે.

#### ● મૂડીનું મહત્વ :-

##### 1. મૂડીનું વધતું મહત્વ :-

મનુષ્ય જીવનની શરૂઆતથી જ મૂડી મનુષ્ય માટે મદદરૂપ થતી આવી છે. જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ ઉત્પાદનક્ષેત્રો મૂડીનું સ્થાન ખૂબજ આગળ પડતું વધી ગયું છે. આજે ઉદ્યોગ ક્ષેત્રો, ખેતીક્ષેત્રો મૂડી સાધનો દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે.

##### 2. વિકાસની ચાવી :-

કોઈ પણ દેશનો વિકાસ ત્યારે જ શક્ય બને જ્યારે તે દેશમાં ઉદ્યોગોનો વિકાસ થયો હોય. જેના માટે મૂડી આવશ્યક છે. દેશની વસ્તીની જરૂરિયાતો પૂરી કરવા માનવશ્રમ કરતાં મૂડી સાધનો દ્વારા ઉત્પાદન કરવું જરૂરી છે. આજે આપણો જોઈએ છીએ કે વિશ્વમાં મૂડી પ્રધાન દેશો જ વિકસિત દેશો છે. એટલે કે જ્યાં મૂડીનો ઉત્પાદનક્ષેત્રો વધુ ઉપયોગ કરવામાં આવે છે ત્યાં વિકાસ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. આમ, મૂડી એ વિકાસની ચાવી છે.

##### 3. શ્રમ

###### ● અર્થ :-

સામાન્ય રીતે આપણે કામ કરવાથી લાગતા થાક ને શ્રમ કહીએ છીએ. પણ અર્થશાસ્ત્રની ભાખામાં “કોઈની દેખરેખ હેઠળ વસ્તુ કે આર્થિક લાભના બદલાની અપેક્ષાથી કરવામાં આવેલો શારીરિક કે માનસિક પ્રયત્ન એટલે શ્રમ અને જે શ્રમ કરે છે તેને શ્રમિક કહેવામાં આવે છે.”

દા.ત. કોઈ ઓફીસમાં કામ કરતાં કર્મચારી, મિલ મજૂરો, જુદા જુદા ક્ષેત્રોમાં કામ કરતાં કારીગરો કે મજૂરો એ શ્રમિક છે. જેઓને તેમનાં શ્રમનાં બદલામાં પગાર કે વેતન મળે છે. પરંતુ સ્વતંત્ર રીતે કામ કરતાં જેવા કે ડોક્ટર, એન્જિનિયર, વકીલ વગેરે તેઓનાં શ્રમ બદલ વળતર પ્રામ કરે છે. પરંતુ તેઓ શ્રમિક નથી, તેઓ નિયોજક છે.

આમ, પેસાની કે વેતનની અપેક્ષા રાખી કામ કરે તેને શ્રમ કરે છે તેમ કહેવાય.

- શ્રમનાં લક્ષણો :-

1. સળવ :-

જમીન અને મૂડી નિર્જવ છે. જ્યારે શ્રમ એ ઉત્પાદનનું સળવ સાધન છે. માલિકનું વર્તન, કામનાં સંઝોગો, કામનાં પ્રકાર, મજુરને મળતી સગવડ વગેરે શ્રમની ઉત્પાદકતાને અસર કરે છે શ્રમિક ઉત્પાદક પણ છે અને ગ્રાહક પણ છે.

2. શ્રમ અને શ્રમિક અવિભાજ્ય :-

જમીન કે મૂડીને તેના માલિકથી જુદા પાડી શકાય છે, પરંતુ શ્રમને શ્રમિકથી જુદો પાડી શકતો નથી. શ્રમના માલિકની હાજરી વગર શ્રમ કરી શકતો નથી. શ્રમનો માલિક શ્રમને સાથે લઈ ફરી શકે છે.

3. અત્યંત નાશવંત :-

શ્રમ નાશવંત છે એટલે કે વ્યક્તિ કામ ન કરે તો શ્રમનો સંગ્રહ કરી શકતો નથી. આજનો શ્રમ આવતીકાલ માટે સંગ્રહી શકતો નથી. કામ વિના ગયેલો સમય પાછો આવતો નથી. શ્રમનો સંગ્રહ થઈ શકતો ન હોવાથી શ્રમની સોદાશક્તિ નીચી હોય છે. આપેલા વેતનદરે શ્રમ પ્રામ હોવાથી શ્રમિકો, વધુ વેતન મેળવવામાં સફળ થતાં નથી.

4. ગતિશીલતા ઓછી :-

શ્રમ જીવંત સાધન છે. તે અન્ય સ્થળે, અન્ય વાતાવરણમાં જલ્દીથી કામ કરવા જવા તૈયાર થતો નથી એટલે કે યંત્રોની જેમ શ્રમ સંપૂર્ણ ગતિશીલ નથી પણ ઓછો ગતિશીલ છે.

5. ઉત્પાદકતામાં વિભિન્નતા :-

શ્રમનાં દરેક એકમોની ઉત્પાદકતા જુદી જુદી હોય છે એટલે કે જુદા જુદા શ્રમિકોની કામ કરવાની શારીરિક – માનસિક ક્ષમતા જુદી જુદી હોય છે. આથી તેઓની ઉત્પાદકતા પણ જુદી જુદી હોય છે કોઈ વધુ ઉત્પાદન કરી શકે છે તો કોઈ ઓછું ઉત્પાદન કરી શકે છે.

6. ઉત્પાદકતામાં ફેરફાર ક્ષમતા :-

શ્રમિકોની ઉત્પાદકતા હંમેશા સ્થિર રહેતી નથી. તેમાં ફેરફાર થતો રહે છે. જો વ્યક્તિની ઉત્પાદકતા ઓછી હોય તો શિક્ષણ, તાલીમ, સહાયક સાધનો વગેરેની મદદથી તે ઉત્પાદકતા વધારી શકે છે.

7. શ્રમનાં પુરવઠામાં ફેરફાર ક્ષમતા :-

શ્રમનો પુરવઠો પણ વસ્તી, વેતનદર, કાર્ય કરવાની ઈચ્છા, કામ કરવાની શક્તિ સાથે બદલાય છે. જો વસ્તીમાં વધારો થાય કે કિંમતમાં વધારો થાય તો શ્રમનો પુરવઠો વધે છે જો વેતનદર વધે તો કામ કરનાર શ્રમિકો કામનાં કલાકો વધારે છે, આથી શ્રમનો પુરવઠો વધે છે.

### ● શ્રમનું મહત્વ :-

કોઈ પણ દેશમાં વિપુલ પ્રમાણમાં કુદરતી સંપત્તિ કે મૂડી સાધનો હોય પરંતુ તેનો ઉપયોગ કરી ઉત્પાદન કરવા માટે શ્રમ મહત્વનો છે. કોઈપણ દેશમાં જો વસ્તી અભિજા, નિર્બળ, આણસુ, પ્રમાણી હોય તો તે દેશોમાં વિકાસ થઈ શકતો નથી. શિક્ષિત અને કાર્યશીલ વસ્તી દેશ માટે મૂડી સમાન છે. આથી, પ્રા. ટી. ડાલ્ટોન શુલ્લાજ કહે છે કે, “ જો માનવ સમાજોની અતિ મૂલ્યવાન મૂડી હોય તો તે માનવ મૂડી છે.”

### (4) નિયોજન શક્તિ :-

અર્થ:-

“ નિયોજક એટલે અનિશ્ચિતતાઓ ઉઠાવનાર ” ઉત્પાદનનાં અન્ય ગ્રાશ સાધનો જમીન, મૂડી અને શ્રમ ઉત્પાદન ક્ષેત્રે જેટલા મહત્વનાં છે તેટલું જ મહત્વ નિયોજન શક્તિ ધરાવનાર નિયોજક ન હોય તો બહું જ નકામું છે.

### ● નિયોજકનાં લક્ષ્ણો :-

#### (1) નિયોજક માત્ર સાધન સંયોજક નથી :-

નિયોજન શક્તિ સિવાયનાં ઉત્પાદનનાં અન્ય ગ્રાશ સાધનોની માલિકી જુદા જુદા લોકો પાસે હોય છે તેમજ તેઓ અલગ અલગ જગ્યાએ હોય છે. આ ગ્રાણેયને ભેગા કરવાનું, યોગ્ય સમયે સ્થાને, યોગ્ય પ્રમાણમાં યોગ્ય વળતર આપવું, તેમના કામ પર દેખરેખ રાખવી, તેઓ દ્વારા ઉત્પાદિત તૈયાર વસ્તુઓને યોગ્ય ભાવે બજારમાં વેચવી વગેરે તમામ કાર્યોનિયોજક કરે છે.

#### (2) નિયોજક માત્ર વ્યવસ્થાપક નથી :-

નિયોજક એ વ્યવસ્થાપક નથી. ઉત્પાદન કાર્યમાં જેઓ પગારથી વ્યવસ્થાપક તરીકે કામગીરી કરે છે તેને શ્રમિક કહેવામાં આવે છે. નિયોજક તેના ઉદ્ઘોગમાં પત્ર વ્યવહાર, દિસાબ કિતાબ, ખરીદ વેચાણ વગેરેમાં તેના નિર્ણય મુજબ પગારદાર વ્યવસ્થાપકો પાસે કાર્ય કરાવે છે.

#### (3) નિયોજક માત્ર મૂડીદાર નથી :-

નિયોજક માત્ર મૂડીદાર નથી. નિયોજક ઉદ્ઘીના વ્યાજે મૂડી લઈને કે પોતાની મૂડી વડે ધંધો કરે છે. મૂડીદાર અને નિયોજક વચ્ચે તફાવત છે. નિયોજકની આવક અનિશ્ચિત હોય છે જ્યારે મૂડીદારની આવક વ્યાજ નિશ્ચિત હોય છે.

#### (4) નિયોજક માત્ર સાહસિક નથી :-

નિયોજક જોખમો અને અનિશ્ચિતતાઓ ઉઠાવે છે. તે ધંધામાં ખોટ કે નફો ભોગવે છે. કેટલાક વીમા પાત્ર જોખમો આગ, અક્સમાત, ચોરી વગેરે જોખમો ઉઠાવે જેમાં તે વીમાના પ્રિમિયમ ભરી વીમાનાં પ્રિમિયમ જેટલા ભાવ વધારી નિયોજક તેના બોજામાંથી મુક્ત થઈ જાય છે.

## ● નિયોજન શક્તિનું મહત્વ :-

### 1. આર્થિક વિકાસ :-

કોઈપણ દેશનાં વિકાસનો આધાર પેઢીઓની સંખ્યા અને પ્રકાર પર હોય છે. દેશમાં ઉત્પાદનનાં સાધનો ઘણાં ઉપલબ્ધ હોય પરંતુ પેઢી કક્ષાએ આ સાધનોનું સંયોજન કરનાર નિયોજક જરૂરી છે. જો લોકો માત્ર સ્વવપરાશ માટે જ ઉત્પાદન કરે તો દેશનો આર્થિક વિકાસ થઈ ન શકે પરંતુ જરૂરિયાત ઉપરાંત વધુ ઉત્પાદન કરી બજારમાં વેચાણ કરે તો દેશનો આર્થિક વિકાસ શક્ય બને છે. જેના માટે નિયોજક જરૂરી છે. જે દેશમાં નિયોજકની સંખ્યા વધુ તેમ દેશનાં વિકાસની પ્રક્રિયા વધુ ઝડપી બને છે. આથી નિયોજન શક્તિને દેશનાં આર્થિક વિકાસની ચાવીરૂપ સાધન કહેવામાં આવે છે.

### 2. ગતિશીલતા :-

નિયોજકો સ્થિર અર્થતંત્રમાં ગતિશીલતા લાવે છે. નિયોજકો વચ્ચે પોતાની વસ્તુનું ઉત્પાદન અને વેચાણમાં હરીફાઈ થાય છે. નિયોજકોનો મુખ્ય હેતુ નફો કમાવાનો હોય છે. આથી તે હંમેશા પ્રયત્નશીલ હોય છે. આથી અર્થકારણમાં ગતિશીલતા આવે છે.

### 3. જુદા જુદા કોનો વિકાસ :-

નિયોજકોનો મુખ્ય હેતુ નફાનો હોવાથી તે એવી વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરશે જેની બજારમાં માંગ વધુ હોય, જે વસ્તુનાં ઉત્પાદનમાં ઓછી હરીફાઈ હોય. આથી અર્થતંત્રમાં જુદાજુદા ઉદ્યોગો અને આર્થિક પ્રવૃત્તિઓની શરૂઆત થાય છે અને વિકાસ થાય છે.

### 4. વિવિધ વસ્તુઓની પ્રાપ્તિ :-

નિયોજકો વધુમાં વધુ નફો પ્રાપ્ત કરવા માટે નવી નવી વસ્તુઓની શોધ કરે છે. લોકોને વધુ સંતોષ આપે તેવી ચીજ વસ્તુઓ શોધનારને વધુ નફો મળવાથી સંશોધનને વેગ મળે છે. અને લોકોને વિવિધ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે.

### 5. સસ્તી વસ્તુઓની પ્રાપ્તિ :-

નિયોજકો બજારમાં હરીફાઈમાં ટકી રહેવા માટે પોતાની વસ્તુનાં ભાવ વધારી શકતાં નથી. આથી ઉત્પાદન ખર્ચ ઘટાડવા ઓછી ખર્ચાળ, કાર્યક્રમ ઉત્પાદન પધ્યતિ, નવો સસ્તો સારો માલ, વધુ ઉત્પાદન અને ઓછા ખર્ચાળ ઉત્પાદનનાં સાધનોની શોધ કરે છે. આથી લોકોને સસ્તી વસ્તુ પ્રાપ્ત થાય છે.

### 6. ગ્રાહકોની સેવા :-

નિયોજકોનો મુખ્ય હેતુ નફો કમાવાનો છે. તેઓ માટે ગ્રાહક તેમનો રાજી છે, ભગવાન છે. તે હંમેશા પોતાના ગ્રાહકોને વિવિધ સેવા પૂરી પાડી ખુશ રાખી ને નફો વધારવા કોશિશ કરે છે. તદ્દુપરાંત જ્યાં ગ્રાહકો હોય ત્યાં જઈ પોતાનું બજાર વિસ્તારે છે. એ માટે મોટા પ્રમાણમાં ઓછા ઉત્પાદન ખર્ચે સસ્તી વસ્તુઓ ઉત્પાદિત કરી ગ્રાહકોને નવી, સસ્તી વસ્તુઓ પૂરી પાડે છે, નવા

ગ્રાહકો ઉભા કરી પ્રચાર કરી પોતાની વસ્તુ ખરીદવા માટે ગ્રાહકોને પ્રેરે છે અને વધુ વેચાણ કરી નફો કમાય છે.

### 1.5 અર્થતંત્રની મૂળભૂત સમસ્યાઓ :-

અર્થતંત્રમાં સમસ્યા ઉદ્ભવવાનું મુખ્ય કારણ અધ્યત છે. હવા, સૂર્યપ્રકાશ જેવી વસ્તુઓની છત હોવાથી તેને પ્રામ કરવા માટે કોઈ આર્થિક સમસ્યા ઉભી થતી નથી. પરંતુ જેની અધ્યત છે, જેમાં પસંદગીનાં પ્રશ્નો ઉભા થાય છે તેના ઉકેલ શોધી દેશની આર્થિક પ્રગતિ અંગે અંદાજ બાંધી શકાય છે. દરેક વ્યક્તિ સામે પસંદગીનો પ્રશ્ન ઉભો થાય છે. અને તેમાંથી મહત્તમ સંતોષ મેળવવા વિવિધ મૂળભૂત આર્થિક સમસ્યાઓને ઉકેલવી જરૂરી છે જે નીચે મુજબ છે.

#### 1. ઉત્પાદનનાં તમામ સાધનોને પૂર્ણ રોજગારી મળે છે :-

દેશમાં લોકોની અમયાદિત જરૂરિયાતોને સંતોષવાનાં સાધનો મયાદિત છે. આ મયાદિત સાધનોનો પૂર્ણ અને બુદ્ધિ પૂર્વકનો ઉપયોગ થવો જોઈએ. એટલે કે ઉત્પાદનનાં તમામ સાધનો સંપૂર્ણપણે રોજગારી કેન્દ્રો જોડાયેલા હોય. તેમ છતાં માનવશ્રમની બાબતમાં મૂડીવાદી અર્થ વ્યવસ્થામાં માનવશ્રમ બેકાર જોવા મળે છે. માનવશ્રમની બેકારીથી ઉત્પાદન ઘટે છે તેની સાથે સાથે તેનાં કુટુંબની પણ આવક ઘટે છે. અર્થતંત્રમાં મંદીની પરિસ્થિતિમાં પણ ઉત્પાદન સાધનોમાં બેકારી પ્રવર્તે છે. અર્થશાસ્ત્રનો મૂળભૂત ઉદ્દેશ આ સમસ્યા ઉકેલવાનો છે. બેકારીમાં ઉત્પાદનનાં સાધનો વેડફાતા અટકાવવા અને જાહેર કાર્ય કરી ઉત્પાદનનાં સાધનોનો મહત્તમ ઉપયોગ કરવો. મંદીની પરિસ્થિતિમાં સરકાર દ્વારા પૂર્ણ રોજગારીની સ્થાપના માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરી લોકોની આવક વધારી અસરકારક માંગમાં વધારો થાય તેવા પ્રયત્નો કરવામાં આવે તો અર્થતંત્રને મંદીમાં બહાર લાવી શકાય.

#### 2. કઈ વસ્તુનું ઉત્પાદન કરવું ? :-

અમયાદિત જરૂરિયાતોને મયાદિત સાધનો દ્વારા પૂર્ણ કરવી શક્ય નથી. આથી જુદી-જુદી અગત્યાનુક્રમ નક્કી કરવામાં આવે અને ત્યારબાદ સાધનોનો મહત્તમ ઉપયોગ કરવો પડે. એક વસ્તુનું ઉત્પાદન કરવા જતાં અન્ય વસ્તુ જતી કરવી પડે છે. માટે વસ્તુની જરૂરિયાતનાં પ્રમાણમાં અને ઉત્પાદનનાં સાધનોના પ્રમાણના અધારે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું ? તે નક્કી કરવામાં આવે છે.

#### 3. કેટલું ઉત્પાદન કરવું ? :-

કઈ વસ્તુનું ઉત્પાદન કરવું ? તે નક્કી થયા બાદ કેટલું ઉત્પાદન કરવું ? તે નક્કી કરવામાં આવે છે. બધારમાં કઈ વસ્તુની માંગ છે ? કેટલા પ્રમાણમાં વસ્તુની માંગ છે, તેનું કેટલું ઉત્પાદન ખર્ચ છે તેના આધારે વસ્તુના ઉત્પાદનનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે.

#### 4. કઈ પદ્ધતિથી ઉત્પાદન કરવું ? :-

કઈ કઈ વસ્તુનું, કેટલું ઉત્પાદન કરવું તે નક્કી કર્યા પછી તરત પ્રશ્ન આવે કે દરેક ચીજ કઈ પદ્ધતિથી ઉત્પાદન કરવું ? એટલે કે સાધન સંયોજન, મૂડી પ્રચૂર ઉત્પાદન પદ્ધતિ, શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ કઈ ઉત્પાદન પદ્ધતિ અપનાવવી તે નક્કી કરવામાં આવે છે. જો ઉત્પાદન કાર્યમાં શ્રમનો ઉપયોગ વધુ જરૂરી હોય તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ જેમ કે, ખેતીક્ષેત્રે ઉત્પાદન માટે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવામાં આવે છે. જો ઉત્પાદન કાર્યમાં યંત્રોનો ઉપયોગ વધુ થતો હોય તો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવામાં આવે છે. તદુપરાંત જ્યાં શ્રમ સસ્તો હોય ત્યાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિઓ અને જ્યાં મૂડી સસ્તી હોય ત્યાં મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે. આમ, ઉત્પાદન પદ્ધતિની પસંદગી સંજોગોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. સંશોધનો, સમય, સ્થળ બદલાય તેમ સાધન બજારના સંજોગો બદલાય છે એ તે રીતે ઉત્પાદન પદ્ધતિ પસંદ કરવામાં આવે છે.

#### 5. ઉત્પાદિત વસ્તુની વહેંચણી કઈ રીતે કરવી ? :-

ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થયા બાદ તેને સમાજનાં જુદા જુદા વર્ગો, સમૂહો કે સત્ત્યો વચ્ચે કઈ રીતે વહેંચણી કરવી ? એ એક અગત્યનો પ્રશ્ન છે. વહેંચણી કરવાની એક રીતે બજારની છે. બજારમાં જેની આવક વધુ છે તે વધુ ખરીદી કરે છે અને જેની આવક ઓછી છે તે ઓછી ખરીદી કરે છે. આવકની અસમાન વહેંચણી વસ્તુની અસમાન વહેંચણીમાં પરિવર્તિત થાય છે. વહેંચણીની બીજી પદ્ધતિ માપ બંધીની છે. જે પ્રમાણે સરકાર દ્વારા પ્રત્યેક નાગરિકને નક્કી કરેલા પ્રમાણમાં વસ્તુની વહેંચણી કરવામાં આવે છે. ઉત્પાદનની વહેંચણી, રાષ્ટ્રીય આવકની વહેંચણી બરાબર છે. માટે તેનો અભ્યાસ વહેંચણીનાં સિદ્ધાંતમાં પડા જોવા મળે છે. ઉત્પાદનનાં દરેક સાધન જમીનને ભાસું, શ્રમને વેતન, મૂડીને વ્યાજ અને નિયોજકોને નક્કો મળે છે.

#### 6. ઉત્પાદનનાં સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ :-

ઉત્પાદનનાં સાધનો મયારીદિત હોવાથી ઉત્પાદન પ્રક્રિયામાં તેનો ઉપયોગ કાર્યક્ષમતા પૂર્વક થવો જોઈએ. કઈ વસ્તુનું, કેટલું અને કઈ ઉત્પાદન પદ્ધતિથી ઉત્પાદન કરવું ? તેની વહેંચણી કેવી રીતે કરવી ? આ તમામ પ્રશ્નોનાં ઉકેલ પ્રામ કર્યા બાદ એ પ્રશ્ન આવે કે ઉત્પાદનનાં સાધનોનો ઉપયોગ કાર્યક્ષમ છે કે નહિ ? ઉત્પાદનની કાર્યક્ષમતા એટલે ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવામાં આવે કે જેમાં કોઈપણ ફેરફાર કરવામાં આવે તો ઉત્પાદનનું પ્રમાણ બદલાય છે. સાધનની ફાળવણીમાં ફેરફાર કરી અન્ય વસ્તુનું ઉત્પાદન ઘટાડ્યા વિના કોઈ એક વસ્તુનું ઉત્પાદન વધારવું શક્ય ન હોય તો ઉત્પાદન કાર્યક્ષમ કહેવાય. સમગ્ર ઉત્પાદનનાં સાધનોની કાર્યક્ષમતા એટલે રાષ્ટ્રીય ઉત્પાદનની એવી વહેંચણીમાં ફેરફાર કરવામાં આવે તો કુલ સંતોષ ઘટી જાય. વહેંચણીમાં ફેરફાર કરી અન્ય વ્યક્તિનાં સંતોષમાં ઘટાડો કર્યા સિવાય એક વ્યક્તિનાં સંતોષમાં વધારો કરવો શક્ય ન હોય તો તે વહેંચણી કાર્યક્ષમ કહેવાય.

## 7. ઉત્પાદન શક્તિ કઈ રીતે વધારવી ? :-

કોઈ પણ દેશમાં ટૂંકા ગાળામાં અછતનો સામનો કરકસર વડે તથા ન્યાયી વહેંચણી વડે કરવાનો હોય છે, લાંબાગાળે સમાજની સમગ્ર ઉત્પાદન શક્તિમાં વધારો કરી અછતનો સામનો કરવાનો હોય છે. દેશમાં ઉત્પાદન ક્ષમતા સતત વધવી એટલે કે દેશમાં ઉત્પાદનનાં સાધનોનું પ્રમાણ સતત વધતું રહેવું જોઈએ. તેમજ ટેકનોલોજીકલ પરિવર્તનનો દ્વારા ઉત્પાદનનાં સાધનોની ઉત્પાદન ક્ષમતામાં સુધારા વધારા થવા જોઈએ. દેશનાં ઉત્પાદનનાં સાધનોની ઉત્પાદકતા જેમ વધે તેમ વસ્તુઓ અને સેવાઓનું પણ ઉત્પાદન વધે છે. કેમ કે જેમ વસ્તી વધે, આવક વધે તેમ બયતો વધે, બયતોનું મૂડી રોકાણ થતાં સાધનોનું પ્રમાણ વધે, ઉત્પાદકતા વધે અને બેકારી દૂર થાય. લોકોનું જીવનધોરણ ઊંચું જાય છે, જીવનધોરણમાં વિવિધતા આવે છે. જેથી લોકોના સંતોષની સપાઠી ઊંચી જાય છે. આમ, આર્થિક વિકાસ દ્વારા ઉત્પાદનનાં સાધનોની અછત ઘટાડવામાં આવે છે. અર્થતંત્ર સતત પરિવર્તનશીલ હોવું જોઈએ. બદલાતી પરિસ્થિતિઓને અનુકૂળ થવાની એનામાં ક્ષમતા હોવી જોઈએ. આમ દેશનાં ઉત્પાદનનાં સાધનોની ઉત્પાદન ક્ષમતા સતત વધતી રહે છે.

### ● ઉત્પાદન શક્યતા વક :-

મૂળભૂત આર્થિક સમસ્યાઓની આફૂતિમાં રજૂઆત ઉત્પાદન શક્યતા વક દ્વારા કરવામાં આવે છે. ઉત્પાદન શક્યતા વકને રૂપાંતર રેખા પણ કહેવામાં આવે છે.

---

### 1.6 ઉત્પાદન શક્યતા વક :-

અર્થ :- “ જ્યારે ઉત્પાદનનાં સાધનોનું પ્રમાણ તેમની ઉત્પાદકતા અને ઉત્પાદન પદ્ધતિ સ્થિર હોય તારે કોઈપણ બે વસ્તુઓનાં કયાંકયાં સંયોજનોનું ઉત્પાદન શક્ય છે અને કયા સંયોજનોનું ઉત્પાદન અશક્ય છે તે દર્શાવતી રેખાને ઉત્પાદન શક્યતા રેખા કે ઉત્પાદન શક્યતા વક કહે છે.”

### ● ઉત્પાદન શક્યતા વકની ધારણા :-


1. ઉત્પાદનનાં તમામ સાધનો ઉત્પાદન કાર્યમાં જોડાયેલા છે અને અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તમાન છે.
2. સાધનોનો પુરવઠો સ્થિર છે તેમજ સાધનને એક ઉદ્યોગમાંથી અન્ય ઉદ્યોગમાં લઈ જઈ ઉત્પાદન માટે વાપરવામાં આવે છે.
3. ઉત્પાદન પદ્ધતિ બદલાતી નથી.
4. X અને Y માત્ર બે જ વસ્તુઓનું ઉપાદન કરવામાં આવે છે.

### ઉદાહરણ દ્વારા સમજૂતી.

સંયોજનો	X વસ્તુ	Y વસ્તુ
A	0	25
B	1	22
C	2	18
D	3	13
E	4	07
F	5	0

ઉપરોક્ત અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ જે બધાં જ સાધનો વડે માત્ર Y વસ્તુનું જ ઉત્પાદન કરવામાં અવે તો વધુમાં વધુ  $25Y$  પ્રામ કરી શકાય. અને માત્ર X વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તો વધુમાં વધુ 5એકમો પ્રામ કરી શકાય છે. અહીં A સંયોજનમાં  $0X$  અને  $25Y$  નું છે. જેમ જેમ સંયોજન B, C, D, E, F તરફ જઈએ તેમ તેમ Xનાં ઉત્પાદનમાં એક એકમનો વધારો થતો જાય છે અને Y નાં ઉત્પાદનમાં ઘટાડો થતો જાય છે. અહીં X નાં દરેક એકમ માટે Y વધુને વધુ એકમો જતાં કરે છે.

### આકૃતિ દ્વારા સમજૂતી :-



ઉપરોક્ત આકૃતિમાં OX ધરી પર X વસ્તુનાં એકમો અને OY ધરી પર Y વસ્તુનાં એકમો દર્શાવવામાં આવ્યાં છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ X નું ઉત્પાદન શૂન્ય છે. ત્યારે Y નાં 25 એકમોનું ઉત્પાદન થાય છે. જે આકૃતિમાં A બિંદુ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. X નાં ઉત્પાદનમાં

કમશ : 1, 2, 3, 4, અને 5 એકમનું ઉત્પાદન કરતાં Y નાં ઉત્પાદન કમશઃ ઘટીને 22, 18, 13, 7 અને 0 એકમ જેટલું થાય છે જે B, C, D, E અને F બિંદુ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. તમામ બિંદુઓને જોડતાં ઉત્પાદન શક્યતા વક્ત પ્રામ થાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપેલા સાધન પ્રમાણે અને ટેકનોલોજીને ઉત્પાદક X નાં વધુમાં વધુ 5 અને Y નાં વધુમાં વધુ 25 એકમો ઉત્પાદન કરી શકે છે. એટલે કે ઉત્પાદક A થી F સુધીનાં સંયોજનો શક્ય છે તેની અંદરનાં કોઈપણ સંયોજન પસંદ કરી ઉત્પાદન કરી શકાય છે.

આકૃતિમાં G બિંદુ ઉત્પાદન શક્યતા રેખાની બહારનું બિંદુ છે. આથી તે સંયોજન પ્રામ કરવું અશક્ય છે. H બિંદુ ઉત્પાદન શક્યતા રેખાની નીચેનું બિંદુ છે. તે શક્ય છે પરંતુ તેના કરતાં પણ આગળનાં સંયોજનો પર X અને Y નાં સંયોજનો શક્ય હોવાથી H બિંદુ ઈચ્છવા યોગ્ય નથી. કારણ કે આ બિંદુ એ ઉત્પાદનનાં બધાં સાધનોનો સંપૂર્ણપણે ઉપયોગ થતો નથી, કેટલાક સાધનો બેચોજગાર હોય છે.

#### (i) કઈ વસ્તુનું ઉત્પાદન કરવું અને કેટલું ઉત્પાદન કરવું ? :-

ઉત્પાદનનાં સાધનો મયાર્દિત હોવાથી સાધનોની અછતનો પ્રશ્ન ઉભો થાય છે, આથી માનવીની તમામ જરૂરીયાતો એક સાથે સંતોષવા માટે બધી જ વસ્તુઓનું એકમ સાથે ઉત્પાદન વધારી શકતું નથી. જો એક વસ્તુનું ઉત્પાદન વધારવામાં આવે તો અન્ય વસ્તુનું ઉત્પાદન ઘટાડવું પડે છે. આથી ઉત્પાદન શક્યતા રેખા ઋણ ફાળવાળી બને છે. જે ઉપરોક્ત આકૃતિ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. તે મુજબ X નું ઉત્પાદન વધારવામાં આવે તો Y નું ઉત્પાદન ઘટાડવું પડે છે. સમાજે ઉત્પાદન શક્યતા રેખા પર આવેલું કોઈપણ બિંદુ પસંદ કરી શકે છે પણ તે ઉત્પાદન શક્યતા રેખાની બહારનું બિંદુ પસંદ ન કરી શકે. ઉત્પાદન શક્યતા રેખા પરનાં દરેક બિંદુ X અને Y વસ્તુનાં ઉત્પાદનમાં થયેલ સાધન ફાળવણી દર્શાવે છે.

#### (ii) કઈ પદ્ધતિથી ઉત્પાદન કરવું :-

કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું નક્કી કર્યા પછી કઈ ઉત્પાદન પદ્ધતિથી ઉત્પાદન કરવું તે પ્રશ્ન થાય છે. જો ઉચ્ચકક્ષાની ઉત્પાદન પદ્ધતિ હોય તો સમાજ ઉત્પાદન શક્યતા રેખા પરનાં બિંદુઓમાંથી કોઈપણ બિંદુ પસંદ કરશે. જો ઉત્પાદન પદ્ધતિ હલકી કક્ષાની હશે તો સાધનનો દુવ્યય થાય છે અને સાધનોની ઉત્પાદકતા ઘટે છે. આવી પરિસ્થિતિમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ H બિંદુએ અટકી હશે. મહત્વમાં ઉત્પાદન પ્રામ કરી શકશે નાહિએ.

#### (iii) સમાજમાં વસ્તુઓ અને સેવાઓની વહેંચણીનો પ્રશ્ન :-

ઉત્પાદિત વસ્તુઓને સમાજનાં વિવિધ વર્ગોમાં કેટ કેટલી વહેંચણી કરવી તેની માહિતી ઉત્પાદન શક્યતા રેખા દ્વારા પરોક્ષ રીતે પ્રામ થાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉત્પાદન શક્યતા રેખાનાં E બિંદુને પસંદ કરવામાં આવે તો એનો અર્થ એ થાય કે મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન થાય છે. અને જો B બિંદુ પસંદ કરે તો ગરીબોની પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓનું વધુ


ઉત્પાદન થાય છે. E બિંદુએ આવકની વહેંચણી વધુ અસમાન હોય છે અને B બિંદુએ આવકની વહેંચણી ઓછી અસમાન હોય છે.

(iv) સાધનોનો સંપૂર્ણ ઉપયોગ થાય છે કે નહિ તે પ્રશ્ન : -

આકૃતિમાં સમાજ દ્વારા X અને Y વસ્તુનાં ઉપલબ્ધ ઉત્પાદનનાં સાધનોનો પૂર્ણ ઉપયોગ થાય છે તે દર્શાવી શકાય છે. પૂર્ણ રોજગારીની પરિસ્થિતિમાં સમાજની ઉત્પાદન શક્યતા રેખા AF પરનાં કોઈપણ બિંદુ પર રહે. અપૂર્ણ રોજગારીની પરિસ્થિતિમાં સમાજ ઉત્પાદન શક્યતાઓની નીચેનાં બિંદુને એટલે કે H બિંદુને પસંદ કરશે. H બિંદુએ ઉત્પાદનનાં સાધનો સંપૂર્ણપણે ઉપયોગમાં લેવાયેલ ન હોવાથી અન્ય વસ્તુનું ઉત્પાદન ઘટાડ્યા વગર અન્ય વસ્તુનું ઉત્પાદન વધારી શકાય છે.

(v) અર્થતંત્રની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવો : -

કઈ વસ્તુનું કેટલા પ્રમાણમાં, કઈ પદ્ધતિથી ઉત્પાદન કરવું, સમાજમાં તેની વહેંચણી કરવી તે નક્કી થયા બાદ ઉત્પાદન હતાં સાધનોનો પૂર્ણતામ ઉપયોગ થાય છે તે નક્કી થયા બાદ જેમ સમય જાય છે તેમ વસ્તી વધતાં માંગ વધે છે. આવી પરિસ્થિતિમાં સમયાંતરે વધતી માંગને પહોંચી વળવા ઉત્પાદનનાં સાધનોની ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો થવો જોઈએ, આ બાબતને ઉત્પાદન શક્યતા વક દ્વારા દર્શાવી શકાય છે. જો સાધનનો પુરવઠો વધે અથવા સ્થિર રહે પરંતુ તેમાં ટેક્નોલોજીકલ પરિવર્તનો લાવવામાં આવે તો ઉત્પાદકતા વધે છે. ઉત્પાદન ક્ષમતા વધવાથી X અને Y બંને વસ્તુઓનું ઉત્પાદન વધારી શકાય છે. આથી નવી ઉત્પાદન શક્યતા રેખા AF મૂળ ઉત્પાદન શક્યતા રેખાની જમણી બાજુ ઉપર તરફ ગતિ કરે છે. જે નીચેની આકૃતિ દ્વારા સમજાવી શકાય.



આકૃતિમાં દર્શાવ્યા મુજબ OX ધરી પર X વસ્તુનાં એકમો અને OY ધરી પર Y વસ્તુનાં એકમો દર્શાવવામાં આવ્યા છે. આકૃતિમાં મૂળ ઉત્પાદન શક્યતા રેખા AF છે. અર્થતંત્રમાં ઉત્પાદન ક્ષમતા વધતાં નવી ઉત્પાદન શક્યતા રેખા A1, F1 અસ્થિતવમાં આવે છે. તે મુજબ

હવે X અને Y બંને વસ્તુઓનું પહેલાં કરતાં વધારે ઉત્પાદન કરી શકાય છે. અને સમાજ C બિંદુએથી I બિંદુએ જઈ શકે છે. આમ, આર્થિક વિકાસની પ્રક્રિયા દરમ્યાન ઉત્પાદન શક્યતા વક્ત સતત ઉપરની તરફ ગતિ કરે છે અને લોકોનું જીવન ધોરણ સુધરતું જાય છે.

### 1.7 આર્થિક પદ્ધતિઓ અને સંસાધનોની ફાળવણી :-

આર્થિક પદ્ધતિઓનો અર્થ :-

જે. એસ. પ્રાભુલાની વ્યાખ્યા :-

“ આર્થિક પદ્ધતિ એટલે એવી રીત રસમોનો સમૂહ જે પોતાના આંતર સંબંધો દ્વારા કોઈ આર્થિક પસંદગીને અસરકારક બનાવે છે, એટલે કે એવી રીત રસમો જે પસંદગીના વિચારોનું કિયામાં રૂપાંતર કરે છે. કિયા એટલે સાધનોને નક્કી કરેલા ઉપયોગો તરફ વાસ્તવમાં લઈ જવા તે. ”

આર્થિક પદ્ધતિનું સ્વરૂપ :-

આર્થિક પદ્ધતિનાં સિદ્ધાંતની રીતે મુખ્ય બે પદ્ધતિઓ અને બે ઉપાયો છે.

(i) બજાર પદ્ધતિનો અને (ii) કેન્દ્રવર્તી હુકમવાળી પદ્ધતિ સાધનો ફાળવવાનાં બે ઉપાયો (i) ઉત્પાદનનાં બધાંજ સાધનો ખાનગી માલિકીનાં રાખવા અને (ii) ઉત્પાદનનાં બધાં સાધનો જાહેર માલિકીના રાખવાં.

સાધનોની ફાળવણીની પદ્ધતિઓ અને તેના ઉપાયોના સંયોજનથી ચાર શુધ્ય આર્થિક પદ્ધતિઓ બનાવે છે.

- (i) મૂડીવાદ.
- (ii) સમાજવાદ.
- (iii) બજાર સમાજવાદ
- (iv) અશુદ્ધ મૂડીવાદ.

આર્થિક પદ્ધતિનાં કાર્યો.

- (i) કોણ નિષયો લેશો? બજાર, આયોજન પંચ કે સરકાર તે આર્થિક પદ્ધતિ નક્કી કરે છે.
- (ii) કોઈ એક સમયે અને કોઈ સમયગાળા દરમ્યાન સાધનોના ઉપયોગની બાબતમાં લેવાતાં નિષયો વચ્ચે મેળ બેસે તેની સંભાળ આર્થિક પદ્ધતિ લે છે.
- (iii) કોણ કઈ રીતે નિષય લેશો તેનો વિચાર કરવા ઉપરાંત ક્યા નિષયો લેવાશે તેનો વિચાર આર્થિક પદ્ધતિ કરે છે.

## આર્થિક પદ્ધતિની સફળતાના માપ દંડો :-

- (i) સમાજમાં ઉત્પાદક સાધનોનો મહત્વમાં ઉપયોગ થતો હોય તો એટલે કે સમાજ ઈજ અવસ્થા પ્રાપ્ત કરે તો પદ્ધતિ સફળ કહેવાય.
- (ii) કોઈ ચોક્કસ સમયગાળા દરમ્યાન દેશમાં વિકાસદરની સાથે સાધનોની ઉત્પાદન ક્ષમતા વધે, મૂળભૂત આર્થિક સમસ્યાઓનું નિરાકરણ આવી શકે તે જોવું જરૂરી છે.
- (iii) અર્થતંત્રમાં ફુગાવો, મંદી, નાણાંની અછત જેવી આર્થિક અસ્થિરતા સમાજની સુખાકારીમાં ઘટાડો કરે છે. આથી કોઈ પદ્ધતિ જેટલા અંશે સમાજને સ્થિર- સહી સલામત આર્થિક જીવન બક્ષે તેટલા અંશે તે પદ્ધતિ સફળ નીવડી કરી શકાય.
- (iv) કોઈપણ આર્થિક પદ્ધતિ માત્ર વસ્તુના જથ્થાના આધારે સફળ ન ગણાય. તેની સાથે સાથે ગ્રાહકોની જરૂરિયાતનાં કમ, પ્રમાણ, ગુણવત્તા, સ્થળ, સમય વગેરે મુજબ વસ્તુનું ઉત્પાદન થાય છે કે નહિ તેના આધારે સફળતા માપી શકાય.
- (v) સમાજમાં ઉપલબ્ધ કામો, આવક- અને સંપત્તિની વહેંચણી સમાજની અપેક્ષા મુજબ થાય તો આર્થિક પદ્ધતિ સફળ ગણી શકાય.
- (vi) વ્યક્તિને તેની કામગીરી બદલ, તેની કામ કરવાની વૃત્તિ અને શક્તિ મુજબ વળતર મળે છે તેનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે.

## 1.8 આર્થિક પદ્ધતિઓમાં સંસાધનોની ફાળવણી :

### (A) મૂડીવાદી આર્થિક પદ્ધતિનાં સાધન ફાળવણી :-

મૂડીવાદનો અર્થ :-

ડબલ્યુ એન. લુકાસની વ્યાખ્યા :-

“ મૂડીવાદ એ આર્થિક વ્યવસ્થાનું એવું સ્વરૂપ છે જેમાં માનવ સર્જિત અને કુદરત સર્જિત મૂડી ખાનગી માલિકીમાં હોયઅને ખાનગી નફાનાં હેતુથી તેનો ઉપયોગ થાય. ”

મૂડીવાદનાં લક્ષણો :-

- (i) ઉત્પાદનનાં સાધનો ખાનગી માલિકીનાં હોય છે.
- (ii) ઉત્પાદનનાં સાધનોનું રોકાણ વ્યક્તિગત સાહસ દ્વારા થાય છે.
- (iii) ખાનગી સાહસિકો વ્યક્તિગત લાભ કે નફાને લક્ષ્યમાં રાખીને બધાં નિષયો લે છે.
- (iv) સાધનોનો ઉપયોગ અને આવકની વહેંચણી બજારો દ્વારા નક્કી થાય છે.

### મૂડીવાદની આર્થિક સંસ્થાઓ અને તેની કામગીરી.

#### (i) આર્થિક માનવી :-

અર્થ :- મૂડીવાદી અર્થવ્યવસ્થામાં વ્યક્તિ પોતાના નિષયો આર્થિક માનવી તરીકે કરે છે. વ્યક્તિ હુંમેશા ખર્ચ અને તુલ્યીગુણની ઉત્પાદનનાં ફાળાની અને બદલામાં પ્રાપ્ત વળતરની તુલના કરે છે.

અને મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય તે રીતે ઉત્પાદન, વપરાશ અને વિનિમય કરે છે. મહત્તમ સંતોષ માટે તે અસામાન્ય તુલ્યગુણનાં નિયમનું પાલન કરે છે.

કાર્યો આર્થિક માનવી તરીકેની વ્યક્તિની નિષ્ઠાય શક્તિ મૂડીવાઈ અર્થતંત્રને સંપૂર્ણ બનાવે છે. જે જુદા જુદા એકમનો જોડાણ કરતી સંકળ બને છે. મૂડીવાદમાં ઉત્પાદન ખર્ચનાં અંદાજો, ત્યાગનું પ્રમાણ સંતોષનું પ્રમાણ વગેરે જાણવા માટે “આર્થિક માનવી” તરીકેનું વર્તન જરૂરી છે.

### (ii) ખાનગી મિલકત :-

મૂડીવાદમાં ખાનગી મિકલત અનિવાર્ય અને તેનો અંતર્ગત ભાગ ગણાય છે. ખાનગી મિલકત માનવી વચ્ચેના સંબંધો નક્કી કરે છે. ખાનગી મિલકત વ્યવસ્થિત જીવનની હેતુલક્ષી પ્રવૃત્તિઓનું સાધન છે અને ખાનગી મિલકતનો હક વ્યક્તિ સ્વાતંત્ર્યનું સાધન કે જેના દ્વારા ઉત્પાદનનાં સાધનોની ઈછ ફાળવણી અંગે જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત થાય છે, મૂડી વાઈ અર્થતંત્ર ગતિશીલ બને છે, બચતો અને મૂડી સર્જનને ઉત્તેજન મળે છે, સંપત્તિનો બગાડ થતો અટકાવે છે, વધારે આર્થિક લાભ મેળવવાનું ઉત્તેજન મળે છે.

### (iii) વારસો :-

મૂડીવાદમાં વારસાનો હક પણ મહત્વનો છે. લોકસ નામના અર્થશાસ્ત્રી વારસાહકની સમજૂતી આપતા જણાવે છે. વારસાના હક પ્રમાણે વ્યક્તિ પોતાની મિલકત પોતાના કાયદેસરના વારસોને વારસામાં આપી શકે છે અથવ પોતાની મિલકત બીજાને મળે તે રીતે વસિયતનામું કરી શકે છે. વારસાની સંસ્થા મૂડીવાદને સતત ચાલુ રાખવા જરૂરી છે. મૂડીવાઈ અર્થ વ્યવસ્થામાં વારસા હક બચતો અને મૂડી નિર્મિત પ્રોત્સાહન આપવાનું તેમજ સંપત્તિનું રક્ષણ કરવાનું પરિબળ પુરું પાડે છે.

### (iv) વ્યક્તિગત પહેલવૃત્તિનું સ્વાતંત્ર્ય :-

વ્યક્તિગત પહેલ વૃત્તિનું સ્વાતંત્ર્ય મૂડીવાઈનું આર્થિક પદ્ધતિનું મહત્વનું અંગ છે. મૂડીવાદમાં પ્રત્યેક વ્યક્તિને આવું સ્વાતંત્ર્ય આપવામાં આવે છે. દરેક તેનો ઉપયોગ ઉત્પાદન રોજગારી અને વપરાશની બાબતમાં સ્વેચ્છાએ નિષ્ઠાય લઈ શકે છે, ગમે તે વ્યવસાયમાં જોડાઈ શકે છે, ગમે તે વસ્તુઓની વપરાશ પાછળ ખર્ચ કરી શકે છે.

વ્યક્તિગત પહેલવૃત્તિનાં સ્વાતંત્ર્યથી ઉત્પાદનનાં સાધનોની ઈછ ફાળવણી થાય છે. ઉત્પાદનનું દરેક સાધન એવી કામગીરી પસંદ કરે છે જેમાં સૌથી વધુ વળતર પ્રાપ્ત થાય. જેના પરિણામે ઉત્પાદનનાં સાધનોની ઈછ ફાળવણી થાય છે અને મહત્તમ ઉત્પાદન પ્રાપ્ત થઈ શકે છે. તદ્વારાંત સંશોધનો, ટેક્નિકલ ફેરફારો વગેરેને ઉત્તેજન મળે છે. દરેક નિયોજક મહત્તમ નફો પ્રાપ્ત કરવા ઉત્પાદન પદ્ધતિ, વસ્તુમાં નવસંશોધન કરે છે, સાધન સંયોજનોમાં ફેરફાર કરે છે.

#### (v) હરીફાઈ :-

મૂડીવાદી અર્થ વ્યવસ્થામાં બજારમાં જુદા જુદા પ્રકારની અસંખ્ય હરીફાઈ જોવા મળે છે. એક સરખા પ્રકારની વસ્તુનાં ઉત્પાદકો અને વેચનાર પોતાની વસ્તુનું વેચાણ વધારવા ગ્રાહકોને આકર્ષવા સતત એક બીજા સાથે હરીફાઈ કરે છે. નિયોજકો ઉત્પાદનનાં સાધનો મેળવવામાં, શ્રમિકો રોજગારી મેળવવામાં, મૂડીદાર બચતોના સલામત રોકાણ અને ઊંચુ વળતર પ્રામ કરવા ગ્રાહકો ઓદ્ઘા ભાવે ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ પ્રામ કરવા માટે હરીફાઈ કરે છે. હરીફાઈનાં લીધે મૂડીવાદી વ્યવસ્થામાં ઉત્પાદન કાર્યક્રમ બને છે, સંશોધનને ઉતેજન મળે છે, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય અને વધુ ઉત્પાદન કરી શકાય તેવી ટેક્નોલોજીની શોધ કરવા નિયોજકો પ્રેરાય છે. પરિણામે ઉત્પાદકતા વધે છે અને ગ્રાહકોને સસ્તી વસ્તુ મળે છે.

#### (vi) ભાવતંત્ર :-

મૂડીવાદમાં ભાવતંત્ર દ્વારા આર્થિક નિષ્ઠિયોનું સંકલન કરી શકાય છે. મૂડીવાદમાં ભાવ પદ્ધતિ ગ્રાહકોની રૂચિ, માંગ, પુરવઠામાં ફેરફારો, સાધનોની છત- અછત વગેરેનું સંકલન સાધે છે તેમજ વસ્તુઓ અને સેવાઓની સમાજમાં વહેચણીમાં સહાય કરે છે.

#### (B) સમાજવાદી આર્થિક પદ્ધતિ સાધન ફાળવણી :-

##### અર્થ :-

“સમાજવાદી આર્થિક વ્યવસ્થા એટલે ઉત્પાદનનાં મહત્વનાં ભૌતિક સાધનો સરકારની માલિકી હેઠળ હોય અને કેન્દ્ર સરકાર દ્વારા આયોજન કરવામાં આવતું હોય જેનો મુખ્ય ઉદ્દેશ લોકોનાં કલ્યાણનો સામાજિક સુખાકારી અને દેશનાં વિકાસ માટેનો હોય છે. તંદુરાંત અર્થતંત્રમાં આવકની અસમાન વહેચણી દૂર કરવી, શોખણ નાખૂંદી તેમજ લોક કલ્યાણ માટેનાં નિશ્ચિત ધ્યેયો સિદ્ધ કરવાની નીતિ.”

- (i) સમાજવાદમાં આવકની અસમાનતા, નફાખોરી, શોખણ અટકાવવા ઉત્પાદનનાં બધાંજ સાધનો સરકારની માલિકી હેઠળ મૂકવામાં આવે છે તેમજ તેનું સંચાલન પણ સરકાર નિયુક્ત વ્યવસ્થાપકો જ કરે છે.
- (ii) સમાજવાદમાં ઉત્પાદનનું આયોજન શું અને કેટલું ઉત્પાદન કરવું ? કયા, કયા સમયે, કઈ પદ્ધતિથી ઉત્પાદન કરવું ? તેની વહેચણી વગેરે મહત્વના નિષ્ઠિયો સરકાર દ્વારા લેવામાં આવે છે.
- (iii) કેન્દ્રીય સમાજવાદમાં રાજ્ય સમાજવાદનાં સિદ્ધાંતો અમલમાં મૂકવાનું અને સમાજવાદનાં ધ્યેયો સિદ્ધ કરવાનું મહત્વનું સાધન છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા ઉપરાંત આયોજન હેઠળ ઉત્પાદન અને વિતરણ અંગેનાં નિષ્ઠિયો લેનાર, તેનો અમલ કરનાર આર્થિક નિયામક બને છે.
- (iv) સમાજવાદમાં બજાર પદ્ધતિ નિયંત્રિત રાખવામાં આવે છે. નાણાનો પણ સ્વીકાર કરવામાં આવે છે. ઉત્પાદનનાં ભૌતિક સાધનોની માલિકી રાજ્યની હોય છે. આથી

ઉત્પાદકીય વસ્તુઓ અને સેવાઓનો વિનિમય, રાજ્યની હોય છે. આથી ઉત્પાદકીય વસ્તુઓ અને સેવાઓનો માલિકીનું જુદા જુદા ઉત્પાદન એકમો વચ્ચેની આપ લે થાય છે.

- (v) સમાજવાદી અર્થ વ્યવસ્થામાં ગ્રાહકોને તેમની લાયકાત અને કાર્ય પ્રમાણે નાણાંના રૂપમાં આવક પ્રાપ્ત થાય છે. ગ્રાહકો તેમની નાણાંકીય આવકમાંથી તેને ગમે તે વસ્તુઓ ખરીદવા સ્વતંત્ર હોય છે. તેમજ બેંકોમાં બચત પણ કરે છે. તેમ છતાં ગ્રાહકોની વસ્તુની ખરીદી પર મર્યાદા આવે છે. તેમણે સરકાર દ્વારા ઉત્પાદિત વસ્તુઓનો જ વપરાશ કરવો પડે છે.
- (vi) સામાન્ય રીતે સમાજવાદમાં દરેક વ્યક્તિને તેઓની લાયકાત મુજબ કામગીરી સોંપવામાં આવે છે. છતાં જરૂર પડે ત્યારે રાજ્ય વ્યક્તિને તેની ઈચ્છા વિરુદ્ધ ફરજિયાત કામગીરી સોંપી શકે છે.
- (vii) કેન્દ્રીય સમાજવાદમાં ખાનગી મિલકત અને વારસાનો હકને મર્યાદિત પ્રમાણમાં જાળવવામાં આવે છે.

### **(C) મિશ્ર અર્થ વ્યવસ્થા સાધન ફાળવણી :-**

અર્થ:-

એસ. એમ. ઇસરાની વ્યાખ્યા :-

“ મિશ્ર અર્થતંત્ર એવી આર્થિક વ્યવસ્થા છે જ્યાં ખાનગી અને જાહેરક્ષેત્રને એવી કામગીરી સોંપવામાં આવે છે જેથી સમાજના બધાજ વગ્ાનું આર્થિક હિત વધારી શકાય. ”

- (v) મિશ્ર અર્થતંત્રમાં કેટલાક ઉદ્યોગો જેવા કે ખેતી વપરાશી ચીજો પેદા કરતાં ઉદ્યોગો, દૂદક વેપાર કે જેમાં જલ્દીથી નફો મળે, ઓછું ઉત્પાદન ખર્ચ, ઓછું મૂડી રોકાણ કરવું પડે તેમાં ખાનગી કંપનીની અથવા વ્યક્તિગત માલિકી હોય છે તો કેટલાક અર્થતંત્રની આવક અને રોજગારીની દાખિએ ચાવીરૂપ ઉદ્યોગો જેવા કે લોંબંડ, પોલાંડ, વીજળી, વાહન વ્યવહાર, ભારે મોટા પાયાનાં ઉદ્યોગો, બંધ, શિક્ષણ, રસ્તા, સંરક્ષણ, પુલ, ન્યાય જેવી બાબતોમાં સરકારની કે જાહેર ક્ષેત્રની માલિકી હોય છે. જાહેર ક્ષેત્ર દ્વારા સમાજને કેવી, કેટલી સસ્તી ચીજવસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવામાં આવે તેનું ધ્યાન રાખવામાં આવે છે. ખાનગીક્ષેત્રમાં નફો કેન્દ્ર સ્થાને હોવાથી મજૂરોનું શોખણ, કૃત્રિમ અદ્ઘતો, વસ્તુમાં ભેણસેળ, ઊચા ભાવ લેવા વગેરે જોવા મળે છે.

ખાનગીક્ષેત્રનાં હરીફ તરીકે નહિ પણ પૂરક તરીકે જાહેરક્ષેત્ર અસ્તિત્વ ધરાવતું હોવાથી મિશ્ર અર્થતંત્રમાં બંને સાથે રહી કામગીરી બજાવવાની હોય છે. દેશના તથા સમયનાં સંદર્ભમાં બંને સાધનોનું યોગ્ય રીતે મિશ્રણ કરવાની આવકત સત્તાધારીઓ પાસે હોય તો જ દેશનો વિકાસ થઈ શકે છે.

- (i) ભિશ્ર અર્થતંત્રમાં આર્થિક વિકાસનાં નિશ્ચિત ધ્યેયો સાથે ટૂંકા અને લાંબાગાળાનું આયોજન સરકાર કરી શકે છે. તે માટે ઉત્પાદનનાં સાધનોની જુદા જુદા ક્ષેત્રોમાં ફાળવણી કરે છે. જાહેરક્ષેત્ર પોતાનાં અંકુશમાં હોવાથી તેમજ ખાનગીક્ષેત્ર પર સરકારનું નિયંત્રણ હોવાથી થોડા ઘણા અંશે આયોજન કરવું શક્ય અને જરૂરી હોય છે. જાહેરક્ષેત્રનાં ઉત્પાદન એકમો તેમની કામગીરી માટે પ્રત્યક્ષ રીતે આયોજનપંચને જવાબદાર રહે છે. જ્યારે ખાનગીક્ષેત્રની બાબતમાં આયોજનપંચ માર્ગદર્શક બની રહે છે.
- (ii) ભિશ્ર અર્થતંત્રમાં વ્યક્તિનું આર્થિક સ્વતંત્ર્ય અને અંકુશો વચ્ચે પણ સમન્વય સાધવામાં આવે છે. અહીં વ્યક્તિને સંપૂર્ણ સ્વાતંત્ર્ય મળતું નથી. સ્વાતંત્ર્ય કેવળ વ્યક્તિ હિત- માટે નહિ પણ સૌના હિત સાથે જોડવામાં આવે છે. આથી સરકાર મૂડી રોકાણ, ઉત્પાદન પ્રમાણ, ઉત્પાદન સ્થળ, સંગ્રહ વેચાણ, ભાવ, આયાત-નિકાસ, આવક વગેરે નિયંત્રિત કરે છે. અને આર્થિક સ્વતંત્રતાના હુરૂપયોગને રોકે છે. છતાં લોકોની પહેલવૃત્તિને મોકણાશ પણ આપવામાં આવે છે.
- (iii) ભિશ્ર અર્થતંત્રમાં બજાર પદ્ધતિ અને ભાવ પદ્ધતિનો સ્વીકાર કરવામાં આવે છે. એટલે કે સરકાર અને ખાનગી સાહસિકો સાથે ઉદ્યોગ ચલાવે છે. તેમાં સરકારની મૂડી 50% કરતાં વધારે રાખવામાં આવે છે, જેથી સરકારનો અંકુશ વધારે રહે છે અને પેઢીનું સંચાલન ફક્ત નફાલકી ન રહેતાં સમાજનાં હિત ને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. સરકાર ખાનગી સાહસિકોની સાહસ તથા સંચાલન શક્તિનો લાભ લે અને ખાનગી સાહસિકો સરકારી મૂડીનો લાભ લે છે. આમ, બંસે એક બીજાના સહકારમાં કામ કરી ને સમાને જરૂરી ચીજ-વસ્તુઓ પૂરી પાડે છે અને તેથી સરકારને પણ નફો મળે છે.
- (iv) ભિશ્ર અર્થતંત્રમાં જાહેર સુખાકારી પર સરકાર ધ્યાન આપે છે. શ્રમિકોને યોગ્ય વેતન, રોજગારી, નોકરીની સલામતી વગેરે અંગે સરકાર યોગ્ય કરવાનું હોય છે અને તે દ્વારા આવકની અસમાનતા ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તદ્વારાંત જાહેર તંદુરસ્તી, શાંતિ, સલામતી, ન્યાય, શિક્ષણ, તાલીમ, સંશોધન, કુદરતી તેમજ માનવ સર્જિત આફતો સમયે લોકોને સહાય, વગેરે જવાબદારીઓ સરકાર સ્વતંત્ર રીતે કે અન્ય લોકોની મદદ લઈને કરે છે. વર્તમાનમાં સરકાર દ્વારા દરેક મોટા ઉદ્યોગોને સમાજના નબળા વર્ગોનો વિવિધ સહાય કરવા માટે CSR Fund ની ઓગવાઈ કરવાનું જણાવવામાં આવેલ છે.
- (v) ભિશ્ર અર્થતંત્રમાં કેટલાક ક્ષેત્રોએ સહકારનાં સિધ્યાંત પર પેઢીનું સંચાલન કરવામાં આવે છે. ખેતી, તેરી, નાના પાયાનું ઉત્પાદન, ખરીદ વેચાણ વગેરે ક્ષેત્રોએ સહકારી મંડળીઓ, પેઢીઓનું સંચાલન કરે છે, જેથી ગ્રાહકોને સસ્તી ચીજો, ઉત્પાદનનાં સસ્તા સાધનો મળે છે તેમજ તેઓ દ્વારા ઉત્પાદિત વસ્તુનું વાજબી ભાવે વેચાણ થઈ

શકે, ખેડાણનું એકમ મોટું બને. આ ક્ષેત્રે જો લોકોની પહેલવૃત્તિ મુખ્ય હોય અને તેને સરકારનાં સાથ - સહકાર અને માર્ગદર્શન મળતાં હોય તો સફળતા હાંસલ કરી શકે છે.

### 1.9 પાયાનાં ઘ્યાલો :

પ્રસ્તાવના :-

અર્થશાસ્ત્રમાં માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે. અર્થશાસ્ત્રનાં અભ્યાસને સમજવા તેના પાયાનાં ઘ્યાલો સમજવા આવશ્યક છે. જે વિશે અહીં આપણે વિચાર કરીશું ?

#### (1) તુલ્યીગુણ (Utility)

“કોઈપણ વસ્તુ કે સેવામાં રહેલો માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે તુલ્યીગુણ ” દા.ત. ભૂખ લાગી હોય તો તમે દાબેલી ખાવ તો દાબેલીમાં તમારી ભૂખ સંતોષવાનો ગુણ એટલે કે તુલ્યીગુણ રહેલો છે. તરસ લાગી હોય તો પાણી કે ઢાપીણામાં તુલ્યીગુણ રહેલો છે.

- તુલ્યીગુણનાં લક્ષણો.

##### (i) તુલ્યીગુણ એટલે સારાપણું નહિ :-

તુલ્યીગુણને વ્યક્તિના સારા - નરસા સાથે સંબંધ નથી. વ્યક્તિને વસ્તુ વાપરવાથી સંતોષ મળે છે તે તેના માટે ફાયદાકારક છે કે તુકશાનકારક તેની સાથે કોઈ સંબંધ નથી. દા.ત. અફીશ, ગાંજે, ચરસ, દારૂ, તમાકુ વગેરેનાં સેવનથી વ્યક્તિનાં સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે. પરંતુ તેનાં વ્યસનીઓને તેમાંથી સંતોષ મળે છે માટે તેમાં પણ તુલ્યીગુણ રહેલો છે. આત્મ હત્યા કરનાર વ્યક્તિ માટે ઝેરમાં પણ તુલ્યીગુણ રહેલો છે.

##### (ii) તુલ્યીગુણ એટલે આનંદ નહિ :-

કુટલીક વસ્તુઓની વપરાશમાંથી આપણને તુલ્યીગુણ મળે છે. પરંતુ તે વસ્તુનાં વપરાશમાંથી હંમેશા આનંદ મળે તેવું નથી હોતું જેમ કે આપણે બિમાર હોઈએ તો સાજા થવા માટે કડવી દવા પીવી પડે છે. દવા કડવી હોવાથી પીવી ગમતી નથી તેમ છતાં સાજા થવા માટે દવાનું સેવન કરીએ તો દવામાં પણ તુલ્યીગુણ છે.

##### (iii) તુલ્યીગુણનો ઘ્યાલ સાપેક્ષ છે :-

તુલ્યીગુણનો ઘ્યાલ સાપેક્ષ છે. એટલે કે વ્યક્તિ, સમય, સ્થળ, સંજોગો બદલાય તેમ તુલ્યીગુણ પણ બદલાય છે. દા.ત. શિયાળામાં ગરમ કપડાંમાં તુલ્યીગુણ હોય છે પણ ઉનાળા કે ચોમાસામાં ગરમ કપડાંમાંથી તુલ્યીગુણ મળતો નથી, કોઈ વ્યક્તિને શાસ્ત્રીય સંગીત સાંભળવાથી આનંદ મળતો હોય તો અન્યને ઓછો આનંદ મળતો હોય કે આનંદ ન પણ મળે. નદી કિનારા પર

રેતીમાંથી તુલ્યીગુણ ઓછો કે શુન્ય મળે છે જ્યારે શહેરમાં બાંધકામ માટે તે જ રેતીમાંથી વધુ તુલ્યીગુણ મળે છે.

#### (iv) તુલ્યીગુણ એટલે ઉપયોગિતા નહિ :-

સામાન્ય રીતે ઉપયોગિતા અને તુલ્યીગુણને એકજ ગણવામાં આવે છે. પરંતુ અર્થશાસ્ત્રમાં તુલ્યીગુણ અને ઉપયોગિતાનો અર્થ જુદો જુદો છે. દા. ત. દાર્ઢિયો દાર્ઢ પીવે તો તેને દાર્ઢમાંથી તુલ્યીગુણ મળે છે, પરંતુ તેની દાર્ઢની લતના લીધે તેના પરિવારને જે સહન કરવું પડે, તેની સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે, સમાજ માટે પણ હાનિકારક સાબિત થાય છે. એટલે કે ત્યારે દાર્ઢમાં ઉપયોગિતાનો ગુણ નથી. તુલ્યીગુણને વસ્તુનાં સારા કે ખરાબ લક્ષણો સાથે સંબંધ નથી. જ્યારે ઉપયોગિતાને માત્ર વસ્તુનાં સારા લક્ષણ સાથે સંબંધ છે.

#### (v) તુલ્યીગુણ માપી શકતો નથી :-

તુલ્યીગુણ માનસિક ઘ્યાલ છે. કોઈ વસ્તુની વપરાશ કરવાથી તેમાંથી કેટલો તુલ્યીગુણ મળે છે તે અનુભવી શકાય છે પણ ચોક્કસ રીતે માપી શકતો નથી.

#### ● તુલ્યીગુણનાં પ્રકારો :-

##### (i) પ્રાથમિક કે નૈસર્જિક તુલ્યીગુણ :-

કેટલીક વસ્તુઓ કુદરતી રીતે જ કે પ્રાથમિક અવસ્થામાં જ માનવીની જરૂરિયાતો સંતોષે છે તે ને પ્રાથમિક કે નૈસર્જિક તુલ્યીગુણ કહે છે. દા.ત. જંગલમાંથી મળતું લાકડું, પેટ્રોલિયમ પેદાશો, કોલસો વગેરેમાં પ્રાથમિક તુલ્યીગુણ રહેલો છે.

##### (ii) સ્વરૂપ તુલ્યીગુણ :-

વસ્તુનું સ્વરૂપ બદલાવાથી એટલે કે કોઈ વસ્તુનાં રંગ, સ્વાદ, આકાર, કદ, વજન, ગુણ વગેરે બદલાય અને તેની સાથે તેમાંથી મળતો તુલ્યીગુણ બદલાય તો તેને સ્વરૂપ તુલ્યીગુણ કહે છે. દા.ત. જંગલમાંથી મળતાં લાકડામાંથી ફર્નિચર બનાવવામાં આવે, ઘઉં, ચોખા, બાજરી જેવા અનાજમાંથી લોટ તૈયાર કરી વસ્તુ બનાવવામાં આવે તો જે તુલ્યીગુણ મળે છે તે સ્વરૂપ તુલ્યીગુણ છે.

##### (iii) સમય તુલ્યીગુણ :-

સમયમાં ફેરફારની સાથે તુલ્યીગુણમાં ફેરફાર થાય તેને સમય તુલ્યીગુણ કહે છે. દા.ત. શિયાળામાં ગરમ કપડામાંથી વધુ તુલ્યીગુણ મળે છે, જ્યારે ઊનાળા કે ચોમાસામાં ઓછો તુલ્યીગુણ મળે છે. ઠંડાપીણા, આઈસ્ક્રીમ વગેરેમાંથી ઊનાળામાં વધુ તુલ્યીગુણ મળે છે જ્યારે શિયાળો કે ચોમાસામાંથી નહિવત તુલ્યીગુણ મળે છે.

##### (iv) સ્થળ તુલ્યીગુણ :-

વસ્તુને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતાં તુલ્યીગુણમાં જે ફેરફાર થાય છે તેને સ્થળ તુલ્યીગુણ કહે છે જેમ કે નદી કિનારાની રેતને બાંધકામ સાઈટ પર લઈ જવામાં આવે તો નદી કિનારા કરતાં બાંધકામ સાઈટ પર રેતીમાંથી વધુ સંતોષ મળે છે.

**(v) માલિકી હકનો તુલ્યતા :-**

વસ્તુની માલિકી બદલાય તેમ તેનો તુલ્યતા બદલાય તેને માલિકી હકનો તુલ્યતા કહે છે. દા.ત. કોઈ વ્યક્તિ ભાડાનાં મકાનમાં રહેતી હોય અને તે પોતાના મકાનમાં રહેવા જાય તો તેનો તુલ્યતા વધે છે.

**(2) વસ્તુઓ અને સેવાઓ :- (Goods And services)**

**• વસ્તુઓનો અર્થ :-**

માણસ પોતાની વિવિધ જરૂરિયાતો વિવિધ રીતે સંતોષવાનો પ્રયત્ન કરે છે. ભૌતિક બાબતો દ્વારા જરૂરિયાત સંતોષાય છે તે વસ્તુ છે.

**• વસ્તુનાં લક્ષણો :-**

**(i) તુલ્યતા હોવો જોઈએ :-**

અર્થશાસ્ત્રની રીતે જે વસ્તુમાં જરૂરિયાત સંતોષવાની શક્તિ હોય અથવા જરૂરિયાત સંતોષવાનો ગુણ હોય તેને વસ્તુ કહેવાય. દા.ત. કાપડ, અનાજ, દવા, મકાન વગેરે.

**(ii) મૂર્ત અથવા ભૌતિક સ્વરૂપ :-**

જે વસ્તુ ભૌતિક સ્વરૂપમાં હોય એટલે કે જેને નરી આંખે જોઈ શકાય, જેને સ્પર્શ કરી શકાય તેને વસ્તુ કહેવાય.

**(iii) વિનિમય પાત્રતા :-**

કોઈ વસ્તુમાંથી તુલ્યતા મળતો હોય, ભૌતિક સ્વરૂપ હોય તેની સાથે તેનો વિનિમય થઈ શકતો હોય એટલે કે જેનું ખરીદ- વેચાણ કે આપ-લે થઈ શકે તેને જ વસ્તુ કહેવાય. દા.ત. ટી.વી. રેફીજરેટર, અનાજ, કપડાં, દવા વગેરે. ગાયક કલાકાર દ્વારા ગાવામાં આવતા ગીત, ડૉક્ટરની સેવા વગેરે દ્વારા તુલ્યતા મળે છે. તેની વિનિમય પાત્રતા છે. પરંતુ તે અભૌતિક હોવાથી વસ્તુ ન કહી શકાય.

**• વસ્તુઓનું વર્ગીકરણ :-**

**(i) આર્થિક વસ્તુ અને સર્વ સુલભ વસ્તુ :-**

જે વસ્તુની છત હોય, સરળતાથી પ્રાપ્ત કરી શકાય, તેને મેળવવા કોઈ પ્રયત્ન કરવો ન પડે અથવા કોઈ કિંમત ચૂકવવી ન પડે તેને સર્વ સુલભ કે મુક્ત વસ્તુ કહે છે. સર્વસુલભ વસ્તુઓને બિન આર્થિક વસ્તુ પણ કહે છે. સૂર્ય પ્રકાશ, હવા, પાણી વગેરે સર્વસુલભ વસ્તુઓ છે. સર્વસુલભ વસ્તુઓ કુદરતી રીતે પ્રાપ્ત થાય છે. આવી વસ્તુઓ વિનિમયપાત્ર હોતી નથી. જે વસ્તુની અધૃત હોય, જેને મેળવવા માટે માનવીએ ખર્ચ કરવો પડે છે અને જે વિનિમય પાત્ર છે તેવી વસ્તુને આર્થિક વસ્તુ કહે છે. દા.ત. રેફીજરેટર, ટીવી, મકાન, કપડાં, ફર્નિચર વગેરે.

કેટલીક વસ્તુઓ સર્વસુલભ પણ હોય છે અને આર્થિક પણ હોય છે. સમય, સંજોગો, પરિસ્થિતિ બદલાય તેમ વસ્તુનું સ્વરૂપ બદલાય છે. જેમ કે, હવા કે ઓક્સિજન સર્વસુલભ છે. પરંતુ ઘણીવાર વ્યક્તિને હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડર દ્વારા ઓક્સિજન આપવામાં આવે ત્યારે તેની તેને કિંમત ચૂકવવી પડે છે તે રીતે ત્યારે ઓક્સિજન આર્થિક વસ્તુ બને છે.

#### (ii) વપરાશી વસ્તુઓ અને ઉત્પાદકીય વસ્તુઓ :-

જે વસ્તુનો માનવી પ્રત્યક્ષ રીતે ઉપયોગ કરે તેને વપરાશી વસ્તુ કહે છે. જેમકે; એરકન્ટીશનર, રેફીજરેટર, અનાજ, કપડાં વગેરે. ઉપરાંત વકીલની સેવા, સંગીતકારની સેવા, ડોક્ટરની સેવા વગેરે પણ વપરાશી વસ્તુ છે. આવી વપરાશી વસ્તુઓ કે સેવાઓને પ્રાથમિક કે પ્રથમ કક્ષાની વસ્તુ પણ કહેવામાં આવે છે.

જે વસ્તુનો માનવી પરોક્ષ રીતે ઉપયોગ કરતાં હોય તેને ઉત્પાદક વસ્તુ કહે છે. કારખાનાનાં યંત્રો કે જેના દ્વારા જુદી જુદી વસ્તુઓનું ઉત્પાદન થાય છે અને પરોક્ષ રીતે માનવીની તે વસ્તુની જરૂરિયાત સંતોષે છે. આથી યંત્ર ઉત્પાદક વસ્તુ છે.

વસ્તુ વપરાશી છે કે ઉત્પાદક તેનો આધાર તે વસ્તુની વપરાશ પર છે. દા.ત. જો વ્યક્તિ મોટરકારનો પોતાના માટે વપરાશ કરે તો વપરાશી વસ્તુ છે, પરંતુ જો મોટરકારને ભાડે ટેક્ષી તરીકે વાપરવામાં આવે તો તે ઉત્પાદકીય વસ્તુ છે.

#### (iii) ભૌતિક અને અભૌતિક વસ્તુઓ :-

જે વસ્તુ નરી આંખે જોઈ શકાય, સ્પર્શ કરી શકાય તેવી વસ્તુને ભૌતિક વસ્તુ કહે છે. દા.ત. ખુરશી, ટેબલ, મોબાઇલ ફોન, ટી.વી. વગેરે. યંત્રો, મકાનો, વસ્તુઓ વગેરે માનવસર્જિત ભૌતિક વસ્તુઓ છે. જ્યારે ખનીજ, ખેતર, જમીન, કુવો વગેરે કુદરતી ભૌતિક વસ્તુઓ છે.

જે વસ્તુ વ્યક્તિની જરૂરિયાત સંતોષી શકતી હોય, નરી આંખે જોઈ ન શકતી હોય, સ્પર્શી ન શકતી હોય એટલે કે અદૃશ્ય હોય તેવી વસ્તુને અભૌતિક વસ્તુ કહે છે. દા.ત. શિક્ષકની સેવા, ડોક્ટરની સેવા, વકીલની સેવા વગેરે.

#### (iv) ટકાઉ અને નાશવંત વસ્તુઓ :-

જે વસ્તુને અનેકવાર ઉપયોગમાં લેવા છતાં તે માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ ટકાવી રાખે તેને ટકાઉ વસ્તુ કહે છે. દા.ત. ખુરશી, ટેબલ, સોફસેટ, રેફીજરેટર વગેરે.

જે વસ્તુને એક વાર ઉપયોગમાં લેવાથી તેમાં રહેલો માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ ગુમાવે છે તેને નાશવંત વસ્તુ કહે છે. દા.ત. હુદ્દ, શાકભાજ, ફળ, બ્રેડ, ઈડા વગેરે.

(v) ખાનગી અને જાહેર વસ્તુઓ :-

જે વસ્તુની માલિકી કોઈ એક વ્યક્તિની, કંપનીની, સંસ્થાની, જૂથની કે પરિવારની હોય તેને ખાનગી વસ્તુ કહે છે. દા.ત. મકાન, પુસ્તક, ઓફિસ, મોટરકાર વગેરે.

જે વસ્તુની માલિકી રાજ્યની કે સરકારની કે સમાજની કે રાષ્ટ્રની હોય તેને જાહેર વસ્તુ કહે છે. દા.ત. બગીચો, પુલ, રસ્તા, નહેરો વગેરે.

કેટલીક વસ્તુ ખાનગી હોય છે પણ તેનો ઉપયોગ જાહેર વસ્તુ તરીકે થાય છે. જેમ કે ટોરેન્ટ પાવર ખાનગી કંપની છે જે વીજળી ઉત્પન્ન કરે છે પણ તેનો ઉપયોગ લાખો લોકો કરે છે. આમ એક બાજુ તે ખાનગી છે અને બીજી રીતે જાહેર વસ્તુ છે.

(3) સંપત્તિ :- (Wealth)

● અર્થ :-

માર્શલની વ્યાખ્યા :- “ જે વસ્તુ તુધીગુણ ધરાવતી હોય, જેની અધ્યત હોય, જેનો વિનિમય થઈ શકતો હોય અને જેનો વંશ પરંપરાગત કે કાયદેસરનો હક પ્રામ થઈ શકતો હોય તેને સંપત્તિ કહે છે.”

પ્રો. ટોસિંગની વ્યાખ્યા :- “ દરેક આર્થિક વસ્તુને સંપત્તિ કહી શકાય ”

● સંપત્તિનાં લક્ષણો :-

(i) તુધીગુણ :

જે વસ્તુમાં માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ હોય તેને સંપત્તિ કહે છે. દા.ત. મકાન, સોના-ચાંદી, જવેરાત, રેફીજરેટર વગેરે.

(ii) અધ્યત :-

જે કોઈ વસ્તુમાં તુધીગુણ હોય તેની સાથે તેની અધ્યત હોય તો તેને સંપત્તિ કહેવાય. જે વસ્તુની ઇત હોય એટલે કે સવભુલભ વસ્તુને સંપત્તિ ન કહી શકાય. દા.ત. સૂર્ય પ્રકાશ, હવા, પાણી વગેરે.

(iii) પ્રયત્ન કરવો પડે છે ? :-

જે વસ્તુ પ્રામ કરવા માટે પ્રયત્ન કરવો પડે તેને સંપત્તિ કહેવાય. જે વસ્તુ મેળવવા માટે પ્રયત્ન કરવો પડે છે એટલે કે તે વસ્તુની અધ્યત છે. જેને મેળવવા શ્રમ, સેવા કે પ્રવૃત્તિ કરવી પડે છે.

(iv) વિનિમય પાત્રતા :-

જે વસ્તુનું બજાર હોય, જેના ખરીદ વેચાણ થઈ શકતાં હોય તેને સંપત્તિ કહે છે. દા.ત. ફર્નિચર, મકાન, ઘરધંટી, ટી.વી. વગેરે.

(v) ટકાઉપણાનો ગુણ :-

જે સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોય એટલે કે જે સંપત્તિનો વારંવાર અનેક ઉપયોગ શક્ય હોય તેને સંપત્તિ કહેવાય. જેમ કે મકાન, ટી.વી. વગેરે દુધ, શાકભાજી, બ્રેડ વગેરે જેવી નાશવંત વસ્તુઓને સંપત્તિ ન કહી શકાય.

(vi) માલિકી હક્કની પ્રાપ્તિ :-

જે વસ્તુનો માલિકી હક મેળવી શકાય તેમ હોય તેને જ સંપત્તિ કહી શકાય. વસ્તુ પર માલિકી કાંતો તેની કિંમત ચૂકવી તેની ખરીદી કરીને અથવા વારસાગત સંપત્તિ પ્રાપ્ત કરવી.

(vii) ભૌતિક સ્વરૂપ :-

માત્ર ભૌતિક વસ્તુને જ સંપત્તિ કહેવાય.

(viii) સંપત્તિનો ઘ્યાલ સાપેક્ષ છે :-

સંપત્તિનો ઘ્યાલ સાપેક્ષ છે. સમય, સ્થળ, સંજોગોનાં આધારે સંપત્તિનો અર્થ બદલાય છે. જેમ કે હીરાની ખાણમાં રહેલો હીરો સંપત્તિ નથી, પણ જે બ્યક્ટિ બજારમાંથી હીરો ખરીદે તો તે સંપત્તિ છે.

● સંપત્તિનાં પ્રકારો :-

(i) વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ :-

જે વસ્તુ પર વ્યક્તિ માલિકી હક ધરાવી શકે તેવી આર્થિક વસ્તુને વ્યક્તિગત સંપત્તિ કહે છે. દા.ત. મકાન, મોટરકાર, સોનું ચાંદી, જવેરાત વગેરે. ધંધામાં પેટન્ટ, ધંધાની પ્રતિષ્ઠા, કોપીરાઇટ પણ વ્યક્તિગત સંપત્તિ છે.

જે આર્થિક વસ્તુ પર જાહેર જનતા કે સમાજની માલિકી હોય તેને સામાજિક સંપત્તિ કહે છે. દા.ત. રસ્તાઓ, પુલો, નહેરો, બગીચાઓ વગેરે.

(ii) રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ :-

રાષ્ટ્રનાં બધા જ નાગરિકોની વ્યક્તિગત સંપત્તિનો સરવાળો કરી તેમાં કુલ સામાજિક સંપત્તિને ઉમેરવામાં આવે ત્યારે રાષ્ટ્રીય સંપત્તિ પ્રાપ્ત કરી શકાય. એટલે કે રાષ્ટ્રીય સંપત્તિ = રાષ્ટ્રનાં બધાં જ નાગરિકોની વ્યક્તિગત સંપત્તિ + કુલ સામાજિક સંપત્તિ.

જે સંપત્તિ પર કોઈ એક વ્યક્તિ, સમાજ કે દેશનો નહિ પણ હુનિયાનાં તમામ દેશોની માલિકી હોય તેને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહે છે. દા.ત. મહાસાગરો, ઓઝોન વાયુ વગેરે.

### (iii) સંભવિત સંપત્તિ :-

જે સંપત્તિ વર્તમાનમાં અસ્તિત્વમાં ન હોય, પરંતુ ભવિષ્યમાં તેની શોધ થવાની સંભાવના હોય તેને સંભવિત સંપત્તિ કહે છે. દા.ત. મંગળ ગ્રહ પર માનવજીવનની શક્યતા. વૈજ્ઞાનિકક્ષેત્રે શોધખોળો વગેરે.

### (iv) નકારાત્મક સંપત્તિ :-

જે સંપત્તિ એક વ્યક્તિ કે એક રાખ્રી એ બીજી વ્યક્તિ કે બીજા રાખ્રીને દેવાની ચુકવણી કરવા માટે આપવાની હોય તો તેને નકારાત્મક સંપત્તિ કહે છે.

#### • સંપત્તિ અને કલ્યાણ કે સુખાકારી :-

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય તો તેનું કલ્યાણ કે સુખાકારી વધે છે. પરંતુ હંમેશા એવું થતું નથી. કેટલીકવાર સંપત્તિ વધે છતાં વ્યક્તિનું કલ્યાણ ન પણ વધે. સિગારેટ, દાડુ જેવી હાનિકારક વસ્તુઓ સંપત્તિ છે પણ તેનાથી વ્યક્તિનું કલ્યાણ વધતું નથી. આમ, સંપત્તિમાં વધારો થવાથી લોકોના કલ્યાણમાં વધારો થાય છે તે ઉપરાંત અન્ય પરિબળો પણ કલ્યાણનાં વધારવા પર ભાગ ભજવે છે. જેમ કે;

#### (i) સંપત્તિનું સ્વરૂપ :-

સંપત્તિમાં વધારો થશે તેથી લોકોના કલ્યાણમાં વધારો થશે કે નહિ તેનો આધાર સંપત્તિનાં સ્વરૂપ પર છે. દા.ત. દારુંગોળા, શાખ સરંજામ, ચરસ જેવી હાનિકારક સંપત્તિ વધવા છતાં લોકોનું કલ્યાણ ઘટે છે. જ્યારે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ જેવી કે; અનાજ, કઠોળ, કપડાં વગેરેમાં વધારો થાય તો લોકોના કલ્યાણમાં વધારો થાય છે.

#### (ii) સંપત્તિનું ઉત્પાદન :-

કોઈપણ દેશમાં સંપત્તિનું ઉત્પાદન કઈ પદ્ધતિથી કરવામાં આવે છે તેના પર લોકોના કલ્યાણનો આધાર છે. જે ટેક્નોલોજીથી લોકોને વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય, વસ્તુની વપરાશમાં વધારો થાય તો લોકોનું કલ્યાણ વધે છે.

#### (iii) સંપત્તિની વહેંચણી :-

સંપત્તિની વહેંચણી સમાજના જુદા જુદા વર્ગો વચ્ચે કેવી રીતે થાય છે તેના પર લોકોના કલ્યાણનો આધાર છે. જે સંપત્તિની ન્યાયી વહેંચણી થાય તો માનવ કલ્યાણમાં વધારો થાય છે, પરંતુ જે અસમાન વહેંચણી થાય તો સંપત્તિ વધવા છતાં લોકોના કલ્યાણમાં વધારો થતો નથી. એટલે ધનિકોને વધુ સંપત્તિ અને ગરીબ, ખેતમજૂરો, ઔદ્યોગિક મજૂરોને પ્રાથમિક જરૂરિયાતો પણ સંતોષી શકતી ન હોય તો સંપત્તિ વધવા છતાં કલ્યાણ ઘટે છે.

(iv) સંપત્તિ સર્જનનું સામાજિક ખર્ચ :-

એક બાજુ સંપત્તિનાં ઉત્પાદનમાં વધારો થતો હોય અને બીજી બાજુ ઉદ્યોગિકરણનાં લીધે ગંડા વસવાટો, પ્રદૂષણ, વસ્તી ગીયતા, કાયદો, વ્યવસ્થા, પાણીનું પ્રદૂષણ વગેરે પાછળ સરકારનું સામાજિક ખર્ચ વહે છે. આથી રાષ્ટ્રની સંપત્તિમાં વધારો થવા છતાં લોકોનાં કલ્યાણમાં ઘટાડો થાય છે.

(v) રાજ્યની આર્થિક નીતિ :-

સંપત્તિમાં વધારો થવાથી લોકોનાં કલ્યાણમાં વધારો થશે કે નહિ તેનો આધાર રાજ્યની આર્થિક નીતિ પર છે. જો સરકાર પ્રગતિશીલ વેરા નાંખી ધનિકો, ઉદ્યોગપતિઓ પાસેથી કર આવક પ્રાપ્ત કરી તેને ગરીબોના કલ્યાણ માટેની વિવિધ યોજનાઓ માટે વાપરે તો લોકોનું કલ્યાણ વહે છે.

● નાણું અને સંપત્તિ :-

નાણું; સંપત્તિનાં બધાંજ લક્ષણો ધરાવતું હોવા છતાં નાણું સંપત્તિ ન કહેવાય. દૂધ, શાકભાજ, કપડાં વગેરે પ્રત્યક્ષ વપરાશની વસ્તુઓ છે. જેની વપરાશ દ્વારા જરૂરિયાતોને સંતોષી શકાય છે. જ્યારે નાણું પ્રત્યક્ષ વપરાશની વસ્તુ ન હોવાથી તે સંપત્તિ નથી.

(4) મૂલ્ય અને કિંમત :- (Value And Price)

● મૂલ્યનો અર્થ:-

“ કોઈપણ વસ્તુમાં રહેલી અન્ય વસ્તુ ખરીદવાની શક્તિ અથવા વ્યક્તિની જરૂરિયાત સંતોષવાની શક્તિ એટલે મૂલ્ય.”

● વપરાશ મૂલ્ય :-

જે વસ્તુ કે સેવાની વપરાશથી માનવીની જરૂરિયાત સંતોષાય છે તે વસ્તુમાં વપરાશ મૂલ્ય રહેલું છે તેમ કહી શકાય.

● વિનિમય મૂલ્ય :-

જો કોઈ વસ્તુનાં બદલે બીજી વસ્તુ મેળવી શકતી હોય એટલે કે વસ્તુનો વિનિમય થઈ શકતો હોય તો તે વસ્તુમાં વિનિમય મૂલ્ય છે તેમ કહેવાય.

ધારો કે કોઈ વસ્તુ વપરાશ મૂલ્ય ધરાવતી હોય પણ વિનિમય પાત્રતા ધરાવતી ન હોય તો તેમાં વિનિમય મૂલ્ય નથી તેમ કહેવાય. દા.ત. હવા, સૂર્યપ્રકાશ વગેરે જેનું વપરાશ મૂલ્ય છે પણ તેનો વિનિમય થઈ શકતો નથી. આથી તેનું વિનિમય મૂલ્ય શૂન્ય હોય છે.

જો કોઈ વસ્તુનાં બદલામાં વધુ વસ્તુ મેળવી શકતી હોય તો તેનું વિનિમય મૂલ્ય વધુ અને ઓછી વસ્તુ મેળવી શકતી હોય તો તેનું વિનિમય મૂલ્ય ઓછું હોય છે.

વસ્તુની અદ્યત વિનિમય મૂલ્યને અસર કરે છે જે વસ્તુની અદ્યત હોય તેનું વિનિમય મૂલ્ય વધુ અને જે વસ્તુની છત હોય તેનું વિનિમય મૂલ્ય ઓછું કે શૂન્ય હોય છે.

જેનું વિનિમય મૂલ્ય હોય તેનું વપરાશ મૂલ્ય હોય જ છે પરંતુ જેનું વપરાશ મૂલ્ય હોય તેનું વિનિમય મૂલ્ય હોય તે જરૂરી નથી.

ટૂંકમાં; મૂલ્ય એટલે વપરાશની રીતે વસ્તુની અગત્યતા નાહિ પરંતુ કોઈ વસ્તુની બીજી વસ્તુ પરની વર્ચસ્વ શક્તિ કે વિનિમય શક્તિ.

- **કિંમતનો અર્થ :-**

વસ્તુના મૂલ્યની નાણાંનાં રૂપમાં કરવામાં આવતી રજૂઆત એટલે કિંમત. દા.ત. X વસ્તુનાં 1 એકમ માટે રૂ. 10 ચૂકવવા પડે તો X ની કિંમત 10 રૂ. છે તેમ કહેવાય.

- **કિંમત અને મૂલ્ય વચ્ચે તફાવત :**

મૂલ્ય		કિંમત	
(1)	વસ્તુનાં સ્વરૂપમાં વ્યક્ત થાય તે મૂલ્ય છે.	(1)	નાણાંનાં સ્વરૂપમાં વ્યક્ત થાય તે કિંમત છે.
(2)	કોઈપણ વસ્તુનું મૂલ્ય સાપેક્ષ છે એટલે કે અલગ અલગ હોય છે.	(2)	કિંમત એક જ હોય છે.
(3)	બધી જ વસ્તુઓનું મૂલ્ય એક સાથે વધી કે ઘટી શકે નાહિ.	(3)	બધીજ વસ્તુઓની કિંમતમાં એક સાથે વધારો ઘટાડો કરી શકાય છે.
(4)	મૂલ્યનો ખ્યાલ વિનિમય પ્રથામાં ઉપયોગી થાય છે.	(4)	કિંમતનો ખ્યાલ નાણાં આધારિત અર્થ વ્યવસ્થામાં ઉપયોગી છે.

**(5) કલ્યાણ :- (Welfare) :-**

- **અર્થ :-**

કલ્યાણ એટલે સારી સ્થિતિ, પરિસ્થિતિમાં સુધારો, એટલે કે ભૌતિક જીવન ધોરણમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ એટલે કલ્યાણ.

**(i) સામાન્ય કલ્યાણ અને આર્થિક કલ્યાણ :-**

જો કોઈ વ્યક્તિનું કુલ કલ્યાણ કે સુખ આરોગ્ય, શિક્ષણ, ઘર, સામાજિક મોભો, સત્તા, સંતોષ વગેરે પરિબળો પર આધારિત છે. આ મનુષ્યનું સામાન્ય કલ્યાણ છે એમ કહેવાય.

મનુષ્યનું આર્થિક કલ્યાણ એ એના સામાન્ય કલ્યાણનો એક ભાગ છે. આર્થિક કલ્યાણને માપી શકાય છે. જે વસ્તુઓ અને સેવાઓનું નાણાંકીય મૂલ્ય છે અને જેનો વિનિમય થાય છે અને જેની વપરાશ થાય છે તેને આર્થિક કલ્યાણ સાથે સંબંધ છે.

**(ii) વ્યક્તિનું કલ્યાણ :-**

વ્યક્તિનું કલ્યાણ આત્મલક્ષી બાબત છે. દરેક વ્યક્તિને અલગ અલગ વસ્તુમાંથી અલગ અલગ સંતોષ મળે છે. આમ; વ્યક્તિએ વ્યક્તિએ કલ્યાણનો ઘ્યાલ બદલાય છે.

એ જ રીતે વ્યક્તિનો પસંદગીની તક વધારે તેમ વધુ કલ્યાણ, પસંદગીની તક ઓછી તેમ કલ્યાણ ઘટે છે.

જ્યારે વ્યક્તિની આવક વધે, વપરાશ વધે ત્યારે તેનું કલ્યાણ થયું તેમ કહેવાય.

### (iii) સામાજિક કલ્યાણ :-

સમગ્ર સમાજનું કલ્યાણ એ સામાજિક કલ્યાણ છે. સમાજની બધી જ વ્યક્તિઓનું કલ્યાણ એટલે સામાજિક કલ્યાણ. પરંતુ ઘણીવાર સમાજની બધી જ વ્યક્તિનું કલ્યાણ એક સાથે થતું નથી તેમજ એક સરખું પણ થતું નથી. તમામ વ્યક્તિઓના કલ્યાણનો સરવાળો એટલે સામાજિક કલ્યાણ.

જેમ વ્યક્તિની પસંદગી હોય છે તેમ સમાજની પણ પસંદગી હોય છે, આથી ઘણીવાર વ્યક્તિ અને સમાજની પસંદગી એક બીજા સાથે ટકરાય છે. જેમકે; કોઈ વ્યક્તિને સિગારેટ પીવાની મજા આવે છે. તે જાહેર સ્થળે સિગારેટ પીવે તો અન્ય લોકોને તે ન ગમે. તો જાહેર સ્થળોએ સરકાર ધુમ્રપાન પર પ્રતિબંધ મૂકે છે. આ રીતે વ્યક્તિગત પસંદગી અને સામાજિક પસંદગી વચ્ચે ટકરાવ થાય છે.

### (iv) કલ્યાણનું માપન :-

કલ્યાણને નાણાકીય આવક અને વાસ્તવિક આવક દ્વારા માપી શકાય છે. નાણાકીય અને વાસ્તવિક આવક વધે તો કલ્યાણ વધે છે તેમ કહી શકાય.

### (v) મૂલ્ય નિર્ણય :-

સામાજિક કલ્યાણ સિદ્ધ થયું કે નહિ તે નક્કી કરવા અથવા સામાજિક કલ્યાણ શું છે એ નક્કી કરવા માટે મૂલ્ય નિર્ણયો કરવા પડે છે. એટલે કે; સમગ્ર સમાજની દાખિએ શું સારું અને શું ખોટું એ નક્કી કરવું પડે છે. મૂલ્ય નિર્ણયને નીતિશાસ્ત્ર સાથે સંબંધ છે. આર્થિક વિશ્લેષણમાં મૂલ્ય નિર્ણય કરી શકાય છે. સમાજના પ્રતિનિધિ તરીકે રાજ્ય એટલે કે સરકાર મૂલ્ય નિર્ણયો લે છે.

### (6) નાણું :- (Money) :-

#### • નાણાંનો અર્થ :-

કેદીનસની વ્યાખ્યા :- “ જેનાથી લેવડ-ફેવડ તેમજ મૂલ્ય સંબંધી સોંદાઓની પતાવટ થતી હોય તથા જેમાં ખરીદ શક્તિ સંગ્રહાયેલી હોય તેને નાણું કહે છે ”

પ્રો. ફીડમેન :- “ ખરીદ શક્તિના કામ ચલાઉ સંગ્રહસ્થાન તરીકે કામ કરવા શક્તિમાન એવી કોઈપણ અસ્ક્રયામત નાણું છે. ”

## ● નાણાંના લક્ષણો :-

### (i) ખરીદ શક્તિ :-

નાણાંમાં વસ્તુ કે સેવા ખરીદવાની શક્તિ હોય છે. દા.ત. દુકાનદારને રૂ. 100 આપવામાં આવે તો તે ગ્રાહકને 1 કિલો સફરજન આપે છે. જો તે દુકાનદારને ઘડિયાળ આપવામાં આવે તો તે સફરજન આપતો નથી. એટલે કે ચલણી નોટો કે સિક્કા આપવામાં આવે તો જ વસ્તુ મળે છે.

### (ii) વિનિમયનું માધ્યમ :-

નાણું વિનિમયનું માધ્યમ છે, નાણાંથી જ વિનિમય થાય છે. વ્યક્તિને રોજબરોજ વસ્તુ કે સેવાનાં ખરીદ વેચાણ કે આપ લે માટે નાણું જરૂરી છે. એટલે કે, નાણું વિનિમયનાં માધ્યમ તરીકેની કામગીરી બજાવે છે.

### (iii) મૂલ્યનું સંગ્રહક :-

નાણાંના મૂલ્યનો એટલે કે ખરીદ શક્તિનો સંગ્રહ થાય છે કોઈ વસ્તુઓનો સંગ્રહ કરતાં નથી. લોકો જેમાંથી ભવિષ્યમાં અને વર્તમાનમાં વસ્તુઓ અને સેવાઓની ખરીદી કે વેચાણ શક્ય છે તેને સંગ્રહે છે. આવી વસ્તુને નાણું કહે છે. મૂલ્યનો સંગ્રહ જેટલી સહેલાઈથી નાણાંમાં શક્ય છે તેટલો બીજું કોઈ વસ્તુમાં નથી.

## 1.10 સારાંશ :-

ધંધાકીય અર્થશાસ્ત્ર એ સંસાધનોની અછતની વચ્ચે વસ્તુ અને સેવાઓનાં ઉત્પાદન અને વપરાશમાં ગ્રાહકો પેઢીઓ વગેરેનો અભ્યાસ છે. તે તેના ઇન્સ્ટિટ્યુટ લક્ષ્યોને પ્રામ કરવા માટે મયાર્દિત સાધનોનું આયોજન અને ફાળવણી કઈ રીતે કરવી તે દર્શાવે છે. ધંધાકીય અર્થશાસ્ત્રની એક વિશેષ શાખા છે. જે અમૃત આર્થિક સિદ્ધાંત અને મેનેજરીઅલ પ્રેક્ટિસ વચ્ચેનાં અંતરને દૂર કરે છે. માનવીની અમયાર્દિત જરૂરિયાતોની સામે તેનો સંતોષવાના સાધનો મયાર્દિત હોવાથી અછતનો પ્રશ્ન થાય છે. આથી માનવી પોતાને જરૂરિયાતો એવી રીતે પુરી કરે છે જેમાંથી મહત્તમ સંતોષ પ્રામ થાય. જે માટે વિવિધ સંસ્થાઓ, પદ્ધતિઓ અને વ્યવસ્થાઓની રૂચના કરવામાં આવે છે.

જેમાં ઉત્પાદનનાં સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજકોનો ઉત્પાદનમાં ઉપયોગ થાય છે. જમીન કુદરતી સાધન છે. જ્યારે મૂડી, શ્રમ માનવ સર્જિત સાધનો છે. નિયોજકો વેપારી પ્રવૃત્તિ અંગેનાં નિર્ણયો લેવાનું અને જોખમ તેમજ અનિશ્ચિતતાઓ ઉઠાવે છે.

દરેક અર્થતંત્રને તેની મૂળભૂત સમસ્યાઓ હોય છે. શેનું ઉત્પાદન કરવું ? કેટલું ઉત્પાદન કરવું ? કઈ પદ્ધતિથી ઉત્પાદન કરવું ? ઉત્પાદન થયેલ વસ્તુની સમાજનાં વિવિધ વર્ગોમાં વહેંચણી કઈ

રોતે કરવી? ઉત્પાદનનાં સાધનોની ઉત્પાદન શક્તિ કઈ રોતે ટકાવી રાખવી? વગેરે સમસ્યાઓ જોવા મળે છે. ઉત્પાદન શક્તિ વક દ્વારા આ તમામ સમસ્યાઓમાં શું પરિસ્થિતિ હોય તે સમજાવી શકાય છે. જ્યારે અર્થતંત્રમાં ઉત્પાદનનાં બધાં સાધનો ઉત્પાદનમાં રોકાયેલા હોય એટલે કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારોની પરિસ્થિતિ હોય ત્યારે કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન થઈ શકે? અન્ય વસ્તુનાં ઉત્પાદનમાં ઘટાડો કર્યા વગર તેનાં ઉત્પાદનમાં વધારો થઈ શકતો નથી. જો આર્થિક વિકાસ થવાથી બધી જ વસ્તુઓનાં ઉત્પાદનમાં વધારો એક જ વખતે શક્ય બને છે, કારણ કે ઉત્પાદન શક્તિ વક બહારની તરફ ખસે છે.

ઉત્પાદનનાં સાધનોની ફાળવણી જુદી જુદી જુદી હોય છે. મૂડીવાદી આર્થિક પદ્ધતિમાં સાધન ફાળવણી બજારતંત્રની મદદથી થાય છે. મૂડીવાદી અર્થ વ્યવસ્થામાં ખાનગી એકમોની માલિકી હોય છે. જેનો મુખ્ય હેતુ નફાકારતાનો હોય છે. સમાજવાદી અર્થતંત્રમાં સાધનોની માલિકી સમાજની કે રાજ્યની હોય છે. આવી વ્યવસ્થામાં આવક અને સંપત્તિની વહેંચણીમાં અસમાનતા દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. લોકોની સાચી જરૂરિયાતો મુજબ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે. તે મુજબ સાધન ફાળવણી કરવામાં આવે છે. મિશ્ર અર્થ વ્યવસ્થામાં નિર્ણયિકરણની જવાબદારી ખાનગી એકમો અને સરકાર બંને વચ્ચે વહેંચી દેવામાં આવે છે.

અર્થશાસ્ત્રમાં માનવીને આર્થિક વર્તનનો અભ્યાસ સમજવા પાયાનાં ખ્યાલો સમજવા જરૂરી બને છે. તુલ્યીગુણ, સંપત્તિ, નાણું, વિનિમય, મૂલ્ય વગેરે મહત્વનાં ખ્યાલો છે. વસ્તુઓ અને સેવાઓના પ્રવાહોની બનેલી આર્થિક પદ્ધતિ તરીકે અર્થતંત્રને સમજ શકાય છે. જેમાં વ્યક્તિ, કુટુંબ, પેઢી, ઉદ્યોગ, ઉત્પાદક, વેચનાર, સરકાર વગેરે જુદા જુદા ક્ષેત્રો વચ્ચે આર્થિક પ્રવાહો ચાલતાં હોય છે. એક વ્યક્તિ અન્ય પાસેથી વસ્તુ ખરીદે છે, પોતાની વસ્તુ બીજાને વેચે છે. દરેક વ્યક્તિ, કુટુંબ કે સમાજ વિવિધ કારણોના પ્રતિસાદરૂપે આર્થિક એકમોને અર્થશાસ્ત્રનાં વિવિધ સિદ્ધાંતો દ્વારા સમજાવે છે. અર્થશાસ્ત્રનાં સિદ્ધાંતો ધારણાઓ આધારિત તેમજ વાસ્તવિકતા આધારિત તર્કની મદદથી રચાયા હોય છે. તેના આધારે તારણો કાઢવામાં આવે છે. બીજી બાજુ હકીકત આધારિત તર્કમાં હકીકતો એકત્રિત કરીને વિવિધ બળો અને ઉદ્દીપનો સામેનાં પ્રતિસાદરૂપે આર્થિક એકમોની વર્તણુંકનાં સ્વરૂપને શોધી કાઢવા પ્રયાસ કરવામાં આવે છે.

### 1.11 ચાવીરૂપ શબ્દો :- (Key- Words)

- (1) શ્રમ :- ભૌતિક અને માનાસિક માનવ પુરુષાર્થ જેનો ઉપયોગ ઉત્પાદન માટે નીપજકો તરીકે થાય છે.
- (2) નિક્ષેપ/નીપજક :- વસ્તુ કે જેનો ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગ થાય છે.

- (3) જમીન :- કુદરત દ્વારા વિના મૂલ્યે પ્રામ થયેલ ઉત્પાદનના સાધનો. જેમાં ખેતી કામની ભૂમિ, ઔદ્યોગિક હેતુની ભૂમિ, અને ધરતીની ઉપર અને અંદરથી મળતાં કુદરતી સંસાધનોનો સમાવેશ થાય છે.
- (4) ઉત્પાદન :- વિવિધ પદ્ધતિઓ દ્વારા વસ્તુના તુણ્ણુણું સર્જન કરવું.
- (5) મૂડી :- ઉત્પાદિત અથવા માનવસર્જિત ઉત્પાદનનાં સાધનો.
- (6) આર્થિક ઘટકો :- આર્થિક પદ્ધતિમાં નિર્ણય કરનારાં આર્થિક એકમો.
- (7) આર્થિક પદ્ધતિ અથવા અર્થતંત્ર :- બધી જ સંસ્થાઓ પદ્ધતિઓ અને વ્યવસ્થાઓ કે જેના વડે અમયાર્દિત જરૂરિયાતોના સાધનોની અછતની સમસ્યા હલ કરવાનો પ્રયાસ થાય છે અને કઈ જરૂરિયાતો સંતોષવી તેની પસંદગી થાય છે.
- (8) નિયોજન :- વ્યાવસાયિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ જોખમ લેનાર અને આખરી નિર્ણય કરનાર એકમ નિયોજન ઉત્પાદન વ્યવસ્થાના પ્રબંધનું કાર્ય છે.
- (9) મધ્યવર્તી વસ્તુ :- ઉત્પાદનમાં વપરાતાં નીયોજક.
- (10) મોજશોખની વસ્તુઓ :- સામાજિક મોખા કે દરજા માટેની વસ્તુઓ.
- (11) વિનિમય મૂલ્ય :- કોઈ પણ વસ્તુ બજારમાં જે મળી શકે તે કિંમત.
- (12) સરેરાશ તુલ્યીગુણ :- કુલ ભાગ્ય વસ્તુના કુલ તુલ્યીગુણ એકમો.
- (13) વસ્તુ વિનિમય :- વસ્તુ અને સેવાના બદલામાં આપેલ અન્ય વસ્તુ અને સેવાની આપવી.
- (14) અર્થશાસ્ત્રના સિદ્ધાંતો :- વિવિધ બળો અને ઉદ્વીપનો સામેના આર્થિક એકમોના પ્રામાર્દ અથવા તારવેલા પ્રતિસાદનાં વલણો અને વિવિધ વલણો સમજાવતાં વિધાનો.
- (15) પ્રાથમિક જરૂરિયાતો :- કિંદળીને વધુ આરામ દાયક બનાવવા અથવા ઉત્પાદક શક્તિ વધારવા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ.
- (16) ગતિશીલ અર્થશાસ્ત્ર :- સ્થિર ધારી લેવાયેલા ચલ પરિમાણોમાં તેમજ અન્ય પરિબળોમાં ગમે તે ફેરફાર થાય છે તેવું માનીને થતાં આર્થિક વિશ્વેષણની પદ્ધતિ. અભ્યાસ હેઠળના ચલ પરિમાણની સ્થિતિ તેના ફેરફારના માર્ગ શોધીને નક્કી કરવામાં આવે છે.
- (17) તુણ્ણુણું :- વસ્તુની જરૂરિયાતને સંતોષવાની શક્તિ કે જે ઉપભોક્તાને સંતોષ આપે છે.
- (18) કુલ તુણ્ણુણું :- વસ્તુનાં બધાં જ એકમોના ઉપભોગમાંથી મળતો કુલ સંતોષ.
- (19) ઉપયોગિતા મૂલ્ય :- વસ્તુનો તુણ્ણુણું.
- (20) વૈકલ્પિક ખર્ચ :- જતા કરાતા બીજા શ્રેષ્ઠના વિકલ્પનો લાભ પસંદ કરેલા વિકલ્પનું વિકલ્પાર્થી ખર્ચ છે.
- (21) પુરવઠો :- આપેલ સમયગાળા દરમિયાન ચોક્કસ કિંમતે વેચનાર દ્વારા વેચાણ માટે મુકવામાં આવતા વસ્તુના એકમોનો જથ્થો.

- (22) સામાન્ય :- કોઈપણ ચલ પરિમાણના સૌથી વધારે વખત જેવા મળતાં વલણની સામાન્ય સ્થિતિ.
- (23) નાણાં વિનિમય :- નાણાંની સામે વસ્તુ અને સેવાનું વેચાણ.
- (24) સીમાંત :- કોઈપણ ચલ પરિમાણના એક વધુ એકમનું મૂલ્ય.
- (25) સીમાંત - તુછિગુણ :- વસ્તુના એક વધુ એકમના ઉપભોગમાંથી મળતો વધારાનો સંતોષ.
- (26) અભ્યાસ પદ્ધતિ :- વિશ્લેષણનાં સાધનો પાયાની માહિતીના એકત્રીકરણ અને ઉપયોગ અને લાગુ કરવામાં આવતા તર્ક ને દર્શાવતી પદ્ધતિ.
- (27) વસ્તુલક્ષી અર્થશાસ્ત્ર :- આર્થિક વિશ્લેષણનો એવો ભાગ કે જે “શું છે” તેનો અભ્યાસ કરે છે પણ તે ઈછ છે કે અનિષ્ટ તેના તરફ ધ્યાન આપતો નથી અને વર્તમાન સ્થિતિને સુધારવાના ઉકેલો સૂચવતો નથી.
- (28) આદર્શલક્ષી અર્થશાસ્ત્ર :- આર્થિક વિશ્લેષણનો એવો ભાગ કે “શું હોવું જોઈએ” તેનો અભ્યાસ કરે છે અને વર્તમાન સ્થિતિ કેવી રીતે સુધારી શકાય તેના ઉકેલો દર્શાવે છે.
- (29) સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર :- સમગ્ર અર્થતંત્ર અથવા તેના મોટા હિસ્સાની ફાળવણીને અભ્યાસ કરતી અર્થશાસ્ત્રની એક શાખા.
- (30) એકમલક્ષી અર્થશાસ્ત્ર :- આર્થિક વિશ્લેષણની એવી શાખા કે જે વ્યક્તિગત આર્થિક એકમ અથવા તેના નાના સમૂહનો અભ્યાસ કરે છે અને વ્યક્તિગત વસ્તુની કિંમત અને એકમલક્ષી ચલ પરિમાણોને ધ્યાનમાં લેવાય છે.
- (31) સ્વૈતિક અર્થશાસ્ત્ર :- વિશ્લેષણની એક પદ્ધતિ કે જેમાં મૂળ સમતુલા અને નવી સમતુલાની સ્થિતિની તુલના કરવામાં આવે છે તે માટે અર્થતંત્રની પાયાની બાબતો બદલાતી નથી તેવી ધારણા કરવામાં આવે છે.
- (32) મૂડીવાદ :- ઉત્પાદનનાં સાધનોની માલિકી ખાનગી હોય છે અને ઉત્પાદન મુખ્યત્વે બજાર માટે હોય છે.
- (33) જાહેર ક્ષેત્ર :- ઉત્પાદનનાં સાધનોની માલિકી સરકારની હોય છે તે લોકોના વિશાળ હિત માટે જે ઉત્પાદન કરે છે.
- (34) ખાનગી ક્ષેત્ર :- ઉત્પાદનનાં સાધનોની માલિકી અંગત હોય અને જ્યાં નફા માટે ઉત્પાદન થાય છે તેવું ક્ષેત્ર.
- (35) ઉત્પાદક બળો :- ઉત્પાદનનાં સાધનો અને શ્રમશક્તિ વચ્ચેની આંતરકિયા.
- (36) બજાર તંત્ર :- વસ્તુ તેમજ સાધનના ખરીદનાર અને વેચનાર વચ્ચેની આંતરકિયાની વ્યવસ્થા.
- (37) પ્રાથમિક સમાજ :- માણસે છ થી સાત હજાર વર્ષ પહેલાં કરેલી સૌ પ્રથમ વ્યવસ્થા.
- (38) ઉત્પાદકોનું સાર્વભૌમત્વ :- વિજ્ઞાનના જોરે ઉત્પાદક ગમે તે ચીજ વેચી શકે તેવી સ્થિતિ.
- (39) ઉત્પાદનના સંબંધો :- ઉત્પાદન પ્રક્રિયાના પરિણામે સર્જિતા લોકો વચ્ચેના સંબંધો.
- (40) નફાનો ઉદ્દેશ :- નફો કમાવાનો ઉદ્દેશ કે જે ખાનગી ક્ષેત્રના ઉત્પાદકને આર્થિક પ્રવૃત્તિ તરફ પ્રેરિત કરે છે.

- (41) સમાજવાદ :- ઉત્પાદનનાં સાધનો રાજ્યની માલિકીનાં હોય અને જેમાં સમાજની જરૂરિયાતને અંદાજીત વસ્તુનું ઉત્પાદન થતું હોય.
- (42) સમાજવાદી સંચય :- સમાજવાદી ક્ષેત્રમાં સંસાધનોનું એકત્રીકરણ જે પોતાના વિસ્તાર માટે હોય.
- (43) વેપારી પ્રથા :- એવી વ્યવસ્થા કે જેમાં વેપારી કારીગરને કાચો માલ આપી વસ્તુનું ઉત્પાદન કરાવતો હતો અને તેની રકમ લઈને કારીગર વસ્તુનું ઉત્પાદન વેપારીને પૂરું પાડતો.
- (44) મિશ્ર અર્થતંત્ર :- જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રના સહ આસ્તિત્વવાળી આર્થિક પદ્ધતિ.
- (45) પ્રાથમિક સમાજવાદ :- સમાજવાદી ક્ષેત્રના વિકાસ માટે બિનસમાજવાદી ક્ષેત્રમાં મૂડી- સંચય કરવો.
- (46) આયોજિત અર્થતંત્ર :- બજાર તંત્રના બદલે આર્થિક આયોજનને નિષાયિક કામ કરવાનું હોય તેવી પદ્ધતિ.

## 1.12 સ્વાધ્યાય

1. આર્થિક વ્યવસ્થા એટલે શું ?
  2. આર્થિક એકમો વિશે જણાવો ?
  3. જરૂરિયાતો અમયાદિત બને છે તે માટે જવાબદાર બે લક્ષણો જણાવો.
  4. વિકાસની સમસ્યા વિશે જણાવો
  5. મૂડી નિર્માણ એટલે શું ?
  6. અર્થતંત્રની મૂળભૂત સમસ્યાઓ કઈ કઈ છે ?
  7. ખાનગી અને જાહેર વસ્તુઓ વચ્ચેનો ભેદ ટૂંકમાં સમજાવો ?
  8. ઉત્પાદન શક્યતા વક એટલે શું ?
  9. મૂડીવાદી અર્થતંત્રના સંસાધનની ફાળવણી વિશે ટૂંકમાં સમજાવો ?
  10. મિશ્ર અર્થતંત્રમાં સાધન ફાળવણી વિશે જણાવો ?
  11. “ઇણતમ ” નો ઘ્યાલ સમજાવો ?
  12. એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વિશે ટૂંકમાં સમજાવો ?
  13. મિશ્ર અર્થતંત્રના લક્ષણો જણાવો.
1. આર્થિક પદ્ધતિ એટલે શું ? અર્થતંત્રની મૂળભૂત સમસ્યાઓ એટલે શું ?
  2. માનવ જરૂરિયાતોનાં મુખ્ય લક્ષણો કયાં છે ?
  3. અર્થતંત્રની મૂળભૂત સમસ્યાઓના નિરાકરણો એકબીજા સાથે સંબંધિત હોય છે તે સમજાવો.

4. "અધ્યત" તે દરેક આર્થિક પદ્ધતિની માતા છે તે સમજાવો.
  5. ઉત્પાદન શક્યતા વકનો ખ્યાલ સમજાવો, અને તેની ધારણાઓ સમજાવી ઉદાહરણ આપીને સમજૂતી આપો.
  6. ઉત્પાદનના સાધનોનો અર્થ જણાવો. ચાર સાધનોમાંથી દરેક સાધનની સમજૂતી આપો.
- 8. ટૂંક નોંધ લખો.**
- (અ) માનવ જરૂરિયાતો.
  - (બ) ખાનગી અને જાહેર વસ્તુઓ.
9. વસ્તુલક્ષી અને આદર્શલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો ભેદ સમજાવો. કયા અર્થશાસ્ત્રને શા માટે પસંદ કરવું જોઈએ ?
  10. દરેક આધુનિક અર્થતંત્ર ગતિશીલ હોય છે તેના કારણો સમજાવો.
  11. કયા સ્વરૂપમાં વિકલ્પથી ખર્ચ વ્યક્ત થાય છે – ઉત્પાદક માટે, સાધન માલિક માટે, ઉપભોક્તા માટે?
  12. તફાવત સમજાવો.
    - (અ) ગતિશીલ અર્થશાસ્ત્ર અને સ્થૈનિક અર્થશાસ્ત્ર
    - (બ) સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર અને એકમળક્ષી અર્થશાસ્ત્ર

**13. ટૂંક નોંધ લખો.**

    - (અ) અર્થશાસ્ત્રના સિદ્ધાંતોની મર્યાદાઓ.
    - (બ) સમતુલાનો ખ્યાલ.
    - (ક) જથ્થા અને પ્રવાહો વિશે ટૂંક નોંધ લખો.
    - (ઢ) ફેરફારનો માર્ગ શોધવો અંગે ટૂંક નોંધ લખો.
    14. આર્થિક પદ્ધતિ એટલે શું અને આર્થિક પદ્ધતિનાં વિવિધ સ્વરૂપોની ચર્ચા કરો ?
    15. મૂડીવાદનાં લક્ષણો સમજાવો અને તેમાં બજારતંત્રની ભૂમિકા વર્ણવો.
    16. મિશ્ર અર્થતંત્રના લક્ષણો અને તેની મર્યાદાઓ જણાવો.
    17. સમાજવાદ એટલે શું ? તેનાં લક્ષણો જણાવો.
    18. નીચેનામાંથી કયું વિધાન ખરું કે ખોટું છે તે લખો.
    1. બધાજ માણસોની જરૂરિયાતો મર્યાદિત હોય છે.
    2. બધાજ વ્યક્તિઓની જરૂરિયાતો એકસરખી હોય છે.
    3. કેટલીક આર્થિક વ્યવસ્થાઓમાં બધીજ વ્યક્તિઓની બધીજ જરૂરિયાતોને સંતોષવાનું શક્ય હોય છે.
    4. વ્યક્તિની બધીજ જરૂરિયાતોનો આધાર તેની આવક ઉપર જ છે.
    5. જરૂરિયાતો અને તેમને સંતોષવાનાં સાધનોના વૈકલ્પિક સંયોજન શક્ય છે.

6. જરૂરિયાતો અને તેમને સંતોષવાનાં સાધનોના વિવિધ વૈકલ્પિક સંયોજન શક્ય છે.
7. કમિશન એજાન્ટોની માફક આર્થિક એકમો અન્યોને ખરીદી કે વેચાણની પ્રવૃત્તિ કરવામાં ઉપયોગી બને છે.
8. ખાનગી વસ્તુઓ બધી જ વ્યક્તિઓને મફત મળે છે.
9. બધાં અર્થતંત્રોમાં ઉત્પાદક સાધનોની ફાળવણી એક સમાન હોય છે.
10. જે પણ વસ્તુઓનો પુરવઠો પસંદગીની વ્યક્તિઓ પૂરતો સીમિત હોતો નથી તેને સાર્વજનિક વસ્તુઓ કહે છે.
11. બજાર આધારિત અર્થતંત્રમાં સાધન ફાળવણી હંમેશા સમાજની સાચી જરૂરિયાતો મુજબ જ થાય છે.
12. ચોક્કસતા પૂર્વકની આગાહી કરવામાં અર્થશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે.
13. અવલોકન કરેલી હકીકતોના આધારે હકીકતલક્ષી તર્ક કામ કરે છે.
14. ભૌતિક વિજ્ઞાનોના સિદ્ધાંતો જેટલા ચોક્કસ અર્થશાસ્ત્રના સિદ્ધાંતો હોતા નથી.
15. અર્થશાસ્ત્રનો દરેક સિદ્ધાંત “અન્ય” પરિબળો યથાવત રહેશે એવી શરત હેઠળ જ કામ કરે છે.
16. અનુમાન આધારિત તર્કમાં બધીજ ધારણાઓ અવાસ્તવિક હોય છે.
17. બાકીના સામાજિક સિદ્ધાંતોથી અર્થશાસ્ત્રના સિદ્ધાંતોને હંમેશા અલગ પાડી શકાય છે.

જવાબો :

- |      |       |      |       |      |       |      |       |      |     |
|------|-------|------|-------|------|-------|------|-------|------|-----|
| (૧)  | ખોટું | (૨)  | ખોટું | (૩)  | ખોટું | (૪)  | ખોટું | (૫)  | ખરુ |
| (૬)  | ખરુ   | (૭)  | ખરુ   | (૮)  | ખોટું | (૯)  | ખોટું | (૧૦) | ખરુ |
| (૧૧) | ખોટું | (૧૨) | ખરુ   | (૧૩) | ખરુ   | (૧૪) | ખરુ   | (૧૫) | ખરુ |
| (૧૬) | ખોટું | (૧૭) | ખોટું |      |       |      |       |      |     |

### M C Q.

- યોગ્ય વિકલ્પ શોધી જવાબ આપો.

1. અર્થશાસ્ત્રની મૂળભૂત આર્થિક સમસ્યાઓ કેટલી છે ?
 

(અ)	એક	(બ)	બે
(ક)	ત્રણ	(દ)	પાંચ
2. આર્થિક સમસ્યાઓ શામાંથી ઉદ્ભવે છે ?
 

(અ)	માંગ	(બ)	પુરવઠો
(ક)	છાત	(દ)	અદ્ધત
3. ઉત્પાદનનું કયું સાધન માનવસર્જિત છે.

(અ) જમીન (બ) મૂડી

(ક) તળાવ (ઝ) શ્રમ

4. મૂડીવાદી અર્થતંત્રમાં કોની માલિકી હોય છે ?

(અ) ખાનગી એકમ (બ) રાજ્ય સરકાર

(ક) સમાજ (ઝ) એક પણ નહીં

5. કયા પ્રકારનાં અર્થતંત્રમાં ખાનગી અને જાહેરકોને કામગીરી સોંપવામાં આવે છે ?

(અ) સમાજવાદી અર્થતંત્ર (બ) મિશ્ર અર્થતંત્ર

(ક) ખાનગી અર્થતંત્ર (ઝ) મૂડીવાદી અર્થતંત્ર

6. “ An Enquiry in to the Nature And Courses of Wealth of Nation’s”આ પુસ્તક કયા અર્થશાસ્ત્રીનું છે.

(અ) રોબર્ટસ (બ) પ્રો. માર્શલ

(ક) એડમ સ્મિથ (ઝ) પ્રો. કેઈન્સ

7. ઉત્પાદનનું ક્યું સાધન અત્યંત નાશવંત છે.

(અ) જમીન (બ) મૂડી

(ક) શ્રમ (ઝ) નિયોજક

8. ઉત્પાદન શક્યતા વકનો દાળ કેવો હોય છે ?

(અ) ધન (બ) અંતર્ગોળ

(ક) બાહ્યગોળ (ઝ) કાટખૂણાવાળો

9. તુલ્ણિગુણનો ઘ્યાલ કેવો છે ?

(અ) સાપેક્ષ (બ) નિરપેક્ષ

(ક) ઉપરનાં બંને (ઝ) ઉપરમાંથી એકપણ નાલિ

10. જે વસ્તુનો વિનિમય ન થઈ શકે તેવી વસ્તુને શું કહેવાય ?

(અ) આર્થિક વસ્તુ (બ) બિનઆર્થિક વસ્તુ

(ક) બાહ્ય વસ્તુ (ઝ) આંતરિક વસ્તુ

11. નાણાંનાં મૂલ્યને શેના દ્વારા વ્યક્ત કરવામાં આવે છે ?

(અ) વસ્તુઓ (બ) સેવાઓ

(ક) ચલણી નાણું (ઝ) ઉપરમાંથી એકપણ નાલિ

12. નીચેમાંથી કઈ સંપત્તિ સામાજિક સંપત્તિ છે ?

(અ) મોટરકાર (બ) મકાન

(ક) કુવો (ઝ) રેલ્વ

13. જે વસ્તુની છત હોય તે કયા પ્રકારની વસ્તુ કહેવાય ?

(અ) સર્વસુલભ વસ્તુ (બ) આર્થિક વસ્તુ

(ક) મૂડી વસ્તુ (ઝ) વપરાશી વસ્તુ

14. ઉત્પાદનની પ્રક્રિયામાં નીચેનામાંથી શું હોવું જરૂરી છે ?  
 (અ) તુલ્યગુણ      (બ) વિનિમય મૂલ્ય  
 (ક) ઉત્પાદન ખર્ચ      (ઝ) કાચો માલ
15. નીચેમાંથી કયા સાધનનો પુરવઠો મયોડિત છે.  
 (અ) જમીન      (બ) મૂડી  
 (ક) શ્રમ      (ઝ) નિયોજન શક્તિ
16. ઉત્પાદનનું કયું સાધન આનિશ્વિતા ઉઠાવે છે ?  
 (અ) શ્રમ      (બ) મૂડી  
 (ક) નિયોજક      (ઝ) જમીન
17. એડમ સ્મેથ અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં કેવી સંપત્તિનો ઉલ્લેખ કરે છે ?  
 (અ) ભૌતિક      (બ) અભૌતિક  
 (ક) સામાજિક      (ઝ) અદશ્ય
18. રોબિન્સ અર્થશાસ્ત્રને કેવું શાસ્ત્ર કહે છે ?  
 (અ) નાણાનું      (બ) ત્રવેડ  
 (ક) મૂડીનું      (ઝ) સમાજનું
19. ટેલ્ફોન- ખુરશીને કેવી વસ્તુ કહેવાય ?  
 (અ) ભૌતિક      (બ) અભૌતિક  
 (ક) પ્રવાહી      (ઝ) એક પણ નાથી
20. જો સાધનોની ઉત્પાદન ક્ષમતા વધે તો ઉત્પાદન શક્યતા રેખા કઈ બાજુ ખસશે ?  
 (અ) જમણી બાજુ      (બ) ડાબી બાજુ  
 (ક) સ્થિર રહેશે      (ઝ) સીધી રેખા થશે

જવાબ :

- (૧) (૩) (૨) (૩) (૩) (૬) (૪) (૫) (૫) (૬)  
 (૬) (૫) (૭) (૫) (૮) (૬) (૯) (૬) (૧૦) (૬)  
 (૧૧) (૫) (૧૨) (૩) (૧૩) (૫) (૧૪) (૩) (૧૫) (૫)  
 (૧૬) (૫) (૧૭) (૫) (૧૮) (૬) (૧૯) (૬) (૨૦) (૫)

## : રૂપરેખા :

- 2.1 પ્રસ્તાવના.
- 2.2 તુલ્યાંગુણ.
- 2.3 તટસ્થતા વકોનું પૃથ્વીકરણ.
- 2.4 વપરાશકારની માંગ.
- 2.5 માંગની સ્થિતિ સ્થાપકતાનાં ઘ્યાલો.
- 2.6 સારાંશ, ચાવીરૂપ શરૂઆતો.
- 2.7 સ્વાધ્યાય.

- ઘટતાં સીમાંત તુલ્યાંગુણનો નિયમ :-** (Law of Diminishing Marginal Utility)

- તુલ્યાંગુણનો અર્થ :-** (Utility)

“કોઈપણ વસ્તુ કે સેવામાં રહેલો માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે તુલ્યાંગુણ” દા.ત. તરસ લાળી હોય તો પાણી કે ઠંડા પીણામાં વ્યક્તિની તરસ છીપાવવાનો ગુણ કે તુલ્યાંગુણ રહેલો છે.

- કુલ તુલ્યાંગુણ :-** (Total Utility)

“વાપરવામાં આવતી વસ્તુનાં તમામ એકમોમાંથી પ્રાપ્ત થતાં તુલ્યાંગુણના સરવાળાને કુલ તુલ્યાંગુણ કહે છે.”

દા. ત. ગ્રાહક ગુલાબજાંબુની વપરાશ કરે છે તેના જુદા જુદા એકમોમાંથી પ્રાપ્ત થતો તુલ્યાંગુણ નીચે મુજબ છે.

એકમ	તુલ્યાંગુણ
1	25
2	20
3	15
4	10
5	5

અહીં ગ્રાહક ગુલાબજાંબુનાં કુલ પાંચ એકમોની વપરાશ કરે છે, તેને પ્રથમ એકમમાંથી 25 એકમ જેટલો તુલ્યાંગુણ મળે છે એ જ રીતે કમશા: બીજા, ત્રીજા, ચોથા અને પાંચમાં એકમનો

વપરાશ કરવાથી કમશા: 20, 15, 10 અને 5 એકમ જેટલો તુલ્યગુણ મળે છે. અહીં ગુલાબજાંબુનાં 5 એકમોનો વપરાશ કરવાથી કુલ તુલ્યગુણ  $25 + 20 + 15 + 10 + 5 = 75$  એકમ જેટલો થાય છે.

- સીમાંત તુલ્યગુણ (Marginal Utility) Mu :-

“કોઈપણ વાપરવામાં આવતી વસ્તુનાં વપરાશમાં એક એકમનો વધારો કરવાથી કુલ તુલ્યગુણમાં જે ફેરફાર થાય છે તેને સીમાંત તુલ્યગુણ કહે છે.”

દા. ત. વ્યક્તિ ગુલાબજાંબુનાં 5 એકમની વપરાશ કરે છે ત્યારે કુલ તુલ્યગુણ 75 એકમ જેટલો મળે છે. જો તે ગુલાબજાંબુની વપરાશમાં એક એકમનો વધારો કરે એટલે કે 6 એકમ વાપરે તો કુલ તુલ્યગુણ 78 એકમ જેટલો મળે છે. આમ વધારાનો એક એકમ વાપરવાથી કુલ તુલ્યગુણમાં  $78 - 75 = 3$  એકમનો થતો વધારો એ સીમાંત તુલ્યગુણ છે.

- ઘટતાં સીમાંત તુલ્યગુણનો નિયમ :-

ઘટતાં સીમાંત તુલ્યગુણના નિયમની રજુઆત સૌ પ્રથમ જર્મન અર્થશાસ્તી પ્રા. ગોસેને કરી હતી. આથી આ નિયમને ગોસેનના નિયમ નં. 1 તરીકે પણ ઓળખાવે છે.

પ્રો. માર્શલ ઘટતાં સીમાંત તુલ્યગુણના નિયમનો અર્થ સમજાવતાં કહે છે કે “કોઈ એક સમાનગુણી વસ્તુના વપરાશમાં જેમ જેમ એક એકમનો વધારો કરવામાં આવે છે તેમ તેમ જરૂરિયાત સંપૂર્ણપણે સંતોષાય નહિ ત્યાં સુધી વધારાના દરેક એકમમાંથી પ્રાપ્ત થતો સીમાંત તુલ્યગુણ ઘટતો જાય છે.”

- ઘટતાં સીમાંત તુલ્યગુણનાં નિયમની ધારણાઓ :-

- (1) સમાનગુણી એકમો :-

વાપરવામાં આવતી વસ્તુનાં એકમો સમાનગુણી છે. એટલે કે વસ્તુના દરેક એકમના રૂપ, સ્વાદ, કદ, વજન, આકાર વગેરે એક સરખાં હોવા જોઈએ. દા.ત. વ્યક્તિ કેરીની વપરાશ કરે તેમાં પ્રથમ કેરી ખાટી હોય, બીજી કેરી મીઠી હોય તો સીમાંત તુલ્યગુણ ઘટવાને બદલે વધે છે. આથી વસ્તુના દરેક એકમ સમાનગુણી હોવાં જોઈએ.

- (2) સમાન કદ:-

વપરાશમાં લેવામાં આવતી વસ્તુના એકમો વ્યાજબી કદના હોવા જોઈએ. દા.ત. રોટલી ખાતા હોય તો રોટલીનું કદ યોગ્ય હોવું જોઈએ. અત્યંત નાની કે અત્યંત મોટી રોટલી ન હોવી જોઈએ.

(3) સમયાંતરનો અભાવ :-

વસ્તુની વપરાશકિયા દરમ્યાન સમયનું અંતર ન પડવું જોઈએ. એટલે કે વસ્તુના દરેક એકમનો એક પછી એક સતત વપરાશ કરવામાં આવે છે. દા.ત. તરસ લાગી હોય તો વ્યક્તિ પાણીનો પ્રથમ ગલાસ, પછી તરત બીજો ગલાસ, તરત ત્રીજો ગલાસ વાપરવાથી સીમાંત તુલ્યીગુણ ઘટે છે.

(4) ગ્રાહકોનો સ્વભાવ, રૂચિ, ફેશન, ટેવ બદલાતાં નથી :-

ગ્રાહકોનો સ્વભાવ સામાન્ય હોવો જોઈએ. તેનું વર્તન બુધ્ય પૂર્વકનું હોવું જોઈએ. તેના રૂચિ, ફેશન, ટેવ બદલાતાં નથી. જો તેમાં ફેરફાર થાય તો વસ્તુના પ્રત્યેક એકમમાંથી મળતો તુલ્યીગુણ ઘટવાને બદલે વધે છે.

(5) તુલ્યીગુણ માપી શકાય છે :-

વાપરવામાં આવતી વસ્તુના દરેક એકમમાંથી કેટલો તુલ્યીગુણ મળે છે તે માપી શકાય છે.


(6) અન્ય વસ્તુથી સ્વતંત્ર વસ્તુ :-

વાપરવામાં આવતી વસ્તુ અન્ય વસ્તુથી સ્વતંત્ર વસ્તુ છે. એટલે કે તે કોઈ અન્ય વસ્તુની અવેજી, હરીફ કે પૂરક વસ્તુ નથી. આથી તે વસ્તુના જથ્થામાં વધારો થાય તો પણ અન્ય વસ્તુના ફેરફારની તેના તુલ્યીગુણ પર કોઈ અસર થતી નથી.

ઘટતાં સીમાંત તુલ્યીગુણની અનુસૂચિ :-

વસ્તુના એકમો	કુલ તુલ્યીગુણ Tu	સીમાંત તુલ્યીગુણ Mu
1	5	5
2	9	4
3	12	3
4	14	2
5	15	1
6	15	0
7	13	-2

આકૃતિ દ્વારા સમજૂતી :-



ઉપરોક્ત આકૃતિમાં OX ધરી પર વસ્તુનાં એકમો અને OY ધરી પર કુલ તુલ્યીગુણ અને સીમાંત તુલ્યીગુણ દર્શાવવામાં આવ્યાં છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ વ્યક્તિ વસ્તુનો પ્રથમ એકમ વપરાશ કરે છે ત્યારે કુલ તુ. ગુ. 5 એકમ જેટલો થાય છે. એ જ રીતે કમશા: ક્રિતિય, તૃતિય, ચોથો, પાંચમો એકમ વાપરે છે ત્યારે અનુક્રમે 9, 12, 14 અને 15 એકમ છઢા એકમનો વપરાશ કરે છે ત્યારે પહેલા જેટલો જ એટલે કે 15 એકમ જેટલો તુલ્યીગુણ મળે છે, સાતમા એકમે કુલ તુલ્યીગુણ 13 એકમ જેટલો થાય છે. આ તમામ બિંદુઓને જોડતાં કુલ તુલ્યીગુણની રેખા TY પ્રામ થાય છે. ઉધા ‘U’ આકારની છે. જે દર્શાવે છે કે વસ્તુની વપરાશની શરૂઆતમાં કુલ તુ. ગુ. વધે છે. આથી કુલ તુલ્યીગુણ રેખા ધન ઘણવાળી બને છે, 5 અને 6 એકમે કુલ તુલ્યીગુણ 15 એકમ જેટલો સ્થિર થાય છે આથી કુલ તુલ્યીગુણની રેખા શૂન્ય ઘણવાળી બને છે અને સાતમા એકમો કુલ તુલ્યીગુણ ઘટીને 13 એકમ જેટલો થાય છે. આથી કુલ તુલ્યીગુણની રેખા ઝાંખ ઘણવાળી બને છે.

આકૃતિમાં Mu રેખા સીમાંત તુ. ગુ. ની રેખા છે. જે ઝાંખ ઘણવાળી છે. જે દર્શાવે છે કે વ્યક્તિ જેમ જેમ વસ્તુના વપરાશમાં એક એક એકમનો વધારો કરતો જાય છે તેમ તેમ તેમાંથી પ્રામ થતો સીમાંત તુલ્યીગુણ ઘટતો જાય છે, શૂન્ય થાય છે અને નકારાત્મક થાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વ્યક્તિ અનુક્રમે પ્રથમ, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમાં એકમની વપરાશ કરે છે તેમ તેમ તેમાંથી પ્રામ થતો સીમાંત તુલ્યીગુણ ઘટીને અનુક્રમે 5, 4, 3, 2 અને 1 એકમ જેટલો થાય છે, છઢા એકમે શૂન્ય અને સાતમા એકમે – 2 એકમ એટલે કે નકારાત્મક તુલ્યીગુણ પ્રામ થાય છે.

#### ● ઘટતાં સીમાંત તુલ્યીગુણનાં નિયમનાં અપવાદો :-

વ્યક્તિ જ્યારે સમાનગુણી વસ્તુનો સતત વપરાશ કરે છે તો તેમાંથી પ્રામ થતો સીમાંત તુલ્યીગુણ ઘટતો જાય છે પરંતુ કેટલીક વસ્તુઓની બાબતમાં ઘટતાં સીમાંત તુલ્યીગુણનાં નિયમથી ઉલ્લંઘન બને છે એટલે કે આવી વસ્તુઓની વપરાશમાં જેમ જેમ એક એક એકમનો વધારો કરે છે તેમ તેમ તેમાંથી પ્રામ થતો સીમાંત તુલ્યીગુણ વધતો જાય છે.

#### (1) ખૂબ શરૂઆતમાં :-

વ્યક્તિ જ્યારે કોઈ વસ્તુની વપરાશની શરૂઆત કરે છે ત્યારે તેને પ્રથમ એકમ કરતાં બીજો એકમમાંથી વધુ સંતોષ મળે છે. જેમ કે, કોઈ વ્યક્તિને ખૂબ જ તરસ લાગી હોય ત્યારે પ્રથમ જ્વાસ પાણી પીએ પણ તેની તરસ છીપાતી નથી તે બીજો જ્વાસ પાણી માટે તલપાપડ થઈ જાય છે અને જ્યારે તે બીજો જ્વાસ પાણી પીએ ત્યારે તેને વધારે સંતોષ પ્રામ થાય છે.

#### (2) મદીરા પાન :-

દારૂદિયા માટે ઘટતાં સીમાંત તુલ્યીગુણનાં નિયમથી ઉલ્લંઘન બને છે. દારૂદિયો જેમ વધુને વધુ દારૂ પીએ તેમ તેને વધુ ને વધુ સંતોષ પ્રામ થાય છે. જો કે વધારે દારૂ પીવાથી વ્યક્તિનું વર્તન

બદલાય છે જ્યારે ઘટતાં સીમાંત તુલ્લીગુણનાં નિયમ મુજબ ગ્રાહકનું વર્તન સ્થિર રહેવું જોઈએ.  
દારૂદિયો અસામાન્ય વર્તણૂંક ધરાવનાર વ્યક્તિ છે.

### (3) નાણું અથવા ધન લાલચ :-

કેટલીક વ્યક્તિ એવી હોય છે કે જેની પાસે નાણું કે ધનનું જેમ જેમ પ્રમાણ વધે તેમ તેમ તેના સીમાંત તુલ્લીગુણમાં વધારો થતો જાય છે. કંજુસ વ્યક્તિઓ કે જેને પોતાની બેંકની પાસબુકનાં આંકડા વધુને વધુ મોટા થતાં હોય તેમાં આનંદ આવતો હોય છે. આવી વ્યક્તિઓની બાબતમાં ઘટતાં સીમાંત તુલ્લીગુણનો નિયમ લાગુ પાડી શકાય નહિ.

### (4) સંગ્રહ શોખ :-

કેટલીક વ્યક્તિઓને જૂની પુરાણી વસ્તુઓ, ચલણી સિક્કાઓ, જુદા જુદા દેશોની ચલણી નોટો - સિક્કાઓ ટપાલની ટિકિટો વગેરે સંગ્રહ કરવાનો શોખ હોય છે. આવી વ્યક્તિઓ પાસે જેમ જેમ અલગ અલગ વસ્તુઓનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમાંથી પ્રામ થતો સીમાંત તુલ્લીગુણ વધતો જાય છે. એટલે કે સંગ્રહ શોખ ધરાવનાર વ્યક્તિઓની બાબતમાં ઘટતાં સીમાંત તુલ્લીગુણના નિયમથી વિપરીત બને છે.

### (5) અસામાન્ય વર્તણૂંક ધરાવતી વ્યક્તિઓ :-

અસામાન્ય વર્તણૂંક ધરાવતી વ્યક્તિઓને ઘટતાં સીમાંત તુલ્લીગુણનો નિયમ લાગુ પડતો નથી. જેમ કે કોઈને શાસ્ત્રીય સંગીત સાંભળવાનો શોખ હોય તે જેમ જેમ વધુ ને વધુ શાસ્ત્રીય સંગીત સાંભળે છે તેમ તેમ તેને વધુને વધુ આનંદ મળે છે. એ જ રીતે વાંચનનો શોખ ધરાવતી વ્યક્તિને પણ ઘટતાં સીમાંત તુલ્લીગુણનો નિયમ લાગુ પડતો નથી.

### ● ઘટતા સીમાંત તુલ્લીગુણનું મહત્વ :-

#### (1) અતિમહત્વની વસ્તુ સસ્તી સાથી :-

આપણા જીવનમાં કેટલીક વસ્તુઓ અત્યંત મહત્વની હોય છે. જેમ કે કેટલીક વસ્તુઓનું વપરાશ મૂલ્ય વધુ હોય છે પરંતુ તેનું વિનિમય મૂલ્ય નહિવત કે ઓછું હોય છે જેમ કે હવા, સૂર્ય પ્રકાશ, પાણી વગેરે. કેટલીક વસ્તુઓ આપણાં જીવનમાં ખૂબ મહત્વની ન હોય છતાં પણ ખૂબ મોંઢી હોય છે. જેમ કે હીરા, ઝવેરાત, મોતી, માણેક વગેરે. જીવનમાં અત્યંત મહત્વની જરૂરિયાતની વસ્તુ શા માટે સસ્તી અને ઓછી મહત્વની જરૂરિયાતની વસ્તુ શા માટે મોંઢી છે તે અંગેની સમજૂતી ઘટતાં સીમાંત તુલ્લીગુણનાં નિયમ પરથી મળે છે. જે વસ્તુની છત છે તે સસ્તી અને જેની અછત હોય તે મોંઢી હોય છે. કારણ કે જે વસ્તુની છત હોય તેનું સીમાંત મહત્વ વધુ હોય છે આથી તે મોંઢી હોય છે.

## (2) કરવેરા નક્કી કરવા :-

સરકારને કરવેરા નક્કી કરવા માટે ઘટતાં સીમાંત તુલ્યીગુણનો નિયમ ઉપયોગી છે. જે વસ્તુઓની વપરાશ ગરીબ કે મધ્યમ વર્ગ કરતો હોય તેના પર ઓછા દરે અને ધનિક વર્ગ પર જેંચા દરે કરવેરા નાખે છે. કારણ કે જો ગરીબો પર વધુ વેરા નાખવામાં આવે તો તેમના સીમાંત તુલ્યીગુણ કે કલ્યાણમાં ઘટાડો થાય છે, કલ્યાણ લક્ષી સરકાર હંમેશા ગરીબોને કલ્યાણને ધ્યાનમાં રાખી કરવેરા નક્કી કરે છે. જ્યારે ધનિકોના કલ્યાણમાં ઓછોક ઘટાડો થાય તે રીતે કરવેરા નક્કી કરે છે.

## (3) કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ સમજવા :-

કિંમત અને માંગ વચ્ચે શા માટે વ્યસ્ત સંબંધ છે તે ઘટતાં સીમાંત તુલ્યીગુણ દ્વારા સમજવી શકાય છે. કિંમત વધતા ગ્રાહકને પહેલા કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે જેને કારણે એનો સીમાંત તુલ્યીગુણ ઘટે છે આથી તે વસ્તુની માંગ ઘટાડે છે.

## (4) વિવિધ વસ્તુઓની વપરાશ શાથી :-

લોકો શા માટે જુદી જુદી વસ્તુઓની વપરાશ કરે છે તેનો ખ્યાલ ઘટતા સીમાંત તુલ્યીગુણના આધારે આવી શકે છે. માનવીની જરૂરિયાતો અમયાદિત છે જ્યારે તેને સંતોષવાના સાધનો મયાદિત છે આ મયાદિત સાધનોના વેકલ્યેક ઉપયોગમાં લઈ માનવી મહત્તમ સંતોષ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. જો વ્યક્તિ એક જ પ્રકારની વસ્તુની સતત વપરાશ કરે તો તેમાંથી પ્રાપ્ત થતો સીમાંત તુલ્યીગુણ ઘટે છે. અને કોઈપણ વ્યક્તિ સંતોષમાં ઘટાડો થાય તે ઈચ્છાનો નથી આથી તે જુદા જુદા પ્રકારની વસ્તુ વપરાશ કરે છે.

## (5) ગ્રાહકના અધિક સંતોષનો ખ્યાલ :-

ગ્રાહકના અધિક સંતોષનો ખ્યાલ પડા ઘટતા સીમાંત તુલ્યીગુણનો નિયમ પર આધારિત છે. વસ્તુની કિંમત તેના સીમાંત તુલ્યીગુણ બરાબર હોય છે. આથી પૂર્વ સીમાંત એકમો માટે ચૂકવાતી કિંમત કરતા તેમાંથી પ્રાપ્ત થતાં વધારાનાકક્ક તુલ્યીગુણ જે ગ્રાહકોનાં અધિક સંતોષ દર્શાવે છે.

### • ઘટતાં સીમાંત તુલ્યીગુણનાં નિયમની મર્યાદાઓ :-

#### (1) તુલ્યીગુણ માપી શકાય નહિ :-

આ નિયમમાં એવી ધારણા કરવામાં આવે છે કે વાપરવામાં આવતી વસ્તુમાંથી પ્રાપ્ત થતો તુલ્યીગુણ માપી શકાય છે. પરંતુ વાસ્તવમાં તુલ્યીગુણ એ માનસિક ખ્યાલ છે વસ્તુની વપરાશમાંથી તુલ્યીગુણ કેટલો મળ્યો તે અનુભવી શકાય છે પરંતુ ચોક્કસ રીતે માપી શકતો નથી.

## (2) વસ્તુઓ વચ્ચે આંતર સંબંધ :-

અહીં એવી ધારણા કરવામાં આવી છે કે વાપરવામાં આવતી વસ્તુ અન્ય વસ્તુથી સ્વતંત્ર છે. પરંતુ વાસ્તવમાં દરેક વસ્તુઓ વચ્ચે આંતર સંબંધ હોય છે. દરેક વસ્તુ કોઈની હરીકું પૂરક કે અવેજી વસ્તુ હોય છે. આથી અન્ય વસ્તુના ભાવમાં કે ગુણવત્તામાં ફેરફાર થાય તો પણ તે વસ્તુની માંગમાં ફેરફાર થાય છે.

## (3) ઈર્ષાનું દુઃખ :-

કેટલીકવાર વ્યક્તિ પોતે વસ્તુની વપરાશ ન વધારે પણ અન્ય પાસે વસ્તુ જોઈને તેના તુછીગુણમાં ઘટાડો થાય છે. જેમ કે વ્યક્તિ પાસે એક ગાડી હોય અને પડોશીના ઘરે પ્રથમ ગાડી પછી બીજી ગાડી આવે તે જોઈને વ્યક્તિને ઈર્ષા થાય છે અને તેનો તુછીગુણ ઘટે છે.

## (4) અવિભાજ્યતા :-

અહીં નિયમમાં વસ્તુના જુદા જુદા એકમો વાપરવાથી તેમાંથી પ્રામ થતો તુછીગુણ ઘટે છે તે સમજાવ્યું છે. પણ તે વિભાજ્ય વસ્તુને લાગુ પડે છે. વાપરવામાં આવતી બધી જ વસ્તુઓ વિભાજ્ય હોતી નથી. કેટલીક વસ્તુઓ અવિભાજ્ય પણ હોય છે. જેમ કે રેફીજરેટર, ફર્નિચર, ટીવી, આવી અવિભાજ્ય વસ્તુની બાબતમાં સંબંધ અતુટ રેખા પ્રામ કરી શકતી નથી.

### ● તુછીગુણ વિશ્લેષણ દ્વારા માંગના નિયમની સમજૂતી.

#### પ્રસ્તાવના :-

તુછીગુણ વિશ્લેષણ પદ્ધતિ દ્વારા માંગના નિયમની સમજૂતી પ્રો. માર્શલે રજૂ કરી હતી. તેઓએ એવું દર્શાવ્યું કે માંગનો નિયમ ઘટતા સીમાંત તુછીગુણનાં નિયમ પર આધારિત છે. તે મુજબ ગ્રાહક કોઈ એક વસ્તુના એકમોની સતત વપરાશ ચાલુ રાખે છે ત્યારે તેમાંથી પ્રામ થતો સીમાંત તુછીગુણ ઘટતો જાય છે. દરેક વ્યક્તિ મહત્તમ સંતોષ પ્રામ કરવા માટે વસ્તુ કે સેવાની ખરીદી કે વપરાશ કરે છે. જો તેમાંથી પ્રામ થતો સીમાંત તુછીગુણ ઘટે તો તે વસ્તુની માંગ પણ ઘટાડે છે. ગ્રાહકના આ વલણ દ્વારા માંગનો નિયમ સાબિત કરી શકાય.

#### ● માંગનો નિયમ :-

પ્રો. માર્શલ કિંમત અને માંગ વચ્ચે કારણ - પરિણામનો સંબંધ સમજાવે છે. પ્રો. માર્શલ જણાવે છે કે “જ્યારે બજારમાં વસ્તુનું પ્રમાણ વધારે હોય ત્યારે વધારે ગ્રાહકોને આકર્ષણ શકે તે માટે વસ્તુની કિંમત ઓછી રાખવામાં આવે છે. કિંમત ઘટવાને કારણે માંગ વધે છે અને કિંમત વધે તો માંગ ઘટે છે.”

● ધારણાઓ :-

- (1) ગ્રાહકોની સંખ્યા સ્થિર રહે છે.
- (2) ગ્રાહકોની આવક સ્થિર રહે છે.
- (3) ગ્રાહકના રુચિ, ફેશન, ટેવ બદલાતા નથી.
- (4) અન્ય અવેજ વસ્તુના ભાવો.
- (5) વસ્તુની ગુણવત્તા.
- (6) ભવિષ્યના ભાવ અંગેના અંદાજો.
- (7) સીમાંત તુલ્યગુણ માપી શકાયે.
- (8) વસ્તુની વપરાશ કિયા દરમાન સમયનું અંતર પડતું નથી.
- (9) વાપરવામાં આવતી વસ્તુના એકમો સમાન ગુણી છે.
- (10) નાણાનો સીમાંત તુલ્યગુણ સ્થિર રહે છે.
- (11) ગ્રાહકનું વર્તન તર્કબધ્ય છે.

● તુલ્યગુણ પદ્ધતિ દ્વારા માંગનો નિયમની સમજૂતી :-

માર્શિલ માંગનો નિયમ સમજીવા તુલ્યગુણ પદ્ધતિનો આધાર લીધો છે. આ પદ્ધતિમાં ગ્રાહકનું વલણ સીમાંત તુલ્યગુણ = કિંમત ચૂકવવાની તૈયારીનું રહેતું હોય છે. કારણ કે ગ્રાહક તેની વસ્તુની જરૂરિયાતની તીવ્રતાના આધારે કિંમત ચૂકવવા તૈયાર થતો હોય છે. જો વસ્તુની તીવ્ર જરૂરિયાત હોય તો વધુ કિંમત ચૂકવવા તૈયાર થાય અને વસ્તુની જરૂરિયાત ઓછી તીવ્ર હોય તો કિંમત ઓછી ચૂકવવા તૈયાર થાય છે. અને તે મુજબ ગ્રાહકને તે વસ્તુમાંથી સીમાંત તુલ્યગુણ અથવા સંતોષ પ્રાપ્ત થાય છે. આમ, વસ્તુની કિંમત એ વસ્તુની માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય છે. આથી, ગ્રાહક હંમેશા મહત્વમાં સંતોષ પ્રાપ્ત કરવા પોતાની ખરીદી સીમાંત તુલ્યગુણ = કિંમત ચૂકવવાની તૈયારી = બજાર કિંમતને ધ્યાનમાં લઈને કરશે. જ્યારે વસ્તુની કિંમત અને સીમાંત તુલ્યગુણ સમાન થશે ત્યારે ગ્રાહક સમતુલ્યાની સ્થિતિ પ્રાપ્ત કરે છે અને તે વસ્તુની ખરીદી બંધ કરે છે.

દા.ત. ગ્રાહક X વસ્તુ ખરીદવા હશે છે. X ની કિંમત, તેમાંથી પ્રાપ્ત થતો સીમાંત તુલ્યગુણ, તેની કિંમત ચૂકવવાની તૈયારી, મૂળ બજાર કિંમત નીચે મુજબ દર્શાવવામાં આવ્યાં છે.


વસ્તુના એકમ	સીમાંત તુ.ચુ.	કિંમત ચૂકવવાની તૈયારી (રૂ.માં)	મૂળ બજાર કિંમત (રૂ.માં)	નવી બજાર કિંમત (રૂ.માં)
1	20	20	12	04
2	16	16	12	04
3	12	12	12	04
4	08	08	12	04
5	04	04	12	04
6	00	00	12	04

ઉપરોક્ત ઉદાહરણમાં દર્શાવવામાં આવ્યું છે કે ગ્રાહક X ના એકમની વપરાશમાં જેમ જેમ એક એકમ એ વધારતો જાય છે તેમ તેમ અનુક્રમે 1, 2, 3, 4, 5 અને 6 એકમમાંથી અનુક્રમે 20, 16, 12, 08, 04 અને શૂન્ય એકમ જેટલ તુલ્યીગુણ થાય છે. એટલે સીમાંત તુલ્યીગુણ ઘટતો જાય છે. X ની મૂળ બજાર કિંમત રૂ. 12 છે. ત્યારે તે X નાં 3 એકમો ખરીદવા તૈયાર થશે. કારણ કે ત્રીજા એકમે ગ્રાહકને તે વસ્તુમાંથી પ્રાપ્ત થતો સીમાંત તુલ્યીગુણ 12 એકમ, કિંમત ચૂકવવાની તૈયારી રૂ. 12 અને મૂળ બજાર કિંમત રૂ. 12 ત્રણેય સરખા થાય છે. જ્યાં તેને મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય છે.

હવે જો કિંમત ઘટીને રૂ. 4 થાય એટલે કે નવી બજાર કિંમત રૂ. 4 થતાં ગ્રાહક પાંચ એકમની ખરીદી કરશે અને સમતુલ્ય પ્રાપ્ત કરશે. કારણ કે પાંચમાં એકમે સીમાંત તુલ્યીગુણ 4 એકમ, કિંમત ચૂકવવાની તૈયારી 4 રૂ. અને વસ્તુની કિંમત રૂ. 4 સરખા થાય છે અને ગ્રાહકને મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય છે.

ટૂંકમાં કિંમતમાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે ગ્રાહક સીમાંત તુલ્યીગુણને ધ્યાનમાં લઈને વસ્તુની માંગમાં ફેરફાર કરે છે. આમ વસ્તુની કિંમત અને માંગમાં થતાં ફેરફારો નીચેની આંકૃતિક દ્વારા સમજાવી શકાય.

X વસ્તુની કિંમત (રૂ.માં)	X વસ્તુની માંગ (એકમમાં)
12 રૂ	3 એકમ
4 રૂ	5 એકમ



ઉપરોક્ત આફૂતિમાં OX ધરી પર X વસ્તુના એકમો અને OY ધરી પર X વસ્તુની કિંમત દર્શાવવામાં આવ્યો છે. વસ્તુની કિંમત જ્યારે 12 રૂ. છે. ત્યારે ગ્રાહક 3 એકમોની માંગ કરે છે જે આફૂતિમાં A બિંદુ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. કિંમત ઘટીને રૂ. 4 થતાં ગ્રાહક તેની માંગ વધારીને 5 એકમ જેટલી કરે છે. જે આફૂતિમાં B બિંદુ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. આ બંને બિંદુઓને જોડતાં DD માંગરેખા પ્રાપ્ત થાય છે. જે ઝણ ગાળવાળી છે. જે દર્શાવે છે કે X ની કિંમતમાં ઘટાડો થતાં ગ્રાહક મહત્તમ સંતોષ પ્રાપ્ત કરવા નવી બજાર કિંમતે 5 એકમની માંગ કરે છે.

- માંગનાં નિયમની મર્યાદાઓ :-

(1) તુલ્યીગુણ માપી શકાતો નથી :-

માંગના નિયમમાં એવી ધારણા કરવામાં આવી છે કે ગ્રાહક વસ્તુની વપરાશ કરે છે તેના દરેક એકમમાંથી કેટલો તુલ્યીગુણ પ્રાપ્ત થાય છે તે માપી શકાય છે. પરંતુ વાસ્તવમાં તુલ્યીગુણ મળ્યો તે અનુભવી શકાય છે પરંતુ માપી શકાતો નથી.

(2) નાણાનો સીમાંત તુલ્યીગુણ સ્થિર રહેતો નથી :-

અહીં નાણાના સીમાંત તુલ્યીગુણને સ્થિર ધારી લેવામાં આવ્યો છે. માર્શલના મતે નાણા દ્વારા સીમાંત તુલ્યીગુણ માપી શકાય છે. પરંતુ વાસ્તવમાં નાણાનો સીમાંત તુલ્યીગુણ બદલાય છે. આથી તેના દ્વારા ચોક્કસ રીતે સીમાંત તુલ્યીગુણ માપી શકાય નહિ.

(3) સમયના તત્ત્વની અવગાણના :-

માર્શલે તુલ્યીગુણ પદ્ધતિ દ્વારા માંગના નિયમની સમજૂતી આપતાં એ ધારણા કરી છે કે વસ્તુની વપરાશ કિયા દરમ્યાન સમયનું અંતર પડતું નથી. એટલે કે ગ્રાહક વસ્તુની સતત વપરાશ જુદા જુદા સમયે કરે છે. આથી આ ધારણા અવાસ્તવિક છે.

(4) અવિભાજ્ય વસ્તુનાં સંદર્ભમાં :-

ગ્રાહક વસ્તુના જુદા જુદા એકમોનો કમશા: વપરાશ કરે છે અને તેમાંથી પ્રાપ્ત થતો સીમાંત તુલ્યીગુણ ઘટતો જાય છે અને તેથી તે વસ્તુની માંગ ઘટાડે છે. વિભાજ્ય વસ્તુની બાબતમાં આ સાચું છે. પણ ગ્રાહક માત્ર વિભાજ્ય વસ્તુઓની જ વપરાશ નથી કરતો. રેફીજરેટર, માઈક્રોવેવ, ધરધંટી, સોફસેટ જેવી અવિભાજ્ય ટકાઉ વસ્તુઓની પણ વપરાશ કરે છે જેનું નાના એકમોમાં વિભાજન કરવું શક્ય નથી. આવી અવિભાજ્ય વસ્તુઓનાં સંદર્ભમાં માંગનો નિયમ લાગુ પડે નહિ.

### (5) આવક અસરની ઉપેક્ષા :-

માર્શિલ માત્ર અવેજુ અસર વડે કિંમત અને માંગ વચ્ચે વસ્ત સંબંધ સમજાવે છે આવક અસરની ઉપેક્ષા કરે છે. સામાન્ય રીતે વ્યક્તિની આવકમાં ફેરફાર થાય તો કિંમત સ્થિર હોવા છતાં માંગમાં ફેરફાર થાય છે.

### (6) અન્ય વસ્તુથી સ્વતંત્ર વસ્તુ :-

માર્શિલનો માંગનો નિયમ તુલ્યિગુણ પદ્ધતિ પર આધારિત છે. જેમાં વસ્તુની માંગને સ્વતંત્ર દર્શાવવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં દરેક વસ્તુ કોઈ ની અવેજુ પૂરક કે હરીફ વસ્તુ હોય છે. આથી કોઈ એક વસ્તુની માંગનો સ્વતંત્ર રીતે વિચાર થઈ શકે નથિ.

#### ● માંગના નિયમના અપવાદો :-

##### (1) હલકા પ્રકારની વસ્તુ (ગીફન વસ્તુ) :-

હલકા પ્રકારની વસ્તુઓની બાબતમાં માંગનો નિયમ લાગુ પડતો નથી. એટલે કે હલકા પ્રકારની વસ્તુની કિંમત વધે તો તેની માંગ વધે છે અને કિંમત ઘટે તો તેની માંગ ઘટે છે. જુવાર, બાજરી, બરછટ કાપડ વગેરે જેવી હલકા પ્રકારની વસ્તુઓ કે જેનો વપરાશ ગરીબ ગ્રાહકો કરે છે. જો આવી વસ્તુઓની કિંમત વધે તો ગરીબ ગ્રાહકની ખરીદ શક્તિ ઘટે છે. આથી તે અન્ય સારી જાતની ચીજોની માંગ ઘટાડી હલકા પ્રકારની વસ્તુની માંગ વધારે છે. અને જો હલકા પ્રકારની વસ્તુની કિંમત ઘટે તો ગ્રાહકની ખરીદશક્તિ વધે છે આથી તે સારા પ્રકારની વસ્તુની માંગ વધારે છે અને હલકા પ્રકારની વસ્તુની માંગ ઘટાડે છે. અર્થશાસ્ત્રમાં આવી વસ્તુઓને ગિફન વસ્તુઓ કહે છે. આંકડાશસ્વી રોબર્ટ ગિફને આ વસ્તુઓનો માંગના નિયમના અપવાદ તરીકે સમજૂતી આખી હોવાથી આવી વસ્તુઓને ગિફન વસ્તુઓ કહે છે.

##### (2) પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુઓ :-

જે વસ્તુ વ્યક્તિ પાસે હોવાથી સમાજમાં તેની પ્રતિષ્ઠા દેખાય તેને પ્રતિષ્ઠા મૂલ્ય વાળી વસ્તુ કહે છે. જેમ કે સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, નીલમ વગેરે. આવી વસ્તુઓની બાબતમાં માંગનો નિયમ લાગુ પાડી શકતો નથી. આવી વસ્તુઓની કિંમતમાં વધારો થતાં તેના પ્રતિષ્ઠા મૂલ્યમાં વધારો થાય છે. જે લોકોને સમાજમાં પોતાની પ્રતિષ્ઠા દર્શાવવી છે તેઓ કિંમત વધવા છતાં પ્રતિષ્ઠા મૂલ્ય વાળી વસ્તુની માંગ વધારે છે. અને જો કિંમત ઘટે તો તેનું પ્રતિષ્ઠા મૂલ્ય ઘટે છે. આથી ધનિક વર્ગ તેની માંગમાં ઘટાડો કરે છે.

#### ● સમસીમાંત તુલ્યિગુણનો નિયમ :- (Law of Equi Marginal Utility) :-

##### પ્રસ્તાવના :-

માનવીની જરૂરિયાતો અમયાદિત છે તેમાંથી તે પોતાની જરૂરિયાતો એવી રીતે સંતોષે છે કે જેથી તે ઈષ્ટામ અવસ્થાએ પહોંચી શકે. જરૂરિયાતના આ લક્ષતાને આપારે ઘટતા સીમાંત

તુલ્યગુણનો નિયમ સમજાવવામાં આવ્યો છે. જ્યારે મહત્તમ સંતોષનો નિયમ અવેજનો નિયમ અથવા સમસીમાંત તુલ્યગુણનાં નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે.

માનવીની જરૂરિયાતો અમયાદિત છે આથી જરૂરિયાતો એકબીજાની હરીફ હોય છે. જ્યારે આ જરૂરિયાત સંતોષવાના સાધનો મયાદિત અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા હોય છે. ગ્રાહક તેની મયાદિત આવકમાંથી વિવિધ વસ્તુઓ કે સેવાઓ ખરીદી વધુ ને વધુ તુલ્યગુણ કેવી રીતે પ્રાપ્ત કરે છે તેની સમજૂતી સમસીમાંત તુલ્યગુણના નિયમ દ્વારા સમજાવી શકાય.

#### ● સમસીમાંત તુલ્યગુણનો નિયમ :-

પ્રો. માર્શલના શબ્દોમાં, જ્યારે કોઈ વક્તિ પાસે અનેક ઉપયોગમાં લઈ શકાય તેવું સાધન એટલે કે આવક હોય તો તે આવકને જુદા જુદા ઉપયોગમાં એવી રીતે ગોઠવશે કે જેથી દરેક ઉપયોગમાં તેનો સીમાંત તુલ્યગુણ એક સરખો રહે. જો કોઈ એક ઉપયોગમાં અન્ય ઉપયોગ કરતા સીમાંત તુલ્યગુણ વધારે હોય તો અન્ય ઉપયોગમાંથી પ્રથમ ઉપયોગમાં તેની ફેર બદલી કરવાથી કુલ તુલ્યગુણમાં વધારો કરી શકે છે. તેમજ બંને વસ્તુઓ પર ખર્ચરીના નાણાનો સીમાંત તુલ્યગુણ સરખો થઈ રહે છે.

કોઈપણ વસ્તુનું મૂલ્ય જ્યારે નાણામાં વકત થાય ત્યારે તેને કિંમત કહેવાય. આ રીતે કોઈપણ ગ્રાહક જુદી જુદી વસ્તુઓમાંથી પ્રાપ્ત થતાં સીમાંત તુલ્યગુણને જુદી જુદી વસ્તુઓની કિંમત સાથે કરે છે. અને બે જુદી જુદી વસ્તુઓમાંથી પ્રાપ્ત થતો સીમાંત તુલ્યગુણ અને તેમની કિંમત સરખાં થઈ રહે ત્યાં સુધી એ જુદી જુદી વસ્તુઓના ઉપયોગમાં ફેરબદલી કરશે. જ્યાં તે મહત્તમ સંતોષ પ્રાપ્ત કરે ત્યાં ગ્રાહક સમતુલ્યાની સ્થિતિ પર છે તેમ કહેવાય.

આમ ગ્રાહકની સમતુલ્યા દર્શાવતું સૂત્ર નીચે મુજબ રજૂ કરી શકાય.

A વસ્તુમાંથી પ્રાપ્ત થતો સી.તુ.ગુ.	B વસ્તુમાંથી પ્રાપ્ત થતો સી.તુ.ગુ.	C વસ્તુમાંથી પ્રાપ્ત થતો સી.તુ.ગુ.
----- = -----	----- = -----	-----
A વસ્તુની કિંમત	B વસ્તુની કિંમત	C વસ્તુની કિંમત

#### ● સમસીમાંત તુલ્યગુણના નિયમની ધારણાઓ :-

##### (1) ગ્રાહકનું વર્તન તર્કબધ્ય છે :-

અહીં ગ્રાહકનું વર્તન તર્કબધ્ય છે એટલે કે ગ્રાહક જુદી જુદી વસ્તુઓની ખરીદી તેમાંથી પ્રાપ્ત થતાં સંતોષને આધારે કરે છે. એ પ્રમાણે મહત્તમ સંતોષ મેળવે છે.

##### (2) તુલ્યગુણ માપી શકાય છે તેમજ સરખાવી શકાય છે :-

ગ્રાહકને જુદી જુદી વસ્તુના અલગ અલગ એકમોમાંથી કેટલો તુલ્યગુણ મળે છે તે માપી શકાય છે તેમજ જુદી જુદી વસ્તુઓમાંથી પ્રાપ્ત થતો તુલ્યગુણ સરખાવી શકાય છે.

**(3) ઘટતાં સીમાંત તુલ્યિગુણના નિયમ પર આધારિત નિયમ :-**

સમસીમાંત તુલ્યિગુણનો નિયમ ઘટતાં સીમાંત તુલ્યિગુણના નિયમ પર આધારિત છે. એટલે કે વસ્તુના વપરાશમાં કે ખરીદીમાં જેમ જેમ એક એક એકમનો વધારો કરવામાં આવે છે તેમ તેમ તેમાંથી પ્રામ થતો સીમાંત તુલ્યિગુણ ઘટતો જાય છે.

**(4) સંપૂર્ણ માહિતગાર :-**

ગ્રાહક બજારમાં મળતી વસ્તુઓ તેમાંથી પ્રામ તુલ્યિગુણ વિશે સંપૂર્ણ માહિતગાર છે. તે મુજબ તે વસ્તુની કરે છે.

**(5) ગ્રાહકની આવક અને વસ્તુની કિંમત સ્થિર રહે છે :-**

નિયમમાં એવી ધારણા કરવામાં આવી છે કે ગ્રાહકની આવક કે વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી. કારણ કે જો ગ્રાહકની આવક અથવા વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો સમતુલ્યામાં વિક્ષેપન ઉભું થાય છે.


**• ઉદાહરણ દ્વારા નિયમની સમજૂતી :-**

ધારો કે ગ્રાહકની આવક 1000 રૂ. છે તે A, B અને C ગ્રાણ વસ્તુઓ પાછળ ખર્ચે છે. ગ્રાણે વસ્તુઓની કિંમત 50 રૂ. હોય તો ગ્રાણે વસ્તુઓમાંથી પ્રામ થતાં સીમાંત તુલ્યિગુણની અનુસૂચિ નીચે મુજબ છે.

વસ્તુના એકમો	A વસ્તુમાંથી પ્રામ થતો સી.તુ.ગુ.	B વસ્તુમાંથી પ્રામ થતો સી.તુ.ગુ.	C વસ્તુમાંથી પ્રામ થતો સી.તુ.ગુ.
1	24	20	18
2	22	14	10
3	20	10	6
4	16	06	0
5	10	0	- 6
6	6	- 2	- 12

ઉપરોક્ત અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ ગ્રાહક તેના પ્રથમ 50 રૂ. A વસ્તુ પાછળ ખર્ચે છે કારણ કે તેમાંથી તેને 24 એકમ જેટલો તુલ્યિગુણ મળે છે બીજા 50 રૂ. પણ તે A વસ્તુ પાછળ ખર્ચે છે. કારણ કે તેમાંથી 22 એકમ તુલ્યિગુણ મળે છે તે ત્રીજા 50 રૂ. તે B વસ્તુ પાછળ ખર્ચ કરશે. કેમ કે, C વસ્તુના પ્રથમ એકમમાંથી 18 એકમ જેટલો તુલ્યિગુણ મળે છે. જ્યારે Aનો ત્રીજા અને Bના પ્રથમ એકમમાંથી 20 એકમ જેટલો તુલ્યિગુણ મળે છે. અહીં ગ્રાહક પાસે Aના બે એકમો પહેલેથી જ છે. આથી તે Bનું પ્રથમ ખરીદશે. ત્યારબાદ ચોથા 50 રૂ. તે A વસ્તુ પાછળ ખર્ચશે. કારણ કે તેમાંથી 20 એકમ જેટલો તુલ્યિગુણ મેળવે છે પાંચમાં પચાસ રૂપિયા તે Cના

પ્રથમ એકમ પાછળ ખરીદશે કેમ કે Cના પ્રથમ એકમમાંથી 18 એકમ જેટલો તુલ્યીગુણ મળે છે. આમ તે A અને Bની અવેજમાં C વસ્તુની ખરીદી કરશે. સમસીમાંતના નિયમ મુજબ ગ્રાહક મહત્તમ તુલ્યીગુણ મેળવવા પ્રયત્નશીલ રહે છે. અહીં તેને Aના 5 એકમો, Bના 3 એકમો અને Cના 2 એકમોમાંથી એકસરખો 10 એકમ સીમાંત તુલ્યીગુણ મળે છે. A ના પાંચ એકમમાંથી ગ્રાહકને  $24 + 22 + 20 + 16 + 10 = 92$ , Bના ત્રણ એકમમાંથી  $20 + 14 + 10 = 44$  અને Cના બે એકમમાંથી  $18 + 10 = 28$  એકમ તુલ્યીગુણ મળે છે. કુલ તુલ્યીગુણ  $92 + 44 + 28 = 164$  એકમ જેટલો થશે. જો ગ્રાહક પોતાની ખરીદીમાં ફેરફાર કરશે તો કુલ તુલ્યીગુણ ઘટશે. આથી ગ્રાહક Aના કે, Bના 3 અને Cના 2 એકમો ખરીદી મહત્તમ સંતોષ મેળવીને સમતુલ્ય પ્રાપ્ત કરશે. આ બાબતને આફુતિ દ્વારા સમજાયે.



ઉપરોક્ત આફુતિઓમાં OX ધરી પર અનુક્રમે A, B અને C વસ્તુના એકમો દર્શાવવામાં આવ્યાં છે. જ્યારે OY ધરી પર વસ્તુઓમાંથી પ્રાપ્ત થતો સીમાંત તુલ્યીગુણ દર્શાવવામાં આવ્યાં છે. આફુતિમાં દર્શાવ્યા મુજબ A વસ્તુના પાંચ, B વસ્તુના ત્રણ અને C વસ્તુના બે એકમો ખરીદે છે. ત્યારે સમતુલ્યામાં આવે છે, A ના પાંચમાં એકમ પાછળ છેલ્લા 50 રૂ. ખર્ચે છે. ત્યારે તેને 10 એકમ સી.તુ.ગુ. મળે છે. B વસ્તુના બીજા એકમમાં છેલ્લા પચાસ રૂપિયા ખર્ચે છે ત્યારે તેને 10 એકમ સીમાંત તુલ્યીગુણ મળે છે અને C ના બીજા એકમ પાછળ છેલ્લા 50 રૂ.

ખર્ચ છે. ત્યારે તેને 10 એકમ સીમાંત તુલ્યિગુણ મળે છે. આમ દરેક વસ્તુ પાછળ ખર્ચવામાં આવતા છેલ્લા 50 રૂ. એકસરખો તુલ્યિગુણ આપે છે.

- સમસીમાંત તુલ્યિગુણના નિયમની મર્યાદાઓ :-

- (1) તુલ્યિગુણ માપી શકાય નહિ :-

અહીં એવી ધારણા કરવામાં આવી છે કે ગ્રાહક જે વસ્તુની ખરીદી કે વપરાશ કરે છે તેમાંથી પ્રામ થતો સીમાંત તુલ્યિગુણ માપી શકાય છે તેમજ સરખાવી શકાય છે. પરંતુ વાસ્તવમાં તુલ્યિગુણ માનસિક ઘ્યાલ હોવાથી તે અનુભવી શકાય છે ચોક્કસ પણે માપી શકતો નથી.

- (2) અવિભાજ્ય વસ્તુના સંદર્ભમાં :-

અવિભાજ્ય વસ્તુની બાબતમાં આ નિયમ સાચો સાબિત થતો નથી. કારણ કે અવિભાજ્ય વસ્તુઓનું નાના નાના એકમોમાં વિભાજન શક્ય ન હોવાથી તેની સણંગ અતૃપ્ત સીમાંત તુલ્યિગુણની રેખા મેળવી શકતી નથી. નાશવંત વસ્તુમાંથી તરત તુલ્યિગુણ મળે છે, જ્યારે ટકાઉ વસ્તુમાંથી ક્યારે તુલ્યિગુણ મળે તે જાણી શકતું નથી.

- (3) સમયના તત્ત્વની ઉપેક્ષા :-

વસ્તુની વપરાશ કિયા દરમ્યાન સમયાંતરનો અભાવ છે તેવી અહીં ધારણા કરવામાં આવી છે. વાસ્તવમાં દરેક વ્યક્તિ વસ્તુની એક સાથે સતત વપરાશ કરતી નથી.

- (4) ગ્રાહકની તર્ક બધ્યતા :-

ગ્રાહકનું વર્તન તર્કબધ્ય ધારી લેવામાં આવ્યું છે. વાસ્તવમાં ગ્રાહકો દરેક વસ્તુઓની કિંમત, તેમાંથી પ્રામ થતાં તુલ્યિગુણથી સંપૂર્ણપણે માહિતગાર હોતાં નથી.

- સમસીમાંત તુલ્યિગુણના નિયમનું મહત્વ :-

- (1) ઉત્પાદકો માટે ઉપયોગી :-

ઉત્પાદકો મહત્તમ નફો પ્રામ કરવા ઉત્પાદન ખર્ચ શક્ય તેટલું ઓછું રાખવા પ્રયત્ન કરે છે. જુદા જુદા સાધનોમાંથી જે સાધન સસ્તુ હોય તે સાધનના ઉપયોગથી ઉત્પાદન કરે છે.

- (2) વપરાશ ક્ષેત્રોમાં :-

ગ્રાહકને જે વસ્તુના વપરાશથી મહત્તમ સંતોષ પ્રામ કરી શકે તેટલ ખરીદી કરે છે તેની સમજૂતી સમસીમાંત તુલ્યિગુણના નિયમમાંથી મળે છે.

- (3) સરકાર માટે ઉપયોગી :-

રાખ્યીય અર્થ વિધાનના ક્ષેત્રોમાં આ નિયમ ઉપયોગી છે. દેશના વિવિધ ક્ષેત્રો ખેતી, રસ્તા, બાંધકામ, શાળા-કોલેજો, વીજળી વગેરેના વિકાસ માટે મર્યાદિત સાધનોનો કઈ રીતે ઉપયોગ કરવો તે નક્કી કરવા સમસીમાંત તુલ્યિગુણના નિયમોનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રો. માર્શલ

કહે છે કે, આ નિયમ અર્થશાસ્ત્રનાં લગભગ બધાં જ ક્ષેત્રોને લાગુ પડે છે. પ્રો. રોબિન્સ આ નિયમને ‘અર્થશાસ્ત્રના આધાર’ તરીકે ગણાવે છે, કારણ કે વૈકળ્ખ્યક ઉપયોગ ધરાવતાં મયાર્ગિત સાધનોથી અમયાર્ગિત જરૂરિયાતો સંતોષવા માટે આ નિયમ ઉપયોગી છે.

#### (4) નાણાના વર્તમાન તેમજ ભાવિ ઉપયોગ વિશે નિર્ણય લેવા માટે :-

નાણાના વર્તમાન ઉપયોગ અને ભવિષ્યના ઉપયોગ વિશે નિર્ણય લેવા માટે આ નિયમ ઉપયોગી છે. વર્તમાનમાં કેટલું ખર્ચ કરવું અને ભવિષ્ય માટે કેટલી બચત કરવી તે બંને સમયમાં નાણાના સીમાંત તુલ્લીએ પર આધાર રાખે છે. ભવિષ્યમાં ખર્ચ કરવાથી જો સીમાંત તુલ્લીએ વધુ મળે તેમ હોય, તો તે વર્તમાનમાં ઓછું કરશે અને જો ભવિષ્યમાં સીમાંત તુલ્લીએ ઓછો મળે તેમ હોય તો તે વર્તમાનમાં વધુ ખર્ચ કરશો.

**તુલ્લીએ વિશ્વેષણનાં આધારે ગ્રાહકનો અધિક સંતોષ :-**

પ્રસ્તાવના :-

ગ્રાહકના અધિક સંતોષનો ઘાલ સૌ પ્રથમ 1804માં ફેન્ચ ઓન્ઝિનીયર દુપીટ એ રજૂ કર્યો હતો. ત્યારબાદ પ્રો. માર્શલે 1895માં પોતાનાં પુસ્તક ‘Principles of Economics’ માં વિસ્તૃત રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. માર્શલે આપેલ ગ્રાહકના અધિક સંતોષની વ્યાખ્યા નીચે મુજબ છે.

ગ્રાહક વસ્તુ વિના ચ્યલાવી લેવાને બદલે સ્વેચ્છાએ વધુમાં વધુ જે કિંમત ચૂકવવા તૈયાર હોય અને વાસ્તવમાં જે કિંમત ચૂકવે છે એ બંને વચ્ચેનો તફાવત ગ્રાહકના અધિક સંતોષનું માપ છે. ઓ ઉપભોક્તાનો અધિક સંતોષ કે વિશેષ સંતોષ પણ કહેવામાં આવે છે. ગાણિતિક સૂત્રમાં આ ઘાલને નીચે મુજબ રજૂ કરી શકાય.

**ગ્રાહકનો અધિક સંતોષ = કિંમત ચૂકવવાની તૈયારી – વાસ્તવમાં ચૂકવાતી કિંમત.**

દા.ત. ગ્રાહક કોઈ પુસ્તક ખરીદવા માંગે છે જેની તે રૂ. 500 કિંમત ચૂકવવા તૈયાર થાય છે. પરંતુ જ્યારે તે બજારમાં એ પુસ્તક ખરીદવા જાય છે ત્યારે તે પુસ્તકમાં 25% વળતર હોવાથી તે પુસ્તક તેને રૂ. 375માં મળે છે. એટલે કે ગ્રાહકને  $500 - 375 = 125$  રૂ. ઓછા ચૂકવવા પડે તો તે તેનો અધિક સંતોષ છે.


- ગ્રાહકના અધિક સંતોષનાં ઘાલની ધારણાઓ :-

- (1) ગ્રાહક જે વસ્તુ ખરીદે છે તેની માંગ અન્ય વસ્તુની ગુણવત્તા, પ્રમાણ કે કિંમતથી સ્વતંત્ર છે.
- (2) નાણાનો સીમાંત તુલ્લીએ સ્થિર રહે છે.

- (3) વસ્તુમાંથી પ્રાપ્ત થતો તુલ્યીગુણ માપી શકાય છે.
- (4) માંગને અસર કરતાં અન્ય પરિબળો યथાવત રહે છે.

● ઉદાહરણ દ્વારા સમજૂતી :-

વસ્તુના એકમો	સી.તુ.ગુ. (રૂ.માં)	એકમ દીઠ કિંમત (રૂ.માં)	આધિક સંતોષ (રૂ.માં)
1	50	10	40
2	40	10	30
3	30	10	20
4	20	10	10
5	10	10	0
6	00	10	-



ઉપરોક્ત આદૃતિમાં OX ધરી પર વસ્તુના એકમો અને OY ધરી પર વસ્તુની કિંમત અને સીમાંત તુલ્યીગુણ દર્શાવવામાં આવ્યાં છે. આદૃતિમાં Q બિંદુએ કિંમત રેખા અને સીમાંત તુલ્યીગુણની રેખા એક બીજાને છેંટે છે. એટલે કે કિંમત 10 રૂ. એ ત્યારે ગ્રાહક 5 એકમો ખરીદે છે. કારણ કે ખરીદીની આ સપાટીએ સીમાંત તુલ્યીગુણ = કિંમત રૂ. 10 = રૂ. 10 સરખાય છે.

આકૃતિમાં ધારો ભાગ ગ્રાહકનો અધિક સંતોષ દર્શાવે છે. જે મુજબ પ્રથમ એકમ માટે ગ્રાહક 50 રૂ. ચૂકવવા તૈયાર છે જ્યારે તેને વાસ્તવમાં તેને 10 રૂ. જ ચૂકવવા પડે છે. આથી ગ્રાહકને રૂ.  $50 - રૂ. 10 = 40$  રૂ. જેટલો અધિક સંતોષ મળે છે. એ જ રીતે અનુકમે બીજા, ત્રીજા અને ચોથા એકમમાંથી અનુકમે રૂ.  $40 - રૂ. 10 = રૂ. 30$ , રૂ.  $30 - રૂ. 10 = રૂ. 20$ , રૂ.  $20 - રૂ. 10 = રૂ. 10$  જેટલો અધિક સંતોષ મળે છે. જ્યારે પાંચમા એકમે અને રૂ.  $10 - રૂ. 10 = 0$  જેટલો અધિક સંતોષ પ્રાપ્ત થાય છે.

- ગ્રાહકના અધિક સંતોષના ઘ્યાલની મર્યાદાઓ :-

- (1) અહીં તુલ્યીગુણ માપી શકાય છે તેવી ધારણા કરવામાં આવી છે. જે અવાસ્તવિક છે કારણ કે તુલ્યીગુણ એક માનસિક ઘ્યાલ છે, સાપેક્ષ ઘ્યાલ છે. આથી વસ્તુમાંથી પ્રાપ્ત થતો તુ. ગુ. અનુભવી શકાય છે પણ માપી શકતો નથી.
- (2) નાણાના સીમાંત તુલ્યીગુણને અહીં સ્થિર ધારી લેવામાં આવ્યો છે. વાસ્તવમાં નાણાનો સીમાંત તુલ્યીગુણ બદલાતો રહે છે.
- (3) આ ઘ્યાલમાં વાપરવામાં આવતી વસ્તુને અન્ય વસ્તુથી સ્વતંત્ર વસ્તુ છે તેવી ધારણા કરી છે. પરંતુ દરેક વસ્તુ અન્ય વસ્તુ સાથે સંકળાયેલી હોય છે. તે કોઈની હરીફ, પૂરક કે અવેજ વસ્તુ હોય છે.
- (4) પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ માટે વ્યક્તિ ગમે તેટલી કિંમત ચૂકવવા તૈયાર થાય છે. આથી આવી વસ્તુઓની બાબતમાં આ ઘ્યાલ લાગુ પાડી શકાતો નથી.
- (5) રીવાજ વસ્તુઓ, પ્રણાલિકાગત વસ્તુઓની બાબતમાં પણ આ ઘ્યાલ લાગુ પાડી શકાતો નથી.
- (6) પ્રતિષ્ઠા મૂલ્ય વાળી વસ્તુઓની બાબતમાં પણ આ ઘ્યાલ લાગુ પડતો નથી.
- (7) અહીં દરેક એકમમાંથી કેટલો અધિક સંતોષ મળે છે તે દર્શાવ્યું છે. પરંતુ વાસ્તવમાં અધિક સંતોષ ચોક્કસ રીતે માપી શકતો નથી.
- (8) કોઈ એક વસ્તુના અનેક ગ્રાહકો હોવાથી તેઓને તે વસ્તુમાંથી મળતો અધિક સંતોષ પણ જુદો જુદો હોય છે. આથી વ્યક્તિગત ગ્રાહકના અધિક સંતોષનો સરવાળો શક્ય નથી.
- (9) ગ્રાહકની માંગને અસર કરતાં અન્ય પરિબળોને સ્થિર ધારવામાં આવ્યાં છે. વાસ્તવમાં આ પરિબળો બદલાતા હોય છે. આથી આ ધારણા અવાસ્તવિક છે.

- અધિક સંતોષના ઘ્યાલની ઉપયોગિતા :-

- (1) ગ્રાહકના અધિક સંતોષનો ઘ્યાલ આર્થિક પરિસ્થિતિના એવા લાભો તરફ ધ્યાન દોરે છે કે જે માનવીના રોજબોજના જીવનમાં વિના મૂલ્ય પ્રાપ્ત થાય છે.

- (2) ગ્રાહકના અધિક સંતોષનો ખ્યાલ વપરાશ મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો તફાવત સમજવામાં મદદરૂપ થાય છે.
- (3) ઈજારદારને પોતાની વસ્તુની કિંમત નક્કી કરવા માટે આ ખ્યાલ ઉપયોગી છે.
- (4) આંતરરાષ્ટ્રીય વેપારનો લાભ મુખ્યત્વે અધિક સંતોષના સ્વરૂપમાં મળે છે. જુદા જુદા દેશો વચ્ચે ચીજવસ્તુઓની આયાત-નિકાસને લીધે ભાવો ઘટે છે અને અગત્યની વસ્તુ પણ ઓછા ભાવે પ્રામ થાય છે.
- (5) કરવેરા નક્કી કરવા માટે આ ખ્યાલ ઉપયોગી છે નાણા પ્રધાન એવી વસ્તુ પર વેરા નાખશે જે વસ્તુ ગ્રાહકોને વધુ સંતોષ આપતી હોય.

### **ચારીરૂપ શબ્દો ( Key – Words ) :-**

- (1) તુલ્યિગુણ : - ચીજવસ્તુની જરૂરિયાત સંતોષવાની ક્રમતા ચીજવસ્તુમાંથી પ્રામ થતો અપેક્ષિત સંતોષ.
- (2) સીમાન્ત તુલ્યિગુણ : તે ચીજવસ્તુના છેલ્લા એકમનો તુલ્યિગુણ છે તે ચીજવસ્તુના છેલ્લા એકમના કારણસર એકંદર તુલ્યિગુણમાં થતો વધારો છે.
- (3) માંગ સૂચિ :- જુદા-જુદા નિર્દિષ્ટ ભાવે માંગવા આવતા ચીજવસ્તુન જથ્થાઓનું કોઈકરૂપે નિરૂપણ.
- (4) માંગનો નિયમ :- આ એ વલણ ઘોતક વિધાન છે કે ચીજવસ્તુનો ભાવ ઘટે છે ત્યારે તેની માંગ વધે છે.
- (5) ઉત્તરતી કક્ષાની ચીજવસ્તુઓ :- કેવળ ઓછી આવકવાળી વ્યક્તિઓ દ્વારા આ ચીજવસ્તુઓ બરોદવામાં આવે છે એવી આ ચીજવસ્તુઓ વિશે માન્યતા પ્રવર્તે છે.
- (6) ઘટતા સીમાંત તુલ્યિગુણનો નિયમ :- એ સિધ્યાંત કે જેના પ્રમાણે આપેલી જરૂરિયાતને પૂર્ણ રીતે સંતોષી શકાય છે અને તેથી જેમ જેમ ચીજવસ્તુ વધુને વધુ પ્રામ કરવામાં આવે તેમ તેમ તેનો સીમાંત તુલ્યિગુણ ઘટતો જાય છે.
- (7) તુલ્યિગુણની આંતર વ્યક્તિગત તુલના :- તેનો અર્થ બે વ્યક્તિઓ દ્વારા મેળવતા તુલ્યિગુણની સરખામણી એવો થાય આ તુલના તુલ્યિગુણનું મૂળભૂત માપ કાઢવાની સ્થિતિમાં જ શકાય છે.

### **પ્રશ્નો**

- (1) ઘટતા સીમાંત તુલ્યિગુણનો નિયમ જણાવો.
- (2) ઘટતા સીમાંત તુલ્યિગુણનો નિયમ નાણાને લાગું પડે છે કે કેમ ?
- (3) સમસીમાંત તુલ્યિગુણના નિયમને સમાલોચના પૂર્વક તપાસો.
- (4) સીમાંત તુલ્યિગુણ અને ચીજવસ્તુ માટેની માંગ વિશે ચર્ચા કરો.

(5) એકંદર તુલ્યાની અને સીમાંત તુલ્યાની વચ્ચેનો તફાવત જણાવો.

### **MCQ**

(1) તુલ્યાની કઈ રીતે માપી શકાય છે.

(અ) મૂળભૂત રીતે (બ) કમાંડરપે (ક) અપેક્ષિત (ડ) જરૂરિયાત રીતે

(2) જ્યારે કુલ તુલ્યાની મહત્વમાં હોય ત્યારે સીમાંત તુલ્યાની કેટલો હોય છે ?

(અ) હકારાત્મક (બ) નહકારાત્મક (ક) શૂન્ય (ડ) ગમે તે હોઈ શકે.

(3) માંગ અને સીમાંત તુલ્યાની બંને નહકારાત્મક વલણ ધરાવે છે. કારણ કે

(અ) માંગ અને ભાવ વચ્ચે વ્યસ્ત સંબંધ છે.

(બ) વસ્તુઓના પ્રમાણ અને સીમાંત તુલ્યાની વચ્ચે વ્યસ્ત સંબંધ છે.

(ક) (અ) અને (બ) બંને.

(4) નીચેનામાંથી વસ્તુઓ માટે ઘટતા સીમાંત તુલ્યાનીનો નિયમ લાગુ પડતો નથી.

(અ) તમારું (બ) આઇસકીમ (ક) નાણું (ડ) જૂની ટિકિટો

(5) માંગના નિયમનું ગાણિતિક સ્વરૂપ સૌં પ્રથમ ક્યા અર્થશાસ્ત્રીઓ આપ્યુ હતું.

(અ) આલ્ફેડ માર્શલ (બ) એડમ સ્ટ્રેપ

(ક) જોન રોબિન્સ (ડ) કુનોટ

---

### **તટસ્થવકોનું પૃથ્યકક્રણ :**

---

#### **પ્રસ્તાવના :-**

તુલ્યાની વિશ્લેષણની અવાસ્તવિક ધારણાઓ અને તેના ઉપયોગમાં લેવાયેલા સાધનો તેમજ પદ્ધતિઓ યોગ્ય ન લાગતા અર્થશાસ્ત્રીઓએ તટસ્થ રેખા વિશ્લેષણનો ઘ્યાલ રજૂ કર્યો. પ્રો. એજવર્થ, ફિશરા પેરેટો, લિફ્સ, એલન વગેરે અર્થશાસ્ત્રીઓનો તટસ્થ રેખાનો ઘ્યાલ વિકાસાવવામાં મહત્વનો ફાળો રહ્યો છે.

તટસ્થ રેખા વિશ્લેષણની સૌં પ્રથમ શોધ એજવર્થ નામના અર્થશાસ્ત્રીએ 1881 માં તેમનાં પુસ્તક 'Mathematical Physics' માં કરી હતી. જેમાં તેમણે બે વ્યક્તિઓ વચ્ચે બે વસ્તુઓનો વ્યવહાર થાય છે તે દર્શાવવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. 1892 માં ફિશરે 'Mathematical Investigation In the Theory of Value And Practice' માં તટસ્થરેખાનો ઘ્યાલ રજૂ કર્યો. અને તે દ્વારા ગ્રાહકની સમતુલા સમજાવી હતી. ત્યારબાદ પેરેટો નામના અર્થશાસ્ત્રીએ તેમનાં પુસ્તક 'Manual' માં તટસ્થરેખા દ્વારા ગ્રાહકના વર્તનને

સમજાવવા માંગનો નિયમ રજૂ કર્યો. પેરેટો પછી ઉબલ્યુ. ઈ. જહોનસન દ્વારા પેરેટોની આ વિચાર સરળીને અનુમોદન આપ્યું. 1915 માં રશિયન અર્થશાસ્ત્રી પ્રો. સ્લાટસ્કીએ તેમના પુસ્તક ‘On The Theory of The Budget of The Consumer’ માં ગ્રાહકની સમજુલાના વિવિધ ઘાલો રજૂ કર્યા. તેમણે કમવાચક સંખ્યા પદ્ધતિના આધારે કિંમતમાં થતાં ફેરફારોને લીધે વસ્તુની માંગમાં થતાં કુલ ફેરફારોને આવક અસર અને અવેજ અસરના વહેંચી નાંખવાનો પ્રયાસ કર્યા. ત્યારબાદ બ્રિટનના અર્થશાસ્ત્રી પ્રો. જે. આર. હિક્સ અને પ્રો. આર. ડી. ડેલને 1934 માં ‘ઈકોનોમિકા’ નામના સામયિકમાં ‘A Reconsideration of the Theory of Value’ નામના લેખમાં તત્ત્વસરેખાનો ઘાલ રજૂ કર્યો. 1939 પ્રો. હિક્સે ‘Value And Capital’ નામના તેમનાં પુસ્તકમાં તત્ત્વસરેખા વિશ્લેષણની વૈજ્ઞાનિક રજૂઆત કરી હતી. આમ, તત્ત્વસરેખા પદ્ધતિ એ આર્થિક વિશ્લેષણનું આજનું એક મહત્વનું સાધન છે.

#### તત્ત્વસરેખાની ધારણાઓ :

- (1) ગ્રાહકનું વર્તન તર્કબધ્ય છે, તે પોતાની મયાર્દિત આવકને વિવિધ વસ્તુઓના સંયોજનમાં એવી રીતે ફાળવણી કરે છે કે જેથી તે મહત્તમ સંતોષ પ્રાપ્ત કરી શકે.
- (2) ગ્રાહકની આવક મયાર્દિત છે જે X અને Y બે વસ્તુ પાછળ સંપૂર્ણપણે ખર્ચે છે.
- (3) ગ્રાહક બજાર અંગેની તમામ પરિસ્થિતિઓથી સંપૂર્ણ માહિતગાર છે.
- (4) વાપરવામાં આવતી વસ્તુઓ એક બીજાની અવેજ કે પૂરક છે. આથી વસ્તુની કિંમત, ગુણવત્તા, પ્રાપ્તિ અન્ય વસ્તુની માંગને અસર કરે છે.

જો આવક ઘટે તો કિંમત વસ્તુની, કેટલા પ્રમાણમાં વપરાશ ઘટાડવી, આવક વધે તો કિંમત વસ્તુની કેટલા પ્રમાણમાં વપરાશ વધારવી તેના આધારે તેમની પસંદગીના ધોરણો જાણી શકાય.

#### પસંદગીના ધોરણનો અર્થ :-

‘વસ્તુની કિંમતને કે પોતાની આવકને ધ્યાનમાં લીધા સિવાય, પોતાની જરૂરિયાતની તીવ્રતા કે ફેશન, રૂચિ, ટેવ વગેરે કારણોસર પોતાને મળતા સંતોષની સપાઠીને ધ્યાનમાં રાખીને ગ્રાહક વસ્તુઓ અને સેવાઓના વૈકલ્પિક સંયોજનોની જે કમવાર માનસિક ગોઠવણી કરે છે તેને તેના પસંદગીના ધોરણો કહે છે.’

પસંદગીના ધોરણો વ્યક્તિ વ્યવસાય, સમય તથા સ્વભાવ વગેરે અનુસાર જુદા જુદા હોય છે અને સમય બદલાતા તેમાં પણ ફેરફાર થાય છે. પસંદગીના ધોરણો ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છાને વ્યક્ત કરે છે, તે વ્યક્તિની વસ્તુઓ ખરીદવાની ઈચ્છાનો નકશો છે.

પસંદગીના ધોરણો વસ્તુની કિંમત તથા ગ્રાહકની આવકથી સ્વતંત્ર હોય છે. પસંદગીના ધોરણો પણ તુલ્યગુણની જેમ આત્મલક્ષી, સાપેક્ષ અને માનસિક ઘાલ છે. જો પસંદગીના ધોરણો મગજ પૂર્વક તૈયાર કરવામાં આવે, તે સ્થિર રહે તો જ વાસ્તવિક માંગ રેખા જાણી શકાય.


### તटस्थ रेखानो अर्थ :-

કोઈપણ બે વस્તુઓના જુદા જુદા સંયોજનોમાંથી મળતાં સંતોષની સપાઠીના આધારે વ્યક્તિ દ્વારા યાદી તૈયાર કરવાના આવે અને તેની અન્ય અવેજી અને પૂરક વસ્તુઓનો પણ સાથે સાથે વિચાર કરે. જુદી જુદી વસ્તુઓના વૈકલ્પિક સંયોજનોમાંથી કેટલાક સંયોજનો તેમાંથી મળતા સંયોજનોના આધારે કમશા: ગોઠવવામાં આવે છે. આવા સંયોજનોમાંથી એકસરખો સંતોષ પ્રાપ્ત થતો હવાથી ગ્રાહક તે પ્રત્યે તટસ્થ હોય છે. આપેલી વસ્તુઓનાં એકસરખો સંતોષ દર્શાવતાં જુદાજુદા સંયોજનોની યાદીને તટસ્થ અનુસૂચિ કરે છે. જે નીચેના ઉદાહરણ દ્વારા આપે સમજૂએ.

### તટસ્થ અનુસૂચિ :-

સંયોજન	X વસ્તુ	Y વસ્તુ	સીમાંત અવેજનો દર
A	0	25	-
B	1	20	1 X = 5 Y
C	2	16	1 X = 4 Y
D	3	13	1 X = 3 Y
E	4	11	1 X = 2 Y
F	5	10	• X = 1 Y


- આકૃતિ દ્વારા સમજૂતી :-



ઉપરોક્ત આદૃતમાં OX ધરી પર X વસ્તુના એકમો અને OY ધરી પર Y વસ્તુના એકમો દર્શાવવામાં આવ્યા છે. આદૃતમાં A સંયોજને ગ્રાહક OX અને 25Y ખરીદવા તૈયાર છે. ત્યારબાદ B સંયોજને તે 1X ખરીદવા તૈયાર થાય છે, તેની પાસે X નો એક પણ એકમ ન હોવાથી તે Xના એક એકમ માટે 5Y જતાં કરવા તૈયાર થાય છે. તે જ રીતે અનુક્રમે C, D, E અને F સંયોજને તે Xના એક એક એકમ વધારતો જશે તેમ તેમ તેની પાસે Yના એકમો ઓછા થતાં જશે. આથી ગ્રાહકની Xના એકમ માટે Yના એકમો જતાં તૈયારી ઓછી થતી જશે અનુક્રમે 4, 3, 2 અને 1Y જતાં કરવા તૈયાર થશે. આ તમામ બિંદુઓને જોડતાં IC તરસ્થરેખા પ્રાપ્ત થાય છે. તરસ્થરેખા પર આવેલા તમામ બિંદુઓ પર ગ્રાહકને એકસરખો સંતોષ પ્રાપ્ત થાય છે. આથી તેને સમતૃપ્તિ રેખા પણ કહેવામાં આવે છે. તદ્વપરાંત દરેક સંયોજનમાંથી ગ્રાહકને મળતો સંતોષ એકસરખો હોવાથી તે તેની પસંદગી પ્રત્યે તરસ્થ રહે છે. આથી આ રેખાને તરસ્થરેખા કહે છે.

તરસ્થ રેખાનો નકશો :-

તરસ્થરેખાના સમૂહને તરસ્થરેખાનો નકશો કહે છે. એક જ તરસ્થરેખા પર આવેલા જુદા જુદા બિંદુઓના સંયોજનો એકસરખો સંતોષ દર્શાવે છે. પરંતુ તરસ્થરેખા જેમ ઉપર તરફ જાય તેમ તે વધુ સંતોષ દર્શાવે છે. જે નીચેના તરસ્થરેખાના નકશા દ્વારા જાણી શકાય છે.




ઉપરોક્ત આંકૃતિમાં તટસ્થરેખાઓનો નકશો દર્શાવ્યો છે. જે મુજબ તટસ્થરેખા 1 મજુબ ગ્રાહક A બિંદુએ  $3X$  અને  $9Y$  નું સંયોજન પ્રાપ્ત કરે છે. જો એ ઉપરની તટસ્થરેખા પર જાય. ગ્રાહક અનુક્રમે તટસ્થરેખા 2, તટસ્થરેખા 3 અને તટસ્થરેખા 4 પર જાય છે ત્યારે B, C અને D બિંદુએ  $3X$  અને અનુક્રમે  $11Y$ ,  $15Y$ ,  $20Y$  નું સંયોજન પ્રાપ્ત કરે છે. આમ, અહીં ગ્રાહક જેમ ઉપરની તટસ્થરેખા પર જાય છે તેમ તેમ ને Yના વધારાના એકમને પ્રાપ્ત કરવા Xના એકપણ એકમ જતાં કરવા પડતા નથી. આથી અહીં ગ્રાહક તટસ્થ રહેતો નથી. તેને A કરતાં B માંથી, B કરતાં C માંથી અને C કરતાં D માંથી વધુ સંતોષ મળે છે. આથી તે સોથી ઉપરની તટસ્થરેખાના સંયોજનો પસંદ કરશે.

- તટસ્થ રેખાના લક્ષણો :-

- (1) જેમ તટસ્થ રેખા ઉપર તરફ તેમ વધુ સંતોષ દર્શાવે છે, જેમ તટસ્થરેખા નીચે તરફ તેમ ઓછો સંતોષ દર્શાવે છે. :-

તટસ્થ રેખાનું પ્રથમ લક્ષણ છે કે કોઈ એક તટસ્થરેખા પર આવેલા તમામ બિંદુ પર ગ્રાહક તટસ્થ હોય છે. પરંતુ જો તે ઉપરની તટસ્થરેખા પર જશો તો તેને વધુ સંતોષ મળશે અને જો તે નીચેની તટસ્થરેખા પર જશો તો ઓછો સંતોષ પ્રાપ્ત કરે છે. આ બાબતને નીચેની આંકૃતિ દ્વારા સમજાયે.



$$\text{અહીં} \quad A \text{ સંયોજન} = 4X + 8Y$$

$$B \text{ સંયોજન} = 5X + 9Y$$


$$C \text{ સંયોજન} = 3X + 6Y$$

ઉપરોક્ત આકૃતિમાં દર્શાવ્યા મુજબ OX ધરી પર X વસ્તુના એકમો અને OY ધરી પર Y વસ્તુના એકમો દર્શાવવામાં આવ્યા છે. તટસ્થરેખા 1 મુજબ ગ્રાહક A સંયોજને  $4X$  અને  $8Y$  મેળવે છે. અહીં તટસ્થરેખા 1 પર આવેલા તમામ બિંદુ પર તટસ્થ રહે છે. પરંતુ જો ગ્રાહક તટસ્થરેખા 2 પર જાય તો B બિંદુએ  $5X + 9Y$  નું પ્રામ કરે છે એટલે કે તેને પહેલા કરતા  $1X$  અને  $1Y$  વધુ મળે છે. અહીં તેને X કે Y ના વધારાના 1 એકમ માટે તેની અવેજ વસ્તુ જતી કરવી પડતી નથી. તેને X અને Y બંને પહેલા કરતા વધુ મળતા હોવાથી B બિંદુએ ગ્રાહકને વધુ સંતોષ પ્રામ થાય છે. જો તટસ્થરેખ ઉપર ગ્રાહક જાય તો C બિંદુએ તેને  $3X + 6Y$  નું સંયોજન પ્રામ થાય છે. એટલે કે તેને પહેલા કરતા  $1X$  અને  $2Y$  ઓછા મળે છે. આથી તેના સંતોષમાં ઘટાડો થાય છે. આથી ગ્રાહક C બિંદુ પસંદ કરશે નહિએ.


#### (2) તટસ્થરેખા ઝણા ઢાળવાળી હોય છે :-

તટસ્થરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ જતી ઝણા ઢાળવાળી હોય છે. તટસ્થરેખાની પ્રથમ શરત એ છે કે તટસ્થરેખા પર તમામ બિંદુએ એકસરખો સંતોષ પ્રામ થાય છે તેમજ Xના વધારાના એક એકમ માટે Yના ઓછાને ઓછા એકમો જતાં કરવા તૈયાર થાય છે. આથી તટસ્થરેખાનો ઢાળ ઝણા હોય છે જે નીચેની આકૃતિઓ દ્વારા સમજાએ. જે અંગેની કેટલીક શક્યતાઓ તપાસીએ.

#### (4) જો તટસ્થરેખા આડી ધરીને સમાંતર હોય તો :-




ઉપરોક્ત આકૃતિમાં દર્શાવ્યા મુજબ તટસ્થરેખા  $OX$  ધરીને સમાંતર છે. જે મુજબ ગ્રાહકને A સંયોજનમાંથી  $1X + 4Y$ , B સંયોજનમાંથી  $2X + 4Y$  અને C સંયોજનમાંથી  $3X + 4Y$  પ્રાપ્ત થાય છે. અહીં ગ્રાહક C સંયોજન પસંદ કરશે. કારણ કે તેને A કરતાં B માંથી અને B કરતાં C માંથી  $X$ ના વધારે એકમો પ્રાપ્ત થાય છે. અને  $X$ ના દરેક એકમ માટે Y જતો કરવો પડતો નથી. વાસ્તવમાં તટસ્થરેખાની શરત મુજબ  $X$ ના દરેક એકમ માટે ગ્રાહકે Y જતો કરવો પડે છે અને તે કમશા: Y આપવાનું પ્રમાણ ઘટાડતો જાય છે. તેમજ એક તટસ્થરેખા પર આવેલા તમામ બિંદુઓ એક સરખ સંતોષ દર્શાવે છે. જ્યારે અહીં A, B અને C ત્રણોય બિંદુઓ એકજ તટસ્થરેખા પર આવેલા હોવા છતાં જુદો જુદો સંતોષ દર્શાવે છે. આથી તટસ્થરેખા આડીધરીને સમાંતર હોઈ ન શકે.




આકૃતિમાં દર્શાવ્યા મુજબ જે તટસ્થરેખા ઉભી ધરીને એટલે કે OY ધરીને સમાંતર હોય તો તે મુજબ ગ્રાહકને A બિંદુઓ  $3X + 2Y$ , B બિંદુઓ  $3X + 4Y$  અને C બિંદુઓ  $3X + 6Y$  સંયોજનો પ્રાપ્ત થાય છે. અહીં ગ્રાહક C બિંદુ પસંદ કરશે. કારણ કે તેને A કરતાં B માંથી અને B કરતાં C માંથી વધુ સંતોષ પ્રાપ્ત થાય છે. અને તેને Yના વધારાના એકમો માટે Xના એકમ જતાં કરવા પડતા નથી. અહીં A, B અને C ત્રણોય બિંદુઓ એકજ તટસ્થરેખા પર આવેલા હોવા છતાં જુદો જુદો સંતોષ દર્શાવે છે. આથી તટસ્થરેખા ઉભી ધરીને સમાંતર હોઈ શકે નાહિએ.

(C) જે તટસ્થરેખા ઘન દાળવાળી હોય તો :-



આકૃતિમાં દર્શાવ્યા મુજબ તટસ્થરેખા ઘન દાળવાળી છે. જે મુજબ ગ્રાહકને A બિંદુએ  $1X + 2Y$ , B બિંદુએ  $2X + 4Y$  અને C બિંદુએ  $3X + 6Y$  સંયોજનો પ્રાપ્ત થાય છે. અહીં ગ્રાહક C બિંદુ પસંદ કરશે કારણ કે C બિંદુએ X અને Y બંનેના એકમો વધુ પ્રાપ્ત થાય છે. આમ, A, B અને C ગ્રાહક એક જ તટસ્થરેખા પર આવેલા હોવા જતાં જુદો જુદો સંતોષ દર્શાવે છે. આથી તટસ્થરેખા ઘન દાળવાળી ન હોઈ શકે.

તટસ્થરેખાની શરત મુજબ તટસ્થરેખા ઝડપ દાળવાળી હોવી જોઈએ તેમજ Xના દરેક એકમ માટે ગ્રાહક Y ના ઓછા એકમો જતા કરવા તૈયાર થાય છે તેમજ તટસ્થરેખા પર આવેલા તમામ સંયોજનો એ ગ્રાહક તટસ્થ હોવા જોઈએ. આથી તટસ્થરેખા ઝડપ દાળવાળી હોય છે. જે નીચેની આકૃતિ દ્વારા દર્શાવવામાં આવ્યું છે.




X વસ્તુ

(3) તટસ્થરેખા બહિગોળ હોય છે :-


તટસ્થરેખા અણ ઘણવાળી હોવાની સાથે તે મૂળ તરફથ બહિગોળ હોય છે. જો તટસ્થરેખા અણ ઘણવાળી બહિગોળ ન હોય તો શું પરિસ્થિત હોય, નીચેની આકૃતિઓ દ્વારા તે સમજાએ.

(A) જો તટસ્થરેખા સીધી રેખા હોય છે :-



સંપૂર્ણ અવેજ વસ્તુઓની બાબતમાં તટસ્થરેખા સીધી રેખા હોય છે. દા.ત. ચલણી નાણું આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 રૂ.ની નોટો અને 10 રૂ.ની નોટો એક બીજાની સંપૂર્ણ અવેજ છે. તમે 10 રૂ.ની 1 નોટ આપો કે 1 રૂ.ની 10 નોટ આપો બંને એકબીજાની અવેજમાં સંપૂર્ણ રીતે લઈ શકાય છે. આથી 10 રૂ.ની નોટ અને 1 રૂ.ની નોટ વચ્ચેનો સીમાંત અવેજનો દર સ્થિર રહે છે તેથી તટસ્થરેખા નીચેના ટ્રિકોણો એકસરખા કદના છે. વાસ્તવમાં મોટા ભાગની વસ્તુઓ અપૂર્ણ અવેજ વસ્તુઓ હોવાથી તટસ્થરેખા સીધી રેખા હોઈ શકે નથી.

**(B)** જો તટસ્થરેખા કાટખૂણાવાળી હોય તો ...




પૂરક વસ્તુઓની બાબતમાં તટસ્થરેખા કાટખૂણાવાળી હોય છે. આકૃતિમાં OX ધરી પર બોલપેનના એકમો અને OY ધરી પર રીફીલના એકમો દર્શાવવામાં આવ્યાં છે, જે બંને એકબીજાના પૂરક છે. અહીં ત. રેખા 1 પર A બિંદુએ બોલપેનનો 1 એકમ અને રીફીલનો 1 એકમનું સંયોજન પ્રાપ્ત થાય છે. આથી અહીં ગ્રાહકને 1 પેન જેટલો સંતોષ પ્રાપ્ત થાય છે. B બિંદુ મુજબ બોલપેનના 2 એકમ અને રીફીલના 1 એકમનું સંયોજન મળે છે. અહીં ગ્રાહકને 1 પેન જેટલો જ સંતોષ મળે છે. આમ માત્ર બોલપેનના એકમો વધે અને રીફીલના એકમ સ્થિર રહે તો પણ ગ્રાહકના સંતોષમાં વધારો થતો નથી.

તે જ રીતે C બિંદુએ 1 એકમ બોલપેન અને 2 એકમ રીફીલ છે તો ગ્રાહકને 1 પેન જેટલો જ સંતોષ મળશે. D બિંદુ કે જે ઉપરની તટસ્થરેખા 2 પર આવેલું બિંદુ છે. તે મુજબ ગ્રાહકને 2 બોલપેન અને 2 રીફીલનું સંયોજન મળતાં 2 પેન જેટલો સંતોષ પ્રાપ્ત થાય છે.

આમ, આ પરથી કહી શકાય કે જો પૂરક વસ્તુ હોય તો જ તટસ્થ રેખા કાટખૂણા આકારની હશે. પરંતુ મોટા ભાગની વસ્તુઓ અવેજ હોવાથી તટસ્થરેખા બનિયોળ હશે.


(C) જે તત્ત્વશૈખ અંતગોળ હોય તો ..



સંયોજન.	સીમાંત અવેજનો દર
A = OX + 50Y	-
B = 1X + 49Y	1X = 1Y
C = 2X + 46Y	1X = 3Y
D = 3X + 40Y	1X = 6Y
E = 4X + 30Y	1X = 10Y
F = 5X + 15	1X = 15Y


પરસ્પર વિરોધી વસ્તુઓની બાબતમાં તત્ત્વશૈખ અંતગોળ હોય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ OX ધરી પર સોનાના એકમો અને OY ધરી પર કોલસાના એકમો દર્શાવ્યા છે. જે બંસે પરસ્પર વિરોધી છે. અહીં A સંયોજને ગ્રાહકને OX અને 50Y મળે છે. એટલે કે સોનાના O એકમ અને કોલસાના 50 એકમો મળે છે. સોનાના એકમમાં જેમ જેમ 1 એકમનો વધારો થતો જાય છે તેમ તેમ ગ્રાહક Yના વધુને વધુ એકમો જતાં કરવા તૈયાર થાય છે. ગ્રાહક સોનાના દરેક વધારાના એકમ માટે અનુક્રમે કોલસાના 1, 3, 6, 10 અને 15 એકમો જતાં કરવા તૈયાર કરુશાં: મોટા થતાં જાય છે જે આકૃતિમાં ઘાટા ભાગ દ્વારા દર્શાવવામાં આવ્યું છે.

સામાન્ય રીતે સીમાંત અવેજનો દર ઘટતો હોવો જોઈએ. પરંતુ અહીં સીમાંત અવેજનો દર વધતો જાય છે. આથી તટસ્થરેખા અંતગોળી ન હોઈ શકે.



આકૃતિમાં તટસ્થરેખા બાહ્યગોળી છે. તે અનુસાર  $X$ -ના દરેક એકમ માટે ગ્રાહક  $Y$ -ના ઓછાને ઓછા એકમો જતાં કરવા તૈયાર છે. અવેજ વસ્તુઓ માટે તટસ્થરેખા બાહ્યગોળી હોય છે. અહીં તટસ્થરેખા નીચે આવેલા ત્રિકોણ ક્રમશ: નાના થતાં જાય છે. એટલે કે એક વસ્તુનું પ્રમાણ વધે અને બીજી વસ્તુનું પ્રમાણ ઘટે ત્યારે સીમાંત અવેજનો દર ઘટતો જાય છે. આથી તટસ્થરેખા બાહ્યગોળી હોય છે.

(4) બે તટસ્થરેખા એકખીજને છેદી શકે નથી :-



આકૃતિમાં બે તરસ્થરેખા 1 ને તરસ્થરેખા 2 બંને એકબીજાને B બિંદુએ છેઠે છે. તરસ્થરેખા 1 પર A અને B બિંદુ છે. તેથી તે બંને સરખો સંતોષ દર્શાવે છે. B અને C બિંદુ તરસ્થરેખા 2 પર આવેલા છે અહીં C બિંદુ તરસ્થરેખા 1થી ઉપરની તરસ્થરેખા પર વધુ સંતોષ આપે છે. B અને C બંને એક જ તરસ્થરેખા પર આવેલા હોવાથી સરખો સંતોષ દર્શાવે છે.

સંક્રમતાના નિયમ મુજબ,

$$A = B$$

$$B = C \quad \text{હોય તો}$$

$$A = C \quad \text{થાય.}$$

પરંતુ અહીં A અને C બંને જુદીજુદી તરસ્થરેખા પર આવેલા હોવાથી એકસરખો સંતોષ આપતા નથી. આથી તરસ્થરેખાઓ એકબીજાને છેદી શકતી નથી.

- ઘટતાં સીમાંત અવેજનો દર નો નિયમ :-**

- વ્યાખ્યા :-**


“જ્યારે એક વસ્તુનું પ્રમાણ વધે ત્યારે બીજી વસ્તુનું પ્રમાણ ઘટતું જાય, ત્યારે એક વસ્તુના એક એક એકમમાં વધારો થતો જાય છે તેમ તેમ ગ્રાહક અન્ય વસ્તુના ઓછા ને ઓછા એકમો જતાં કરવા તૈયાર થાય છે. એટલે કે બે વસ્તુઓ વચ્ચેનો સીમાંત અવેજનો દર ઘટતો જાય છે.”

નિયમની ધારણો :-

- (1) બે વસ્તુ X અને Y છે જે બંને એકબીજાની અવેજ વસ્તુ છે.
  - (2) ગ્રાહક X અને Y ના દરેક સંયોજનમાંથી એક સરખો સંતોષ પ્રાપ્ત કરે છે.
  - (3) ગ્રાહક પાસે 25 Y છે અને શૂન્ય X છે.
- ઉદાહરણ દ્વારા સમજૂતી.

સરખો સંતોષ દર્શાવતાની સંયોજનો.	X વસ્તુના એકમો	Y વસ્તુના એકમો	સીમાંત અવેજનો દર
A	0	25	-
B	1	20	$1X=5Y$
C	2	16	$1X=4Y$
D	3	13	$1X=3Y$
E	4	11	$1X=2Y$
F	5	10	$1X=1Y$

ઉપરોક્ત કોષ્ટકમાં X અને Y વસ્તુના જુદા જુદા સંયોજનો દર્શાવવામાં આવ્યો છે. ગ્રાહક પાસે Y ના 25 એકમ છે ત્યારે X ના શૂન્ય એકમો છે. તે X ના કમશા: 1, 2, 3, 4, 5 એકમો ખરીદ છે ત્યારે તેની પાસે Y ના કમશા: 20, 13, 11 અને 10 એકમો બચે છે. એટલે કે X ના દરેક એકમ માટે ગ્રાહક કમશા: 5, 4, 3, 2 અને 1 એકમો એટલે કે ઓછાને ઓછા એકમો જતા કરવા તૈયાર થાય છે.



આકૃતિમાં A બિંદુ દર્શાવે છે કે ગ્રાહક પાસે માત્ર Y ના 25 એકમ છે. જ્યારે X ના શૂન્ય એકમો છે. B બિંદુએ 1X અને 20Y એકમોનું સંયોજન પ્રાપ્ત થાય છે. તેજ રીતે કમશા: C, D, E અને F બિંદુએ X ના પ્રત્યેક એકમે Y ના કમશા: 16, 13, 11 અને 10 એકમો પ્રાપ્ત થાય છે. આ તમામ બિંદુઓને જોડતા જે રેખા પ્રાપ્ત થાય છે તેને સમતૃપ્તિ રેખા કે તટસ્થરેખા કહે છે. તટસ્થરેખા પર આવેલા તમામ બિંદુઓએ એકસરખો સંતોષ પ્રાપ્ત કરે છે.

આકૃતિમાં તટસ્થરેખા ઝડપ ટાળવાળી બહિગોળ રેખા છે. આથી તેની નીચેના ત્રિકોણો નાના થતાં જાય છે. જે દર્શાવે છે કે X ના એકમ માટે ગ્રાહક Y ના ઓછા ને ઓછા એકમો જતાં કરવા તૈયાર થાય છે.

(3) Y વસ્તુની 'જરૂરિયાત સંતોષવાની શક્તિ'માં વધારો થતો નથી :-

જો ગ્રાહક પાસે X નું પ્રમાણ વધવાની સાથે Y ની ગ્રાહકોની જરૂરિયાત સંતોષવાની શક્તિમાં વધારો થાય તો X નું વધારે એકમ મેળવી, સંતોષની એકસરખી સપાઈ પર રહેવા માટે, ગ્રાહક ય ના વધુને વધુ એકમ ચૂકવવાં પડશે. એટલે કે X અને Y નો સીમાંત અવેજીનો દર વધે છે.

- સીમાંત અવેજુ દરના નિયમના અપવાદો :-

  - (1) સંપૂર્ણ અવેજુ વસ્તુ મટે ઘટતા સીમાંત અવેજનો દરનો નિયમ લાગુ પડતો નથી.
  - (2) પૂરક વસ્તુઓ માટે ઘટતા સીમાંત અવેજના દરનો નિયમથી ઉલ્લંબ બને છે.
  - (3) પરસ્પર વિરોધી વસ્તુની બાબતમાં સીમાંત અવેજનો દર ઘટવાને બદલે વધે છે.

- ઘટતા સીમાંત અવેજના દરના નિયમની ઉપયોગિતા :-

  - (બ) બ્યક્ટિત, પેઢી કે રાખ્ણે મયાર્દિત સાધનોની ઈચ્છતમ ફાળવણી કરી મહત્તમ ઉત્પાદન, મહત્તમ સંતોષ કે મહત્તમ કલ્યાણની સપાઠી કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેની સમજૂતી સીમાંત અવેજુ દરના નિયમમાંથી જાણી શકાય છે.

- નિયમની મર્યાદાઓ :-


  - (1) આ નિયમમાં ઘટતા સીમાંત તુલ્યિગુણના નિયમ મુજબ મહત્તમ સંતોષ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેવી ધારણા કરવામાં આવી છે. વાસ્તવમાં સંતોષનો ઘ્યાલ માનાસિક ઘ્યાલ હોવાથી તે અનુભવી શકાય છે પરંતુ માપી શકતો નથી.
  - (2) અવિમાજ્ય વસ્તુઓ માટે આ નિયમ લાગુ પાડી શકાય નહિ.
  - (3) ગ્રાહકોનું વર્તન તર્કબધ્ય છે તેવી ધારણા અવાસ્તાવિક છે હંમેશા ગ્રાહક બજારની તમામ માહિતીથી સંપૂર્ણ માહિતગાર અને તે તર્કબધ્ય વર્તન કરે છે તેવું બનતું નથી.

- તક રેખા અથવા આવક રેખા અથવા કિંમત રેખા અથવા અંદાજપત્ર રેખા અથવા બજેટ રેખા :-

- કોઈપણ વસ્તુની માંગ ગ્રાહકની ખરીદવાની ઈચ્છા, શક્તિ અને વૃત્તિ પર આધાર રાખે છે. તટસ્ય રેખા દ્વારા ગ્રાહકની ખરીદવાની ઈચ્છા કે પસંદગીઓ વ્યક્ત થાય છે. પરંતુ માંગ ખરીદવાની ઈચ્છા ખરીદવાની શક્તિ પર આધાર પર પડી આધાર રાખે છે. આ બાબતને આપણે તકરેખાના ઘ્યાલ દ્વારા સમજીએ.

ધારો કે ગ્રાહકની આવક 24 રૂ. છે. X ની કિંમત 4 રૂ. અને Y ની કિંમત 2 રૂ. છે. તો નીચે પ્રમાણેની પરિસ્થિતિ સર્જશે.

સંયોજનો	X વસ્તુ	Y વસ્તુ	સીમાંત અવેજનો દર
A	0	12	--
B	1	10	$1X = 2Y$
C	2	08	$1X = 2Y$
D	3	06	$1X = 2Y$
E	4	04	$1X = 2Y$
F	5	02	$1X = 2Y$
G	6	00	$1X = 2Y$




ઉપરોક્ત આકૃતિમાં OX ધરી પર X વસ્તુના એકમો અને OY ધરી પર Y વસ્તુના એકમો દર્શાવવામાં આવ્યા છે. A સંયોજને ગ્રાહક પાસે માત્ર Yના 12 એકમો છે. ગ્રાહક Xના પ્રથમ એકમ માટે Yના 2 એકમ ખર્ચ કરે છે. આથી B બિંદુએ 1X અને 10Y નું સંયોજન પ્રાપ્ત કરે છે. એ જ રીતે કમશા: C, D, E, F બિંદુએ Xના 2, 3, 4, 5 એકમો અને Y ના 10, 08, 06, 04, 02 એકમો મેળવે છે. Xના 6 એકમ ગ્રાહકની સંપૂર્ણ આવક ખર્ચ થઈ જાય છે આથી Yના શૂન્ય એકમ મળે છે. આ તમામ બિંદુઓને જોડતા પ્રાપ્ત થતી રેખાને તકરેખા કહે છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ તકરેખા સીધી રેખા છે તેમજ અણ ફળવાળી છે. તક રેખા નીચેના તમામ ત્રિકોણ એકસરખું કંઈ ધરાવે છે. જે દર્શાવે છે કે સીમાંત અવેજાનો દર એકસરખો રહે છે. એટલે કે  $X$  ના પ્રત્યેક એકમ માટે ગ્રાહક  $Y$  ના 2 એકમ જતાં કરે છે.

તક રેખાને કિંમતરેખા કે અંદાજપત્ર રેખા પણ કહે છે. કારણ કે ગ્રાહક જ્યાં સુધી તેની બધી આવક  $X$  અને  $Y$  પાછળ ખર્ચ ના કરે ત્યાં સુધી તે પોતાની ખરીદી કરે છે. તે પોતાની કિંમત રેખાની બહારની બાજુએ આવેલા કોઈપણ સંયોજનને પસંદ કરી શકતો નથી. તેમજ ગ્રાહક સંપૂર્ણપણે પોતાની આવક ખર્ચે છે તે ધારકા કરી હોવાથી તે તકરેખાની અંદરનાંભાગમાં આવેલું કોઈપણ સંયોજન પસંદ કરતો નથી. આથી ગ્રાહક તેની તકરેખા પર આવેલા સંયોજનોમાંથી જ એક સંયોજન પસંદ કરે છે.

તક રેખાના સ્થાનમાં ફેરફાર : -

જો ગ્રાહકની આવકમાં વધારો થાય અથવા કિંમતમાં ઘટાડો થાય તો તકરેખા ઉપર તરફ જશે અને જો ગ્રાહકની આવકમાં ઘટાડો થાય અથવા કિંમતમાં વધારો થાય તો તકરેખા નીચે તરફ ખસશે. જે નીચેની આકૃતિ દ્વારા દર્શાવી શકાય.



આકૃતિમાં દર્શાવ્યા મુજબ  $PL$  મૂળ કિંમત રેખા છે. ધારો કે ગ્રાહકની આવક 100 રૂ. એ.  $X$  ની કિંમત 2 રૂ. છે અને  $Y$  ની કિંમત 2 રૂ. છે ત્યારે ગ્રાહક  $50X$  અથવા  $50Y$  ખરીદી શકે છે. જો  $X$  અને  $Y$  ની કિંમત ઘટીને 1 રૂ. થાય તો ગ્રાહક હવે  $X$  ના વધુમાં વધુ 100 એકમો અથવા  $Y$  ના વધુમાં વધુ 100 એકમો ખરીદે છે. આથી નવી તકરેખા  $P1L1$  - અસ્તિત્વમાં આવે છે. જે મૂળ તક રેખાની ઉપરની તરફ ખસે છે.

જો X અને Y ની કિંમત વધીને 4 રૂ. થાયતો ગ્રાહકે હવે Xના વધુમાં વધુ 25 એકમો અથવા Y ના વધુમાં વધુ 25 એકમો ખરીદે છે. આથી તકરેખા મૂળ તકરેખાની નીચે તરફ ખસશે અને નવી તકરેખા 52L2 અસ્તિત્વમાં આવે છે.

કિંમતરેખાનું સ્થાન બદલાય છે ત્યારે વસ્તુઓની કિંમત વચ્ચેનો ગુણોત્તર ( Px )

PY

બદલાતો ન હોવાથી વસ્તુઓ વચ્ચેની અવેજનો સીમાંતદર ( Y ) પણ બદલાતો નથી.

X



આથી કિંમત રેખાનું માંગ સ્થાન બદલાય છે. ટાળ બદલાતો નથી.

(ii) તક રેખાના ગ્રામમાં ફેરફાર :-


(a) જો Y ની કિંમત સ્થિર રહે અને X ની કિંમતમાં ફેરફાર થાય તો માંગ રેખાનો નીચેનો ટાળ બદલાય છે. દા.ત. ગ્રાહકની આવક 100 રૂ. છે.

$$X \text{ ની કિંમત } 1 = 10 \text{ રૂ.}$$

$$X \text{ ની કિંમત } 2 = 5 \text{ રૂ.}$$

$$X \text{ ની કિંમત } 3 = 25 \text{ રૂ.}$$

$$Y \text{ ની કિંમત } = 10 \text{ રૂ. છે.}$$



ઉપરોક્ત આકૃતિમાં દર્શાવ્યા મુજબ X પ્રથમ કિંમત 10 રૂ. છે ત્યારે ગ્રાહક 10X અથવા Y ની કિંમત 10 રૂ. છે ત્યારે ગ્રાહક વધુમાં વધુ 10Y ખરીદે છે. જે PL તક રેખા દ્વારા દર્શાવવામાં આવ્યું છે. Y ની કિંમત સ્થિર રહે છે. X ની કિંમત ઘટીને 5 રૂ. થતાં તે વધુમાં વધુ 10Y અથવા 20X ખરીદે છે. આથી નવી તકરેખા P1L1 અસ્તિત્વમાં આવે છે. X ની કિંમત વધીને 25 રૂ. થતાં તે X ના વધુમાં વધુ 4 એકમો અને Y ના વધુમાં વધુ 10 એકમો ખરીદે છે. આથી નવી

તકરેખા P2L2 અસ્તિત્વમાં આવે છે. અહીં Y ની કિંમત સ્થિર રહે છે અને X ની કિંમતમાં ફેરફાર થતો હોવાથી તકરેખાનો દાળ ઓછો તીવ્ર છે જ્યારે તકરેખા 3 નો દાળ વધુ તીવ્ર બને છે. કિંમતરેખાનો દાળ X અને Y વસ્તુઓ વચ્ચેના અવેજના સીમાંત અવેજનો દર  $\frac{Y - PX}{X - PY}$  દારા નક્કી થાય છે. જે X અને Y માટેનો સીમાંત અવેજનો દર બદલાય તો કિંમત રેખાનો દાળ બદલાય છે.

(બી) જે X ની કિંમત સ્થિર રહે અને Y ની કિંમતમાં ફેરફાર થાય તો કિંમત રેખાનો ઉપરનો દાળ બદલાય છે. દા. ત. ગ્રાહકની આવક 100 રૂ. છે.


$$X \text{ ની કિંમત} = 10 \text{ રૂ.}$$

$$Y \text{ ની કિંમત} 1 = 10 \text{ રૂ.}$$

$$Y \text{ ની કિંમત} 2 = 5 \text{ રૂ.}$$

$$Y \text{ ની કિંમત} 3 = 20 \text{ રૂ. છે.}$$

આથી નીચે મુજબ પરિસ્થિતિ સર્જશે.



ઉપરોક્ત આંકૃતિમાં દર્શાવ્યા મુજબ X ની કિંમત 10 રૂ. સ્થિર રહે છે. ગ્રાહક તેની આવકમાંથી વધુમાં વધુ 10X ખરીદે છે. Y ની કિંમત 10 રૂ. છે ત્યારે ગ્રાહક 10Y ખરીદી શકે છે. જે આંકૃતિમાં PL તકરેખા દારા દર્શાવવામાં આવ્યું છે. Y ની કિંમત ઘટીને 5 રૂ. થતાં ગ્રાહક હવે વધુમાં વધુ 20Y ખરીદી શકે છે. જ્યારે X ની કિંમત 10 રૂ. સ્થિર હોવાથી તે વધુમાં વધુ 10X ખરીદી શકે છે. આવી નવી તકરેખા P1L1 અસ્તિત્વમાં આવે છે. જેનો દાળ PL કરતા વધુ તીવ્ર છે. Y ની કિંમત વધીને 20 રૂ.

થતાં ગ્રાહક હવે વધુમાં વધુ 5Y ખરીદી શકે છે. આથી નવી તક રેખા P2L2 અસ્તિત્વમાં આવે છે. જેનો ટાળ PL તકરેખા કરતાં ઓછો તીવ્ર હોય છે.

### ગ્રાહકની સમતુલ્યા :-


#### પ્રસ્તાવના :-

પ્રો. છિક્સ અને એલને તટસ્થરેખા વિશ્વેષણના આધારે ગ્રાહકની સમતુલ્યા સમજાવવા પ્રયત્ન કર્યો છે. તેઓના મતે તટસ્થારેખાઓ ગ્રાહકની પસંદગી સૂચવે છે જ્યારે કિંમતરેખા કે તકરેખા ગ્રાહક X અને Y ના કયા કયા વિકલ્પો ખરીદી શકે છે તેની શક્યતાઓ દર્શાવે છે.

- ગ્રાહકની સમતુલ્યાનો અર્થ :- “ગ્રાહક વસ્તુની ખરીદી એવી રીતે કરે છે કે જેથી તેને શક્ય તેટલો મહત્તમ સંતોષ મળે. ગ્રાહકની સમતુલ્યા એટલે એવી પરિસ્થિતિ કે જ્યાં પહોંચ્યા પછી ગ્રાહક તેની ખરીદીમાં વધારો કે ઘટાડો કરતો નથી. ” સમતુલ્યાની સ્થિતિએ સ્થિરતાની સ્થિતિ છે. ગ્રાહક સમતુલ્યાની સ્થિતિમાં તર્કબધ્ય હોય છે.
- ધારણાઓ :-  
ગ્રાહકની સમતુલ્યા સમજાવવા માટે નીચે મુજબની ધારણાઓ કરવામાં આવી છે.

  - (1) ગ્રાહકનું વર્તન તર્કબધ્ય છે તે મહત્તમ સંતોષ પ્રાપ્ત કરવા ઈચ્છે છે.
  - (2) વસ્તુના એકમો સમાનગુણી અને વિભાજ્ય છે.
  - (3) ગ્રાહકના X અને Y વસ્તુના પસંદગીના ધોરણો તટસ્થરેખાના નકશા દ્વારા દર્શાવવામાં આવ્યાં છે અને તે સ્થિર રહે છે.
  - (4) ગ્રાહકની આવક મયાર્દિત છે અને તે X અને Y વસ્તુ પાછળ સંપૂર્ણપણે ખર્ચ કરે છે. ધારો કે, ગ્રાહકની આવક 100 રૂ. છે.
  - (5) ગ્રાહક બજારની તમામ પરિસ્થિતિઓથી સંપૂર્ણ માહિતગાર છે.
  - (6) વસ્તુઓની કિંમત આપેલી છે અને ગ્રાહક તેનાથી માહિતગાર છે. ધારો કે Xની કિંમત 10 રૂ. અને Yની કિંમત 10 રૂ. છે. જે સ્થિર રહે છે.

## આકૃતિ દ્વારા સમજૂત



ઉપરોક્ત આકૃતિમાં OX ધરી પર X વસ્તુના એકમો અને OY ધરી પર Y વસ્તુનાં એકમો દર્શાવવામાં આવ્યાં છે. આકૃતિમાં તટસ્થરેખાનો નકશો તેમજ તકરેખા દર્શાવવામાં આવ્યાં છે. આકૃતિમાં તટસ્થરેખા 1 પર P1 અને P2 બિંદુ આવેલા છે.

આકૃતિમાં તટસ્થરેખા 2 પર આવેલું P3 - બિંદુ સૌથી વધુ સંતોષ દર્શાવે છે. આ તટસ્થરેખા ઉપર તરફ તેમ વધુ સંતોષ દર્શાવે છે. આથી P7 બિંદુ સૌથી વધુ સંતોષ દર્શાવે છે. પરંતુ ગ્રાહકની આવક મયોડિટ છે જો ગ્રાહકની આવક અમયોડિટ હોત તો P7 બિંદુ પસંદ કરશે. પરંતુ અહીં આવક મયોડિટ હોવાથી P7 બિંદુ ઈચ્છતા હોય છે. પરંતુ ખરીદવા શક્ય નથી. એ જ રીતે P6 બિંદુ પણ અશક્ય છે. કારણ કે P6 બિંદુ પણ તકરેખાથી ઉપરની તટસ્થરેખા પર આવેલું હોવાથી વધુ સંતોષ આપતું હોવા છતાં તે બિંદુએ ખરીદી શક્ય જ નથી. આથી ગ્રાહક P6 અને P7 બિંદુ પર સમતુલા પ્રામ નહિ કરી શકે.

તકરેખા X અને Yના વધુમાં વધુ કેટલા એકમો ખરીદી શક્ય તેની શક્યતા દર્શાવે છે. આકૃતિમાં તટસ્થરેખા 1 પર P1 અને P2 બિંદુઓ આવેલા છે. જે તટસ્થરેખા 2 પર આવેલા P3 અને તટસ્થરેખા 3 4 2 P4 બિંદુ કરતાં ઓછો સંતોષ આપે છે. આથી ગ્રાહક P3 અથવા

P4 બિંદુ પસંદ કરે છે. પરંતુ ગ્રાહકની આવક હજુ પણ વધુ હોવાથી તે ઉપરની તટસ્થરેખા પર જઈ શકે તેમ હોવાથી તે P1, P2, P3 કે P4 બિંદુ પસંદ કરતો નથી.


તટસ્થરેખા તે પર આવેલું P5 બિંદુ કે જ્યાં તકરેખા અને તટસ્થરેખા એકબીજાને સ્પર્શે છે. અને તે બિંદુએ ગ્રાહક પોતાની સમક્ષ આવક X અને Y વસ્તુ પાછળ ખર્ચ કરે છે. આથી P5 બિંદુએ ગ્રાહક મહત્વામાં સંતોષ મેળવી સમતુલા પ્રાપ્ત કરે છે.

આમ, સમતુલા પ્રાપ્તિ માટે મુખ્ય બે શરતો અનિવાર્ય છે.

- (i) તકરેખા અને તટસ્થરેખા એકબીજાને સ્પર્શતી હોવી જોઈએ.
- (ii) તટસ્થરેખા ઋણ ઢાળી બાંધગોળ હોવી જોઈએ.

જો આ બે શરતો પૂર્ણ થાય તો જ ગ્રાહક સમતુલા પ્રાપ્ત કરી શકે છે. બે માંથી એક પણ શરત ગેરહાજર હોય તો સમતુલા મળતી નથી. જે નીચેની શક્યતાઓ ઉપરથી સમજૂ શકાય.


જો તટસ્થરેખા અંતગોળ હોય તો ...



જો તટસ્થરેખા અંતગોળ હોય તો S1 બિંદુએ તટસ્થરેખા 2 અને તકરેખા એકબીજાને સ્પર્શે છે ત્યાં ગ્રાહક સમતુલા મેળવે છે S1 બિંદુએ ગ્રાહકને Y ના ઓછા અને X ના વધુ એકમો મળે છે. જો ગ્રાહક તટસ્થરેખા તે પર આવેલું S2 બિંદુ પસંદ કરી સમતુલા મેળવે તો S2 બિંદુએ X ના ઓછા અને Y ના વધુ એકમો મેળવે છે. આમ અહીં ગ્રાહક ક્રયું બિંદુ પસંદ કરશે તે બાબતમાં અસ્થિર બને છે. આથી અહીં ગ્રાહકની સમતુલા અસ્થિર બને છે. આકૃતિમાં તટસ્થરેખા 1 પર

આવેલું S બિંદુ કે જ્યાં તકરેખા અને તટસ્થરેખા 1 એકબીજાને સ્પર્શો છે છતાં ત્યાં સમતુલા આવતી નથી. કારણ કે, S બિંદુ કરતાં ગ્રાહક S1 કે S2 બિંદુ પર વધુ સંતોષ મળતો હોવાથી તે S1 કે S2 બિંદુ પસંદ કરશે. પરંતુ અહીં ગ્રાહકની સમતુલાની એકજ શરત પૂર્ણ થાય છે. કે તકરેખા અને તટસ્થરેખા એક બીજાને સ્પર્શતી હોવી જોઈએ. પણ બીજી શરત તટસ્થરેખા બિંગોળ હોવી જોઈએ તે પૂર્ણ થતી નથી. આથી તટસ્થરેખા અંતગોળ હોય તો ગ્રાહક સમતુલા પ્રાપ્ત કરતો નથી.


ઓ તટસ્થરેખા કાટખૂણાવાળી હોય તો ...



ઓ પૂરક વસ્તુઓ હોય તો તટસ્થરેખા કાટખૂણાવાળી હોય છે. અહીં તટસ્થરેખા 1 પર આવેલા P1, P2 અને તટસ્થરેખા 2 પર આવેલા P3 અને P4 બિંદુ ગ્રાહક પસંદ કરતો નથી. કારણ કે P1, P2 સૌથી નીચેની તટસ્થરેખા પર આવેલા હોવાથી ઓછો સંતોષ દર્શાવે છે. P3, P4 બિંદુ ઉપરથી તટસ્થરેખા પર હોવા છતાં તેનાથી વધુ ખરીદી શક્ય હોવાથી ગ્રાહક P3 કે P4 બિંદુ પસંદ નહિ કરે. P6 બિંદુ તટસ્થરેખા 4 પર એટલે કે સૌથી ઉપરની તટસ્થરેખા પર આવેલું

છે. આથી તે સૌથી વધુ સંતોષ દર્શાવે છે. પરંતુ તે તકરેખાથી ઉપરની તરસ્થરેખા પર આવેલું હોવાથી અશક્ય છે. P5- બિંદુએ તકરેખા અને તરસ્થરેખા ત એક બીજાને સ્પર્શો છે. આથી ગ્રાહક P5 બિંદુએ સમતુલા પ્રામ કરે છે.

જો તરસ્થરેખા સીધી રેખા હોય તો ...



જો સંપૂર્ણ અવેજ વસ્તુ હોય તો તરસ્થરેખા સીધી રેખા હોય છે. આકૃતિમાં તરસ્થરેખા 1 પર આવેલું P1 બિંદુ તરસ્થરેખા 2 પર આવેલા P2 બિંદુ વધુ સંતોષ આપતું હોવાથી P2 બિંદુ પસંદ કરશે. P4 બિંદુ સૌથી ઉપરની તરસ્થરેખા 4 પર આવેલું હોવાથી સૌથી વધુ સંતોષ દર્શાવે છે. તેમ છતાં ગ્રાહક P4 બિંદુ સુધી જઈ શકતો નથી. કારણ કે ગ્રાહકની આવક મળીદિત છે. P5 બિંદુએ તકરેખા અને તરસ્થરેખા 3 એક બીજાને સ્પર્શો છે. અને તે બિંદુએ ગ્રાહક પોતાની સમગ્ર આવક X અને Y વસ્તુ પાછળ ખર્ચ કરે છે. આથી P5 બિંદુએ ગ્રાહક મહત્તમ સંતોષ પ્રામ કરી સમતુલા પ્રામ કરે છે.

## ચાવી રૂપ શબ્દો ( Key Words )

- (1) ભાવ વપરાશ વક્ત : જ્યારે ચીજવસુના ભાવમાં ફેરફારના કારણે અંદાજપત્ર ભાવ રેખા ખસે છે ત્યારે તટસ્થતા વક્ત સહિત અંદાજપત્ર ભાવ રેખાની સ્પર્શ રેખાના બધા બિંદુઓનો તે બિંદુ પથ હોય છે.
  - (2) તટસ્થતા વક્ત : તટસ્થતા સૂચિનું આવેખમાં નિરૂપણ.
  - (3) તટસ્થતા સૂચિ : તે એકસરખો સંતોષ આપતા X અને Y ના બધાં સંયોજનોનું કોષ્ટક રૂપે નિરૂપણ કરે છે.
  - (4) અવેજનો સીમાન્ત દર : X નો એક વધુ એક મેળવવા માટે, સીમાન્ત સ્થિતિમાં, વપરાશકાર Y નો જે જથ્થો જતો કરવા તૈયાર હોય તેને Y ના ના બદલે X મેળવવાના અવેજના સીમાન્ત દર તરીકે વ્યાખ્યાપિત કરવામાં આવ્યો છે.

ਪ੍ਰਸ਼ਾਸਨ

- (1) દૂંકનોંધ લખો : અવેજાનો સીમાંત દર.
  - (2) તટસ્થતા વકોના ગુણ ધર્મો જણાવો.
  - (3) તટસ્થતા વકની સહાય વડે વપરાશકાર દ્વારા સમતોલ સ્થિતિએ પહોંચવાની બાબત સમજાવો.
  - (4) અંદાજપત્ર ભાવ રેખા એક અને માત્ર એક તટસ્થતા વકની સ્પર્શરેખા હોય છે એ દર્શાવો.

MCQ

(4) સીમાંત અવેજનો દર એટલે શું ?

(અ) વસ્તુ X અને Y અવેજ

(બ) વસ્તુ Y અને X અવેજ

(ક) વસ્તુ Z અને Y અવેજ

(ડ) વસ્તુ Y અને Z અવેજ.

(5) સીમાંત અવેજના દરનું બીજું નામ જણાવો.

(અ) દુષ્ટિગુણ      (બ) વૈયક્તિક દર      (ક) એક્સરખો દર

(ડ) સમતૃલાનો છે

(6) બજેટ રેખાનું બીજું નામ શું છે ?

(અ) તકરેખા, કિંમતરેખા      (બ) એક્સરખી રેખા

(ક) આધુનિક રેખા      (ડ) સમતૃપ્તિ રેખા.

### જવાબ :

(1) અ      (2) બ      (3) અ      (4) અ      (5) બ      (6)  
અ

---

### 2.4 વપરાશકારની માંગ :

---

#### પ્રસ્તાવના :-

સામાન્ય રીતે માંગનો અર્થ વ્યક્તિની કંઈક મેળવવાની દરદ્વારા અથવા જરૂરિયાત એવો કરવામાં આવે છે. પરંતુ અર્થશાસ્ત્રમાં માંગનો અર્થ જુદ્દો છે. અહીં આપણે માંગનો અર્થ સમજવા માટે નીચેની શરતો સમજવી જરૂરી છે.

#### (1) દરદ્વા :-

ગ્રાહકને વસ્તુ ખરીદવાની દરદ્વા હોવી જોઈએ જો ગ્રાહકની કોઈ વસ્તુ કે સેવા ખરીદવાની દરદ્વાજ ન હોય તેની માંગ થશે નહિ. દા.ત. રેતી, ઝેર, દીટ જેવી નિર્જવ વસ્તુઓની માંગ કરતો નથી. કારણ કે નિર્જવ વસ્તુઓની દરદ્વા હોતી નથી. જે જીવંત છે તેની શારીરિક-માનસિક જરૂરિયાતો હોય છે, તેથી તે દરદ્વા કરે છે. અને તેથી તે વસ્તુની માંગ કરે છે.

## (2) ખરીદશક્તિ :-

ગ્રાહક વસ્તુ ખરીદવાની ઈચ્છા ધરાવતો હોય પરંતુ તે વસ્તુ ખરીદવાની તેની શક્તિ ન હોય તો માંગ થઈ શકે નાહિ. દા. ત. કોઈ વ્યક્તિ મસ્તિઝ ગાડી લેવાની ઈચ્છા ધરાવતો હોય પરંતુ તે ગાડી ખરીદવા જેટલા તેની પાસે પેસા ન હોય તો માંગ થતી નથી. આથી, વસ્તુ ખરીદવાની ઈચ્છા સાથે તે વસ્તુ ખરીદવાની શક્તિ પણ હોવી જરૂરી છે. તો જ માંગ શક્ય બને છે.

## (3) ખર્ચ કરવાની વૃત્તિ :-

ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય, ખરીદવાની શક્તિ પણ હોય પણ ખરીદવાની વૃત્તિ ન હોય તો માંગ ન થાય. કેટલાક ગ્રાહકો કંજૂસ હોય છે. વસ્તુ ખરીદવાની ઈચ્છા અને તે માટે તેની પાસે પેસા હોવા છતાં પેસા ખર્ચ કરવા તૈયા થતાં નથી. જો તે પેસા ખર્ચ કરવા તૈયાર હોય તો જ ઈચ્છા માંગ બને છે.

## (4) સમયની અનુકૂળતા :-

ઘડીવાર વ્યક્તિની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને વૃત્તિ હોય પણ તે વસ્તુ ખરીદવા જવા માટે સમય ન મળતો હોયતો પણ માંગ તે સમયે થતી નથી. આથી માંગ માટેની ચોથી શરત સમયની અનુકૂળતા છે. દા.ત. વ્યક્તિ કોમ્પ્યુટર ખરીદવા ઈચ્છે છે, તેની શક્તિ અને વૃત્તિ છે છતાં તે ખરીદવા માટે વ્યક્તિને હુકાન સુધી જવાનો સમય ન હોય તો તે કોમ્પ્યુટરની માંગ થતી નથી.

## (5) વસ્તુની ઉપલબ્ધિ :-

વસ્તુની ખરીદવાની ઈચ્છા, શક્તિ, વૃત્તિ હોય, ગ્રાહક પાસે વસ્તુ ખરીદવાનો સમય પણ હોય પરંતુ બજારમાં તે વસ્તુ ઉપલબ્ધ ન હોય તો માંગ થઈ શકે નાહિ. દા.ત. વ્યક્તિ Apple નો Iphone- II લેવા ઈચ્છે છે, તેની ફોન ખરીદવાની શક્તિ, વૃત્તિ છે અને સમયની અનુકૂળતા પણ છે પરંતુ બજારમાં તે મોબાઇલ ફોન ઉપલબ્ધ ન હોય તો તેની માંગ થઈ શકે નાહિ. આથી માંગની પાંચમી શરત વસ્તુની ઉપલબ્ધિની છે. તો જ માંગ થઈ શકે.

## (6) સમયનો સંદર્ભ :-

કેટલીક વસ્તુઓની માંગ સમય આધારિત હોય છે. સમય બદલાતા માંગ પણ બદલાય છે. જેમ કે શિયાળામાં ગરમ કપડાની માંગ, ચોમાસામાં છત્રી કે રેઇનકોટની.

## (7) ભવિષ્યના ભાવ વિશેના અંદાજો :-

ભવિષ્યનાં ભાવ વિશેના અંદાજો પણ માંગમાં ફેરફાર લાવે છે. જો ભવિષ્યમાં વસ્તુનાં ભાવ ઘટવાનો અંદાજ હોય તો વર્તમાનમાં વસ્તુનો ભાવ વધ્યો ન હોવા છતાં વસ્તુની માંગ ઘટે છે અને જો ભાવ વધવાનો અંદાજ હોય તો વર્તમાનમાં ભાવ ઘટ્યાં ન હોવા છતાં વસ્તુની માંગ વધે છે.

- માંગનું વિધેય :- ગ્રાહકની માંગને અસર કરતાં અન્ય પરિબળો યથાવત રહે અને કિંમતમાં ફેરફાર થાય તો માંગમાં ફેરફાર થાય છે એટલે કે માંગનો આધાર કિંમત પર હોય તો માંગનું વિધેય નીચે મુજબ લખી શકાય.

$$Dx = f(Px, y, t, Py, Pz)$$

$dx = x$  વસ્તુની માંગ

$Px = x$  વસ્તુની કિંમત

$Y =$  ગ્રાહકની આવક

$T =$  ગ્રાહકની સુધી

$Py = Y$  વસ્તુની કિંમત - પુરક વસ્તુ

$Pz = Z$  વસ્તુની કિંમત - અવેજ વસ્તુ.

- બજારની માંગ નક્કી કરતા પરિબળો :-

### (1) વસ્તીનું કદ :-

અન્ય પરિબળો યથાવત રહે અને માત્ર વસ્તીનું કદ વધે તેમ બજારમાં વસ્તુઓની માંગ વધે છે. એટલે કે દેશમાં જન્મદર વધે, મૃત્યુદર ઘટે, અન્ય દેશમાંથી વસ્તુનું સ્થળાંતર થાય વગેરેને કારણે વસ્તીનું કદ વધે છે. અને એનાથી ઉલ્લંઘે જન્મદર ઘટે, કે મૃત્યુદરમાં વધારો થાય, કે નાનો દેશ હોય તો વસ્તીનું કદ ઘટે તો માંગ ઘટે છે.

### (2) આવકની વહેંચણી :-

જો દેશમાં રાષ્ટ્રીય આવકની અસમાન હોય એટલે કે દેશની કુલ રાષ્ટ્રીય આવકમાંથી ગરીબોને ઓછો ભાગ મળે અને ધનિકોને વધુ આવક મળે તો ધનિકો દ્વારા ઉપયોગમાં લેવાતી મોજશોખની કે સુખસગવડની વસ્તુઓની માંગ વધશે. જો આવકની વહેંચણીમાં ગરીબ વગને આવકની ફાળવણી વધુ કરવામાં આવે તો ગરીબો દ્વારા વપરાશમાં લેવાતી પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓની માંગ વધશે.

માંગનો નિયમ :-

વસ્તુની કિંમત અને માંગ વર્ષેના સંબંધની રજૂઆત માંગના નિયમ દ્વારા કરવામાં આવી છે.

માર્શલના મતે :-

“ અન્ય પરિબળો સ્થિર રહેતાં કોઈ એક વસ્તુની કિંમતમાં વધારો થતાં તેની માંગમાં ઘટાડો થાય છે અને કિંમતમાં ઘટાડો થતાં તેની માંગમાં વધારો થાય છે.”

પ્રો. બેનહામની વ્યાખ્યા :-

“ અન્ય પરિબળો યથાવત રહેતા અમુક કિંમતે થતી વસ્તુની માંગ તેનાથી વધારે કિંમતે થતી વસ્તુની માંગ કરતાં વધારે હોય છે.”

પ્રો. કેનરીઝ : - “વસ્તુની માંગનો અર્થ લોકો કેટલા પ્રમાણનાં તેની માંગ કરે છે તેવો નથી થતો. પરંતુ અસરકારક માંગનો અર્થ આપેલી કિંમતે આપણે કેટલા પ્રમાણમાં વસ્તુની ખરીદી કરીએ છીએ તેના પરથી થાય છે.”

• ધારણાઓ :-

**(1) ગ્રાહકની આવક સ્થિર રહે છે :-**

માંગના નિયમમાં ગ્રાહકની આવકને સ્થિર ધારી લેવામાં આવે છે. કિંમતમાં ફેરફાર થવાની સાથે જો ગ્રાહકની આવકમાં ફેરફાર થાય તો ગ્રાહકની વસ્તુની માંગમાં પણ ફેરફાર થાય છે. જો કિંમત વધવાની સાથે ગ્રાહકની આવક વધે તો માંગ ઘટવાને બદલે વધે છે અને કિંમત ઘટે તો માંગ ઘટે છે. આથી અહીં વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ સાચો સાબિત કરી શકતો નથી.

**(2) ગ્રાહકની સંખ્યા :-**

ગ્રાહકની સંખ્યાને અહીં સ્થિર ધારી લેવામાં આવી છે. કિંમત વધવાની સાથે જો ગ્રાહકની સંખ્યા વધે તો માંગ ઘટવાને બદલે વધે છે અને કિંમત ઘટે તેની ગ્રાહકની સંખ્યા ઘટે તો માંગ ઘટે છે. આથી અહીં કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ સમજવી શકતો નથી.

**(3) ગ્રાહકની રૂચિ, ફેશન, ટેવ બદલાતા નથી :-**

વસ્તુની કિંમત વધે તે સમયે ગ્રાહકની તે વસ્તુ પ્રત્યેની રૂચિ, ફેશન, ટેવ બદલાતા નથી તેવી ધારણા કરવામાં આવી છે. તો જ નિયમ સાચો કરે છે.

**(4) વસ્તુની ગુણવત્તા :-**

અહીં જે વસ્તુની માંગનો વિચાર કરવામાં આવે છે. તેની ગુણવત્તા સ્થિર ધારી લેવામાં આવી છે તો જ માંગનો નિયમ સાચો સાબિત કરી શકાય કેમ કે જે વસ્તુની કિંમત વધવાની સાથે તેની ગુણવત્તામાં પણ સુધારો થાય તો જે ગ્રાહકો વસ્તુની ગુણવત્તાને મહત્વ આપે છે તે વસ્તુની માંગ ઘટાડતા નથી.

**(5) અન્ય વસ્તુના ભાવો :-**

વસ્તુની અન્ય અવેજી કે હરીફ વસ્તુનાં ભાવોને અહીં સ્થિર ધારવામાં આવ્યાં છે. કેમ કે, જે વસ્તુની કિંમતમાં વધારો થાય તેની સાથે અન્ય વસ્તુની કિંમતમાં પણ વધારો થાય તો વસ્તુની માંગ ઘટતી નથી. આથી અન્ય વસ્તુઓના ભાવ સ્થિર હોય તો જ કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ સમજવી શકાય.

## (6) ભવિષ્યના ભાવ વિશેના અંદાજો :-

ભવિષ્યના ભાવ વિશેના અંદાજો પણ સ્થિર ધારી લેવામાં આવ્યાં છે. કારણ કે જો ભવિષ્યમાં ભાવ વધવાના અંદાજ હોય તો વર્તમાનમાં ભાવ સ્થિર હોવા છતાં માંગ વધે છે. અને જો ભાવ ઘટવાના અંદાજ હોય તો વર્તમાનમાં ભાવ સ્થિર હોવા છતાં માંગ ઘટે છે. આથી અહીં ભવિષ્યના ભાવ વિશેના અંદાજો પણ સ્થિર રહેવા જોઈએ તો જ કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ સમજાવી શકાય.


- માંગની અનુસૂચિ :-

માંગના નિયમને સમજાવા માટે ગ્રાહક વસ્તુની જુદી જુદી કિંમતે કેટલી માંગ કરે છે તે દર્શાવતી અનુસૂચિ એટલે માંગની અનુસૂચિ ધારો કે, ગ્રાહક બજારમાં કોઈ એક X વસ્તુ ખરીદવા માટે જાય છે. તેની જુદી જુદી કિંમતે ગ્રાહક કેટલી માંગ કરે છે તે નીચેના કોષ્ટકમાં દર્શાવવામાં આવ્યું છે.

X વસ્તુની કિંમત (રૂપિયામાં)	X વસ્તુની માંગ (એકમમાં)
10	500
20	400
30	300
40	200
50	100

ઉપરોક્ત અનુસૂચિમાં X વસ્તુની જુદી જુદી કિંમતે ગ્રાહકની માંગ દર્શાવવામાં આવી છે. X ની કિંમત 10 રૂ. છે ત્યારે માંગ 500 એકમ જેટલી છે. કિંમત અનુક્રમે વધીને 20 રૂ., 30 રૂ. 40 રૂ. અને 50 રૂ. થતાં માંગ અનુક્રમે ઘટીને 400 એકમ, 300 એકમ, 200 એકમ અને 100 એકમ થાય છે.

### આકૃતિ દ્વારા સમજૂતી :-



X વસ્તુની માંગ (એકમમાં)

## માંગના નિયમના અપવાદો :-

માંગનો નિયમ બધી જ વસ્તુઓ માટે લાગુ પડતો નથી. કેટલાક અપવાદરૂપ સંજોગોમાં માંગના નિયમથી ઉલટું બને છે. એટલે કે આવી વસ્તુઓની કિંમત વધે તો માંગ ઘટવાને બદલે વધે છે. માંગના નિયમના કેટલાક અપવાદો નીચે મુજબ છે.

### (1) ગિફન વસ્તુઓ (હલકા પ્રકારની વસ્તુઓ) :-

હલકા પ્રકારની વસ્તુઓની બાબતમાં માંગનો નિયમ લાગુ પડતો નથી. એટલે કે હલકા પ્રકારની વસ્તુ કે જેનો ઉપયોગ ગરીબ લોકો કે ઓછી આવકવાળા કરતાં હોય છે. જેવી બાજરી, જુવાર, બરણટ કાપડ વગેરે. આવી વસ્તુઓની કિંમત વધતાં ગ્રાહક પોતાની આવકનો અમુક ભાગ સારા પ્રકારની વસ્તુઓ પાછળ ખર્ચ કરતો હોય છે. જો હલકા પ્રકારની વસ્તુની કિંમત વધે તો તેની આવકનો જે હિસ્સો સારા પ્રકારની વસ્તુ પાછળ ખર્ચ કરે છે તે હલકા પ્રકારની વસ્તુ પાછળ ખર્ચ કરવો પડે છે એટલે હલકા પ્રકારની વસ્તુની માંગ વધે છે. જો હલકા પ્રકારની વસ્તુની કિંમત ઘટે તો ગ્રાહકની ખરીદશક્તિ વધવાથી તે હલકા પ્રકારની વસ્તુની માંગ ઘટાડે છે અને સારા પ્રકારની માંગમાં વધારો કરે છે. હલકા પ્રકારની વસ્તુઓનો સૌ પ્રથમ ઝ્યાલ રોબર્ટ ગિફને આઘ્યો હોવાથી આવી વસ્તુઓને ગિફન વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે.

### (2) પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુઓ :-

જે વસ્તુ વ્યક્તિ પાસે હોય તેનાથી તેની પ્રતિષ્ઠામાં વધારો થાય તેવી વસ્તુને પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુ કહે છે. દા.ત. હીરા, માણેક, મોતી, નીલમ વગેરે. આવી વસ્તુઓની માંગ ધનિક લોકો કરતાં હોય છે. જો આવી વસ્તુઓની કિંમત વધે તો તેનું પ્રતિષ્ઠા મૂલ્ય જીચું જાય છે. આથી ધનિક વર્ગ કે જેમણે સમાજમાં પોતાની પ્રતિષ્ઠા બતાવવી છે તેઓ આવી વસ્તુઓની માંગ વધારે છે. એથી ઉલટું જો પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુઓની કિંમત ઘટે તો તેનું પ્રતિષ્ઠા મૂલ્ય નીચું જાય છે. આથી ધનિક વર્ગ આવી વસ્તુઓની માંગ ઘટાડે છે. આમ, પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુઓ માટે માંગનો નિયમ લાગુ પડતો નથી.

### (3) અત્યંત સસ્તી વસ્તુઓ :-

મીઠું, વર્તમાનપત્ર, ટાંકણી, પોસ્ટકાર્ડ જેવી અત્યંત સસ્તી વસ્તુઓની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય તો પણ તેમની માંગમાં કોઈ ફેરફાર થતો નથી. તે ઉપરાંત જીવન જરૂરિયાતની વસ્તુઓ તેમજ નાશવંત વસ્તુઓને પણ માંગનો નિયમ લાગુ પાડી શકતો નથી.

#### (4) ગ્રાહકની અજ્ઞાનતા :-

કટલીક વાર ગ્રાહકો વસ્તુની ગુણવત્તા એની પ્રામત્રા વિશે સંપૂર્ણ માહિતગાર હોતા નથી. તેમજ તેઓ એવી માન્યતા ધરાવતાં હોય છે કે વસ્તુની કિંમત વધારે હોય તો કિંમત વધે છતાં તેની માંગ ઘટાડવાને બદલે વધારે છે.

### 2.5 માંગમાં વિસ્તરણ - સંકોચન :


પ્રસ્તાવના :-

વસ્તુની માંગમાં ફરેફાર થતાં ચારે મુખ્યત્વે પ્રકારના પરિબળો છે. (1) વસ્તુની કિંમતમાં ફરેફાર અને (2) અન્ય પરિબળો જેવા કે ગ્રાહકની આવક, ગ્રાહકની સંખ્યા, ગ્રાહકની રૂચિ, ફેશન, ટેવ વસ્તુની ગુણવત્તા, અન્ય વસ્તુની કિંમત અને ભવિષ્યના ભાવ વિશેના અંદાજો.

માંગના ફરેફાર થવા માટે જવાબદાર પરિબળોના લીધે માંગમાં થતાં ફરેફારને માંગનું વિસ્તરણ અને માંગનું સંકોચન તેમજ માંગમાં વધારો- માંગમાં ઘટાડો આ બંને બાબતોને આપણે વિગતવાર સમજીએ.

#### (1) માંગનું વિસ્તરણ- સંકોચન :-

અન્ય પરિબળો યથાવત રહેતાં વસ્તુની કિંમતમાં વધારો થાય તેના લીધે માંગમાં સંકોચન અને કિંમતમાં ઘટાડો થાય તેના લીધે માંગમાં વિસ્તરણ થાય છે. જેને આકૃતિ દ્વારા સમજીએ.



આકૃતિમાં OX ધરી પર વસ્તુની માંગ અને OY ધરી પર વસ્તુની કિંમત દર્શાવવામાં અવી છે.


આકૃતિમાં દર્શાવ્યા મુજબ વસ્તુની કિંમત 20 રૂ. છે ત્યારે વસ્તુની માંગ 200 એકમની છે. જે A બિંદુ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. કિંમત વધીને 30 રૂ. થતાં માંગ ઘટીને 100 એકમ થાય છે. જે

આકૃતિમાં B બિંદુ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. કિંમતમાં વધારો થતાં ગ્રાહકની માંગ A બિંદુથી ખસીને B બિંદુને થાય છે. આમ, A થી B બિંદુ તરફની ગતિ માંગનું સંકોચન છે.

જે વસ્તુની કિંમત ઘટીને 10 રૂ. થાય તો માંગ વધીને 300 એકમ થાય છે. જે આકૃતિમાં C બિંદુ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. કિંમતમાં ઘટાડો થતાં ગ્રાહકની માંગ A બિંદુથી ખસી C બિંદુએ થાય છે. આમ, A થી C બિંદુ તરફની ગતિ એ માંગનું વિસ્તરણ છે.

## (2) માંગમાં વધારો - ઘટાડો :-

જ્યારે વસ્તુની કિંમત સ્થિર રહે અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય તો માંગમાં વધારો અથવા માંગમાં ઘટાડો થાય છે. જે નીચેની આકૃતિ દ્વારા સમજૂ શકાય.



ઉપરોક્ત આકૃતિમાં OX ધરી પર વસ્તુના એકમો અને OY ધરી પર વસ્તુની કિંમત દર્શાવવામાં આવ્યાં છે. જ્યારે OP કિંમત છે ત્યારે ગ્રાહક OM એકમોની માંગ કરે છે. જે DD રેખા પર આવેલા A બિંદુ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. કિંમત સેવાયના અન્ય પરિબળો બદલાતા માંગ કરે છે. જે DD રેખા પર આવેલા A બિંદુ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. કિંમત સેવાયના અન્ય પરિબળો બદલાતા વસ્તુની માંગ વધીને OM એકમો જેટલી થાય છે. આથી મુજબ માંગ રેખા DD ની જમણી બાજુ ઉપર તરફ નવી માંગ રેખા D1D1 અસ્તિત્વમાં આવે છે. જે મુજબ ગ્રાહક OPકિંમતે OM એકમોની માંગ કરે છે. આમ, માંગમાં MM1 જેટલો

વધારો થાય છે. અહીં કિંમત વધીને OP થાય છે તો પણ ગ્રાહક O1Y1 એકમો જેટલી જ માંગ કરે છે જે આકૃતિમાં B બિંદુ દ્વારા દર્શાવવામાં આવ્યું છે.

જે કિંમત સિવાયના અન્ય પરિબળો બદલાતા વસ્તુની માંગ ઘટીને O1Y2 જેટલી થાય છે. આથી મૂળ માંગ રેખા DD ની ડાબી બાજુ નીચે તરફ નવી માંગ રેખા D2D2 અસ્તિત્વમાં આવે છે. જે મુજબ OP કિંમતે ગ્રાહક OM2 એકમોની માંગ કરે છે. અહીં ગ્રાહક OP2 કિંમત આપવાની થાય તો પણ ગ્રાહક OM2 એકમોની જ માંગ કરે છે. જે આકૃતિમાં C બિંદુ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. માંગમાં MM2 જેટલો ઘટાડો થાય છે. અહીં ગ્રાહક OP2 કિંમત આપવા તૈયાર થાય છે.

**તારણ :-**

- (i) માંગમાં કિંમત અથવા કિંમત સિવાયના અન્ય પરિબળોથી ફેરફાર થાય છે.
- (ii) કિંમતમાં ફેરફાર થવાથી માંગનું વિસ્તારણ કે સંકોચન થાય છે.
- (iii) કિંમત સિવાયના અન્ય પરિબળોમાં ફેરફાર થવાથી માંગમાં વધારો કે ઘટાડો થાય છે.
- (iv) માંગનું વિસ્તારણ-સંકોચન એકજ માંગરેખા પર થાય છે.
- (v) માંગનો વધારો - ઘટાડો થતાં માંગનું સ્થાન બદલાય છે. અને નવી માંગ રેખા અસ્તિત્વમાં આવે છે.

**ચાવી રૂપ શાખાઓ :**

- (1) માંગ સૂચિ : ચીજવસ્તુ માટે જુદી જુદી ભાવ સપાઠીએ તે ચીજવસ્તુના માંગવામાં આવતા જથ્થાઓ દર્શાવતું કોષ્ટક.
- (2) માંગમાં ફેરફાર : માંગ વક ઉપર અમુક બિન્દુને અનુલક્ષીને માંગ વક ઉપર ગતિ.
- (3) માંગ : ખરોદ શક્તિના પઠ બળવાળી વપરાશ કારની જરૂરિયાત.
- (4) ગાફિન ચીજવસ્તુ : એવી ચીજવસ્તુની કે જેની બાબતમાં ચીજ વસ્તુનો ભાવ અને તેના માંગેલા જથ્થા વચ્ચે સીધો સંબંધ હોય છે.
- (5) આવક અસર : તે વપરાશકારની આવકમાં ફેરફારની ચીજવસ્તુના માંગવામાં આવવા જથ્થા ઉપરની અસર દર્શાવે છે.
- (6) માંગ વક : ચીજવસ્તુના ભાવો અને તેના માંગવામાં આવતા જથ્થામાં જુદા જુદા સંયોજનો દર્શાવતી રેખા અથવા વક તે સામાન્ય રીતે નીચેની તરફ ડાબીથી જમણી બાજુ રહે છે.
- (7) સામાન્ય ચીજવસ્તુ : એવી ચીજવસ્તુ કે જેની બાબત કઈ વપરાશકારની આવક અને ચીજવસ્તુના માંગવામાં આવતા જથ્થા વચ્ચેનો સંબંધ સીધો હોય છે.

- (8) ઉત્તરતી કક્ષાની ચીજવસ્તુ : એવી ચીજવસ્તુ કે જેની બાબતમાં વપરાશકારની આવક અને ચીજવસ્તુના માંગવામાં આવતા જથ્થા વચ્ચે વિપરીત સંબંધ હોય છે.

### પ્રશ્નો

- (1) બજાર માટે ચીજવસ્તુની માંગ નક્કી કરતાં મુખ્ય પરિબળો સમજાવો.
- (2) માંગ સૂચિ અને માંગ વકની મદદથી માંગનો સિદ્ધાંત સમજાવો.
- (3) ઉત્તરતી કક્ષાની ચીજ અને ગિફ્ટિન ચીજ વચ્ચેનો ભેદ સમજાવો.
- (4) સરકાર ભાવ નીતિ નક્કી કરવામાં અને કર તથા આર્થિક સહાયની નીતિ મટે માંગના નિયમનો શો ઉપયોગ કરી શકે?
- (5) ચીજવસ્તુની જરૂરિયાત અને માંગ વચ્ચેનો ભેદ સમજાવો.
- (6) વપરાશકાર માટે ચીજવસ્તુની માંગ નક્કી કરનાર પરિબળો કયા છે.

નીચેના જોડકા જોડો.

(અ) (બ)

- |                           |       |                      |
|---------------------------|-------|----------------------|
| (1) જે તે ચીજવસ્તુનો ભાવ  | ----- | વપરાશકારોની અભિપ્રાય |
| (2) અન્ય ચીજવસ્તુઓના ભાવો | ----- | વસ્તીનું કદ, અને     |
| (3) વપરાશકારોની આવક       | ----- | આવકની વહેંચણી        |

### MCQ

- (1) જો વસ્તુના ભાવ વધે અને સાથે સાથે ગ્રાહકની આવક વધે તો માંગ.  
(અ) વધે છે (બ) ઘટે છે (ક) સ્થિર રહે છે. (ઝ) કહી ન શકાય.
- (2) માંગ રેખા ઋણ દાળ ધરાવે છે એટલે કે?  
(અ) કિંમત અને માંગ સ્વતંત્ર છે.  
(બ) કિંમત અને માંગ વચ્ચે સીધો સંબંધ છે.  
(ક) કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે.  
(ઝ) માંગ અને કિંમત વચ્ચે સંબંધ જ નથી.
- (3) ગિફ્ટિન વસ્તુઓની કિંમત ઘટતા માંગ.  
(અ) વધે છે (બ) સ્થિર રહે છે (ક) (અ) અને (બ) બંને (ઝ) ઘટે છે.
- (4) કિંમત અને માંગ વચ્ચે શો સંબંધ હોય છે.  
(અ) વ્યસ્ત (બ) અવ્યસ્ત (ક) ખોટો (ઝ) સીધો

જવાબ :

(1) ક (2) ક (3) ઝ (4) અ

## માંગની સ્થિતિ સ્થાપકતા :

### પ્રસ્તાવના :-

આપણે માંગના નિયમમાં જોઈ ગયાં કે કિંમત અને માંગ વચ્ચે વસ્ત સંબંધ છે. એટલે કે વસ્તુની કિંમત વધે તો માંગનું સંકોચન થાય છે અને કિંમત ઘટે તો માંગનું વિસ્તારણ થાય છે. પરંતુ કિંમતમાં ફેરફાર થવાથી માંગમાં કેટલો ફેરફાર થાય છે તે માંગના નિયમ દ્વારા જાણી શકતું નથી. કિંમતમાં થયેલા ટકાવારી ફેરફારને કારણે માંગમાં થયેલા ટકાવારી ફેરફારને જાણવા માટે માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ ઉપયોગી છે. આર્થિક વિશ્લેષણમાં માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ ખૂબ જ મહત્વનો છે. અર્થશાસ્ત્ર અને સંચાલકીય અર્થશાસ્ત્રમાં માંગની મૂલ્ય સાપેક્ષતાનું ખૂબ જ મહત્વ છે.

માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ સૌ પ્રથમ પ્રો. આલ્ફેડ માર્શલે 1890 માં તેમના પુસ્તક ‘Principles of Caonovaico’ માં આવ્યો.

### માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ :-

માંગનો નિયમ વસ્તુની કિંમત અને ગ્રાહક દ્વારા થતી તેની માંગ વચ્ચેનું ગુણપત્રક વિધાન છે. પરંતુ આ નિયમ કિંમત અને માંગ વચ્ચે પારિમાળિક સંબંધ દર્શાવતો નથી. દા.ત. કિંમતમાં ઘટાડો થતાં માંગમાં કેટલા પ્રમાણમાં વધારો થશે તેનો કોઈ ચોક્કસ આંક માંગનો નિયમ રજૂ કરતો નથી. આ અંગેની સમજૂતી મેળવવા માંગની મૂલ્ય સાપેક્ષતાનાં ખ્યાલનો ઉપયોગ કરવામાં આવે છે.

“ અન્ય પારિબળો યથાવત્ રહેતા વસ્તુની કિંમતમાં થતાં ફેરફારને કારણે તે વસ્તુની માંગમાં થતાં ફેરફારોનું માપ અથવા ગુણોત્તરને માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે.”

માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ વધુ સારી રીતે સમજવા કેટલાંક અર્થશાસ્ત્રીઓ દ્વારા વ્યાખ્યા રજૂ કરવામાં આવી છે તે જોઈએ.

### પ્રો. આલ્ફેડ માર્શલ :-

“માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે કિંમતના સાપેક્ષ ફેરફારો અને તેને લીધે થતાં માંગના સાપેક્ષ ફેરફારોનું ગુણોત્તર પ્રમાણે.”

### પ્રો. કેઈન્કોસ :-

“માંગની મૂલ્ય સાપેક્ષતા એ એક એવો દર છે કે, તે દરે ખરીદાતી વસ્તુના પ્રમાણમાં, વસ્તુના ભાવમાં આવતા પરિવર્તનો સાથે ફેરફાર થાય છે.”

પ્રો. મેયર્સ :-

“આપેલી માંગરેખા પરના ભાવમાં સાપેક્ષ ફેરફાર થતાં તેના પ્રત્યાધાત્રુપે ખરીદવામાં આવતી વસ્તુના પ્રમાણમાં જે સાપેક્ષ ફેરફાર થાય છે તેનું માપ એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા.”

પ્રો. આર. જે. લિલ્સી :-

“કિંમતમાં ફેરફાર થવાને લીધે માંગમાં જે ફેરફાર થાય છે તેને માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે.”

શ્રીમતી જોન રોબિન્સન :-

“કિંમતમાં થયેલાં થોડા ફેરફારને પરિણામે માંગમાં જેટલાં પ્રમાણમાં ફેરફાર થાય છે, તેને કિંમતમાં થયેલા ફેરફારના પ્રમાણ વડે ભાગવાથી જે આંક આવે, તેને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે.”

• સૂત્ર દ્વારા રજૂઆત :-

માંગની મૂલ્ય સાપેક્ષતા = વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર

---

વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર

$$Ed = \frac{\Delta D\%}{\Delta P\%}$$

અથવા

માંગમાં ફેરફાર

---

મૂળ માંગ

માંગની મૂલ્ય સાપેક્ષતા = \_\_\_\_\_

કિંમતમાં ફેરફાર

---

મૂળ કિંમત

$$Ed = \frac{\frac{DP}{D}}{\frac{\Delta P}{P}}$$

ધારો કે, કોઈ વસ્તુની કિંમતમાં 20% નો ઘટાડો થાય તેને કારણે તેની માંગમાં 40% ની વધારો થાય તો, સૂત્ર મુજબ ગણતા.

$$\begin{aligned} Ed &= \frac{D\%}{\Delta P\%} & Ed &= \frac{માંગની મૂ. સા.}{મૂળ માંગ} \\ &----- & & \Delta D = માંગમાં થતો ફેરફાર \\ & & & P = મૂળ કિંમત \\ & & & \Delta P = કિંમતમાં ફેરફાર \\ & = \frac{40\%}{20\%} & & \\ & = 2 & & \end{aligned}$$


અહીં વસ્તુની માંગની મૂલ્યસાપેક્ષતા 2 છે. એટલે કે કિંમતમાં ફેરફાર થવાથી માંગમાં થતો ફેરફાર બે ગણો છે.

- માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો :-
- (1) સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ (Ed = x)

કોઈ ચોક્કસ કિંમતે અથવા કિંમતમાં થતાં નજીવા ફેરફારને લીધે વસ્તુની માંગમાં અમયાર્દિત પ્રમાણમાં ફેરફાર થાય છે. જેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગની રેખા OX ધરીને સમાંતર હોય છે.

Ex. t.

X વસ્તુની કિંમત (રૂ. માં)	X વસ્તુની માંગ (એકમ માં)
5.25	0
5	X



વસ્તુની માંગ (એકમ માં)


આકૃતિમાં OX ધરી પર વસ્તુની માંગ અને OY ધરી પર વસ્તુની કિંમત દર્શાવવામાં આવ્યાં છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કિંમત રૂ. 5.25 હોય ત્યારે માંગ શૂન્ય છે. કિંમત ઘટીને 5 રૂ. થતાં માંગમાં અનંતગણો વધારો થાય છે. જે DD માંગ રેખા દ્વારા દર્શાવવામાં આવ્યું છે. આકૃતિમાં DD માંગ રેખા OX ધરીને સમાંતર છે. જે દર્શાવે છે કે કિંમતમાં નજીવો ફેરફાર થતાં માંગમાં અનેકગણો ફેરફાર થાય છે.

## (2) સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ (Ed = 0)

વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય છતાં તેની માંગમાં કોઈ જ ફેરફાર ન થાય તો માંગ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ છે તેમ કહેવાય.

Ex. ૧.

X વસ્તુની કિંમત (રૂ. માં)	X વસ્તુની માંગ (એકમ માં)
2	100
4	100
6	100



### वस्तुनी मांग (ऐकम मांग)


ઉपરોક્ત આદૃતમાં દર્શાવ્યા મુજબ વस્તુની કિંમત 2 રૂ. છે ત્યારે માંગ 100 ઐકમ જેટલી થાય છે. કિંમત વધીને 4 રૂ. કે 6 રૂ. થાય છે. તો પણ માંગ 100 ઐકમ જેટલી સ્થિર રહે છે. આથી અહીં માંગરેખા OY ધરીને સમાંતર હોય છે. આદૃતમાં DD માંગરેખા OY ધરીને સમાંતર છે. જે દર્શાવે છે કે કિંમતમાં ગમે તેટલો વધારો થાય માંગમાં કોઈ જ ફેરફાર થતો નથી.

### (3) ઐકમ કરતાં વધુ મૂલ્ય સાપેક્ષ માંગ (Ed > 1)

કિંમતમાં થતાં ટકાવારી ફેરફાર કરતા માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય તો તેને ઐકમ કરતાં વધુ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે.

દા.દ.

વસ્તુની કિંમત (રૂ. મિ)	વસ્તુની માંગ (ऐકમમાં)
4	50
2	150




આકૃતિમાં OX ધરી પર વस્તુની માંગ અને OYધરી પર વસ્તુની કિંમત દર્શાવવામાં આવ્યાં છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કિંમત 4 રૂ. છે ત્યારે માંગ 50 એકમ જેટલી થાય છે. કિંમત ઘટીને 2 રૂ. થતાં માંગ 150 એકમ જેટલી થાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ X ની કિંમત 4 રૂ. થી ઘટીને 2 રૂ. થતાં માંગ 50 એકમથી વધીને 150 એકમ જેટલી થાય છે. એટલે કે કિંમતમાં 100% ફેરફાર થતાં માંગમાં 150% ફેરફાર થાય છે. આથી DD માંગરેખા ઓછા દાળવાળી બને છે.

#### (4) એકમ કરતાં ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ (Ed<1)

કિંમતમાં થતાં ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય તો એકમ કરતાં ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય.

વસ્તુની કિંમત (રૂ.માં)	વસ્તુની માંગ (એકમ માં)
4	50
2	75




વस्तुની માંગ (એકમ માં)

આકૃતિમાં  $OX$  ધરી પર વસ્તુના એકમો અને  $OY$  ધરી પર વસ્તુની કિંમત દર્શાવવામાં આવી છે. કિંમત 4 રૂ. થી ઘટીને 2 થતાં માંગ 50 એકમથી વધીને 75 એકમ થાય છે. અહીં કિંમત અડધી થતાં માંગ બે ગણી થવાને બદલે માંગમાં દોડ ગણો વધારો થાય છે. એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતાં ઓછી છે. આથી  $DD$  માંગરેખા તીવ્ર દ્વારા જાળવાળી હોય છે.

#### (5) એકમ બરાબર મૂલ્ય સાપેક્ષ માંગ ( $Ed = 1$ )

કિંમતમાં જેટલો ટકાવારી ફેરફાર થાય તેટલો જ ટકાવારી ફેરફાર માંગમાં થાય તેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે.

વસ્તુની કિંમત (રૂ.માં)	વસ્તુની માંગ (એકમ માં)
4	50
2	100



આકૃતિમાં દર્શાવ્યા મુજબ કિંમત 4 રૂ. થી ધીરીને 2 રૂ. થતાં માંગ 50 એકમથી 100 એકમ થાય છે. આમ, અહીં કિંમત અડવી થતાં માંગ બે ગણી થાય છે.

એટલે કે કિંમતમાં જેટલો ટકાવારી ફેરફાર થાય છે તેટલો જ ફેરફાર માંગમાં થાય છે. આથી DD માંગરેખા સપ્રમાણ ઘણવાળી બને છે.

- માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતાં / પરીબળો :-

**(1) પ્રાથમિક વસ્તુ :-**

વ્યક્તિની રોજબરોજની જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, ખાંડ, તેલ વગેરે વસ્તુઓની માંગ સામાન્ય રીતે મૂલ્ય અનપેક્ષ હોય છે. કારણ કે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ વ્યક્તિને જીવન ટકાવી રાખવા માટે ખૂબ જ મહત્વની હોવાથી આવી વસ્તુઓની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય છતાં તેની માંગમાં ખાસ ફેરફાર થતો નથી.

**(2) મોજશોખની કે સુખ સગવડની વસ્તુઓ :-**

ટી.વી., રેફીજરેટ, મોટરકાર, એરકન્ડિશનર જેવી મોજશોખ અને સુખ સગવડની વસ્તુઓની માંગ મૂલ્ય સાપેક્ષ હોય છે. આવી વસ્તુઓની વ્યક્તિની જીવનમાં ખાસ જરૂર હોતી નથી. આથી આવી વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં માંગમાં વધુ ફેરફાર થાય છે.

**(3) ગ્રાહકનાં બજેટમાં વસ્તુનું સ્થાન (અત્યંત સસ્તી વસ્તુ) :-**

અત્યંત સસ્તી વસ્તુઓ જેવી કે મીઠું, સોય, ટાકણી, વર્તમાનપત્ર, પોસ્ટકાર્ડ જેવી અત્યંત સસ્તી વસ્તુઓ કે જેની પાછળ ગ્રાહકની આવકનો ખૂબ જ ઓછો ભાગ ખર્ચ થાય છે. આવી વસ્તુઓની માંગ મૂલ્ય અનપેક્ષ હોય છે. કારણ કે આવી વસ્તુની કિંમતમાં થતાં ફેરફાર નજીવો હોવાથી ગ્રાહકની માંગમાં ખાસ પરિવર્તન આવતું નથી.

**(4) અત્યંત મોંઘી વસ્તુ :-**

હીરા, માણેક, મોતી, નીલમ, સોનું જેવી અત્યંત મોંઘી વસ્તુઓની માંગ મૂલ્ય અનપેક્ષ હોય છે. આવી વસ્તુઓ જીવન જીવવા માટે મહત્વની હોતી નથી. પરંતુ આવી વસ્તુઓ પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુઓ હોવાથી ધનિક વર્ગ આવી વસ્તુઓની કિંમતમાં ફેરફાર થવાં છતાં તેની માંગમાં ખાસ ફેરફાર થતો નથી.

**(5) અવેજીપણું :-**

કોઈ પણ વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતાનો આધાર તેની અવેજમાં આવી શકે તેવી વસ્તુઓની સંખ્યા પર હોય છે. જેમ અવેજ વસ્તુઓની સંખ્યા વધુ તેમ માંગ વધુ મૂલ્ય સાપેક્ષ હોય છે. દા.ત. નાહવાના સાબુ જેમ કે ફેરગલો, લક્સ, ડવ, ટેટોલ વગેરે. જે કંપનીના સાબુની કિંમત વધે તો તેની માંગ વધે અને જે કંપનીના સાબુની કિંમત વધે તેની માંગ વધે છે.

જેમ અવેજની સંખ્યા ઓછી તેમ માંગ ઓછી મૂલ્ય સાપેક્ષ હોય છે. દા.ત. કેરોસીન, પેટ્રોલ વગેરે. જો અવેજ વસ્તુ ન હોય તો માંગ મૂલ્ય અનપેક્ષ હોય છે. દાત. મીઠું

#### (6) અનિવાર્ય સેવા :-

ડોક્ટર, શિક્ષક, વકીલ વગેરે લોકોની અનિવાર્ય સેવાની માંગ સામાન્ય રીતે મૂલ્ય અનપેક્ષ હોય છે. જેમ કે, કોઈ વ્યક્તિ બિમાર હોય તો ડોક્ટર ગમે તેટલી ફી વસૂલે તો પણ ગ્રાહક ડોક્ટરને વધુ ફી ચૂકવીને પણ ઈલાજ કરાવે છે. અને જો ડોક્ટર નિઃશુલ્ક કે ઓછા દરે ઈલાજ કરતાં હોય તો પણ સામે વ્યક્તિ દવા લેવા જતો નથી.

#### (7) ખરીદી મુલત્વી રાખી શકાય તેવી વસ્તુ :-

કેટલીક વસ્તુઓ એવી હોય છે જેની ખરીદી ભવિષ્ય માટે મુલત્વી રાખી શકાય છે. આવી વસ્તુઓની માંગ મૂલ્ય સાપેક્ષ હોય છે. દા.ત. કપડા, ચંપલ, રેઝીજરેટર વગેરેનો ભાવ વધે તો ઘણા લોકો તેની ખરીદી મુલત્વી રાખે છે અને કિંમત ઘટે ત્યારે તેની માંગ કરે છે.

#### (8) ટકાઉ વસ્તુઓ :-

ટકાઉ વસ્તુઓની માંગ મૂલ્ય અનપેક્ષ હોય છે. દા.ત. ફર્નિચર, ડાઈનિંગ ટેબલ, ઘરબંદી વગેરે જેની એકવાર લીધા પછી લાંબા સમય સુધી જરૂરિયાત રહેતી નથી. આવી વસ્તુઓની કિંમતમાં ગમે તેટલો વધારો ઘટાડો થાય તેની માંગમાં ખાસ ફેરફાર થતો નથી.

#### (9) અનેકોપ્યોગી વસ્તુ :-

કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જે અનેક ઉપયોગમાં લઈ શકતી હોય છે. દા.ત. વિજળી તેના અનેક ઉપયોગો હોય છે. વિજળી ઘર માટે વપરાય, ફેક્ટરીમાં ઉત્પાદન માટે, રેલ્વે, વાહન વ્યવહાર, ખેતીક્ષેત્રે ઉપયોગમાં લેવામાં આવે છે. આવી વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ હોય છે. જો તેની કિંમતમાં વધારો થાય તો અનેક ઉપયોગમાં તેની માંગ ઘટે છે અને જો તેની કિંમતમાં ઘટાડો થાય તો અનેક ઉપયોગમાં તેની માંગ વધે છે.

#### (10) ગ્રાહકના બજેટમાં વસ્તુનું સ્થાન :-

ગ્રાહકના બજેટમાં વસ્તુનું મહત્વ કેટલું છે તેનો આધાર તે વસ્તુ પર ગ્રાહક આવકનો કેટલો ભાગ બર્ચે છે તેના પર છે. જો ગ્રાહકની આવકનો નજીવો ભાગ બર્ચે થતો હોય તો માંગ મૂલ્ય અનપેક્ષ હોય છે. દા.ત. મીઠું, વર્તમાનપત્ર, ટાંકણી, પોસ્ટકાર્ડ વગેરે આવી વસ્તુઓની કિંમતમાં થતાં ફેરફારની માંગ પર ખાસ અસર થતી નથી.

જો ગ્રાહકની આવકનો મોટો ભાગ જે વસ્તુ પાછળ બર્ચે છે તેવી વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ હોય છે. દા.ત. વિજળીનું બિલ, મકાનભાડું વગેરેની કિંમતમાં ફેરફાર થાય તો ગ્રાહકના સમગ્ર બજેટ પર ખૂબ જ મોટી અસર પડે છે.

**(11) રિવાજ વસ્તુઓ :-**

રિવાજ વસ્તુઓની માંગ મૂલ્ય અનપેક્ષ હોય છે. જે લાંબાગાળે બદલાય છે. દા.ત. લગ્ન પ્રસંગે કરવો પડતો ખર્ચ.

**(12) ટેકનીકલ મુશ્કેલીઓ :-**

કેટલોક વસ્તુઓની વપરાશ કરવા માટે અન્ય પુરક વસ્તુઓ પણ ખરીદવી પડે છે. દા.ત. વિજળી સસ્તી થાય તો તેની વપરાશ કરવા માટે તેની પુરક વસ્તુઓ પંખો, ઈંઝી, રેફીજરેટર, એરકન્ડીશનર, માઈકવેવ વગેરેમાં રોકાણ કરવું પડે છે. જે ટૂંકાગાળામાં શક્ય નથી. પરંતુ લાંબાગાળે રોકાણ કરવામાં આવે છે.

**(13) બજારની અપૂર્ણતા :-**

ગ્રાહકો બજારની માહિતી અંગે સંપૂર્ણપણે વાકેફ હોતા નથી. આથી કોઈ એક સમયે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો પણ તે સમયે ગ્રાહકની વસ્તુની માંગમાં ફેરફાર થતો નથી. આથી ટૂંકાગાળામાં માંગ મૂલ્ય અનપેક્ષ હોય છે. લાંબાગાળે ગ્રાહકને જેમ જેમ ખબર પડે તેમ તેમ માંગમાં ફેરફાર કરે છે. આથી લાંબાગાળે માંગ મૂલ્ય સાપેક્ષ હોય છે.

• ચાપ પદ્ધતિ અથવા સરાસરી પદ્ધતિ ( Arc Elasticity ) :-

જ્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા રેખા ઉપર આવેલાં બે બિંદુઓ વચ્ચેના અંતરના આધારે માપવામાં આવે તો તેને અંતર બિંદુ મૂલ્ય સાપેક્ષતા પદ્ધતિ કહે છે. માંગરેખા ઉપરના બે બિંદુઓ વચ્ચેનું અંતર કિંમતમાં અને માંગમાં કેટલો ફેરફાર થાય છે તે દર્શાવે છે. અંતરબિંદુ મૂલ્ય સાપેક્ષતા માપવાનું સૂત્ર નીચે મુજબ છે.

$$\frac{\text{માંગમાં થતાં ફેરફાર}}{\text{મૂળ માંગ} + \text{નવી માંગ} \div 2}$$

$$Ed = \frac{\text{કિંમતમાં થતો ફેરફાર}}{\text{મૂળ કિંમત} + \text{નવી કિંમત} \div 2}$$

$$Ed = \frac{\frac{Q_1 - Q}{Q_1 + Q} \times \frac{P_1 - P}{P_1 + P}}{2}$$

$$Ed = \frac{Q_1 - Q}{Q_1 + Q} \div \frac{P_1 + P}{P_1 - P}$$

અહીં  $Q =$  મૂળ માંગ  $Q_1 =$  નવી માંગ  
 $P =$  મૂળ કિંમત  $P_1 =$  નવી કિંમત.

દા.ત. ગ્રાહક 10 રૂ.ની કિંમતે વस્તુના 100 એકમોની માંગ કરે છે. કિંમત ઘટીને 5 રૂ.ની કિંમતે 150 એકમોની માંગ કરે છે. તો માંગની મૂલ્ય સાપેક્ષતાની ગણતરી નીચે મુજબ કરી શકાય.

$$\begin{aligned} \text{માંગની મૂલ્ય સાપેક્ષતા} &= \frac{100 - 150}{100 + 150} \div \frac{10 - 5}{10 + 5} \\ &= \frac{-50}{250} \div \frac{5}{15} \\ &= \frac{-50}{250} \times \frac{15}{5} \\ &= -0.6 \end{aligned}$$

અહીં માંગની મૂલ્ય સાપેક્ષતા જાણ છે. કારણ કે કિંમત ઘટતાં માંગ વધે છે, કિંમત વધતાં માંગ ઘટે છે.

- માંગની મૂલ્ય સાપેક્ષતાના ખ્યાલની ઉપયોગિતા :-

### (1) ઈજારદાર માટે :-

ઇજારદાર માટે માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ ઉપયોગી છે. ઇજારદાર પોતાની વેચવાની વસ્તુની કિંમતમાં કેટલો વધારો કે ઘટાડો કરવો તે નક્કી કરવા માંગની મૂલ્ય સાપેક્ષતાના ખ્યાલનો ઉપયોગ કરે છે. જો તેની વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ હોય તો તે વસ્તુની કિંમત વધારે રાખે છે અને તેની વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ હોય તો વસ્તુની કિંમત ઓછી રાખે છે.

**(2) સંચાલકીય નિર્ણયો લેવામાં ઉપયોગી :-**

માંગની મૂલ્ય સાપેક્ષતાનો ઘ્યાલ સંચાલકીય નિર્ણયો લેવામાં ઉપયોગી નિવતે છે. વસ્તુનું ઉત્પાદન કે વેચાણ નક્કી કરવા માટે માંગની મૂલ્ય સાપેક્ષતાનો ઘ્યાલનો ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યાં માંગ વધુ મૂલ્ય અનપેક્ષ હશે ત્યાં વધુ ભાવ અને વેચાણ કરશે. મૂલ્ય સાપેક્ષ માંગની વસ્તુની કિંમત ઓછી રાખી વેચાણ કરશે. તદ્દુપરાંત જે બજારમાં વસ્તુની માંગ સ્થિર એટલે કે મૂલ્ય અનપેક્ષ હોય ત્યાં વસ્તુના ભાવ વધારે રાખશે અને જે બજારમાં માંગ મૂલ્ય સાપેક્ષ હશે ત્યાં ઓછા ભાવ રાખશે.

**(3) કરવેરા નક્કી કરવા માટે તેમજ આર્થિક નીતિઓનાં ઘડતર માટે :-**

સરકારને આર્થિક નીતિ અને કરવેરા નીતિ નક્કી કરવા માટે માંગની મૂલ્ય સાપેક્ષતાનો ઘ્યાલ ઉપયોગી છે. અર્થતંત્રમાં ભાવનીતિ નક્કી કરવામાં કઈ વસ્તુના ભાવો પર અંકુશ મૂકવો તમામ બાબતો માટે સરકાર પહેલા વસ્તુની મૂલ્ય સાપેક્ષતાનો વિચાર કરે છે. એ જ રીતે વસ્તુ પર કરવેરા નાખવા માટે પણ મૂલ્ય સાપેક્ષતાના ઘ્યાલનો ઉપયોગ કરે છે. જે વસ્તુની વપરાશ ગરીબ, ધનિક વર્ગ વપરાશ કરતો હોય. એટલે કે, પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ હોય કે જેના પર કરવેરા નાંખવાથી ગરીબોના કલ્યાણના ઘટાડો થાય આવી વસ્તુ પર ઓછા દરે વેરા નાખશે. જ્યારે જે વસ્તુની વપરાશ ધનિક વર્ગ કરતો હોય. તેવી વસ્તુઓ જેવી કે મોજશોખ કે સુખ સગવડની વસ્તુઓ પર ઊંચા દરે વેરા નાંખે છે.

**(4) મજૂર નેતા માટે :-**

જો શ્રમની માંગ મૂલ્ય અનપેક્ષ હોય એટલે કે સ્થિર હોય તો ઉત્પાદકો એ વધુ વેતન આપી શ્રમ ખરીદવો પડે છે. આથી શ્રમની સોંદા શક્તિ મજબૂત હશે. તેઓ વધુ વેતન મેળવવામાં સફળ થાય છે.

**(5) ખેડૂતો માટે :-**

ઘણીવાર ખેત ઉત્પાદન વધે તો ખેડૂતોની આવક ઘટે છે. અને ઉત્પાદન ઘટે તો ખેડૂતોની આવક ઘટે છે. અને ઉત્પાદન ઘટે તો ખેડૂતોની આવક વધે છે. સામાન્ય રીતે ખેત પેદાશોની માંગ મૂલ્ય અનપેક્ષ હોય છે. આથી જો તેનું ઉત્પાદન વધુ થાય તો તેનું વેચાણ વધારવા ખેડૂતોએ તેના ભાવ ઘટાડવા પડે છે. જેને કારણે તેની ખેત આવક ઘટે છે. અને તેને નુકશાન જાય છે. આ માટે ખેડૂતોને પોતાની વસ્તુના યોગ્ય ભાવ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા તળિયાના ભાવ નક્કી કરવામાં આવે છે.

**(6) વિદેશી ચલણનો ભાવ નક્કી કરવા :-**

વિદેશ વેપાર દરમ્યાન વિદેશી ચલણનો ભાવ ઊંચો રાખવો કે નીચે તે નક્કી કરવાં માંગની મૂલ્ય સાપેક્ષતાનો ઘ્યાલ ઉપયોગી બને છે. જો વિદેશી ચલણનો ભાવ વધે તો આયાતો મોંઘી થાય. પરંતુ આયાતોનું પ્રમાણ વધશે કે ઘટશે તેનો આધાર આયાતી વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા પર

હોય છે. જો આપાતી વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ હશે તો આપાતી વસ્તુની માંગ ઘટશે. તેથી આપાતો ઘટશે. જો વિદેશી ચલણાના ભાવ ઘટે તો વિદેશી ચલણની માંગ ઘટશે. આવી પરિસ્થિતિમાં વિદેશી ચલણનો ભાવ વધારીને રૂપિયાનું અવમૂલ્યન કરવાની નીતિ ફળદાયી સાબિત થશે.

#### (7) સંયુક્ત પેદાશોની વસ્તુઓની નક્કી કરવા માટે :-

અમુક વસ્તુઓનું ઉત્પાદન સંયુક્ત રીતે થતું હોય છે. ત્યારે આ બંને વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ જાણવું મુશ્કેલ હોય છે. આવી વસ્તુઓની કિંમત નક્કી કરવામાં મૂલ્ય સાપેક્ષતાનો ઘ્યાલ ઉપયોગી નીવડે છે. જેમ કે જે વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ હોય તેનું ઉત્પાદન ખર્ચ ઓદ્ધું ગણી તે વસ્તુનાં ભાવ નીચા રાખવા જેથી તે વસ્તુની માંગ વધી શકે જે વસ્તુની માંગ ઓછી મૂલ્ય સાપેક્ષ હોય તેનું ઉત્પાદન ખર્ચ વધુ ગણી તેનાં ભાવ ઊંચા રાખવા જેથી વધુ નફો પ્રામ કરી શકાય.

- **માંગની આવક સાપેક્ષતા (income Elsticity of Demand) :-**

આપણે આગળ માંગની મૂલ્ય સાપેક્ષતા વિશે અત્યાસ કરી ગયાં. પરંતુ વસ્તુની માંગને માત્ર કિંમત ફેરફાર જ અસર નથી કરતી, આવકમાં થતો ફેરફાર પણ અસર કરે છે. ગ્રાહકની આવકમાં થતાં ફેરફાર માંગમાં ફેરફાર લાવે છે.

**અર્થ:-** “અન્ય પરિબળો યથાવત્ રહેતા ગ્રાહકની આવકમાં ફેરફાર થતાં વસ્તુની માંગમાં થતાં ફેરફારનું માપ એટલે માંગની આવક સાપેક્ષતા બીજા શાબ્દોમાં કહીએ તો,”

“ અન્ય પરિબળો યથાવત્ રહેતાં ગ્રાહકની આવકમાં થતાં ટકાવારી ફેરફારને કારણે માંગમાં થતો ટકાવારી ફેરફાર એટલે માંગની આવક સાપેક્ષતા.”

- **માંગની આવક સાપેક્ષતા માપવાની પદ્ધતિ :-**

માંગની આવક સાપેક્ષતા માપવા માટે ટકાવારી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.

$$\text{માંગની આવક સાપેક્ષતા} = \frac{\text{માંગમાં ટકાવારી ફેરફાર}}{\text{આવકમાં ટકાવારી ફેરફાર}}$$


---

આવકમાં ટકાવારી ફેરફાર

$$EY = \frac{D}{P} \div \frac{\Delta Y}{Y}$$

$$\text{જેમાં } D = \frac{\text{માંગમાં ફેરફાર} \Delta}{\text{આવકમાં ફેરફાર} Y} \quad D = \frac{\text{મૂળ માંગ}}{\text{મૂળ આવક}}$$

ધૂરો કે કોઈ વ્યક્તિની આવક રૂ. 25,000 છે અને તેની X વસ્તુની વપરાશ 25 Kg છે. જે તેની આવક વધી 90,000 રૂ. થાય તો તેની વપરાશ વધીને 30Kg થાય છે. આ પરિસ્થિતિમાં માંગની આવક સાપેક્ષતા નીચે મુજબ શોધી શકાય.


$$EY = \frac{\Delta D}{D} \times \frac{Y}{\Delta Y}$$

$$EY = \frac{5}{25} \times \frac{25000}{5000}$$

$$EY = 1 \quad \text{માંગની આવક સાપેક્ષતા થશે.}$$

માંગની આવક સાપેક્ષતા ધન કે હકારાત્મક છે. કારણ કે આવક અને માંગ વચ્ચે સીધો સંબંધ છે.  
અહીં માંગની આવક સાપેક્ષતા એકમ બરાબર છે.

- માંગની આવક સાપેક્ષતાનાં પ્રકારો :-
- (1) હકારાત્મક આવક સાપેક્ષ માંગ ( $EY = +ve$ )
- ગ્રાહકની આવકમાં વધારો થવાની સાથે તેની માંગમાં પણ વધારો થાય તેને હકારાત્મક કે ધન આવક સાપેક્ષ માંગ કહે છે.




આકૃતિમાં  $OX$  ખરી પર વસ્તુની માંગના એકમો અને  $OY$  ખરી પર ગ્રાહકની આવક દર્શાવવામાં આવી છે. આકૃતિમાં  $DD$  માંગરેખા ધન ઘાળવાળી છે. જે દર્શાવે છે કે ગ્રાહકની આવક  $ON$  છે ત્યારે ગ્રાહક  $OM$  એકમોની માંગ ગ્રાહકની આવક  $ON_1$  થી વધી  $ON_1$  થતી

માંગ OM થી વધુ OM<sub>1</sub> જેટલી થાય છે. સામાન્ય વસ્તુઓની માંગની આવક સાપેક્ષતા નકારાત્મક હોય છે. ગ્રાહકની આવક વધે તો સામાન્ય વસ્તુની માંગ વધે છે, ગ્રાહકની આવક ઘટે તો સામાન્ય વસ્તુની માંગ ઘટે છે.

### (2) નકારાત્મક આવક સાપેક્ષ માંગ (Negative Income Elasticity)

$$EY = -ve.$$


જ્યારે અન્ય પરિબળો યથાવત્ રહે અને ગ્રાહકની આવકમાં વધારો થતાં વસ્તુની માંગ ઘટે અને ગ્રાહકની આવક ઘટે તો માંગ ઘટે તો માંગની આવક સાપેક્ષતા નકારાત્મક હોય છે.



આકૃતિમાં OX ધરી પર વસ્તુની માંગ અને OY ધરી પર ગ્રાહકની આવક દર્શાવવામાં આવ્યાં છે. આકૃતિમાં DD માંગરેખા ઝણવાળી છે. જે દર્શાવે છે કે ગ્રાહકની આવક ON જેટલી છે ત્યારે માંગ OM જેટલી છે. આવક વધીને ON<sub>1</sub> થતાં વસ્તુની માંગ ઘટીને OM<sub>1</sub> જેટલી થાય છે. હલકા પ્રકારની વસ્તુઓની માંગની આવક સાપેક્ષતા નકારાત્મક હોય છે.

### (3) એકમ બરાબર આવક સાપેક્ષ માંગ (EY = 1)


અન્ય પરિબળો યથાવત્ રહે અને ગ્રાહકની આવકમાં જેટલો ફેરફાર થાય તેટલોજ ફેરફાર માંગમાં થાય તો તેને એકમ બરાબર આવક સાપેક્ષ માંગ કહે છે.



આકૃતિમાં  $OX$  ધરી પર વસ્તુની માંગ અને  $OY$  ધરી પર ગ્રાહકની આવક દર્શાવવામાં આવી છે. આકૃતિમાં  $DD$  માંગરેખા ધન ફળવાળી 45ના ખૂણો આવેલી રેખા છે. જે મુજબ ગ્રાહકની આવક  $ON$  છે ત્યારે માંગ  $OM$  જેટલી થાય છે. ગ્રાહકની આવક  $ON_1$  થી વધી  $ON_1$  થતાં માંગ  $OM$  થી વધી  $OM_1$  જેટલી થાય છે. એટલે કે ગ્રાહકની આવકમાં 100% વધારો થતાં માંગમાં 100% નો વધારો થાય છે.

#### (4) એકમ કરતા વધુ આવક સાપેક્ષ માંગ ( $Ey > 1$ )


અન્ય પરિબળો યથાવત્ રહેતા ગ્રાહકની આવકમાં થતાં ફેરફાર કરતા માંગમાં થતો ફેરફાર વધુ હોય તો માંગની આવક સાપેક્ષતા એકમ કરતા વધુ હોય છે.



આકૃતિમાં OX ધરી પર વસ્તુની માંગ અને OY ધરી પર ગ્રાહકની આવક દર્શાવવામાં આવ્યાં છે. આકૃતિમાં DD માંગ રેખા ઓછા ટાળવાળી ધન રેખા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગ્રાહકની આવક ON છે ત્યારે માંગ OM જેટલી છે. ગ્રાહકની આવક ON1 થતાં માંગ વધીને OM1 થાય છે. અહીં ગ્રાહકની આવકના ફેરફાર કરતા માંગનો ફેરફાર વધુ છે. આથી માંગરેખાનો ટાળ ઓછો હોય છે.

### (5) એકમ કરતાં ઓછી આવક સાપેક્ષ માંગ (Ey <1) :-


અન્ય પરિબળો યથાવત રહેતા ગ્રાહકની આવકમાં થતાં ફેરફાર કરતા માંગમાં થતો ફેરફાર ઓછો હોય ત્યારે માંગની આવક સાપેક્ષતા એકમ કરતા ઓછી હોય છે.



ઉપરોક્ત આકૃતિમાં OX ધરી પર વસ્તુની માંગ અને OY ધરી પર ગ્રાહકની આવક દર્શાવવામાં આવી છે. ગ્રાહકની આવક ON છે ત્યારે માંગ OM જેટલી છે. આવક વધીને ON1 થતાં માંગ વધીને OM1 જેટલી થાય છે. અહીં આવકમાં થતાં ફેરફાર કરતા માંગમાં થતો ફેરફાર ઓછો છે. આથી માંગરેખા તીવ્ર ટાળવાળી અને ધન ટાળવાળી હોય છે.

પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ જેવી કે અનાજ, કઠોળ, શાકભાજ વગેરેની આવક સાપેક્ષતા એકમ કરતા ઓછી હોય છે. ગ્રાહકની આવકમાં થતાં ફેરફાર કરતા આવી વસ્તુઓની માંગમાં થતો ફેરફાર ઓછો હોય છે.

(6) શૂન્ય આવક સાપેક્ષ માંગ :- ( $Ey > O$ )



અન્ય પરિબળો યથાવત રહેતાં ગ્રાહકની આવકમાં ગમે તેટલો ફેરફાર થાય પરંતુ તેની માંગમાં કોઈ જ ફેરફાર ન થાય તો તેને શૂન્ય આવક સાપેક્ષ માંગ કહે છે.

આકૃતિમાં  $OX$  ધરી પર માંગ અને  $OY$  ધરી પર ગ્રાહકની આવક દર્શાવવામાં આવ્યાં છે.

ગ્રાહકની આવક  $ON$  થી વધી  $ON_1$  થાય છે ત્યારે માંગ  $OM$  જેટલી સ્થિર રહે છે. આથી માંગરેખા  $OY$  ધરીને સમાંતર હોય છે.

અત્યંત સસ્તી વસ્તુઓની માંગની આવક સાપેક્ષતા શૂન્ય છે. ગ્રાહકની આવકમાં ગમે તેટલો ફેરફાર થાય આવી વસ્તુની માંગમાં ફેરફાર થતો નથી.

માંગની આવક સાપેક્ષતાના ઘ્યાલનું મહત્વ :-

(1) વ્યાપારિક નિષ્ઠયો લેવામાં આવક સાપેક્ષતાનું મહત્વ :-

વ્યાપારિક નિષ્ઠયો લેવામાં આવક સાપેક્ષતાનો ઘ્યાલ પેઢીને ખૂબ જ ઉપયોગી થાય છે. વસ્તુઓનું વર્ગીકરણ કરવા માટે એટલે કે જો માંગની આવક સાપેક્ષતા હકારાત્મક હોય તો સામાન્ય પ્રકારની વસ્તુ, નહારાત્મક આવક સાપેક્ષતા હોય તો હલકા પ્રકારની વસ્તુ, એકમ કરતાં વધુ આવક સાપેક્ષતા હોય તો મોજશોખ કે સુખ સગવડની વસ્તુ, એકમથી ઓછી હોય તો પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ હોય છે.

## (2) ઉત્પાદકો માટે :-

માનગળી ઉત્પાદકો માટે માંગની આવક સાપેક્ષતાનો ઘ્યાલ ઉપયોગી છે. પેઢી પોતાની પેઢીઓમાં ઉત્પાદન શક્તિનું આયોજન કરવા માંગની આવક સાપેક્ષતાની માહિતીના આધારે તેઓ પોતાની પેઢીઓમાં ઉત્પાદન કરે છે. જો લોકોની આવક વધવાનું વલણ બતાવે છે કે નહિ અને ઉત્પાદકની વસ્તુની માંગની આવક સાપેક્ષતા હકારાત્મક છે કે નહિ. જો માંગની આવક સાપેક્ષતા શૂન્ય કરતા વધારે પરંતુ એકમ કરતા ઓછી હશે, તો વસ્તુનું વેચાણ વધશે, જ્યારે આર્થિક વિકાસના દર કરતા વેચાણનો દર નીચો રહેશે અને જો માંગની આવક સાપેક્ષતા એકમ કરતા વધુ હોય તો આર્થિક વિકાસના દર કરતા વેચાણનો દર ઊંચો રહે છે.

## (3) ઉત્પાદન શક્તિનું પૂર્વ આયોજન કરવા માટે :-

માંગની આવક સાપેક્ષતાના આધારે ઉત્પાદક પેઢી પોતાની ઉત્પાદન શક્તિનું આયોજન કરે છે. લોકોની આવક વધવાનું વલણ અને માંગની આવક સાપેક્ષતાના આધારે ભવિષ્યના ઉત્પાદન અંગે આયોજન કરે છે.

## (4) આર્થિક આયોજન :-

અર્થતંત્રમાં યોજનાઓ ઘડવા માટે માંગની આવક સાપેક્ષતાનો ઘ્યાલ ઉપયોગી બને છે. લોકોની આવકમાં કેટલો વધારો થશે, જુદી જુદી વસ્તુઓની માંગની આવક સાપેક્ષતા કેવી છે વગેરે નો અંદાજ મેળવી આયોજકો જુદા જુદા ઉદ્યોગોમાં ઉત્પાદનના લક્ષ્યાંકો નક્કી કરી શકે છે અને આ લક્ષ્યાંકો સિધ્ય થાય એવી રીતે જુદા જુદી ઉદ્યોગો વચ્ચે સાધનોની ફાળવણી કરી શકે છે.

## માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા ( Cross Elastiaty of Demand)

“ જ્યારે અન્ય પરિબળો યથાવત હોય અને કોઈપણ વસ્તુની અવેજી, પૂરક, વિરોધી કે હરીફ વસ્તુઓની કિંમતમાં ફેરફાર થતાં તે વસ્તુની માંગમાં થતો ફેરફાર એટલે માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા.”

$$\text{સૂત્રના રૂપમાં} =$$

$$\text{X-ની માંગમાં થતો ફેરફાર} \\ \text{માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા} = \frac{\text{---}}{\text{Y- ની કિંમતમાં થતો ફેરફાર}}$$

$$Ec = \frac{\Delta Q_x}{\Delta P} \times \frac{P_y}{Q_x}$$

ધારો કે કોઈ એક વस્તુની કિંમતમાં 10% થાય તેને કારણે અન્ય વસ્તુની માંગમાં ફેરફાર થાય તો તેને પ્રતિ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે.

પ્રતિ મૂલ્ય સાપેક્ષ માંગના પ્રકારો :-

**(1) હકારાત્મક પ્રતિ મૂલ્ય સાપેક્ષ માંગ :-**

અવેજ વસ્તુઓની બાબતમાં માંગ પ્રતિમૂલ્ય સાપેક્ષ હોય છે. દા.ત. ચા અને કોફી જે બંને એકબીજાની અવેજમાં આવે છે. ધારો કે, ચાની કિંમત 200 રૂ. છે ત્યારે ચાની માંગ 10 એકમની છે, જ્યારે કોફીની કિંમત 250 રૂ. છે ત્યારે કોફીની માંગ 5 એકમ જેટલી છે. હવે ચાની કિંમત સ્થિર રહે અને કોફીની કિંમત વધીને 300 રૂ. થાય તો કોફીની માંગ વધીને 4 એકમ થાય છે. જ્યારે ચાની માંગ વધીને 12 એકમ થાય છે. આમ, અહીં માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા નીચે મુજબ શોધી શકાય. ધારો કે,

$$\begin{aligned} \text{ચા} &= X \\ \text{કોફી} &= Y \end{aligned}$$


$$\begin{aligned} Ec &= \frac{Q_x}{P_y} = \frac{\Delta P_y}{\Delta Q_x} \\ &= \frac{2}{1} = \frac{5}{10} \\ &= 1 \end{aligned}$$

બીજુ રીતે કહીએ તો,

$$\begin{aligned} \text{માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા} &= \frac{X \text{ વસ્તુની માંગમાં ટકાવારી ફેરફાર}}{Y \text{ વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર}} \end{aligned}$$

$$\begin{aligned} Ec &= \frac{P_x \%}{P_y \%} = \frac{\Delta}{\Delta} \\ Ec &= \frac{20\%}{20\%} = \frac{\Delta}{\Delta} \\ Ec &= 1 \end{aligned}$$

આમ માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા 1 જેટલી છે. નકારાત્મક છે. જેને આકૃતિ દ્વારા સમજુએ.



ઉપરોક્ત આકૃતિમાં  $OX$  ખરી પર ચાની માંગ અને  $OY$  ખરી પર કોફીની કિંમત દર્શાવવામાં આવ્યાં છે. કોફીની કિંમત  $ON$  જેટલી છે ત્યારે ચાની માંગ  $M$  જેટલી છે. કોફીની કિંમતમાં 20% જેટલો વધારો થાય છે. જે  $ON_1$  કિંમત છે. આથી ચાની માંગમાં પણ 20% જેટલો વધારો થાય છે જે  $OM_1$  દ્વારા દર્શાવવામાં આવ્યું છે. અહીં  $DD$  માંગરેખા ધન ઘણવાળી છે. જે દર્શાવે છે કે કોફીની કિંમતમાં ફેરફાર થતાં એટલે કે કોફીની કિંમત વધતાં તેની અવેજ વસ્તુ ચાની માંગમાં વધારો થાય છે.


## (2) નકારાત્મક પ્રતિ મૂલ્ય સાપેક્ષતા :-

પૂરક વસ્તુઓની બાબતમાં માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા નકારાત્મક હોય છે. દા.ત. રીફીલ અને બોલપેન, સ્કુટર અને પેટ્રોલ વગેરે. પૂરક વસ્તુમાંની કોઈ એક વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો તેની પૂરક વસ્તુની માંગ વધે છે.

ધારો કે, રીફીલની કિંમત 10 રૂ. છે ત્યારે રીફીલની માંગ 20 એકમ જેટલી છે. પેનની કિંમત 20 રૂ. છે ત્યારે પેનની માંગ 10 એકમ છે. રીફીલની કિંમત ઘટીને 8 રૂ. ત્યારે થાય છે ત્યારે પેનની માંગ વધીને 14 એકમ જેટલી થાય છે. તો માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા નીચે મુજબ આવે.

$$\begin{aligned}
 \text{રોકીલ} &= X \\
 \text{બોલપેન} &= Y \\
 \text{માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા} &= \frac{Qx}{Py} - \frac{Py\Delta}{Qx\Delta} \\
 &= \frac{4}{-2} - \frac{10}{10} \\
 &= -2
 \end{aligned}$$

આ બાબતને નીચેની આકૃતિ દ્વારા સમજાઓ.



આકૃતિમાં  $OX$  ધરી પર બોલપેનની માંગ અને  $OY$  ધરી પર રોકીલની કિંમત દર્શાવવામાં આવ્યાં છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ રોકીલની કિંમત 10 રૂ. છે ત્યારે બોલપેનની માંગ 10 એકમ જેટલી છે. રોકીલની કિંમત ઘટીને 8 રૂ. થતાં બોલપેનની માંગ વધીને 14 એકમ જેટલી થાય છે. અહીં  $DD$  માંગરેખા જણા ફળવાળી છે. જે દર્શાવે છે કે રોકીલની કિંમત ઘટે છે ત્યારે તેની પૂરક વस્તુ બોલપેનની માંગમાં વધારો થાય છે.

### (3) શૂન્ય પ્રતિ મૂલ્ય સાપેક્ષ માંગ :-

પરસ્પર વિરોધી વસ્તુઓની માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા શૂન્ય હોય છે. દા.ત. ખાંડ અને પેટ્રોલ, સોનું અને કપડાં વગેરે. આવી વસ્તુની કિંમતમાં ગમે તેટલો વધારો ઘટાડો થાય તેની વિરોધી વસ્તુની માંગમાં કોઈ જરૂરફકર થતો નથી.

દા.ત. ખાડની કિંમત 50 રૂ. છે ત્યારે માંગ 5 Kg છે. જ્યારે પેટ્રોલની કિંમત 70 રૂ. છે ત્યારે માંગ 2 લિટરની છે. જો પેટ્રોલની કિંમત ઘટીને 50 રૂ. થાય તો પણ ખાડની માંગ 5 કિલો જેટલી સ્થિર રહે છે જે નીચે સમજાયે.


$$Ec = \frac{Qx}{Py} - \frac{\Delta Py}{\Delta Qx}$$

$$= \frac{0}{20} - \frac{70}{50}$$

$$= \frac{70}{50}$$

$$= \frac{7}{5}$$

આ બાબતને આકૃતિ દ્વારા સમજાયે.



ઉપરોક્ત આકૃતિમાં OX ધરી પર ખાડની માંગ અને OY ધરી પર પેટ્રોલની કિંમત દર્શાવવામાં આવ્યાં છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેટ્રોલની કિંમત 70 રૂ. છે ત્યારે ખાડની માંગ 5 Kg. છે. પેટ્રોલની કિંમત ઘટીને 50 રૂ. થતાં ખાડની માંગ 5 Kg. જેટલી જ સ્થિર રહે છે. અહીં DD માંગ રેખા OY ધરીને સમાંતર છે. જે દર્શાવે છે કે કોઈપણ વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય તેની વિરોધી વસ્તુની માંગ સ્થિર રહે છે. એટલે કે માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા શૂન્ય હોય છે.

## ચાવી રૂપ શરૂદો :

- (1) અવેજની ચીજવસ્તુ :- એ એવી ચીજવસ્તુ કે જેની માંગ વિચારણા હેઠળની ચીજવસ્તુની માંગ સાથે વિપરીત સંબંધ ધરાવે છે.
- (2) માંગની ભાવ સ્થિતિ સ્થાપકતા :- તે ચીજવસ્તુના ભાવમાં આપેલા ફેરફાર તરફ માંગનો પ્રતિભાવ છે.
- (3) માંગની આવક સ્થિતિ સ્થાપકતા :- એ વપરાશકારની આવકમાં ફેરફારના આપેલા પ્રમાણ તરફ માંગનો પ્રતિભાવ છે.
- (4) તળીયાનો ભાવ :- આ સરકાર વડે નક્કી કરવામાં આવતો ચીજવસ્તુનો એ ભાવે છે કે જેના કરતા ભાવ નીચો જઈ શકે નહીં.
- (5) ટોચનો ભાવ :- એ સરકારે ચીજવસ્તુ માટે નક્કી કરેલો ભાવ છે કે જેનાથી તેનો ભાવ વધી શકે નહીં.

### સ્વાધ્યાય:

- (1) માંગની ભાવ સ્થિતિસ્થાપકતા મુદ્દા અનુસાર લખો ? અને તેના પરીબળો ક્યાં છે ?
- (2) અવેજ અને પૂરક ચીજવસ્તુઓની માંગની ભાવ તિર્થક સ્થિતિસ્થાપકતા સમજાવો.
- (3) માંગની ભાવ સ્થિતિ સ્થાપકતા માંગની આવક સ્થિતિસ્થાપકતા અને માંગની ભાવ તિર્થક સ્થિતિ સ્થાપકતાના ઘાલો સમજાવો.
- (4) માંગની ભાવ સ્થિતિસ્થાપકતા અને માંગની આવક સ્થિતિ સ્થાપકતા વચ્ચે શો તફાવત છે.

### MCO

- (1) માંગ રેખાના મધ્ય બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા.  
(અ)  $ed > 1$       (બ)  $ed = 1$   
(ક)  $ed = 0$       (ઝ)  $ed < 1$
- (2) મોજશોખની વસ્તુઓની માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી હોય છે ?  
(અ)  $1 < ed < a$       (બ)  $ed = 0$   
(ક)  $ed = a$       (ઝ)  $ed = 1$
- (3) પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓની માંગની મૂલ્ય સાપેક્ષતા સામાન્ય રીતે કેવી હોય છે.  
(અ) મૂલ્ય અનપેક્ષ  
(બ) મૂલ્ય સાપેક્ષ  
(ક) સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ  
(ઝ) સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ
- (4) માંગ રેખાનો ઢાળ માંગ કેવી હોય ત્યારે ઓછો હોય ?  
(અ) સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ      (બ) સંપૂર્ણ મૂલ્ય નરપેક્ષ  
(ક) મૂલ્ય અનપેક્ષ      (ઝ) મૂલ્ય સાપેક્ષ

જવાબ :-

- (1) બ      (2) અ      (3) ઝ      (4) ઝ

### એકમ - 3

### ઉત્પાદન અને ઉત્પાદન વિધેય

#### : રૂપરેખા :

- 3.1      ઉત્પાદન અને ઉત્પાદન વિધેય
  - 3.1.1 ઉત્પાદન વિધેયના લક્ષણો
  - 3.1.2 ઉત્પાદન વિધેયના પ્રકાર
- 3.2      ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેય
- 3.3      ઉત્પાદનનો બિનપ્રમાણસર સાધનનો નિયમ
  - 3.3.1 નિયમની ધારણા
  - 3.3.2 નિયમની સમજૂતી
  - 3.3.3 તબક્કાવાર સમજૂતી
  - 3.3.4 નિયમનું મહત્વ
- 3.4      લાંબા ગાળાનું ઉત્પાદન વિધેય
- 3.5      કદ વિકાસનો અથવા વળતરનો નિયમ
  - 3.5.1 કદ મળતરની અનુસૂચી તથા આફૂતી
  - 3.5.2 કદ મળતરના તબક્કાવાર સમજૂતી
- 3.6      કદ વિકાસના લાભ અને ગેરલાભ
  - 3.6.1 પેઢી વિકાસના લાભ
  - 3.6.2 ઉદ્યોગ વિકાસના લાભ
  - 3.6.3 પેઢી વિકાસના ગેરલાભ
  - 3.6.4 ઉદ્યોગ વિકાસના ગેરલાભ
- 3.7      સમઉત્પાદન રેખા
  - 3.7.1 ટેક્નિકલ સીમાંત અવેળનો દર
  - 3.7.2 સમ ઉત્પાદન રેખાના લક્ષણો
- 3.8      સમખ્યારેખા
  - 3.8.1 સમખ્યારેખાનું સ્થાન અને ફોળાવ
- 3.9      સ્વાધ્યાય

### 3.1 ઉત્પાદન અને ઉત્પાદન વિધેય :

પ્રસ્તાવના :

કુલ ઉત્પાદનનો આધાર બે બાબતો પર રહે છે :-

1. ઉત્પાદનના સાધનોનું પ્રમાણ
2. સાધનો અને ઉત્પાદન વચ્ચેનો ભૌતિક સંબંધ

ઉત્પાદનના સાધનોનું પ્રમાણ બદલાય છે ત્યારે કુલ ઉત્પાદનમાં ફેરફાર થાય છે.

ઉત્પાદનના સાધનોનું પ્રમાણ વધે છે ત્યારે કુલ ઉત્પાદન વધે છે અને ઉત્પાદનના સાધનોનું પ્રમાણ ઘટે છે ત્યારે કુલ ઉત્પાદન ઘટે છે.

- “સાધનો અને ઉત્પાદન વચ્ચેના ભૌતિક સંબંધને ટેકનિકલ ભાષામાં ઉત્પાદન વિધેય (Production Function) તરીકે ઓળખવામાં આવે છે. ”
- સાધન પ્રમાણ અને ઉત્પાદન પ્રમાણ વચ્ચેના વિધેયાત્મક સંબંધને ઉત્પાદન વિધેય કહેવાય છે.

$$P = f [ a, b, c, d, \dots \dots ]$$

જેમાં  $P =$  કુલ ઉત્પાદન દર્શાવે છે.

$$a = ભૂમિ$$

$$b = શ્રમ$$

$$c = મૂડી$$

$$d = નિયોજક પ્રમાણ દર્શાવે છે.$$

$$f = વિધેયાત્મક સંબંધ (સંજ્ઞા) દર્શાવે છે.$$

- આ સાધનોનું પ્રમાણ અને ઉત્પાદનના પ્રમાણ વચ્ચે વિધેયાત્મક સંબંધ છે તેમ દર્શાવે છે પરંતુ આ સંબંધ ચોક્કસ કેવા પ્રકારનો છે તે દર્શાવતું નથી.
- જો  $f$ નો ચોક્કસ પ્રકાર બતાવવામાં આવે તો ગાણિતિક પદ્ધતિથી કહી શકાય કે સાધનોના પ્રમાણમાં અમૂક ફેરફારને પરિણામે ઉત્પાદનના પ્રમાણમાં ચોક્કસ કેટલો ફેરફાર થશે.
- સૂરેખા સમાન ગુણધર્મી ઉત્પાદન વિધેયનો પ્રથમ કક્ષાનું સમાન ગુણધર્મી ઉત્પાદન વિધેય કહેવામાં આવે છે. ઉત્પાદનના બે સાધનો (x અને y) હોય તો પ્રથમ કક્ષાનું ગુણધર્મમાં ઉત્પાદન વિધ્યે :  $MQ = f (mx.my)$

$$Q = કુલ ઉત્પાદન$$

$$M = ચોક્કસ સંખ્યા છે.$$

X અને y સાધનોના પ્રમાણમાં m ગણો વધારો થાય તો ઉત્પાદન Q માં પણ m ગણો વધારો થાય છે.

### 3.1.1 ઉત્પાદન વિધેયના લક્ષણો :

- તે દર્શાવે છે કે સાધનોના ચોક્કસ સંયોજન દ્વારા વધુમાં વધુ કેટલું ઉત્પાદન મેળવી શકાય.
- ઉત્પાદનનું ચોક્કસ પ્રમાણ મેળવવા માટે ઓછામાં ઓછા કેટલા પ્રમાણમાં સાધનોની જરૂર પડશે.
- ચોક્કસ સમયગાળા દરમ્યાન પણ કેટલું ઉત્પાદન મેળવી શકાય છે.
- ઉત્પાદન વિધેયનો આધાર તેની ટેક્નોલોજી પર રહેલો છે તેની ટેક્નોલોજી બદલાય તો ઉત્પાદન વિધેય પણ બદલાય છે.

### 3.1.2 ઉત્પાદન વિધેયના પ્રકાર :

1. ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેય એવી ધારણા પર આધારિત છે કે માત્ર એક સાધન પરિવર્તનશીલ છે. એ સિવાયના અન્ય સાધનો સ્થિર છે. તેને પરિવર્તનશાલ સાધન સુયોજન કે બિનપ્રમાણસર ઉત્પાદનનો નિયમ કે ઘટતી પેદાશનો નિયમ આપે છે.
2. લાંબા ગાળાનું ઉત્પાદન વિધેય જે એવી ધારણા પર આધારિત છે કે બધાં સાધનો અસ્થિર છે. આ ઉત્પાદન વિધેય પેઢીનો કદ વિકાસને પરિણામે પ્રાપ્ત થતાં વળતર અંગેનો નિયમ આપે છે.

---

## 3.2 ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેય :

---

ટૂંકા ગાળામાં ઉત્પાદનના સાધનો સ્થિર હોય છે. કોઈ એક સાધનના પ્રમાણમાં વધારો ઘટાડો થઈ શકે છે. આમ, પરિસ્થિતિમાં ઉત્પાદનમાં કેવો ફેરફાર થાય છે. તે ટૂંકા ગાળાના ઉત્પાદન વિધેય દ્વારા દર્શાવાય છે.

$$Q = f(L, K)$$

$$\text{જેમાં } Q = \text{ઉત્પાદન}$$

$L$  = શ્રમિકો  $K$  = મૂડી  $K$  = પરની ( $\bar{K}$ ) રેખા સૂચવે છે કે મૂડી સ્થિર સાધન છે. શ્રમનું પ્રમાણ વધારીને ઉત્પાદન વધારવાનો પ્રયાસ છે.

#### • કુલ ભૌતિક ઉત્પાદન :

મૂડીનું પ્રમાણ સ્થિર રાખીને શ્રમના ચોક્કસ પ્રમાણ વડે મેળવવામાં આવતા વસ્તુના કુલ એકમોને કુલ ભૌતિક ઉત્પાદન કહે છે. શ્રમનું પ્રમાણ વધે તો કુલ ભૌતિક ઉત્પાદન વધે છે. પરંતુ કુલ ભૌતિક ઉત્પાદન વૃદ્ધિનો દર જુદો જુદો હોય છે.

#### • સરેરાશ ભૌતિક ઉત્પાદન :

એટલે મૂડીનું પ્રમાણ સ્થિર હોય ત્યારે શ્રમના એકમદીઠ ઉત્પાદન પ્રમાણ જે કુલ ભૌતિક ઉત્પાદનને શ્રમના એકમો વડે ભાગીને મેળવવામાં આવે છે.

- **સીમાંત ભૌતિક ઉત્પાદન :**

એટલે મૂડીનું પ્રમાણ સ્થિર હોય ત્યારે શ્રમના વધારાના એક એકમના ઉપયોગના પરિણામે કુલ ભૌતિક ઉત્પાદનમાં થતો વધારો.

ધારો કે 10 શ્રમિકો હોય ત્યારે કુલ ઉત્પાદન 100 એકમમાં 11 શ્રમિક ઉમેરતાં કુલ ઉત્પાદન 108 એકમ થાય છે.

$$108-100 = 8 \text{ એકમ સીમાંત ભૌતિક ઉત્પાદન છે.}$$

### 3.3 ઉત્પાદનનો બિનપ્રમાણસર સાધનનો નિયમ or પરિવર્તનીય સાધન સંયોજનનો નિયમ : (Law of Variable Proportion) or ઘટતી પેદાશનો નિયમ :

#### પ્રસ્તાવના :

અન્ય સાધનના પ્રમાણમાં સ્થિર અને માત્ર શ્રમના પ્રમાણમાં વધારો ઘટાડો કરવામાં આવે તો શ્રમ અને અન્ય સાધનો વચ્ચેનું સાપેક્ષ પ્રમાણ બદલાય છે. આ નિયમને ઘટતી પેદાશનો નિયમ કે પરિવર્તનીય સાધન સંયોજનનો નિયમ કહેવાય છે. કારણ બે શ્રમનું પ્રમાણ સતત વધારવામાં આવે તો અમુક બિંદુ પછી શ્રમની સીમાંત ઉત્પાદકતા ઘટતી હોય છે.

- પ્રો. માર્શલે ખેતીક્ષેત્રના ઉત્પાદનના સંદર્ભમાં ઘટતી પેદાશનો નિયમ રજુ કર્યો હતો.  
જો ખેત પદ્ધતિમાં ફેરફાર કર્યા સિવાય જમીનનું પ્રમાણ સ્થિર રાખીને મૂડી અને શ્રમનો ઉપયોગ વધારવામાં આવે તો જમીનમાંથી થતાં ઉત્પાદનનો વધારો અમુક કદ પછી સામાન્ય રીતે ઓછો થતો જાય છે.

#### 3.3.1 નિયમની ધારણા :

- ઉત્પાદન પદ્ધતિમાં કોઈ ફેરફાર ન થવો જોઈએ.
- અસ્થિર સાધનના બધા એકમો સમાન ગુણી હોવા જોઈએ. શ્રમ અસ્થિર સાધન હોય તો બધા શ્રમિકો સરખી કાર્યક્ષમતા ધરાવતા હોવા જોઈએ.
- સાધન સંયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ.
- ઓછામાં ઓછું એક સાધન સ્થિર હોવું જોઈએ.
- સાધનનું પ્રમાણ સાપેક્ષ રીતે પરિવર્તનશીલ હોવું જોઈએ.

### 3.3.2 નિયમની સમજૂતી :

જમીનના એક ટુકડા પર શ્રમના એકમોમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવે છે. શ્રમિકોનું પ્રમાણ વધતા ઉત્પાદનમાં વધારો થાય છે પછી ઘટે છે અને અમૃક એકમ પછી સીમાંત ઉત્પાદન નકારાત્મક થાય છે.


#### અનુસૂચિ

શ્રમના એકમો	કુલ ઉત્પાદન	સીમાંત ઉત્પાદન કિવન્ટલ	સરેરાશ ઉત્પાદન કિવન્ટલ	ઉત્પાદનના તબક્કા
1	6	6	6	પ્રથમ તબક્કો (વધતી પેદાશનો તબક્કો)
2	16	10	8	
3	27	11	9	
4	40	13	10	
5	50	10	10	બીજો તબક્કો (ઘટતી પેદાશનો તબક્કો)
6	54	4	9	
7	56	2	8	
8	56	0	7	
9	54	-2	6	ગીજો તબક્કો (નકારાત્મક પેદાશનો તબક્કો)
10	50	-4	5	

#### આકૃતિ :

OX પર શ્રમના એકમો oy ધરી પર કુલ ઉત્પાદન કિવન્ટલમાં દર્શાવેલ છે. આકૃતિમાં ગ્રાફ તબક્કા દર્શાવ્યા છે.

આકૃતિ :



### 3.3.3 તબક્કાવાર સમજૂતી :

#### 1. પ્રથમ તબક્કો :

શ્રમના પ્રમાણમાં વધારો થતાં કુલ ઉત્પાદન અને સરેરાશ ઉત્પાદનમાં વધારો થાય છે. સરેરાશ ઉત્પાદન કરતાં સીમાંત ઉત્પાદન વધારે છે. ઉત્પાદનનો પ્રથમ તબક્કો વધતી પેદાશનો છે.

#### 2. ઉત્પાદનનો બીજો તબક્કો :

શ્રમના 5 થી 7 એકમોનું રોકાણ કરવામાં આવે છે ત્યારે કુલ ઉત્પાદનમાં વધારો થાય છે. પરંતુ અસ્થિર સાધન શ્રમના પ્રમાણમાં વધારો કરવામાં આવતા કુલ ઉત્પાદન વધે છે પરંતુ સીમાંત અને સરેરાશ ઉત્પાદનમાં ઘટાડો થાય છે. બીજો તબક્કો ઘટતી પેદાશનો તબક્કો.

### 3. ત્રીજો તબક્કો :

અહીં શ્રમનાં 8,9,10 એકમોનું રોકણ વધારવામાં આવે છે. ત્યારે કુલ ઉત્પાદનમાં ઘટાડો થાય છે. 8 શ્રમનાં એકમે કુલ ઉત્પાદન વધુ થાય છે પરંતુ સીમાંત ઉત્પાદન શૂન્ય અને સરેરાશ ઉત્પાદન 7 કિવનટલ થાય છે. પરંતુ 9 માં અને 10 માં શ્રમિકે સીમાંત ઉત્પાદન અનુકમે -2 અને -4 નકારાત્મક થાય છે અને સરેરાશ ઉત્પાદન પણ ઘટે છે. ત્રીજો તબક્કો નકારાત્મક પેદાશનો છે.

#### 3.3.4 નિયમનું મહત્વ :

આ નિયમ માત્ર ખેતક્ષેત્રમાં નહીં પરંતુ ઉત્પાદનના દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. ઉત્પાદનના દરેક ક્ષેત્રમાં ઘટતા મળતરનો નિયમ એક સામાન્ય ઘટના છે તેમ છતાં ખેતીક્ષેત્રો આ નિમય વહેલો અમલી થાય છે જ્યારે ઉદ્યોગક્ષેત્રો અમુક તબક્કા પદ્ધતી નિયમ આવતો જગાય છે.

---

### 3.4. લાંબાગાળાનું ઉત્પાદન વિધેય :

---

લાંબાગાળે ઉત્પાદનના બધા સાધનો પરિવર્તનશીલ છે. બધા સાધનોનું પ્રમાણ એક સાથે વધારી શકાય છે. સમગ્ર પેટીનો કદ વિસ્તાર પામે છે. આવા સમયે ઉત્પાદનનું વલાશ કેવું હશે તે કદ વિકાસના મળતરના નિયમ દ્વારા સમજાવામાં આવે છે.

લાંબાગાળાનું ઉત્પાદન વિધેયનું સમીકરણ

$$Q = f (x_1, x_2, x_3, \dots, x_w, \bar{T})$$


$Q = \text{ઉત્પાદન}$

$x_1, x_2, x_3, \dots, x_n = \text{ઉત્પાદનના વિભિન્ન સાધનો}$

$T = \text{ટેક્નોલોજી જે સ્થિર છે.}$

$F = \text{વિધેયાત્મક સંબંધ}$

આકૃતિ



**સમજૂતિ :**  $OX$  આડી ધરી પર શરીરના એકમો અને  $OY$  ધરી પર મૂડીના એકમો દર્શાવ્યા છે. ધારોકે વસ્તુના ઉત્પાદન માટે શરીર અને મૂડીના સાધનોની જરૂરિયાત છે. શરીરના એકમો  $OC$  સ્થિર દર્શાવ્યા છે.  $CD$  પર જેમ ઉપર તરફ ગતિ કરવામાં આવે છે. તેમ તેમ મૂડીના એકમોમાં વધારો થાય છે. આમ,  $CD$  અને  $AB$  રેખાઓ પરિવર્તનીય સાધન પ્રમાણાની રજૂઆત કરે છે. અહીંથી શરીર અને મૂડીના એકમો વધારવામાં આવે છે. તેથી ઉત્પાદક પેઢીનું કદ વિસ્તાર પામે છે. સાધનપ્રમાણમાં ફરજાર થતો નથી.

### 3.5 કદ વિકાસનો અથવા વળતરનો નિયમ :


જ્યારે ઉત્પાદનના બધાં જ સાધનોનું પ્રમાણ એક સાથે વધારવામાં આવે ત્યારે ઉત્પાદનના વલાણો ત્રણ તબક્કામાં વહેંચાયેલાં જોવા મળે છે.

#### 3.5.1 કદ મળતરના તબક્કાનું અનુસૂચિ :

કદનો કમાંક	કદ		કુલ ઉત્પાદન ક્રિવન્ટલ	સીમાત મળતર ક્રિવન્ટલ	તબક્કા
	શરીર + (એકમો)	જમીન (એકર)			
1	1	3	20	20	પ્રથમ તબક્કામાં વધતા મળતરનો તબક્કો
2	2	6	50	30	
3	3	9	90	40	
4	4	12	140	50	
5	5	15	190	50	બીજો સ્થેર
6	6	18	240	50	

7	7	21	280	40	મળતરનો તબક્કો
8	8	24	310	30	ગીજે ઘટતો
9	9	27	330	20	મળતરનો દર

:



### 3.5.2 કદ મળતરના તબક્કાવાર સમજૂતિઃ

1. **વધતા મળતરનો તબક્કો :** પેઢીના કદમાં ૫૦ ટકાનો પ્રત્યેક સાધનના પ્રમાણમાં ૫૦ ટકા વધારો થાય તો તેને લીધે ૫૦ ટકાથી વધુ ઉત્પાદનને પ્રાપ્ત થાય જેને વધુ મળતર કહેવાય છે. આ પ્રથમ તબક્કામાં કદ વિસ્તાર સાથે સીમાંત મળતરમાં વધારો થાય છે તેથી કુલ ઉત્પાદનમાં કદ વિસ્તારની સરખામણીમાં વધુ વધારો થાય છે. જો કે શ્રમ અને જમીનના પ્રમાણમાં વધારો કરવામાં આવે છે. શ્રમવિભાજન અને વિશેષકરણનો શ્રમિકોની સંખ્યા વધતા લઈ શકાય છે.
2. **સ્થિર મળતરનો તબક્કો :** પેઢીના કદમાં ૫૦ ટકા જ વિસ્તાર કરવામાં આવે જેને પરિણામે ઉત્પાદનમાં પણ ૫૦ ટકાનો વધારો થાય તો તેને સ્થિર મળતર કહેવામાં આવે છે. કદનું સીમાંત વળતર 50 ક્રિન્ટલની સપાટીએ સ્થિર થવા પામે છે.
3. **ઘટતા મળતરનો તબક્કો :** પેઢીના કદમાં ૫૦ ટકાનો વિસ્તાર કરવામાં આવે જેને પરિણામે ઉત્પાદનમાં ૫૦ ટકાથી ઓછો વધારો થાય તો તેને ઘટતું મળતર કહેવામાં આવે છે. ગીજી તબક્કામાં શ્રમ અને જમીનનું પ્રમાણ વધારવામાં આવે છતાં

શ્રમિકોમાં શ્રમવિભાજન અને વિશિષ્ટીકરણનો અવકાશ ઘટે છે તેથી સીમાંત મળતર ઘટવા પામે છે.

કદ વિકાસના મળતરના તબક્કાની સમજૂતી આપવા માટે સાધનોની અવિભાજયતા મહત્વનો ભાગ ભજવે છે. અવિભાજયતા મહત્વનું પરિબળ છે.

### 3.6 કદ વિકાસના લાભ અને ગેરલાભ :

પેઢીનું કદ મોટું થતા તેને માટે ઉત્પાદનખર્ચમાં કરકસર થાય છે. તેથી પેઢી વિકાસના લાભ આંતરિક કરકસરના લાભ (ઇન્ટરનલ ઇકોનોમી) તરીકે ઓળખાય છે.

#### 3.6.1 પેઢી વિકાસના લાભ :

કોઈ પેઢીના કદમાં થતા વધારાને લીધે પેઢીને મળતાં અંગત લાભ પેઢી વિકાસના લાભ કહેવાય છે. પ્રો. રોબિન્સને પોતાના પુસ્તકમાં સ્ટ્રક્ચર ઓફ કોમ્પ્યુટીટીવ ઇન્ડસ્ટ્રીમાં પેઢી વિકાસનાં પાંચ લાભો દર્શાવ્યા છે.

##### 1. યાંત્રિક લાભ :

- શ્રમવિભાજન : પેઢીનું કદ વધતાં મોટા પાયા પરના ઉત્પાદનમાં શ્રમવિભાજન વિશિષ્ટકરણનો લાભ થઈ શકે છે. ઉત્પાદન પ્રક્રિયામાં નિષ્ણાંત અને આવડતવાળા શ્રમિકો અને યંત્રસામગ્રીનો ઉપયોગ થઈ શકે છે. તેમની કુશળતાથી સમયનો બગાવ થાય છે અને એકમંડિટ ખર્ચ ઘટે છે.
- અવિભાજયતા : મોટી પેઢી અવિભાજ્ય સાધનોનો પૂર્ણતમ ઉપયોગ કરી શકે છે. નાની પેઢી કરી શકતી નથી મોટા કિંમતી અને અવિભાજ્ય યંત્રના લાભ નાના પાયા પર ઉત્પાદન કરતી પેઢીને પ્રાપ્ત થતા નથી.
- વિસ્તાર વધારાનો લાભ : ઉત્પાદનમાં વધારો કરવા માટે મૂડી સાધનનું કદ વધવાને લીધે વિસ્તાર વધારાનો લાભ પ્રાપ્ત થાય છે.
- ઉત્પાદન પ્રક્રિયાનું સંકલન : મોટી પેઢી માટે ઉત્પાદન પ્રક્રિયાનું સંકલન એક જ સ્થળે શક્ય બને છે.
- આડપેદાશના લાભ : મોટી પેઢી દ્વારા મોટા પાયા પર ઉત્પાદન કરવાને કારણે આડપેદાશના લાભ મેળવી શકાય છે.

## 2. વહીવટી અને સંચાલકીય લાભો :

જો પેઢીનું કદ વિસ્તાર પામે તો કામની વહેંચણી સરળતાથી થઈ શકે છે. આ સમયે નિષ્ણાંતની સેવા જેમ કે કલાર્ક, ટાઇપિસ્ટ, હિસાબનીશ, સુપરવાઈઝર, ફોરમેન વગેરે દ્વારા સારી સસ્તી ટકાઉ અને નીચા ઉત્પાદન ખર્ચ વસ્તુઓનું ઉત્પાદન કરી શકાય.

## 3. નાણકીય લાભ :

પેઢી મોટા કદની થતાં તેની શક્તિમાં વધારો થાય છે. આથી નાણાં બજારમાંથી ઉત્પાદનકાર્ય માટે સરળતાથી ધ્વિરાણ મેળવી શકાય. લોકો પણ મોટી પેઢીમાં પોતાની બચતો રોકતાં અચકાતા નથી કારણ કે મોટી પેઢીની કાર્યક્ષમતામાં રોકાણકારોને વિશ્વાસ હોય છે તેથી પેઢી સહેલાયથી મૂડી એકત્રિત કરી શકે છે.

## 4. ખરીદ વેચાણના લાભ :

પેઢીનાં કદમાં વધારો થતાં જથ્થાબંધ ખરીદીમાં પેઢીની સોદાશક્તિમાં વધારો થાય છે. કાચો માલ પણ મોટા જથ્થામાં ખરીદવાનો હોવાથી સસ્તા ભાવે મળે છે, જેથી વસ્તુનાં ઉત્પાદન ખર્ચ ઘટે છે વેચાણમાં નિષ્ણાંત તજ્જોની સેવાનો લાભ મળે છે.

## 5. જોખમનું વિકેન્દ્રીકરણ :

મોટી પેઢી ધંધાના જોખમને ઘટાડે છે તે અનેક બજારોમાં વસ્તુઓનું વેચાણ કરે છે. એટલે કે એક બજારમાં મંદીને કારણે ખોટ આવે તો બીજા બજારમાં મળતા નફા દ્વારા ખોટ ભરપાઈ થઈ જાય છે.

### 3.6.2 ઉદ્યોગ વિકાસના લાભ ( External Economics ) :

- સ્થાનિયકરણના લાભ : કોઈ એક ઉદ્યોગ અમુક સ્થળે કેન્દ્રિત થવાથી બીજા અનેક સહાયક ઉદ્યોગોનો વિકાસ થાય છે. જેને લીધે સાધનસામગ્રી અને સેવાઓનાં બજારો વિકસે છે. ઉદ્યોગની દરેક પેઢીને તેનો લાભ મળે છે.
- માહિતી અને સંસોધનના લાભ : ઉદ્યોગોનો વિકાસ થતાં શ્રમિકોના મંડળો, સંચાલકોનાં મંડળો, ઉત્પાદન અને બજાર અંગોના સર્વે હાથ ધરાય છે. જેને પારિષામે ઉત્પાદન પદ્ધતિ અને વસ્તુની ગુણવત્તા અંગે સંશોધન થાય છે. તે સામયિકો પ્રકાશિત થાય છે. જેમાં કાચા માલની પ્રાપ્તિ, માંગની સ્થિતિ, સરકારની નીતિ, કરવેરાનું ભારણ, બજારની સ્થિતિ વગેરેની રજૂઆત થાય છે.
- સહાયક ઉદ્યોગો : કોઈ એક સ્થળે ઉદ્યોગોનો વિકાસ થવા સાથે સહાયક ઉદ્યોગો પણ વિકસે છે.

### **3.6.3 પેઢી વિકાસના ગેરલાભ :**

પેઢીનું કદ અમયાદિત પ્રમાણમાં વધારવું હિતાવહ નથી. કારણ કે શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટતું જશે. પરંતુ અમુક હદ પછીથી સરેરાશ ખર્ચમાં વધારો થાય છે અને મોટા કદના ગેરલાભ મળે છે.

#### **1. યાંત્રિક લાભ :**

પેઢી મોટા કદથી થતા ઉત્પાદનની જુદી પ્રક્રિયાના સંચાલનની સમસ્યા, ઉત્પાદન પ્રક્રિયા અને વેચાણ પ્રક્રિયા, સંકલન સમસ્યા સર્જિય છે. નિયોજકની શક્તિની કેટલીક મર્યાદા જેને લીધે જુદી પ્રક્રિયાઓ વચ્ચે વિશિષ્ટ પ્રશ્નો, સમસ્યાઓ અને તાત્કાલિક નિષ્ઠયો લેવામાં વિલંબ થાય છે.

#### **2. વહીવટી ગેરલાભ :**

પેઢીના કદનો વિસ્તાર થવાથી વહીવટી સંચાલન ક્રેત કેટલીક સમસ્યાઓ સર્જિય છે. કર્મચારીઓ, વહીવટીદારો અને અધિકારીઓના હક્કના પ્રશ્નો, નિરીક્ષણ, નિયંત્રણ અને સંકલનની જવાબદારીમાં વધારો થાય છે. આવા સમયે સંચાલકોની કાર્યક્રમતા ઘટે છે.

#### **3. ખરીદ-વેચાણ ગેરલાભ :**

મોટી પેઢી કાચામાલની જથ્થાબંધ ખરીદી કરે છે. આ સંજોગોમાં કાચામાલના ભાવો ઘટે તો પેઢીને નુકસાની ભોગવવી પડે છે. આ સાથે કાચા માલના સંગ્રહનો પ્રશ્ન, કમોસમી માંગ, અપૂરતી માંગ વગેરે ખરીદ-વેચાણના ગેરલાભ પેઢીને સહન કરવા પડે છે.

### **3.6.4 ઉદ્યોગ વિકાસના ગેરલાભ :**

#### **1. કારખાના પ્રથાના દૂષણો :**

ઉદ્યોગોનું સ્થાનીકરણ થતાં કારખાનાં પ્રથા અસ્તિત્વમાં આવે છે. કારખાનાં પ્રથાનાં દુષ્ણો સર્જિય છે. જેમ કે વસ્તીનું દબાણ, ગંદા ગીય રહેઠાણો, ઝૂંપડપહ્ણીઓ, હવા પાણીનું દૂષિતીકરણ કામદારોનાં સ્વાસ્થ્યના પ્રશ્નો પણ સર્જિય છે. તેમની કામ કરવાની શક્તિ અને ઈચ્છા પર વિપરીત અસર થાય છે. જે સમાજને માટે નુકસાનકારક છે.

**2. ઔદ્યોગિક અશાંતિ :** ઉદ્યોગોના કેન્દ્રીકરણના સ્થળે અશાંતિ સર્જિય છે. માલિક અને મજૂર વચ્ચે થતા ઔદ્યોગિક ઝડપા, વેતન વધુ કામનો પ્રશ્ન વગેરે સમસ્યાઓ સર્જિય છે.

**3. શહેરીકરણના પ્રશ્નો :** ઉદ્યોગના કેન્દ્રીકરણને પરિણામે શહેરી વિસ્તારોમાં વસ્તીનું સ્થળાંતર થાય છે. શહેરીકરણના પ્રશ્નો સર્જિય છે. જેમાં રહેઠાણનો પ્રશ્ન, પાણી, વીજળી, વાહનવ્યવહાર, ગંદા-ગીય વસવાટો, સમાજના નૈતિક અધ્યાત્મિક જેવી સામાજિક સમસ્યાઓ બેકારી અને અધિબેકારી સર્જિય છે.

### 3.7. સમઉત્પાદન રેખા : (Iso- quant Curve ) (IQC)

ઉત્પાદનનાં કોઈપણ બે સાધનો વતાઓછા અંશે એકબીજાની અવેજ લઈ શકે છે. તેથી કોઈ એક સાધનનું પ્રમાણ ઘટાડીને અને બીજા સાધનનું પ્રમાણ વધારીને એકસરખું ઉત્પાદન મેળવી શકાય છે.

**સમઉત્પાદન રેખાનો અર્થ :**

બે સાધનોનાં જુદા જુદાં સંયોજનો વડે એકસરખું ઉત્પાદન વ્યક્ત કરતી રેખાને ઉત્પાદન રેખા તરીકે ઓળખવામાં આવે છે.


- અમુક ચોક્કસ ઉત્પાદન મેળવવાં માટે એક કરતાં વધુ સાધન સંયોજન શક્ય હોય તો બિના બિન સાધન સંયોજનો દ્વારા એક સરખું ઉત્પાદન મેળવી શકાતું હોય તો તેવા સાધન સંયોજને સમઉત્પાદન સાધન સંયોજન તરીકે ઓળખી શકાય.

● ધારણાઓ :

1. ઉત્પાદક ઉત્પાદન કરવા માટે શ્રમ અને મૂડી એમ બે સાધનોનો ઉપયોગ કરે છે.
2. ઉત્પાદન પદ્ધતિ આપેલી છે.
3. ઉત્પાદન દરેક સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે.

**અનુસૂચિ અને આકૃતિ**

સાધન સંયોજન	શ્રમ અને મૂડીનું પ્રમાણ (એકમમાં)	સીમાંત અવેજનો દર મૂડી : શ્રમ	કુલ ઉત્પાદન (એકમમાં)
A	1 + 25	-	100
B	2 + 17	1:8	100
C	3 + 11	1 :6	100
D	4 + 6	1 :5	100




આકૃતિમાં OX રેખા પર શ્રમ અને OY રેખા પર મૂડીનું પ્રમાણ દર્શાવવામાં આવે છે. A, B, C અને D બિંદુઓ એકસરખું ઉત્પાદન આપી તેવા સાધન સંયોજન દર્શાવે છે. A, B, C, D બિંદુઓને જોડતા એક સંંગ્રહ રેખા પ્રાપ્ત થાય છે જેને સમ ઉત્પાદન રેખા ISO-quant Curve અથવા Equal product Curve તરીકે ઓળખવામાં આવે છે.

### 3.7.1 ટેક્નિકલ સીમાંત અવેજનો દર :

કુલ ઉત્પાદનમાં ફેરફાર જન્માવ્યા સિવાય શ્રમના પ્રમાણમાં એક એકમનો વધારો કરવા માટે મૂડીના જેટલા એકમો ઘટાડવા પડે છે તે શ્રમનો ટેક્નિકલ સીમાંત અવેજન દર દર્શાવે છે.

$$\text{શ્રમનો ટેક્નિકલ સીમાંત અવેજન દર} = \frac{\text{મૂડીના પ્રમાણમાં ઘટાડો}}{\text{શ્રમના પ્રમાણમાં વધારો}}$$




$OX$  રેખા પર શરીરના એકમો અને  $OY$  રેખા પર મૂડીના એકમો દર્શાવ્યા છે.  $B$  અને  $D$  સંયોજન એકસરખું ઉત્પાદન કરી શકે તેવા શ્રમ અને મૂડીના ભિત્તિ ભિત્તિ પ્રમાણ દર્શાવતા સાધન સંયોજન છે.

તેથી શરીરનો સીમાંત અવેજ એ  $= \frac{BE}{ED}$  થાય છે.

### 3.7.2 સમ ઉત્પાદન રેખાના લક્ષણો:

1. સમઉત્પાદન રેખા જમણી બાજુ નીચે ટળતી હોય છે. તેનો આણ ટાળ હોય છે. એક સાધનના પ્રમાણમાં વધારો થાય છે ત્યારે બીજા સાધનના પ્રમાણમાં ઘટાડો થાય છે.

આકૃતિ



$Iq$  એ સમઉત્પાદન રેખા છે તેથી શ્રમના પ્રમાણમાં  $L_1 L_2$  જેટલો વધારો થાય ત્યારે મૂડીનું પ્રમાણ  $C_1 C_2$  જેટલું ઘટાડવામાં આવે તો એકસરખું ઉત્પાદન પ્રાપ્ત થાય છે તેથી સમઉત્પાદનરેખા ઉપરથી નીચે જમણી તરફ ઘણતી જાય છે.


### 2. સમઉત્પાદન રેખા મધ્યબિંદુ તરફ બહિગોળ છે :

સમઉત્પાદન રેખાના હોવાવનો આધાર ટેકનિકલ અવેજીના સીમાંત દર પર રહેલો છે. ટેકનિકલ સીમાંત અવેજીનો દર ઘટતો જતો હોવાથી સમઉત્પાદન રેખા મધ્યબિંદુ તરફ બહિગોળ છે. જેમ જેમ શ્રમના એકમો વધતા જાય છે તેમ તેમ મૂડીના એકમો ઘટે છે તે શ્રમનો સીમાંત અવેજીનો દર દર્શાવે છે અને ટેકનિકલ અવેજીનો સીમાંત દર કમશા: ઘટતો જતો હોવાથી સમઉત્પાદન રેખા મધ્યબિંદુ તરફ બહિગોળ છે.

### 3. સમઉત્પાદન રેખા એકબીજાને છેદી શકે નહીં :

જો બે રેખાઓ એકબીજાને છેદતી હોય તો તે સમઉત્પાદન રેખાઓ હોઈ શકે નહિએ. આકૃતિમાં A અને B બિંદુઓ એક જ સમઉત્પાદન રેખા  $Iq_1$  પર આવેલાં છે. તે જ રીતે A અને B બિંદુઓ એક જ સમઉત્પાદન રેખા  $Iq_2$  પર આવેલા છે. પરંતુ આ બંને સંયોજનમાં મૂડીનું પ્રમાણ સરખું છે. પરંતુ શ્રમનું પ્રમાણ સરખું નથી. તેથી સમઉત્પાદન રેખા કહી શકાય નહીં

આકૃતિ




શ્રમના એકમો

4. સમઉત્પાદન રેખા જેમ ઉપર તેમ ઉત્પાદન વધુ:

આકૃતિમાં  $Iq_1, Iq_2, Iq_3$  ત્રણ સમઉત્પાદન રેખાઓ દર્શાવી છે.

$Iq_3$  સમઉત્પાદન રેખા ઊંચી છે જે નીચેની રેખા કરતાં વધુ ઉત્પાદન આપે છે.



$Iq_1, Iq_2$  કરતાં  $Iq_3$  માં શ્રમના એકમો વધારે છે. તેથી તે વધુ ઉત્પાદન દર્શાવે છે. આમ; જેમ સમઉત્પાદન રેખા ઊંચી તેમ ઉત્પાદન વધુ.

### 3.8. સમખર્ય રેખા:

“ઉત્પાદક પાસે જે આપેલી રકમ હોય તે રકમ વડે ઉત્પાદનનાં બે સાધનોના કયાં સંયોજનો પેઢી ખરીદી શકે તે બાબત દર્શાવતી રેખા એટલે સમખર્ય રેખા.”

પેઢી તોણે નક્કી કરેલ ખર્ચવાપાત્ર રકમ દ્વારા ઉત્પાદનનાં બે સાધનોનાં કયા સંયોજનો ખરીદી શકે તે દર્શાવતી રેખાને સમખર્ય કહેવામાં આવે છે.


ધારો કે ઉત્પાદક પાસે શ્રમ અને મૂડી પાછળ રૂ. 1000 ખર્ચ કરવાનો છે. મૂડી અને શ્રમની કિંમત અનુક્રમે રૂ. 10 અને રૂ. 5 છે. ઉત્પાદક માટે એકસરખા ખર્ચ દ્વારા ઉપલબ્ધ સાધન સંયોજન નીચે મુજબ દર્શાવી શકાય.

### અનુસૂચિ શક્ય સાધન સંયોજનો

સંયોજન	શ્રમ + મૂડી (એકમો)	શ્રમનું ખર્ચ (રૂ. માં)	મૂડીનું ખર્ચ (રૂ. માં)	કુલ ખર્ચ (રૂ. માં)
A	0 + 100	000	1000	1000
B	40 + 80	200	800	1000
C	80 + 60	400	600	1000
D	120 + 40	600	400	1000
E	160 + 20	800	200	1000
F	200 + 00	1000	000	1000

ઉત્પાદક પાસે ત્રણ વિકલ્પો છે.


1. ઉત્પાદક બધી જ રકમ મૂડી પાછળ ખર્ચે તો મૂડીના 100 એકમ ખરીદી શકે છે.
2. ઉત્પાદક બધી જ રકમ શ્રમ પાછળ ખર્ચે તો શ્રમના 200 એકમ ખરીદી શકે છે.
3. અમુક રકમ મૂડી પાછળ અને અમુક રકમ શ્રમ પાછળ ખર્ચ કરે તો અનુસૂચિ પર બતાવેલા અલગ અલગ સાધન સંયોજન મેળવી શકાય. દા.ત. શ્રમના 120 એકમ અને 40 એકમ મૂડીના ઉત્પાદક ખરીદી શકે છે. જો ઉત્પાદક બધી રકમ D સંયોજન પર રોકે તો



આફુતિમાં A, B, C, D, E અને Dબિંદુઓ એક સરખું ખર્ચ થતું હોય તેવા શ્રમ અને મૂડીના શક્ય સંયોજનો દર્શાવે છે. આ બિંદુઓને જોડતા જે સંગંગ રેખા પ્રાપ્ત થાય છે તે સમખર્ચ રેખા છે.

### 3.8.1 સમખર્ચરેખાનું સ્થાન :


સમખર્ચ રેખાના સ્થાનનો આધાર ઉત્પાદક પાસે ખર્ચવા માટે કેટલી રકમ છે તેના પર રહેલો છે. જેમ ઉત્પાદક પાસે ખર્ચવા માટેની રકમ વધુ તેમ સમખર્ચ રેખાનું સ્થાન ઊંચું હોય છે.



આફુતિ મુજબ ઉત્પાદક ખર્ચ ₹. 1000 છે ત્યારે ABસમખર્ચ રેખા છે. ₹. 1500 છે ત્યારે A'B'સમખર્ચ રેખા છે. અને ₹. 1500 છે ત્યારે A''B''સમખર્ચ રેખા છે. જેમ ઉત્પાદકનું ખર્ચ વધુ તેમ સમખર્ચ રેખાનું સ્થાન ઊંચું.

- સમખર્ચરેખાનો ઢોળાવ :

જે ખર્ચનું પ્રમાણ સ્થિર હોય અને એક સાધનની કિંમતમાં ફેરફાર થાય તો તેની સમખર્ચ રેખાના ઢોળાવમાં ફેરફાર થાય છે.



ધારો કે ઉત્પાદક રૂ. 1000 ખર્ચ કરવા માગે છે મૂડી અને શરમની કિંમત અનુક્રમે રૂ. 10 અને રૂ. 5 છે ત્યારે ABસમખ્યા રેખા છે. જો શરમની કિંમત ઘટીને રૂ. 5 માંથી 4 રૂ. થાય તો શરમના 250 એકમ મેળવી શકે છે તેથી સમખ્યા AB' આવશે.

આમ AB રેખા કરતા AB' રેખાનો ફોળાવ ઓછો છે.

### 3.9 સ્વાધ્યાય :

મુદ્દાસર પ્રશ્નોના જવાબ આપો.

1. એકમ વિકાસ અથવા પેઢી વિકાસ અને ઉદ્યોગ વિકાસના લાભ અને ગેરલાભ જણાવો.
2. કદ મળતરનો નિયમ લખો.
3. દૂંકા અને લાંબાગાળાનું ઉત્પાદન વિધેય ખ્યાલ આપો.
4. બિનપ્રમાણસર સાધન સંયોજનનો નિયમ આકૃતિ સહિત સમજાવો.
5. સમઉત્પાદન રેખાનો અર્થ અને લક્ષણો દર્શાવો.
6. સમઉત્પાદન રેખાનો અર્થ, સ્થાન તથા ફોળાવ વિશે ખ્યાલ આપો.

● ટૂંકનોંધ લખો.

1. ઉત્પાદન વિધેયનો અર્થ તથા લક્ષણો દર્શાવો.
2. ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેય સમજાવો.
3. લાંબા ગાળાનું ઉત્પાદન વિધેય દર્શાવો.
4. સમખ્યાર્થી રેખા પર નોંધ લખો.
5. ઉદ્યોગ વિકાસના લાભ દર્શાવો.
6. ઉદ્યોગ વિકાસની ખામી દર્શાવો.
7. સમઉત્પાદન રેખા પર નોંધ લખો.
8. પેઢી વિકાસના લાભો દર્શાવો.

● બહુવિકલ્પ પ્રશ્નો :

1. સાધનો અને ઉત્પાદન વચ્ચેના ભૌતિક સંબંધને ટેક્નિકલ જાપામાં શું કહેવાય છે?
 

(a) ઉત્પાદન	(b) સાધન પ્રમાણ
(c) ઉત્પાદન વિધેય	(d) ભૌતિક સંબંધ
2. ઉત્પાદન વિધેય કેટલા પ્રકારનું છે?
 

(a) બે	(b) ત્રણ
(c) ચાર	(d) પાંચ
3. ટૂંકા ગાળામાં ઉત્પાદનના સાધનો કેવા હોય છે?
 

(a) અચ્યલ	(b) અસ્થિર
(c) સ્થિર	(d) ઉપરોક્ત કોઈ નહીં
4. કયા અર્થશાસ્ત્રીએ બિનપ્રમાણસર સાધનસંયોજનના નિયમની રજૂઆત કરી છે?
 

(a) એકમ સ્મિથ	(b) કેઈન્સ
(c) માર્શલ	(d) રોબિન્સ
5. બિનપ્રમાણસર સાધન સંયોજનનો નિયમ કયા ક્ષેત્ર સાથે જોડાયેલ છે?
 

(a) મત્સ્ય ઉદ્યોગ	(b) ઘેતી
(c) ખનન ઉદ્યોગ	(d) સેવાક્ષેત્ર
6. બિનપ્રમાણસર સાધન સંયોજનના નિયમમાં કયાં તબક્કે સીમાંત ઉત્પાદન નકારાત્મક બને છે?
 

(a) ચોથો તબક્કો	(b) બીજો તબક્કો
(c) પછેલો તબક્કો	(d) તૃજો તબક્કો

7. કદ વિકાસનાં મળતરનો નિયમમાં કેટલા વલણ જોવા મળે છે?

- (a) ગ્રાઝ  
(b) ચાર  
(c) પાંચ  
(d) છ

8. પેઢી વિકાસના કયા લાભ છે?

- (a) યાંત્રિક  
(b) નાણાકીય  
(c) વહીવટ  
(d) ઉપરોક્ત બધા

9. પેઢી વિકાસના કયા ગેરલાભ છે?

- (a) સંચાલનની સમસ્યા  
(b) સંકલનના પ્રશ્નો  
(c) વેચાણના પ્રશ્નો  
(d) ઉપરોક્ત બધા

10. ઉદ્યોગ વિકાસના લાભો કયા છે?

- (a) સ્થાનિયકરણ  
(b) સદાયક ઉદ્યોગો  
(c) સંશોધન  
(d) ઉપરોક્ત બધા

11. બે સાધનોનાં જુદાં જુદાં સંયોજનો વડે એકસરખું ઉત્પાદન વ્યક્ત કરતી રેખાને શું કહેવાય છે?

- (a) સમઉત્પાદન રેખા  
(b) ઉત્પાદન વિધેય  
(c) સમખ્ય રેખા  
(d) તટસ્થ રેખા

12. શ્રમનો ટેક્નિકલ સીમાંત અવેજ દર એટલે ?

- (a) મૂડીનાં પ્રમાણમાં ઘટાડો  
(b) શ્રમના પ્રમાણમાં વધારો  
(c) A અને B બન્ને  
(d) તટસ્થ રેખા

13. સમઉત્પાદન રેખા નીચેનામાંથી કયા લક્ષણો છે?

- (a) જમણી બાજુથી નીચે તરફ ફળતી  
(b) બહિગોળી છે  
(c) તે એકબીજાને છેદતી નથી  
(d) ઉપરોક્ત બધા

14. પેઢી તોણે નક્કી કરેલ ખર્ચવાપાત્ર રકમ દ્વારા ઉત્પાદનના બે સાધનોનાં કયા સંયોજનો ખરીદી શકે તે દર્શાવતી રેખા ?

- (a) સમઉત્પાદન  
(b) સીમાંત રેખા  
(c) સમખ્ય  
(d) સરેરાશ ઉત્પાદન રેખા

15. સમખ્ય રેખાના ફોળાવનો આધાર શેના પર રહેલો છે?

- (a) સાધનની કિંમત  
(b) સંચાલન  
(c) ઉત્પાદકની આવક  
(d) ઉપરોક્ત બધા

**ଓଡ଼ିଆ :**

1. (c)
2. (a)
3. (c)
4. (c)
5. (b)
6. (d)
7. (a)
8. (d)
9. (d)
10. (d)
11. (a)
12. (c)
13. (d)
14. (c)
15. (a)

## 4.1 ઉત્પાદનના ખર્ચના ઘ્યાલો

પ્રસ્તાવના :

ઉત્પાદન ખર્ચ એટલે વસ્તુના ઉત્પાદન માટે પેઢી દ્વારા કરવામાં આવતું ખર્ચ. ઉત્પાદક વસ્તુનું ઉત્પાદન કરતી વખતે કિંમતની સાથે- સાથે ઉત્પાદન ખર્ચને પણ ધ્યાનમાં લે છે. કિંમતની સાથે - સાથે ઉત્પાદન ખર્ચ પણ ઉત્પાદન કરવું કે નહિ, ઉત્પાદન કરવું તો કેટલું

કરવું, ઉત્પાદન વધારવું કે ઘટાડવું વગેરે બાબતોનાં નિષ્ઠયો લેવામાં માર્ગદર્શક નીવડે છે. પેઢીના ઉત્પાદન ખર્ચનાં ત્રણ પ્રકાર પાડી શકાય છે.

#### **4.1.1 વાસ્તવિક ખર્ચ :-**

વાસ્તવિક ખર્ચ નાણાના રૂપમાં વ્યક્ત કરવામાં આવતો નથી. આથી તેને બિનનાણાકીય ખર્ચ પડું કહી શકાય. વાસ્તવિક ખર્ચ એટલે વસ્તુનું ઉત્પાદન કરવા માટે સાધન માલિકોએ જે તકલીફો સહન કરવી પડે છે તે. ટૂંકમાં ઉત્પાદન પ્રક્રિયામાં જોડાયેલા નિયોજક, મજુરો અને મૂડી પતિઓ જે માનસિક અને શારીરિક કષ્ટ ભોગવે છે તથા ત્યાગ વગેરે તે વસ્તુના ઉત્પાદનનો વાસ્તવિક ખર્ચ છે.

- વાસ્તવિક ખર્ચનો ઘ્યાલ પરિશ્રમ, ત્યાગ, કષ્ટ કંટાળો જેવા માનસશાસ્ત્રીય શર્દૂદો દ્વારા સમજાવવામાં આવે છે તેથી તે આત્મલક્ષી અને સાપેક્ષ બની જાય છે.
- વાસ્તવિક ખર્ચ એક અનુભૂતિ છે તેથી તેને ચોક્કસાઈથી માપી શકાતો નથી.

#### **4.1.2 નાણાકીય ખર્ચ :-**

નાણાકીય ખર્ચ એટલે વસ્તુના ઉત્પાદન માટે કરવામાં આવતો નાણાના સ્વરૂપમાં ખર્ચ. નાણાકીય ખર્ચ વસ્તુના ઉત્પાદનમાં રોકાયેલા સાધનોને જે નાણાકીય વળતર આપવામાં આવે છે, ઉત્પાદનના સાધનોને તેમની સેવાઓના બદલામાં જે નાણાકીય ચૂકવણીઓ કરવામાં આવે છે, તેનો સરવાળો. નાણાકીય ખર્ચમાં જમીનનું ભાડું, શ્રમિકોનું વેતન, મૂડીનું વ્યાજ, યંત્રો, કાચો માલ વીજળી વગેરે તેમજ ઓક્ટ્રોય ખર્ચ, કરવેરા, વાહન વ્યવહાર ખર્ચ, વિમા પ્રિમિયમનો ખર્ચ, આહેરાત ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે.

- કુલ નાણાકીય ખર્ચ = હિસાબી ખર્ચ + આરોપિત અદૃશ્ય ખર્ચ ઉત્પાદક નફા-નુકસાનની ગણતરી કરવા માટે નાણાકીય ખર્ચના ઘ્યાલનો ઉપયોગ કરે છે.

#### **4.1.3 વૈકિલ્પક ખર્ચ :-**

વૈકિલ્પક ખર્ચ એટલે જતો કરવામાં આવેલો શ્રેષ્ઠ વિકિલ્પ. કોઈપણ વસ્તુના ઉત્પાદન માટે ઉત્પાદનના સાધનોને તેના વૈકિલ્પક ઉપયોગથી મળનારી આવક જાણવી જોઈએ. સાધન માટે આવકનો જે બીજો શ્રેષ્ઠ વિકિલ્પ હોય તો તેને વૈકિલ્પક ખર્ચ કહી શકાય.

- વૈકિલ્પક ખર્ચનો ઘ્યાલ તે મહાવની આર્થિક બાબત પર રચાયેલ છે.
- સાધનોનો પુરવઠો મર્યાદિત છે.
- ઉત્પાદનના સાધનો વૈકિલ્પક ઉપયોગો ધરાવે છે. દા.ત. જમીનનો ઉપયોગ તમાકુ, ચોખા, ઘંઉના ઉત્પાદન માટે કરી શકાય છે.

## 4.2 સમયગાળાના આધારે ખર્ચના ઘ્યાલ

- સમયગાળાના મુખ્ય પ્રકારો:- (A) ટૂંકો ગાળો  
(B) લાંબો ગાળો

ટૂંકો ગાળો એટલે એવો સમય કે જે સમય દરમિયાન પેઢીના કદમાં વધારો કે ઘટાડો થઈ શકતો નથી. ટૂંકા ગાળા દરમિયાન પેઢીના કેટલાક સાધનો સ્થિર હોય છે. જેમકે; ખાન્ટ અને યંત્ર સામગ્રીમાંથી ટૂંકા ગાળામાં ઉત્પાદન વધારવું હોય તો અસ્થિર સાધનોનું પ્રમાણ વધારીને જ ઉત્પાદન વધારી શકાય છે. ઉત્પાદન ઘટાડવું હોય તો અસ્થિર સાધનોનું પ્રમાણ ઘટાડી નાંખવામાં આવે છે. જેમકે; શ્રમ, કાચો માલ, વીજળી, બળતાણ વગેરેનું પ્રમાણ વધારી કે ઘટાડીને ઉત્પાદનમાં વધારો- ઘટાડો કરી શકાય છે. આમ; ટૂંકા ગાળામાં પુરવઠો થોડા પ્રમાણમાં વધારી કે ઘટાડી શકાય છે.

### (1) કુલ સ્થિર ખર્ચ:- (Total Fixed Cost)


સ્થિર ખર્ચને પૂરક ખર્ચ અથવા સામાન્ય ખર્ચ પણ કહેવામાં આવે છે. ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે છતાં જે ખર્ચમાં ફેરફાર થતો નથી પણ સ્થિર રહે છે તેને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે.

- કુલ સ્થિર ખર્ચમાં જમીનનું ભાડું, કારખાનાના મકાનનું ભાડું, મૂડીનું વ્યાજ, કાયમી સ્ટાફનું વેતન, વીમા પ્રીમિયમ, યંત્રોના ઘસારા ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે.
- ટૂંકમાં જે ખર્ચ ઉત્પાદનમાં વધારાની થવા છતાં બદલાતું નથી તે ખર્ચ સ્થિર ખર્ચ-પૂરક ખર્ચ કે સામાન્ય ખર્ચ કહી શકાય.

કુલ સ્થિર ખર્ચની અનુસૂચિ અને આકૃતિમાં રજૂઆત.

કુલ ઉત્પાદન	કુલ સ્થિર ખર્ચ
એકમો	(રૂ. મા)
0	100
1	100
2	100
3	100
4	100
5	100

### આકૃતિ



ઉપરોક્ત કુલ સ્થિર ખર્ચની અનુસૂચિ અને આકૃતિ મુજબ ઉત્પાદન શૂન્ય હોય.

વધે કે ઘટે પરંતુ સ્થિર ખર્ચ રેખા OXને સમાંતર છે. જે દરાવે છે કે, કુલ સ્થિર ખર્ચ રૂ. 100/- ની સપાઠીએ જળવાઈ રહે છે.


### (2) કુલ અસ્થિર ખર્ચ :- (Total Variable Cost)

જે ખર્ચ ઉત્પાદનના વધારા કે ઘટાડા સાથે પરિવર્તન પામે છે તે ખર્ચને અસ્થિર ખર્ચ કે મુખ્ય ખર્ચ કહેવામાં આવે છે. આ ખર્ચ અસ્થિર એ અર્થમાં કહેવામાં આવે છે કે; ઉત્પાદનના પ્રમાણ સાથે વધ્યટ પામે છે. ઉત્પાદિત વસ્તુ તેની સાથે પ્રત્યક્ષ સંબંધ ધરાવે છે. જો અસ્થિર ખર્ચમાં મજુરોને વેતન, કાચો માલ, વીજળી, બળતણ, વાહન વ્યવહાર વગેરેના વધ્યટ સાથે ફેરફાર થાય છે. ઉત્પાદન શૂન્ય હોય તો તે ખર્ચ શૂન્ય હોય છે. ઉત્પાદન વધે તો તે વધે અને ઉત્પાદન ઘટે તો તે ઘટે છે. ઉત્પાદનનું પ્રમાણ અને કુલ અસ્થિર ખર્ચ વચ્ચેનો સંબંધ અનુસૂચિમાં જોઈ શકાય છે.

- કુલ અસ્થિર ખર્ચની અનુસૂચિ અને આકૃતિમાં રજૂઆત :-

કુલ ઉત્પાદન (એકમો)	કુલ અસ્થિર ખર્ચ (રૂ. માં)
0	0
1	90
2	170
3	240
4	300
5	370

### આકૃતિ



- ઉપરની અનુસૂચિ મુજબ ઉત્પાદન શૂન્ય હોય તો કુલ અસ્થિર ખર્ચ શૂન્ય હોય છે. ઉત્પાદનમાં જેમ વધારો થાય છે તેમ કુલ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે.
- આકૃતિ મુજબ કુલ અસ્થિર ખર્ચની રેખા ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જાય છે અથડત્ત તેનો ઢાળ ધન છે ઉત્પાદન વધતાં કુલ અસ્થિર ખર્ચ વધે છે.

### 3. કુલ ખર્ચ :- (Total Cost)


ઉત્પાદનની પ્રત્યેક સપાટીએ કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચના સરવાળાને કુલ ખર્ચ કહેવામાં આવે છે.

$$\text{કુલ ખર્ચ} = \text{કુલ સ્થિર ખર્ચ} + \text{કુલ અસ્થિર ખર્ચ}$$

- ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ યથાવત હોય છે. પરંતુ જેમ ઉત્પાદન વધે તેમ જે દરે કુલ અસ્થિર ખર્ચ વધે છે તે દરે કુલ ખર્ચમાં વધારો થાય છે.

કુલ ખર્ચની અનુસૂચિ અને આકૃતિમાં રજુઆત.

કુલ ઉત્પાદન	કુલ ખર્ચ
એકમોમાં	રૂપિયામાં
0	100
1	190
2	270
3	340
4	400
5	570




- કુલ ખર્ચની રેખા અને અસ્થિર ખર્ચની રેખા (TVC) પરસ્પર સમાંતર છે. જ્યારે OX ધરીને સમાંતર રેખા એટલે કે સ્થિર ખર્ચની રેખા (TFC) છે.

#### 4. સરેરાશ સ્થિર ખર્ચ :- (Average Fixed Cost)

સરેરાશ સ્થિર ખર્ચ એટલે કે એકમદાર સ્થિર ખર્ચ. કુલ સ્થિર ખર્ચને ઉત્પાદન એકમો વડે ભાગવાથી સરેરાશ સ્થિર ખર્ચ પ્રાપ્ત થાય છે. સરેરાશ સ્થિર ખર્ચ = કુલ સ્થિર ખર્ચ  $\div$  કુલ ઉત્પાદન.

ઉત્પાદનમાં વધારો થવાથી સરેરાશ સ્થિર ખર્ચમાં ઘટાડો થાય છે. ઉત્પાદન અને સરેરાશ સ્થિર ખર્ચ વચ્ચેનો વ્યસ્ત સંબંધ નીચેની અનુસૂચિમાં દર્શાવ્યો છે.

કુલ ઉત્પાદન	કુલ સ્થિર ખર્ચ	સરેરાશ સ્થિર ખર્ચ
એકમો	રૂ.	રૂ.
0	100	--
1	100	100.100
2	100	50.00
3	100	33.33
4	100	25.00
5	100	20.60



આક්ઝිතමાં ઉત્પાદન અને સરેરાશ સ્થિર ખર્ચ વચ્ચેનો વ્યસ્ત સંબંધ સમજાવ્યો છે.  
સરેરાશ સ્થિર ખર્ચ રેખાનો જગ્ઘા ટાળ સૂચવે છે કે જેમ ઉત્પાદન વધે છે તેમ સરેરાશ સ્થિર ખર્ચ ઘટે છે.

### (5) સરેરાશ અસ્થિર ખર્ચ :- (Average Variable Cost)


કુલ અસ્થિર ખર્ચ કુલ ઉત્પાદન વડે ભાગવાથી સરેરાશ અસ્થિર ખર્ચ મેળવવામાં આવે છે. “સરેરાશ અસ્થિર ખર્ચ એટલે એકમ દીઠ અસ્થિર ખર્ચ”

$$\text{સરેરાશ અસ્થિર ખર્ચ} = \frac{\text{કુલ અસ્થિર ખર્ચ}}{\text{ઉત્પાદન}}$$

કુલ ઉત્પાદન વધે તેમ કુલ અસ્થિર ખર્ચ વધે છે. પરંતુ શરૂઆતમાં ઉત્પાદન વધે તેમ સરેરાશ અસ્થિર ખર્ચ ઘટે છે. પરંતુ અમુક બિંદુ પદ્ધી અસ્થિર ખર્ચની સરખામણીમાં કુલ ઉત્પાદનમાં ઓછા વધારો થાય છે. ઉત્પાદન અને સરેરાશ અસ્થિર ખર્ચ વચ્ચેનો સંબંધ નીચેની અનુસૂચિમાં દર્શાવ્યો છે.

કુલ ઉત્પાદન એકમો	કુલ સ્થિર ખર્ચ (રૂ.)	સરેરાશ સ્થિર ખર્ચ (રૂ.)
0	0	--
1	90	90.00
2	170	85.00
3	240	80.00
4	300	75.00

5	370	74.00
6	450	75.00
7	540	77.14



સરેરાશ અસ્થિર ખર્ચ વસ્તુના પાંચમાં એકમ સુધી ઉત્પાદનના વધારા સાથે સરેરાશ અસ્થિર ખર્ચ ઘટે છે. પાંચમાં એકમમાં સરેરાશ અસ્થિર ખર્ચ લધુતમ સપાઠીએ છે. તથા પાંચમાં એકમ પછી ઉત્પાદનના વધારા સાથે સરેરાશ અસ્થિર ખર્ચ વધે છે. સરેરાશ અસ્થિર ખર્ચ રેખા અંગ્રેજી અક્ષર U આકારની છે. પાંચમાં એકમ સુધી સરેરાશ અસ્થિર ખર્ચ ઉત્પાદન વૃદ્ધિ સાથે ઘટે છે અને પછી તે વધે છે.

#### (6) સરેરાશ ખર્ચ :-


સરેરાશ ખર્ચને સરેરાશ કુલ ખર્ચ પણ કહેવામાં આવે છે. કુલ ખર્ચને ઉત્પાદનના કુલ એકમો વડે ભાગવાથી સરેરાશ કુલ ખર્ચ પ્રાપ્ત થાય છે. પરંતુ કુલ ખર્ચ એ કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો છે.

$$\text{સરેરાશ ખર્ચ} = \frac{\text{કુલ ખર્ચ}}{\text{ઉત્પાદન}}$$

- ઉત્પાદન વૃદ્ધિ સાથે સરેરાશ ખર્ચ શરૂઆતમાં ઘટતો જાય છે. પણ અમુક બિંદુ પછી ને વધે છે.

અનુસૂચિ.

કુલ ઉત્પાદન એકમો	સરેરાશ ખર્ચ રૂ.
1	190.00
2	135.00
3	113.33
4	100.00
5	94.00
6	91.00
7	91.43
8	93.73
9	97.78




- આકૃતિ અને અનુસૂચિ મુજબ ઉત્પાદન વધે તેમ સાતમા એકમ સુધી સરેરાશ ખર્ચ ઘટે છે. સાતમા એકમ પછી ઉત્પાદન વધારા સાથે સરેરાશ ખર્ચમાં વધારો થાય છે. સરેરાશ ખર્ચની રેખા અંગ્રેજી અક્ષર U આકારની છે. સરેરાશ ખર્ચની રેખા સાતમા એકમ સુધી ઝડપ ફળની અને ત્યારબાદ ધન ફળવાળી બને છે.

## (7) સીમાંત ખર્ચ :- Marginal Cost

વસ્તુના ઉત્પાદનમાં એક એકમનો વધારો - ઘટાડો કરતાં કુલ ખર્ચમાં જે ફેરફાર થાય તેને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. ટૂંકમાં વસ્તુના વધારાનું એક એકમ ઉત્પન્ન કરતાં કુલ ખર્ચમાં થતો વધારો એ સીમાંત ખર્ચ છે. ટૂંકાગાળામાં વધારાના એક એકમનું ઉત્પાદન કરતાં વધારાનો જે ખર્ચ થાય છે તે અસ્થિર સાધનોના ખર્ચ. આમ સીમાંત ખર્ચ એ વધારાના એક એકમના ઉત્પાદનને લીધે કુલ અસ્થિર ખર્ચનો વધારો દર્શાવે છે. એટલે કે કુલ ખર્ચનો વધારો = કુલ અસ્થિર ખર્ચનો વધારો ઉત્પાદન અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ નીચેની અનુસૂચિ મુજબ દર્શાવી શકાય.

કુલ ઉત્પાદન એકમો	કુલ (રૂપિયા)	સીમાંત ખર્ચ (રૂ.)
0	100	--
1	190	90
2	270	80
3	340	70
4	400	60
5	470	70



- આકૃતિ અને અનુસૂચિ મુજબ ચોથા એકમ સુધી સીમાંત ખર્ચ ઘટે છે ચોથા એકમ પછી સીમાંત ખર્ચ વધે છે. સીમાંત ખર્ચ રેખા અંગ્રેજ અક્ષર U આકારની છે. ચોથા એકમ સુધી ઝણા ફાળવાણી અને ત્યાર પછી ધન ફાળવાણી સીમાંત ખર્ચ રેખા થાય છે.

#### 4.3 સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ વચ્ચે સંબંધ :-


સરેરાશ ખર્ચ એટલે વસ્તુનું એકમ દીઠ ખર્ચ.

$$\text{સરેરાશ ખર્ચ} = \text{કુલ ખર્ચ}$$

-----  
કુલ ઉત્પાદન

$$\text{Average cost} = \frac{\text{Total Cost}}{\text{Number of Units}}$$

- વસ્તુનો એક વધુ કે ઓછો એકમ ઉત્પાદન કરતાં કુલ ખર્ચમાં જે વધણ થાય તેને સીમાંત ખર્ચ કહે છે.



- જ્યારે સરેરાશ ખર્ચ ઘટે છે ત્યારે સીમાંત ખર્ચ પણ ઘટે છે અહીં સીમાંત ખર્ચ સરેરાશ ખર્ચ કરતાં ઓછો હોવાથી એની રેખા સરેરાશ ખર્ચની નીચે રહે છે.
- જ્યારે સરેરાશ ખર્ચ વધે છે. ત્યારે સીમાંત ખર્ચ પણ વધે છે. પરંતુ સીમાંત ખર્ચની રેખા ઉપર છે. કારણ કે અહીં સીમાંત ખર્ચ કરતાં સરેરાશ ખર્ચ વધુ છે.
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સરેરાશ ખર્ચ લધુતમ થયા પછી જ તેમાં વધારો થાય છે. આથી સીમાંત ખર્ચ રેખા સરેરાશ ખર્ચ રેખાને દેંક નીચેલા બિંદુએ ઓછામાં ઓછા બિંદુએ કાપે છે. આમ, જ્યારે સરેરાશ ખર્ચ લધુતમ હોય છે ત્યારે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ સરખા થાય છે.

### **મહત્વ :-**


જ્યારે સમયના લાંબા ગાળામાં જેટલા પ્રમાણમાં માંગ વધે કે ઘટે તેટલા પ્રમાણમાં પુરવઠો વધારી કે ઘટાડી શકાય છે. લાંબાગાળે પુરવઠો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ બને છે. સ્થિર અને અસ્થિર ખર્ચનો ભેદ માત્ર ટૂંકા ગાળા પૂરતો જ હોય છે. લાંબાગાળે બધું જ ખર્ચ અસ્થિર બની જાય છે. આમ સમયના લાંબાગાળામાં પેઢીના કદમાં વધવટ થઈ શકે છે.

- લાંબાગાળે ઉત્પાદન ચાલુ રાખવું કે નાહિ તે અંગેનો નિષ્ણય લેવામાં સરેરાશ ખર્ચનો ખ્યાલ ઉપયોગી નીકળે છે.
- જ્યારે લાંબાગાળે તમામ સરેરાશ ખર્ચ અથર્ત સરેરાશ કુલ ખર્ચ (સરેરાશ સ્થિર ખર્ચ કે અસ્થિર ખર્ચ) નીકળી રહે તેટલી બાજર કિંમત નક્કી થાય તો જ ઉત્પાદક ચાલુ ઉત્પાદન બંધ કરી દેશે અને લાંબાગાળે નક્કી થતી કિંમતથી સરેરાશ કુલ ખર્ચ ન નીકળે તો પણ ઉત્પાદન બંધ કરી દેવામાં આવશે.
- જ્યાં સુધી સીમાંત ખર્ચ સીમાંત આવક હોય તો ત્યાં સુધી ઉત્પાદક ઉત્પાદન ચાલુ રાખશે. આમ સીમાંત ખર્ચ ખ્યાલની મદદથી ઉત્પાદકે કેટલું ઉત્પાદન કરવું તે નક્કી થાય છે.

### **4.4 લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા :- (Long Run Average Cost) LAC**

લાંબાગાળે બધા સાધનો પરિવર્તનશીલ હોય છે તેથી ખાન્ટ અને યંત્ર સામગ્રીમાં વધારો-ઘટાડો કરી શકાય છે.

- પ્રો. બેન્ચામ મુજબ - “ લાંબાગાળે બધા જ ખર્ચ અસ્થિર હોય છે ” કારણ કે ઉત્પાદન વધારવા માટે બધા સાધનોનું પ્રમાણ વધારવામાં આવે છે તેથી પેઢીનું કદ વિસ્તાર પામે છે.



- લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા ટૂંકાગાળાની સરેરાશ ખર્ચ રેખા પરથી મેળવવામાં આવે છે. જુદા-જુદા ટૂંકાગાળાની સરેરાશ ખર્ચ રેખા પરનાં તે બિંદુઓ શોધી કાઢવા જોઈએ, જે પેઢી દ્વારા પસંદ કરવામાં આવ્યા છે.
- આ બિંદુઓને જોડીને લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા મેળવી શકાય છે. ઉત્પાદન વૃદ્ધિ સાથે શરૂઆતમાં લાંબાગાળાનું સરેરાશ ખર્ચ ઘટે છે. અમુક બિંદુ પદ્ધી તે વધવા માંડે છે. આકૃતિમાં B બિંદુ પદ્ધી લાંબાગાળાનો સરેરાશ ખર્ચ લધુતમ છે. B બિંદુની ડાબી બાજુએ સરેરાશ ખર્ચ રેખા ઋણ ફાળવાળી છે.
- B બિંદુની જમણી બાજુ ધન ફળ છે આ લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખાને “આવરણ રેખા” કું “આયોજન રેખા” પણ કહેવામાં આવે છે.
- તેનો આકાર ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચ રેખાની જેમ યુ (U) આકારનો છે.
- શરૂઆતમાં LAC રેખા ધીમી ગતિએ ઘટે છે. અને લધુતમ બિંદુ પદ્ધી કમશા: ધીમી ગતિએ વધે છે.
- લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા ટૂંકાગાળાની સરેરાશ ખર્ચ રેખાને માત્ર સ્પર્શ છે, કદી છેદતી નથી.
- તે ટૂંકાગાળાની સરેરાશ ખર્ચ રેખાને લધુતમ બિંદુએ સ્પર્શ છે.

#### **4.5 પુરવઠાનો નિયમ :-**

વસ્તુનો પુરવઠો હંમેશા તેની પ્રવર્તમાન કિંમતના સંદર્ભમાં નક્કી થાય છે.

- પ્રો. માર્શલ મુજબ.

“ જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત અને તેના પુરવઠા વચ્ચે સમ સંબંધ છે. એટલે કે વસ્તુની કિંમત વધતાં તેનો પુરવઠો વિસ્તરણ પામે છે. અને વસ્તુની કિંમત ઘટતાં તેનો પુરવઠો સંકોચાય છે.

- આમ વસ્તુની કિંમતમાં ફેરફાર એ કારણ છે અને વસ્તુના પુરવઠામાં ફેરફાર એ અસર છે. કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે.


##### **4.5.1 પુરવઠા નિયમની ધારણા :-**

- કિંમત અને પુરવઠા વચ્ચે કારણ અને પરિણામ વચ્ચેનો સંબંધ સ્થાપિત કરતી વખતે કેટલીક બાબતો સ્થિર ધારી લેવામાં આવે છે.
- ઉત્પાદન ખર્ચ સ્થિર રહેવું જોઈએ.
- અવેજ વસ્તુઓની કિંમત સ્થિર રહેવી જોઈએ.
- ભવિષ્યમાં ભાવો અંગેની અટકળો સ્થિર રહેવી જોઈએ.
- કરવેરાનું પ્રમાણ સ્થિર ધારવામાં આવ્યું છે.
- અર્થતંત્રમાં હુઝાર, અતિવૃદ્ધિ, ધરતીકંપ જેવી કુદરતી ઘટનાઓની ગેરહાજરી તેવું ધારવામાં આવે છે.
- અવેજ વસ્તુઓની શોધખોળનો અભાવ હોવો જોઈએ.

##### **પુરવઠાની અનુસૂચિ :-**

વસ્તુની જુદી-જુદી કિંમતે અમુક નિયત સમયે બજારમાં વસ્તુનો કેટલો પુરવઠો આવશે તે પુરવઠાની અનુસૂચિ દર્શાવે છે. ધારો કે X વસ્તુનો પુરવઠો નીચે મુજબ છે.

વસ્તુની કિંમત રૂ.	પુરવઠો (એકમમાં)
1	100
2	200
3	300
4	400
5	500



X વસ્તુનો પુરવઠો

- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણો OX રેખા પર X વસ્તુનો પુરવઠો અને OY ઉભી ધરી પર X વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવી છે. SS રેખા પુરવઠા રેખા છે જેના પરનું દરેક બિંદુ (A,B,C,D અને E) નિયત કિંમતે વસ્તુનો પુરવઠો કેટલો હશે તે દર્શાવે છે. SS પુરવઠા રેખા ડાબી બાજુથી જમણી બાજુ એમ નીચેથી ઉપર તરફ જાય છે.
- પુરવઠા રેખાનો (SS) ગાળ ધન છે.
- વસ્તુની કિંમત જે-મ-જે-મ વધતી જાય છે તેમ તેમ X વસ્તુનો પુરવઠો પણ વધે છે. અને વસ્તુની કિંમતમાં જે-મ જે-મ ઘટાડો થાય છે તેમ - તેમ પુરવઠો પણ ઘટાડો જાય છે.

#### 4.5.2 નિયમના અપવાદો :-

- કેટલીક અલાભ્ય વસ્તુઓની કિંમતમાં ગમે તેટલો ફેરફાર કરવામાં આવે છતાં તેના પુરવઠામાં કોઈ ફરેફાર થતો નથી. દા.ત. હીરા, માણેક, સિક્કા, મૃત ચિત્રકારોના હાથ ચિત્રો, મૂર્તિઓ હસ્તપતો વગેરેની કિંમતમાં ગમે તેટલો વધારો થાય તેના પુરવઠામાં વધારો કરી શકતો નથી.


- કેટલીકવાર અનાજની કિંમતો વધતાં અનાજનો પુરવઠો ઘટી જાય છે. તેના કારણમાં અનાજની કિંમતો વધતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરે છે તેથી તે ઓછું કામ અને વધુ આરામ કરવા પ્રેરાશે.
- જ્યારે શ્રમિકોના વેતન વધે છે ત્યારે તે વધુ કામ કરવા પ્રેરાય છે. પરંતુ એક હં પદ્ધી વેતન વધતાં શ્રમિક વધુ કામ કરવાને બદલે ઓછા સમય કામ કરવાનું પસંદ કરે છે. આમ વેતન દર વધવા છતાં પણ શ્રમનો પુરવઠો વધતો નથી.
- બાજરમાં વસ્તુની કિંમત ઘટી હોય અને અફવા ફેલાય કે કિંમત વધુ ઘટવાની છે તો વિકેતા ભવિષ્યમાં વધુ નીચી કિંમતે વસ્તુ વેચવી ન પડે અને ખોટ સહન ન કરવી પડે તે માટે ઘટતી કિંમતે વધુ પુરવઠો વેચવા કાઢે છે.
- જાહેર હરાળમાં જ્યારે બ્યક્ટિ પોતાના કપરા સંઝેગોમાં નાણાંની જરૂરિયાત પહોંચી વળવા પોતાની વસ્તુની હરાળ કરે છે. આમ; આવા સમયે જેમ કિંમત ઉંચી તેમ હરાળ માટે પોતાની વસ્તુઓનો પુરવઠો વધારી શકતો નથી.
- કેટલીક વસ્તુઓનો પુરવઠો ટૂંકા ગાળામાં સ્થિર હોય છે. દા.ત. શાકભાળુ, ફળ, દૂધ, મકાન, યંત્રો આમ; આવી વસ્તુની કિંમતમાં ફેરફાર થતા પુરવઠો વધારી કે ઘટાડી શકતો નથી.

#### **4.5.3 પુરવઠામાં ફેરફાર :-**

##### **1) કિંમત પ્રેરિત પરિવર્તનો.**

- પુરવઠામાં વિસ્તરણ :-
- જ્યારે અન્ય પરિબળો સ્થિર રહે પરંતુ વસ્તુની કિંમતમાં વધારો થતાં પુરવઠામાં જે વૃદ્ધિ થાય ત્યારે તેને પુરવઠામાં વિસ્તરણ કરે છે.
- પુરવઠામાં સંકોચન :-

પરંતુ વસ્તુની કિંમતમાં ઘટાડો થતાં પુરવઠામાં જે ઘટાડો થાય છે તેને પુરવઠાનું સંકોચન કરેવામાં આવે છે.




- OX રેખા પર વસ્તુનો પુરવઠો, OY પર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવી છે.
- SS પુરવઠા રેખા છે.
- વસ્તુની કિંમત 2 છે ત્યારે 20 એકમોનો પુરવઠો છે.
- હવે કિંમત વધીને 3 રૂપિયા થઈ પુરવઠો વધીને 30 એકમ થાય છે તેને પુરવઠાનું વિસ્તરણ કરે છે.
- જ્યારે કિંમત ઘટીને 1 રૂપિયો થાયે ત્યારે પુરવઠો ઘટીને 10 એકમ થાય છે, તેને પુરવઠાનું સંકોચન કરે છે.

## 2) કિંમત સિવાયનાં પરિબળોમાં પરિવર્તનો :-

- પુરવઠામાં વધારો-ઘટાડો

કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં જ્યારે વસ્તુની કિંમત સ્થિર રહે અને અન્ય પરિબળોમાં પરિવર્તન આવે જેને લીધે પુરવઠામાં પહેલાની સ્થિતિની સરખામણીમાં વધારો કે ઘટાડો થાય છે. તેને પુરવઠામાં વધારો-ઘટાડો કહેવાય. દા.ત., વસ્તુના ઉત્પાદનની પ્રથામાં પરિવર્તન આવે, વિક્તાની સંખ્યા વધે, અથવા ભવિષ્યમાં ભાવો કે કિંમતો વધશે તે અટકડ થવાથી પુરવઠો વધે છે. અને જ્યારે ઉત્પાદન પ્રથામાં મુશ્કેલી આવે, સાધનોના ભાવ વધે, વિક્તાની સંખ્યા ઘટે ત્યારે પુરવઠામાં ઘટાડો થાય છે.



વસ્તુના એકમો

- આકૃતિ મુજબ મૂળ પુરવઠા રેખા 2 છે ત્યારે 3 રૂપિયાની કિંમતે 20 વસ્તુના એકમોનો પુરવઠો છે.
- વસ્તુની કિંમત 3 રૂપિયા સ્થિર છે ત્યારે અન્ય પરિબળોમાં ફેરફાર થવાથી વસ્તુનો પુરવઠો વધીને 30 એકમ થાય છે, તેને પુરવઠામાં વધારો કહે છે. અહીં પુરવઠા રેખા જમણીબાજુ ખસે છે.
- તેજ સ્થિર કિંમતે પુરવઠા રેખા ડાબી બાજુએ ખસે ત્યારે જે પુરવઠા રેખા - 1 છે તે 10 એકમોનો પુરવઠો દર્શાવે છે, જે પુરવઠામાં ઘટાડો કહેવાય છે.
- પુરવઠાને અસર કરતાં પરિબળો :-
- કિંમતમાં ફેરફાર થવાથી પુરવઠાનું વિસ્તારણ સંકોચન થાય છે.
- અન્ય પરિબળોમાં ફેરફાર થતા વસ્તુના પુરવઠામાં વૃદ્ધિ કે ખોટ આવે તો તેને પુરવઠાનો વધારો - ઘટાડો કહેવામાં આવે છે.
- અન્ય વસ્તુની કિંમત પણ પુરવઠાને અસર કરે છે. દા.ત. ચાની કિંમત સ્થિર રહે, પરંતુ કોઝીની કિંમત વધતાં ચાનો પુરવઠો ઘટશે અને કોઝીનો વધશે.
- આ ઉપરાંત ઉત્પાદન પ્રથા, સાધનોના ભાવ, વાહન વ્યવહારનો વિકાસ, ભવિષ્યનાં ભાવો અંગેના અંદાજો, પેઢીઓની સંખ્યા અને રાજકીય પરિસ્થિતિ પુરવઠાને અસર કરે છે.

## 4.6 પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા :-

માંગની મૂલ્ય સાપેક્ષતાની જેમ પુરવઠાની ટકાવારી ફેરફાર અને કિંમતના ટકાવારી ફેરફાર વચ્ચેનો ગણોત્તર છે. કિંમતમાં અમૂક ફેરફાર થવાથી વસ્તુના પુરવઠામાં કેટલા પ્રમાણમાં ફેરફાર થશે તે પુરવઠાની મૂલ્યસાપેક્ષતાના ઘ્યાલથી સમજી શકાય.

### 4.6.1 પુરવઠાની મૂલ્યસાપેક્ષતાનો અર્થ :-

વસ્તુની કિંમતમાં થતાં ફેરફારના પ્રત્યાખાત રૂપે તે વસ્તુના પુરવઠામાં થતાં ફેરફારનાં દરતું માપ એટલે પુરવઠાની મૂલ્યસાપેક્ષતા.

$$\text{પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા} = \frac{\text{કિંમતમાં થતો ટકાવારી ફેરફાર}}{\text{પુરવઠામાં થતો ટકાવારી ફેરફાર}}$$

$$\frac{\text{પુરવઠા ફેરફાર}}{\text{કિંમત}} = \frac{\text{મૂળ કિંમત}}{\text{મૂળ પુરવઠો}}$$

સૂત્રને ગાણિતિક સંઝામાં મૂકીએ તો

$$es = \frac{\Delta S}{S} \times \frac{P}{\Delta P}$$

$$\Delta (\text{રૂલ}) = \text{ફેરફાર}, \quad es = \text{પુરવઠાની મૂલ્ય}$$

સાપેક્ષતા

$$S = \text{પુરવઠો} \quad P = \text{કિંમત}$$

- પુરવઠાની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો :-

(1) સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ પુરવઠો:-

એટલે કે; એવો પુરવઠો કે વસ્તુની કિંમતમાં થોડોક ફેરફાર થવાથી વસ્તુના પુરવઠામાં અમાપ પ્રમાણમાં ફેરફાર થતો હોય.

(2) સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ પુરવઠો:-

એવો પુરવઠો કે વસ્તુની કિંમતમાં ગમે તેટલાં પ્રમાણમાં ફેરફાર થવા છતાં તે વસ્તુના પુરવઠામાં જરા પણ ફેરફાર થતો નથી.

(3) એકમ મૂલ્ય સાપેક્ષ પુરવઠો:-

એવો પુરવઠો કે વસ્તુની કિંમતમાં જેટલાં પ્રમાણમાં ટકાવારી ફેરફાર થાય તેટલો જ ટકાવારી ફેરફાર તે જ દિશામાં પુરવઠામાં પણ થાય છે.

(4) મૂલ્ય સાપેક્ષ પુરવઠો :-

એવો પુરવઠો કે વસ્તુની કિંમતમાં જેટલાં ટકા ફેરફાર થાય તેના કરતાં તે વસ્તુના પુરવઠામાં વધારે પ્રમાણમાં ટકાવારી ફેરફાર બે દિશામાં થતો હોય છે.

(5) મૂલ્ય અનપેક્ષ પુરવઠો :-

એવો પુરવઠો કે જેમાં વસ્તુની કિંમતમાં જેટલાં પ્રમાણમાં ટકાવારી ફેરફાર થાય તેના કરતાં તે વસ્તુના પુરવઠામાં ઓછા ટકાવારી પ્રમાણમાં તે દિશામાં ફેરફાર થતાં હોય.

---

## 4.7 સ્વાધ્યાય

---

● મુદ્દાસર પ્રશ્નોના ઉત્તર લખો

- (1) ટૂંકા ગાળાના ખર્ચના ઘ્યાલો સમજાવો.
- (2) સરેરાશ અને સીમાંત ખર્ચના ઘ્યાલ સમજાવો તથા બંને વચ્ચેનો સંબંધ આકૃતિ સહિત દર્શાવો.
- (3) ઉત્પાદનના ખર્ચના ઘ્યાલો જેવા કે વાસ્તવિક ખર્ચ, નાણાકીય ખર્ચ અને વૈકલ્પિક ખર્ચ સમજાવો.
- (4) સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચના ઘ્યાલ આકૃતિ સહિત સમજાવો.
- (5) પુરવઠાનો નિયમ તથા પુરવઠાની મૂલ્ય સાપેક્ષતાની ચર્ચા કરો.
- (6) પુરવઠામાં વિસ્તારણ - સંકોચન અને પુરવઠામાં વધારો- ઘટાડો આકૃતિ દ્વારા સમજાવો.

● ટૂંકા પ્રશ્નોના જવાબ આપો

- (1) વૈકલ્પિક ખર્ચ અને નાણાકીય ખર્ચ વિશે નોંધ લખો.
- (2) પુરવઠાની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ અને પ્રકાર લખો.
- (3) સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ પર નોંધ લખો.
- (4) સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ સમજાવો.

- (5) સરેરાશ ખર્ચ સમજવો.  
 (6) સીમાંત ખર્ચ પર નોંધ લખો.  
 (7) પુરવઠાનો નિયમ આકૃતિ સહિત સમજવો.  
 (8) પુરવઠામાં વિસ્તરણ - સંકોચન દર્શાવો.  
 (9) પુરવઠામાં ઘટાડો - વધારો પર નોંધ લખો.  
 (10) લાંબા ગાળાના સરેરાશ ખર્ચ રેખાનો ઘ્યાલ આપો.

● બહુવિકલ્પ પ્રશ્નો.

- (1) ઉત્પાદન કરતી વખતે કિંમતની સાથે - સાથે કઈ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે છે ?  
 (A) ઉત્પાદન ખર્ચ (B) ઈજારો  
 (C) માંગ રેખા (D) સરકારની નીતિ
- (2) વાસ્તવિક ખર્ચના લક્ષણો ક્યા છે ?  
 (A) અનુભૂતિ (B) લાગણી  
 (C) માપી શકતો નથી (D) ઉપરોક્ત બધા
- (3) વસ્તુના ઉત્પાદન માટે કરવામાં આવતું નાણાનાં સ્વરૂપમાં ખર્ચ ----- ?  
 (A) વાસ્તવિક ખર્ચ (B) નાણાકીય ખર્ચ  
 (C) ગર્ભિત ખર્ચ (D) ઉપરોક્ત બધા
- (4) કુલ નાણાકીય ખર્ચમાં કોનો સમાવેશ થાય છે ?  
 (A) હિસાબી ખર્ચ (B) આરોપિત ખર્ચ  
 (C) (એ) અને (બી) બંને (D) ઉપરોક્ત કોઈ નહીં.
- (5) જતો કરવામાં આવતો શ્રેષ્ઠ વિકલ્પ એટલે ----- ?  
 (A) વાસ્તવિક ખર્ચ (B) નાણાકીય ખર્ચ  
 (C) વૈકલ્પિક ખર્ચ (D) ઉપરોક્ત બધા
- (6) કુંકા ગાળાના ખર્ચ ક્યા છે ?  
 (A) સ્થિર ખર્ચ (B) અસ્થિર ખર્ચ  
 (C) કુલ ખર્ચ (D) ઉપરોક્ત બધા
- (7) સ્થિર ખર્ચનું બીજુ નામ ક્યું છે ?  
 (A) પૂરક ખર્ચ (B) (A) અને (C) બંને  
 (C) સામાન્ય ખર્ચ (D) ઉપરોક્ત કોઈ નહીં.

- (8) ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે છતાં જે ખર્ચમાં ફેરફાર થતો નથી તેને શું કહેવાય ?
- (A) અસ્થિર ખર્ચ (B) કુલ ખર્ચ  
 (C) સ્થિર ખર્ચ (D) સરેરાશ ખર્ચ
- (9) જે ખર્ચ ઉત્પાદનના વધારા સાથે પરિવર્તન પામે છે તેને શું કહેવાય ?
- (A) અસ્થિર ખર્ચ (B) કુલ ખર્ચ  
 (C) સ્થિર ખર્ચ (D) સીમાંત ખર્ચ
- (10) કોનો સમાવેશ અસ્થિર ખર્ચમાં થાય છે ?
- (A) મજુરનું વેતન (B) વીજળી, બળતર  
 (C) કાચો માલ (D) ઉપરોક્ત તમામ.
- (11) ઉત્પાદનની પત્યેક સપાટીએ કુલ સ્થિર અને અસ્થિર ખર્ચના તફાવતને શું કહેવાય ?
- (A) કુલ ખર્ચ (B) સીમાંત ખર્ચ  
 (C) સરેરાશ ખર્ચ (D) સ્થિર ખર્ચ
- (12) કુલ સ્થિર ખર્ચને ઉત્પાદન એકમો વડે ભાગવાથી શું પ્રામ થાય છે ?
- (A) સીમાંત ખર્ચ (B) વૈકલ્પિક ખર્ચ  
 (C) સરેરાશ સ્થિર ખર્ચ (D) નાણાકીય ખર્ચ
- (13) કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદન એકમ વડે ભાગવાથી શું પ્રામ થાય છે ?
- (A) વાસ્તવિક ખર્ચ (B) સરેરાશ અસ્થિર ખર્ચ  
 (C) સીમાંત ખર્ચ (D) નાણાકીય ખર્ચ
- (14) સરેરાશ ખર્ચ = કુલ ખર્ચ આ સૂત્ર પૂરું લખો
- 
- (A) કુલ વેતન (B) કુલ મૂડી  
 (C) કુલ માલ-સામાન (D) કુલ ઉત્પાદન.

- (15) વસ્તુના ઉત્પાદનમાં એકમોનો વધારો ઘટાડો કરતાં કુલ ખર્ચમાં જે ફેરફાર થાય તે  
શું કહેવાય?
- (A) સીમાંત ખર્ચ (B) સરેરાશ ખર્ચ  
(C) કુલ ખર્ચ (D) વાસ્તવિક ખર્ચ
- (16) સીમાંત ખર્ચ રેખા કેવા આકારની હોય છે?
- (A) યુ (B) (A) અને (C) બંને  
(C) એ (D) ઉપરોક્ત કોઈ નહીં.
- (17) કોના મુજબ લાંબાગાળે બધા જ ખર્ચ અસ્થિર છે?
- (A) પ્રો. બેન્ઝામ (B) પ્રો. રોબર્ટ  
(C) પ્રો. ડિક્સ (D) ઉપરોક્ત કોઈ નહીં.
- (18) લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા શેના પરથી મેળવવામાં આવે છે?
- (A) ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચ રેખા (B) સીમાંત ખર્ચ રેખા  
(C) વાસ્તવિક ખર્ચ (D) ઉપરોક્ત બધા
- (19) પુરવઠા અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે?
- (A) ઋણ (B) વ્યસ્ત  
(C) સીધો (D) કોઈ સંબંધ નથી
- (20) નીચેનામાંથી કઈ પુરવઠાની ધારણા છે?
- (A) ઉત્પાદન ખર્ચ સ્થિર (B) ભાવિ અટકડ  
(C) કરવેરા સ્થિર (D) ઉપરોક્ત બધા
- (21) પુરવઠાના નિયમના અપવાદો.
- (A) અલભ્ય વસ્તુ (B) શ્રામિકનું વેતન  
(C) અનાજની કિંમત (D) ઉપરોક્ત બધા
- (22) પુરવઠામાં કિંમત પ્રેરિત પરિવર્તનોથી શું થાય છે?
- (A) વિસ્તરણ (B) સંકોચણ  
(C) (એ) અને (બી) બંને (D) કોઈ નહીં.

(23) કિંમત સિવાયના પરિવર્તનો કયા-કયા છે ?

- (A) ભવિષ્યની કિંમત              (B) વિકેતાની સંખ્યા  
(C) સાધન ભાવ              (D) ઉપરોક્ત બધા.

(24) પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા સાપેક્ષતાના કેટલા પ્રકાર છે ?

- (A) પાંચ              (B) છ  
(C) સાત              (D) આઠ

(25) ----- એવો પુરવઠો કે વસ્તુની કિંમતમાં ગમે તેટલા પ્રમાણમાં ફેરફાર થવા છતાં તે વસ્તુના વસ્તુના પુરવઠામાં ફેરફાર થતો નથી.

- (A) સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ પુરવઠો              (B) એકમ મૂલ્ય સ્વપેક્ષ  
(C) મૂલ્ય સાપેક્ષ              (D) મૂલ્ય અનપેક્ષ

### જવાબ

- |     |   |      |   |      |   |      |   |
|-----|---|------|---|------|---|------|---|
| (1) | A | (8)  | C | (15) | A | (22) | C |
| (2) | D | (9)  | A | (16) | A | (23) | D |
| (3) | B | (10) | D | (17) | A | (24) | A |
| (4) | C | (11) | A | (18) | A | (25) | A |
| (5) | C | (12) | C | (19) | C |      |   |
| (6) | D | (13) | B | (20) | D |      |   |
| (7) | B | (14) | D | (21) | D |      |   |

નોંધ

નોંધ





## યુનિવર્સિટી ગીત

સ્વાધ્યાય: પરમં તપ:

સ્વાધ્યાય: પરમં તપ:

સ્વાધ્યાય: પરમં તપ:

શિક્ષણ, સંસ્કૃતિ, સદ્ગ્ભાવ, દિવ્યબોધનું ધામ  
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નામ;  
સૌને સૌની પાંખ મળે, ને સૌને સૌનું આભ,  
દશે દિશામાં સ્મિત વહે હો દશે દિશે શુભ-લાભ.

અભાગ રહી અજ્ઞાનના શાને, અંધકારને પીવો ?  
કહે બુદ્ધ આંબેડકર કહે, તું થા તારો દીવો;  
શારદીય અજવાળા પહોંચ્યાં ગુર્જર ગામે ગામ  
ધ્રુવ તારકની જેમ ઝણહળે એકલવ્યની શાન.

સરસ્વતીના મયૂર તમારે ફળિયે આવી ગાહેકે  
અંધકારને હડસેલીને ઉજાસના ફૂલ મહેકે;  
બંધન નહીં કો સ્થાન સમયના જવું ન ઘરથી દૂર  
ઘર આવી મા હરે શારદા દૈન્ય તિમિરના પૂર.

સંસકારોની સુગંધ મહેકે, મન મંદિરને ધામે  
સુખની ટપાલ પહોંચે સૌને પોતાને સરનામે;  
સમાજ કેરે દરિયે હાંકી શિક્ષણ કેરું વહાણ,  
આવો કરીયે આપણ સૌ  
ભવ્ય રાષ્ટ્ર નિર્માણ...  
દિવ્ય રાષ્ટ્ર નિર્માણ...  
ભવ્ય રાષ્ટ્ર નિર્માણ

# એકમલક્ષી અર્થશાસ્ત્ર

પ્રથમ વર્ષ બી. કોમ.

**BCECON105**

ભાગ-2





પ્રથમ વર્ષ બી.કોમ.

BCECON105

એકમલક્ષી અર્થશાસ્ત્ર

ભાગ - 2

## એકમલક્ષી અર્થશાસ્ત્ર

---

એકમ : 5

બજારના પ્રકારો અને કિંમત નિર્ધારણ

1-15

---

એકમ : 6

બજારના પ્રકારો અને કિંમત નિર્ધારણ- II

16-37

---

એકમ : 7

બજારના પ્રકારો અને કિંમત નિર્ધારણ- III

38-44

---

એકમ : 8

રાજ્યીય આવકની વહેંચાણી

45-63

લેખન :	ડૉ. આત્મન શાહ ડૉ. બિનાબેન પટેલ	આસિસ્ટન્ટ પ્રોફેસર, સેન્ટ ઐવિયર્સ કોલેજ, અમદાવાદ. આસિસ્ટન્ટ પ્રોફેસર, GLS કોલેજ, અમદાવાદ.
પરામર્શક(વિષય) :	ડૉ. હિનાબેન પટેલ ડૉ. પલ્લવી વ્યાસ	પ્રિન્સીપાલ, મણીબેન એમ.પી. શાહ મહિલા આર્ટ્સ કોલેજ, કડી. આસિસ્ટન્ટ પ્રોફેસર એન્ડ હેડ ઓફ ઇકોનોમિક ડીપાર્ટમેન્ટ, પ્ર. એમ.સી. શાહ કોમર્સ કોલેજ, અમદાવાદ.
પરામર્શક(ભાષા) :	ડૉ. જાગૃતિ મેહતા ડૉ. પ્રવીણ વણકર	આસિસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાતી, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ. આસિસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાતી, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ.
સંયોજક :	પ્રો. (ડૉ.) મનોજ શાહ	પ્રોફેસર & નિયામક, સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ.
પ્રકાશક :	ડૉ. ભાવિન ત્રિવેદી	કાર્યકારી કુલસચિવ, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ-382481.

આવૃત્તિ : જૂન 2020 પ્રથમ આવૃત્તિ (નવો અભ્યાસકમ)

ISBN No :

#### સર્વાધિકાર સુરક્ષિત

આ પાઠ્યપુસ્તક ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ઉપક્રમે વિદ્યાર્થીની સ્વઅધ્યન હેતુથી; દ્વારાતી શિક્ષણના ઉદ્દેશને કેન્દ્રમાં રાખી તૈયાર કરવામાં આવેલ છે. જેના સર્વાધિકાર સુરક્ષિત છે. આ અભ્યાસ-સામગ્રીનો કોઈપણ સ્વરૂપમાં ધંધાધારી ઉપયોગ કરતાં પહેલાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની લેખિત પરવાનગી લેવાની રહેશે.

## એકમ 5 :

## બજારના પ્રકારો અને કિંમત નિર્ધારણ

### ઃ રૂપરેખા :

- 5.1 ઉદ્દેશો
- 5.2 પ્રસ્તાવના
- 5.3 સમતુલાનો ઘ્યાલ અને બજારનું માળખું
- 5.4 પૂર્ણ હરીફાઈના લક્ષણો અને આવકના ઘ્યાલો
- 5.5 પૂર્ણ હરીફાઈમાં ટૂંકા ગાળામાં પેઢીની સમતુલા
- 5.6 પૂર્ણ હરીફાઈમાં લાંબા ગાળામાં પેઢી અને ઉદ્યોગની સમતુલા
- 5.7 સારાંશ અને ચાવીરૂપ શરૂઆત
- 5.8 સ્વાધ્યાય

---

### 5.1 ઉદ્દેશો :

આ એકમના અભ્યાસ બાદ નીચેની બાબતો સમજું શકાશે :

1. બજારનો અર્થ
2. બજારમાં સમતુલા
3. પૂર્ણ હરીફાઈના લક્ષણો
4. પૂર્ણ હરીફાઈમાં ટૂંકા ગાળામાં અને લાંબા ગાળામાં પેઢી અને ઉદ્યોગની સમતુલા.

---

### 5.2 પ્રસ્તાવના :

બજાર એટલે જ્યાં વસ્તુઓ અને સેવાઓનું ખરીદ વેચાણ થાય છે તે સ્થળ. અહીં ગ્રાહક અને ઉત્પાદક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકબીજાના સંપર્કમાં આવે છે. પ્રશાસ અર્થશાસ્ત્રીઓના મતે બજાર દ્વારા જે ઉત્પાદન થાય છે તે કાર્યક્ષમ ઉત્પાદન છે. એટલે કે તેમાં સંસાધનોનો બગાડ થતો નથી અને આથી તેઓ બજારમાં કોઈ પડ્યા પ્રકારના સરકારી હસ્તક્ષેપની આવશ્યકતા જોતાં નથી. ઉત્પાદકોની સંખ્યાના આધારે, માંગની મૂલ્ય સાપેક્ષતાના આધારે કે પછી ઈજારાશક્તિના આધારે બજારના પ્રકારો પાડી શકાય છે. આપણે એકમ 5થી 7માં બજારના જુદા જુદા પ્રકારો અને તેના લક્ષણો સમજુશું તથા તેની સાથે સાથે બજારમાં જે તે ઉત્પાદક પેઢી કેવી રીતે સમતુલા પ્રાપ્ત કરે છે તેની આકૃતિ દ્વારા સમજૂતી મેળવીશું.

### 5.3 સમતુલાનો ખ્યાલ અને બજારનું માળખું

અર્થશાસ્ત્રમાં આંશિક સમતુલા અને સામાન્ય સમતુલા એમ બે ખ્યાલો છે. આપણો કોઈ એક પેઢી અથવા તો ઉદ્યોગ કેવી રીતે સમતુલા પ્રાપ્ત કરે છે તેની સમજૂતી મેળવવાની છે અને આથી તે આંશિક સમતુલા વિશ્લેષણ કહેવાય. પેઢી અને ઉદ્યોગ વચ્ચે પણ તફાવત છે. પેઢી એટલે વસ્તુ કે સેવાનું વેચાણ કરનાનું નાનામાં નાનું એકમ. જેમ કે કાપડ ઉદ્યોગમાં કાપડનું ઉત્પાદન કરનારી અનેક પેઢીઓ હોઈ શકે અને તે તમામનું કદ જુદું જુદું હોય છે. જે તે પેઢીનો ઉદ્દેશ બજારમાં પેઢી મહત્તમ નફો પ્રાપ્ત કરે ત્યારે તે સમતુલામાં છે તેમ કહેવાય. એટલે કે જો પેઢી પોતાના ઉત્પાદનમાં ફેરફાર કરે તો તેના નફોમાં ઘટાડો થાય. આમ, સમતુલા એટલે પેઢીની એવી સ્થિતિ કે જેનાથી વિચલિત થવા માટે પેઢી પાસે કોઈ કારણ નથી અને આથી તે તેના ઉત્પાદનમાં ફેરફાર કરશે નહીં.

#### ● આંશિક સમતુલા

આંશિક સમતુલા એટલે આર્થિક સમતુલાની એવી સ્થિતિ કે જેમાં બજારના એક જ ભાગને ધ્યાનમાં લેવામાં આવે છે, એટલે કે તેમાં ધારણાઓ કરીને સિદ્ધાંત તારવવામાં આવે છે. જેમ કે, માંગના નિયમમાં અને પુરવઠાના નિયમમાં અગાઉ કેટલીક ધારણાઓ કરવામાં આવી છે અને પછી નિયમો તારવવામાં આવ્યા છે અને પછી જ્યાં માંગ અને પુરવઠો સરખાં થાય છે ત્યાં જે કિંમત પ્રવર્તે છે તે સમતુલાની કિંમત છે એમ કહેવામાં આવે છે. એટલે નોબેલ ઈનામ વિજેતા અર્થશાસ્ત્રી જ્યોર્જ જોસેફ સ્ટેગલર એમ કહે છે કે, “આંશિક સમતુલા એટલે એવી સમતુલા કે જે અમુક નિયંત્રિત માહિતી ઉપર આધારિત છે, તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કોઈ એક વસ્તુની કિંમત છે કે જ્યાં અન્ય તમામ વસ્તુઓની કિંમતો વિશ્લેષણ દરમ્યાન સ્થિર ધારી લેવામાં આવી હોય છે.” આમ; માંગ અને પુરવઠાનું મોડેલ એ આંશિક સમતુલાનું મોડેલ છે, કારણ કે તેમાં અનેક ધારણાઓ કરીને અનેક બાબતોને સ્થિર માની લેવામાં આવી છે. આવી ધારણા કરવામાં આવે છે કારણ કે સામાન્ય સમતુલાના વિશ્લેષણ કરતાં આ વિશ્લેષણ કરવાનું સરળ બને છે. ફેન્ચ અર્થશાસ્ત્રી એન્ટની કુનોર્ટ અને બ્રાંટિશ અર્થશાસ્ત્રી આલ્ફેડ માર્શલ વિશ્લેષણ માટેની આ પદ્ધતિના પ્રસ્તુતકર્તા હતા.

આંશિક સમતુલા વિશ્લેષણની પદ્ધતિ કોઈક ગ્રાહક, પેઢી, ઉદ્યોગ કે ઉત્પાદનનું સાધન કેવી રીતે સમતુલા પ્રાપ્ત કરે છે તે સમજવા માટે ઉપયોગી થાય છે.

#### ● સામાન્ય સમતુલા:

સામાન્ય સમતુલાનો સિદ્ધાંત માંગ, પુરવઠો અને કિંમતમાં થતાં ફેરફારને સમગ્ર અર્થતંત્રના સંદર્ભમાં વિચારવામાં આવે છે કે જેમાં ધણાં પરિબળો એકસાથે કામ કરે છે અથવા ધણાં બજારો એકસાથે કામ કરે છે. એટલે કે તેમાં એમ સાબિત કરવામાં આવે છે કે કોઈ એક જ ભાવ બજારમાં અસ્તિત્વમાં નથી પણ અનેક ભાવ અસ્તિત્વમાં છે અને તેને

પરિણામે એકંદર સમતુલા ઊભી થાય છે કે જે સામાન્ય સમતુલા છે. ફેન્ચ અર્થશાસ્ત્રી લિયોન વોલરાસના 1874માં પ્રકાશિત થયેલા પુસ્તક 'Elements of pure Economics' માં આ ઘ્યાલને પ્રયત્નિત કરવામાં આવ્યો છે.

આમ; સામાન્ય સમતુલામાં એક કરતાં વધારે પરિબળોને અથવા સમગ્ર અર્થતંત્રને ધ્યાનમાં લેવામાં આવે છે. તેમાં એવી ધારણા કામ કરે છે કે વિવિધ પરિબળો, અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો પરસ્પરાવલંબી છે, એટલે જો એક પરિબળ કે ક્ષેત્રમાં ફેરફાર થાય તો બીજા પરિબળો પર કે ક્ષેત્રો પર તેની અસર થાય છે જ. એનો અર્થ એ છે કે વસ્તુઓ કે સેવાઓની કિંમતો એકસાથે બજારમાં નક્કી થાય છે અને પારસ્પરિક રીતે પણ નક્કી થાય છે. એટલે તમામ વસ્તુઓ અને સેવાઓ તથા ઉત્પાદનનાં સાધનોનાં બજારોમાં એકસાથે સમતુલા ઊભી થાય છે. આથી તેને સ્પર્ધાત્મક (Competitive) સમતુલા તરીકે પણ ઓળખવામાં આવે છે.

ડા.ત. આંશિક સમતુલામાં માંગના નિયમમાં અનેક ધારણાઓ કરીને એમ કહેવામાં આવ્યું કે ભાવ વધે તો માંગ ઘટે, અને ભાવ ઘટે તો માંગ વધે. સામાન્ય સમતુલાના વિશ્લેષણમાં આવી ધારણાઓ કરવામાં આવતી નથી, અને આંશિક સમતુલાના વિશ્લેષણમાં ધારણાઓમાં જે પરિબળોને સ્થિર માની લેવામાં આવ્યાં છે તે બધાંને સામાન્ય સમતુલામાં અસ્થિર અને ફેરફારક્ષમ માનવામાં આવે છે અને માત્ર ભાવ નહિ પણ એ બધાં જ પરિબળો માંગ પર અસર કરે છે એમ માનવામાં આવે છે.

#### ● પેઢીની સમતુલાની શરતો :

1. પેઢીનો સીમાંત ખર્ચ અને સીમાંત આવક સમાન હોવા જોઈએ. એટલે કે  $MR = MC$
2. સમતુલાએ પેઢીનો સીમાંત ખર્ચ વધતો હોવો જોઈએ.

જ્યારે સીમાંત ખર્ચ ઘટતો હોય ત્યારે પેઢી સમતુલામાં ન આવી શકે. કેમકે; જો સીમાંત ખર્ચ ઘટતો હોય તો પેઢી ઉત્પાદન વધારીને પોતાના નફામાં વધારો કરી શકે છે. આથી સમતુલાની પરિસ્થિતિએ સીમાંત ખર્ચ ઘટતો જ હોય. આ બે શરતોનું પાલન થાય ત્યાં જે તે પેઢી સમતુલામાં આવે છે તેમ કહેવાય એટલે કે પેઢીનો નફો મહત્તમ થાય છે અથવા ખોટ ન્યૂનતમ થાય છે.

#### 5.4 પૂર્ણ હરીફાઈના લક્ષણો અને આવકના ઘ્યાલો :

##### 1. અસંખ્ય ઉત્પાદકો અને અસંખ્ય ગ્રાહકો :

પૂર્ણ હરીફાઈ એટલે એવું બજાર કે જેમાં અસંખ્ય ગ્રાહકો છે અને અસંખ્ય ઉત્પાદકો છે. એટલે કે બજારમાં કુલ માંગ અને કુલ પુરવઠામાં ઉપર એક ગ્રાહક કે એક ઉત્પાદકનો હિસ્સો નહિવત છે અને આથી બજાર કિંમત ઉપર તે કોઈ પ્રભુત્વ ધરાવતા નથી.

## 2. સમરૂપ વસ્તુઓ :

પૂર્વી હરીફાઈવાળા બજારમાં અસંખ્ય ઉત્પાદકો જે વસ્તુ વેચે છે તે વસ્તુના તમામ એકમો વજન, રૂપ, રંગ, આકાર, કદ, ગુણવત્તા, પેકિંગ બધાની દસ્તિઓ સરખા હોય છે. ઉત્પાદક ગમે તે હોય પણ વસ્તુ એક જ પ્રકારની હોય છે. આવી વસ્તુએ સમરૂપ અથવા સમાનગુણી (homogeneous) વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જુદા જુદા ઉત્પાદકો દ્વારા ઉત્પન્ન થયેલી વસ્તુના તમામ એકમો એકબીજાની અવેજ સંપૂર્ણપણે ધરાવે છે. એનો અર્થ એ છે કે કોઈ પણ ગ્રાહક કોઈ પણ ઉત્પાદકની વસ્તુ પ્રત્યે વિશેષ રૂપી કે પસંદગી ધરાવતો નથી. જો X વસ્તુ A ઉત્પાદક દ્વારા ઉત્પન્ન થઈ હોય અને બરાબર એવી જ વસ્તુ B ઉત્પાદક દ્વારા ઉત્પન્ન થઈ હોય તો ગ્રાહકને Aના બદલે Bની વસ્તુ ખરીદવા માટે કોઈ આકર્ષણ રહેતું નથી. ગ્રાહક તમામ ઉત્પાદકો પ્રત્યે તટસ્થ રહે છે. તેને માટે બધા જ ઉત્પાદકો સરખા હોય છે.

જો કે, અહીં એમ પણ ધારી લેવામાં આવે છે કે સમરૂપ વસ્તુઓ વેચનારા વેપારીઓ કે વિકેતાઓ પણ સમાનગુણી છે. જો A અને B ઉત્પાદક દ્વારા ઉત્પન્ન થયેલી X વસ્તુ S અને R દ્વારા વેચાતી હોય અને Rનું ગ્રાહક પ્રત્યેનું વર્તન S કરતાં વધારે સાદું હોય તો ગ્રાહક વસ્તુ એકસરખી હોવા છતાં પણ S પાસેથી ન ખરીદે અને R પાસેથી ખરીદે એમ બને. માટે વિકેતાઓ પણ સમાનગુણી છે એવી ધારણા કરવામાં આવે છે.

## 3. સંપૂર્ણ માહિતી :

પૂર્વી હરીફાઈવાળા બજારમાં તમામ ઉત્પાદકો અને તમામ ગ્રાહકોને બજાર વિશે સંપૂર્ણ માહિતી હોય છે. આ એક ખૂબ જ અગત્યની શરત છે. ઉત્પાદક ઉત્પાદનનાં સાધનોના બજાર વિશે સંપૂર્ણ માહિતી ધરાવે છે. એટલે કે દરેક ઉત્પાદક સાધન કેવું છે, કયા ભાવે મળે છે, તેનો પુરવઠો પૂરો પાડનાર કોણ છે અને ઉત્પાદનની પ્રક્રિયામાં તે કેવો ફાળો આપે છે તેને વિશે બધી જ માહિતી ધરાવે છે અને પછી જ તે કયું ઉત્પાદનનું સાધન કેટલું વાપરવું તેને વિશે નિર્ણય કરે છે. ઉત્પાદક નિર્ણય એવી રીતે કરશે કે જેથી તેનું ઉત્પાદનનું ખર્ચ ઓછામાં ઓછું એટલે કે લઘુતમ આવે. જો તે લઘુતમ ખર્ચું ઉત્પાદન કરે તો જ તેને મહત્તમ નફો મળે. એટલે કે ઉત્પાદક તર્કબદ્ધ નિર્ણય કરે છે કે જેથી તેને મહત્તમ નફો પ્રાપ્ત થાય. આમ, ઉત્પાદક અને ગ્રાહક માહિતીપ્રદ પસંદગી (Informed Choice) કરે છે.

બરાબર એ જ રીતે, તમામ ગ્રાહકો બજારને વિશે સંપૂર્ણ માહિતી ધરાવે છે. એટલે કે, ગ્રાહક વસ્તુ ઉત્પન્ન કરનારા કેટલા ઉત્પાદકો છે, વસ્તુ કેવી ગુણવત્તાવાળી છે, શું ભાવ છે, ભાવ મુજબ ગુણવત્તા છે કે નહિએ, વસ્તુની કે સેવાની વપરાશથી પોતાને શી સારી કે ખરાબ અસર થશે વગેરે તમામ પ્રકારની માહિતી ધરાવે છે. આ માહિતી પ્રાપ્ત કરીને જ તે પ્રકારની માહિતી ધરાવે છે. આ માહિતી પ્રાપ્ત કરીને જ તે કયા ઉત્પાદકની કઈ વસ્તુ કે

સેવા વાપરવી તેને અંગે નિર્ણય લે છે. વળી, તે આ નિર્ણય એ રીતે લે છે કે જેથી તેનો સંતોષ મહત્વમાં થાય. આ ગ્રાહકનું તર્કબદ્ધ વર્તન છે. તે પાગલની માફક કે આદેખદ નિર્ણયો લઈને ખરીદી કરતો નથી એમ અહીં ધારવામાં આવે છે. એટલે કે જો કોઈ ઉત્પાદક વધારે ભાવે વસ્તુ વેચે અને એ વસ્તુની ગુણવત્તા બીજા ઉત્પાદકની વસ્તુ જેવી જ હોય તો ગ્રાહક વધુ ભાવ આપે જ નાહિ. એ જ રીતે, બે ઉત્પાદક દ્વારા વેચાતી વસ્તુની ગુણવત્તામાં તફાવત હોય પણ ભાવ એકસરખા હોય તો ગ્રાહક જેની ગુણવત્તા વધુ સારી હશે તેની વસ્તુ જ ખરીદશે. અહીં ઉત્પાદક કોઇ છે તે તેને માટે મહત્વનું નથી, વસ્તુની ગુણવત્તા કેવી છે એ જ તેને માટે અગત્યનું બની જાય છે. ઓછા ભાવે સારી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદાય તો જ ગ્રાહકને મહત્વમાં સંતોષ મળે. એટલે કોઈ પણ ઉત્પાદક પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ગ્રાહક પાસેથી ઓછી ગુણવત્તાવાળી વસ્તુ તેને આપીને વધુ ભાવ લઈ શકતો નથી અને તેથી ગ્રાહકનું શોષણ આ બજારમાં શક્ય જ બનતું નથી.

#### **4. મુક્ત પ્રવેશ અને મુક્ત વિદાય :**


પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કોઈ પણ પેઢીને કોઈ પણ વસ્તુ કે સેવાના ઉદ્ઘોગમાં ગમે ત્યારે પ્રવેશ કરવાની છૂટ છે અને કોઈ પણ પેઢીને ઉદ્ઘોગ છોડીને જવું હોય તો તેની પણ છૂટ છે. એટલે કે કોઈ પેઢીના પ્રવેશ પર કે તેની વિદાય પર કોઈ સરકારી નિયંત્રણ નથી અથવા તો બજાર એવું નથી કે જેથી પેઢીના પ્રવેશ ઉપર કે વિદાય ઉપર બીજી કોઈ પેઢી કોઈ અંકુશ ધરાવી શકે.

આનું પરિણામ એ આવે કે, જો લાંબા ગાળે પણ X વસ્તુ ઉત્પાદન કરનારી પેઢીઓને અસામાન્ય નફો મળતો હોય તો અન્ય પેઢીમાં પણ X વસ્તુના ઉદ્ઘોગમાં દાખલ થવા લલચાય. એમ થવાથી હરીફાઈ ઊભી થાય અને બધી પેઢીઓને પછી સામાન્ય નફો જ મળે. એટલે પૂર્ણ હરીફાઈમાં કોઈ પણ પેઢી લાંબા ગાળા સુધી અસામાન્ય નફો કર્માઈ શકે જ નાહિ.

જે પેઢીને ખોટ જતી હોય તે પેઢી પણ ઉદ્ઘોગ છોડીને જતી રહે છે કારણ કે તે હરીફાઈ સહન કરી શકતી નથી અને તેથી પણ માત્ર સામાન્ય નફો જ કર્માનારી પેઢીઓ બાકી બચે છે. એટલે ઉદ્ઘોગનો ત્યાગ કરવાની છૂટ આપોઆપ જ પૂર્ણ હરીફાઈમાં કોઈ પણ પેઢીને મળતી હોય છે.

#### **5. પેઢી કિંમત સ્વીકારનાર :**

અસંખ્ય ઉત્પાદકો છે અને આથી પેઢીનું બજાર કિંમત ઉપર કોઈ જ પ્રભુત્વ નથી. એટલે કે કિંમત બજારમાં કુલ માંગ અને કુલ પુરવઠા દ્વારા નક્કી થાય છે અને પેઢી તે કિંમત સ્વીકારે છે. આમ; પૂર્ણ હરીફાઈમાં પેઢી કિંમત નક્કી નથી કરતી પરંતુ કિંમત સ્વીકારે છે અને તે જ તેની માંગ રેખા છે. આકૃતિ 5.1 માં તેની સમજૂતી આપી છે.



### આકૃતિ 5.1 : પૂર્ણ હરીફાઈમાં પેટીની માંગ રેખા

આકૃતિ 5.1માં દર્શાવ્યા મુજબ X-અક્ષ ઉપર વસ્તુનો જથ્યો અને Y-અક્ષ ઉપર વસ્તુની કિંમત દર્શાવી છે. DD અને SS એ અનુક્રમે બજારની કુલ માંગ રેખા અને કુલ પુરવઠા રેખા દર્શાવે છે. બંને એકલીયાને E બિંદુએ છેંદે છે જ્યાં વસ્તુની કિંમત OP જેટલી છે. હવે આ કિંમત બજાર દ્વારા નક્કી થઈ છે અને તે પેટી સ્વીકારે છે અને તે જ પેટીની માંગ રેખા છે કે કે કે X-અક્ષને સમાંતર છે. આમ; પૂર્ણ હરીફાઈમાં પેટીની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ છે એટલે કે અનંત છે.

પૂર્ણ હરીફાઈમાં સરેરાશ આવક અને સીમાંત આવક કેવી હશે તે કોષ્ટક 5.1માં ને આકૃતિ 5.2માં દર્શાવ્યું છે.

કોષ્ટક 5.1 : પૂર્ણ હરીફાઈમાં સરેરાશ અને સીમાંત આવક			
એકમો	કિંમત અને સરેરાશ આવક (રૂપિયામાં)	કુલ આવક (રૂપિયામાં)	સીમાંત આવક (રૂપિયામાં)
1	10	10	10
2	10	20	10
3	10	30	10
4	10	40	10
5	10	50	10
6	10	60	10
7	10	70	10
8	10	80	10
9	10	90	10

આ અનુસૂચિ પરથી સ્પષ્ટ થાય છે કે બજારમાં ભાવ 10 રૂ. છે. એટલે કે દરેક પેટીએ 10 રૂ. ના ભાવે વસ્તુ વેચવી પડે છે. જો વસ્તુનો વધારાનો એક એકમ વેચવામાં આવે તો કુલ આવકમાં 10 રૂ. નો વધારો થાય છે. એટલે કે સીમાંત આવક 10 રૂ. ની થાય છે. અહીં સીમાંત આવક પણ સ્થિર રહે છે. એટલે કે સીમાંત આવક (MR), સરેરાશ આવક (AR) અને કિંમત (P) સરખાં જ રહે છે.

આ અનુસૂચિ પરથી સરેરાશ આવક અને સીમાંત આવક આકૃતિ નં. 5.2માં દર્શાવાયા છે. આકૃતિ 5.2માં OX ધરી ઉપર વસ્તુનો જથ્થો (Q) અને OY ધરી ઉપર સીમાંત આવક (MR) અને સરેરાશ આવક (AR) દર્શાવાયાં છે.

અહીં સીમાંત આવક અને સરેરાશ આવક રેખા OX ધરીને સમાંતર છે તથા એક જ છે. સરેરાશ આવક રેખા એ જ પેટીની સીમાંત આવક રેખા અને માંગ રેખા દર્શાવે છે. આમ; પેટીની સરેરાશ આવક સ્થિર રહે છે અને સીમાંત આવક એ સરેરાશ આવક જેટલી જ હોય છે.




આકૃતિ 5.2 પૂર્ણ હરીફાઈમાં સરેરાશ આવક અને સીમાંત આવક આમ; પૂર્ણ હરીફાઈવાળા બજારની લાક્ષણિકતા ખૂબ જ મહત્વની એ છે કે અહીં પેટીની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ છે. જો કોઈ ઉત્પાદક કે વેપારી વસ્તુના ભાવ સહેજ પણ વધારે તો તેની માંગ શૂન્ય થાય છે કારણ કે બજારમાં તે જ વસ્તુ તેનાથી ઓછા ભાવે પ્રાપ્ત હોય છે. એ જ રીતે જો વસ્તુના ભાવ થોડા પણ ઘટે તો માંગ ખૂબ જ વધી જાય છે કારણ કે તે વસ્તુ એટલા ઓછા ભાવે બજારમાં કયાંય પણ ઉપલબ્ધ હોતી નથી. આમ, પૂર્ણ હરીફાઈમાં માંગ રેખા X ધરીને સમાંતર એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષ હોય છે, એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતા અનંત  $ed = (a)$  હોય છે.

## 5.5 પૂર્ણ હરીકાઈમાં ટૂંકા ગાળામાં પેઢીની સમતુલા :

પૂર્ણ હરીકાઈમાં પેઢી સમતુલામાં આવે ત્યારે બે શક્યતાઓ રહેલી છે :

### a. અસામાન્ય નફો :

આદૃતિ 5.3 માં અસામાન્ય નફાની પરિસ્થિતિ સમજાવી છે.



આદૃતિ : 5.3 પૂર્ણ હરીકાઈમાં અસામાન્ય નફો


આદૃતિ 5.3 માં ટૂંકા ગાળામાં પૂર્ણ હરીકાઈમાં પેઢી ક્યારે અસામાન્ય નફો કમાય છે તે દર્શાવ્યું છે.

1.  $OP$  વસ્તુની કિંમત છે કે જે બજાર દ્વારા નક્કી થઈ છે. સરેરાશ આવક, સીમાંત આવક અને કિંમત રેખા સમાન હોય છે.
2.  $J$  અને  $E$  બંને બિંદુએ સીમાંત ખર્ચ અને સીમાંત આવક સમાન થાય છે પરંતુ  $J$  બિંદુએ સીમાંત ખર્ચ વધુ છે અને  $E$  બિંદુએ સીમાંત ખર્ચ ઓછું છે આથી સમતુલા  $E$  બિંદુએ સ્થપાશે.

3. પેટીની કુલ આવક ( $TR$ ) = કિંમત વસ્તુના એકમો ( $Q$ ) =  $OP \times OQ = OPEQ$
4. પેટીનું કુલ ખર્ચ ( $TC$ ) = સરેરાશ ખર્ચ ( $AC$ )  $\times$  વસ્તુના એકમો ( $Q$ ) =  $OH \times OQ = OHGQ$
5. અહીં પેટીની કુલ આવક એ કુલ ખર્ચ કરતાં વધુ છે એટલે કે  $TR > TC$ . માટે પેટી અસામાન્ય નફો કમાય છે તેમ કહેવાય.
6. પેટીનો અસામાન્ય નફો ( $\pi$ ) =  $TR - TC = OPEQ - OHGQ = PEGH$

### B. ખોટ :

આકૃતિ 5.4 માં પેટીની ખોટની શક્યતા દર્શાવી છે.



આકૃતિ 5.4 પૂર્ણ હરીફાઈમાં ખોટ

1.  $OP$  વસ્તુની કિંમત છે કે જે બજેટ દ્વારા નક્કી થઈ છે. સરેરાશ આવક, સીમાંત આવક અને કિંમત રેખા સમાન હોય છે.
2.  $J$  અને  $E$  બંને બિંદુએ સીમાંત ખર્ચ અને સીમાંત આવક સમાન થાય છે પરંતુ  $J$  બિંદુએ સીમાંત ખર્ચ વધતું છે અને  $E$  બિંદુએ સીમાંત ખર્ચ ઘટતું છે આથી સમતુલ્ય  $E$  બિંદુએ સ્થપાશે.
3. પેટીની કુલ આવક ( $TR$ ) = કિંમત વસ્તુના એકમો ( $Q$ ) =  $OP \times OQ = OPEQ$
4. પેટીનું કુલ ખર્ચ ( $TC$ ) = સરેરાશ ખર્ચ ( $AC$ )  $\times$  વસ્તુના એકમો ( $Q$ ) =  $OM \times OQ = OMLQ$
5. અહીં પેટીની કુલ આવક એ કુલ ખર્ચ કરતાં ઓછી છે એટલે કે  $TR < TC$ . માટે પેટીને ખોટ જાય છે તેમ કહેવાય.


6. પેઢીની ખોટ =  $TC - TR = OLMQ - OPEQ = MLEP$
  7. પ્રશ્ન એ ઉભો થાય કે જો પેઢી ટૂંકા ગાળામાં ખોટ થાય તો તે ઉત્પાદન ચાલુ રાખે કે બંધ કરે. જો પેઢી ઉત્પાદન બંધ કરશે તો પણ તેને સ્થિર ખર્ચ તો ભોગવવા જ પડશે. આથી ખોટ સાથે ઉત્પાદન ચાલુ રાખવું કે નહીં તે નિર્ણય માટે અસ્થિર ખર્ચ મહત્વનો છે.
  8. જો વસ્તુની કિંમત પેઢીના અસ્થિર ખર્ચ (Average Variable Cost-AVC) કરતા વધુ હોય તો પેઢી ઉત્પાદન ચાલુ રાખશે અને જો કિંમત તેનાથી ઓછી હશે તો પેઢી ઉત્પાદન બંધ કરશે. જ્યારે વસ્તુની કિંમત અને સરેરાશ અસ્થિર ખર્ચ સમાન હોય તે બિંદુને બંધ બિંદુ (Shut Down Point) કહેવામાં આવે છે. એટલે કે કિંમત જો તેનાથી ઓછી થાય તો પેઢી ઉત્પાદન બંધ કરીને બજાર છોડી દેશે.
- આમ; ટૂંકા ગાળામાં પૂર્ણ હરીફાઈમાં સમતુલ્યાએ -
1.  $MR=AR=P=MC$
  2. ગ્રાહક જે કિંમત ચૂકવે છે તે સીમાંત ખર્ચ જેટલી છે.
  3. કિંમત MC થી ઓછી શક્ય નથી.
  4. પૂર્ણ હરીફાઈમાં સમતુલ્યાની કિંમત એ બજારની ન્યૂનતમ શક્ય કિંમત (Minimum Possible Price) છે કારણ કે તે સીમાંત ખર્ચ જેટલી છે. તેનાથી ઓછી કિંમત કોઈ પણ બજારમાં શક્ય નથી. આથી ગ્રાહકનું મહત્વાનું પૂર્ણ હરીફાઈવાળા બજારમાં થાય છે તેમ કહેવાય.

## 5.6 પૂર્ણ હરીફાઈમાં લાંબાગાળામાં પેઢી અને ઉદ્યોગની સમતુલ્યા :

પૂર્ણ હરીફાઈવાળા બજારમાં લાંબા ગાળામાં પેઢી જે સમતુલ્યા પ્રાપ્ત કરે છે તેમાં તેને સામાન્ય નફો જ પ્રાપ્ત થાય છે. લાંબો ગાળો એટલે સમયનો ઓવો ગાળો કે જ્યારે ઉત્પાદનનાં તમામ સાધનોના પ્રમાણમાં ફેરફાર થાય છે. એટલે કે સ્થિર ખર્ચ લાંબે ગાળે અસ્થિર ખર્ચ થાય છે. પેઢીનું કદ પણ બદલાય. પરંતુ લાંબે ગાળે પેઢીને પૂર્ણ હરીફાઈમાં સામાન્ય નફો જ પ્રાપ્ત થાય કારણ કે જો અસામાન્ય નફો મળતો હોય તો નવી પેઢીઓ ઉદ્યોગમાં પ્રવેશે અને બધો અસામાન્ય નફો હરીફાઈને લીધે ધોવાઈ જાય. ખોટ કરનારી પેઢીઓ ઉદ્યોગ છોડીને જતી પણ રહે છે કારણ કે તેમને ટૂંકા ગાળામાં ખોટ સહન કરવાનું પોસાય પણ લાંબાગાળા માટે તે ખોટ સહન કરી શકે નાહિ. આમ; બધી જ પેઢીઓને લાંબા ગાળામાં પૂર્ણ હરીફાઈમાં સામાન્ય નફો જ મળે.

પૂર્ણ હરીફાઈમાં લાંબાગાળે પેઢી સામાન્ય નફો કમાય છે એટલે કે તેની કુલ આવક અને કુલ ખર્ચ સમાન હોય છે. તે એ શૂન્ય નફોની સ્થિતિ પણ કહેવામાં આવે છે. પ્રશ્ન એ છે કે જો પેઢી શૂન્ય નફો કમાય તો શા માટે બજારમાં ટકી રહે. અહીં શૂન્ય નફો અથવા તો

સામાન્ય નકો એટલે એવી સ્થિતિ કે જેમાં પેઢીએ જે મૂડીરોકાણ કર્યું છે તેની ઉપર તેને સામાન્ય વળતર પ્રાપ્ત થાય છે અને તે બીજે ક્યાંય પણ મૂડીરોકાણ કરે તો એનાથી વધારે વળતર પ્રાપ્ત થશે નહીં તેથી બજાર છોડી દેવા માટે પેઢી પાસે કોઈ કારણ નથી. આકૃતિ 5.5માં લાંબાગાળે પેઢીની સમતુલા દર્શાવી છે.



### આકૃતિ 5.5 સામાન્ય નકો

- (1) AH પેઢીની માંગ રેખા છે. તે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષતા દર્શાવે છે એટલે કે પેઢી OA ભાવે જ ઉત્પાદન કરીને વેચે છે.
- (2) ભાવ OA જેટલા છે અને બદલાતા નથી એટલે AH રેખા સરેરાશ આવક (AR)ની રેખા તો છે જ પણ સાથે સાથે સીમાન્ય આવક (MR)ની રેખા પણ છે.
- (3) DE સરેરાશ ખર્ચ (AC)ની રેખા છે કે જે B બિંદુએ લઘુતમ થાય છે.
- (4) FG સીમાન્ય ખર્ચ (MC)ની રેખા છે અને તે B બિંદુએ જ AH રેખાને છેદે છે.
- (5) B બિંદુએ જ તેથી ઉત્પાદન નક્કી થાય છે અને પેઢી સમતુલામાં આવે છે કારણ કે ત્યાં જ MR = MC થાય છે.
- (6) આમ, ઉત્પાદન OC જેટલું થાય છે.
- (7) આટલા ઉત્પાદને કુલ આવક (TR) કેટલી થાય છે તે જોઈએ:  

$$TR = AR \times Q$$

$$\therefore TR = OA \times OC = OABC$$
 આમ, કુલ આવક OABC જેટલી થઈ.
- (8) કુલ ખર્ચ  $OC$  ઉત્પાદને કેટલું થાય છે તે જોઈએ:  

$$TC = AC \times Q$$

$$\therefore TR = BC \times OC = OABC.$$
 એટલે કુલ ખર્ચ OABC થયું.


- (9) આમ; આ આકૃતિમાં કુલ આવક ( $TR$ ) અને કુલ ખર્ચ ( $TC$ ) બંને જેટલાં સરખાં થાય છે. અને તેથી પેઢીને સામાન્ય નફો મળે છે.  $TR = TC$  થાય છે તેનું કારણ એ છે કે  $AR = AC$  છે.
- (10) નોંધનીય બાબત એ છે કે; જે  $B$  બિંદુએ ઉત્પાદન નક્કી થાય છે અને પેઢી સમતુલામાં આવે છે તે બિંદુ લઘુતમ સરેરાશ ખર્ચ દર્શાવે છે. એટલે કે જ્યાં  $AC$  ઓછામાં ઓદૃષ્ટ હોય છે ત્યાં ઉત્પાદન થાય છે.
- (11) વળી,  $B$  બિંદુએ સીમાન્ત ખર્ચની  $FG$  રેખા પણ  $AH$  રેખાને છેદે છે અને  $AH$  રેખા ભાવ, સરેરાશ આવક અને સીમાન્ત આવક તો દર્શાવે જ છે. તેથી  $B$  બિંદુએ  $AR = P = MR = MC = AC$  થાય છે. આમ; આ પાંચેય બાબતો જ્યાં સરખી થાય છે ત્યાં પેઢીને સામાન્ય નફો મળે છે.

પેઢીને લાંબા ગાળે સામાન્ય નફો મળે છે એનો અર્થ એ છે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં લઘુતમ સરેરાશ ખર્ચ ઉત્પાદન થાય છે. જો સરેરાશ ખર્ચ ઓછામાં ઓદૃષ્ટ હોય તો ભાવ પણ ઓછામાં ઓછો જ હોય. જો ભાવ ઓછામાં ઓછો હોય તો ગ્રાહકોને લાભ થાય. એનો અર્થ જ એ છે કે પેઢીને જ્યારે સામાન્ય નફો મળે છે ત્યારે ગ્રાહકોનું શોખણ થતું નથી.

નીચેની ગ્રાફ શરતોનું પાલન થાય ત્યારે લાંબાગાળે પેઢી સમતુલામાં આવે -

1. તમામ પેઢીઓનો ઉદેશ મહત્તમ નફો કમાવવાનો છે.
2. તમામ પેઢીઓ શૂન્ય અથવા સામાન્ય નફો કમાય છે.
3. વસ્તુની કિંમત એવી છે કે જેથી બજારમાં તે ઉદ્યોગની કુલ માંગ અને કુલ પુરવઠો સમાન થાય છે એટલે કે ઉદ્યોગ પણ સમતુલામાં છે.

અહીં એ બાબત પણ મહત્વની છે કે પેઢી લાંબેગાળે સરેરાશ ખર્ચ રેખાના લઘુતમ બિંદુએ ઉત્પાદન કરે છે એટલે કે તેનું સરેરાશ ખર્ચ ન્યૂનતમ થાય છે. લાંબાગાળે ઉદ્યોગની સમતુલા આકૃતિ 5.6 માં દર્શાવી છે.



### આકૃતિ 5.6 ઉદ્યોગની સમતુલા

આકૃતિમાં X-અક્ષ ઉપર કુલ માંગ અને કુલ પુરવઠો અને Y- અક્ષ ઉપર વસ્તુની કિંમત દર્શાવી છે. DD અને SS એ કુલ માંગરેખા અને કુલ પુરવઠા રેખા છે જે એકબીજાને E બિંદુએ છેટ છે જ્યાં સમતુલા સ્થપાય છે અને વસ્તુની કિંમત OP જેટલી છે. અહીં આ કિંમત એવી રીતે નક્કી થાય છે કે તમામ પેઢીઓ પણ લાંબાગાળે સમતુલામાં આવે.

### 5.7 સારાંશ અને ચાવીરૂપ શબ્દો :

અહીં આપણે જોયું કે પૂર્ણ હરીફાઈમાં સમતુલાની સ્થિતિમાં વસ્તુની કિંમત અને પેઢીનું સીમાંત ખર્ચ સમાન હોય છે અને આથી ગ્રાહકનું મહત્તમ કલ્યાણ થાય છે અને આથી પૂર્ણ હરીફાઈ એક આદર્શ બજાર છે. જ્યારે લાંબાગાળે પેઢી સામાન્ય નફો કમાય છે. જ્યારે પેઢી સમતુલામાં હોય છે ત્યારે  $AR=MR=MC=P$  હોય છે.

#### ચાવીરૂપ શબ્દો :

પૂર્ણ હરીફાઈ, સમતુલા, સમાનગુણી વસ્તુઓ, અસામાન્ય નફો, ખોટ, સામાન્ય નફો

### 5.8 સ્વાધ્યાય :

- નીચેના પ્રશ્નોમાં સાચો વિકલ્પ પસંદ કરો.
1. પૂર્ણ હરીફાઈમાં પેઢીની માંગરેખા
    - A. અણા ટાળ ધરાવે
    - B. ઘન ટાળ ધરાવે
    - C. X અક્ષને સમાંતર હોય
    - D. Y અક્ષને સમાંતર હોય
  2. સામાન્ય નફો એટલે -
    - A.  $TR = TC$
    - B.  $TR > TC$
    - C.  $TR < TC$
    - D. ઉપરનામાંથી એક પણ નહીં
  3. ટૂંકા ગાળામાં પેઢી સમતુલામાં આવે ત્યારે -
    - A. સીમાંત ખર્ચસ્થિર હોય
    - B. સીમાંત ખર્ચ વધતું હોય
    - C. સરેરાશ ખર્ચ વધતું હોય
    - D. સીમાંત ખર્ચ ઘટતું હોય

4. પૂણી હરીફાઈમાં ટૂંકા ગાળામાં સમતુલા એ -
- $MR = AR = MC = P$
  - $P < MR = AR = MC$
  - $P < MR = AR$
  - $MR = MC < P$
5. જ્યારે પેઢી ટૂંકા ગાળામાં ખોટ ખાય ત્યારે
- કુલ ખર્ચ કરતાં કુલ આવક વધુ હોય
  - કુલ ખર્ચ કરતાં કુલ આવક ઓછી હોય
  - કુલ ખર્ચ અને કુલ આવક સમાન હોય
  - સરેરાશ ખર્ચ અને સરેરાશ આવક સમાન હોય
6. ટૂંકા ગાળામાં ક્યારે પેઢી બજાર છોડી દેશો ?
- $P < AVC$
  - $P = AVC$
  - $P < TC$
  - $P > TC$
7. નીચેનામાંથી કયું પૂણી હરીફાઈનું લક્ષણ નથી ?
- $MR = AR$
  - $P > MC$
  - સમાનગુણી વસ્તુઓ
  - સંપૂર્ણ માર્કેટી
8. બંધ બિંદુ એટલે કેવી પરિસ્થિતિ ?
- $P = AVC$
  - $P = TC$
  - $P = MR$
  - $P < AVC$
- જવાબ : (1) (C)      (2) (A)      (3) (D)      (4) (A)  
(5) (B)      (6) (A)      (7) (B)      (8) (A)

● નીચેના વિધાનો સાચાં છે કે ખોટાં તે જણાવો :

- પૂણી હરીફાઈમાં અસંઘ્ય ઉત્પાદકો હોય છે.
- પૂણી હરીફાઈમાં વસ્તુઓની ગુણવત્તા જુદી જુદી હોય છે.
- જ્યારે પેઢીની કુલ આવક તેના કુલ ખર્ચ કરતાં વધુ હોય ત્યારે પેઢી અસામાન્ય નફો કમાય છે.

4. જ્યારે સીમાંત ખર્ચ વધતું હોય ત્યારે પેઢી સમતુલામાં આવે છે.
5. પૂર્ણ હરીફાઈમાં ગ્રાહકો અને ઉત્પાદકો પાસે બજાર અંગેની સંપૂર્ણ માહિતી છે.
6. પૂર્ણ હરીફાઈમાં સીમાંત આવક અને સરેરાશ આવક સમાન હોય છે.
7. સામાન્ય નફાની સ્થિતિમાં પેઢી સરેરાશ ખર્ચ રેખાના લઘુતમ બિંદુ એ ઉત્પાદન કરે છે.

જવાબ : (1) (સાચું)      (2) (ખોટું)      (3) (સાચું)      (4) (ખોટું)  
 (5) (સાચું)      (6) (સાચું)      (7) (સાચું)

● નીચેના પ્રશ્નોના એક-બે વાક્યમાં જવાબ લખો :

1. પેઢીની સમતુલા એટલે શું ?
  2. પૂર્ણ હરીફાઈમાં શા માટે એક ગ્રાહકનું વસ્તુની કિંમત ઉપર પ્રભુત્વ નથી.
  3. ટૂંકા ગાળામાં પેઢી ક્યારે ખોટ ખાય છે ?
  4. સામાન્ય નફો એટલે શું ?
  5. બંધ બિંદુ એટલે શું ?
  6. પૂર્ણ હરીફાઈમાં વસ્તુની કિંમત કોણ નક્કી કરે છે ?
  7. સમતુલાની શરતો જણાવો.
  8. સમાનગુણી વસ્તુઓનો અર્થ જણાવો.
  9. સંપૂર્ણ માહિતી એટલે શું ?
  10. પેઢી ક્યારે ટૂંકા ગાળામાં બજાર દરોડી દે ?
- નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો :
1. પૂર્ણ હરીફાઈના લક્ષણો જણાવી તેમાં આવકના ખ્યાલો આકૃતિ ચર્ચો.
  2. પૂર્ણ હરીફાઈમાં ટૂંકા ગાળામાં પેઢીની સમતુલા સમજાવો.
  3. પૂર્ણ હરીફાઈમાં લાંબા ગાળામાં પેઢી અને ઉદ્ઘોગની સમતુલા જણાવો.

એકમ 6:

બજારના પ્રકારો અને કિંમત નિર્ધારણ-॥

: રૂપરેખા :

6.1 ઉદ્દેશો

6.2 પ્રસ્તાવના

6.3 ઇજારાના લક્ષણો

6.4 ઇજારામાં પેઢીની આવકના ઘ્યાલો

6.5 ઇજારામાં ટ્રેક ગાળામાં પેઢીની સમતુલા

6.6 ઇજારાયુક્ત હરીકાઈનો અર્થ અને તેના લક્ષણો

6.7 ઇજારાયુક્ત હરીકાઈમાં ટ્રેકગાળામાં પેઢીની સમતુલા

6.8 વેચાણખર્ચનો ઘ્યાલ

6.9 સારાંશ અને ચાવી રૂપ શબ્દો

6.10 સ્વાધ્યાય

---

6.1 ઉદ્દેશો :

---

આ એકમના અભ્યાસ બાદ નીચેની બાબતો સમજુ શકશે:

1. ઇજારાનો અર્થ અને તેના કારણો

2. ઇજારામાં પેઢીની સમતુલા અને પૂર્ણ હરીકાઈ સાથે સરખામણી

3. ઇજારાયુક્ત હરીકાઈના લક્ષણો

4. વેચાણ ખર્ચનો ઘ્યાલ

**6.2 પ્રસ્તાવના**

ઇજારો એ પૂર્ણ હરીકાઈની તદ્દન વિકુલની બાજુ છે. પૂર્ણ હરીકાઈમાં અસંખ્ય ઉત્પાદકો છે અને તેમની વચ્ચે તીવ્ર હરીકાઈ છે. આ ઉપરાંત કોઈ એક ઉત્પાદકનો કુલ પુરવઠા કે વસ્તુની કિંમત ઉપર ઇજારો નથી. જ્યારે ઇજારામાં માત્ર એક જ ઉત્પાદક છે અને બજાર પુરવઠા ઉપર તેનું સંપૂર્ણ નિયંત્રણ છે. તેવી જ રીતે ઇજારાયુક્ત હરીકાઈમાં પણ પેઢીઓ બજાર પુરવઠા ઉપર નિયંત્રણ ધરાવે છે.

ઇજારાયુક્ત હરીફાઈમાં પૂર્ણ હરીફાઈ અને ઇજારો બંનેના લક્ષણો જોવા મળે છે.

કોષ્ટક 6.1માં તેમની સરખામણી દર્શાવી છે.

કોષ્ટક 6.1: પૂર્ણ હરીફાઈ, ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈની સરખામણી				
બજારનો પ્રકાર	ઉત્પાદકોની સંખ્યા	માંગની મૂલ્ય સાપેક્ષતા	વસ્તુ	માંગ રેખા
પૂર્ણ હરીફાઈ	અસંખ્યા	સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ (અસંખ્યા)	સંપૂર્ણ અવેજી વસ્તુઓ (સમાનગુણી)	X-અક્ષને સમાંતર
ઇજારો	એક જ	મૂલ્ય અનપેક્ષ (૦ થી ૧ ની વચ્ચે)	-	ઝાણ ઢાળ
ઇજારાયુક્ત હરીફાઈ	વધારે	મૂલ્ય અનપેક્ષ (૦ થી ૧ ની વચ્ચે) પરંતુ ઇજારા કરતાં વધુ	નજીકની અવેજી વસ્તુઓ	ઝાણ ઢાળ

### 6.3 ઈજારાના લક્ષણો :

#### 1. એક જ ઉત્પાદક કે વેચનાર:

ઇજારો એ પૂર્ણ હરીફાઈથી તદ્દન વિરુદ્ધની સ્થિતિ છે. ઈજારામાં ઉત્પાદક એક જ છે. એટલે કે ઉત્પાદકો વચ્ચે કોઈ સ્પર્ધા નથી. જો કોઈ સ્પર્ધા હોય તો પણ તે ગ્રાહકો વચ્ચે જ છે. ઉત્પાદન કરનારી પેઢી એક જ છે એટલે જે પેઢી છે તે જ ઉદ્યોગ છે. એનો અર્થ એ છે કે જે પેઢીની સમતુલ્યા છે તે જ ઉદ્યોગની સમતુલ્યા છે. પેઢી એક જ છે એનો અર્થ એ પણ છે કે તે જ પુરવઠો પૂરો પાડનાર છે. એટલે કે તે પુરવઠા ઉપર અંકુશ ધરાવે છે. જો પેઢી પુરવઠા ઉપર અંકુશ ધરાવી શકતી હોય તો તે ભાવ ઉપર પણ અંકુશ ધરાવે છે. એટલે કે તે પુરવઠો પણ નક્કી કરે છે અને ભાવ પણ નક્કી કરે છે.

#### 2. અવેજીની વસ્તુનો અભાવ:-

ઇજારો કેવો છે તેનો આધાર તો હરીફાઈ ઉપર હોય છે. જો હરીફાઈમાં કોઈક વસ્તુ હોય તો પછી ઈજારો પૂર્ણ ઈજારો હોતો નથી. એટલે કે શુદ્ધ ઈજારો હોતો નથી. હરીફાઈ અવેજીની વસ્તુ ઉપર આધાર રાખે છે. અવેજીની વસ્તુ બે પ્રકારની હોય છે:

## (1) નજીકની અવેજીની વસ્તુ:

કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જે એકબીજાની ખૂબ જ નજીકની અવેજીની વસ્તુ હોય. જેમ કે, ચા અને કોઝી, ધર્ત અને ચોખા, બાજરી અને જુવાર વગેરે. એટલે કે આ વસ્તુઓ એવી છે કે જો એક વસ્તુના ભાવમાં મોટો ફેરફાર થાય તો બીજી વસ્તુની માંગ ઉપર તેની અસર પડે છે. દા.ત. કોઝીનો ભાવ ખૂબ જ વધે તો ગ્રાહકો ચાની માંગ વધારે એમ બને. અહીં હરીફાઈનું તત્ત્વ વધારે હોય છે.

## (2) દૂરની અવેજીની વસ્તુ:

કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જેમાં અવેજી હોય છે પણ એ દૂરની હોય છે. જેમ કે, ટ્રૈન, બસ એટલે કે આવી વસ્તુઓ વચ્ચે હરીફાઈ ખૂબ જ ઓછી હોય છે. ઈજારદાર પેઢી જે વસ્તુ ઉત્પન્ન કરે છે તેની અવેજીમાં કેવી વસ્તુ ઉત્પન્ન થાય છે તેના ઉપર તેના ઈજારાનો આધાર હોય છે. જો નજીકની અવેજીની વસ્તુ પ્રાપ્ય હોય તો ઈજારદાર ખૂબ વધારે ભાવ વધારી શકતો નથી. પરંતુ જો દૂરની અવેજીની વસ્તુ બજારમાં પ્રાપ્ય હોય તો તેને ભાવ વધારવામાં આસાની રહે છે. મોટે ભાગે ઈજારદાર પેઢી માટે નજીકની અવેજીની વસ્તુનો બજારમાં અભાવ હોય છે. કોઈ અવેજીની વસ્તુ હોય જ નહિ તો તેને શુદ્ધ ઈજારો કહેવાય. એટલે કે તેવા સમયે તે ભાવ વધારે તો માંગ ઉપર ખૂબ જ ઓછી અસર પડે છે. આમ, બે તારણો નીકળી શકે છે.

- (1) જો નજીકની અવેજીની વસ્તુ ઈજારદાર પેઢી માટે પ્રાપ્ય હોય તો તે પોતાની વસ્તુના ભાવ પર ઓછો અંકુશ ધરાવે છે. કારણ કે તે જો ભાવ ખૂબ વધારે તો ગ્રાહક આસાનીથી અવેજીની વસ્તુ ખરીદી લે છે.
- (2) જો દૂરની અવેજીની વસ્તુ બજારમાં પ્રાપ્ય હોય તો ઈજારદાર પેઢી ભાવ વધારે તો તેની માંગ ઉપર બહુ અસર થતી નથી. એટલે તેને ભાવ વધારવામાં થોડી આસાની રહે છે. એટલે તેને ભાવ વધારવામાં થોડી આસાની રહે છે. એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા શૂન્યથી વધારે નજીક રહે.
- (3) જો દૂરની કે નજીકની બેમાંથી એકેય અવેજીની વસ્તુ ના હોય તો ઈજારદાર પેઢી પુરવઠા ઉપર અને ભાવ ઉપર સંપૂર્ણ અંકુશ ધરાવે છે અને તેથી તે ભાવમાં ખાસ્સો વધારો કરે તો પણ માંગ ઉપર અત્યંત ઓછી અસર થાય છે અથવા બિલકુલ થતી નથી. આવા ડિસ્સામાં ઈજારદાર પેઢી દ્વારા ઉત્પન્ન થતી વસ્તુની પ્રતિમૂલ્ય સાપેક્ષતા શૂન્ય હોય છે.  
જહાં ડી. સમર શુદ્ધ ઈજારા (Pure Monopoly) માટે એમ કહે છે કે તેમાં પેઢીની માંગની મૂલ્ય સાપેક્ષતા શૂન્ય જ હોય છે. જો એવું હોય તો માંગ રેખા OY ધરીને સમાંતર એટલે કે લંબરૂપ હોય. પિયેરો સાફા સ્થિતિને સંપૂર્ણ ઈજારો (Absolute Monopoly) તરીકે ઓળખાવે છે.

### (3) પ્રવેશબંધી:

ઈજારાની સ્થિતિમાં આ એક નોંધપાત્ર લક્ષણ જોવા મળે છે. ઈજારો ચાલુ રહે તે માટે આ શરતનું પાલન જરૂરી છે. ઈજારદાર પેઢી જે વસ્તુ ઉત્પન્ન કરતી હોય એ જ વસ્તુ ઉત્પન્ન કરવા માટે બજારમાં બીજી કોઈ પેઢી પ્રવેશી શકતી

નથી. જો બીજી પેઢીઓ પ્રવેશી શકતી હોય તો હરીકાઈ ઊભી થાય અને ઈજારો તૂટી જાય. આવી પ્રવેશબંધી જુદી જુદી રીતે ઊભી થઈ શકે છે.

- (1) પેટન્ટ, કોપીરાઇટ વગેરે: નવી શોખ કે નવું સંશોધન કરીને બજારમાં નવી જ વસ્તુ ઉત્પન્ન કરનાર પેઢીને સરકાર પેટન્ટ (Patent) એટલે કે એકાધિકાર આપે છે. જેને આવો પેટન્ટ અપાય છે તે પેઢી જ સમયના અમુક ગાળા સુધી તે વસ્તુનું ઉત્પાદન કરી શકે છે અને બીજી કોઈ પેઢી તે વસ્તુનું ઉત્પાદન કરી શકતી નથી. એ જ રીતે પુસ્તકો, ટેપ, સીડી, વીસીડી વગેરેના કોપીરાઇટ પણ સરકાર દ્વારા અપાય છે અને તેથી ઈજારા ઊભા થાય છે.
- (2) કાયદા દ્વારા ઈજારાનું સર્જનઃ સરકાર કાયદા દ્વારા અમુક વસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન પોતે જ કરે છે અને પોતાના ઈજારા ઊભા કરે છે. જેમ કે, ભારતમાં અત્યારે અણુ ઊર્જાનું ઉત્પાદન 2010 સુધી ખાનગી કંપનીઓ કરી શકતી નહોતી અથવા ખાનગી કંપનીઓ ટ્રેનો દોડાવી શકતી નથી.
- (3) ઈજારદારનો અંકુશઃ ઈજારદાર પેઢી જે વસ્તુનું ઉત્પાદન કરે છે તે વસ્તુના ઉત્પાદનમાં વપરાતા કાચા માલ (Raw Materials) ઉપર પણ તે અંકુશ ધરાવે છે. જેથી બીજી કોઈ પેઢી તેવી જ વસ્તુનું ઉત્પાદન કરી શકતી નથી. જેમ કે OPEC (Organization of Petroleum Exporting Countries) પેટ્રોલિયમ પેદાશોના ઉત્પાદનમાં ઈજારો ધરાવે છે.

ઈજારમાં એ બાબત ખૂબ જ અગત્યની છે કે ઈજારદાર પેઢી એ વસ્તુની કિંમત અથવા તો વસ્તુના પુરવઠા ઉપર નિયંત્રણ રાખી શકે. જો કે, કોઈપણ ઈજારદાર પેઢી હંમેશાં એક સાથે વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા ઉપર અંકુશ ધરાવતી નથી. એટલે જે ઈજારદાર પેઢીની માંગ રેખા સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ નથી હોતી, પણ મૂલ્ય અનપેક્ષ હોય છે.

#### 6.4 ઈજારામાં પેઢીની આવકના ખ્યાલો:

કોષ્ટક 6.2 માં ઈજારામાં પેઢીની આવકની અનુસૂચિ દર્શાવી છે.


કોષ્ટક 6.2 ઈજારામાં પેઢીની આવક.

ઉત્પાદન (Q)	કિંમત = સરેરાશ આવક (ર) (AR)	કુલ આવક (ર) (TR)	સીમાંત આવક (ર) (MR)
1	12	12	12
2	11	22	10
3	10	30	8
4	9	36	6
5	8	40	4
6	7	42	2
7	6	42	0
8	5	40	-2
9	4	36	-4

સમજૂતી :

- (1) જેમ જેમ કિંમત ઘટતી જાય છે તેમ તેમ કુલ આવક વધતી જાય છે. પરંતુ કોઠામાં જણાવાયા અનુસાર તે ઉત્પાદનના છઙ્ગા અને સાતમા એકમે સ્થિર થઈ જાય છે કે જ્યારે કિંમત રૂ. 7 અને રૂ. 6 છે. કુલ આવક તે સમયે રૂ.42 જેટલી સ્થિર છે.
- (2) કુલ આવક મહત્તમ બને છે ત્યારે સીમાંત આવક શૂન્ય થાય છે. કુલ આવક સાતમા એક પદ્ધી ઘટે છે ત્યારે સીમાંત આવક જ્ઞાણ બને છે.
- (3) છઙ્ગા એકમ સુધી સીમાંત આવક ઘટે છે, સાતમા એકમે તે શૂન્ય બને છે અને પદ્ધી તે જ્ઞાણ બને છે.

આકૃતિ 6.1 ઈજારામાં પેઢીની સીમાંત આવક સરેરાશ આવક અને કુલ આવક રેખાઓ.



આકૃતિમાં દર્શાવાયા મુજબ ઈજારા માટે સીમાંત ખર્ચ રેખા (MR) એ સરેરાશ ખર્ચ રેખા (AR) ની નીચે આવેલી હોય છે. એટલે કે કિંમત ઘટતાં AR કરતાં MR માં ઝડપી ઘટાડો થાય છે. AR એ ઈજારદાર પેઢીની માંગ રેખા છે. આકૃતિમાં દર્શાવાયા મુજબ ઈજારદાર પેઢી માટે સરેરાશ આવક રેખા અને સીમાંત આવક રેખા બંને ઝડપા ટાળ ધરાવે છે. તે એમ દર્શાવે છે કે જો પેઢીને ઉત્પાદન કે વેચાણ વધારવું હોય તો કિંમત ઘટાડવી પડે છે.

- (1) શરૂઆતમાં જ્યારે કિંમત ઘટાડવામાં આવે છે ત્યારે સીમાંત આવક અને સરેરાશ આવક ઘટે છે પરંતુ કુલ આવક વધતી જાય છે, જે TR દર્શાવે છે. આ સમયે પેઢી કિંમત ઘટાડી વધુ ઉત્પાદન કે વેચાણ કરવાનો પ્રયત્ન કરે છે.
- (2) અમુક સમય પછી કુલ આવક મહત્વમાં બને છે. તે C બિંદુ દર્શાવે છે. તે એમ પણ દર્શાવે છે કે પેઢીની કુલ આવક મહત્વમાં થાય છે ત્યારે સીમાંત આવક શૂન્ય બને છે.
- (3) જો પેઢી હજુ પણ કિંમત ઘટાડી ઉત્પાદન વધારવાનો નિષિદ્ધ કરે તો તેની કુલ આવક ઘટે છે તથા સીમાંત આવક ઝડપા થાય છે. આથી પેઢી મહત્વમાં આવક પ્રાપ્ત થાય ત્યાર બાદ કિંમત ઘટાડી વધુ ઉત્પાદન કે વેચાણ કરશે નહીં.

- (4) આકૃતિમાં દર્શાવા મુજબ A બિંદુના ઉપરના ભાગમાં માંગની મૂલ્ય સાપેક્ષતા એક કરતાં વધે છે. ( $ed > 1$ ) આ સંઝોગોમાં કિંમત ઘટતાં કુલ આવક વધે છે. જે O થી C સુધીનો ભાગ દર્શાવે છે.
- (5) A બિંદુ પાસે માંગની મૂલ્ય સાપેક્ષતા એક છે. ( $ed = 1$ ) A એ AR રેખાનું મધ્ય બિંદુ છે. આ સમયે કુલ આવક મહત્વામાં હોય તથા સીમાંત આવક શૂન્ય છે.
- (6) A બિંદુથી નીચેના ભાગમાં માંગની મૂલ્ય સાપેક્ષતા એક કરતાં ઓછી છે. ( $ed < 1$ ). આ સંઝોગોમાં કિંમત ઘટતાં કુલ આવક ઘટે છે. તથા સીમાંત આવક ઋણ થાય છે કે જે C થી K સુધીનો ભાગ દર્શાવે છે.

સરેરાશ આવક ( $AR = P$ ), સીમાંત આવક અને માંગની મૂલ્ય સાપેક્ષતા વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે.

$$MR = P \left(1 \frac{1}{ed}\right)$$

$$MR = AR \left(1 \frac{1}{ed}\right) \quad (AR = P)$$

જ્યાં,  $MR = \text{સીમાંત આવક}$

$AR = \text{સરેરાશ આવક} = \text{કિંમત} = P$

$ed = \text{માંગની મૂલ્ય સાપેક્ષતા}$

MR, AR અને ed વચ્ચેનો આ સંબંધ ગાળિતક પદ્ધતિ દ્વારા સાબિત કરવામાં આવે છે.

### 6.5 ઇજારામાં ટ્રેકા ગાળામાં પેઢીની સમતુલ્યા :


ઇજારદાર પેઢીનો ઉદ્દેશ મહત્વમાં નફો અથવા લઘુત્તમ ખોટનો હોય છે.

જ્યારે નીચેની શરતોનું પાલન થાય ત્યારે તે સમતુલ્યામાં આવે છે તેમ કહેવાય.

1. જ્યારે સીમાંત આવક અને સીમાંત ખર્ચ સમાન થાય.


2. સીમાંત ખર્ચ વધતું હોય.

(1) ઉત્પાન ખર્ચ શૂન્ય હોય ત્યારે પેઢીની સમતુલ્યા.



જો ઉત્પાદન ખર્ચ શૂન્ય હોય ત્યારે પેઢી જે પણ મેળવે છે તે તમામ અસામાન્ય નફો હોય છે. આકૃતિમાં  $OX$  ધરી પર ઉત્પાદન પ્રમાણ અને  $OY$  ધરી પર આવક અને ખર્ચ દર્શાવવામાં આવ્યાં છે. આકૃતિમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ શૂન્ય છે.  $Q$  બિંદુએ સી.આ.= સી.ખ. થતાં પેઢી  $O$  જેટલું ઉત્પાદન કરે છે. અને  $OP$  જેટલી કિંમત નક્કી કરે છે. ત્યારે  $OPMQ$  જેટલો કુલ અસામાન્ય નફો પ્રાપ્ત થાય છે.

(3) જો ઉત્પાદન ખર્ચ વધતું હોય તો...




આકૃતિ Q બિંદુએ  $MR = MC$  થતાં પેઢી OM ઉત્પાદન કરે છે. OM ઉત્પાદને પેઢીની કુલ આવક OBCM છે જ્યારે કુલ ખર્ચ OADM છે. અહીં કુલ ખર્ચ કરતાં કુલ આવક વધુ હોવાથી પેઢી અસામાન્ય નફો પ્રાપ્ત કરે છે.

$$\begin{aligned}
 \text{અસામાન્ય નફો} &= TR - TC \\
 &= OBCM - OADM \\
 &= \square ABCD \\
 \text{સરેરાશ નફો} &= AR - AC \\
 &= OB - OA = AB
 \end{aligned}$$

અથવા

$$CM - DM = CD \text{ થાય}$$

(3) ઉત્પાન ખર્ચ ઘટતું હોય તો ...




આકૃતિ Q બિંદુએ  $MR = MC$  થતાં પેઢી OM ઉત્પાદન એ છે. OM ઉત્પાદને પેઢીની કુલ આવક OBCM છે જ્યારે કુલ ખર્ચ OADM છે. અહીં કુલ ખર્ચ કરતાં કુલ આવક વધુ હોવાથી પેઢી અસામાન્ય નફો પ્રાપ્ત કરે છે.

$$\begin{aligned}
 \text{અસામાન્ય નફો} &= TR - TC \\
 &= OBCM - OADM \\
 &= \square ABCD \\
 \text{સરેરાશ નફો} &= AR - AC \\
 &= OB - OA = AB
 \end{aligned}$$

અથવા

$$CM - DM = CD \text{ થાય}$$



આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પેઢી સ્થિર ખર્ચના નિયમ હેઠળ કામ કરે છે. આથી સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા થશે. પરિષામે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચની રેખા આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પાયાને સમાંતર રહેશે.

OM ઉત્પાદને સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા થાય છે. OS એકમદીઠ કિંમત છે. QM સરેરાશ ખર્ચ અને MR સરેરાશ આવક છે. તેથી તે બંને વચ્ચેનો તરફાર PQRS ઈજારદારને મળતો કુલ નક્કો છે.

## 6.6 ઈજારાયુક્ત હરીફાઈનો અર્થ અને તેના લક્ષણો:

ઇજારાયુક્ત હરીફાઈનો ઘ્યાલ સૌ પ્રથમ 1933 માં શ્રીમતી જોન રોબીન્સને તેમના પુસ્તક 'Economics of Imperfect Competition' અને એડવર્ડ એચ. યેભાલિને તેમના પુસ્તક 'The Theory of Monopolistic Competition' આપ્યો. ઇજારાયુક્ત હરીફાઈનાં મુખ્ય લક્ષણો નીચે મુજબ છે.

## (1) અનેક પેઢી:-

ઈજારાયુક્ત હરીફાઈમાં ઉત્પાદક પેઢીઓ મોટી સંખ્યામાં હોય છે. અહીં ઉત્પાદક પેઢીઓ જે વસ્તુ ઉત્પન્ન કરે છે તે વસ્તુઓ એકબીજાની નજીકની અવેજી વસ્તુઓ છે. કોઈપણ ઉત્પાદક પેઢી એટલી બધી મોટી નથી કે તે બજારના એકંદર ભાવ ઉપર અસર કરી શકે. એટલે કે વસ્તુના ભાવ ઉપર કોઈપણ ઉત્પાદક પેઢી નિયંત્રણ ધરાવતી નથી. તેનો અર્થ એ થાય કે કોઈ એક પેઢી પોતાના ઉત્પાદન અને ભાવો અંગે જે નિર્ણય લે છે તેની અસર બીજી પેઢીઓ ઉપર પડે જ છે. અહીં દરેક પેઢી ઈજારો તો ભોગવે જ છે પરંતુ બીજી પેઢીઓ સાથે તે તીવ્ર સ્પર્ધામાં છે. અહીં ઈજારામાં એક જ પેઢી હોય છે તેના કરતાં વધારે પેઢીઓ હોય છે અને પૂર્ણ હરીફાઈમાં હોય છે તેના કરતાં ઓછી પેઢીઓ હોય છે.

## (2) વસ્તુ વિકલન (Product Differentiation):

ઈજારામાં એક જ પેઢી હોય છે. તેથી તેના દ્વારા ઉત્પન્ન થતી વસ્તુની અવેજી વસ્તુ ભજારમાં હોતી નથી. જ્યારે પૂર્ણ હરીફાઈમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સમરૂપ હોય છે. ઈજારાયુક્ત હરીફાઈમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સમરૂપ નથી પરંતુ એકબીજાની નજીકની અવેજી વસ્તુઓ છે. અહીં વસ્તુઓ વિવિધ પ્રકારની (Heterogeneous) હોય છે. એટલી વસ્તુઓ એકબીજાથી જુદી હોય તેટલું ઈજારાનું તત્ત્વ વધુ હોય છે. વળી, દરેક પેઢી પોતાના ઈજારાનું તત્ત્વ ચાલુ રાખવા પ્રયત્નશીલ રહે છે. જો વસ્તુ એકબીજાની ખૂબ જ નજીકની અવેજી હોય તો સ્પર્ધા વધારે અને જો નજીકની અવેજની વસ્તુઓ ન હોય તો સ્પર્ધા ઓછી. આમ, ઈજારાયુક્ત હરીફાઈમાં વેચાતી વસ્તુઓ બિસ બિસ હોય છે. પરંતુ એકબીજાની નજીકની અવેજી વસ્તુઓ હોય છે. તેને વસ્તુ વિકલન કહે છે. એટલે કે દરેક પેઢીની વસ્તુ રૂપ, રંગ, આકાર, કદ, ગુણવત્તા, પેકિંગ વગેરેની દસ્તિએ જુદી જુદી હોય છે.

આ વસ્તુઓ તેમની ડિઝાઇન, નામ, ડિલિવરીની પદ્ધતિ વગેરે જેવી બાબતોમાં પણ બીજી વસ્તુઓ કરતાં જુદી પડે છે. આથી પોતાની વસ્તુના ભાવ ઉત્પાદક પોતે જ નક્કી કરે છે. જ્યારે ગ્રાહક કોઈક ચોક્કસ પેઢીની જ વસ્તુ ખરીદવાનો વિચાર કરે છે ત્યારે ગ્રાહક પેઢીની પસંદગી કરતો હોય છે. અહીં ગ્રાહકનાં આત્મલક્ષી વલણો ખૂબ જ મહત્વનાં બને છે. જો ગ્રાહકની અભિસૂચિ કોઈ એક પેઢીની પેદાશ અંગે વધુ કેળવાય તો તેની માંગ મૂલ્ય અનપેક્ષ બને છે. એટલે કે તેની કિંમત વધવા છતાં પણ માંગમાં ઓછો ઘટાડો થશે. ઘણી વખત એવું બને છે કે બે વસ્તુઓ સરખી જ હોય પરંતુ બીજી વસ્તુ કરતાં ચઢિયાતી ગણે તો તે પેઢીની વસ્તુની કિંમત વધુ હોવા છતાં પણ તે ખરીદશે. અહીં વસ્તુના ભૌતિક ગુણધર્મો કરતાં ગ્રાહકના માનસિક કે કાલ્યનિક કે આત્મલક્ષી વલણો મહત્વનાં બને છે.

વસ્તુ વિકલનનાં અનેક ઉદાહરણો આપી શકાય:

- (1) સાબુ બનાવનારી દરેક કંપનીનો સાબુ બીજી કંપનીના સાબુ કરતાં જુદો હોય છે. રંગ, સુગંધ, ગુણવત્તા વગેરે બાબતોમાં તે અલગ અલગ હોય છે. એટલું જ નહિ, દરેક સાબુની જાહેર ખબર જુદી જુદી હોય છે અને તેમાં જુદા જુદા અભિનેતા કે અભિનેત્રીઓ કે મોડેલ દેખા દે છે.
- (2) પંખા બનાવનારી દરેક કંપનીનો પંખો તેના દેખાવ, રંગ, ડિઝાઇન અને ગુણવત્તાની બાબતમાં અલગ હોય છે.

આ બંને કિસ્સામાં સાખુ કે પંખા બનાવનારી કંપનીઓ તેમના પોતાના સાખુ કે પંખાની બાબતમાં ઈજારો ધરાવે છે પણ તેમણે બીજી સાખુ કે પંખા બનાવનારી કંપનીઓ સા�ે હરીફાઈ તો કરવી જ રહે છે. આ હરીફાઈ ભાવ, ગુણવત્તા વગેરેની બાબતમાં હોય છે.

### (3) વસ્તુની કિંમત ઉપર આંશિક નિયંત્રણ:

ઈજારાયુક્ત હરીફાઈમાં ઉત્પત્તિ થતી વસ્તુઓ એકબીજાની નજીકની અવેજી વસ્તુઓ હોય છે. જો કોઈ ઉત્પાદક પેઢી વસ્તુના ભાવ ઘટાડે તો ગ્રાહકો તે પેઢીની વસ્તુ વધુ ખરીદશે. કારણ કે તેની નજીકની અવેજી વસ્તુ કરતાં તો ભાવ ઓછા છે. એ જ પ્રમાણે જો ઉત્પાદક પેઢી ભાવ વધારે તો ગ્રાહકો તે પેઢીની વસ્તુ ઓછી ખરીદશે. કારણ કે તેની નજીકની અવેજી વસ્તુ કરતાં તેના ભાવ વધારે છે. ઈજારાયુક્ત હરીફાઈમાં પેઢી કિંમત સ્વીકારનાર (Price Taker) નથી પરંતુ પોતાની વસ્તુની કિંમત ઉપર આંશિક નિયંત્રણ ધરાવે છે, સંપૂર્ણ નિયંત્રણ નહિ.

દા.ત. સફેદ રંગનો પંખો બનાવનારી કંપની તેમાં ઈજારો ધરાવે છે અને તે તેનો ભાવ રૂ.1,500 રાખે છે. કોઝી રંગનો પંખો બનાવનારી કંપની તેમાં ઈજારો ધરાવે છે અને તે તેનો ભાવ રૂ.1,700 રાખે છે. બંને પોતપોતાના ઉત્પાદનમાં ઈજારો ધરાવે છે પણ બંને વચ્ચે હરીફાઈ પણ છે. એટલે કોઝી રંગના પંખાના ઉત્પાદક તેના પંખાનો ભાવ રૂ. 2,500 રાખી શકે નહિ. જો તે એમ કરે તો જે ગ્રાહકોને કોઝી રંગનો પંખો ગમે છે તેઓ પણ માત્ર રંગને કારણે રૂ.1,000 ની વધુ કિંમત આપવા તૈયાર થાય નહિ. એટલે તેણે રૂ.1,700 માં જ કોઝી રંગનો પંખો વેચવો પડે. આમ, ઈજારાયુક્ત હરીફાઈમાં પેઢી ભાવ ઉપર સંપૂર્ણ અંકુશ ધરાવતી નથી, પણ આંશિક અંકુશ ધરાવે છે.

### (4) મુક્ત પ્રવેશ અને વિદાય:

પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુઓ સમરૂપી છે આથી ઉદ્યોગ શરૂ વાપરવામાં આવે છે. પ્રો.ચેમ્બરલિન અહીં ‘ઉદ્યોગ’ (Industry) ને બદલે ‘જૂથ’ (Group) શરૂ વાપરે છે. આવા જૂથમાં પેઢીઓની સંખ્યા બદલાતી રહે છે. તેની અસર પેઢીના નફા ઉપર પડે છે. જ્યારે પેઢી ટૂંકા ગાળામાં અસામાન્ય નફો કમાય છે ત્યારે નવી પેઢીઓ જૂથમાં પ્રવેશે છે, કે જેથી ઉત્પાદનમાં વધારો થાય છે. આમ, લાંબે ગાળે વસ્તુના ભાવ ઘટે છે. અહીં અન્ય પેઢીઓનો નફો વસ્તુ વિકલનને લીધે જળવાઈ રહે છે. ઈજારાયુક્ત હરીફાઈમાં પેઢીઓની આવ-જા ચાલુ જ રહે છે. કોઈ વસ્તુ કે સેવા ઉત્પાદનમાં તેમના પ્રવેશ ઉપર કોઈ અંકુશ હોતો નથી. જે પેઢીને દાખલ થવું છે તે દાખલ થઈ શકે છે અને જેને જવું હોય તે જઈ પણ શકે છે. પેઢીઓ પોતાનો નફો વધારવા કે વેચાણ વધારવા માટે ત્રણ રીતો અપનાવે છે.

- (1) વેચાણ ખર્ચ કરે છે.
- (2) ઉત્પાદન થતી વસ્તુની ગુણવત્તા બદલે છે.
- (3) કિંમતમાં ફેરફાર કરે છે.

પ્રો. ચેમ્બરલિન એમ જણાવે છે કે પેઢી ભાવ અને ઉત્પાદનમાં ફેરફાર કરીને પોતાનું વેચાણ અને તેના દ્વારા નફો વધારવાની મર્યાદિત શક્તિ ધરાવે છે.

### (5) વેચાણ ખર્ચ:

વસ્તુનું વેચાણ વધારવા કે પછી વેચાણ કરવા માટે કરવામાં આવતું ખર્ચ એ વેચાણ છે. વેચાણ ખર્ચ એ ઈજારાયુક્ત હરીફાઈનું એક મહત્વનું લક્ષણ છે. ઉત્પાદક પેઢી ગ્રાહકને પોતાની વસ્તુ તરફ આકર્ષવા માટે આ ખર્ચ કરે છે. વેચાણ ખર્ચ કરવાનો મુખ્ય હેતુ ગ્રાહકની પસંદગી ઉપર અસર પાડવાનો હોય છે. વેચાણ ખર્ચ એ વસ્તુની માંગ અને ઉત્પાદન ખર્ચ બંને ઉપર અસર પાડે છે. એટલે કે વેચાણ ખર્ચ દ્વારા ઉત્પાદક પેઢી પોતાની વસ્તુ માટેની માંગ ઊભી કરે છે. વેચાણ ખર્ચ અનેક સ્વરૂપે થાય છે. જેમ કે રેડિયો, ટીવી, છાપા, પોસ્ટરો વગેરે ઉપર જાહેર ખબરો આપીને વેચાણ ખર્ચ કરવામાં આવે છે.

ઉત્પાદક પેઢી જેમ પોતાનો નફો મહત્વમાં કરવા માટે વસ્તુની કિંમત અને ઉત્પાદન નક્કી કરે છે તેમ વસ્તુનું વેચાણ ખર્ચ પણ નક્કી કરે છે. ઉત્પાદન ખર્ચ એ વસ્તુ કે સેવા ઉત્પન્ન કરવાનું ખર્ચ છે, જ્યારે વેચાણ ખર્ચ એ વસ્તુની માંગ ઉત્પન્ન કરવાનું ખર્ચ છે. ઉત્પાદન ખર્ચ માંગ રેખા ઉપર સીધી ઓરંગ કરતું નથી જ્યારે વેચાણ ખર્ચ માંગ રેખા પર સીધી અસર કરે છે. વેચાણ ખર્ચની અસરથી ઘણી વાર ગ્રાહકો એક વસ્તુની માંગ ઘટાડી બીજી વસ્તુની માંગ કરવા પણ પ્રેરાય છે અથવા નવી જ માંગ ઊભી કરવા પ્રેરાય છે. ઉત્પાદન ખર્ચથી વસ્તુ કે સેવા ઉત્પન્ન થાય છે અને એ રીતે તે તુષ્ટિગુણનું સર્જન કરે છે જ્યારે વેચાણ ખર્ચ માંગનું સર્જન કરે છે. ઘણી વખત ઉત્પાદન ખર્ચ અને વેચાણ ખર્ચમાં તફાવત કરવો અધરો થઈ પડે છે. ખાસ કરીને પેકિંગ તુષ્ટિગુણ અને માંગ બત્તે સર્જે છે. પ્રો. ચેમ્બરલિન એમ જણાવે છે કે, “પેકિંગ સિવાય પણ વસ્તુની માંગ હતી જ, આકર્ષક પેકિંગથી માંગ વધે છે.” આમ જે ખર્ચ દ્વારા માંગને અનુરૂપ વસ્તુ બનાવાય તે ઉત્પાદન ખર્ચ છે. જે ખર્ચ દ્વારા માંગને વસ્તુને અનુરૂપ બનાવાય તે વેચાણ ખર્ચ છે. સ્પષ્ટ છે કે ઉત્પાદન ખર્ચની અસર વસ્તુના પુરવઠા પર પડે છે અને વેચાણ ખર્ચની અસર વસ્તુની માંગ ઉપર પડે છે.

### 6.7 ઈજારાયુક્ત હરીફાઈમાં ટ્રેકાગાળામાં પેઢીની સમતુલ્ય :


ઇજારાયુક્ત હરીફાઈમાં પેઢીનો ઉદ્દેશ મહત્વમાં નફો અથવા લઘુત્તમ ખોતનો હોય છે. જ્યારે નીચેની શરતોનું પાલન થાય ત્યારે તે સમતુલ્યમાં આવે છે તેમ કહેવાય.

3. જ્યારે સીમાંત આવક અને સીમાંત ખર્ચ સમાન થાય.
4. સીમાંત ખર્ચ વધતું હોય.

અસમાન્ય નફો:

જ્યારે દ્રોગ ગાળામાં પેઢીની કુલ આવક તેના કુલ ખર્ચ કરતાં વધુ હોય ત્યારે તે અસમાન્ય નફો કમાય છે તેમ કહેવાય. આકૃતિ 6.5માં તે દર્શાવ્યું છે.

આકૃતિ 6.5: ઈજારાયકત હરીફાઈમાં અસમાન્ય નફો



આકૃતિમાં X-અક્ષ ઉપર વસ્તુનો જથ્થો અને Y-અક્ષ ઉપર આવક અને કિંમત દર્શાવ્યા છે.


1. AR અને MR અનુક્રમે પેઢીની સરેરાશ અને સીમાંત આવક દર્શાવે છે જ્યારે AC અને MC એ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ દર્શાવે છે.
2. E એ સમતુલાનું બિંદુ છે કારણ કે સીમાંત ખર્ચ અને સીમાંત આવક સમાન થાય છે અને સીમાંત ખર્ચ વધતું છે. આ બિંદુ એ પેઢી OQ જેટલું ઉત્પાદન કરે છે અને વસ્તુની કિંમત OP છે.
3. પેઢીની કુલ આવક (TR) = કિંમત X વસ્તુના એકમો = OP X OQ = OPKQ થાય.
4. પેઢીનું કુલ ખર્ચ (TC) = સરેરાશ ખર્ચ X વસ્તુના એકમો = OC X OQ = OCJQ થાય.
5. અહીં પેઢીનું સરેરાશ ખર્ચ તેની સરેરાશ આવક કરતાં ઓછું છે અને આથી પેઢી દ્રોગ ગાળામાં અસમાન્ય નફો કમાય છે તેમ કહેવાય.

$$6. પેઢી નક્કો (\pi) = કુલ આવક - કુલ ખર્ચ = OPKQ - OCJQ = PCJK$$

ઓટ:

દ્રોકા ગાળામાં પેઢીનું કુલ ખર્ચ જ્યારે તેની કુલ આવક કર્તા વધુ હોય ત્યારે તેને ઓટ જાય છે. આકૃતિ 6.6માં તે દર્શાવ્યું છે.


આકૃતિ 6.6: ઈજારાયુક્ત હરીકાઈમાં ઓટ



આકૃતિમાં X-અક્ષ ઉપર વસ્તુનો જથ્થો અને Y-અક્ષ ઉપર આવક અને કિંમત દર્શાવ્યા છે.

1. AR અને MR અનુક્રમે પેઢીની સરેરાશ અને સીમાંત આવક દર્શાવે છે જ્યારે AC અને MC એ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ દર્શાવે છે.
2. E એ સમતુલ્યાનું બિંદુ છે કારણે કે સીમાંત ખર્ચ અને સીમાંત આવક સમાન થાય છે અને સીમાંત ખર્ચ વધતું છે. આ બિંદુ એ પેઢી OQ જેટલું ઉત્પાદન કરે છે અને વસ્તુની કિંમત OP છે.
3. પેઢીની કુલ આવક (TR) = કિંમત X વસ્તુના એકમો = OP X OQ = OPHQ થાય.
4. પેઢીનું કુલ ખર્ચ (TC) = સરેરાશ ખર્ચ X વસ્તુના એકમો = OF X OQ = OFJQ થાય.


5. અહીં પેઢીનું સરેરાશ ખર્ચ તેની સરેરાશ આવક કરતાં છે અને આથી પેઢી દ્રકા ગાળામાં ખોટ જાય છે તેમ કહેવાય.
6. ખોટ કુલ ખર્ચ - કુલ આવક =  $OFJQ - OPHQ - FPHJ$
7. અહીં પુષ્ટ એ ઉભો થાય કે જો પેઢી ખોટ ખાય છે તો શું તે ઉત્પાદન ચાલુ રાખે કે બંધ કરે? જો કિંમત પેઢીના સરેરાશ અસ્થિર ખર્ચ કરતાં વધુ હોય તો પેઢી ઉત્પાદન ચાલુ રાખે અને જો કિંમત તેના સરેરાશ અસ્થિર ખર્ચ કરતાં ઓછી હોય તો પેઢી ઉત્પાદન બંધ કરે.



#### ઉત્પાદન પ્રમાણ

ઉપરોક્ત આકૃતિમાં  $OX$  ધરી પર ઉત્પાદન પ્રમાણ અને  $OY$  ધરી પર ખર્ચ આવક અને કિંમત દર્શાવવામાં આવેલ આકૃતિમાં  $Q$  બિંદુને સીમાન્ત આવક = સીમાંત ખર્ચ થાય છે. આવી પેઢી  $OM$  એકમો ઉત્પાદન કરશે. અહીં પેઢી વસ્તુના  $M$  એકમોનું વેચાણ  $RM$  ભાવે કરે છે. અહીં પેઢીનું સરેરાશ ખર્ચ અને સરેરાશ આવક પર  $RM$  જેટલા છે એટલે કે અહીં પેઢીને સામાન્ય નકો પ્રામ થાય છે અને પેઢી સમતુલા પ્રામ કરે છે.

### આકૃતિ 6.7: વેચાણ ખર્ચની માંગ ઉપર અસર



ઈજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં કોઈ પેઢી જાહેર ખબર આપે તો પેઢીની વસ્તુની માંગ રેખાનું સ્થાન જ બદલાઈ જાય છે. આ બાબત આકૃતિ 6.7 માં સમજવવામાં આવી છે. વસ્તુની કિંમત સ્થિર રહે અને છતાં માંગમાં વધારો થાય તો તેને માંગના વધારા તરીકે ઓળખવામાં આવે છે. વેચાણ ખર્ચને લીધે આવી પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે. આકૃતિમાં OX ધરી પર X વસ્તુના એકમો QX અને OY ધરી ઉપર X વસ્તુનો ભાવ દર્શાવાયા છે. વેચાણ ખર્ચ પહેલાંની માંગ રેખા CD છે કે જ્યાં G બિંદુએ માંગ OI જેટલી છે. વેચાણ ખર્ચ થવાથી માંગ રેખા જમણી બાજુ ખસે છે અને નવી માંગ રેખા મળે છે. નવી માંગ રેખા EF છે કે જેના ઉપર H બિંદુએ માંગ OJ છે. જૂની માંગ રેખા CD ઉપર ભાવ GI અથવા OA હતો. નવી માંગ રેખા ઉપર ભાવ HJ અથવા OA જેટલો જ છે અને છતાં માંગ IJ જેટલી વધે છે. આમ, વેચાણ ખર્ચની અસર IJ જેટલી થાય છે.

---


### 6.8 વેચાણ ખર્ચનો ઘ્યાલ:

---

અગાઉ જોયું તે પ્રમાણે વેચાણ ખર્ચ કે વિજ્ઞાપન ખર્ચ કરીને ઈજારાયુક્ત બજારની પેઢીઓ ગ્રાહકોને પોતાના તરફ આકર્ષવાનો પ્રયત્ન કરે છે. તેઓ ગ્રાહકોને જુદી જુદી રીતે આકર્ષે છે. તેઓ એમ કહે છે કે વસ્તુ નવી છે, આધુનિક ટેક્નોલોજી દ્વારા ઉત્પન્ન થઈ છે અથવા તેની ગુણવત્તા સારી છે કે પછી વસ્તુના ભાવ ઘટાડવામાં આવ્યા છે. ઘણી પેઢીઓ પોતાની


વस्तु સાથે કોઈક વસ્તુની ભેટ આપવાની જાહેરાત પણ કરે છે અથવા બીજી કેટલીક લાલચો પણ આપે છે. આમ, જાહેર ખબરો દ્વારા પેઢીઓ ગ્રાહકોમાં પોતાની વસ્તુ માટે મજબૂત પસંદગીઓ ઊભી કરવાનો પ્રયત્ન કરે છે. જેમકે, કબાટ તો ગોદરેજનું જ, મોબાઇલ ફોન તો નોકિયાનો જ, આઈસકિમ તો હેવમોરનો જ ખરીદાય એમ ગ્રાહકોના મનમાં ઠસી જાય છે. એ રીતે ગ્રાહકોના મનમાં ઠસી જાય છે. એ રીતે ગ્રાહકોના દિમાગમાં અમુક કંપનીની જ વસ્તુ વાપરવાનું વલણ ઊભું થાય છે અને ઘણી વાર તો એ આખી જિંદગી ટકે છે. આ રીતે પેઢીઓ પોતાની વસ્તુઓ માટેની માંગ ઉપર અસર કરે છે.

### (1) માંગ રેખાના ઉપરનાં ટાળમાં ફેરફાર



આકૃતિમાં DD મૂળ માંગરેખા છે. D,D વેચાણ ખર્ચ પદ્ધીની માંગ રેખા છે. કિંમત OP થી વધીને OP થાય છે. ત્યારે માંગ OM થી ઘટીને OM, થાય છે. પરંતુ વસ્તુની ગુણવત્તાવાળી જાગ કરવામાં આવે તો માંગ OM<sub>2</sub> જેટલી થાય છે. જે પહેલા કરતા ઓછો ઘટાડો બતાવે છે. આમ; વેચાણ ખર્ચને લીધે માંગમાં M, M<sub>2</sub> જેટલો ઓછો ઘટાડો થાય છે.

(2) માર્ગ રેખાના નીચેના ફાળમાં કિરણ.



આકૃતિમાં DD માંગરેખા મુજબ OP કિંમત OM જેટલી માંગ થાય છે. કિંમત વટીને OP થાય છે. ત્યારે માંગ વધીને OM, જેટલી થાય છે. પરંતુ વેચાણ ખર્ચને લીધે કિંમત ઘટાડાની જાણ થવાથી DD, માંગ રેખા મુજબ માંગ OM2 જેટલી થાય છે. આમ; વેચાણ ખર્ચને લીધે માંગમાં M, M2 જેટલો વધુ વધારો થાય છે.

### 6.9 સારાંશ અને ચાવી રૂપ શબ્દો :

અહીં આપણે જોયું કે પૂર્ણ હરીકાઈમાં સમતુલાની સ્થિતિમાં વસ્તુની કિંમત અને પેઢીનું સીમાંત ખર્ચ સમાન હોય છે અને આથી ગ્રાહકનું મહત્તમ કલ્યાણ થાય છે અને આથી પૂર્ણ હરીકાઈ એક આદર્શ બજાર છે. જ્યારે લાંબાગાળે પેઢી સામાન્ય નફો કમાય છે. જ્યારે પેઢી સમતુલમાં હોય છે ત્યારે  $AR = MR = MC = P$  હોય છે.

**ચાવી રૂપ શબ્દો:**

ઇજારો, ઇજારાયુક્ત હરીકાઈ, વસ્તુ વિકલન, અપૂર્ણ હરીકાઈ, વેચાણ ખર્ચ

### 6.10 સ્વાધ્યાય :

નીચેના પ્રશ્નોમાં સાચો વિકલ્પ પસંદ કરો:

1. ઇજારામાં પેઢીની માંગ રેખા-
  - A. રૂણા ઢાળ ધરાવે

- B. ધન ફાળ ધરાવે
- C. X અક્ષને સમાંતર હોય
- D. Y અક્ષને સમાંતર હોય

જવાબ: A

2. ઇજારામાં અસામાન્ય નઝો એટલે-

- A.  $TR = TC$
- B.  $TR > TC$
- C.  $TR < TC$
- D. ઉપરનામાંથી એક પણ નહીં

જવાબ: B

3. ઇજારાયુક્ત હરીફાઈમાં ઢ્રેકાગાળામાં પેઢી સમતુલામાં આવે ત્યારે-

- A. સીમાંત ખર્ચ સ્થિર હોય
- B. સીમાંત ખર્ચ વધતું હોય
- C. સરેરાશ ખર્ચ વધતું હોય
- D. સીમાંત ખર્ચ ઘટતું હોય

જવાબ: D

4. ઇજારામાં ઢ્રેકા ગાળામાં સમતુલા એ-

- A.  $MR = AR = MC = P$
- B.  $P < MR = AR = MC$
- C.  $P < MR = AR$
- D.  $P > MC$

જવાબ: D

5. જ્યારે ઇજારાયુક્ત હરીફાઈમાં પેઢી ઢ્રેકા ગાળામાં ખોટ ખાય ત્યારે

- A. કુલ ખર્ચ કરતાં કુલ આવક વધુ હોય
- B. કુલ ખર્ચ કરતાં કુલ આવક ઓછી હોય
- C. કુલ ખર્ચ અને કુલ આવક સમાન હોય
- D. સરેરાશ ખર્ચ અને સરેરાશ આવક સમાન હોય

જવાબ: B

6. ઇજારાયુક્ત હરીફાઈમાં ઢ્રેકા ગાળામાં ક્યારે પેઢી બજાર છોડી દેશે?

A.  $P < AVC$

B.  $P = AVC$

C.  $P < TC$

D.  $P > TC$

જવાબ: A

7. નીચેનમાંથી કયું ઇજારાયુક્ત હરીફાઈનું લક્ષણ છે?

A.  $MR = AR$

B. વેચાણ ખર્ચ

C. સમાનગુણી વસ્તુઓ

D. માંગ રેખા X-અક્ષને સમાંતર

જવાબ: B

8. વેચાણ ખર્યનો ઉદ્દેશ-

A. માંગ વધારવાનો

B. ઉત્પાદન વધારવાનો

C. માંગ ઘટાડવાનો

D. એક પણ નહીં

જવાબ: A

• નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો :

1. ઇજારાયુક્ત હરીફાઈમાં અનેક ઉત્પાદકો હોય છે. ✓
2. ઇજારાયુક્ત હરીફાઈમાં વસ્તુઓની ગુણવત્તા જુદી જુદી હોય છે. ✓
3. વેચાણ ખર્ચ એ ઇજારાનું લક્ષણ છે. X
4. વસ્તુ વિકલન એ ઇજારાયુક્ત હરીફાઈનું લક્ષણ છે. ✓
5. ઇજારમાં અવેજુ વસ્તુનો અભાવ છે. ✓

• નીચેના પ્રશ્નોમાં એક-બે વાક્યોમાં જવાબ લખો :

1. ઇજારો એટલે શું?
2. વેચાણ ખર્ચ એટલે શું?
3. વસ્તુ વિકલનનો અર્થ જણાવો.
4. ઇજારાયુક્ત હરીફાઈનું કોઈ પણ એક લક્ષણ સમજાવો.
5. અપૂર્ણ હરીફાઈ એટલે શું?
6. ઇજારમાં કિમત કોણ નક્કી કરે છે?

- નીચેના પ્રશ્નોનોના ટ્રૂકમાં જવાબ આપો :

1. ઇજારાના લક્ષણો ચર્ચો.
2. ઇજારમાં આવકના ખ્યાલો સમજાવો.
3. ઇજારાયુક્ત હરીફાઈમાં ખોટની પરિસ્થિતિ જણાવો.
4. ટ્રૂક ગાળામા ઇજારામાં પેઢીની અસમાન્ય નફાની સ્થિતિ સમજાવો.
5. વેચાણખર્ચ વિશે ચર્ચા કરો.

- નીચેના પ્રશ્નોનોના ટ્રૂકમાં જવાબ આપો :

1. ઇજારમાં ટ્રૂક ગાળામાં પેઢીની સમતુલ્ય ચર્ચો.
2. ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો સમજાવી વેચાણખર્ચ વિશે ચર્ચા કરો.
3. ઇજારા અને ઇજારાયુક્ત હરીફાઈમાં આવકના ખ્યાલો સમજાવો.
4. ઇજારાયુક્ત હરીફાઈમાં ટ્રૂક ગાળામાં પેઢીની સમતુલ્ય આકૃતિ સહિત સમજાવો.

## એકમ 7 :

## બજારના પ્રકારો અને કિંમત નિર્ધારણ-III

: રૂપરેખા :

- 7.1 ઉદ્દેશો
- 7.2 પ્રસ્તાવના
- 7.3 અલ્યુહસ્તક ઈજારાનાં લક્ષણો
- 7.4 ખાંચાવાળી માંગરેખા
- 7.5 સારાંશ અને ચાવી રૂપ શાઢો
- 7.6 સ્વાધ્યાય

---

### 7.1 ઉદ્દેશો :

---

આ એકમના અભ્યાસ બાદ નીચેની બાબતો સમજ શકાશે:

1. અલ્યુહસ્તક ઈજારાનાં લક્ષણો
2. કિંમત જડતા
3. ખાંચાવાળી માંગરેખા
4. ખાંચાવાળી માંગરેખા અને પેઢીની સમતુલ્ય

---

### 7.2 પ્રસ્તાવનાઃ :

---

એકમ 5 અને 6 માં આપણે પૂર્ણ હરીફાઈ, ઈજારો અને ઈજારાયુક્ત હરીફાઈ વિશે માહિતી મેળવી. પૂર્ણ હરીફાઈમાં અસંઘ્ય ઉત્પાદકો છે, ઈજારામાં એક જ ઉત્પાદક હોય છે જ્યારે ઈજારાયુક્ત હરીફાઈમાં અનેક ઉત્પાદક પેઢીઓ હોય છે. અપૂર્ણ હરીફાઈમાં ઘણા પ્રકારો પડે છે જેમાનો એક પ્રકાર છે અલ્યુહસ્તક ઈજારો. અલ્યુહસ્તક ઈજારમાં ખૂબ જ થોડી જ પેઢીઓ વસ્તુનું ઉત્પાદન કરે છે. તદ્વારાંત આ પેઢીઓ બજારમાં કુલ પુરવઠા ઉપર પ્રભુત્વ ધરાવે છે અને આથી તેઓ કિંમત નક્કી કરનાર પેઢીઓ છે.

### 7.3 અલ્યુહસ્તક ઈજારાના લક્ષણો :

અલ્યુહસ્તક ઈજારાના લક્ષણો નીચે મુજબ છે:

#### 1. પરસ્પરાવલંબન:

અલ્યુહસ્તક ઈજારામાં પેઢીઓની સંખ્યા ઓછી હોય છે, તેથી દરેક પેઢી કુલ પુરવઠા ઉપર અમુક પ્રમાણમાં અંકુશ ધરાવે છે. બીજી પેઢી પુરવઠા વિશે કે ભાવ વિશે કયો નિષ્ઠયિ લે છે તેને વિશે પેઢીએ સતત આગૃત રહેવું પડે છે. તેનું કારણ એ છે કે A પેઢી તેની વસ્તુના ભાવ વધારે કે ઘટાડે તો તેની અસર B, C, D, E વગેરે પેઢીઓ પર પડે જ છે. એટલે એ પેઢીઓ પણ ભાવ વધારે કે ઘટાડે એવું બને છે. એ જ રીતે વસ્તુની ગુણવત્તા, પેક્ચિંગ તેને માટેનું જાહેરખબર ખર્ચ વગેરે અંગે એક પેઢી દ્વારા લેવામાં આવતા નિષ્ઠયોની અસર બીજી પેઢીઓ પર પડે છે. આ પરિસ્થિતિને પારસ્પરાવલંબન કહેવામાં આવે છે.

#### 2. અનિશ્ચિતતાની સ્થિતિ:

પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કે ઈજારામાં કે ઈજારયુંકત હરીફાઈવાળા બજારમાં પેઢી સમતુલા પ્રામ કરે છે. એટલે કે જ્યાં તેનાં સીમાન્ત આવક અને સીમાન્ત ખર્ચ સરખાં થાય છે ત્યાં પેઢી સમતુલામાં આવે છે. પરંતુ અલ્યુહસ્તક ઈજારામાં પેઢી સમતુલા હંમેશા પ્રામ કરે છે એવું હોતું નથી. એમાં તો સતત અનિશ્ચિતતા અને અસ્થિરતાની પરિસ્થિતિ હોય છે. પેઢીએ સતત બીજી પેઢીઓ કેવું વર્તન કરે છે એટલે કે તેઓ કેટલો પુરવઠો બજારમાં મુકે છે, કેટલો ભાવ રાખે છે, કઈ ગુણવત્તાવાળી વસ્તુ પેદા કરે છે, કેટલું વેચાણ ખર્ચ કરે છે તેની માહિતી મેળવીને ફેરફારો કરવા પડે છે. એટલે હંમેશા મહત્તમ નફાને ધ્યાનમાં રાખીને જ નિષ્ઠયો લેવાય એવું જરૂરી નથી. વળી, ઉત્પાદન અને કિમત અંગેના નિષ્ઠયો વારંવાર બદલવા પડે છે.

#### 3. સામૂહિક વર્તન:

અલ્યુહસ્તક ઈજારામાં કોઈ એક પેઢીનો અભ્યાસ કરવાનું મુશ્કેલ છે. તેમાં જેટલી પેઢીઓ છે તેટલી બધી પેઢીઓના વર્તનનો એકસાથે અભ્યાસ કરવાનો થાય છે.

દા.ત. મોબાઇલ ફોન ઉત્પન્ન કરનારી 10 પેઢીઓ હોય તો એ પેઢીઓના ઉદ્દેશો શું છે, તેમની વચ્ચે ખરેખર કેવો સંબંધો છે, કઈ પેઢીનું નેતૃત્વ બાકીની પેઢીઓ સ્વીકારે છે, બધી પેઢીઓ વચ્ચે જોડાણ થાય છે કે કેમ, તેઓ બધા એકસાથે

#### 4. ભાવનેતૃત્વ

અલ્પહસ્તક ઈજારામાં ઘણી વાર કોઈ એક પેઢી વસ્તુનો જે ભાવ રાખે તેના અનુસંધાનમાં બીજી પેઢીઓ પોતાની વસ્તુને ભાવ નક્કી કરે એમ પણ બને છે. એલે કે કોઈ એક પેઢી ભાવ નક્કી કરવામાં નેતૃત્વ લે છે. આવું નેતૃત્વ લેનારી પેઢી ભાવનેતા અથવા ભાવનિષ્ઠાયક પેઢી તરીકે ઓળખવાય છે. ભાવનેતૃત્વ બે પરકારનું હોય છે.


1. પ્રભાવશાળી પેઢી ભાવ નેતૃત્વ કરે છે. જે પેઢીનું કાળ મોટું હોય એટલે કે વધારે ઉત્પાદન કરતી હોય, ખર્ચ ઓછું હોય અને વેચાણ માટે આકારક વલણ અપનાવતી હોય એ પેઢી જો ભાવમાં ફેરફાર કરે તો બાકીની પેઢીઓ એને અનુસરે છે. નાની પેઢીઓ વસ્તુ કે સેવાના કુલ ઉત્પાદન કે કિંમત ઉપર અસર કરી શકતી નથી.
2. કોઈ પેઢી એટલી પ્રભાવશાળી નાં હોય કે જેથી તે અન્ય પેઢીઓને પોતે નક્કી કરેલા ભાવ સ્વીકારવાની ફરજ પાડે. પણ તે બજારની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કિંમત રાખવાનું આડકતરું સુચન બાકીની પેઢીઓને કરે છે. દા.ત. બજારમાં અધ્યત પ્રવર્તતી હોય તો કોઈ પેઢી જ્યારે કિંમત વધારવાની હિંમત ના કરતી હોય ત્યારે એક પેઢી ભાવ વધારે છે અને પછી બધી પેઢીઓ ભાવ વધારે છે. આમ, બધી જ પેઢીઓ બજારની પરિસ્થિતિને અનુસરે છે.

## 5. ભાવચુસ્તતા:

અલ્પહસ્તક ઈજારાની સ્થિતિમાં પેઢીઓ જે ચીજો ઉત્પન્ન કરે છે તેમના ભાવ વારંવાર બદલાતા નથી. પેઢીઓ એક વાર ભાવ નક્કી કરે પછી લાંબા ગાળા સુધી એ ભાવને વળગી રહે છે. પેઢીના આ પકારના વર્તનને ભાવચુસ્તતાનું વર્તન કહેવામાં આવે છે. આમ, અલ્પહસ્તક ઈજારામાં પેઢીઓ શક્ય હોય ત્યાં સુધી ભાવને સ્થિર રાખવાનું વલણ અપનાવે છે.

## 7.4 ખાંચાવાળી માંગરેખા :

આકૃતિ ૭.૧માં ખાંચાવાળી માંગરેખા દર્શાવી છે.



આકૃતિ ૭.૧: ખાંચાવાળી માંગરેખા :

૧. ARB એ અલ્પ હસ્તક ઈજારામાં પેઢીની માંગરેખા દર્શાવે છે.
૨. R બિંદુએ માંગ રેખામાં ખાંચ જોવા માળે છે. એટલે કે R બિંદુની ઉપરની અને નીચેની બાજુએ માંગરેખાનો ફાળ જુદો જુદો છે અને આથી તેમની મૂલ્ય સાપેક્ષતા પણ જુદી છે તેમ કહેવાય.
૩. R બિંદુની ઉપરની કે ડાબી બાજુ એ માંગરેખાનો ફાળ ઓછો છે એટલે કે માંગ મૂલ્ય સાપેક્ષ બને છે તેમ કહેવાય. જો કોઈ પેઢી વસ્તુની કિંમત વધારે તો અન્ય પેઢીઓ તેને અનુસરતી નથી અને આથી જે પેઢીએ વસ્તુની કિંમત વધારી છે તેની માંગમાં ખોબ મોટો ઘટાડો જોવા મળે છે.
૪. R બિંદુની જમણી કે નીચેની બાજુએ માંગરેખાનો ફાળ વધુ છે અને આથી માંગ મૂલ્ય અનપેક્ષ બને છે તેમ કહેવાય. જો કોઈ પેઢી વસ્તુની કિંમત ઘટાડે તો અન્ય પેઢીઓ તેને અનુસરે છે અને આથી પેઢી એ વસ્તુની કિંમત ઘટાડી હોવા છતાં તેની માંગમાં થોડોક જ વધારો થાય છે.
૫. જો પેઢી વસ્તુની કિંમત વધારે તો માંગ મૂલ્ય સાપેક્ષ બને અને જો પેઢી વસ્તુની કિંમત ઘાટદાએ તો માંગ મૂલ્ય અનપેક્ષ બને છે.
૬. આ બાબત દર્શાવે છે કે પેઢી પોતાની વસ્તુની કિંમતમાં ફેરફર કરતી નથી અને તેથી કિંમત સેમીના લાંબા ગાળા સુધી સ્થિર રહે છે, જેને કિંમત જડતા અથવા ચુસ્તતા કહેવામાં આવે છે.

## 7.5 સારાંશ અને ચાવી રૂપ શબ્દો :

અલ્યુહસ્તક ઈજારો એ અપૂર્ણ હરીફાઈનો જ એક ભાગ છે. અહીં ખૂબ જ થોડા ઉત્પાદકોએ બજારના પુરવઠા ઉપર પ્રલુત્વ ધરાવે છે અને આથી કિંમત નક્કી કરે છે. અલ્યુહસ્તક ઈજારામાં પેઢીની માંગરેખા ખાંચાવાળી હોય છે કારણ કે કિંમત જડતા જોવા મળે છે.

### ચાવીરૂપ શબ્દો:

અલ્યુહસ્તક ઈજારો, કિંમત જડતા, ખાંચાવાળી માંગ રેખા

## 7.6 સ્વાધ્યાય :

નીચેના પ્રશ્નોમાં સાચો વિકલ્પ પસંદ કરો:

1. અલ્યુહસ્તક ઈજારામાં-

- A. વસ્તુઓ સમાનગુણી
- B. પૂરક વસ્તુઓ
- C. તદ્દન જુદી વસ્તુઓ
- D. નજીકની અવેજ વસ્તુઓ

જવાબ- D

2. ખાંચાવાળી માંગ રેખાના ઉપરના ભાગમાં માંગ-

- A. મૂલ્ય અનપેક્ષ
- B. મૂલ્ય સાપેક્ષ
- C. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ
- D. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ

જવાબ- B

3. ખાંચાવાળી માંગરેખાના નીચેના ભાગમાં માંગ-

- A. મૂલ્ય અનપેક્ષ
- B. મૂલ્ય સાપેક્ષ
- C. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ
- D. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ

જવાબ- A

4. કિંમત જડતા એ શેનું લક્ષણ છે?

- A. પૂર્ણ હરીફાઈ

- B. ઇજારો
- C. અલ્યુહસ્તક ઇજારો
- D. ઇજારાયુક્ત હરીફાઈ

**જવાબ- C**

5. નજીકની અવેળ વસ્તુઓ એ શેનું લક્ષણ છે?
- A. ઇજારાયુક્ત હરીફાઈ
  - B. અલ્યુ હસ્તક ઇજારો
  - C. A અને B બંને
  - D. પૂણી હરીફાઈ

**જવાબ- C**

6. કયા બજારમાં પેઢી કિંમત નક્કી કરે છે?
- A. ઇજારો
  - B. અલ્યુહસ્તક ઇજારો
  - C. ઇજારાયુક્ત હરીફાઈ
  - D. ઉપરના તમામ

**જવાબ- D**

**નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો:**

- 1. અલ્યુહસ્તક હરીફાઈમાં અનેક ઉત્પાદકો હોય છે. \*
- 2. અલ્યુહસ્તક ઇજારામાં વસ્તુઓની ગુણવત્તા જુદી જુદી હોય છે. ✓
- 3. નજીકની અવેળ વસ્તુઓ એ ઇજારાનું લક્ષણ છે. \*
- 4. ખાંચાવાળી માંગરેખા અલ્યુ હસ્તક ઇજારમાં જોવા મળે છે. ✓
- 5. અલ્યુહસ્તક ઇજારામાં જો પેઢી કિંમત ઘટાડે તો અન્ય પેઢીઓ તેને અનુસરતી નથી. \*

**નીચેના પ્રશ્નોમાં એક-બે વક્યોમાં જવાબ લખો:**

- 1. અલ્યુહસ્તક ઇજારો એટલે શું?
- 2. કિંમત જડતા એટલે શું?
- 3. અલ્યુહસ્તક ઇજારામાં પેઢીઓ કેવી વસ્તુનું વેચાણ કરે છે?
- 4. અલ્યુહસ્તક ઇજારાનું કોઈ પણ એક લક્ષણ જણાવો.
- 5. માંગરેખામાં ખાંચાનું કારણ જણાવો.

**નીચેના પ્રશ્નોનોના ટૂંકમાં જવાબ આપો:**

- 1. અલ્યુહસ્તક ઇજારાના લક્ષણો ચર્ચો.
- 2. ખાંચાવાળી માંગરેખા સમજાવો.

3. અલ્યુહસ્તક ઈજારો અને ઈજારા વચ્ચેનો તફાવત સમજાવો.  
નીચેના પ્રશ્નોનોના ટૂંકમાં જવાબ આપો:
1. ખાંચાવાળી માગરેખાની સમજૂતી આકૃતિ સહિત આપો.
  2. અલ્યુહસ્તક ઈજારાનો અર્થ સમજાવી તેના લક્ષણો ચર્ચો.
  3. અલ્યુહસ્તક ઈજારામાં પેઢીની સમતુલાની ચર્ચા કરો.

એકમ : 8

## રાષ્ટ્રીય આવકની વહેંચણી

: રૂપરેખા :

- 8.1 રાષ્ટ્રીય આવકની વહેંચણીનો ઘ્યાલ
- 8.2 વહેંચણીના અલગ સિદ્ધાંતના કારણો
- 8.3 સીમાંત ઉત્પાદકતાનો અથવા વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત
  - 8.3.1 સીમાંત ઉત્પાદકતાનો અર્થ
  - 8.3.2 ધારણા
  - 8.3.3 મયાંડા
- 8.4 રાષ્ટ્રીય આવકની વહેંચણી
  - 8.4.1 નાણાકીય વેતન અને વાસ્તવિક વેતન
  - 8.4.2 વેતન નિર્ધારણના સિદ્ધાંત
  - 8.4.3 નફો
  - 8.4.4 વ્યાજ
  - 8.4.5 ભાડાનો સિદ્ધાંત
  - 8.4.6 આવકની અસમાનતા
- 8.5 સ્વાધ્યાય

### 8.1 રાષ્ટ્રીય આવકની વહેંચણીનો ઘ્યાલ :

પ્રસ્તાવના :

ઉત્પાદનનાં ચાર સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજકની મદદથી જે ઉત્પાદન થાય તેને રાષ્ટ્રીય પેદાશ કહે છે અને તેના નાણાકીય મૂલ્યને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. રાષ્ટ્રીય આવક ઉત્પાદનનાં આ ચાર સાધનો વચ્ચે અનુક્રમે ભાડું, વ્યાજ, વેતન અને નફાના સ્વરૂપે વહેંચાય છે. આમ; વહેંચણીનો અર્થ ‘સાધનદીઠ વહેંચણી’ કરવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં રાષ્ટ્રીય આવકની વહેંચણીનો અભ્યાસ જુદા જુદા દાખિકોણથી કરવામાં આવે છે.

(1) વ્યક્તિદીઠ વહેંચણી : વ્યક્તિદીઠ વહેંચણીમાં રાષ્ટ્રીય આવક સમાજની જુદી જુદી વ્યક્તિઓ વચ્ચે કેવી રીતે વહેંચાય છે તે દશાવે છે. એક વ્યક્તિની આવક બીજી વ્યક્તિની આવક કરતાં વધારે, ઓછી કે એકસરખી શા માટે ? આવકની અસમાનતાનાં કારણો ક્યા છે વગેરે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે છે.

(2) સાધનદીઠ વહેંચણી : સાધનદીઠ વહેંચણીમાં જમીન, શ્રમ, મૂડી અને નિયોજન શક્તિની સેવાઓ માટે ચૂકવાતી કિંમત ભાડું, વેતન, વાજ અને નફો કેવી રીતે નક્કી થાય છે તેની સમજૂતી આપવામાં આવે છે.

આવકની વહેંચણીના આ બંને પ્રકારો પરસ્પર સંકળાયેલા છે, કારણ કે .... વ્યક્તિની આવકનો આધાર છેવટે તો તેની પાસેના સાધનોના જથ્થા અને સાધનોની સેવાઓની કિંમત પર આધારિત છે. દા.ત. કોઈ વ્યક્તિ પાસે બીજી વ્યક્તિ કરતાં વધારે જમીન, મૂડી અને નિયોજનશક્તિ છે તેમજ તે વધુ શ્રમ પણ કરી શકે છે. આવા સંઝોગોમાં તે વ્યક્તિને વેતન ઉપરાંત ભાડું, વાજ અને નફાડુપી આવક પણ પ્રાપ્ત થાય છે. તેથી બીજી વ્યક્તિ કરતાં તેની આવકમાં વધારો થાય છે. આમ, આવકની અસમાનતાનું મૂળભૂત કારણ સાધન માલિકીનો તફાવત છે તેથી સાધનદીઠ વહેંચણીનો પ્રશ્ન વ્યક્તિદીઠ વહેંચણીના પ્રશ્ન સાથે સંકળાયેલો છે.

## 8.2 વહેંચણીના અલગ સિદ્ધાંતનાં કારણો :

### 1) વસ્તુની માંગ અને સાધનની માંગ વચ્ચે તફાવત :

વસ્તુની માંગ પ્રત્યક્ષ હોય છે એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ વસ્તુની માંગ કરે છે ત્યારે તેનો હેતુ વસ્તુના વપરાશમાંથી પોતાની જરૂરિયાત સંતોષી તુષ્ટિગુણ પ્રાપ્ત કરવાનો હોય છે. જ્યારે ઉત્પાદનના સાધનની માંગ પરોક્ષ માંગ છે. સાધન સ્વયં જરૂરિયાતો સંતોષતું નથી પરંતુ તેનામાં માનવ જરૂરિયાતો સંતોષી શકે તેવી વસ્તુ ઉત્પન્ન કરવાની સાધનની શક્તિ છે. આમ; વસ્તુની માંગ અને સાધનની માંગ વચ્ચે તફાવત હોવાથી કિંમત નિર્ધારણમાં માંગ અને પુરવઠાનો નિયમ ઉપયોગી થઈ શકે નાહિએ.

### 2) વસ્તુના અને સાધનના પુરવઠા વચ્ચે તફાવત :

વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી તેના પુરવઠામાં તાત્કાલિક ફેરફાર થાય છે. પરંતુ સાધનની કિંમતમાં ફેરફાર થવા છતાં તેના પુરવઠામાં તાત્કાલિક કોઈ ફેરફાર થતો નથી. દા.ત. જમીનની કિંમતમાં કે શ્રમની કિંમતમાં વધારો થાય તો તેનો પુરવઠો વધારો શકાતો નથી.

### 3) સાધનોનું ઉત્પાદનખર્ચ જાણી શકતું નથી :

કોઈ એક વસ્તુની કિંમત નક્કી થઈ શકે છે. ઉત્પાદકને તે વસ્તુનું ઉત્પાદન કરવા માટે કેટલું ખર્ચ થયું તેની ગણતરી સહેલાઈથી થઈ શકે છે. તેમજ સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચના આધારે તે વસ્તુનો કેટલો પુરવઠો બજારમાં મૂકવો અને કિંમત કેટલી રાખવી તે નક્કી થઈ શકે છે. પરંતુ ઉત્પાદનના સાધનોની કિંમત નક્કી થઈ શકતી નથી. દા.ત. જમીન કે શ્રમિકની કિંમત નક્કી કરી શકતી નથી તેથી ઉત્પાદનના સાધનોનું ઉત્પાદનખર્ચ જાણી શકતું ન હોવાથી તેમની કિંમત નક્કી કરી શકતી નથી.

#### 4) ઉત્પાદનનાં સાધનોની વિશિષ્ટતાઓ :

ઉત્પાદનના દરેક સાધનને કેટલીક વિશિષ્ટતાઓ હોય છે. જે સાધનની કિંમતને અસર કરે છે. જ્યારે વપરાશી વસ્તુઓની ગુણવત્તા સમાન હોઈ શકે છે. પરંતુ ઉત્પાદનના સાધનોમાં સમાનતા જોવા મળતી નથી. દા.ત. શ્રમિક જુદી-જુદી શારીરિક અને માનસિક શક્તિ ધરાવે છે.

#### 8.3 સીમાંત ઉત્પાદકતાનો અથવા વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત :

ઉત્પાદનનાં સાધનોના મૂલ્યનિર્ધારણની પ્રક્રિયાને સમજૂતી આપવાના પ્રયાસને સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત કહે છે.

વહેંચણીના સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતનો વિકાસ કર્મશાસ્નક થયો છે. સિદ્ધાંતની સૌપ્રથમ રજૂઆત કરવાનું માન રિકાર્ડો અને વેસ્ટના લખાણોમાં જોવા મળે છે. પરંતુ તેમની રજૂઆત વૈજ્ઞાનિક ન હોવાથી સિદ્ધાંત પ્રયાલિત થયો ન હતો. ત્યારબાદ અમેરિકાન અર્થશાસ્ત્રી જે. બી.કલાર્ક, બ્રાંટિશ અર્થશાસ્ત્રી વિકર્સ્ટેડ અને ફેન્સ અર્થશાસ્ત્રી વોલરાસે તેની વૈજ્ઞાનિક ફબે રજૂઆત કરીને પ્રયાલિત બનાવ્યો. આ નિયમ સાધનોના મૂલ્યનિર્ધારણની પ્રક્રિયાની સમજૂતી આપવાનો પ્રયાસ કરે છે તેથી તેને મૂલ્યનિર્ધારણનો સિદ્ધાંત પણ કહે છે.

##### 8.3.1 સીમાંત ઉત્પાદકતાનો અર્થ

કોઈપણ ઉત્પાદનમાં સાધનના એક વધુ એકમને રોજગારી આપવાથી કુલ ઉત્પાદનમાં જે વૃદ્ધિ થાય છે તે વધારાના ઉત્પાદનને તે સાધનોની સીમાંત ભૌતિક ઉત્પાદકતા કહેવામાં આવે છે. આ સીમાંત ભૌતિક ઉત્પાદકતાને બજારમાં ચાલુ કર્મતે વેચાણ કરવાથી જે આવક પ્રાપ્ત થાય છે તે સાધનની સીમાંત આવક ઉત્પાદકતા છે.

પ્રો. જે. બી. કલાર્કના મત મુજબ “વહેંચણીના સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંત અનુસાર ઉત્પાદનના પત્યેક સાધનને તેની સીમાંત ઉત્પાદકતા મુજબ વળતર મળે છે.

##### 8.3.2 સિદ્ધાંતની ધારણાઓ

- 1) વસ્તુ બજાર અને સાધન બજારમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તમાન છે. એટલે કે શ્રમ, મૂડી, ભૂમિ અને નિયોજકરૂપી સાધન બજારમાં અનેક વિકેતાઓ અને અનેક ખરીદનારા અસ્તિત્વ ધરાવે છે.
- 2) ભૂમિ, શ્રમ, મૂડી અને નિયોજક-ઉત્પાદનનાં તમામ સાધનો સંપૂર્ણ ગતિશીલ છે. એટલે કે એક ઉપયોગમાંથી બીજા ઉપયોગમાં સહેલાઈથી ખસેડી શકાય છે.

- 3) સ્થિર સમાજની ધારણા કરાઈ છે તે મુજબ જે વસ્તુના ઉત્પાદન માટે ઉત્પાદનના સાધનોની માંગ કરે છે તે વસ્તુ માટે ગ્રાહકોની રૂચિ અને પસંદગી સ્થિર ધારી લેવામાં આવે છે.
- 4) સાધન બજારમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તમાન છે. તેથી ઉત્પાદનના બધા સાધનો સમાનગુણી છે.
- 5) ઉત્પાદનનાં સાધનો વિભાજય છે. એટલે ઉત્પાદનનું પ્રત્યેક સાધન નાનામાં નાના એકમોમાં પ્રાપ્ત કરી શકાય છે.
- 6) અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તમાન છે એટલે કે ઉત્પાદનના પ્રત્યેક સાધનને તેની સીમાંત ઉત્પાદકતા જેટલું વળતર મળતું હોવાથી પ્રત્યેક સાધન રોજગારીમાં છે.
- 7) સાધન સંયોજન ફેરફારક્ષમ છે પરંતુ ઉત્પાદન પદ્ધતિ સ્થિર છે, તે બદલાતી નથી.
- 8) સીમાંત ઉત્પાદકતા માપી શકાય છે.
- 9) અન્ય સાધનોનું પ્રમાણ સ્થિર રાખીને શ્રમિકોની સંખ્યા વધારવામાં આવતાં કુલ ઉત્પાદન ઘટતા દરે વધે છે. એટલે કે ઘટતી પેદાશનો નિયમ અમલમાં છે.


**સિક્ષાંતની સમજૂતી :**

#### અનુસૂચિ

શ્રમના એકમો	કુલભૌતિક ઉત્પાદન (એકમમાં)	સીમાંત ભૌતિક ઉત્પાદન (એકમમાં)	વસ્તુનો એકમદીઠ ભાવ (રૂ. માં)	સીમાંત પેદાશનું મૂલ્ય (રૂ. માં)	વેતન દર (રૂ. માં)	વધારાના શ્રમિકને રોકવાથી પ્રાપ્ત થતું ચોખ્યું વળતર (રૂ. માં)
1	4	4	2	8	6	2
2	9	5	2	10	6	4
3	15	6	2	12	6	6
4	22	7	2	14	6	8
5	29	7	2	14	6	8
6	35	6	2	12	6	6
7	40	5	2	10	6	4
8	43	3	2	6	6	-
9	45	2	2	4	6	-2
10	46	1	2	2	6	-4

### સીમાંત પેદાશની વલય

આકૃતિ :



### મજુરની સંખ્યા

- સમજૂતી :

આકૃતિમાં  $OX$  ધરી પર મજુરની સંખ્યા અને  $OY$  ધરી પર મજુરનું વેતન અને તેમની પેદાશ દર્શાવી છે. અહીંથી અટલે કે મજૂરોની સંખ્યા 8 હશે ત્યારે તેની ઉત્પાદકતાનું (સીમાંત પેદાશ) મૂલ્ય રૂ. 6 થાય છે અને વેતનદર પડા રૂ. 6 ચૂકવાય છે. તેથી નિયોજક અંગુઠમે રૂ. 2 અને રૂ. 4 ની ખોટ જશે. આમ થવાનું કારણ આઠમા એકમ પછી સીમાંત પેદાશનું મૂલ્ય ઘટતું જાય છે. આમ, મજૂરોની સીમાંત ઉત્પાદકતાને આધારે વેતનદર નક્કી થાય છે આ પ્રકારની પરિસ્થિતિમાં ઉત્પાદનનાં સાધનોની ફળવણી ઇષ્ટતમ થાય છે અને સાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ થાય છે.

#### 8.3.3 સિદ્ધાંતની મર્યાદા

- (1) પૂર્ણ હરીફાઈની અવાસ્તાવિક ધારણા છે કારણ કે વાસ્તવમાં સાધન બજાર અને વસ્તુ બજારમાં અપૂર્ણ હરીફાઈ જોવા મળે છે.
- (2) ઉત્પાદનનાં એકમો સમાનગુણી હોતા નથી. જેમકે; બે શ્રમિકો એકસરખી ઉત્પાદકતા ધરાવતા નથી.

- (3) ઉત્પાદનનાં સાધનો વિભાજય હોતા નથી કારણ કે અમુક ચોક્કસ મયાર્દા પછી ઉત્પાદન સાધન વિભાજય એટલે કે નાના ટુકડાઓમાં વહેંચી શકતું નથી.
- (4) ઉત્પાદનનાં બધા સાધનો ગતિશીલ હોતા નથી.
- (5) સ્થિર સમાજની ધારણા ખોટી છે.
- (6) સીમાંત ઉત્પાદકતા માપવી અશક્ય છે કારણ કે ઉત્પાદન કે પેદાશ એ ઉત્પાદનનાં ચારેય સાધનોનું સંયુક્ત પરિણામ છે. તેથી કોઈ એક સાધનનો કુલ ઉત્પાદનમાં હિસ્સો કેટલો છે તે નક્કી કરવાનું મુશ્કેલ છે.
- (7) વાસ્તવિક પરિબળોની ઉપેક્ષા જેમ કે મજૂરોની સામૂહિક સોદાશક્તિ, લઘુતમ વેતનના કાયદા, સરકારના કાયદા વગેરે.
- (8) ઘટતી પેદાશના નિયમનો આધાર. આ સિદ્ધાંત મુજબ ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે. સંશોધન, ટેકનિકલ પ્રગતિ વગેરે પરિબળો ઘટતી પેદાશને અટકાવી શકે છે.

#### **8.4 રાષ્ટ્રીય આવકની વહેંચણી :**

##### **8.4.1 નાણાકીય વેતન અને વાસ્તવિક વેતન**

- નિશ્ચિત સમય દરમ્યાન સેવાઓ માટે શ્રમિકને આપવામાં આવતી નાણાકીય રકમ એ નાણાકીય વેતન છે. નાણાકીય વેતનનો ઘ્યાલ નિરપેક્ષ છે.
- શ્રમિકને તેની સેવાઓ બદલ પ્રાપ્ત થતા નાણાકીય વેતનની ખરીદશક્તિ અને નાણાકીય લાભોનો સરવાળો વાસ્તવિક વેતન છે. વાસ્તવિક વેતનનો ઘ્યાલ સાપેક્ષ છે. જેમકે; માલિક તરફથી શિક્ષણ તાલીમ, રહેઠાણ, તબીબી સગવડ તેમજ વાહનવ્યવહાર ભથ્થા, મુસાફરીના અન્ય ખર્ચોનો વગેરે વાસ્તવિક વેતનના ઉદાહરણ છે.
- શ્રમને તેના કાર્ય બદલ આપવામાં આવતા વળતર કે બદલાને વેતન તરીકે ઓળખવામાં આવે છે. વેતન એ શ્રમિકની ડિમ્યત છે.

##### **8.4.2 વેતન નિર્ધારણના સિદ્ધાંતો**

###### **1) વેતનનો જીવનનિર્વાહ ખર્ચનો સિદ્ધાંત :**

18મી સદીમાં ફાંસમાં નિસર્ગવાદી આર્થિક વિચારધારા પ્રચલિત હતી. આ વિચારધારાના પુરસ્કર્તાઓ માનતા હતા કે શ્રમિકોનું વેતન જીવનનિર્વાહ ખર્ચ જેટલું નક્કી થાય છે. જીવન નિર્વાહ ખર્ચમાં જીવન ટકાવી શકાય અને પ્રજોત્પત્તિ કરી શકાય તેટલી શક્તિ શ્રમિકોને પ્રાપ્ત થાય તે માટે આવશ્યક ખોરાક, પોશાક અને રહેઠાણ માટેના ખર્ચનો સમાવેશ થતો હતો. આ સિદ્ધાંતને વેતનનો લોખંડી કાયદો કહેવાય છે.

**સિદ્ધાંતની મર્યાદાઓ :**

આ સિદ્ધાંત મુજબ શ્રમિકને જવનનિવાહ ખર્ચ નીકળી રહે તેટલા વેતન કરતાં વધારે વેતન આપવામાં આવશે, તો શ્રમિકની નાની ઉમરે લગ્ન થશે, વધારે બાળકો થશે, તથા શ્રમિકને સંખ્યા વધશે તેથી શ્રમનો પુરવઠો વધતા વેતન ઘટશે.

વાસ્તવિકતામાં વેતન વધતાં બાળકો નહીં વધે પરંતુ વધારે ઊંચું જવનધોરણ પસંદ કરે છે તે સાપેક્ષ ખ્યાલ છે. શ્રમિકની ઉમર, વ્યવસ્થા, સ્થળ વગેરે સંદર્ભમાં જવનનિવાહનો ખ્યાલ બદલતો રહે છે.

### (2) વેતનનો જવનધોરણ ખર્ચનો સિદ્ધાંત :

આ સિદ્ધાંત મુજબ જવનધોરણ એટલે ટેવાયેલું જવનધોરણ એવો સિદ્ધાંતમાં અભિપ્રેત છે. જેમાં પોષણયુક્ત ખોરાક, સારા સુધૃ પોશાક, જરૂરી શિક્ષણ, સ્વાસ્થ્ય સવલતો, મનોરંજન વગેરે તમામ બાબતોનો ખર્ચ નીકળે તે રીતે શ્રમિકને વેતન આપવું.

#### ● મર્યાદા :

આ સિદ્ધાંતમાં જવનધોરણનો ખ્યાલ સ્પષ્ટ નથી. આ સિદ્ધાંત એકાંગી છે. કેમ કે શ્રમનો પુરવઠો વેતન વધારવાથી વધે છે પરંતુ શ્રમની માંગ કયા પરિબળોથી નક્કી થાય છે તે અંગે વિચાર કરવામાં આવ્યો નથી.

### (3) 'શેષ'ના અધિકારનો સિદ્ધાંત :

ટેકિડ રિકાર્ડોના મત મુજબ "ઉત્પાદનનું વેતન સિવાયનો કુલ ખર્ચ ચૂકવ્યા બાદ જે કંઈ બાકી (શેષ) રહે છે તે વેતનરૂપે શ્રમિકોને પ્રાપ્ત થાય છે. જમીનને ભાડુ, મૂડીને વ્યાજ, નિયોજકનો નફો બાદ કરતાં જે અધિશેષ બાકી રહે તેમાંથી શ્રમિકને વેતન ચૂકવાય છે.

● મર્યાદા : આ સિદ્ધાંત એવું પ્રતિપાદન કરવા માગે છે કે ઉત્પાદનવૃદ્ધિ વિના વેતનવૃદ્ધિ શક્ય નથી. શ્રમિકોનાં મંડળો ગમે તેટલા પ્રયાસો કરે તો પણ ઉત્પાદન વધાર્યા વિના અસરકારક રીતે વેતન વધારી શકાય નહિ. વેતનવૃદ્ધિ માટે ઉત્પાદનવૃદ્ધિ કરવી જરૂરી છે.

### (4) વેતન-ભંડોળનો સિદ્ધાંત :

પ્રો. જે. એસ. મિલના મત મુજબ વેતનના નિર્ધારણ માટે બે પરિબળો છે. શ્રમિકોની સંખ્યા અને મૂડીનો જથ્થો એટલે વેતનભંડોળ.

$$\text{વેતન-ભંડોળ} = \frac{\text{શ્રમિકોની સંખ્યા}}{\text{શ્રમિકોની સંખ્યા}}$$

શ્રમિકોનાં મંડળો તેમની તાકાતના જોરે કદાચ એક ઉદ્યોગમાં વેતનવધારો મેળવી શકે, તો બીજા ઉદ્યોગમાં વેતનઘટાડાના ભોગે જ આ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. તેનું કારણ એ છે કે દેશના બધા જ શ્રમિકોને જેમાંથી વેતનની ચૂકવણી થાય છે તે વેતનભંડોળનું કુલ કદ તો કોઈ એક સમયે આપેલા સમયે નિશ્ચિત ને સ્થિર હોય છે. વેતનધારા માટે એક અસરકારક પરિબળ શ્રમિકોની સંખ્યા સીમિત રાખવાનું છે.

### ● મર્યાદાઓ :

શ્રમિકોનું વેતન કાલ્પનિક વેતનમંડળ દ્વારા નહીં પરંતુ તેમની ઉત્પાદકતાના સ્તર દ્વારા નક્કી થાય છે.

કોઈ એક ઉદ્યોગમાં શ્રમિકોનું મંડળ વેતનવધારો હાંસલ કરી શકે છે અને તેમ કરતી વખતે બીજા કોઈ ઉદ્યોગમાં વેતન ઘટાડો થતો નથી. તેથી સિદ્ધાંતનો ફલિતાર્થ સાચો પડતો નથી.

### (5) શ્રમની સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત

આ સિદ્ધાંત મુજબ ઉત્પાદનના અન્ય સાધનોનું પ્રમાણ સ્થિર રાખીને શ્રમના પ્રમાણમાં વધારો કરવામાં આવે છે. ત્યારે વધારાના શ્રમનું પ્રત્યેક એકમ કુલ ઉત્પાદનમાં જે વધારો કરે છે તે સીમાંત ભૌતિક ઉત્પાદન છે અને સીમાંત ભૌતિક ઉત્પાદનને બજારકિંમત વડે ગુણવાથી સીમાંત ઉત્પાદકતા પ્રાપ્ત થાય છે. આમ; નૂતન શિષ્ટ અર્થશાસ્ત્રીઓ શ્રમની સીમાંત ઉત્પાદકતાને વેતનવ્યોરણ તરીકે સ્વીકારે છે.


### ● મર્યાદાઓ

ઉત્પાદનના એકમો સમાનગુણી હોતા નથી, પૂર્ણ હરીફાઈની અવાસ્તવિક ધારણા કરવામાં આવી છે, ઉત્પાદનના સાધનો વિભાજ્ય હોતા નથી. ઉત્પાદનના બધા સાધનો ગતિશીલ હોતા નથી. સીમાંત ઉત્પાદકતા માપવી અશક્ય છે.

### (6) શ્રમની માંગ અને પુરવઠાનો સિદ્ધાંત

પ્રો. માર્શલના મત મુજબ “વેતનનો દર શ્રમની માંગ અને શ્રમના પુરવઠા પર આધારિત હોવાથી શ્રમની માંગ અને શ્રમનો પુરવઠો જ્યાં સરખા થાય છે ત્યાં વેતનદરનું નિર્ધારણ થાય છે.”

આકૃતિ :



## આકૃતિની સમજૂતી :

OX પર શ્રમની માંગ/પુરવઠો અને OY પર વેતન દરશાવેલ છે. DD શ્રમની માંગ રેખા અને SS શ્રમની પુરવઠા રેખા છે જે બંને એકબીજાને K બિંદુએ છેદે છે. ત્યાં માંગ અને પુરવઠો સરખો થાય છે. OT વેતનદરે શ્રમનો પુરવઠો અને શ્રમની માંગ OM થાય છે.

### (7) વેતનનો સામૂહિક સોદાશક્તિનો સિદ્ધાંત

શ્રમના વેચાણની બાબતમાં પોતાને અનુકૂળ શરતોએ સોદો કરવાની સંગઠન દ્વારા શ્રમિકોએ પ્રાપ્ત કરેલી શક્તિને સામૂહિક સોદાશક્તિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રો. આર.જી. લિલ્લીના મતે “સામૂહિક સોદા-શક્તિમાં એકપક્ષીય નહિ પરંતુ દ્વિપક્ષીય ઈજારાની સ્થિતિ હોવી જરૂરી છે. શ્રમના પુરવઠા યા વેચાણની બાજુએ મજૂર સંઘોનો ઈજારો અને શ્રમની માંગની બાજુએ માલિકોના મંડળોનો ઈજારો હોય અને તેઓ પરસ્પર વાતાવાટો અને ખેંચાણ દ્વારા વેતન નક્કી કરે તેને સામૂહિક સોદાશક્તિ દ્વારા વેતનનિર્ધારણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે.

#### ● મર્યાદા

- મજૂર મંડળો અમયાર્દિત રીતે વેતન વધારો કરાવી શકતાં નથી. વેતન વધે તો ઉત્પાદન ખર્ચ વધે અને નિયોજકોના નફામાં ઘટાડો થાય, પરિણામે તેઓ મજૂરોને છૂટા કરે.
- ઘણીવાર વેતન વધતાં ઉત્પાદન ખર્ચ વધે અને શ્રમિકોની અવેજ દ્વારા ઉત્પાદન શક્ય હોય તો યંત્રો રોકવાનું પસંદ કરશે.
- જો દેશમાં બેકારોનું પ્રમાણ વધારે હોય તો મજૂરમંડળો વેતન વધારવામાં સફળ થઈ શકતાં નથી.

#### 8.4.3 નફો:

નફો તે નિયોજકને તેની વિશિષ્ટ કામગીરી બદલ મળતું વળતર છે. એફ.બી. હોલી “મુજબ નફો એ જોખમ ઉઠાવવાનો બદલો છે. નફારૂપી બદલો પ્રાપ્ત થતો હોવાથી નિયોજક જોખમ ઉઠાવે છે.

#### (i) કાચો નફો :

ઉત્પાદન કરવામાં આવેલી વસ્તુઓના વેચાણ દ્વારા પ્રાપ્ત થતી કુલ આવકમાંથી કુલ ઉત્પાદન ખર્ચ બાદ કરતા જે વધારો રહે તે પેઢીનો કાચો નફો છે.

ટૂંકમાં કાચો નફો = વ્યવસ્થાપક તરીકેનું વળતર + નિયોજકની મૂડીનું વાજ + જમીનનું ભાડું + ઘસારા ખર્ચ + ઈજારાનો નફો + તકનો નફો

## (ii) શુદ્ધ નફો :

અર્થશાસ્ત્રમાં ચોખ્યા નફાનો અભ્યાસ મહત્વનો છે. ચોખ્યો નફો = વ્યવસ્થાપક તરીકેનું વળતર - નિયોજકની મૂડીનું વ્યાજ - જમીનનું ભાડું - ઘસારા ખર્ચ - ઈજારાનો નફો - તકનો નફો

### (1) પ્રો. હોલીનો જોખમનો સિદ્ધાંત

તેમના મુજબ નિયોજકનું કાર્ય ધંધામાં રહેલા જોખમો એ નફાનું કારણ છે. નિયોજક જ્યારે મૂડીનું રોકાણ કરે છે ત્યારે કેટલાક જોખમો ઉઠાવે છે જેમકે; વસ્તુની માંગમાં ફેરફાર થાય. ભાવ ઘટવા પામે અથવા અકર્માત થવાને કારણો મૂડીરોકાણ જોખમમાં મૂકાય. આમ; નિયોજક જોખમ ઉઠાવે છે. નફો એ જોખમ ઉઠાવવાનો બદલો છે. કેટલાક ધંધાઓમાં જોખમની માત્રા વધુ હોય છે તેવા ધંધાઓમાં નફાનું પ્રમાણ વધારે હોય છે. જોખમો બે પ્રકારનાં હોય છે. વીમાપાત્ર જોખમો અને બિનવીમાપાત્ર જોખમો.

### (2) પ્રો. નાઈટનો નફા અંગે અનિશ્ચતતાનો સિદ્ધાંત

જે બનાવો અથવા ઘટનાઓનું અનુમાન થઈ શકે તથા જેની સરેરાશ નક્કી થઈ શકે નહિ તને પ્રો. નાઈટ અનિશ્ચતતાઓ તરીકે ઓળખાવે છે. તેમના મત મુજબ નફો ધંધામાં રહેલી અનિશ્ચતતાઓ વહોરવાનો બદલો છે. જેમાં ઉત્પાદનમાં અન્ય હરીફનો પવેશ, યંત્રવિષયક પરિવર્તનો તથા સરકારી નીતિમાં પરિવર્તન વગેરે જેવી અનિશ્ચતતાનો સમાવેશ થાય જે નફાને ઘટાડે છે.

➤ તે જ રીતે ગ્રાહકોની ફેશન રુચિનાં પરિવર્તનોની ગણતરી કે આગાહી કરી શકાતી નથી.

### (3) નફાનો સંશોધનનો સિદ્ધાંત

પ્રો. શુમીટરના મતે નફો એ નવપ્રવર્તનનું વળતર છે. નવપ્રવર્તનો એટલે નવું સંશોધન જે ઉત્પાદન પ્રક્રિયામાં એવા ફેરફાર સર્જે છે જેને પરિણામે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય કે વસ્તુની પ્રવર્તમાન કિંમત અને ઉત્પાદન ખર્ચ વચ્ચે તફાવત પેદા થાય. સંશોધન એટલે નવી વસ્તુનું ઉત્પાદન, નવા કાચા માલની શોધ ઉત્પાદન પદ્ધતિમાં સંશોધન, નવા બજારની શોધ વગેરે. આમ; ગતિશીલ સમાજમાં જ્યાં સંશોધન સતત થાય ત્યાં નફો થાય છે. અદશ્ય થાય છે અને ફરીથી અસ્લીતમાં આવે છે.

### (4) નફો ગતિશીલ સમાજને લીધે ઉદ્ભવે છે

અમેરિકન અર્થશાસ્ત્રી પ્રો. જે. બી. કલાર્કના મતે “નફો ગતિશીલ સમાજને કારણે ઉદ્ભવે છે. સ્થિર સમાજમાં નફો ઉદ્ભવી શકતો નથી. જેમકે; વસ્તી, લોકોની રુચિ, ઉત્પાદન પદ્ધતિ, સાધનોનો પુરવઠો, માંગ વગેરેના ફેરફારો નફાને જન્મ આપે છે.

## (5) ઇજારાનો નફો

આધુનિક અર્થશાસ્ત્રી મુજબ નફો એ ઇજારાશાહીનું પરિણામ છે. પ્રો. ચેમ્બરલીનના મત મુજબ “ઇજારા દ્વારા પ્રાપ્ત થતા અસામાન્ય નફોનું કારણ પ્રવેશના માર્ગમાં રહેલા વિઘ્નો છે”.

- નિયોજકો ઇજારાની સ્થિતિ પ્રાપ્ત કરવા વિવિધ પ્રકારની યુક્તિ અપનાવે છે જેમાં પેટન્ટ હક મેળવવા, સરકારના કાયદા હેઠળ રક્ષણ પ્રાપ્ત કરવા, પ્રવેશના વિઘ્નો ભેખા કરવા, વસ્તુ વિકલન કરવું, આહેરાત ખર્ચ કરવા વગેરેથી નફો પ્રાપ્ત કરે છે.
- નિયોજક વસ્તુની કિંમત મેળવીને ગ્રાહકનું શોષણ કરે છે તથા ઉત્પાદનના સાધનને તેમની સીમાંત ઉત્પાદકતા કરતા ઓછું વળતર ચૂકવીને તેમનું શોષણ કરે છે.

### 8.4.4 વ્યાજ :

પ્રો. માર્શલના મતે “વ્યાજ એ મૂડીનું વળતર છે. તેનો દર મૂડીની માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે. મૂડી સાધિત વસ્તુની લોન આપવામાં આવે તો તેને પરિણામે મૂડીનું ઘસારા ખર્ચ બાદ કરતાં ઉત્પાદનમાં જે વધારો થાય તે કુદરતી વ્યાજનો દર ગણાશે. કુદરતી વ્યાજનો દર એ મૂડીની સીમાંત ઉત્પાદકતા દરશાવે છે.

- વ્યાજનો બજારદર એટલે નાણું ઉદ્ધીનું લેવા માટે કે લોન મેળવવા માટે જે વ્યાજનો દર ચૂકવવો પડે છે તેને વિકસેલ વ્યાજનો બજારદર કે લોન દર કહે છે.

#### (1) વ્યાજના દર નિર્ધારણનો પ્રશિષ્ટ સિદ્ધાંત

આ સિદ્ધાંત પ્રો. સિનિયર, પ્રો. માર્શલ, પ્રો. ફિશર, પ્રો. બોલ્વર્ક, પ્રો. ટોસીંગ તથા પિગુ વગેરે જેવા અર્થશાસ્ત્રીઓએ વિકાસમાં ફાળો આપ્યો છે.

#### સિદ્ધાંતની ધારણા

- અર્થતંત્રમાં પૂર્ણ હરીફાઈ, પૂર્ણ રોજગારી છે.
- નાણું માત્ર વિનિમયનું માધ્યમ છે.
- વ્યાજનો દર પારિવર્તનશીલ છે.
- અર્થતંત્રમાં થતી બચતો અને મૂડીરોકાણ વ્યાજના દર આધારિત છે.
- મૂડીની માંગ અને તેનો પુરવઠો વ્યાજના દરને નક્કી કરે છે.


#### (1) બચતની માંગ (મૂડીરોકાણ) મૂડીની માંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્પાદકનો હેતુ નફાનો છે. તેથી તે મૂડીરોકાણ કરે છે. વધુ મૂડીરોકાણ એટલે વધુ ઉત્પાદન થાય છે. પરંતુ ઉત્પાદન ક્ષેત્રે ઘટતા મળતરનો નિયમ લાગુ પડે છે. મૂડીની ઉત્પાદકતા કમશા: ઘટે છે. આમ; મૂડીની સીમાંત ઉત્પાદકતા ઘટતી જાય છે. તેથી ઉત્પાદક જે મૂડીરોકાણ કરે છે તેને બદલે બચત કરનારાઓ પાસેથી મૂડી ઉદ્ધીની લેવી પડે છે. તેમજ મૂડીના વપરાશ બદલ વ્યાજ ચૂકવવું પડે છે તેમજ ઉત્પાદક મૂડીરોકાણ વધારતો જાય

તેમ-તેમ મૂડિની સીમાંત કાર્યક્રમતા ઘટતી જાય છે. તેથી વ્યાજનો દર નીચો હશે તો જ મૂડિરોકાણની માંગમાં વધારો થશે. આમ; મૂડિરોકાણ અને મૂડિની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે.

## (2) બચતનો પુરવઠો (બચતો)

બચતો એટલે વપરાશ માટેની વર્તમાનને બદલે ભવિષ્યની સમય પસંદગી. વર્તમાન વપરાશ મુલતવી રાખવામાં આવે તેથી વર્તમાન વપરાશમાંથી પ્રાપ્ત થતો તુણ્ણુણ જતો કરવો પડે છે. તેથી જો લોકોને વધુ બચતો કરવા મેરવા હોય તો તે માટે તેમને વળતર આપવું જોઈએ. આ વળતર એ વ્યાજનો દર છે. વ્યાજનો દર અને બચતો વચ્ચે સમસંબંધ જોવા મળે છે. તેથી બચતની પુરવઠ રેખાનો ઢાળ ઘન હોય છે. એટલે નીચા વ્યાજના દરે ઓછી બચત અને ઊંચા વ્યાજના દરે વધારે બચત થાય છે.

## વ્યાજદરનું નિર્ધારણ આકૃતિ દ્વારા



આકૃતિમાં AB વ્યાજના દરે મૂડિરોકાણ = બચત થાય છે. વ્યાજનું વલણ AB સપાટીએ સ્થિર થવાનું રહેશે. વ્યાજનો દર AB હોય ત્યારે બચત અને મૂડિરોકાણ બંને OB કેટલાં છે. જો અન્ય પરિબળોમાં ફેરફાર થાય તો SS અને II રેખાઓ ઉપર કે નીચે તરફ જશે. તેથી વ્યાજનો દર તેમજ બચત અને મૂડિરોકાણનું પ્રમાણ પણ બદલાશે.

### ● મર્યાદા

આ નિયમમાં નાણાંકીય પરિબળોની ઉપેક્ષા કરવામાં આવી છે. ઉપરાંત વ્યાજ એ બચતનો બદલો નથી.

બચતો એ મૂડિનો પુરવઠો નથી.

બચતનો આધાર વ્યાજદર પર નહિ પરંતુ આવક પર હોય છે અને આ નિયમમાં શાખી નાણાંની અવગણના કરવામાં આવી છે.

## (2) ધિરાણ ભંડોળનો સિદ્ધાંત


આ સિદ્ધાંતની સર્વપ્રथમ રજૂઆત સ્વીઠનના પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી નટ વિકસેલે કરી હતી તથા પ્રો.

ડી. એચ. રોબર્ટસને તેને વિકસાવવામાં મહત્વનો ફાળો આપ્યો.

- ધિરાણભંડોળના સિદ્ધાંત મુજબ વ્યાજનો દર ધિરાણભંડોળની કુલ માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે.
- ધિરાણ ભંડોળની માંગ એટલે લોકો જુદા-જુદા હેતુ માટે બીજાઓ પાસેથી ધિરાણ માંગ મેળવે છે અને નાણાં માટેની તેમની માંગને ધિરાણભંડોળની માંગ કહે છે. જેમાં ગ્રાહકો, ઉત્પાદકો અને વેપારીઓ, સરકાર તથા અન્ય સંસ્થાઓ તેમજ વક્તિઓ સંગ્રહ માટે ધિરાણ ભંડોળની માંગ કહે છે.
- ધિરાણ ભંડોળની માંગરેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફ દળતી હોય છે.
- ધિરાણ ભંડોળના પુરવઠાને લોકોની કુલ બચત, સંસ્થાકીય બચત, નાણાંનો સંગ્રહ અને અસંગ્રહ બંદોળનું ધિરાણ તથા વિમૂક્તીકરણ વગેરે પરિબળો અસર કરે છે.

### • વ્યાજદરનું નિર્ધારણ

વ્યાજનો દર ધિરાણ ભંડોળનો પુરવઠો અને માંગ સરખા થાય છે તે વ્યાજનો દર બજારમાં પ્રવર્તમાન થાય છે.



આકૃતિમાં OX આડી રેખા પર વિરાષ ભંડોળની માંગ અને પુરવઠો અને OY ઊભી ધરી પર વ્યાજનો દર દર્શાવ્યો છે. DD રેખા કુલ વિરાષ ભંડોળની માંગ અને SS રેખા કુલ વિરાષ ભંડોળનો પુરવઠો દર્શાવે છે. K બિંદુએ વિરાષની માંગ અને વિરાષ ભંડોળનો પુરવઠો સરખો થઈ રહે છે. ત્યારે OP વ્યાજનો દર નક્કી થાય છે. જે સમતુલ્યાનો વ્યાજદર છે.

#### ● મર્યાદાઓ

- કુલ આવક સ્થિર હોવાની ધારણા
- વ્યાજના દર આવક પર અસર
- માંગ વધુ સક્રિય પરિબળ
- નાણાંની સંગ્રહવૃત્તિનો અસ્પષ્ટ ઘ્યાલ
- આવક અસરની અવગણના, વ્યાજના દર અનિશ્ચિત

#### (3) રોકડ પસંદગીનો સિદ્ધાંત

આ સિદ્ધાંત લૉડ કેઈન્સે તેમના પ્રખ્યાત પુસ્તક “જનરલ થિયરી ઓફ એમ્પ્લોઇમેન્ટ ઇન્ટરેસ્ટ એન્ડ મની”માં વ્યાજના દરનો સિદ્ધાંત આપ્યો છે.

લોકો નાણાંની માંગ અથવા રોકડ પસંદગીનો આધાર મુખ્યત્વે ગ્રાશ બાબત પર હોય છે.

#### ● વિનિમયનો હેતુ:

વ્યક્તિને મળતી આવક તે રોજબરોજના ખર્ચ, ચૂકવણીઓ, વેતન, હેરફર ખર્ચ વગેરે માટે રોકડ રાખવાનું પસંદ કરે છે. વિનિમયના હેતુ માટે આવકનો કેટલો ભાગ રોકડ નાણાં તરીકે રાખશે તેનો આધાર આવકનું કદ, પ્રાપ્તિનો સમય તથા ચૂકવણીની પદ્ધતિ પર રહેલો છે.

#### ● સાવચેતીનો હેતુ:

ભવિષ્યની અનિશ્ચિતતા જેવી કે માંડગી, અક્સમાત કે સામાજિક ખર્ચને પહોંચી વળવા માટે રોકડ નાણાં હાથ પર રાખે છે.

#### ● સહાનો હેતુ:

કેટલાક લોકો જમીનગીરી ભાવમાં થતી ઉથલ-પાથલનો લાભ લેવા માટે પ્રયાસ કરે છે. આમ; જમીનગીરીઓની લે-વેચ કરવા માટે જે રોકડ નાણાં હાથ પર રાખવામાં આવે છે તેને સહાના હેતુ માટે રોકડ નાણાંની માંગ કહે છે.

#### ● વ્યાજદરનું નિર્ધારણ :

વ્યાજનો દર નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો એમ સંયુક્ત રીતે નક્કી થાય છે. નાણાંનો પુરવઠો ટૂંકા ગાળામાં સ્થિર હોવાથી વ્યાજના દર પર તેની અસર થતી નથી.

જ્યારે જુદા-જુદા વ્યાજના દરે નાણાંની માંગ જુદી-જુદી હોય છે. તેથી વ્યાજના દરમાં વધારો થતા રોકડ નાણાંની માંગ ઘટે છે. અને વ્યાજના દરમાં ઘટાડો થતાં નાણાંની માંગ વધે છે.

#### ● મર્યાદા

આ સિદ્ધાંત ટૂંકા ગાળાના વ્યાજના દરની સમજૂતી આપે છે, રોકડ પસંગળનો ખ્યાલ બિનઉપ્યોગી બને છે. વ્યાજદરોના તફાવતની સમજૂતી અશક્ય તથા રોકડ નાણાંના અથ અંગે અસ્પષ્ટતા છે.

#### 8.4.5 ભાડાનો (રિકાર્ડોના) સિદ્ધાંત

- આર્થિક ભાડાનો સૌપ્રથમ ખ્યાલ તેવિડ રિકાર્ડોએ આપ્યો હતો.
- જમીનનાં મૂળ અને અવિનાશી તત્ત્વોની વપરાશ બદલ જમીનની ઉપજમાંથી જમીનના માલિકને જે હિસ્સો આપવામાં આવે છે તે ભાડું છે.
- જમીનની ઉપજમાંથી મૂડી, મજૂરી ખર્ચ જેવાં ઉત્પાદન ખર્ચને બાદ કરતા જે વધારો રહે છે તેને રિકાર્ડો ભાડા તરીકે ઓળખાવે છે.


#### ● ધારણા

- ભાડું ફક્ત જમીન પર જ ઉદ્ભવે છે. જમીન સેવાયના અન્ય ઉત્પાદનના સાધનને ભાડું મળતું નથી.
- જમીનની ફળૃપતામાં તફાવત છે.
- જમીન કુદરતી બાણિસ હોવાથી તેની કોઈ પુરવઠા કિંમત નથી, જમીનની અછત હોય છે. જમીનનો પુરવઠો અમાપ નથી.
- જમીનમાં થતું ઉત્પાદન ઘટતી પેદાશના નિયમ મુજબ થાય છે.
- ભાડું ટૂંકા ગાળે નહિ પરંતુ લાંબે ગાળે ઉપજે છે.
- પૂર્ણ હરીફાઈ પ્રવર્તમાન છે.

#### અનુસૂચિ અને આકૃતિ

જમીનની ફળૃપતાની દર્શાવેલી પ્રકાર	મૂડી અને મજૂરો પાદળનું કુલ ઉત્પાદન ખર્ચ (રૂ. મા)	પ્રત્યેક જમીનની કુલ ઉપજ (રૂ. મા)	ભાડું વધારો (રૂ. મા)
A	1000	5000	4000
B	1000	4000	3000
C	1000	2500	1500
D	1000	1000	-

## આકૃતિ :



વિવિધ પ્રકારની જમીન

OX આડી ધરી પર ABCD વિવિધ પ્રકારની જમીનના એકસરખા કદનાં ખેતરો દર્શાવ્યા છે. OY ધરી પર આવક અને ખર્ચ રૂ. માં દર્શાવ્યા છે. ABC જમીનને અનુક્રમે રૂ. 4000, 3000 રૂ. અને 1500 રૂપિયા ભાડું મળે છે જ્યારે D ને ભાડું પ્રાપ્ત થતું નથી. D જમીનની ઉપજ રૂ. 1000 અને ઉત્પાદન ખર્ચ રૂપિયા 1000 હોવાથી કોઈ ભાડું પ્રાપ્ત થતું નથી. આમ જમીનની ફળકૃપતામાં તફાવત હોવાથી વધુ ફળકૃપ જમીનને વધુ ભાડું મળે છે. જેની ઉપજ અને ઉત્પાદનખર્ચ સરખા થાય છે તેવી જમીનને શૂન્ય ભાડું મળે છે.

### ● મર્યાદાઓ :

- જમીનના તફાવતને કારણે ભાડાના તફાવત નથી પરંતુ જમીનની અદ્ધતને લીધે ભાડું ઉદ્ભવે છે.
- જમીનના ખેડાણનો કમ ઐતિહાસિક દાખિયો સાચો નથી.
- ઘટતી પેદાશના નિયમની ધારણા ટીકાપાત્ર છે.

### 8.4.6 આવકની અસમાનતા

ભૂતકાળના સ્વેરવિધારી પદ્ધતિને વરેલા યુગમાં વેતનનિર્ધારણની પ્રક્રિયામાં રાજ્યની દરમ્યાનગીરી સ્વીકારવામાં આવતી નહીં. પરંતુ હવેના કલ્યાણબદ્ધ આદર્શને વરેલા રાજ્યમાં વેતનનિર્ધારણમાં રાજ્યની દરમ્યાનગીરી આવશ્યક બની છે. મજૂરો તેમનું જીવનનિર્વહિ ચલાવી શકે તેટલું વેતન તો મળવું જ જોઈએ. તેથી વર્તમાન સમયમાં રાજ્ય લઘુતમ વેતનદર નક્કી કરતા શ્રમજીવીઓની લઘુતમ જરૂરિયાત અને જીવનધોરણ સુધરે છે. સાથે-સાથે આવકની અસમાનતા દૂર કરવા માટે સરકાર દ્વારા અનેક પગલાં તથા

સુધારણા કાર્યક્રમ હાથ ધરેલ છે. જેમાં આજાદી બાદ લીધેલા જમીનસુધારણા અંગેના પગલાં ખેડૂતો તથા નાનાં અને સીમાંત ખેડૂતોની સલામતી માટે અને જમીન માલિકી હક્ક પુનઃપ્રાપ્ત થાય તથા સમાન વહેંચણી થાય તેવો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો હતો.

આ ઉપરાંત જ્યારે વ્યક્તિ વિતરણ એ મુખ્યત્વે નિષ્કર્ષ કાઢતાં, સામાન્ય રીતે આવક મેળવનાર ટોચના લોકો રાષ્ટ્રીય આવકના લગભગ 25 થી 35% વર્ષે મેળવે છે. જ્યારે સૌથી ઓછા 20% આવક મેળવનાર રાષ્ટ્રીય આવકનો આશરે 5% છિસ્સો મેળવે છે. ગરીબ દેશોમાં અસમાનતા સૌથી મોટી જોવા મળે છે. જ્યારે આર્થિક વિકાસ દરમ્યાન ધીમે-ધીમે આવકની અસમાનતા કંઈક અંશે ઓછી થાય છે.

## 8.5 સ્વાધ્યાય

મુદ્દાસર પ્રશ્નોના જવાબ લખો.

- (1) રાષ્ટ્રીય આવકની વહેંચણીનો ખ્યાલ સમજાવો તથા વહેંચણીના કારણો આપો.
- (2) સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત ચર્ચા.
- (3) વેતન નિર્ધારણના સિદ્ધાંત ચર્ચા.
- (4) વ્યાજદરના સિદ્ધાંતોની આકૃતિ સાચિત ચર્ચા કરો.
- (5) ભાડાનો સિદ્ધાંત સમજાવો.

- ટૂંકા પ્રશ્નોના ઉત્તર આપો.

- (1) આવકની અસમાનતા વિશે નોંધ લખો.
- (2) નફો વિશેના ખ્યાલો સમજાવો.
- (3) નાણાકીય વેતન અને વાસ્તવિક વેતનનો ભેદ સ્પષ્ટ કરો.
- (4) રોકડ પસંદગી પર નોંધ લખો.
- (5) સીમાંત ઉત્પાદકતાનો ખ્યાલ વિગતવાર આપો.
- (6) વેતનનો સામૂહિક સોદાશક્તિના નિયમ ચર્ચા.
- (7) વ્યાજના દરના નિર્ધારણમાં બચતની માંગ તથા બચતના પુરવઠા વિશે ખ્યાલ આપો.

- બહુવિકલ્પ પ્રશ્નો

- (1) આર્થિક ભાડાનો સૌથી પ્રથમ ખ્યાલ કોણે આયો ?
 

(a) રેન્કાર્ડો	(b) મિલન	(c) જે. બી. સે	(d) માશલે
----------------	----------	----------------	-----------
- (2) રાષ્ટ્રીય આવકની વહેંચણીનો અભ્યાસ કેટલી રીતે થાય ?
 

(a) બે	(b) ત્રણ	(c) ચાર	(d) પાંચ
--------	----------	---------	----------

(3) ઉત્પાદનના પ્રત્યેક સાધનને તેમની સીમાંત ઉત્પાદકતા મુજબ વળતર મળે છે. આ વિધાન કોણે કહ્યું છે ?

- (a) કલાક (b) શુમ્પાટર (c) માશિલ (d) એડમ સ્મિથ

(4) વેતનના સિદ્ધાંતો ક્યા છે ?

- (a) શેખના અધિકારનો (b) વેતન ભંડોળ  
(c) વેતનનું જવનધોરણ (d) ઉપરોક્ત બધા

(5) નફો એ \_\_\_\_\_ ઉઠાવવાનો બદલો છે.

- (a) વ્યાજ (b) મૂડી (c) જોખમ (d) વિરાણ

(6) કાચા નફામાં ક્યા વળતરનો સમાવેશ થાય છે ?

- (a) ઘસારા ખર્ચ (b) કરવેરા (c) જમીનનું ભાડું (d) ઉપરોક્ત તમામ

(7) ચોખ્યો નફો = નિયોજકની મૂડીનું વ્યાજ - જમીનનું ભાડું -

- (a) ઘસારા ખર્ચ (b) ઈજારાનો નફો (c) તકનો નફો (d) ઉપરોક્ત તમામ

(8) ક્યા અર્થશાસ્ત્રી નફાને ધંધામાં રહેલી અનિશ્ચિતતાઓ સાથે જોડે છે ?

- (a) પ્રો. કેઈન્સ (b) હોલી (c) નાઈટ (d) ઉપરોક્ત બધા

(9) વિરાણ ભંડોળનો ખ્યાલ સર્વપ્રથમ કોણે આય્યો ?

- (a) નટ વિકસેલે (b) મીડોલ (c) નાઈટ (d) ઉપરોક્ત બધા

(10) વિરાણ ભંડોળના પુરવઠામાં શેનો સમાવેશ થાય છે ?

- (a) સંસ્થાકીય બચત (b) બેંકોનું વિરાણ

- (c) લોકોની બચત (d) ઉપરોક્ત તમામ

(11) રોકડ પસંદગીનો સિદ્ધાંત કોણે આય્યો ?

- (a) ઓહલીન (b) કેઈન્સ  
(c) લીન્ધોલ (d) ઉપરોક્ત તમામ

(12) રોકડની માંગનો આધાર શેના પર છે ?

- (a) વિનિમય (b) સાવચેતી  
(c) સહૃદકીય (d) ઉપરોક્ત તમામ

(13) કેઈન્સના નાણાં પુરવઠાના સિદ્ધાંતનો આધાર શેના પર છે ?

- (a) મધ્યस્થબેંકની સ્થિતિ (b) વેપારી  
(c) ગ્રાહક (d) ઉપરોક્ત તમામ

(14) નાણાંનો પુરવઠામાં શેનો સમાવેશ થાય છે ?

૭૮૬ :

- |    |     |     |     |
|----|-----|-----|-----|
| 1) | (a) | 9)  | (a) |
| 2) | (a) | 10) | (d) |
| 3) | (a) | 11) | (b) |
| 4) | (d) | 12) | (d) |
| 5) | (c) | 13) | (a) |
| 6) | (d) | 14) | (c) |
| 7) | (d) | 15) | (d) |
| 8) | (c) |     |     |

નોંધ

નોંધ

નોંધ





## યુનિવર્સિટી ગીત

સ્વાધ્યાય: પરમં તપ:

સ્વાધ્યાય: પરમં તપ:

સ્વાધ્યાય: પરમં તપ:

શિક્ષણ, સંસ્કૃતિ, સંદૂચાવ, દિવ્યબોધનું ધામ  
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નામ;  
સૌને સૌની પાંખ મળે, ને સૌને સૌનું આભ,  
દશે દિશામાં સ્મિત વહે હો દશે શુભ-લાભ.

અભિજ્ઞ રહી અજ્ઞાનના શાને, અંધકારને પીવો ?  
કહે બુદ્ધ આંબેડકર કહે, તું થા તારો દીવો;  
શારદીય અજવાળા પહોંચ્યાં ગુર્જર ગામે ગામ  
ધ્રુવ તારકની જેમ જળહળે એકલવ્યની શાન.

સરસ્વતીના મધ્યૂર તમારે ફળિયે આવી ગહેરે  
અંધકારને હડસેલીને ઉજાસના ઝૂલ મહેરે;  
બંધન નહીં કો સ્થાન સમયના જવું ન ઘરથી દૂર  
ઘર આવી મા હરે શારદા દૈન્ય તિમિરના પૂર.

સંસ્કારોની સુગંધ મહેરે, મન મંદિરને ધામે  
સુખની ટપાલ પહોંચે સૌને પોતાને સરનામે;  
સમાજ કેરે દરિયે હાંકી શિક્ષણ કેરું વહાણ,  
આવો કરીયે આપણ સૌ  
ભવ્ય રાષ્ટ્ર નિર્માણ...  
દિવ્ય રાષ્ટ્ર નિર્માણ...  
ભવ્ય રાષ્ટ્ર નિર્માણ

એકમલક્ષી અર્થશાસ્ત્ર  
પ્રથમ વર્ષ બી. કોમ  
**BCECO105**  
ભાગ-3



## એકમલક્ષી અર્થશાસ્ત્ર

---

એકમ : 9

વહેંચણીનો સિધ્યાંત

1-13

---

એકમ : 10

વેતન

14-26

---

એકમ : 11

વ્યાજના સિદ્ધાંતો

27-39

---

એકમ : 12

નફના સિદ્ધાંતો

40-52

---

એકમ : 13

કલ્યાણકારી અર્થશાસ્ત્ર

53-67

---

એકમ : 12

જોખમ અને અચોક્કસતાનું અર્થશાસ્ત્ર

68-83

લેખન :	ડૉ. સંગીતા ઘાટે ડૉ. સ્વાતી સક્સેના ડૉ. અંજલી ત્રિવેદી ડૉ. વિજય ધંધુકિયા ડૉ. જીવરાજ અંપડીયા	પ્રિન્સીપાલ, શ્રી એમ. પી. એન બી. એ. પટેલ ઉમિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ફોર ગર્લ્સ, અમદાવાદ. આસિસ્ટન્ટ પ્રોફેસર, શ્રી ચીમનભાઈ પટેલ ઇન્સ્ટ્યુટ ઓફ મેનેજમેન્ટ & રિસર્ચ, અમદાવાદ. આસિસ્ટન્ટ પ્રોફેસર, જી. એલ. એસ. યુનિવર્સિટી, અમદાવાદ. આસિસ્ટન્ટ પ્રોફેસર, સેન્ટ જેવિયર્સ કોલેજ, અમદાવાદ. આસિસ્ટન્ટ પ્રોફેસર, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ.
પરામર્શક(વિષય) :	ડૉ. હિનાબેન પટેલ ડૉ. પલ્લવી વ્યાસ	પ્રિન્સીપાલ, મણીબેન એમ.પી. શાહ મહિલા આર્ટ્સ કોલેજ, કડી. આસિસ્ટન્ટ પ્રોફેસર એન્ડ હેડ ઓફ ઇકોનોમિક ડીપાર્ટમેન્ટ, પ્રી. એમ.રી. શાહ કોમર્સ કોલેજ, અમદાવાદ.
પરામર્શક(ભાષા) :	પ્રો. (ડૉ.) યોગેન્ડ પારેખ	પ્રોફેસર (ગુજરાતી), ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ.
સંયોજક :	પ્રો. (ડૉ.) મનોજ શાહ	પ્રોફેસર & જિયામક, સ્ક્રૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ.
પ્રકાશક :	ડૉ. ભાવિન ત્રિવેદી	કાર્યકારી કુલસાચિવ, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ-382481.
આવૃત્તિ :	જૂન 2020 પ્રથમ આવૃત્તિ (નવો અભ્યાસક્રમ)	

### સર્વાધિકાર સુરક્ષિત

આ પાઠ્યપુસ્તક ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ઉપક્રમે વિદ્યાર્થીલક્ષી સ્વઅધ્યયન હેતુથી;  
દૂરવર્તી શિક્ષણના ઉદ્દેશને કેન્દ્રમાં રાખી તૈયાર કરવામાં આવેલ છે. જેના સર્વાધિકાર સુરક્ષિત છે. આ અભ્યાસ-સામગ્રીનો  
કોઈપણ સ્વરૂપમાં ધંધાધારી ઉપયોગ કરતાં પહેલાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની લેખિત પરવાનગી  
લેવાની રહેશે.

યુનિટ 9	વહેંચણીનો સિદ્ધાંત
------------	--------------------

### : રૂપરેખા :

- 9.1** પ્રસ્તાવના
- 9.2** વહેંચણીનો અર્થ
- 9.2.1** વ્યક્તિદીઠ આવકની વહેંચણી
  - 9.2.2** સાધનદીઠ આવકની વહેંચણી
- 9.3** વસ્તુઓનું મૂલ્યનિર્ધારણ અને સાધનોનું મૂલ્યનિર્ધારણ
- 9.4** વસ્તુ અને સાધનો વચ્ચે તફાવત
- 9.5** સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત
- 9.6** વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત
- 9.7** વહેંચણીના સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતની ધારણાઓ
- 9.8** વહેંચણીનાં સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતની સમજૂતી
- 9.9** સીમાંત ભૌતિક ઉત્પાદનનો અર્થ
- 9.10** સીમાંત ભૌતિક ઉત્પાદકતા
- 9.11** વહેંચણીના સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતની મર્યાદાઓ
- 9.12** ઉત્પાદનના સાધનોનું ભાવ નિર્ધારણ
- 9.13** સારાંશ
- 9.14** ચાવીરૂપ શબ્દો

### સ્વાધ્યાય

#### **9.1** પ્રસ્તાવના :

કોઈપણ રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે આર્થિક નીતિઓના ઘડતર પહેલા રાષ્ટ્રીય આવક તથા આવકની વહેંચણીનો અભ્યાસ કરવો આત્યંત આવશ્યક છે. આર્થિક નિર્ણયોમાં જેટલું મહત્વ રાષ્ટ્રીય આવકનું છે તેટલું જ મહત્વ રાષ્ટ્રીય આવકની વહેંચણીનું પણ છે જ. રાષ્ટ્રીય આવકની વહેંચણીનો અભ્યાસ આવકની અસમાનતા, ગરીબી, સંપત્તિની અસમાનતા, બેરોજગારી, કુગાવો જેવી આર્થિક સમસ્યાઓનો સામનો કરવા ખૂબ જ ઉપયોગી છે. રાષ્ટ્રીય આવક એટલે ઉત્પાદનના સાધનો જેવા કે જમીન, મૂરી, શ્રમ અને નિયોજકોને વળતર તરીકે મળતી આવકોનો સરવાળો. એટલે કે જમીનને વળતર તરીકે મળતું કુલ ભાડું, શ્રમને વળતર તરીકે મળતું કુલ વેતન, મૂરીને વળતર તરીકે મળતું કુલ વ્યાજ તથા નિયોજકને મળતો કુલ નફાનો સરવાળો. ઉત્પાદનના આ સાધનો વચ્ચે રાષ્ટ્રીય આવકની વહેંચણી કઈ રીતે થાય છે. કયા ઉત્પાદનના સાધનને વળતર તરીકે કેટલો બદલો મળે છે. સાધનોનું મૂલ્ય શેના આધારે નક્કી થાય છે તે બાબતોનો અભ્યાસ અર્થશાસ્ત્રના અભ્યાસમાં ખૂબ જ ઉપયોગી છે.

**9.2 વહેંચણીનો અર્થ :**

રાષ્ટ્રીય આવકની વહેંચણી બે રીતે કરવામાં આવે છે : (1) વ્યક્તિદીઠ આવકની વહેંચણી અને (2) સાધન દીઠ આવકની વહેંચણી.

**1. વ્યક્તિદીઠ આવકની વહેંચણી :**

આ પદ્ધતિમાં કુલ રાષ્ટ્રીય આવકની સમાજના જુદા જુદા લોકોમાં વહેંચણી કઈ રીતે થઈ છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે કઈ વ્યક્તિની આવક કેટલી થઈ છે. વ્યક્તિદીઠ આવકની ગણતરી કરતી વખતે એ બાબત ખાસ ધ્યાન રાખવી જોઈએ કે કોઈ એક વ્યક્તિને એકથી વધુ પ્રકારની આવક પણ મળતી હોય છે. દા.ત., નોકરી કરનાર વ્યક્તિને પગારની આવક મળતી હોય તે સાથે તેને પોતાની કોઈ મિલકતના ભાડાના તથા વ્યાજ કે ડિવિડની આવક પણ મળતી હોય તેવું બને. આથી વ્યક્તિની કુલ આવકો ધ્યાનમાં લેવી જોઈએ. સમાજમાં આવકની અસમાનતા તથા સંપત્તિની અસમાનતા જાણવા માટે તથા આ અસમાનતા ઘટાડવા માટે આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે.

**2. સાધનદીઠ આવકની વહેંચણી :**

રાષ્ટ્રીય આવકની વહેંચણીની આ પદ્ધતિમાં રાષ્ટ્રની આવકની ઉત્પાદનના ચાર સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજન વચ્ચે અનુકૂળ ભાંડું, વ્યાજ, વેતન અને નજી સ્વરૂપે કઈ રીતે વહેંચણી કરવામાં આવી છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. જમીન પર મળેલ ભાડાની આવકમાં જમીન પર મળતી રોયલ્ટીની આવક પણ ઉમેરવી જોઈએ. શ્રમના સાધનને વેતન સ્વરૂપે મળતું રોકડ વેતન ઉપરાંત અન્ય પ્રકારે મળતી સવલતોને પણ ધ્યાનમાં લેવું જોઈએ. સાધનદીઠ આવકની વહેંચણી સરકારને “GDP” અને “GNP”ની ગણતરીમાં ઉપયોગી છે. તદ્વારાંત સાધનદીઠ વહેંચણી આવકની અસમાનતા, સંપત્તિની અસમાનતા, શ્રમિકોની ઉત્પાદકતા, મૂડી રોકાણ વગેરે બાબતોના અભ્યાસમાં પણ ખૂબ જ ઉપયોગી છે.

**9.3 વસ્તુઓનું મૂલ્યનિર્ધારણ અને સાધનોનું મૂલ્યનિર્ધારણ :**

સામાન્ય સિદ્ધાંત મુજબ વસ્તુઓનું મૂલ્યનિર્ધારણ વસ્તુની માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા થાય છે. કોઈપણ વસ્તુની માંગ તેના પુરવઠા કરતાં વધુ હોય ત્યારે વસ્તુની બજારમાં અધિત ઉદ્ભવે છે. જેને કારણે વસ્તુનું મૂલ્ય વધે છે એથી ઉદ્ભું જો વસ્તુની માંગ કરતા વસ્તુનો પુરવઠો વધુ હોય તો બજારમાં વસ્તુની છત ઉદ્ભવે છે જેને કારણે વસ્તુનું મૂલ્ય ઘટે છે. આમ, વસ્તુઓનું મૂલ્ય નિર્ધારણ બજાર દ્વારા વસ્તુના માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા નક્કી થાય છે.

સાધનોના મૂલ્ય નિર્ધારણ અંગે બે જુદા જુદા મત પ્રવર્તે છે. કેટલાક અર્થશાસ્ત્રીઓના મતે જેમ વસ્તુઓનું મૂલ્યનિર્ધારણ વસ્તુઓના માંગ અને પુરવઠાને આધારે થાય છે તે જ રીતે સાધનોનું મૂલ્ય નિર્ધારણ પણ સાધનોની માંગ અને પુરવઠાને આધારે જ થવું જોઈએ. પરંતુ અન્ય કેટલાક અર્થશાસ્ત્રીઓનો મત એવો છે કે વસ્તુ અને સાધનો વચ્ચે અનેક તફાવતો હોવાથી સાધનોના મૂલ્ય નિર્ધારણ માટે અલગ સિદ્ધાંત આવશ્યક છે.

**9.4 વસ્તુ અને સાધનો વચ્ચે તફાવત :**

1. માંગ : વસ્તુની માંગ પ્રત્યક્ષ છે જ્યારે સાધનની માંગ પરોક્ષ છે.
2. માંગનો આધાર : વસ્તુની માંગનો આધાર તૃણિગુણ ઉપર છે. જ્યારે સાધનની માંગનો આધાર સાધનની ઉત્પાદકતા પર છે.

3. પુરવઠાની પરિવર્તનશીલતા : વસ્તુઓનો પુરવઠો વધુ પરિવર્તનશીલ હોય છે જ્યારે સાધનોનો પુરવઠો પ્રમાણમાં ઓછો પરિવર્તનશીલ હોય છે.
4. ઉત્પાદન ખર્ચ : વસ્તુનું ઉત્પાદન ખર્ચ જાણવું સરળ છે, જ્યારે સાધનનું ઉત્પાદન ખર્ચ જાણવું મુશ્કેલ છે.
5. પુરવઠાનું મહત્વ : વસ્તુના મૂલ્ય નિર્ધારણમાં વસ્તુનો માંગ અને પુરવઠો બન્ને મહત્વના છે જ્યારે સાધનના મૂલ્ય નિર્ધારણમાં પુરવઠાનું પરિબળ ઓછું મહત્વ ધરાવે છે.

#### **9.5 સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત :**

રાષ્ટ્રીય આવકની વહેંચણીની બે રીતો છે : (1) વ્યક્તિદીઠ અને (2) સાધનદીઠ. કુલ રાષ્ટ્રીય આવકની, ઉત્પાદનના ચાર સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક વચ્ચે જે રીતે વહેંચણી કરવામાં આવે છે. તેને સાધનદીઠ આવકની વહેંચણી કહેવામાં આવે છે. સાધનદીઠ આવકની વહેંચણીનો અભ્યાસ અર્થતંત્રની સમસ્યાઓના અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી છે. સાધનદીઠ આવકની વહેંચણીનો ખ્યાલ સમજવા માટે જુદા-જુદા અર્થશાસ્ત્રીઓ દ્વારા સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો છે. આ સિદ્ધાંતના ઘડતરમાં નીચે જણાવેલ અર્થશાસ્ત્રીઓનો ફાળો ઘણો જ મહત્વનો રહ્યો છે.

પ્રો. રીકાર્ડો, શ્રીમતી જોન રોબિન્સન, પ્રો. કાર્લ માર્ક્સ, કલેકી તથા કાલ્ફોર.

#### **9.6 વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત :**

“પૂર્ણ હરીફાઈમાં ઉત્પાદનના દરેક સાધનને તેમની સીમાંત ઉત્પાદકતા જેટલો બદલો લાંબા ગાળે મળે છે.” એટલે કે સાધનની સીમાંત ઉત્પાદકતા વધુ હોય તેને વધુ વળતર અને જે સાધનની સીમાંત ઉત્પાદકતા ઓછી હોય તે સાધનને ઓછું વળતર મળતું હોય છે. સમયના ટૂંકાગાળા દરમિયાન ઉત્પાદનના સાધનની કિંમત અને સાધનની સીમાંત ઉત્પાદકતા વચ્ચે તફાવત હોઈ શકે છે. એટલે કે ઓછી સીમાંત ઉત્પાદકતા હોવા છતાં વધુ વળતર મળી શકે છે તથા સમયના ટૂંકાગાળા દરમિયાન સીમાંત ઉત્પાદકતા વધુ હોવા છતાં સાધનની કિંમત ઓછી હોય તેવું બને પરંતુ સમયના લાંબા ગાળામાં ઉત્પાદનના દરેક સાધનને તેની સીમાંત ઉત્પાદકતા જેટલો જ બદલો (વળતર) મળતો હોય છે.

વહેંચણીના સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંત મુજબ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં સમયના લાંબાગાળામાં જમીનને તેની સીમાંત ઉત્પાદકતા જેટલું જ ભાડું, મૂડીને તેની સીમાંત ઉત્પાદકતા જેટલા પ્રમાણમાં વાજ, શ્રમિકને તેની સીમાંત ઉત્પાદકતા જેટલું વેતન અને નિયોજક ને તેની સીમાંત ઉત્પાદકતા જેટલો નંખો મળતો હોય છે.

#### **9.7 વહેંચણીના સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતની ધારણાઓ :**

વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત નીચે જણાવેલ ધારણાઓ ઉપર આધારિત છે.

1. સીમાંત ઉત્પાદકતા માપી શકાય છે : આ સિદ્ધાંતમાં એવી ધારણા કરવામાં આવી છે કે ઉત્પાદનના અન્ય સાધનોનું પ્રમાણ સ્થિર રાખી, કોઈ એક સાધનના પ્રમાણમાં ફેરફાર કરી તે સાધનની સીમાંત ઉત્પાદકતા માપી શકાય છે.
2. પૂર્ણ હરીફાઈ : આ સિદ્ધાંત મુજબ વસ્તુના બજારમાં અને ઉત્પાદનના સાધનના બજારમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે.
3. પૂર્ણ રોજગારી : આ ધારણા મુજબ અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી છે એટલે કે ઉત્પાદનનું

કોઈ પણ સાધન બેરોજગાર કે ફાજલ નથી એટલે કે ઉત્પાદનના દરેક સાધનને વર્તમાન કિંમતે રોજગારી મળી રહે છે.

4. મહત્તમ નફાનો હેતુ : આ ધારણા મુજબ નિયોજક એટલે કે ઉત્પાદકનો મુખ્ય હેતુ મહત્તમ નફો કરવામાં છે. એટલે કે પ્રત્યેક ધંધાકીય એકમ પડતરને ન્યૂનતમ કરી મહત્તમ ઉત્પાદન કરી મહત્તમ નફો કમાવવા માંગે છે.
5. ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ છે : આ ધારણા મુજબ ઉત્પાદનના સાધનો વિસ્તાર અને વ્યવસાયની દાખિયા સંપૂર્ણ ગતિશીલ છે એટલે કે એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં તથા એક વ્યવસાયમાંથી બીજા વ્યવસાયમાં જવા માટે સંપૂર્ણ ગતિશીલ છે.
6. ઉત્પાદનના સાધનો વિભાજય છે : આ ધારણા મુજબ ઉત્પાદનના સાધનો, અવિભાજય નથી એટલે કે તેમનું નાના-નાના એકમોમાં વિભાજન કરી શકાય છે.
7. સ્થિર ઉત્પાદન પદ્ધતિ : આ સિદ્ધાંતની રૂચનામાં એવી ધારણા કરવામાં આવી છે કે ઉત્પાદનની પદ્ધતિ બદલાતી નથી એટલે કે સ્થિર જ રહે છે.
8. ઉત્પાદનના સાધનો સમાનગુણી છે : આ ધારણા મુજબ ઉત્પાદનના સાધનોના બધા જ એકમો સમાનગુણી છે એટલે કે સાધનના બધા જ એકમોની કાર્યક્ષમતા એકસમાન છે.
9. ગ્રાહકોની પસંદગી સ્થિર છે : ઉત્પાદનના સાધનો દ્વારા ઉત્પાદિત વસ્તુઓ પ્રત્યે લોકો (ગ્રાહકો)ની પસંદગી બદલાતી નથી. એટલે કે સ્થિર જ રહે છે.
10. અમુક બિંદુ પછી ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે : ઉત્પાદનના અન્ય સાધનોનું પ્રમાણ સ્થિર રાખી માત્ર કોઈ એક સાધન જેમ કે શ્રમના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે તો સીમાંત ઉત્પાદકતા નીચે મુજબ જોવા મળે છે : ઉત્પાદનના અન્ય સાધનો સ્થિર રાખી માત્ર શ્રમના એકમો વધારવામાં આવે તો વસ્તુ “એ” નું કુલ ઉત્પાદન, વસ્તુ “એ” નું સીમાંત ઉત્પાદન તથા વસ્તુ “એ” ની સીમાંત ઉત્પાદકતા અંગેની માહિતી નીચે જણાવેલ કોષ્ટક રૂપે રજૂ કરી શકાય.

#### 9.8 વહેંચણીનાં સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતની સમજૂતી :

ધારો કે ઉત્પાદનના અન્ય સાધનોનું પ્રમાણ સ્થિર રાખી માત્ર કોઈ એક સાધન જેમ કે શ્રમના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે તો સીમાંત ઉત્પાદકતા નીચે મુજબ જોવા મળે છે :

ઉત્પાદનના અન્ય સાધનો સ્થિર રાખી માત્ર શ્રમના એકમો વધારવામાં આવે તો વસ્તુ “એ” નું કુલ ઉત્પાદન, વસ્તુ “એ” નું સીમાંત ઉત્પાદન તથા વસ્તુ “એ” ની સીમાંત ઉત્પાદકતા અંગેની માહિતી નીચે જણાવેલ કોષ્ટક રૂપે રજૂ કરી શકાય.

ઉત્પાદનના અન્ય સાધનો	શ્રમના એકમો	કુલ ઉત્પાદન વસ્તુ “A” નું	સીમાંત ભૌતિક ઉત્પાદન	વસ્તુ “A” નું મૂલ્ય ( ) માં	સીમાંત ઉત્પાદકતા	વેતનદર
50	10	80	-	-	-	100
50	11	90	10	10	100	100
50	12	102	12	10	120	100
50	13	118	16	10	160	100
50	14	132	14	10	140	100
50	15	144	12	10	120	100
50	16	154	10	10	100	100
50	17	162	8	10	80	100
50	18	168	6	10	60	100

ઉપરોક્ત કોષ્ટક મુજબ જ્યારે 10 શ્રમિકો હતા ત્યારે કુલ ઉત્પાદન 80 વસ્તુઓનું થતું હતું જ્યારે 11 શ્રમિકો થયા ત્યારે કુલ ઉત્પાદન વધીને 90 એકમ થયું. આમ 11માં શ્રમિકની સીમાંત ઉત્પાદનની ગણતરી (90 વસ્તુ - 80 વસ્તુ) = 10 એકમ. એ જ રીતે શ્રમના દરેક એકમની સીમાંત ભૌતિક ઉત્પાદનની ગણતરી કરી શકાય છે.

#### **9.9 સીમાંત ભૌતિક ઉત્પાદનનો અર્થ :**

ઉત્પાદનના અન્ય સાધનોનું પ્રમાણ સ્થિર રાખી માત્ર કોઈ એક સાધનનાં પ્રમાણમાં વધઘટ કરવામાં આવે તો કુલ ઉત્પાદનમાં થતી વધઘટને તે સાધનનું સીમાંત ઉત્પાદન કહેવામાં આવે છે. દા.ત.,, ઉપરના કોષ્ટકમાં 12 શ્રમિકો દ્વારા થતું કુલ ઉત્પાદન 102 એકમોનું છે જ્યારે 13 શ્રમિકો દ્વારા થતું “એ” વસ્તુનું કુલ ઉત્પાદન 118 એકમોનું છે. આથી,

$$\begin{aligned} \text{૧૩માં શ્રમિકનું} \\ \text{સીમાંત ઉત્પાદન} &= ૧૩ શ્રમિકોનું કુલ ઉત્પાદન - ૧૨ શ્રમિકોનું કુલ ઉત્પાદન \\ &= ૧૧૮ એકમ - ૧૦૨ એકમ \\ &= ૧૬ એકમ (\text{વસ્તુ } "A") \end{aligned}$$

#### **9.10 સીમાંત ભૌતિક ઉત્પાદકતા :**

સીમાંત ભૌતિક ઉત્પાદકતા શોધવા માટે ઉત્પાદનના સાધનનાં સીમાંત ભૌતિક ઉત્પાદનને ઉત્પાદિત વસ્તુની બજારકિંમત અથવા વસ્તુની વેચાણકિંમત વડે ગુણી કાઢવામાં આવે છે. આમ, સીમાંત ભૌતિક ઉત્પાદકતા = સીમાંત ઉત્પાદન X વસ્તુની કિંમત

દા.ત.,, ઉપરના કોષ્ટકમાં 15માં શ્રમિકનું સીમાંત ઉત્પાદન “12” વસ્તુઓનું છે અને વસ્તુ “એ” વેચાણકિંમત ₹10 છે, આથી,

$$\begin{aligned} \text{૧૫માં શ્રમિકની સીમાંત} \\ \text{ભૌતિક ઉત્પાદકતા} &= ૧૫માં શ્રમિકનું સીમાંત \times (\text{વસ્તુ } "A") \text{નું} \\ &\quad \text{ભૌતિક ઉત્પાદન} \quad \text{બજારમૂલ્ય} \\ &= ૧૨ \text{ વસ્તુઓ} \times ૧૦ \\ &= ૧૨૦ \end{aligned}$$

ઉપરના કોષ્ટકમાં એ સ્પષ્ટ જોઈ શકાય છે કે શ્રમના 13 એકમો સુધી વધતી પેદાશનો નિયમ કામ કરે છે અને શ્રમના 13માં એકમ પછી ઘટતી પેદાશનો નિયમ કામ કરે છે.

કોઈપણ ઉત્પાદક કે નિયોજક શ્રમિકને કેટલું વળતર ચૂકવશે તેનો આધાર જે તે શ્રમિકની સીમાંત ઉત્પાદકતા ઉપર છે. શ્રમિકને ચૂકવાનું વેતન અને જે-તે શ્રમિકની સીમાંત ઉત્પાદકતા સરખા થાય ત્યારે નિયોજક સમતુલ્ય મેળવતો હોય છે એટલે કે જ્યાં સુધી શ્રમિકની સીમાંત ઉત્પાદકતા અને શ્રમિકને ચૂકવાતું વેતન સમાન ન થાય ત્યાં સુધી નિયોજક શ્રમિકોના પ્રમાણમાં ફેરફાર કરતો જ રહે છે.


ઉપરના કોષ્ટકમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે 11માં શ્રમિકે તેમજ 16માં શ્રમિકે બન્ને સમયે સીમાંત ઉત્પાદકતા અને શ્રમિકને ચૂકવાનું વળતર બન્ને સમાન થાય છે પરંતુ નિયોજક 11માં શ્રમિકે સમતુલ્ય પ્રાપ્ત કરશે નહીં કારણ કે 11માં શ્રમિકે વધતી પેદાશનો નિયમ કામ કરે છે જ્યારે 16માં શ્રમિકે સીમાંત ઉત્પાદકતા અને શ્રમિકનું વેતન બન્ને સરખા છે તેમજ તે સમયે ઘટતી પેદાશનો નિયમ કામ કરે છે. આથી નિયોજક 16માં શ્રમિકે સમતુલ્ય મેળવશે.

નિયોજક દ્વારા 16થી વધુ શ્રમિકો રોકવામાં આવશે નહીં કારણ કે 16 થી વધુ શ્રમિકો રોકવાથી નિયોજકને નુકસાન થશે. દા.ત. 17માં શ્રમિકની સીમાંત ઉત્પાદકતા ₹80 છે જ્યારે તેને ચૂકવાતું વેતન ₹100 છે. એટલે કે 17માં શ્રમિકને કારણે નિયોજકને આવક ₹80 થશે અને તેનો ખર્ચ ₹100 થશે એટલે કે તેને ₹20નું નુકસાન થશે. આથી નિયોજક 16થી વધુ શ્રમિકો રાખશે નહિં.

આમ, નિયોજકની સમતુલા માટેની શરતો :

- સીમાંત ઉત્પાદકતા = વેતન થાય
- ઘરતી પેદાશનો નિયમ કામ કરતો હોય.

### આકૃતિ 1



ઉપરોક્ત આકૃતિ મુજબ નિયોજક દ્વારા “OM” જેટલા શ્રમિકો રોકવામાં આવશે. કારણ કે “P” બિંદુએ “OM” જેટલા શ્રમિકોએ સીમાંત ઉત્પાદકતા અને વેતન સરખા છે એટલે કે સીમાંત ઉત્પાદકતા = વેતન છે. તથા સીમાંત ઉત્પાદકતા તે સમયે ઘટી રહી છે. આથી “OM” જેટલા શ્રમિકોએ નિયોજક સમતુલા મેળવશે.

ઉત્પાદનના ચારેય સાધનો વર્ષે રાષ્ટ્રીય આવકની વહેંચણીને આ સિક્ષાંત દ્વારા નીચે મુજબનાં સૂત્ર પ્રમાણે રજૂ કરી શકાય છે.

$$\begin{array}{rcl}
 & \text{જમીનનું પ્રમાણ} & \times \text{ જમીનની સીમાંત ઉત્પાદકતા} \\
 \text{G.N.P.} & = & + \text{ શ્રમનું પ્રમાણ} \quad \times \text{ શ્રમની સીમાંત ઉત્પાદકતા} \\
 (\text{કાચી રાષ્ટ્રીય પેદાશ}) & = & + \text{ મૂડીનું પ્રમાણ} \quad \times \text{ મૂડીની સીમાંત ઉત્પાદકતા} \\
 & & + \text{ યોજકનું પ્રમાણ} \quad \times \text{ યોજકની સીમાંત ઉત્પાદકતા}
 \end{array}$$

## 9.11 વહેંચણીના સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતની મર્યાદાઓ :

વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત આર્થિક બાબતોના અભ્યાસમાં અતિ મહત્વનો હોવા છતાં આ સિદ્ધાંતની ધારણાઓ અને તેની રચનામાં અનેક મર્યાદાઓ રહેલી છે. આ સિદ્ધાંતની મહત્વની મર્યાદાઓ નીચે મુજબ છે.

- પૂર્ણ હરિફાઈની અવાસ્તવિક ધારણા :** આ સિદ્ધાંત મુજબ વસ્તુ બજારમાં અને સાધન બજારમાં બન્ને બજારમાં પૂર્ણ હરિફાઈ પ્રવર્તે છે. પરંતુ વર્તમાન સમયમાં વાસ્તવમાં વસ્તુ બજાર કે સાધન બજારમાં ક્યાંય પૂર્ણ હરિફાઈ જોવા મળતી નથી.
- પૂર્ણ રોજગારીની અવાસ્તવિક ધારણા :** આ સિદ્ધાંત મુજબ એવી ધારણા કરવામાં આવી છે કે દેશમાં પૂર્ણ રોજગારી સ્થિતિ પ્રવર્તે છે પરંતુ હક્કિકતમાં દુનિયાના કોઈ પણ દેશમાં 100% પૂર્ણ રોજગારી જોવા મળતી નથી આથી આ ધારણા અવાસ્તવિક છે.
- સીમાંત ઉત્પાદકતા માપવી મુશ્કેલ :** આ સિદ્ધાંત મુજબ ઉત્પાદનના સાધનોની સીમાંત ઉત્પાદકતા માપી શકાય છે પરંતુ વર્તમાન સમયના મોટા પાયાના ઉદ્યોગોમાં કોઈ એક એકમની સીમાંત ઉત્પાદતા માપવી ઘણી જ મુશ્કેલ છે. કારણકે ખૂબ જ મોટા કદના ઉદ્યોગોમાં એક એકમની વધઘટ કરવાથી કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો નથી. દા.ત., કોઈ ઉદ્યોગમાં 2000 કામદારો હોય તો તેમાં 1 કામદાર વધારતા 2001 કામદારોથી કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો નથી.
- ઉત્પાદનના સાધનોની સંપૂર્ણ ગતિશીલતાની અયોગ્ય ધારણા :** આ સિદ્ધાંત મુજબ ઉત્પાદનના સાધનો વિસ્તાર અને વ્યવસાયની દસ્તિએ સંપૂર્ણ ગતિશીલ છે પરંતુ ટેકનિકલ કારણોને લીધે વ્યવસાયિક ગતિશીલતા અને આર્થિક, સાંસ્કૃતિક, પારિવારીક તથા રાજકીય કારણોને લીધે વિસ્તારની ગતિશીલતા સંપૂર્ણપણે જોવા મળતી નથી.
- ઘટતી પેદાશની અવાસ્તવિક ધારણા :** આધુનિક સમયમાં વૈજ્ઞાનિક સંશોધનો અને ટેક્નોલોજીકલ સંશોધનોને કારણે ઘટતી પેદાશને અટકાવી શકાય છે. આથી ઘટતી પેદાશની ધારણા અવાસ્તવિક છે.
- મહત્વમાં નફાની ધારણા :** આ સિદ્ધાંત મુજબ નિયોજકનો મુખ્ય ઉદ્દેશ મહત્વમાં નફાનો જ છે. પરંતુ વાસ્તવમાં નિયોજક સાધન સંયોજન નક્કી કરતી વખતે માત્ર નફાનો જ નહીં પરંતુ સલામતીને પણ ધ્યાનમાં રાખે છે તેની અવગાણના કરવામાં આવી છે.
- સીમાંત ઉત્પાદકતા અને વેતન વચ્ચેના સંબંધની ધારણા :** આ સિદ્ધાંત મુજબ સીમાંત ઉત્પાદકતાને આધારે વેતન નક્કી થાય છે એટલે કે સીમાંત ઉત્પાદકતા નિરપેક્ષ પરિબળ છે અને વેતન સાપેક્ષ પરિબળ છે અને બન્ને વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. પરંતુ ઘણીવાર વેતનના વધારાને કારણે તે વધુ પોખણયુક્ત આહાર તથા તાલીમ મેળવતા તેની સીમાંત ઉત્પાદકતા વધે છે. આમ, સીમાંત ઉત્પાદકતા અને વેતન બન્ને પરસ્પર એકબીજા ઉપર આધારિત છે.
- વાસ્તવિક પરિબળો ધ્યાનમાં લેવાયા નથી :** આ સિદ્ધાંતમાં ઉત્પાદનના સાધનોનાં મૂલ્ય નિર્ધારણમાં સાધનની સીમાંત ઉત્પાદકતાને જ મહત્વ આપવામાં આવ્યું છે પરંતુ સાધનની કિંમત નક્કી કરવામાં તેના ઉપરાંત સામાજિક પરિબળો, રાજકીય પરિબળો, લઘુત્તમ વેતનનો કાયદો, સામૂહિક સોદાશક્તિ જેવા પરિબળો પણ

મહત્વનો ભાગ ભજવતા હોય છે. પરંતુ આવા પરિબળોની અવગણના કરવામાં આવેલ છે.

9. ઉત્પાદનના સાધનોની માંગનો આધાર : આ સિદ્ધાંત મુજબ ઉત્પાદનના સાધનોની માંગનો આધાર જે-તે સાધનોની સીમાંત ઉત્પાદકતા પર છે પરંતુ વાસ્તવમાં સાધનોની માંગનો આધાર તેમની સીમાંત ઉત્પાદકતા પર નહીં પરંતુ વસ્તુ બજારમાં વસ્તુઓની અસરકારક માંગ પર છે.
10. ઉત્પાદનના સાધનો સમાનગુણી નથી : આ સિદ્ધાંતમાં એવી ધારણા કરવામાં આવી છે કે ઉત્પાદનના સાધનોના તમામ એકમો સમાનગુણી છે એટલે કે બધા જ એકમોની કાર્યક્ષમતા એકસમાન છે પરંતુ વાસ્તવમાં એ શક્ય નથી કારણ કે બધા જ શ્રમિકો, બધી જ જમીન કે બધા જ નિયોજકોની કાર્યક્ષમતા એકસરખી જ હશે તે અશક્ય બાબત છે.
11. ઉત્પાદનના સાધનો વિભાજ્ય નથી : આ સિદ્ધાંત મુજબ ઉત્પાદનના સાધનો વિભાજ્ય છે, પરંતુ હીકતમાં ઉત્પાદનના સાધનો અમુક હદ સુધી જ વિભાજ્ય હોય છે આથી આ ધારણા અયોગ્ય છે.
12. એકપક્ષીય અને અપૂર્ણ સિદ્ધાંત છે : આ સિદ્ધાંતની એક અગત્યની મર્યાદા એ છે કે આ સિદ્ધાંત ઉત્પાદનના સાધનોની માંગનો વિચાર કરે છે પરંતુ આ સિદ્ધાંત ઉત્પાદનના સાધનોના પૂરવક્ષણી અવગણના કરે છે. આથી કેટલાક અર્થશાસ્ત્રીઓના મતે આ સિદ્ધાંત એકપક્ષીય અને અપૂર્ણ છે.
13. સાધનોના મૂલ્યનિર્ધારણની સમજૂતી નથી : આ સિદ્ધાંતની રચનામાં સાધનોનું મૂલ્ય અગાઉથી જ આપી દીધેલ છે જેમ કે આપણા ઉદાહરણમાં સાધનોનું મૂલ્ય (વેતન દર) અગાઉથી જ ₹100 આપી દીધેલ છે પરંતુ તે કઈ રીતે નક્કી થયું છે તેની સમજૂતી આપવામાં આવી નથી.

#### **9.12 ઉત્પાદનના સાધનોનું ભાવ નિર્ધારણ :**

જેમ વસ્તુની કિંમત તેની માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે તે જ રીતે આ સિદ્ધાંત મુજબ ઉત્પાદનના સાધનોનું મૂલ્ય નિર્ધારણ સાધનોની સીમાંત ઉત્પાદકતાને આધારે થતું હોય છે. પૂર્ણ હરિફાઈવાળા બજારમાં જે સાધનની કિંમત તેની સીમાંત ઉત્પાદકતા કરતાં વધુ હોય તો સમયના લાંબે ગાળે સાધનની કિંમત ઘટવાનું વલણ ધરાવશે. એ જ રીતે જે સાધનની કિંમત તેની સીમાંત ઉત્પાદકતા કરતા ઓછી હશે તો સમયના લાંબા ગાળામાં સાધનની કિંમત વધવાનું વલણ ધરાવશે. ટૂંકમાં લાંબા ગાળે સાધનની કિંમત અને સાધનની સીમાંત ઉત્પાદકતા બન્ને સરખા થશે.

આ સિદ્ધાંત પ્રમાણે સમયના લાંબાગાળામાં શ્રમિકને તેની સીમાંત ઉત્પાદકતા જેટલું વેતન, જમીનને તેની સીમાંત ઉત્પાદકતા જેટલું ભાડું, મૂરીને તેની સીમાંત ઉત્પાદકતા જેટલું વ્યાજ તથા નિયોજકને તેની સીમાંત ઉત્પાદકતા જેટલો નહીં મળતો હોય છે. એટલે કે જે સાધનની સીમાંત ઉત્પાદકતા વધુ હોય તેને વધુ વળતર અને જે સાધનની સીમાંત ઉત્પાદકતા ઓછી હોય તેને ઓછુ વળતર મળતું હોય છે.

#### **9.13 સારાંશ**

##### **1. વહેંચણી એટલે શું સમજાવો.**

રાષ્ટ્રીય આવકની વહેંચણીનો ખ્યાલ બે રીતે સમજાવવામાં આવેલ છે. (1) વ્યક્તિદીઠ

આવકની વહેંચણી એટલે કે કુલ રાષ્ટ્રીય આવકની સમાજના જુદા જુદા લોકોમાં કઈ રીતે વહેંચણી થયેલ છે તે અને (2) સાધનદીઠ આવકની વહેંચણી એટલે રાષ્ટ્રની કુલ આવકની વહેંચણી ઉત્પાદનના ચાર સાધનો જમીન, મૂડી, શ્રમ અને ભોજન વચ્ચે કઈ રીતે થઈ છે તેની સમજૂતી.

## 2. વસ્તુઓનું મૂલ્યનિર્ધારણ અને સાધનોનું મૂલ્યનિર્ધારણ :

વસ્તુઓનું મૂલ્યનિર્ધારણ વસ્તુઓની બજારમાં માંગ અને વસ્તુઓના બજારમાં પુરવઠાને આધારે થતું હોય છે. જ્યારે ઉત્પાદનનાં સાધનોનું મૂલ્યનિર્ધારણ માંગ અને પુરવઠાના પરિબળને આધારે નહિ પરંતુ સાધનોની સીમાંત ઉત્પાદકતાને આધારે થતું હોય છે. વસ્તુઓમાં માંગ પુરવઠાથી વધુ હોય તો વસ્તુઓનું મૂલ્ય વધે છે અને જો માંગ તેના પુરવઠા કરતાં ઓછી હોય તો વસ્તુઓનું મૂલ્ય ઘટે છે. જ્યારે સાધનોની સીમાંત ઉત્પાદકતા વધુ હોય તો સાધનોનું મૂલ્ય વધે છે અને જો સાધનોની સીમાંત ઉત્પાદકતા ઓછી હોય તો સાધનોનું મૂલ્ય ઘટતું હોય છે.

## 3. વસ્તુઓના મૂલ્યનિર્ધારણ અને સાધનોના મૂલ્યનિર્ધારણ માટે અલગ સિદ્ધાંતની આવશ્યકતાના કારણો :

“વસ્તુ”	“સાધન”
1. તેની માંગ પ્રત્યક્ષ છે.	1. તેની માંગ પરોક્ષ છે.
2. તેની માંગનો આધાર તૃષ્ણિગુણ ઉપર છે.	2. તેની માંગનો આધાર સાધનની ઉત્પાદકતા પર છે.
3. તેનો પુરવઠો વધુ પરિવર્તનશીલ છે.	3. તેનો પુરવઠો ઓછો પરિવર્તનશીલ છે.
4. તેનો ઉત્પાદનખર્ચ જાણવો સરળ છે.	4. તેનો ઉત્પાદન ખર્ચ જાણવો મુશ્કેલ છે.
5. તેમાં માંગ અને પુરવઠો બન્ને પરિબળ મહત્વના છે.	5. તેમાં પુરવઠાનું પરિબળ ઓછા મહત્વનું છે.

## 4. વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત :

“પૂર્ણ હરિઝાઈમાં ઉત્પાદનના દરેક સાધનને તેની સીમાંત ઉત્પાદકતા જેટલો બદલો લાંબાગાળે મળે છે. એટલે કે જે સાધનની સીમાંત ઉત્પાદકતા વધુ હોય તેને વધુ બદલો અને જે સાધનની સીમાંત ઉત્પાદકતા ઓછી હોય તેને ઓછો બદલો મળે છે.”

સમયના ટૂંકાગાળામાં સીમાંત ઉત્પાદકતા અને સાધનના મૂલ્ય વચ્ચે તફાવત હોય તેવું બને પરંતુ લાંબે ગાળે દરેક સાધનનું મૂલ્ય તેની સીમાંત ઉત્પાદકતા જેટલું જ થાય છે.

## 5. વહેંચણીના સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતની ધારણાઓ :

વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત નીચે જણાવેલ ધારણાઓ પર આધારિત છે.

- (1) સીમાંત ઉત્પાદકત માપી શક્ય છે. (2) વસ્તુ અને સાધન બજારમાં પૂર્ણ હરિઝાઈ પ્રવર્તે છે. (3) અર્થતંત્રમાં પૂર્ણ રોજગારીની સ્થિતિ છે. (4) ઉત્પાદકનો મુખ્ય હેતુ મહત્મ નફાનો છે. (5) ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ છે. (6) ઉત્પાદનના સાધનો વિભાજ્ય છે. (7) ઉત્પાદનની પદ્ધતિ સ્થિર રહે છે. (8) ઉત્પાદનના સાધનો સમાનગુણી છે. (9) ગ્રાહકોની પસંદગી સ્થિર રહે છે. (10) અમુક બિંદુ પછી ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે.

6. **વહેંચણીના સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતની મર્યાદાઓ :**  
 વહેંચણીના સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતમાં નીચે જણાવેલ મર્યાદાઓ રહેલી છે.  
 (1) પૂર્ણ હરિફાઈની અવાસ્તવિક ધારણા (2) પૂર્ણ રોજગારીની ધારણા અવાસ્તવિક છે.  
 (3) સીમાંત ઉત્પાદકતા માપવી મુશ્કેલ છે. (4) ઉત્પાદનના સાધનોની સંપૂર્ણ ગતિશીલતાની અયોગ્ય ધારણા. (5) ઘટતી પેદાશના નિયમની ધારણા અવાસ્તવિક છે. (6) મહત્તમ નફાના હેતુની ધારણા અયોગ્ય છે. (7) સીમાંત ઉત્પાદકતા અને વેતન વચ્ચેના સંબંધની ધારણા અયોગ્ય. (8) સામાજિક અને રાજકીય પરિબળો, લઘુત્તમ વેતનનો કાયદો તથા સામૂહિક સોદા શક્તિ જેવા પરિબળોની અવગાણના. (9) ઉત્પાદનના સાધનોની માંગનો આધાર અસરકારક માંગ પર હોય છે. (10) ઉત્પાદનના તમામ સાધનો સમાજ ગુણી હોતા નથી. (11) ઉત્પાદનના સાધનો અમુક હદ સુધી જ વિભાજ્ય હોય છે. (12) આ સિદ્ધાંત એકપક્ષીય અને અપૂર્ણ સિદ્ધાંત છે. (13) સાધનોનું મૂલ્ય નિર્ધારણ કરી રીતે થાય છે તેની સમજૂતી નથી.
- **ચાવીરૂપ શબ્દો :**

  1. **પૂર્ણ હરિફાઈ :** જે બજારમાં સમાનગુણી વસ્તુના ભાવ, વાહનવ્યવહાર ખર્ચને બાદ કરતા બધા જ ભાગોમાં સરખા હોય તે પૂર્ણ હરિફાઈવાળું બજાર છે.
  2. **પૂર્ણ રોજગારી :** પૂર્ણ રોજગારી એ એવી સ્થિતિ છે જેમાં પ્રવર્તમાન દરે ઉત્પાદનના દરેક સાધનને કામ મળી રહે છે એટલે કે કોઈ પણ સાધન ફરજિયાત બેકારીની સ્થિતિમાં નથી. બજારમાં 100% રોજગારી પ્રાપ્ત છે.
  3. **રાષ્ટ્રીય આવકની વ્યક્તિદીઠ વહેંચણી :** રાષ્ટ્રીય આવકની સમાજના જૂડા જૂડા લોકો વચ્ચે કરાતી વહેંચણીને વ્યક્તિદીઠ આવકની વહેંચણી કહે છે.
  4. **સાધનદીઠ વહેંચણી :** રાષ્ટ્રીય આવકની ઉત્પાદનના ચાર સાધનો જમીન, મૂરી, શ્રમ અને નિયોજક વચ્ચે કરાતી વહેંચણીને સાધનદીઠ વહેંચણી કહેવામાં આવે છે.
  5. **સીમાંત ભૌતિક ઉત્પાદન :** ઉત્પાદનના અન્ય સાધનોનું પ્રમાણ સ્થિર રાખી, કોઈ એક સાધનના પ્રમાણમાં ફેરફાર કરવાથી વસ્તુના કુલ ઉત્પાદનમાં થતા ફેરફારને તે સાધનનું સીમાંત ભૌતિક ઉત્પાદન કહે છે.
  6. **સીમાંત ભૌતિક ઉત્પાદકતા :** ઉત્પાદનના સાધનનાં સીમાંત ભૌતિક ઉત્પાદનને જે તે વસ્તુની વેચાણ કિમત (બજાર કિમત) વડે ગુણવાથી સીમાંત ભૌતિક ઉત્પાદકતા પ્રાપ્ત કરી શકાય છે.
  7. **સીમાંત આવક ઉત્પાદકતા :** ઉત્પાદનના સાધનમાં એક એકમનો ફેરફાર કરવાથી કુલ આવકમાં જે ફેરફાર થાય તેને સીમાંત આવક ઉત્પાદકતા તરીકે ઓળખવામાં આવે છે.
  8. **ઘટતી પેદાશોનો નિયમ :** ઉત્પાદનના અન્ય સાધનો સ્થિર રાખી માત્ર કોઈ એક સાધનના પ્રમાણમાં વધારો કરવામાં આવે તો શરૂઆતમાં સીમાંત ભૌતિક ઉત્પાદન વધે છે પરંતુ અમુક બિંદુ પછી સીમાંત ભૌતિક ઉત્પાદનમાં ઘટાડે જોવા મળે છે આને ઘટતી પેદાશનો નિયમ કહે છે.
  9. **સાધનોની સંપૂર્ણ ગતિશીલતા :** સાધનોની સંપૂર્ણ ગતિશીલતા એટલે ઉત્પાદનના સાધનો વ્યવસાયિક અને ભૌગોલિક રીતે 100% ગતિશીલતા ધરાવે છે એટલે કે

ઉત્પાદનના સાધનો એક વ્યવસાયમાંથી બીજા વ્યવસાયમાં અને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે હંમેશા તત્પર હોય છે.

- 10. મહત્તમ નફાનો ઉદેશ :** દરેક નિયોજકનો ઉદેશ મહત્તમ નફાનો છે. એટલે કે દરેક નિયોજક ઉત્પાદન ખર્ચ ન્યૂનતમ કરી વધુમાં વધુ નફો કમાવવા માંગે છે.
- 11. સાધનોની વિભાજ્યતા :** સાધનોની વિભાજ્યતા એટલે કે કોઈ એક ઉત્પાદનના સાધનોનો જુદા જુદા વ્યવસાય માટે ઉપયોગ કરવા માટે તેનું વિભાજન કરી શકાય છે.
- 12. સ્થિર ઉત્પાદન પદ્ધતિ :** મુખ્યત્વે અર્થતંત્રમાં બે પ્રકારની ઉત્પાદન પદ્ધતિ જોવા મળે છે. (1) શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને (2) મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ. સ્થિર ઉત્પાદન પદ્ધતિ એટલે કે નિયોજક દ્વારા વસ્તુના ઉત્પાદનની પદ્ધતિમાં કોઈપણ ફેરફાર કરવામાં આવતો નથી.
- 13. સમાનગુણી સાધનો :** સમાનગુણી સાધનો એટલે કે ઉત્પાદનના સાધનના તમામ એકમો એકસરખી કાર્યક્ષમતા ધરાવે છે એટલે કે શ્રમના બધા જ એકમો એકસરખી કાર્યક્ષમતા ધરાવે છે. બધા જ શ્રમિકો એકસરખા, કુશળ, હોંશિયાર, અનુભવી અને નિષ્ણાંત છે.

#### સ્વાધ્યાય :

##### ● વૈકલ્પિક પ્રશ્નો :

નીચે આપેલ પ્રશ્નોના તેની નીચે આપેલ વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરીને લખો.

1. રાષ્ટ્રીય આવકની વહેંચણી કેટલી દાખિએ કરાય છે?  
 (અ) બે (બ) ત્રણ (ક) ચાર (દ) પાંચ
2. ઉત્પાદનના મુખ્ય સાધનોની સંખ્યા કેટલી છે?  
 (અ) બે (બ) ત્રણ (ક) ચાર (દ) પાંચ
3. વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત કઈ આવકની વહેંચણી સમજાવે છે?  
 (અ) વ્યક્તિ દીઠ (બ) સમાજ દીઠ (ક) સાધન દીઠ (દ) વર્ગ દીઠ
4. નીચેનામાંથી કયા બજારમાં સીમાંત ભૌતિક ઉત્પાદકતા અને સીમાંત આવક ઉત્પાદકતા એક જ હોય છે?  
 (અ) અપૂર્ણ હરિઝાઈ (બ) પૂર્ણ હરિઝાઈ (ક) ઈજારાયુક્ત હરિઝાઈ (દ) ઈજારો
5. વહેંચણીના સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંત મુજબ સાધનને લાંબેગાળે કેવું વળતર મળે છે?  
 (અ) સીમાંત ઉત્પાદકતા કરતાં વધુ (બ) સીમાંત ઉત્પાદકતા કરતાં ઓદ્ધું  
 (ક) સરેરાશ ઉત્પાદકતા જેટલું (દ) સીમાંત ઉત્પાદકતા જેટલું
6. વહેંચણીના સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતમાં કઈ પેદાશનો નિયમ લાગુ પડે છે?  
 (અ) વધતી પેદાશ (બ) ઘટતી પેદાશ (ક) સ્થિર પેદાશ (દ) એકપણ નહીં
7. વહેંચણીના સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતમાં નિયોજકનો મુખ્ય ઉદેશ કયો છે?  
 (અ) સમાજ સેવા (બ) મહત્તમ નફો (ક) સલામતી (દ) પ્રતિષ્ઠા પ્રાપ્તિ
8. સીમાંત ભૌતિક ઉત્પાદકતા શોધવા માટે સીમાંત ભૌતિક ઉત્પાદનને શેના વડે ગુણવામાં આવે છે?

- |     |  |                                     |
|-----|--|-------------------------------------|
|     | (અ) વસ્તુના એકમો   | (બ) વસ્તુની ખરીદકિમત                |
|     | (ક) વસ્તુની વેચાણ કિમત   | (ડ) વસ્તુદીઠ નફા                    |
| 9.  | ટૂંકાગાળામાં વસ્તુના કિમત નિર્ધારણમાં કયું પરિબળ મહત્વનું છે?                                    |                                     |
|     | (અ) માંગ   | (બ) પુરવઠો                          |
|     | (ક) માંગ અને પુરવઠો બન્ને  | (ડ) માંગ અને પુરવઠા પૈકી એકપણ નહીં. |
| 10. | ટૂંકાગાળામાં સાધનના કિમત નિર્ધારણમાં કયું પરિબળ વધુ મહત્વનું છે?                                 |                                     |
|     | (અ) માંગ   | (બ) પુરવઠો                          |
|     | (ક) માંગ અને પુરવઠો બન્ને  | (ડ) માંગ અને પુરવઠા પૈકી એકપણ નહીં. |
| 11. | લાંબાગાળામાં સાધનના કિમત નિર્ધારણમાં કયું પરિબળ સૌથી વધુ મહત્વનું છે?                            |                                     |
|     | (અ) સાધનની માંગ  | (બ) સાધનનો પુરવઠો                   |
|     | (ક) સાધનની સીમાંત ઉત્પાદકતા  | (ડ) એક પણ નહીં.                     |
| 12. | ઉત્પાદનના સાધનોનો પુરવઠો કેવો હોય છે?  |                                     |
|     | (અ) વધુ પરિવર્તનશીલ  | (બ) ઓછો પરિવર્તનશીલ                 |
|     | (ક) પરિવર્તનશીલ હોતો નથી   | (ડ) એક પણ નહીં.                     |
| 13. | ઉત્પાદનના સાધનોની માંગ કેવી હોય છે?  |                                     |
|     | (અ) પરોક્ષ   | (બ) પ્રત્યક્ષ                       |
|     | (ક) પ્રત્યક્ષ અને પરોક્ષ   | (ડ) પરોક્ષ અથવા પ્રત્યક્ષ           |
| 14. | વહેંચણીના સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંત મુજબ નિયોજિત ક્યારે સમતુલા મેળવે છે?                       |                                     |
|     | (અ) સીમાંત ઉત્પાદકતા વેતન કરતાં વધુ હોય ત્યારે   |                                     |
|     | (બ) સીમાંત ઉત્પાદકતા વેતન કરતાં ઓછી હોય ત્યારે   |                                     |
|     | (ક) સીમાંત ઉત્પાદકતા અને વેતન સરખા હોય ત્યારે  |                                     |
|     | (ડ) ઉપરોક્ત એક પણ સ્થિતિમાં નહીં.  |                                     |
| 15. | વહેંચણીના સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતની રૂચનામાં નીચે પૈકી ક્યા અર્થશાસ્ત્રીનો ફાળો મહત્વનો નથી? |                                     |
|     | (અ) પ્રો. કેઈન્સ   | (બ) પ્રો. રીકાર્ડો                  |
|     | (ક) પ્રો. કાર્લ માર્ક્સ  | (ડ) શ્રીમતી જોન રોબિન્સન            |
| 16. | ઉત્પાદનના ક્યા સાધનમાં સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત લાગુ પાડવો મુશ્કેલ છે?                        |                                     |
|     | (અ) ભાંડું   | (બ) વ્યાજ                           |
|     | (ક) વેતન   | (ડ) નફો                             |

: જવાબો :

1. (અ) 2. (ક) 3. (ક) 4. (બ)
5. (ક) 6. (બ) 7. (બ) 8. (ક)
9. (ક) 10. (અ) 11. (ક) 12. (બ)
13. (અ) 14. (ક) 15. (અ) 16. (ડ)

- નીચેના પ્રશ્નોનાં જવાબ આપો.
  1. રાષ્ટ્રીય આવકની વહેંચણીનો અર્થ અને વહેંચણીના સિદ્ધાંતો સમજાવો.
  2. વક્તિદીઠ આવકની વહેંચણીનો ખ્યાલ સમજાવો.
  3. સાધનદીઠ આવકની વહેંચણીનો ખ્યાલ સમજાવો.
  4. વસ્તુઓનું મૂલ્ય નિર્ધારણ એટલે શું? તે કઈ રીતે થાય છે?
  5. સાધનોના મૂલ્ય નિર્ધારણનો અર્થ અને આધાર જણાવો.
  6. સાધનોના મૂલ્ય નિર્ધારણ માટે અલગ સિદ્ધાંત શાથી આવશ્યક છે?
  7. વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત ચર્ચો.
  8. વહેંચણીના સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતની ધારણાઓ સમજાવો.
  9. વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત તેની મર્યાદાઓ સહિત ચર્ચા કરો.
  10. વહેંચણીના સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતની અર્થશાસ્ત્રના અત્યાસમાં ઉપયોગિતા સમજાવો.
  11. G. N. P. (કાચી રાષ્ટ્રીય પેદાશ) કઈ રીતે શોધવામાં આવે છે તેનું સૂત્ર જણાવો.
  12. વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત બીજા કયા નામે ઓળખવામાં આવે છે? શા માટે?
- **References**
  - H. L. Ahuja Business Economics, S. Chand.
  - Mankiw : Principles of Economics.
  - KPM Sundaram : Micro Economics.

યુનિટ 10	વેતન	
-------------	------	--

: રૂપરેખા :

- 10.0** પ્રસ્તાવના
- 10.1** વેતનનો અર્થ
- 10.2** વેતનનાં પ્રકારો
- 10.3** વેતનની વિભાવનાઓ
- 10.4** વિવિધ બજારમાં વેતન નિર્ધારણ
- 10.5** કામદાર મંડળની સફળતાનો આધાર
- 10.6** સારાંશ
- 10.7** ચાવીરૂપ શબ્દો

#### સ્વાધ્યાય

#### **10.0 પ્રસ્તાવના :**

અર્થશાસ્ત્રમાં ઉત્પાદનની પ્રક્રિયામાં ફાળો આપવા બદલ મજૂરને ચૂકવવામાં આવતી કિંમતને વેતન કહેવામાં આવે છે.

મજૂર એ ઉત્પાદનનો મહત્વપૂર્ણ પરિબળ છે. જો કામ કરવા માટે મજૂર ન હોય તો જમીન અથવા મૂડી, કે અન્ય તમામ પરિબળો નિર્જિય પુરવાર થશે.

આમ કાર્બ માર્કરેં મજૂરને “બધા મૂલ્યનાં સર્જક” (Creator of all value) ગણાવ્યા છે.

#### **10.1 અર્થ :**

જો કે માત્ર મજૂર દ્વારા જ ઉત્પાદન સંભવ નથી. કારણ કે મોટાભાગનાં ઉત્પાદનમાં - ઉત્પાદનનાં વિવિધ પરિબળોનાં સંયુક્ત પ્રયત્નોનું પરિણામ જોવા મળે છે. તેથી, ઉત્પાદન પ્રવૃત્તિ માટે મજૂરને ચૂકવણી કરવામાં આવતી પેદાશોની કિંમતને વેતન કહેવામાં આવે છે.

કામદાર દ્વારા કરવામાં આવેલી સેવાઓ માટે કરાર હેઠળ ચૂકવવામાં આવતી રકમને વેતન ગણવામાં આવે છે.

એ.એસ. હેન્સેનનાં મત મુજબ, “‘વેતન એ ઉત્પાદનમાં સહાયતા માટે મજૂરને કરવામાં આવતી ચૂકવણી છે.’’

એમ.સી. કોનેલનાં મત મુજબ, “‘વેતન દર મજૂરના ઉપયોગ માટે ચૂકવવામાં આવતી કિંમત છે.’’

જે.આર. ટર્નરનાં મત મુજબ, “‘વેતનની કિંમત હોય છે, તે મજૂરને / કામદારને નોકરીદાતા દ્વારા ચૂકવવામાં આવતી કિંમત છે.’’

## 10.2 વેતનનાં પ્રકાર :

વાસ્તવિક વ્યવહારમાં, વેતન ઘણા પ્રકારનાં નીચે મુજબ છે :

### (1) ઉત્પાદનલક્ષી વેતન (Piece Wage) :

ઉત્પાદનલક્ષી વેતન એ મજૂર દ્વારા કરવામાં આવેલા કામ અનુસાર ચૂકવવામાં આવતું વેતન છે, ઉત્પાદનલક્ષી વેતનની ગણતરી કરવા માટે કામદાર દ્વારા ઉત્પાદિત એકમોની સંખ્યા ધ્યાનમાં લેવામાં આવે છે.

### (2) સમયલક્ષી વેતન (Time wage) :

જો મજૂરને સમય અનુસાર તેની સેવાઓ માટે ચૂકવણી કરવામાં આવે છે તો તે સમયલક્ષી વેતન તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો મજૂરને દિવસ દીઠ 40 રૂ. આપવામાં આવે, તો તે સમય વેતન તરીકે ગણાશે.

### (3) નાણાકીય વેતન (Cash wage) :

રોકડ વેતન મજૂરને પૈસાના સ્વરૂપમાં ચૂકવવામાં આવતા વેતનનાં સંદર્ભમાં આપેલ છે. કામદારને ચૂકવવામાં આવતો પગાર રોકડ વેતનનો દાખલો છે.

### (4) રોકડની અવેજ વેતન :

જ્યારે મજૂરને રોકડનાં બદલે અવેજમાં માલની ચૂકવણી કરવામાં આવે છે. આ પ્રકારનાં વેતન ગ્રામીણ વિસ્તારોમાં લોકપ્રિય છે.

### (5) કરાર વેતન :

આ પ્રકાર હેઠળ સંપૂર્ણ કામ માટે શરૂઆતમાં વેતન નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે, જો કોઈ કોન્ટ્રાક્ટરને કહેવામાં આવે કે તેને બિંદિગનાં નિમાણ માટે રૂ.30,000 ચૂકવવામાં આવશે. કામ સોંપનાર અને કામ કરનાર વચ્ચે કામની શરતો, સમયમર્યાદા આદિ બાબતે લિખિત કરાર થાય છે. તે કરાર વેતન તરીકે ઓળખવામાં આવે છે.

## 10.3 વેતનની વિભાવનાઓ :

નીચે મુજબ વેતનની બે મુખ્ય વિભાવનાઓ છે :

### 1. નાણાકીય વેતન

### 2. વાસ્તવિક વેતન

#### (1) નાણાકીય વેતન (Monastery Wage) :

અગાઉથી નક્કી થયેલા કરાર તેમજ કામની શરતો મુજબ, કોઈની દેખરેખ હેઠળ વ્યક્તિ જે શારીરિક કે માનસિક શ્રમ કરે છે તેના બદલામાં નાણાંના સ્વરૂપમાં ચૂકવવામાં આવતું વળતર એટલે નાણાકીય વેતન

#### (2) વાસ્તવિક વેતન (Real Wage) :

અગાઉથી નક્કી થયેલ કરાર તથા કામની શરતો મુજબ કોઈની દેખરેખ હેઠળ વ્યક્તિ જે શારીરિક કે માનસિક શ્રમ કરે છે તેના બદલામાં તેને ચૂકવવામાં આવતું વળતર નાણાકીય સ્વરૂપે તેમજ તે નાણા દ્વારા તે કેટલી ચીજવસ્તુઓ કે સેવાઓ ખરીદી શકે છે તે તેમજ અન્ય ભૌતિક કે અભૌતિક લાભ, સગવડ, સવલત, ખરીદશક્તિની સલામતી, નોકરીની નિશ્ચિતતા વગેરે બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તેને વાસ્તવિક વેતન કહે છે.

## નાણાકીય વેતન અને વાસ્તવિક વેતન વચ્ચેનો તફાવત

નાણાકીય વેતન	વાસ્તવિક વેતન
૧. અગાઉથી નક્કી થયેલા કરાર મુજબ શ્રમિકે માલિકની સૂચના મુજબ વક્તિએ કરેલ શારીરિક કે માનસિક શ્રમનાં બદલામાં નાણા સ્વરૂપે ચૂકવવામાં આવતું વેતન.	૧. અગાઉથી નક્કી થયેલા કરાર મુજબ શ્રમિકે માલિકની સૂચના મુજબ વક્તિએ કરેલ શારીરિક માનસિક શ્રમનાં બદલામાં નાણા સ્વરૂપે ચૂકવવામાં આવતું વેતન તેમજ તેની ખરીદશક્તિ અને સાથે મળતા બિન-નાણાકીય લાભ.
૨. નાણાકીય વેતનને ભાવસપાટી સાથે કોઈ સંબંધ નથી.	૨. વાસ્તવિક વેતનનો ભાવ સાથે વસ્ત સંબંધ છે.
૩. નિરપેક્ષ જ્યાલાછે.	૩. સાપેક્ષ જ્યાલાછે.
૪. શ્રમિકોની વાસ્તવિક આર્થિક પરિસ્થિતિ જાણી શકાતી નથી.	૪. શ્રમિકોની વાસ્તવિક આર્થિક પરિસ્થિતિ જાણી શકાય છે.
૫. કામના કલાકો, જોખમ, નોકરીની અનિશ્ચિતતા જેવા પરિબળો ધ્યાનમાં લેવાતાં નથી.	૫. કામના કલાકો, જોખમ, નોકરીની અનિશ્ચિતતા જેવા પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે.
૬. શ્રમિકોનાં વાસ્તવિક જીવનધોરણનો અભ્યાસ કરી શકતો નથી.	૬. શ્રમિકોનું વાસ્તવિક જીવનધોરણ જાણી શકાય છે.

**10.4 વિવિધ બજારમાં વેતન નિર્ધારણ :**

બજારમાં મુખ્ય વે બે પ્રકારની સ્પર્ધા જેવા મળે છે :

૧. સંપૂર્ણ બજાર સ્પર્ધા


૨. અપૂર્ણ બજાર સ્પર્ધા

૧. સંપૂર્ણ બજાર સ્પર્ધા હેઠળ વેતન નિર્ધારણ :

સંપૂર્ણ બજાર હેઠળ, સંતુલન વેતન દર નક્કી કરવામાં આવે છે, જ્યાં મજૂર માટેની માંગ અને મજૂર પુરવણાની સમાન હોય છે.

બીજા શબ્દોમાં કહેવામાં આવે તો, સંપૂર્ણ સ્પર્ધા હેઠળ મજૂરને લાંબા ગાળે તેની સીમાંત આવક ઉત્પાદકતા સમાન આધારિત વેતન મળશે.

## આકૃતિ - 1



આકૃતિ-1માં X - અક્ષ પર મજૂરની સંખ્યા અને Y - અક્ષ પર વેતન દર દર્શાવવામાં આવેલ છે. DD અને SS અનુક્રમે મજૂરની માંગ અને મજૂરનો પુરવઠો રેખા છે. બંને રેખા E બિંદુ પર એક બીજાને છેદે છે, જે બજારમાં વેતન દર OP નક્કી કરે છે.

**સંતુલન વેતનદર નક્કી કરવા માટે :**

OP સ્તર વેતનદર પર ડોનિટ મજૂરને રોજગારી મળશે. હવે, ધારણા કરો કે, વેતન દર OP થી OP<sup>1</sup> સ્તર જેટલું વધે છે. આ કિંમત પર મજૂરની માંગ ON<sup>1</sup> અને મજૂરનો પુરવઠો ON<sup>2</sup> થશે. અહીંથાં, મજૂરનો પુરવઠો એ મજૂરની માંગ કરતા વધારે છે, જે મજૂરો વચ્ચે રોજગારી માટે સ્પર્ધા ઊભી કરશે, અંતે પરિણામે વેતનદરમાં ઘટાડો થશે. બીજું બાજુ, જો વેતન દર OP<sup>1</sup> થી OP<sup>2</sup> જેટલું ઘટે છે, ત્યારે મજૂરની માંગ એ મજૂરનો પુરવઠો કરતા વધારે થાય છે. જેના પરિણામે ઉત્પાદકો વચ્ચે મજૂરો માટે સ્પર્ધા ઉદ્ભવે છે. તેથી, અહીં જોઈ શકાય છે કે જ્યાં મજૂર માંગરેખા અને મજૂર પુરવઠા રેખા એકબીજાને છેદે છે, ત્યાં સમતુલનાને મેળવી શકાય છે.


**સમયગાળા અનુસાર, પેઢીની સમતુલા :**

- લાંબાગાળા માટે
- ટૂંકાગાળા માટે
- ટૂંકાગાળા માટે :

ટૂંકાગાળો એ એવા સમયગાળાને સંદર્ભિત કરે છે, જેમાં કોઈ પરિબળની માંગ અને પુરવઠાને સંપૂર્ણપણે સમાન બનાવવું કોઈ પેઢી માટે શક્ય નથી. તેથી ટૂંકાગાળામાં એક પેઢી ત્રણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી શકે છે:

- અસાધારણ નફો / અસામાન્ય નફો (Abnormal Profit)
  - સામાન્ય નફો (Normal Profit)
  - સામાન્ય ખોટ (Loss)
- (a) અસાધારણ / અસામાન્ય નફો :

આકૃતિ - 2



(ARP - Average Revenue Productivity)

(MRP - Marginal Revenue Productivity)

(ARP - સરેરાશ આવક ઉત્પાદકતા MRP - સીમાંત આવક ઉત્પાદકતા)

કુલ આવક - કુલ વેતન = અસાધારણ નફો

$OAPX - OWEX = \square WAPE$

સરેરાશ આવક - સરેરાશ વેતન = સરેરાશ નફો

$OA - OW = WA$

અથવા


$PX - EX = PE$

જો  $OW$  વેતનદર પર પેઢી રોજગારી એવા મજૂરોને આપે છે, જે મજૂરોની (ARP) સરેરાશ આવક ઉત્પાદકતા પ્રવર્તમાન વેતનદર કરતા વધારે છે, ત્યારે પેઢી અસાધારણ / અસામાન્ય નફો મેળવે છે. આ આકૃતિ-2 માં જણાવેલ મુજબ, આ પેઢી દ્વારા સંતુલનનાં સમયમાં  $OX$  એકમ મજૂરોને રોજગારી આપવામાં આવે છે. અહીં, સરેરાશ આવક ઉત્પાદકતા (ARP) એટલે  $PX$  - જે પ્રવર્તમાન વેતનદર  $EX$  કરતા વધારે છે. તેથી, આ પેઢી દ્વારા  $EP$  જેટલો અસાધારણ / અસામાન્ય નફો મેળવવામાં આવે છે.

## (b) સામાન્ય નક્ષો :

જો સરેરાશ આવક ઉત્પાદકતા (ARP) અને પ્રવ્તમાન વેતનદર સમાન હોય, તો ત્યારે પેઢી દ્વારા સામાન્ય નક્ષો મેળવવામાં આવે છે.

આકૃતિ - ૩




અહીં આકૃતિ-૩માં જણાવ્યા મુજબ, જ્યારે પેઢી OX એકમ જેટલા મજૂરોને રોજગારી આપે છે, ત્યારે સરેરાશ આવક ઉત્પાદકતા (ARP), એટલે EX જે પ્રવ્તમાન વેતનદર OW જેટલું સમાન છે. તેથી, આ પેઢી દ્વારા ફક્ત સામાન્ય નક્ષો મેળવવામાં આવે છે.

## (c) ખોટ :


જો સરેરાશ આવક ઉત્પાદકતા (ARP), પ્રવ્તમાન વેતનદર કરતાં ઓછું હોય તો, પેઢી દ્વારા ખોટ મેળવવામાં આવે છે. આકૃતિ-૪ માં જણાવ્યા મુજબ, જ્યારે પેઢી OX એકમ જેટલા મજૂરોને રોજગારી આપે છે, ત્યારે સરેરાશ આવક ઉત્પાદકતા (ARP) એટલે PX - જે પ્રવ્તમાન વેતનદર OW કરતા ઓછું જોવા મળે છે તેથી, આ પેઢી દ્વારા EP જેટલી ખોટ મેળવવામાં આવે છે.

આકૃતિ - ૪



- લાંબા ગાળા માટે :

લાંબા ગાળામાં પેઢી ફક્ત સામાન્ય નફો મેળવે છે. અહીં, જો સરેરાશ આવક ઉત્પાદકતા (ARP) અને સીમાંત આવક ઉત્પાદકતા (MRP) સમાન હોય, તો પેઢી દ્વારા સમતુલા મેળવવામાં આવે છે. આકૃતિ - ૫



અહીં, આકૃતિ-૫ માં જગ્યાવ્યા મુજબ, જ્યારે પેઢી દ્વારા OX એકમ મજૂરોને રોજગારી આપવામાં આવે છે, ત્યારે સરેરાશ આવક ઉત્પાદકતા (ARP) અને સીમાંત આવક ઉત્પાદકતા (MRP) સમાન જોવા મળે છે.

(2) અપૂર્ણ બજાર સ્પર્ધા હેઠળ વેતન નિર્ધારણ :

વાસ્તવિકતાની દુનિયામાં સંપૂર્ણ સ્પર્ધાને બદલે અપૂર્ણ સ્પર્ધા જોવા મળે છે, તેથી શ્રીમતી જોન રોબિન્સન અને પ્રો. પીગુએ અપૂર્ણ સ્પર્ધાની શરતો હેઠળ વેતન દર નિર્ધારણનો ખ્યાલ આપ્યો.

વેતનદર નિર્ધારણ નીચે મુજબ જગ્યાવી શકાય :


(X) સંપૂર્ણ હરિફાઈમાં ઉત્પાદન બજાર અને મોનોપ્સીની (એકાધિકાર) હરિફાઈમાં મજૂર બજાર

(Y) ઈજારામાં ઉત્પાદન બજાર અને મોનોપ્સોની (એકાધિકાર) હરિફાઈમાં મજૂર બજાર

(X) સંપૂર્ણ હરિફાઈમાં ઉત્પાદન બજાર અને મોનોપ્સાની (એકાધિકાર) હરિફાઈમાં મજૂર બજાર :

જ્યારે બજારમાં મજૂરનો એક જ ખરીદદાર હોય છે, ત્યારે મજૂર બજારમાં એકાધિકાર (મોનોપ્સોની) હોવાનું કહેવાય છે. જો મજૂર માટેની એકાધિકારની (મોનોપ્સોનીસ્ટ) ની માગમાં વધારો થાય છે, તો વેતનદર તે જ માગને અનુસરે છે, જે બદલામાં સરેરાશ અને સીમાંત વેતનદરમાં વધારો કરે છે.

## આકૃતિ - ૬



આકૃતિ-૬માં જગ્યાવા અનુસાર, X - અક્ષ પર મજૂરોની સંખ્યા અને Y- અક્ષ પર વેતનદર દરશાવવામાં આવેલ છે. ARP (Average Revenue Productivity) સરેરાશ આવક ઉત્પાદકતા અને MRP (Marginal Revenue Productivity) સીમાંત આવક ઉત્પાદકતા છે. AW અને MW જમણી તરફ ઉપરની દિશામાં વધતી વક છે - જે સરેરાશ વેતનદર (Average Wage Rate) અને સીમાંત વેતનદર (Marginal Wage Rate) છે. જેના દ્વારા એવું દરશાવવામાં આવે છે કે જો મોનોપોલીસ્ટ વધારે મજૂરોને રોજગારી આપવા માંગતી હોય તો તેણે ઊંચો વેતનદર આપવો પડે.

એકાધિકારવાદી પેઢી બિંદુ E પર સમતુલા મેળવે છે, જ્યાં સમતુલાની શરત સંતોષાય છે - સીમાંત વેતન દર અને સીમાંત આવક ઉત્પાદકતા (MRP) સમાન (MW) હોવા જોઈએ તથા સીમાંત આવક ઉત્પાદકતા (MRP) વળાંક સીમાંત વેતનદર વળાંકને પહેલા ઉપરથી કાપવા જોઈએ અને પછી નીચેની તરફ આવેલું હોય જોઈએ.

આમ, આ સંતુલનનાં સ્તરે, તે મજૂરનાં OX એકમોને રોજગાર આપશે અને OP જેટલું વેતનદર નક્કી કરવામાં આવશે.

જ્યારે વેતનદર, સીમાંત આવક ઉત્પાદકતા (MRP) કરવા ઓછું આપવામાં આવે છે, ત્યારે એનો અર્થ એ થાય કે એકાધિકારી (મોનોપોલીસ્ટ) દ્વારા મજૂરોનું શોખણ કરવામાં આવે છે. આમ, આ સંતુલનમાં એકાધિકારી (મોનોપ્સીનીસ્ટ) (PLMN) અસાધારણ નફો મેળવે છે. તેથી નિષ્કર્ષ એવું આવી શકે છે કે મજૂર બજારમાં અપૂર્ણ સ્પર્ધા અંતર્ગત મજૂરોનું શોખણ કરવામાં આવે છે.

(Y) ઈજારામાં ઉત્પાદન બજાર અને મોનોપ્સોની (એકાધિકાર) હરિફાઈમાં મજૂર બજાર :


જ્યારે ઉત્પાદન બજારમાં ઈજારો અને મજૂર બજારમાં મોનોપ્સોની

(એકાધિકાર) હરિફાઈ હોય, ત્યારે સીમાંત આવક ઉત્પાદન (MRP) અને સીમાંત ઉત્પાદનનું મૂલ્ય (VMP - Value of Marginal Product) વચ્ચે તફાવત જોવા મળે છે.

સીમાંત ઉત્પાદનનું મૂલ્ય (VMP) એ ઉત્પાદક પરિબળનાં છેલ્લા એકમ દ્વારા રોજગાર આપતી પેઢીની આવકનું એક માપ છે.

આંકૃતિ-7માં જડાવ્યા મુજબ, MRP એ સીમાંત આવક ઉત્પાદકતા વળાંક અને VMP એ સીમાંત ઉત્પાદનનાં મૂલ્ય વળાંક છે. VMP વળાંક એ MRP વળાંકથી ઉપર છે.

આંકૃતિ - 7



મોનોપ્સોનીસ્ટ (એકાધિકારવાદી) એ બિંદુ E પર સંતુલન ધરાવે છે. અહીં, મોનોપ્સોનીસ્ટ (એકાધિકારવાદી) બજારમાં ON એકમ મજૂરોને રોજગાર OP વેતન દર પર આપવામાં આવે છે.

ઉત્પાદન બજારમાં ઈજારો અને મજૂર બજારમાં મોનોપ્સોની (એકાધિકાર) એ બેવડા શોષણ તરફ દોરી જાય છે, એટલે કે ઈજારાયુક્ત શોષણ અને એકાધિકારીક શોષણ. આ સંતુલનનાં સ્તર પર ઈજારાયુક્ત શોષણ EL જેટલું અને એકાધિકારીક (મોનોપ્સોનીસ્ટ) શોષણ EK જેટલું કરવામાં આવે છે.

#### ૧૦.૫ કામદાર મંડળની સફળતાનો આધાર :

વીસમી સદીનાં પ્રારંભમાં, ભારે ઉદ્યોગ અને મોટા વ્યવસાય તેમની બાળપણ અવસ્થામાં હતા અને ઔદ્યોગિક કાંતિને સરળ બનાવવા માટે માનવ મજૂરોની ઘણી જરૂર હતી. આના કારણે બાળકો સહિતના કામદારોનો જડપથી દુરૂપયોગ થયો, જ્યાં તેમને દિવસનાં કેટલાક કલાકો સુધી તેમને પરિશ્રમ કરવાની ફરજ પડી હતી. જો કે, આખરે કામદારો મજૂર સંગઠનોની રચના માટે એક થયા, જે પેઢી અને મોટી કંપનીની સામે ઊભા થયા અને લાખો કર્મચારીઓ માટે વધુ પગાર અને કામ કરવાની શરતો માટે વાટાવાટ કરી

અને બાળમજૂર કાયદા પસાર કરવાની માંગ પણ કરી. જો કે, મજૂર સંગઠનો / મંડળોની સફળતા અને અસરકારકતા હંમેશા વિવાદનું કારણ બની છે.

મજૂર સંગઠન / મંડળની સફળતાનો આધાર એની અસરકારકતા તથા ફાયદાઓ પર છે. મજૂર સંગઠનો તેમના સત્યોના ફાયદા માટે બનાવવામાં આવેલા હોવા જોઈએ.

મજૂર સંગઠને વધુ વેતન અને કામ કરવાની સ્થિતિને સુરક્ષિત કરવા માટે કામદારો વતી વાટાઘાટો કરવી જોઈએ તથા ગ્રન્થોનો ઉચિત અને તાત્કાલિક ઉકેલ લાવવા માટેની તકેદારી રાખવી જોઈએ.

### ● ન્યૂનતમ વેતન :

ન્યૂનતમ વેતન અધિનિયમ 1948 એ ભારતીય મજૂર કાયદાને લગતા સંસદનો એક અધિનિયમ છે, જે કુશળ અને બિન-કુશળ મજૂરોને ચૂકવવાનાં ન્યૂનતમ વેતનને નિર્ધારિત કરે છે.

ભારતીય બંધારણે “Living Wage” ને આ રીતે વ્યાખ્યાપિત કર્યું છે, જે એક કામદારની આવકનું સ્તર છે, જેમાં સારા જીવન, માન, આરામ, શિક્ષણ સહિતનાં જીવનધોરણના મૂળભૂત સુનિશ્ચિત કરશે. કોઈ પણ આકસ્મિક સંઝોગોમાં જોકે બંધારણ મુજબ ચૂકવણી કરવાની ઉદ્યોગોને ક્ષમતાને ધ્યાનમાં રાખવા માટે “વાજબી વેતન - Faith Wage” ને વ્યાખ્યાપિત કરવામાં આવ્યું છે. વાજબી વેતન એ વેતનનું એવું સ્તર છે, જે ચૂકવણીની ક્ષમતાને ધ્યાનમાં રાખીને તેને વધારવાનો પ્રયત્ન કરે છે.

ભારતે 1948 માં ન્યૂનતમ વેતન કાયદો રજૂ કર્યો, વેતન નક્કી કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેને અધિકારકેત્ર આપ્યો. આ કાયદો કાયદેસર રીતે બિન-બંધનકર્તા છે, પરંતુ વૈધાનિક છે. ન્યૂનતમ વેતન ચૂકવવા અને સુધારવા માટેની ઉદ્યોગોની ક્ષમતાની સમીક્ષા કરવા માટે વેતનબોર્ડ ગોઠવવામાં આવ્યા છે, જેમાં દરેક પારિવારને આવરી લેવામાં આવ્યા, જેમની ઓછામાં ઓછી ચાર જરૂરિયાતોનો સમાવેશ કરવામાં આવ્યો : ડેલરી, આશ્રય, કપડા, શિક્ષણ, તબીબી સહાયતા અને મનોરંજનની આવશ્યકતાઓ. કાયદા ડેટાન, અનુસૂચિત રોજગારમાં વેતનનો દર રાજ્યો, ક્ષેત્રો, કુશળતા, પ્રદેશો અને વ્યવસાયમાં જુદા જુદા હોવાને કારણે જીવનનિર્વાહનાં ખર્ચ, પ્રાણીશિક ઉદ્યોગોને ચૂકવણીની ક્ષમતા, વપરાશનાં દાખલાઓ વગેરેમાં તફાવત હોવાને કારણો, ત્યાં એક પણ સમાન લધુતમ વેતનદર નથી. દેશભરમાં અને માળખું વધુ પડતું જટિલ બની ગયું છે. 2012માં સૌથી વધુ લધુતમ વેતન દર રૂ. 322/- દિવસ અંદરમાન અને નિકોબારમાં છે અને સૌથી નીચો ત્રિપુરામાં રૂ. 38/- દિવસ છે.

### ● વેતનમાં તફાવતો :

વેતન તફાવત વિવિધ ક્ષેત્ર અથવા ઉદ્યોગોમાં સમાન કુશળતા ધરાવતા લોકો વચ્ચેનાં વેતનના તફાવતનો સંદર્ભ આપે છે, તે સમાન ઉદ્યોગોમાં વિશિષ્ટ ધૂકુશળતા ધરાવતા કર્મચારીઓ વચ્ચેનાં વેતનનાં તફાવતો પણ ઉલ્લેખ કરી શકે છે. ચોક્કસ નોકરી આપેલ જોખમ અંગે ચર્ચા કરતી વખતે તેનો સામાન્ય રીતે સંદર્ભ લેવામાં આવે છે.

## 10.6 સારાંશ :

અર્થશાસ્ત્રમાં ઉત્પાદનમાં ફાળો આપવા માટે મજૂરને ચૂકવવામાં આવતી કિંમતને વેતન કહેવામાં આવે છે. વેતનને મુખ્યત્વે બે પ્રકારે વિભાગીત કરી શકાય છે : વાસ્તવિક અને નાણાંકીય વેતન. બજારમાં મુખ્યત્વે બે પ્રકારની સ્પર્ધા જોવા મળે છે. સંપૂર્ણ અને અપૂર્ણ, બજાર સ્પર્ધા મજૂર સંગઠનની સફળતાનો આધાર એની અસરકારકતા અને ફાયદાઓ

પર રહેલો છે. ન્યૂનતમ વેતન અધિનિયમ 1948 એ ભારતીય મજૂર કાયદાને લગતો સંસદનો એક અધિનિયમ છે.

#### **10.7 ચાવીરૂપ શર્ધો :**

1. ઉત્પાદનલકી વેતન (Piece Wage) : મજૂર દ્વારા કરવામાં આવતા કામ અનુસાર ચૂકવવામાં આવતું વેતન.
2. સમયલકી વેતન (Time Wage) : મજૂરને સમય અનુસાર તેની સેવાઓ માટે ચૂકવણી કરવામાં આવે છે.
3. વેતન (Wage) : વેતન એ ઉત્પાદનમાં સહાયતા માટે મજૂરને કરવામાં આવતી ચૂકવણી છે.
4. નાણાકીય વેતન (Nominal Wage) : મજૂર દ્વારા ઉત્પાદનની પ્રક્રિયામાં પ્રાપ્ત થતી કુલ રકમને નાણાકીય વેતન કહેવામાં આવે છે.
5. વાસ્તવિક વેતન (Real Wage) : નાણાનું વાસ્તવિક ચીજ-વસ્તુઓ અને સેવાની ખરીદીમાં રૂપાંતરણ કરવું.
6. ARP (Average Revenue Productivity) : જેને સરેરાશ આવક ઉત્પાદકતા તરીકે ઓળખવામાં આવે છે.
7. MRP (Marginal Revenue Productivity) : જેને સીમાંત આવક ઉત્પાદકતા તરીકે ઓળખવામાં આવે છે.
8. AW & MW (Average Wage and Marginal Wage) : જેને સરેરાશ વેતનદર અને સીમાંત વેતનદર તરીકે ઓળખવામાં આવે છે.
9. ન્યૂનતમ વેતન દર : ન્યૂનતમ વેતન અધિનિયમ 1948 એ ભારતીય મજૂર કાયદાને લગતો સંસદના એક અધિનિયમ છે.

#### ● સ્વાધ્યાય :

નીચે આપેલા સવાલોનાં મુદ્દાસર લંબાણમાં જવાબ આપો.

1. વેતન એટલે શું ? વેતનનાં વિવિધ પ્રકારો સમજાવો.
2. સંપૂર્ણ બજાર સ્પર્ધા હેઠળ વેતન નિર્ધારણ સમજાવો.
3. અપૂર્ણ બજાર સ્પર્ધા હેઠળ વેતન નિર્ધારણ સમજાવો.
4. ન્યૂનતમ વેતન વિશે ટૂંકનોંધ લખો.
5. ટૂંકનોંધ - કામદાર મંડળની સફળતાનો આધાર.

#### ● MCQ

(1) “Creator of All Value” - કોના દ્વારા મજૂરને આ ઉપનામ આપવામાં આવ્યું ?

- |                  |            |
|------------------|------------|
| a. કાર્લ માર્ક્સ | c. પીગુ    |
| b. એડમ સ્મિથ     | d. રીકર્ડો |

જવાબ : (a) કાર્લ માર્ક્સ

(2) મજૂરનાં ઉપયોગ માટે ચૂકવવામાં આવતી કિંમત એટલે...

- a. વેતન દર
- c. જરીપી દર
- b. આવક દર
- d. કોઈપણ નહીં

જવાબ : (a) વેતન દર

(3) મજૂર દ્વારા કરવામાં આવેલા કામ અનુસાર ચૂકવવામાં આવતું વેતન એ....

- a. ઉત્પાદનલક્ષી વેતન
- c. નાણાકીય વેતન
- b. સમયલક્ષી વેતન
- d. કરાર વેતન

જવાબ : (a) ઉત્પાદનલક્ષી વેતન

(4) મજૂર દ્વારા ઉત્પાદનની પ્રક્રિયામાં પ્રાપ્ત થતી કુલ રકમને....

- a. ઉત્પાદનલક્ષી વેતન
- c. નાણાકીય વેતન
- b. સમયલક્ષી વેતન
- d. કરાર વેતન

જવાબ : (c) નાણાકીય વેતન

(5) નાણાનું વાસ્તવિક ચીજવસ્તુઓ અને સેવાની ખરીદીમાં રૂપાંતરણ કરવું એટલે

- ....
- a. ઉત્પાદનલક્ષી વેતન
- c. નાણાંકીય વેતન
- b. વાસ્તવિક વેતન
- d. કરાર વેતન

જવાબ : (b) વાસ્તવિક વેતન

(6) ટૂંકાગાળામાં કેટલા પ્રકારની પરિસ્થિતિનો સમાનો કરી શકાય છે ? (વેતનનાં પેઢીનાં સંતુલન માટે)

- a. 1 c. 3
- b. 2 d. 4

જવાબ : (c) 3

(7) સંપૂર્ણ કામ માટે, જ્યારે વેતન અગાઉથી નક્કી કરવામાં આવે તો એ વેતનને..... કહેવામાં આવે છે.

- a. નાણાકીય વેતન
- c. ઉત્પાદન વેતન
- b. કરાર વેતન
- d. અવેજ વેતન

જવાબ : (b) કરાર વેતન

(8) વેતન સમતુલા પૂર્ણ બજારમાં સામાન્ય નફાનું સંતુલન માટે કઈ રીતે મેળવવામાં આવે છે ?

- a.  $ARP = પ્રવૃત્તમાન વેતન/દર$
- b.  $ARP > પ્રવૃત્તમાન વેતન/દર$
- c.  $ARP < પ્રવૃત્તમાન વેતન/દર$
- d.  $ARP > પ્રવૃત્તમાન વેતન/દર$

જવાબ : (a)  $ARP = પ્રવૃત્તમાન વેતન/દર$

(9) પૂર્ણ બજારમાં વેતન સમતુલામાં પેટી દ્વારા જ્યારે ખોટ મેળવવામાં આવે છે,  
ત્યારે.....

- a.  $ARP = \text{પ્ર્વત્તમાન વેતનદર}$
- b.  $ARP > \text{પ્ર્વત્તમાન વેતનદર}$
- c.  $ARP < \text{પ્ર્વત્તમાન વેતનદર}$
- d.  $ARP > \text{પ્ર્વત્તમાન વેતનદર}$

જવાબ : (c)  $ARP = \text{પ્ર્વત્તમાન વેતનદર}$

(10) ન્યૂનતમ વેતનધારાનું અધિનિયમ ક્યા વર્ષમાં કરવામાં આવ્યું ?

- |         |         |
|---------|---------|
| a. 1948 | b. 1949 |
| c. 1950 | d. 1947 |

જવાબ : (a) 1948

યુનિટ 11	વ्याजनां સિધ्यांતો
-------------	--------------------

### : રૂપરેખા :

1. પ્રસ્તાવના
2. અર્થ
3. વ્યાજના પ્રકારો
4. વ્યાજ ઉદ્ભવવાના કારણો
5. વ્યાજ દર અંગેના પ્રશ્નાઓ સિધ્યાંતો
6. વ્યાજનો દર શૂન્ય હોઈ શકે?
7. સારાંશ

#### સ્વાચ્છાય

#### 1. પ્રસ્તાવના :

આધુનિક યુગમાં ઉત્પાદન બહુ મોટા પાયા પર કરવામાં આવે છે. તેથી સ્વાભાવિક છે કે ઉત્પાદનના બધા સાધનો ઉત્પાદકની માલિકીના ન પણ હોય. જ્યારે ઉત્પાદક ઉત્પાદનની પ્રક્રિયા શરૂ કરે છે ત્યારે તેને જરૂરી એવા ઉત્પાદનના વિવિધ સાધનો અન્ય માલિકો પાસેથી મેળવે છે. તે સાધનોના ઉપયોગના બદલામાં જે તે માલિકને પહેલેથી નક્કી કરેલ રકમ વળતર તરીકે ચૂકવે છે. મૂડી એ ઉત્પાદનના વિવિધ સાધનોમાંનું સૌથી અગત્યનું સાધન છે. મૂડીના આ ઉપયોગ બદલ તેના માલિકને જે નક્કી કરેલ રકમ વળતર તરીકે ચૂકવવામાં આવે છે તેને વ્યાજ કહે છે અને તેથી મૂડીની સાથે વ્યાજનો પ્રશ્ન પણ આજના મૂડીવાટી અર્થવ્યવસ્થામાં એટલો જ મહત્વપૂર્ણ બની રહે છે.

#### 2. વ્યાજનો અર્થ :

સામાન્ય અર્થમાં નાણાં ઉધીનાર વ્યક્તિ નાણાંના ઉપયોગ કરવા બદલ નાણાં ઉધીના આપનાર વ્યક્તિને જે નક્કી કરેલ રકમ વળતર તરીકે આપે છે તેને વ્યાજ તરીકે ઓળખાય છે. બીજા શબ્દોમાં કહીએ તો નાણાંની લોન આપનારને નાણાંની લોન લેનાર વ્યક્તિ દ્વારા થતી વળતરની ચૂકવણી એટલે વ્યાજ. આમ વ્યાજ એ નાણાંના ઉપયોગ બદલ ચૂકવાતી રકમ છે. સામાન્ય રીતે વ્યાજ નાણાંમાં દર્શાવાય છે. મુદ્દુલ રકમ પર વર્ષદીઠ ટકાવારીના સ્વરૂપમાં વ્યાજ દર્શાવવામાં આવતું હોય છે.

સરળ અર્થમાં વ્યાજ ઉધીનાં નાણા લેનાર દ્વારા ઉધાર લીધેલા રૂપિયા માટે નાણાં આપનાર વ્યક્તિને કરવામાં આવતી ચૂકવણી છે. વ્યાજનો દર સામાન્ય રીતે ટકા તરીકે દર્શાવવામાં આવે છે. પૈસાની દણિએ વ્યાજ એ વાર્ષિક દર તરીકે દર્શાવવામાં આવે છે. તે ચોક્કસ સમયગાળા માટે બીજાની મૂડીના ઉપયોગ બદલ ચૂકવવામાં આવતી કિંમત છે. ધારો કે કોઈ વ્યક્તિને ઉધીના રૂ. 100 આપવામાં આવે અને વર્ષના અંતે તે વ્યક્તિ રૂ. 110 પરત કરે છે. ત્યારે તેણે વધારાના જે રૂ. 10 આપ્યા તેને વ્યાજ કહે છે, અને એમ કહી શકાય કે વ્યાજનો દર 10% છે. વ્યાજ શબ્દનો ઉપયોગ નાણાંની કિંમતમાં જ થાય છે, કેમ કે નાણાકીય લોન મોટે ભાગે વપરાશના હેતુ માટે લેવામાં આવે છે.

પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એટલે કે જુદા અર્થશાસ્ત્રીઓએ આપેલા વ્યાજના સિદ્ધાંતો આમ તો જુદા જુદા દિણ્ણકોણથી આપેલા છે, પરંતુ બધાની એક સામાન્ય વિશિષ્ટતા એ છે કે બધા એક વસ્તુનો સ્વીકાર કરે છે કે વ્યાજનો દર નક્કી કરવામાં નાણાનું પરિબળ તટસ્થ હોય છે એટલે કે વ્યાજનો દર નક્કી કરવામાં નાણું બિલકુલ ભાગ ભજવતું નથી. પરંતુ નાણાની પાછળ રહેલા વાસ્તવિક પરિબળો વ્યાજના દરને નક્કી કરે છે. જેથી આ સિદ્ધાંતો વાસ્તવિક સિદ્ધાંતો અથવા બિન નાણાકીય સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે.

અર્થશાસ્ત્રીઓએ વ્યાજની જુદી જુદી અલગ અલગ રીતે વ્યાખ્યા આપી છે જે નીચે પ્રમાણે છે.

પ્રો. માર્શલ કહે છે કે “જ્ઞાણકર્તા દ્વારા નિશ્ચિત સમય માટે મૂડીનો ઉપયોગ કરવા બદલ જ્ઞાણાદાતાને જે વળતર ચૂકવવામાં આવે છે તેને વ્યાજ કહે છે.”

પ્રો. સેલિજોન કહે છે કે, વ્યાજ એ મૂડીના ભંડોળમાંથી મળતું વળતર છે.”

પ્રો. જે. એસ. મીલના મતે, “વ્યાજ એ માત્ર ત્યાગ માટેનું મહેનતાણું છે.”

પ્રો. કાર્વરના મત મુજબ, “વ્યાજ એ આવક છે જે મૂડીના માલિકને મળે છે.”

આ દરેક વ્યાખ્યાઓનું બાધ્ય રીતે અલગ અલગ સ્વરૂપ છે, પરંતુ આંતરિક રીતે તેનું સ્વરૂપ એક જ છે અને તે એ કે નાણાકીય મૂડીના ઉપયોગનું વળતર એ વ્યાજ છે. ટૂકમાં કહેવામાં આવે તો આ દરેક વ્યાખ્યાનો મુખ્ય સૂર એ છે કે “વ્યાજ એ મૂડી વાપરવાની કિંમત છે.”

### 3. વ્યાજના પ્રકારો :

વ્યાજના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે (અ) કાચું વ્યાજ અને (બ) શુદ્ધ કે ચોખ્યું વ્યાજ.

#### (અ) કાચું વ્યાજ :

યવહારમાં મૂડીના માલિકને ઉછીનું લેનાર વ્યક્તિ જે રકમ ચૂકવે છે તેને કાચું વ્યાજ કહે છે, એટલે કે દેણાદાર વ્યક્તિ લેણાદારને જે વળતર આપે છે તેને કાચું વ્યાજ કહેવામાં આવે છે. કાચા વ્યાજને કરારી વ્યાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાચું વ્યાજ શુદ્ધ વ્યાજ કરતાં હંમેશા ઘણું વધારે હોય છે, કેમ કે તેમાં શુદ્ધ વ્યાજ સિવાય બીજી કેટલીક બાબતો પણ સમાયેલી હોય છે. કાચું વ્યાજ = શુદ્ધ વ્યાજ + જોખમ માટે ચૂકવણી અથવા વળતર + યવસ્થાક્રિય સેવાઓનું વળતર + અસુવિધા માટે વળતર કે અસુવિધાનું વળતર + નાણાના મૂલ્યમાં ફેરફારનું વળતર.

#### (1) શુદ્ધ વ્યાજ :

મૂડીના ઉપયોગ માટે માત્ર કરવામાં આવેલ ચૂકવણીને શુદ્ધ વ્યાજ કે ચોખ્યું વ્યાજ કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો મૂડી ઉછીની આપવા બદલ મૂડીના માલિકને મૂડીની માત્ર ઉત્પાદનશક્તિને ધ્યાનમાં રાખીને જે વળતર આપવામાં આવે છે તેને શુદ્ધ વ્યાજ કહે છે. કાચા વ્યાજમાં શુદ્ધ વ્યાજનો સમાવેશ થાય છે.

#### (2) જોખમ માટે ચૂકવણી અથવા વળતર :

મૂડીનો માલિક જ્યારે નાણાનું ધિરાણ કરે છે ત્યારે તે જોખમ ઉઠાવે છે. લોન આપવામાં જોખમ રહેલું છે. લોન લેનાર વ્યક્તિ ભવિષ્યમાં કોઈ કારણોસર મુદ્દા રકમ પરત ન કરી શકે તેવું બની શકતું હોય છે. તેથી લોન આપનાર માલિકને આ જોખમ ઉઠાવવા બદલ તેને શુદ્ધ વ્યાજ સિવાય વધુ રકમ મળવી જોઈએ. પૂરતી સુરક્ષા વિના લોન આપવામાં આવે ત્યારે તેમાં જોખમનાં ઉચ્ચ તત્વો સમાયેલા હોય છે તેથી તેના પર વ્યાજ લેવામાં આવે છે. જોખમનું પ્રમાણ જેટલું વધારે હોય તેમ વ્યાજનો દર તેટલો જ વધુ હોય છે.

પ્રો. માર્શલના મત મુજબ જોખમનાં બે પ્રકાર હોય છે. (i) ધંધાકીય જોખમ અને (ii) વ્યક્તિગત જોખમ.

- (i) ધંધાકીય જોખમ : ધંધાકીય વ્યવહારમાં ઋણ લેનાર વ્યક્તિ પ્રામાણિક હોય છે, પરંતુ તે જે ધંધામાં મૂડીનું રોકાણ કરે તે ધંધો વધારે જોખમવાળો હોય ત્યારે મૂડી આપનાર માલિક ધંધામાં રહેલા જોખમને ધ્યાનમાં રાખીને ચોખ્યું વ્યાજ ઉપરાંત વધારાની રકમ લેતા હોય છે.
- (ii) વ્યક્તિગત જોખમ : સામાન્ય વ્યવહારમાં જે વ્યક્તિને ઉછીના નાણા આપવામાં આવે છે તે વ્યક્તિની પ્રામાણિકતા, તેની ઈચ્છા, નાણા પરત કરવાની તેની શક્તિ વગેરે બાબતો વિષે શંકા ઉદ્ભબે છે. જેથી આ પ્રકારનાં વ્યક્તિગત જોખમોને ધ્યાનમાં રાખીને નાણાં આપનાર વ્યક્તિ શુદ્ધ વ્યાજ ઉપરાંત બીજી વધારાની રકમ લેતા હોય છે.

ધંધાકીય જોખમ અને વ્યક્તિગત જોખમ પ્રમાણમાં જેટલાં વધુ હોય તેટલાં જ પ્રમાણમાં નાણાં પરત મેળવવામાં અનિશ્ચિતતા વધારે હોય છે. તેથી જોખમનું પ્રમાણ જેટલું વધારે હોય તેટલો વ્યાજનો દર વધુ ઊંચો રાખવાનું મૂડીના માલિક યોગ્ય રીતે સમજે છે અને જોખમનું પ્રમાણ ઓછું હોય ત્યાં વ્યાજનો દર નીચો રાખે છે.

### (3) વ્યવસ્થાકીય સેવાઓનું વળતર :

મૂડીનો માલિક જ્યારે પોતાની મૂડી ઉછીની આપવાનું નક્કી કરે છે ત્યારે તેણે ઉછીની મૂડી આપવાથી લઈને મૂડી પરત આવે ત્યાં સુધીની વ્યવસ્થા કરવાની હોય છે. જેમ કે શરાફી ધંધાનું લાઈસન્સ પ્રાપ્ત કરવું, કાયદાકીય દસ્તાવેજ અને સ્ટેમ્પ ફી, ઘિરાણનું લખાણ કરવું, હિસાબ રાખવો, નક્કી કરેલા સમયે વ્યાજની રકમ મેળવતા રહેવું અને છીલ્વે મૂળ રકમ પાછી મેળવવા માટેની અનેક કામગીરી મૂડીનાં માલિકે કરવાની હોય છે. આ કામગીરીમાં જરૂરી સ્ટેશનરી, ઓફિસનું ભાડું, વાહનવ્યવહારનો ખર્ચ જેવા ખર્ચાઓ કરવા પડે છે. આ બધા ખર્ચ છેવટે ઉછીનાં નાણા લેનાર (દિણાદાર) પાસેથી વસુલવાના હોય છે અને તેનો સમાવેશ પણ વ્યાજમાં કરવામાં આવે છે. જેથી વ્યાજનો દર ઊંચો રહે છે.

### (4) અસુવિધા માટે વળતર (અગવડતાનું વળતર):

નાણાનું ઘિરાણ કે લોન આપવામાં મૂડીના માલિકને કેટલીક અગવડો / અસુવિધા પણ ભોગવવી પડે છે. જેમ કે ઘિરાણ આપવા માટે બચત કરવી પડે છે. જેથી બચત કરવા માટે તેણે પોતાને વર્તમાન વપરાશમાંથી મળતા સંતોષનો ત્યાગ કરવો પડે છે. લોન આપી દીધા પછી પોતાની જરૂરિયાત સંતોષવા માટે તે નાણાનાં ઉપયોગ કરી શકતો નથી. લોન કે ઘિરાણ ચોક્કસ સમય માટે આપવામાં આવતું હોવાથી મૂડીના માલિકને અચાનક રોકડ નાણાની જરૂર પડે તો પણ તરત નાણાં પાછા મેળવી શકતો નથી. તેથી નાણા હોવા છતાં એકવાર નાણાનું ઘિરાણ કર્યા પછી મૂડીના માલિકને અનેક અગવડો સહન કરવી પડે છે. આ અગવડોનું વળતરરૂપે શુદ્ધ વ્યાજ ઉપરાંત વધુ રકમ વસુલ કરે છે. અગવડો જેમ વધુ હોય તેમ વ્યાજ વધુ લેવામાં આવે છે.

### (5) નાણાનાં મૂલ્યમાં ફેરફારનું વળતર :

જ્યારે સામાન્ય ભાવસપાટીની કિંમતમાં વધારો થાય છે ત્યારે નાણાનું મૂલ્ય થોડા સમયગાળા દરમિયાન ઘટે છે અને તેટલા અંશે મૂડીના માલિક (દિણાદાર)ને નુકશાન થાય છે. આ નુકશાનને દૂર કરવા માટે શુદ્ધ વ્યાજ ઉપરાંત કેટલીક વધારાની રકમ તેમાં સમાવવામાં આવે છે.

આમ, કાચા વ્યાજનું વર્તુળ ધણું મોટું હોય છે. ધીરાણ આપવામાં રહેલ જોખમ, વ્યવસ્થાકીય સેવાઓ, અગવડતા અને નાણાનાં મૂલ્યમાં ફેરફાર વગેરે બાબત પર કાચું વ્યાજ કેટલું હશે તે અસર કરે છે. આ બધાનું પ્રમાણ જેટલું વધારે હશે તેટલો ૪ કાચા વ્યાજનો દર ઊંચો હશે. એથી ઉલ્લંઘાનું પ્રમાણ જેટલું ઓદ્ધું હશે તેટલો વ્યાજનો દર ઓછો હશે.

સામાન્ય વ્યવહારમાં કાચા વ્યાજની લેવડ-દેવડ થાય છે. કાચું વ્યાજ નક્કી કરનારા પરિબળો જુદા જુદા સ્થળે, જુદા જુદા સમયે અલગ અલગ હોય છે. તેથી બધી જગ્યાએ કાચું વ્યાજ એક સરખું હોતું નથી. કાચા વ્યાજને ધ્યાનમાં રાખીને વ્યાજના સિદ્ધાંતો આપવામાં આવ્યા નથી. તેથી કાચા વ્યાજના દર પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોય છે. જેમ કે શહેરમાં શરાફો અને ગામડામાં શાહુકારો જે નાણા ઉઠીના / ધીરાણ / લોન આપવા બદલ વ્યાજ લે છે તે કાચું વ્યાજ હોય છે.

### (બ) શુદ્ધ વ્યાજ / ચોખ્યું વ્યાજ :

મૂરીના માલિકને મૂરીની ઉત્પાદક સેવાના વળતરરૂપે જે કિંમત ચૂકવવામાં આવે છે તેને ચોખ્યું વ્યાજ કે શુદ્ધ વ્યાજ કહેવામાં આવે છે. શુદ્ધ વ્યાજ એ મૂરીની ઉત્પાદકતા બરાબર હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો મૂરીના પુરવઠા અને મૂરીની માગના આંતરસંબંધ દ્વારા જે વ્યાજનો દર નક્કી થાય તેને શુદ્ધ વ્યાજ કહેવામાં આવે છે. શુદ્ધ વ્યાજ દરેક જગ્યાએ એક સમાન હોય છે.

શુદ્ધ વ્યાજનું પ્રમાણ કાચા વ્યાજ કરતાં ધણું ઓદ્ધું હોય છે, જેમ કે તેમાં બીજા કોઈપણ વળતરનો સમાવેશ કરવામાં આવતો નથી. આમ જ્યારે મૂરી માલિક, જોખમ, વ્યવસ્થાકીય વળતર, અગવડતા, નાણાનાં મૂલ્યમાં ફેરફાર વગેરેની ગણના કર્યા વગર ફક્ત મૂરીની ઉત્પાદનશક્તિને ધ્યાનમાં રાખીને જે વળતર વસુલ કરે છે તેને શુદ્ધ વ્યાજ કહે છે. મૂરીના માત્ર ઉપયોગ માટે કરવામાં આવેલ ચૂકવણીને ચોખ્યું વ્યાજ અથવા શુદ્ધ વ્યાજ કહેવામાં આવે છે. પ્રો. ચેપમેનના મતે મૂરીની લોન માટેની ચૂકવણી એ શુદ્ધ વ્યાજ છે. જેમાં કોઈ અગવડતા / અસુવિધા કે કોઈ શાહુકાર પણ સમાયેલા હોતા નથી.”

શુદ્ધ વ્યાજ = કાચું વ્યાજ - (જોખમ માટેની ચૂકવણી + અગવડતાનું વળતર + વ્યવસ્થાકીય સેવાઓનું વળતર + નાણાનાં મૂલ્યમાં ફેરફાર)

એટલે કે મૂરીના ઉપયોગ માટે શુદ્ધ વ્યાજ = શુદ્ધ ચૂકવણી.

આમ શુદ્ધ વ્યાજનું વર્તુળ ધણું નાનું હોય છે. શુદ્ધ વ્યાજ એ ફક્ત કાચા વ્યાજનો એક ભાગ છે. જેમાં મૂરી રોકાણની સલામતી સૌથી વિશેષ હોય છે. અલગ અલગ સ્થળે શુદ્ધ વ્યાજનો દર લગભગ સરખો હોય છે. સામાન્ય વ્યવહારમાં શુદ્ધ વ્યાજ લેવા-દેવામાં આવતું નથી. જેમ કે ટ્રેઝરી બિલ્સ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, કિસાન વિકાસપત્રો, ઈન્દ્રિય વિકાસપત્રો, સરકારી લોન, બોન્ડ્ઝ, સંરક્ષણ સર્ટિફિકેટ વગેરેમાં મૂરીનું રોકાણ કરવામાં સલામતી હોય છે. જેથી તેના પર મળતું વ્યાજ એ શુદ્ધ વ્યાજની નજીક હોય છે. અર્થશાસ્ત્રમાં વ્યાજનાં સિદ્ધાંતો શુદ્ધ વ્યાજને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યા છે. તેથી અર્થશાસ્ત્રમાં અભ્યાસમાં તેનું મહત્વ રહેલું છે.

કાચું વ્યાજ અને શુદ્ધ વ્યાજ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરતાં પ્રો. માર્શિલ જણાવે છે કે “કાચા વ્યાજમાં પ્રતીક્ષાના બદલા ઉપરાંત અન્ય તત્વો પણ સામેલ હોય છે. જ્યારે શુદ્ધ વ્યાજ એ માત્ર પ્રતીક્ષા કરવાનો બદલો હોય છે.”

#### **4. વ्याज ઉદ્ભવવानां કારણો :**

વ्याजના પ્રશિષ્ટ સિદ્ધાંત મુજબ વ्यાજનો દર બચત અને મૂડીરોકાણ દ્વારા નક્કી થાય છે. બચતરેખા હંમેશા ધન ઢાળની હોય છે અને મૂડીરોકાણ રેખા ઋણ ઢાળની હોય છે. મૂડીરોકાણ અને બચતરેખા જ્યાં છેદ છે ત્યાં વેતનનો દર સમતુલા પ્રાપ્ત કરે છે.

વ्यાજ શા માટે ઉદ્ભવે એ સમજાવવા માટે કેટલાક સિદ્ધાંતો નીચે મુજબ રજૂ કરવામાં આવ્યા છે.

- (1) લોકોને બચતનું પ્રમાણ વધારવા માટે કેટલીક વાર વપરાશનું પ્રમાણ જતું કરવું પડે છે.
- (2) મૂડીનાં વપરાશ કરવા બદલ મળતી રકમનું પ્રમાણ વ्यાજ છે.
- (3) બચતનું પ્રમાણ વધારવા માટે લોકો વર્તમાન સમયગાળા દરમિયાન વપરાશનું પ્રમાણ ઘટાડે છે.
- (4) બચતકારોની રોકડતા જતી કરવા બદલ આપવામાં આવતું વળતર છે.
- (5) લોકો ભવિષ્યની આવકની સરખામણીમાં વર્તમાન આવકને વધુ પસંદ કરે છે. બચત કરવા બદલ બચતકારોને વ्यાજ મળે છે.

કેઈન્સનાં મતે વ्यાજનો દર નાણાની માંગ અને નાણાનાં પુરવઠા દ્વારા નક્કી થાય છે. નાણાની માંગરેખા ઋણ ઢાળની હોય છે.

#### **5. વ્યાજદર અંગેના પ્રશિષ્ટ સિદ્ધાંતો :**

કલાસિકલ અર્થશાસ્ત્રીઓ એટલે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ. જુદા જુદા અર્થશાસ્ત્રીઓ વચ્ચે વ્યાજના અર્થધટન અંગે મોટા પ્રમાણમાં મતભેદ નથી, પરંતુ વ्यાજનો દર ક્યા પરિબળો દ્વારા નક્કી થાય છે તે બાબતમાં અલગ અલગ અર્થશાસ્ત્રીઓ અલગ અલગ મત ધરાવે છે. તેમ છતાં તેઓ દ્વારા એક બાબતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે વ्यાજનો દર નક્કી કરવામાં નાણાનું પરિબળ તટસ્થ હોય છે, એટલે કે વ्यાજનો દર નક્કી કરવામાં નાણાનું ભાગ ભજવતું નથી, પરંતુ નાણાની પાછળ રહેલા બિન નાણાકીય કે વાસ્તવિક પરિબળો ભાગ ભજવતા હોય છે. તેથી પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ આપેલા આ બધા સિદ્ધાંતો બિનનાણાકીય સિદ્ધાંતો કે વાસ્તવિક સિદ્ધાંતો તરીકે પણ ઓળખાય છે.

પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ આપેલા સિદ્ધાંતો નીચે મુજબ છે.

##### **(1) આત્મસંયમનો સિદ્ધાંત :**

પ્રો. સિનિયર આ સિદ્ધાંતનાં પ્રણેતા છે. તેમના મતે, “‘વ્યાજ એ આત્મસંયમનું વળતર છે.’’ આ સિદ્ધાંત પ્રમાણે લોકો જે વ્યાજ રૂપે આવક મેળવે છે તે તેમના આત્મસંયમના બદલાના સ્વરૂપે મેળવે છે. પ્રો. સિનિયરના મતે મૂડીની માગનો આધાર મૂડીની ઉત્પાદકતા પર હોય છે. જેથી તેમણે મૂડીના પુરવઠાને સમજાવતો સિદ્ધાંત રજૂ કર્યો. તેમની દલીલ મુજબ બચતો એ મૂડીના પુરવઠાનું ઉદ્ઘગમ સ્થાન છે અને આ બચતો કરવા માટે લોકોએ વર્તમાન વપરાશનો ત્યાગ કરવો પડે છે. લોકો વર્તમાન વપરાશમાંથી જે સંતોષ મેળવી શક્યા હોય તેનો ત્યાગ કરવામાં આવે છે. એટલે કે આત્મસંયમ કરવો પડે છે. જે લોકોમાં આત્મસંયમ કરવાનો ગુણ હોતો નથી, તે લોકો વ્યાજ મેળવી શકતા નથી અને જે લોકોમાં આત્મસંયમનો ગુણ હોય છે, તેઓ વર્તમાન ઉપભોગનો ત્યાગ કરીને બચત કરે છે અને આ બચતના રોકાણ દ્વારા તેઓ વ્યાજ પ્રાપ્ત કરે છે. મોટાભાગે દરેક વ્યક્તિ પોતાની આવક હંમેશા વર્તમાનમાં જ વાપરવા માટે તત્પર (આતુર) હોય છે. જ્યારે તેઓ બચત કરે છે ત્યારે તેમને વર્તમાન ઉપભોગનું બલિદાન કરવું પડે છે. તેથી બચતનું

કાર્ય કહિન હોય છે. જે લોકો પોતાના આત્મસંયમ દ્વારા બચત કરીને નાણાં વ્યાજે પૂરા પાડવાનું કાર્ય કરે છે. તેમને ત્યાગનાં પ્રમાણમાં વિશેષ વળતર આપવામાં ન આવે તો તેઓ ફરી બચત કરવાનું વિચારશે નહીં. તેથી જે લોકો બચતો કરીને ધીરાણ આપે છે તેમણે કરેલા ત્યાગના બદલામાં અને તેમના આત્મસંયમના વળતર રૂપે વ્યાજ આપવું જરૂરી બને છે.

લોકોમાં ત્યાગ કરવાની ક્ષમતા અથવા તો આત્મસંયમ કરવાની ક્ષમતા દ્વારા વ્યાજના દર નક્કી થાય છે. આત્મસંયમ કરવાની ક્ષમતા અલગ અલગ સમાજમાં જુદી જુદી હોય છે. તેથી અલગ અલગ સમાજમાં વ્યાજના દર અલગ અલગ જોવા મળે છે. લોકો જેટલા આત્મસંયમી વધુ હોય તેટલા પ્રમાણમાં બચત વધુ થાય છે. જેથી વ્યાજનો દર નીચો નક્કી થાય છે. તેનાથી ઉદ્ભૂત જેમ લોકો આત્મસંયમી ઓછા તેમ બચત ઓછી થાય છે તેથી વ્યાજનો દર ઊંચો નક્કી થાય છે. આમ, વ્યાજના દર અને આત્મસંયમ વચ્ચે વસ્ત સંબંધ રહેલો છે. ટૂંકમાં એમ કહી શકાય કે વ્યાજ એ આત્મસંયમનું વળતર છે.

- સિદ્ધાંતની ટીકાઓ :

આ સિદ્ધાંતની ટીકાઓ પણ કરવામાં આવી છે જે નીચે પ્રમાણે છે.

- (1) મૂડીના પુરવઠાને જ મહત્વ : આ સિદ્ધાંતમાં વ્યાજને નક્કી કરવા માટે માત્ર ને માત્ર મૂડીના પુરવઠાને જ ધ્યાનમાં લેવામાં આવ્યો છે અને મૂડીની માંગની (અવગણના)ને ધ્યાનમાં લેવામાં આવી નથી. આથી આ સિદ્ધાંત ટીકાપાત્ર બન્યો છે.
- (2) અવ્યવહારું અનુમાન : પૂર્ણ હરીફાઈના અવ્યવહારું અનુમાનને આધારે આ સિદ્ધાંત આપેલ હોવાથી તેનું વ્યાવહારિક મૂલ્ય ઘટી જાય છે.
- (3) ભવિષ્યની સલામતી માટે થતી બચતમાં આનંદ : લોકો પોતાના ભવિષ્યની સલામતી માટે પણ બચત કરતાં હોય છે. આ બચત કરવામાં તેમને આનંદ આવતો હોય છે. આવા લોકો માટે આ બચત કણદાયી નહીં પરંતુ આનંદદાયી હોય છે અને તેથી જ આ સિદ્ધાંત ટીકાપાત્ર બન્યો છે.

- (2) પ્રતીક્ષાનો સિદ્ધાંત :

આ સિદ્ધાંતના પ્રણેતા પ્રો. માર્શલ છે. પ્રો. માર્શલના મત મુજબ વ્યાજ એ આત્મસંયમનું નહિ પરંતુ પ્રતિક્ષાનું વળતર છે. પ્રો. સિનિયરના આત્મસંયમના ખ્યાલમાં સુધારો કરતાં જણાવે છે કે હકીકતમાં ઉદ્ઘોગ-ધ્યાનમાં મોટા ભાગે મૂડી પૂરી પાડનાર લોકો ધનિક હોય છે. તેથી તેમને બચત કરવામાં ખાસ કોઈ આત્મસંયમ કે બલિદાન કરવાની જરૂર પડતી નથી. તેથી આત્મસંયમ નહિ પરંતુ પ્રતીક્ષા વ્યાજના દરને અસર કરનારું પરિબળ છે. ધનીક લોકો પાસે તેમની જરૂરિયાત કરતાં વધુ આવક હોય છે. તેથી તેઓ વર્તમાન વપરાશ પર કાપ મૂક્યા સિવાય બચત કરી શકે છે અને તેનું ધીરાણ કરી વ્યાજ મેળવે છે. ધનીક લોકો પોતાની બચત માટે વર્તમાન વપરાશને ભવિષ્ય પર મુલત્વી રાખે છે. આ સમયગાળા દરમિયાન તેમણે નાણાંની વપરાશ કે તેમાંથી મળતાં સંતોષની પ્રતીક્ષા કરવી પડે છે. આ પ્રતીક્ષાનો અનુભવ પણ આનંદદાયક હોતો નથી. પ્રતીક્ષા કરનારે જે ત્યાગ અને માનસિક તનાવ સહન કરવો પડે છે તેના બદલામાં એને વ્યાજ આપવામાં આવે છે. તેથી વ્યાજ એ આત્મસંયમનું નહીં, પરંતુ પ્રતીક્ષાનું વળતર છે. લોકોની પ્રતીક્ષાવૃત્તિ વધારે હોય તો વ્યાજનો દર નીચે નક્કી થાય છે અને પ્રતીક્ષાવૃત્તિ ઓછી હોય તો વ્યાજનો દર ઊંચો નક્કી થાય છે.

એક બાબત હજુ શંકાસ્પદ છે કે ધનિક લોકો લોન આપીને પ્રતિક્ષાનો દુઃખ અનુભવ કરે છે કે નહિ. ધનિક લોકો વ्यાજનો દર શૂન્ય હોય ત્યારે પણ બચત કરતા હોય છે. આ સિદ્ધાંતમાં પણ પુરવઠા પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. જ્યારે માગ પર ધ્યાન આપવામાં આવ્યું નથી.

- સિદ્ધાંતની ટીકાઓ :

- આ સિદ્ધાંતમાં માત્ર મૂડીના પુરવઠાને મહત્વ આપવામાં આવ્યું છે.
- બચતો કષ્ટરહિત હોય છે.
- ભવિષ્યની સલામતી માટે કરવામાં આવતી બચત માટે આનંદ મળે છે.
- પૂર્ણ હરીફાઈના અવ્યવહારું અનુમાનને આધારે સિદ્ધાંત આપેલો હોવાથી તેનું વ્યવહારિક મૂલ્ય ઓછું થઈ જાય છે.

(3) સમય પસંદગીનો સિદ્ધાંત :

ઓસ્ટ્રેલીયન અર્થશાસ્ત્રી બોઝ બોઝર્ડ આ સિદ્ધાંત રજૂ કર્યો હતો. પ્રો. બોઝમ બવર્ક કહે છે કે, લોકો ભવિષ્યના ઉપભોગ કરતાં વર્તમાનમાં ઉપભોગ કરવાનું વધુ પસંદ કરે છે. આથી વ્યાજ એ વર્તમાન ઉપભોગને ભવિષ્યમાં છોડી દેવાનું વળતર છે.” એટલે કે લોકો સમક્ષ વર્તમાન આવક અને ભવિષ્યની આવક વચ્ચે પસંદગી કરવાનું કહેવામાં આવે તો તેઓ મોટેભાગે વર્તમાન આવક વધુ પસંદ કરે છે. એટલે કે લોકોમાં ભવિષ્યને ઓછું અંદાજવાની દિશા હોય છે. તેથી લોકોને તેમના ભવિષ્યના ઉપભોગને વર્તમાન ઉપભોગની સમાન ગણાના કરવા માટે જે વળતર આપવામાં આવે છે તેને વ્યાજ કહે છે. તેથી વ્યાજ એ મનુષ્યને પોતાના વર્તમાન ઉપભોગને કેટલાક સમય પૂરતો સ્થગિત કરવા માટે ચૂકવવામાં આવતું વળતર છે. લોકોની વર્તમાન સમયમાં નાણાંનો ઉપભોગ કરવાની અધિરાઈ વધુ હોય તો વ્યાજનો દર ઊંચો નક્કી થાય છે અને તેનાથી ઉલટું જો નાણાનો ઉપભોગ કરવાની અધિરાઈ ઓછી હોય તો વ્યાજનો દર નીચો નક્કી થાય છે.

પ્રો. બોઝ બવર્ક તેમના સિદ્ધાંતમાં વ્યાજ માટે લોકોના ભવિષ્યને ઓછું અંદાજવાના દિશિબિન્દુને જવાબદાર ગણાવે છે. જ્યારે અમેરિકન અર્થશાસ્ત્રી પ્રો. ઈરવિગ ફિશર સમય પસંદગીના પરિબળને વધુ જવાબદાર ગણાવે છે. પ્રો. ફિશરના મત મુજબ લોકોની સમય પસંદગી વધારે હોય તેમ વ્યાજનો દર વધુ નક્કી થાય છે અને લોકોની સમય પસંદગી ઓછી હોય તેમ વ્યાજનો દર ઓછો નક્કી થાય છે. ઈરવિગ ફિશરના મત મુજબ ભવિષ્યના સંતોષની સરખામણીમાં વર્તમાન સંતોષ વધુ મહત્વનો હોય છે. વર્તમાનમાં આવક ખર્ચવા માટે લોકો વધુ આતુર હોય છે. આથી જો વ્યાજ આપવામાં ન આવે તો લોકો પોતાના વર્તમાન સંતોષને ભવિષ્યના સંતોષમાં બદલવા તૈયાર થતા નથી. તેથી વર્તમાન સમયમાં લોકોની પોતાના નાણાં વાપરી નાખવાની અધિરાઈને રોકવા માટે જે વળતર ચૂકવવામાં આવે છે તે વ્યાજ તરીકે ઓળખાય છે. લોકોની વર્તમાન સમયમાં નાણાં ઉપભોગ કરવાની આતુરતાને પ્રો. ફિશર “સમય પસંદગી” નામે ઓળખાવે છે. સમય પસંદગી દ્વારા વ્યાજ નક્કી થાય છે. મતલબ કે વ્યાજદરનો આધાર લોકોની સમય પસંદગીની તીવ્રતા પર આધારિત છે. લોકોની વર્તમાન આવક, ભવિષ્યમાં આવકની અપેક્ષા, વ્યક્તિઓની ટેવ, ફેશન અને સ્વભાવ પર સમય પસંદગીની તીવ્રતાનો આધાર રહેલો છે.

આ સિદ્ધાંતમાં પણ બચતના પુરવઠાને જ મહત્વ આપવામાં આવ્યું છે. માગ પર ધ્યાન

આપવામાં આવતું નથી.

- સિદ્ધાંતની ટીકાઓ :

- (1) અપૂર્ણ સિદ્ધાંત : ગ્રો. ફિશર વ્યાજના દર પર અસર કરતાં અન્ય પરિબળોની અવગણના કરે છે. ફિશર માત્ર સમય પસંદગીને જ મહત્વ આપે છે. આથી આ સિદ્ધાંત અપૂર્ણ બની જાય છે.
- (2) સ્થિર ખરીદશક્તિનો અંદાજ : વર્તમાન અને ભવિષ્યમાં નાણાની ખરીદશક્તિ સ્થિર રહે છે. એમ આ સિદ્ધાંત દ્વારા માની લેવામાં આવે છે. પરંતુ હકીકતમાં ભાવોમાં સતત પરિવર્તન થતું રહે છે. જેથી નાણાની ખરીદશક્તિ પણ બદલાતી રહે છે.
- (3) સ્થિર માનવ સ્વભાવનો અંદાજ : માનવનો સ્વભાવ બદલાતો રહે છે. એ સ્થિર રહી શકતો નથી, જ્યારે આ સિદ્ધાંતમાં માનવનો સ્વભાવ વર્તમાન અને ભવિષ્યમાં સ્થિર રહે છે એવો અંદાજ મૂકવામાં આવે છે.
- (4) સમય પસંદગીના ઘ્યાલને માપવાનું કાર્ય કઠિન : સમય પસંદગીનો ઘ્યાલ આત્મલકી હોવાથી તેને માપવાનું કાર્ય કઠિન બની જાય છે. તેથી આ સિદ્ધાંત મુજબ તેના પર રચાયેલા ઘ્યાલનું વ્યવહારિક મૂલ્ય ઓછું થઈ જાય છે.

- (4) મૂડીની માગ અને પુરવઠાનો સિદ્ધાંત :

આ સિદ્ધાંતના પ્રણેતાઓમાં પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ ગ્રો. ડેવિડ રિકાર્ડો, ગ્રો. વોલ્સ્ટસ, ગ્રો. માર્શલ, ગ્રો. નાઈટ, હોર્સિંગ વિ. ના નામ સંકળાયેલા છે. આ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના મત મુજબ, “વ્યાજનો દર એ મૂડીની માંગ અને મૂડીના પુરવઠા દ્વારા નક્કી થાય છે.” “એટલે કે વ્યાજનો દર કેટલો નક્કી થશે તેનો આધાર બજારમાં મૂડીના પુરવઠા (બચતો)નું પ્રમાણ અને મૂડીની માંગ (મૂડી રોકાણ)નું પ્રમાણ કેટલું છે તેના પર રહેલો છે. જે બિંદુએ મૂડીની માગ અને મૂડીનો પુરવઠો સરખા થાય ત્યાં વ્યાજનો સ્થિર દર સ્થાપિત થાય છે. વ્યાજના આ સ્થિર દરને સમતુલ્યાના વ્યાજના દર તરીકે પણ ઓળખવામાં આવે છે.

મૂડીનો પુરવઠો (બચત) લોકોની કરકસર અને તેમની બચતવૃત્તિ દ્વારા ઉદ્ભબે છે. મૂડીની માંગ એ તેની સીમાંત ઉત્પાદકતામાંથી ઉદ્ભબે છે. આથી જ મૂડીની માગ અને મૂડીના પુરવઠાને નક્કી કરવામાં બિનનાણાકીય કે વાસ્તવિક પરિબળો ભાગ બજવે છે. મૂડીની માગ અને મૂડીનો પુરવઠો જે બિંદુએ સરખા થાય ત્યારે સમતુલ્યાનો વ્યાજનો દર અસ્તિત્વમાં આવે છે. જે આદર્શ સ્થિતિ છે. પરંતુ વાસ્તવમાં વ્યવહારમાં મૂડીની માગ અને મૂડીનો પુરવઠો નક્કી કરનારા પરિબળો જુદા જુદા હોય છે. તેથી બજારમાં ક્યારેક મૂડીની માગ કરતાં મૂડીના પુરવઠાનું પ્રમાણ વધી જાય છે. તો કોઈવાર મૂડીના પુરવઠા કરતાં મૂડીની માગનું પ્રમાણ વધી જાય છે. આથી વ્યાજનો દર સમતુલ્યાના દર કરતાં ઊંચો અથવા નીચો નક્કી થાય છે. મૂડીના પુરવઠા (બચત) કરતાં મૂડીની માંગ (મૂડી રોકાણ)નું પ્રમાણ વધારે હોય તારે વ્યાજનો દર ઊંચો નક્કી થાય છે અને જો મૂડી માંગ (મૂડી રોકાણ) કરતાં મૂડીનો પુરવઠો (બચત) વધારે હોય તારે વ્યાજનો દર નીચો નક્કી થાય છે.

મૂડીની માગ અને મૂડીના પુરવઠામાં થતાં ફેરફારો એ વ્યાજના દરના ફેરફારોને કારણે ઉભા થાય છે. મૂડીની માગ અને વ્યાજના દર વચ્ચે વ્યસ્ત સંબંધ રહેલો છે. તેથી જ્યારે વ્યાજના દરમાં વધારો થાય ત્યારે મૂડીની માગમાં ઘટાડો થાય છે અને જો વ્યાજના દરમાં

घटाडो थाय તો મૂડीની માગમાં વધારો થાય છે. તેથી મૂડીની માંગ રેખા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ઢળે છે. વળી મૂડીના પુરવઠા અને વ्यાજના દર વચ્ચે સીધો સંબંધ છે, એટલે કે જો વ्यાજના દરમાં ઘટાડો થાય તો મૂડીના પુરવઠામાં ઘટાડો થાય છે અને જો વ्यાજના દરમાં વધારો થાય તો મૂડીના પુરવઠામાં પણ વધારો થાય છે. આથી મૂડીની પુરવઠાની રેખા જમણીથી ડાબી બાજુએ ઢળે છે અને જે બિંદુએ મૂડીની માગ અને મૂડીની પુરવઠાની રેખા એકબીજાને છેદે છે. ત્યાં પુનઃ સમતુલાનો દર નક્કી કરવામાં આવે છે. આમ વ्यાજના દરને મૂડીની માગ અને મૂડીનો પુરવઠો એક અસર કરનારું પરિબળ છે.

#### ● સિદ્ધાંતની ટીકાઓ :

- વ्यાજના માધ્યમ દ્વારા મૂડીની માગ અને મૂડીના પુરવઠામાં સમાનતા લાવી શકાય છે. પરંતુ કેઈન્સના મત મુજબ મૂડીની માગ (મૂડી રોકાશ) અને મૂડીનો પુરવઠો (બચત) વચ્ચે સમતુલન વ्यાજના દર દ્વારા લાવી શકતું નથી. કેઈન્સના જણાવ્યા મુજબ વ्यાજનો દર એ રાષ્ટ્રીય આવકના પરિવર્તનના માધ્યમ દ્વારા સ્થાપિત થાય છે.
- વ्यાજના દર પર બચતનો આધાર રહેલો છે, પરંતુ કેઈન્સના મતે બચતનો આધાર આવકની સપાટી પર રહેલો છે નહીં કે વ्यાજના દર પર. જો આવક જ ઓછી હોય તો વ्यાજનો દર ગમે તેટલો ઊંચો હોય તો પણ બચત થઈ શકે નહિએ.
- વ्यાજના દરના નિર્ધારણ પર શાખી નાણાનો મહત્વપૂર્ણ પ્રભાવ હોય છે. જે આ સિદ્ધાંતમાં ધ્યાનમાં લેવામાં આવ્યું નથી.
- આ સિદ્ધાંત પ્રમાણે બચતનો બદલો એ વ્યાજ છે એમ માનવામાં આવ્યું છે; જે યોગ્ય નથી. જો વ્યક્તિ બચત કરે પરંતુ બચતનાં નાણાં પોતાની પાસે જ રાખે તો તેને બચતનું વળતર વ्यાજના સ્વરૂપમાં મળતું નથી.

#### (5) રોકડ પસંદગીનો સિદ્ધાંત :

જુના અર્થશાસ્ત્રીઓએ વ્યાજ અંગેના જે સિદ્ધાંતો આપેલા હતા તે બિનનાણાકીય કે વાસ્તવિક પરિબળોને ધ્યાનમાં રાખીને આપ્યા હતા. જે ખામીઓથી ભરેલા હતા. પ્રો. કેઈન્સે બિનનાણાકીય પરિબળો કરતાં નાણાકીય પરિબળો પર આધારિત વ्यાજનો રોકડ પસંદગીનો સિદ્ધાંત રજૂ કર્યો.

પ્રો. કેઈન્સના મત મુજબ વ्यાજના દરને નક્કી કરવામાં નાણાકીય પરિબળ એટલે કે રોકડ પસંદગી મહત્વનો ભાગ ભજવે છે. પ્રો. કેઈન્સના જણાવ્યા અનુસાર, “વ્યાજ એ અમુક ચોક્કસ સમય માટે રોકડ પસંદગી જતી કરવાનું વળતર છે.” નાણાં એ તરફાતા ધરાવતી ભિલકત છે. તેથી નાણાની મદદથી ગમે તે વસ્તુ કે સેવા ગમે ત્યારે ખરીદી શકાય છે. નાણા દ્વારા વસ્તુ, સેવા કે માલભિલકત ખરીદી તેના પર અધિકાર પ્રાપ્ત કરી શકાય છે. તેથી લોકો નાણાને જતું કરવા તૈયાર થતા નથી. લોકો નાણાં જતું કરવા માટે તૈયાર થાય તે માટે તેમને લલચાવવા માટે વ્યાજ આપવું પડે છે. કેઈન્સના મંત્ર્ય મુજબ નાણાની માગ અને પુરવઠા દ્વારા વ्यાજનો દર નક્કી થાય છે. વ્યાજ એ શુદ્ધ નાણાકીય ઘટના મુજબ વપરાશવૃત્તિ પાછળ ખર્ચે છે અને બાકી રહેલ નાણાં (આવક) એ તેની બચત હોય છે. તેણે કરેલી બચતમાંથી કેટલીક રકમ તે હાથ પર રાખે છે અને બાકીની રકમ (બચત) નું ધીરાણ કરે છે. આ બચતમાંથી કેટલીક રકમ તે હાથ પર રોકડ સ્વરૂપે રાખે છે તેનો આધાર તેની રોકડ પસંદગી પર હોય છે, અને વ्यાજનો દર આ રોકડ પસંદગીના આધારે નક્કી થાય છે. વ्यાજના દર અને રોકડ પસંદગી વચ્ચે સીધો સંબંધ

રહેલો છે. લોકો હાથ પર નાણાં રાખવાનું વધુ પસંદ કરે છે. તેના પણ અમુક કારણો રહેલા છે. જે નીચે મુજબ છે.

- (1) **વિનિમયનો હેતુ :** નાણાંનું ધીરાણ કરવાથી નાણાં અમુક નક્કી કરેલા સમયે પરત મળે છે. લોકોને પોતાની દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે સતત ખર્ચ કરવો પડે છે. તેમજ ધંધામાં પણ દૈનિક જરૂરિયાતો પૂર્ણ કરવા માટે નાણાની જરૂર પડે છે. તેથી કેટલુંક નાણું દૈનિક જરૂરિયાતો માટે અથવા વિનિમયના હેતુ માટે હાથ પર રાખવું જરૂરી બની રહે છે.
  - (2) **સહૃકીય હેતુ :** સહૃકીય વૃત્તિ ધરાવતાં લોકોને ભવિષ્યમાં વ્યાજનાં દરમાં વધારો થવાનો હોય એમ લાગતું હોય તો તેઓ વર્તમાનમાં ધિરાણ કરવાને બદલે નાણાં પોતાની પાસે (હાથ પર રાખવાનું) વધુ પસંદ કરશે. તેનાથી ઊલદું જો તેમને એવો અંદાજ આવે કે ભવિષ્યમાં વ્યાજનાં દરમાં ઘટાડો થવાનો છે તો તેઓ વર્તમાનમાં ધિરાણ કરવાનું વધુ પસંદ કરશે. જેથી વર્તમાનમાં તેમની પાસે નાણાં હાથ પર હશે નહિ એટલે કે તેની રોકડ પસંદગીમાં ઘટાડો થશે.
  - (3) **સાવચેતીનો હેતુ :** લોકો ભવિષ્યના આકસ્મિક સંજોગો વિશે વિચારીને ભવિષ્યની સાવચેતી માટે કેટલુંક નાણું પોતાની પાસે (હાથ પર) રાખતાં હોય છે. ભવિષ્યના આકસ્મિક સંજોગો જેવા કે માંદગી, અક્સમાત કે કોઈ સામાજિક ગ્રસંગોળા ખર્ચ માટે નાણાંની જરૂર પડતી હોય છે. આથી સાવચેતીના રૂપે તેઓ નાણાં હાથ પર રાખવાનું વધારે પસંદ કરે છે.
- **સિદ્ધાંતની ટીકાઓ :** પ્રો. કેઠન્સે આપેલ રોકડ પસંદગીના સિદ્ધાંતની પણ ટીકાઓ કરવામાં આવી છે, જે નીચે મુજબ છે.
  - (1) **સંકુચિત દાખિકોણ :** પ્રો. કેઠન્સે વ્યાજનો દર નક્કી કરવામાં નાણાકીય પરિબળો પર ભાર મૂક્યો છે અને બિનનાણાકીય કે વાસ્તવિક પરિબળોની અવગણના કરી છે. જ્યારે પ્રશ્નાએ અર્થશાસ્ત્રીઓએ બિનનાણાકીય પરિબળો પર ભાર મૂક્યો છે અને નાણાકીય પરિબળોની અવગણના કરી છે. તેથી પ્રો. કેઠન્સનો આ સિદ્ધાંત સંકુચિત દાખિકોણવાળો બની જાય છે.
  - (2) **સિમિત (મધ્યાદિત) કાર્યક્ષેત્ર :** સાટા પદ્ધતિ અસ્તિત્વમાં હોય તેવા અર્થશાસ્ત્રમાં આ સિદ્ધાંત પ્રમાણે વ્યાજનો દર કેવી રીકે નક્કી કરવો? એ સમજવું મુશ્કેલ બની જાય છે.
  - (3) **નાણાંના પુરવઠાની અવગણના :** આ સિદ્ધાંતમાં નાણાંના પુરવઠાને ધ્યાનમાં લેવામાં આવ્યો નથી. તેમાં ફક્ત નાણાંની માગને જ ધ્યાનમાં લેવામાં આવ્યું છે. તેથી આ સિદ્ધાંતમાં નાણાંના પુરવઠાની અવગણના કરવામાં આવી છે.
  - (4) **વિરોધાભાસ :** આ સિદ્ધાંત અને વાસ્તવિકતા વચ્ચે વિરોધાભાસ જોવામાં આવે છે. કેમ કે આ સિદ્ધાંત મુજબ લોકોની રોકડ પસંદગી વધે તો વ્યાજનો દર ઊંચો જાય છે. પરંતુ મંદીના સમયમાં વ્યાજનો દર ઊંચો નથી જતો પણ નીચો જાય છે.
  - (5) **નાણાંના પુરવઠાની અસ્પષ્ટતા :** નાણાંના પુરવઠામાં એક બાજુ ફક્ત રોકડ નાણાંના પ્રમાણ પર ધ્યાન આપવામાં આવે છે અને બીજી બાજુ રોકડ નાણાં સિવાય શાખી નાણાંને પણ ધ્યાનમાં લેવામાં આવે છે તેથી આ સિદ્ધાંતમાં નાણાંના પુરવઠાની અસ્પષ્ટતા જોવા મળે છે.
  - (6) **ટૂંકા ગાળાનો વ્યાજનો દર :** આ સિદ્ધાંતમાં લાંબા ગાળાના વ્યાજના દર વિશે કોઈ

સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેમાં માત્ર ટૂંકા ગાળાના વ્યાજના દર વિશે સમજાવવામાં આવ્યું છે.

#### (6) ધીરાણ ભંડોળની માગ અને પુરવઠાનો સિદ્ધાંત :

ગુજરાત મિડોલ અને પ્રો. નટ વિકસેલના મત મુજબ વ્યાજનો દર એ ધીરાણ ભંડોળની માગ અને ધીરાણ ભંડોળના પુરવઠા દ્વારા નક્કી કરવામાં આવે છે. વસ્તુની કિંમત જેવી રીતે તેની માગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે. આ અર્થશાસ્ત્રીઓના મત મુજબ, “જ્યાં ધીરાણપાત્ર ભંડોળની માગ અને ધીરાણપાત્ર ભંડોળના પુરવઠાનો ઉપયોગ કરવા બદલ ચૂકવવામાં આવતી કિંમત એ વ્યાજ છે. વાસ્તવમાં ધીરાણપાત્ર ભંડોળની માગ અને ધીરાણપાત્ર ભંડોળની માગ અને ધીરાણપાત્ર ભંડોળના પુરવઠાને નક્કી કરનારા પરિબળો અલગ અલગ હોય છે અને તેમની રીતે કામ કરતા હોય છે. તેથી જ્યારે ધીરાણ ભંડોળની માગ ધીરાણ ભંડોળના પુરવઠા કરતાં વધી જાય ત્યારે તો વ્યાજનો દર નક્કી થાય છે અને જ્યારે ધીરાણ ભંડોળની માગ ધીરાણ ભંડોળના પુરવઠા કરતા ઓછી થઈ જાય ત્યારે નીચો વ્યાજનો પુરવઠાને નક્કી કરનારા અલગ અલગ પરિબળો હોય છે. જે નીચે પ્રમાણે આપેલા છે.

#### (1) ધીરાણ ભંડોળની માગ નક્કી કરતાં પરિબળો :

નીચેના પરિબળો દ્વારા ધીરાણ ભંડોળની માગ નક્કી કરવામાં આવે છે.

- (1) ધંધાદારી વ્યક્તિઓની નાણાની માગ : ધંધાદારી વ્યક્તિઓ એટલે કે ઉત્પાદકો અને વેપારીઓ પોતાના ધંધા માટે વ્યાજના દરને ધ્યાનમાં રાખી ને ધીરાણપાત્ર ભંડોળની માગ કરે છે. જો વ્યાજનો દર ઘટે તો ધીરાણપાત્ર ભંડોળની માગમાં વધારો થાય છે અને જો વ્યાજનો દર વધે તો ધીરાણપાત્ર ભંડોળની માગમાં ઘટાડો થાય છે.
- (2) સરકાર દ્વારા નાણાની માગ : આર્થિક વિકાસનાં કાર્યો માટે યુદ્ધ તથા સંકટ સમયે સરકાર દ્વારા ધીરાણપાત્ર ભંડોળની માગ કરવામાં આવે છે.
- (3) સંગ્રહ માટે નાણાની માગ : લોકો રોકડ હાથ પર રાખવા માટે પણ ધીરાણપાત્ર ભંડોળની માગ કરતાં હોય છે.
- (4) ઉપભોક્તા દ્વારા નાણાની માગ : પોતાની જરૂરિયાતની ચીજ-વસ્તુઓ ખરીદવા માટે અને જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ધીરાણપાત્ર ભંડોળની માગ કરે છે. વ્યાજનો દર ઓછો હોય ત્યારે નાણાની માગ વધારે હોય છે. તેથી વ્યાજનો દર અને ધીરાણપાત્ર ભંડોળની માગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે.

#### (2) ધીરાણપાત્ર ભંડોળના પુરવઠાને નક્કી કરતાં પરિબળો :

નીચેના પરિબળો ધીરાણપાત્ર ભંડોળના પુરવઠાને નક્કી કરે છે.

- (1) નાણાનું સંગ્રહ - અસંગ્રહનું પ્રમાણ : જ્યારે લોકો નાણાનો વધારે સંગ્રહ કરે છે ત્યારે ધીરાણપાત્ર ભંડોળના પુરવઠામાં ઘટાડો થાય છે તેથી ઉલટું જ્યારે લોકો નાણાનો ઓછો સંગ્રહ કરે ત્યારે ધીરાણપાત્ર ભંડોળના પુરવઠામાં વધારો થતો જોવા મળે છે.
- (2) બેંકની શાખ : વ્યાજના દરમાં વધારો થાય ત્યારે બેંકો શાખમાં વધારો કરે છે. તેને કારણે ધીરાણપાત્ર ભંડોળના પુરવઠામાં વધારો થાય છે અને આનાથી ઉલટું વ્યાજના દરમાં ઘટાડો થતો હોય ત્યારે બેંકો શાખમાં ઘટાડો કરતી

હોવાથી ધીરાણપાત્ર ભંડોળની પુરવઠામાં ઘટાડો થાય છે.

- (3) લોકોની કુલ બચત : કુલ આવકમાંથી કુલ ખર્ચ બાદ કરતાં જે રકમ વધે તે બચત ધીરાણપાત્ર ભંડોળનો પુરવઠો હોય છે. એ સ્વાભાવિક છે કે જો વ્યાજના દરમાં વધારો થતો હોય તો લોકો વધુ બચત કરે છે અને જો વ્યાજના દરમાં ઘટાડો થતો હોય તો લોકો બચત ઓછી કરતા હોય છે.

આમ, ધીરાણપાત્ર ભંડોળની માગ અને પુરવઠાને ઉપર મુજબના પરિબળો અસર કરતાં હોય છે. આ સિદ્ધાંત મુજબ વ્યાજનો દર નક્કી કરવામાં નાણાકીય પરિબળો ઉપરાંત બિનનાણાકીય પરિબળોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. આથી આ સિદ્ધાંત વધુ વૈજ્ઞાનિક છે.

- સિદ્ધાંતની ટીકાઓ :

નીચે પ્રમાણેની ટીકાઓ આ સિદ્ધાંતમાં પણ કરવામાં આવી છે.

- (1) વ્યાજનો દર બચતનો નિર્ણાયક નથી : આ સિદ્ધાંતમાં એવું ધારવામાં આવે છે કે બચતનું પ્રમાણ એ વ્યાજના દરને આધારે નક્કી કરવામાં આવે છે. વાસ્તવમાં વ્યાજનો દર ઊંચો હોવા છતાં પણ લોકો બચત કરતાં નથી અને ધણીવાર વ્યાજ દર શૂન્ય હોય તો પણ બચત કરતાં હોય છે.
- (2) વાસ્તવિક પરિબળો અને નાણાકીય આયોજન અયોગ્ય : વાસ્તવિક પરિબળો અને નાણાકીય પરિબળોનો સમન્વય વ્યાજનો દર નક્કી કરવા માટે કરવામાં આવે છે તે યોગ્ય નથી.
- (3) આવકની વ્યાજના દર પર થતી અસરની અવગણના : આ સિદ્ધાંતમાં આવકને સ્થિર ધારવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં આવકમાં સતત વધારો કે ઘટાડો જેવા ફેરફાર થતા હોય છે અને આ ફેરફારો વ્યાજના દર પર અસર કરતાં હોય છે. આમ, આ સિદ્ધાંતની સમીક્ષા થઈ છે.

---

## 6. વ્યાજનો દર શૂન્ય હોઈ શકે ?

---

વ્યાજનો દર મૂરીની માંગ અને મૂરીના પુરવઠા દ્વારા નક્કી કરવામાં આવે છે. જેને લોનેબલ ભંડોળ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યાં સુધી મૂરીની માંગ તેના પુરવઠા કરતા વધારે હોય તાં સુધી વ્યાજ દર હંમેશા હકારાત્મક રહે છે.

પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનાં મત મુજબ, જેમ જેમ વધતી જતી આવક અને સાક્ષરતાનાં પ્રમાણને લીધે પણ્યિમના દેશોનાં લોકોનું જીવન ધોરણ વધતુ જાય છે. એક તબક્કો એવો પણ આવી શકે છે કે જેમાં લોકોની શક્તિ અને મૂરી બચાવની ઈચ્છા એટલી વધી જશે કે મૂરી સંચયના દર મૂરી માટેની માંગ કરતા આગળ નીકળી જશે. માંગની સરખામણીએ મૂરીનો પુરવઠો એટલો વિપુલ બની શકે છે કે તેની સીમાંત ઉત્પાદકતા ઘટાડીને શૂન્ય કરી શકાય. પરંતુ તે એકદમ અસંભવ છે, કારણકે મૂરીની માંગ તેના પુરવઠાથી પાછળ રહેવાની સંભાવના નથી. તેમજ મૂરીનો પુરવઠો પણ શૂન્ય હોવાની સંભાવના નથી.

વિશ્વાનાં ઓછામાં ઓછા અવિકસિત વિસ્તારોમાં વસ્તી ઝડપથી વધી રહી છે. વિકાસશીલ અર્થતંત્રમાં મૂરીની માંગ વિશ્વાળ છે. આ ઉપરાંત નવી ટેકનોલોજીમાં મૂરીની બચત કરતા મૂરી શોષણાની શક્યતા છે. આવા અનેક પરિબળોને લીધે મૂરીની માંગની શક્યતા શક્ય નથી, કારણ કે વ્યાજના દરને શૂન્ય પર આવવા દે છે.

જો પુરવઠા પર નજર કરવામાં આવે તો વ્યાજનો દર શૂન્ય ન હોઈ શકે, તે સાચું છે. કેટલાક

લોકો આદત અથવા જરૂરિયાતનાં તીવ્ર દભાગથી શૂન્ય અથવા નકારાત્મક વ્યાજ દરે પણ બચત કરી શકે છે, પરંતુ જો વ્યાજનો દર શૂન્ય છે, તો જે દરે આગામી બચતનું પ્રમાણ ઓછું હશે કે જેથી મૂડીની તીવ્ર અછત ઉભી થાય.

મૂડીની માંગને સંતોષવા માટે પૂરતા પ્રમાણમાં લોકોને તેમની બધી આવકનો વર્તમાન વપરાશ પૂરો કરવા માટે પ્રેરણા આપવા માટે તેને હકારાત્મક વ્યાજની જરૂર પડશે.

હવે તરલતા પસંદગીનાં સિદ્ધાંત પર જોઈએ તે કેઈન્સ એ નાણાકીય ઓથોરીટી દ્વારા નાણાના વિશાળ પુરવઠા દ્વારા વ્યાજનાં દરને શૂન્ય સુધી ઘટાડવાની શક્યતાને નકારી હતી. કેઈન્સનું માનવું હતું કે વ્યાજનાં નીચા હકારાત્મક દરે પ્રવાહિતા પસંદગી આડી (OX) અક્ષની સમાંતર બને છે. બીજા શબ્દોમાં કહીએ તો ઓછા હકારાત્મક દરે કેઈન્સને “લિકિવાટી ટ્રેપ” પણ કહે છે. નાણાકીય સત્તા ભંડોળના નાણાનો મોટો જથ્થો પરિબ્રમણમાં આગળ વધારવામાં આવે તો પણ વ્યાજ દર રોક્કસ હકારાત્મક દરથી નીચે નહીં આવે, કારણ કે આ દરે લોકો ફક્ત વધારાના પૈસા તેમનાં મની હોડ્સમાં સમાઈ જાય છે.

## 7. સારાંશ :

પ્રશ્નાં અર્થશાસ્ત્રીઓ દ્વારા આપવામાં આવેલ વ્યાજનાં સિદ્ધાંતમાં વ્યાજનાં અર્થઘટનની બાબતમાં જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ જુદી જુદી વ્યાખ્યા આપી છે. વ્યાજનાં સિદ્ધાંતમાં વાસ્તવિક પરિબળોની અવગણના થઈ શકે નહીં. બચત કરનારાઓ સમય પસંદગીને કારણે વ્યાજરૂપી વળતર માંગે છે. કેટલાક અર્થશાસ્ત્રીઓએ વાસ્તવિક પરિબળો પર ભાર મુક્યો છે. તો કેટલાક અર્થશાસ્ત્રીઓ નાણાકીય પરિબળો પર ભાર મુક્યો છે. તેથી સિદ્ધાંત અપૂર્ણ છે. તેમાં વ્યાજનાં દરને નક્કી કરવા માટે વાસ્તવિક અને નાણાકીય પરિબળો બનેનો સમન્વય સાધીને એક નવી જ વિચારધારાને આકાર આપ્યો છે.

### : સ્વાધ્યાય :

- (1) વ્યાજનો અર્થ સ્પષ્ટ કરો.
- (2) શુદ્ધ વ્યાજ એટલે શું?
- (3) કાચા વ્યાજનો અર્થ સમજાવો.
- (4) કાચું વ્યાજ શુધ્ય વ્યાજ કરતા શા માટે વધારે હોય છે.
- (5) વ્યાજનાં દરને નક્કી કરનારા નાણાકીય પરિબળો કયા છે?
- (6) વ્યાજનાં વિરાણ ભંડોળના સિદ્ધાંતની ટીકાઓ વર્ણવો.
- (7) વ્યાજનાં દરને નક્કી કરનારા નાણાકીય પરિબળો કયા છે.
- (8) વ્યાજનાં દરને અસર કરતા બિનનાણાકીય પરિબળો જણાવો.
- (9) રોકડ પસંદગીનો અર્થ સમજાવો.

## એકમ :- ૧૨ નફાનાં સિધ્યાંતો

એકમ ની રૂપરેખા :-

- ૧) પ્રસ્તાવના
- ૨) નફો શા માટે?
- ૩) નફાનાં લક્ષણો
- ૪) નફાની વ્યાખ્યાઓ
- ૫) નફાનો અર્થ
- ૬) નફો (ઉદ્ભવવાનાં કારણો
- ૭) નફાનાં પ્રકારો
- ૮) નફો અને અન્ય સાધનો ની આવક
- ૯) નફાનાં સિધ્યાંતો
- ૧૦) સારાંશ ચાવીરૂપ શબ્દો
- ૧૧) સ્વાધ્યાય
- ૧૨) ટૂંકા પ્રશ્નો.
- ૧૩) હેતુલક્ષી પ્રશ્ના

પ્રસ્તાવના :-

અર્થશાસ્ત્રનાં અભ્યાસમાં બે ઘ્યાલો ૧) ઉત્પાદનનાં સાધનો અને ૨) આર્થિક પ્રવૃત્તિ ખુબજ મહત્વનાં છે. સમગ્ર અર્થશાસ્ત્રનું મૂળ આ બે ઘ્યાલો ઉપર રચાયેલું છે એમ કહી શકાય.

અર્થશાસ્ત્રનાં પિતા એડમ સ્મિથનાં શબ્દોમાં કહીએ તો અર્થશાસ્ત્ર સંપત્તિ કમાવવાનું અને સંપત્તિ ખર્ચવાનું શાસ્ત્ર છે. જે તેમણે ૧૭૭૮માં લખેલ નિબંધ "ઇહું હૂંઓં હારી ઝડેજીજીજીકુંર્ક હક્કેંહ" માંથી પ્રતિત થાય છે.

અર્થત ઉડાણપૂર્વક અભ્યાસ કરીએ તો તારણ સ્વરૂપે એમ કહી શકાય કે ઉત્પાદનનાં ચાર સાધનો છે.

(અ) જમીન (બ) મૂડી (ક) શ્રમ (ડ) નિયોજક,

આ ચારેય સાધનો વળતરની અપેક્ષા એ કાર્ય કરે છે. અને બીજાશબ્દોમાં કહીએ તો આર્થિક પ્રવૃત્તિ કરે છે. જેના બદલા માં કમાણી નાં સ્વરૂપે અનુકૂમે તેમને ભાંસું, વ્યાજ, વેતન અને નફો મળે છે. આમ ઉત્પાદનનાં ચાર સાધનોમાંથી નિયોજક બદલા માં કમાણી કે આર્થિક પ્રવૃત્તિનાં વળતર તરીકે નફો મેળવે છે. એટલે કે નફો એ નિયોજકની કિંમત છે.

### નિયોજક શા માટે નફો કમાય છે ?

આર્થિક પ્રવૃત્તિમાં નિયોજક પોતાની આગવી સૂર્જ બુજ કે બુધ્યિ શક્તિનો ઉપયોગ કરી જમીન, મૂડી અને શ્રમિકો નાં ઇષ્ટતમ સંયોજન ધ્વારા ઉત્પાદનની પ્રક્રિયામાં પોતાનું યોગદાન આપે છે. ઉપરાંત વિવિધ પ્રકારનાં જોખમો અને અનિશ્ચિતતાઓ પણ ઉઠાવે છે.

અંહી રસપ્રદ વાત એ છે કે ઉત્પાદનનાં સાધનો જમીન-ભાંસું, મૂડી-વ્યાજ, શ્રમ-વેતન તરીકે હકારાત્મકસ્વરૂપે વળતર મેળવે છે જ્યારે નિયોજક નફો તરીકે નહીં હકારાત્મક વળતર નુકસાન પણ મેળવી શકે છે. ઉત્પાદનના પ્રથમ ગ્રણ સાધનો જમીન, મૂડી અને શ્રમ પૂર્વનિર્ધારિત વળતરનાં દરે આવક પ્રાપ્ત કરે છે જ્યારે નિયોજક નું વળતર અનિશ્ચિત ને અનિર્ણિત જોવા મળે છે.

ટૂકમાં કહીએતો નિયોજકને તેના સંકલન, જોખમ, અનિશ્ચિતતા અને નવીનતા સભર પ્રયત્નો માટે નફા રૂપી વળતર પ્રામ થાય છે.

#### નફાનાં લક્ષણો :-

- ૧) નફો પૂર્વનિર્ધરીત કરાર આધારિત વળતર નથી.
- ૨) નફો ચોક્કસ વળતર નથી.
- ૩) તે અન્ય સાધનોની ચુકવણી બાદ વધતો અધિશેષ છે.
- ૪) તે અનિશ્ચિત છે.
- ૫) ઉત્પાદનનાં અન્ય સાધનો ચોક્કસ પણ હકારત્મક વળતર મેળવે છે પરંતુ નફો નકારત્મક પણ હોઈ શકે છે.

#### નફાની વ્યાખ્યાઓ :-

અર્થશાસ્ત્ર વિષયની પરંપરાગત લાક્ષણિકતા મુજબ નફાની વ્યાખ્યા આપવાનો ઘણા બધા અર્થશાસ્ત્રીઓ એ પ્રયત્નો કર્યા છે. જે તેમના નફા વિશેનાં અભ્યાસ અને સમજણ શક્તિનો આગવો પરિચય આપે છે. જેમાં સૌપ્રથમ અર્થશાસ્ત્રી એફ.એ.વોકર, જે.બી. કલાર્ક, એફ.બી. હોલી, ફેફ નાઈટ, જી.જી.સ્ટીગલર, શ્રીમતી જોન રોબિન્સન ઈ.એચ.ચભરલીન, એમ.ક્લેસ્કી, જોસેફ શુભ્મીટર, ટીફીન, લેફ્ટવીચ, ટાઉસીગ, કાર્વર વગેરે છે.

આ વ્યાખ્યા ઓ નીચે મુજબ છે.

- ૧) એફ.એ.વોકર :- અમેરિકન અર્થશાસ્ત્રી અને આંકડાશાસ્ત્રી છે. તેમના મત મુજબ નફો એટલે નિયોજકની ક્ષમતા કે કુશળતાનો બદલો કે વળતર છે. વર્ષ ૧૮૪૦ માં અમેરિકામાં જન્મેલા. (ફાન્સીસ અમાસા વોકર).
- ૨) જે.બી.કલાર્ક :- જોન બેન્સ કલાર્ક ૧૮૪૭ માં અમેરિકામાં જન્મેલા નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી છે. વર્ષ ૧૮૦૦ માં વિકસાવેલ સિધ્યાંત મુજબ નફો એ ગતિશીલ નિયોજન શક્તિ કે જે અર્થતંત્રમાં પેદા થતા ગતિશીલ પરિવર્તનો ધ્વારા આકાર પામે છે.
- ૩) એફ.હોલી :- ૧૮૪૩ માં અમેરિકાના ન્યૂયોર્ક માં જન્મેલા અર્થશાસ્ત્રીનાં મત મુજબ નિયોજક ને જોખમ ખેડવા બદલ મળતું વળતર એ નફો છે. (૧૮૮૩ માં નફા અંગે સિધ્યાંતો વિકસાવેલા તે મુજબ.)
- ૪) ફેફ નાઈટ :- વર્ષ ૧૮૮૫ માં જન્મેલ અમેરિકન અર્થશાસ્ત્રી છે. તેમનાં મત મુજબ નફો એ નિયોજક ધ્વારા ઉઠાવવામાં આવતી અનિશ્ચિતતાઓની બદલે કમાણી છે.
- ૫) જી.જી.સ્ટીગલર :- જ્યોર્જ જે સેફ સ્ટીગલર વર્ષ ૧૮૧૧માં જન્મેલ અમેરિકન અર્થશાસ્ત્રી છે. જેમનાં મત મુજબ સ્પર્ધત્મક ઉદ્યોગોમાં પેઢી નફો કમાય છે કારણ કે અર્થતંત્રમાં અસમતુલા પ્રવર્તે છે.
- ૬) શ્રીમતી જોન રોબિન્સન :- જોન વાયોલેટ રોબિન્સન વર્ષ ૧૮૦૩ માં હંગલેન્ડમાં જન્મેલ બ્રિટીશ અર્થશાસ્ત્રી છે. તેમના મત મુજબ નફો એ નફાનો દર અને મૂડીરોકાણની પેદાશ છે.
- ૭) ઈ.એચ.ચભરલીન :- એડવર્ડ હસ્ટોર્સ ચભરલીન વર્ષ ૧૮૮૮ માં અમેરિકા માં જન્મેલ અમેરિકન અર્થશાસ્ત્રી છે. તેમના મત મુજબ નફો એટલે ટૂકાગાળાની પેઢીમાં ઈજારાયુક્ત હરીફાઈ નફો જન્માવે છે.
- ૮) એમ. ક્લેસ્કી :- માઈકલ ક્લેસ્કી વર્ષ ૧૮૮૮ માં પોલેન્ડ માં જન્મેલ અર્થશાસ્ત્રી છે. તેમના મત મુજબ નફો એ એક આર્થિક યંત્ર છે. જે અમુક પેઢીઓ ઈજારો ભોગવે છે તે સ્વયં નફો કમાય છે.
- ૯) જોસેફ શુભ્મીટર :- જોસેફ એલોઈસ શુભ્મીટર વર્ષ ૧૮૮૩ માં ચેક રિપલ્વીકમાં જન્મેલા અર્થશાસ્ત્રી છે. તેમના મત મુજબ નફો સતત ચાલતી સંશોધનની પ્રક્રિયાનું વળતર છે.
- ૧૦) ટીફીન :- સતત પરિવર્તનને લીધે મળતો નફો ઈજારાશાહીને લીધે મળતા નફો જેવો જ હોય છે.
- ૧૧) લેફ્ટવીચ :- દક્ષિણ આફ્રિકામાં વર્ષ ૧૮૪૦માં જન્મેલ અર્થશાસ્ત્રી છે. તેમનાં મત મુજબ નફો એટલે પેઢી કે ઉત્પાદક ધ્વારા પ્રામ કરેલ કુલ આવકમાંથી તમામ પ્રકારની ચુકવણીઓ બાદ કરતાં વધતો અધિશેષ છે.

૧૨) ટાઉસીગ :- વર્ષ ૧૮૫૮માં અમેરિકામાં જન્મેલ અર્થશાસ્ત્રી છે. તેમના મત મુજબ નફો અનિશ્ચિત અને ઓળખી ન શકાય તેવી વળતર રૂપી આવક છે.

૧૩) કાર્વર :- થોમસ નિક્સન કાર્વર વર્ષ ૧૮૬૫ માં અમેરિકામાં જન્મેલ અર્થશાસ્ત્રી છે. તેમના મત મુજબ નફો એટલે નિયોજક ધ્વારા જોખમ ધટાડવાનાં પ્રયત્નોનો બદલો છે.

૧૪) હેનરી :- હેનરી જ્યોર્જ વર્ષ ૧૮૭૮માં જન્મેલ અમેરિકન અર્થશાસ્ત્રી છે. તેમના મત મુજબ નફો (૧) સંશોધન માટેનો પુરસ્કાર (૨) અનિશ્ચિતતા અને જોખમ નું વળતર (૩) બજારની અપૂર્ણતાનું પરિણામ એમ ત્રણેય માંથી કોઈ એક અથવા ત્રણેય નું પરિણામ છે.

આમ, ઉપરોક્ત વ્યાખ્યાઓને આધારે સામાન્ય અને સરળ અર્થ એવો કરી શકીએ કે, “નફો એ સતત ચાલતી પ્રક્રિયા છે જે નિયોજક ને જોખમ, અનિશ્ચિતતા, સંશોધન અને કુશળતા બદલ પ્રાપ્ત થાય છે.

➤ નફો ઉદ્ભવવાનાં કારણો :-

- ૧) ઈજારાશાહીને લીધે ઉદ્ભવે છે.
- ૨) પરિવર્તનને લીધે પ્રાપ્ત થાય છે.
- ૩) સતત સંશોધનને કારણે મેળવે છે.
- ૪) કુશળતા અને જોખમનાં નાં સંયોજનનું પરિણામ છે.
- ૫) અનિશ્ચિતતાઓ સાથે બાથ ભીડવાનું પરિણામ છે.

નોંધ :- નફો હંમેશા હકારાત્મક વળતર આપે તેવું કહી શકાય નહીં, તે નકારાત્મક પણ હોઈ શકે છે.

નફોનાં પ્રકારો :-


અર્થશાસ્ત્રમાં નફો ને ૧) કાચો નફો કે કુલ નફો અને શુધ્ય નફો અને ૨) સામાન્ય (સાધારણ) નફો અને અસામાન્ય (અસાધારણ) નફો એમ કુલ બે વિભાગમાં વહેચવામાં આવે છે.

(અ) કાચો નફો / કુલ નફો અને શુધ્ય નફો.

(ય) કાચો નફો કે કુલ નફો :-

પ્રો. વોકર અને શુમ્પીટર ધ્વારા આપવામાં આવેલા નફો અંગેનાં ઘ્યાલને આગળ વધારીએ તો નિયોજક જે કુલ આવક પ્રાપ્ત કરે છે તેમાંથી કુલ બચ્યને બાદ કરતા જે બચે છે કે શેષ રહે છે તેને નિયોજક કે ઉત્પાદન એકમ કે ઉત્પાદક નો કાચો નફો અથવા કુલ નફો તરીકે ઓળખવામાં આવે છે.

કાચો નફો નિયોજકને શા માટે પ્રાપ્ત થાય છે ? તે પ્રશ્નનાં જવાબમાં કાચા નફો નાં ઘ્યાલમાં સમાવિષ્ટ વિવિધ પ્રકારનાં વળતરો જવાબદાર છે તેમ માનવામાં આવે છે.



આ ઉપરાંત અન્ય કેટલાક પરિબળો જેવા કે ઈજારાશાહી, ધંધા-વ્યવસાય માં રહેલી તકો પણ કાચો નફો ઉદ્ભવવામાં અસરકારક ભૂમિકા નિભાવે છે. ઉ.દા. ચીન-કોરોના વાયરસ-માસ્ક.

આમ, જો કાચો કે કુલ નફો ટૂંકમાં સમજીએતો તે નિયોજક/ઉત્પાદક/ઉત્પાદન એકમનું

(૨૦/-)                    (૨૦/-)                    (૨૦/-)                    (૨૦/-)

વ્યવસ્થાપનનું વળતર + મૂડી પરનું વ્યાજ + જમીનનું ભાડું + ઈજારાશાહીનો +

(૨૦/-)

તકનો લાભ = કાચો કે કુલ નફો = ૧૦૦/-

એમ કહી શકાય, કાચો નફો = ૧૦૦/- રૂપિયા = ૨૦ + ૨૦ + ૨૦ + ૨૦ + ૨૦

(૧) શુદ્ધ નફો :-

અર્થશાસ્ત્ર વિષયમાં / કોઈ પણ ધેંધા વ્યવસાયમાં મહદવંશો શુદ્ધ નફો મહત્વનો માનવમાં આવે છે.

શુદ્ધ નફો ઉદ્ભવવામાં નિયોજક/ઉત્પાદક. ઉત્પાદન એકમની ભૂમિકા અને જવાબદારી મહત્વનું પરિબળ માનવમાં આવે છે. કારણો કે નફો ત્યારે જ ઉદ્ભવે જ્યારે વ્યુહરચના આધારિત ઉત્પાદનનાં સાધનોનું સંયોજન થયેલ હોય.

૩.૬. મૂડી પ્રધાન દેશ અને શ્રમ પ્રધાન દેશ.

ઉત્પાદનનાં સાધનોમાં ‘શ્રમ’ એક અગત્યનું પરિબળ છે. મૂડી પ્રધાન દેશો જેવા કે અમેરિકા, ઈંગ્લેન્ડ, જર્મની. જેમાં મૂડીનું પ્રમાણ વધારે છે અને શ્રમનું પ્રમાણ ઓછું છે તેવા સંજોગોમાં નિયોજક ની ભૂમિકા મૂડીના એકમ વધારે અને શ્રમનાં એકમો ઓછા વાળા ઉત્પાદન સંયોજન વડે ઉત્પાદન હાથ ધરવાથી છે. કારણ કે શ્રમનો પુરવઠો ઓછો હોવાથી શ્રમ પ્રમાણમાં મૌખો હોઈ શકે છે, જ્યારે મૂડી નું પ્રમાણ વધારે હોવાથી તે પ્રમાણમાં સસ્તી ઉપલબ્ધ થઈ શકે છે.

આ પરિસ્થિતિથી તદ્દન વિપરિત એટલે કે શ્રમ પ્રધાન દેશ જેમ કે ભારત, જેમાં ‘શ્રમ’નું (વસ્તીનું) પ્રમાણ વધારે છે. અને મૂડીનું પ્રમાણ ઓછું છે તેવા સંજોગો માં નિયોજક ઉત્પાદનની પ્રક્રિયામાં મૂડીના ઓછા એકમો અને શ્રમ નાં વધારે એકમો વાળા ઉત્પાદન સંયોજન વડે ઉત્પાદન હાથ ધરવાની પ્રક્રિયા અંગેની જવાબદારી નિભાવે છે.

આમ, ટૂંકમાં કહીએ તો ભૂતકાળનાં અનુભવો કે બોધપાઠો, વર્તમાન પરિસ્થિતિ અને ભવિષ્યનાં અંદાજો ને ધ્યાનમાં રાખીને ઉત્પાદક/નિયોજક/ઉત્પાદન એકમ ઉત્પાદનનાં સાધનોનું સંયોજન કરે છે તેની બદલા-કમાણી નફો છે.

આ ઉપરાંત, નિયોજક ઉત્પાદનની પ્રક્રિયામાં બજાર સંશોધન આધારિત અનિશ્ચિતતાઓ ઉઠાવે છે. આ અનિશ્ચિતતાઓ ઉઠાવવા બદલ મળતું વળતર એટલે નફો.

૩.૬. કોઈ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું? ક્યારે કરવું? કોના માટે કરવું? વગેરે...

આમ, આ પ્રશ્નોના નિરાકરણ માટે સતત સંશોધનો ચાલ્યા કરે છે. જેનાં વળતર બદલ નિયોજક નફો પ્રાપ્ત કરે છે.

ચોખ્ખો નફો મેળવવા માટે કાચો નફો મહત્વનો છે. કારણ કે કાચા નફા માંથી નિયોજકનાં પ્રયત્નો નું વળતર બાદ કરીએ તો ચોખ્ખો નફો મળવા પામે છે.

એટલે કે..

કાચા નફા માંથી નિયોજકનાં પોતાનાં અંગત વળતરો જેવાં કે તેની વ્યવસ્થાપન ક્ષમતાનું વળતર, તેની પોતાની મૂડી પરસ્નું વ્યાજ, તેની જમીનનું ભાડું, સાધનોનું ધસારા ખર્ચ, વગેરે બાદ કરવામાં આવતા જે શેષ રહે તે ચોખ્ખો નફો છે.

૩.૬. કાચો નફો	=	વ્યવસ્થાપનનું વળતર	=	૧૦/- રૂ.
(૧૦૦/- રૂ.)		મૂડીનું વ્યાજ	=	૧૦/- રૂ.
		જમીનનું ભાડું	=	૧૦/- રૂ.
		ધસારા ખર્ચ	=	૧૦/- રૂ.
				૪૦/- રૂ.

ચોખ્ખો નફો = ૧૦૦-૪૦ = ૬૦/- રૂ.

એટલે કે કાચો નફોમાંથી નિયોજકની બદલા કર્માણી માંથી અમુક બાબતોની બાદબાકી કરવામાં આવે તો બાકી રહેતી રકમ ચોખ્ખો નફો છે.

ચોખ્ખો નફો = કાચો નફો – વ્યવસ્થાપનનું વળતર-મૂડીનું વ્યાજ-જમીનનું ભાડું-ધસરાખર્ય.

અહીં ધ્યાનમાં રાખવામાં આવતી કેટલીક બાબતો છે.

૧) કાચો નફો હંમેશા શુધ્ય નફો કરતાં વધારે હોય છે.

કાચો નફો | શુધ્ય નફો.

૨) અર્થશાસ્ત્ર વિષય હંમેશા શુધ્ય નફો ઉપર વિશેષ ભાર મુકવામાં આવે છે.

૩) કાચો નફો મહદાંશ હકારત્મક હોય છે જ્યારે શુધ્ય નફો હકારત્મક, નકારત્મક કે શૂન્ય પણ હોઈ શકે છે.

૪) સામાન્ય નફો અને અસામાન્ય નફો :-

(સાધારણ નફો અને અસાધારણ નફો)

૫) સામાન્ય કે સાધારણ નફો :-

નિયોજક પોતાનાં ધંધામાં કે વ્યવસાયમાં જે યોગદાન આપે છે તે જ યોગદાન અન્ય કોઈ વ્યક્તિનાં ધંધા કે વ્યવસાયમાં આપે અને બંને પરિસ્થિતિમાં વળતર તરીકે નફો એક સરખો જોવા મળે તો તેને સામાન્ય કે સાધારણ નફો કહેવામાં આવે છે.

ઉ.દા. ઉત્પાદક – ‘દ’ પોતે બિસ્કિટ બનાવવાની શરૂઆત કરે, અને પોતે સાધન સંયોજન ધ્વારા ઉત્પાદન કરે અને તેમાંથી મળતું વળતર અને ઉત્પાદક – ‘છ’ અન્ય કોઈની માલિકીનાં ઉત્પાદન ચોક્સમાં સાધન સંયોજનની નિયોજકની ભૂમિકા નિભાવે અને તેમાંથી પ્રામ થતું વળતર,

આમ, આ બંને વળતર એક સરખા હોય તો તે સામાન્ય કે સાધારણ નફો છે એમ કહી શકાય.

આમ, સામાન્ય કે સાધારણ નફો મહદાંશે વ્યવસાયમાં રોકવામાં આવેલ મૂડીની ફેરફાર ક્ષમતા (વધારે કે ઓછી) અને મૂડી રોકાણની વૈકલ્પિક કે ફેરફાર જન્ય તક ધ્વારા નિર્ધારિત થાય છે.

૬) અસામાન્ય કે અસાધારણ નફો :-

અસામાન્ય કે અસાધારણ શર્દુ જ આણધાર્યું કે અકલ્પનીયતા દર્શાવે છે.

એટલે કે કુલ સરેરાશ ખર્ચની તુલનામાં કુલ સરેરાશ આવક નું પ્રમાણ ખુબજ વધારે હોય તો અસામાન્ય કે અસાધારણ નફોને જન્માવે છે.

મહદાંશે ઈજારાશાહી એટલે કે જ્યાં ઉત્પાદક ધ્વારા ઉત્પજા થતી ચીજ-વસ્તુનો કોઈ વિકલ્પ હોતો નથી.

ત્યાં ઈજારાદાર પેઢી કે ઉત્પાદન એકમ અસાધારણ નફો પ્રામ કરે છે.

વર્તમાન આધુનિક સમયમાં, મહદાંશે ઉત્પાદકો પોતાની ઉત્પાદિત ચીજ વસ્તુનાં સંયોજનનાં પેટન્ટ હક, કોપી રાઇટ હક વગેરે પ્રામ કરે છે અને બજારમાં ઈજારો ભોગવે છે. એટલે કે ઈજારાદાર ચીજવસ્તુની કિંમત ઉત્પાદન ખર્ચની તુલનામાં ઘણી ઉચ્ચી રાખી શકે છે.

ઉ.દા. અમેરિકાની મોબાઈલ ફોન કંપની, ટંડા પીણાની કંપની વગેરે.

આમ, અસામાન્ય નફો ઊંચી કિંમત ધ્વારા પ્રામ કરાયેલ ઊંચી આવક અને ઉત્પાદનનાં સાધનોને વળતર રૂપે ચૂકવાયેલ નીચી કિંમતનાં સંયોજન ધ્વારા કે ચીજ-વસ્તુનાં એકમો અને તેના ઉપયોગમાં સંકળાયેલ દરજ્ઞો જેવી બાબતો સાથે સંકળાયેલ છે.

નફો અને અન્ય સાધનો ની આવક :-

ઉત્પાદનાં ચાર સાધનો છે. ૧) જમીન, ૨) મૂડી, ૩) શ્રમ અને ૪) નિયોજક. જેઓ અનુક્રમે ૧) ભાડું, ૨) વ્યાજ,  
૩) વેતન અને ૪) નફો બદલાકમાણી કે આવક કે વળતર મેળવે છે.

નીચે આપેલા/ દર્શાવિલા કોષ્ટક ની સમજૃતી ધ્વારા નફો અને અન્ય સાધનોની આવક સમજવાનો પ્રયત્ન  
કરીશું.

ક્રમ નંબર	ઉત્પાદનનાં સાધનો	વિશિષ્ટતા	ઉત્પાદનની પ્રક્રિયામાં ભૂમિકા	વળતર કે બદલા કમાણી	પ્રકાર	ખ્યાલ સંકળાયેલ અર્થશાસ્ત્રીઓ
૧	જમીન	કુદરતી ભેટ, અછત ધરાવતું સાધન	સક્રિય, જમીન વગર ઉત્પાદન પ્રક્રિયા શક્ય નથી.	મૂળભૂત અને અવિનાશી તત્વોનાં ઉપયોગનું વળતર ભાડું	૧) કરારી ભાડું ૨) આર્થિક ભાડું	ટેવિડ રીકોર્ડો બ્રિટીશ અર્થ શાસ્ત્રીવોકર, રોબિન્સન
૨	મૂડી	ભૌતિક મૂડી, માનવ સર્જિત	સક્રિય, ગુણવત્તા ઝડપી ઉત્પાદન માટે	મૂડી વાપરવાની કિંમત વ્યાજ	૧) કુલ વ્યાજ ૨) કુદરતી વ્યાજ ૩) સામાન્ય વ્યાજ ૪) વાસ્તવિક વ્યાજ	સેલિંમેન, વિકસેલ, મેયસ
૩	શ્રમ	શ્રમિક (માનવ) માલિક સાથેનો પૂર્વનિર્ધારિત કરાર.	સક્રિય શારીરિક અને માનસિક શ્રમ	વેતન	૧) નાણાંકીય વેતન ૨) વાસ્તવિક વેતન	બેન્છામ, ગાઈડ, કેઈન્સ
૪	નિયોજક	જમીન, મૂડી અને શ્રમનું સંયોજન, બુધ્ય ક્ષમતા, તર્ક બુધ્ય સૌથી છેલ્લે પ્રામ થાય હકારાત્મક કે નહીરાત્મક પણ હોઈ શકે.	સક્રિય, સતત, વિવેકપૂર્ણ મહદદંશે માનસિક શ્રમ	નફો	૧) કાચો નફો ૨) શુધ્ય નફો ૩) સાધારણ નફો ૪) અસાધારણ નફો	વોકર, કલાર્ક, હોલી

નફાનાં સિધ્યાંતો :-

અર્થશાસ્ત્રમાં ‘નફો’ નિયોજકીય પ્રવૃત્તિ બદલા કમાણી તરીકે માનવામાં આવે છે. નફો ઉદ્ભવવાનાં ઘણા બધા કારણો હોઈ શકે છે. તેથી વિશ્વનાં અલગ-અલગ અર્થશાસ્ત્રીઓએ નફો ઉદ્ભવવાનું કારણ અલગ-અલગ સિધ્યાંતોનાં રૂપમાં રજૂ કર્યું છે.

અર્થશાસ્ત્રીઓ જેવાં કે જે.બી.કલાર્ક, જોસેફ શુમિટર, એફ.બી.હોલી, અને ફેંક નાઈટ વગેરે એ નિયોજકને નફો શા માટે પ્રામ થાય છે ? તે અંગે પોતાનાં મંતવ્યો સંશોધન અને આધારભૂત ઉદાહરણોની મદદથી સમજવવાનો પ્રયત્ન કર્યો છે.

## નફાનો સિધ્યાંત :-

- ૧) ગતિશીલ અર્થતંત્ર અને નફો :- જે. બી. કલાક (હાયક્સ્પેચ ઇન્ડસ્ટ્રીઝ.)

જો બેટ્સ કલાર્ક વર્ષ ૧૮૪૭ માં અમેરિકામાં જન્મેલા નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રી છે. તેમનો સમયગાળો ૧૮૪૭ થી ૧૮૮૮ નો માનવામાં આવે છે તેઓ સીમાંત ઉત્પાદકતાનાં સિધ્યાંતો માટે વિશ્વભરમાં જાહીતા હતા, જેમાં તેમને ઉત્પાદનનાં સાધનોને આવકની વહેંચણી કેવી રીતે થાય છે તેની સરળ સમજીતી આપવામાં આવેલી છે.

અમેરિકન અર્થશાસ્ત્રી એ ગતિશીલ અર્થતંત્ર અને નફો અંગે નો ખ્યાલ રજૂ કરતા જણાવ્યું છે કે નફો હંમેશા ગતિશીલ અર્થતંત્રમાં જ જન્મે છે. એટલે કે જો અર્થતંત્ર ગતિશીલ નાં હોયતો વસ્તુની કિંમત અને ખર્ચ માં તફાવત જોવા મળે છે. એટલે કે જો માંગ અને પુરવઠો ફેરફાર નાં પામે તો નફો પ્રાપ્ત થતો નથી. જો માંગ અને પુરવઠાની સ્થિતિ બદલાય અને વસ્તુની કિંમત, ખર્ચ કરતા વધે તો જ નફો ઉદ્ભવવા પામે છે. કારણ કે જો વસ્તુ ઉત્પન્ની કરવાનો ખર્ચ તેની કિંમત કરતા વધેતો ખોટ ઉલ્લંઘને છે.

આમ, ટુકડાળામાં અર્થતંત્ર અગતિશીલ હોઈ શકે છે. પણ લાંબા ગાળે અર્થતંત્રમાં ઉદ્ભવતી ગતિશીલતા નફો ઉદ્ભવવાનું કારણ બને છે.

સરળ શબ્દોમાં કહીએ તો ગતિશીલ અર્થતંત્ર અને નજો આ સિધ્યાંત માંગ અને પુરવઠાની પરિસ્થિતિનાં કારણે ઉદ્ભવતી અસમતુલાને લીધે પ્રામથ્યતી કે કમાવવામાં આવતી વધારાની રકમ એ નજો છે.

જે.બી.કલાર્કનાં શબ્દોમાં કહીએ તો "જો અર્થતંત્રમાં માંગ અને પુરવઠાની પરિસ્થિતિઓમાં ફેરફાર ના થાય ત્યારે ઉત્પાદનનાં સાધનોને તેમની સીમાંત ઉત્પાદકતાને આધારે વળતર ચૂકવવામાં આવે છે. તેથી કુલ ખર્ચ =કુલ કિંમત થવા પામે છે. તેથી આવી પરિસ્થિતિમાં નફો ઉદ્ભવતો નથી."

અર્થતંત્રમાં દરીયાનાં મોજાની જેમ સતત પરિવર્તનો ચાલ્યા જ કરે છે. મહદભાંશે અર્થતંત્ર ઝડપી કે ધીમી ગતિએ ગતિશીલ પરિસ્થિતિમાં જ જોવા મળે છે. કારણ કે અર્થતંત્રની વસ્તી વિષયક લાક્ષણિકતાઓ, માંગ ને અસરકર્તા પરિબળો, પુરવઠાને અસરકરતા પરિબળો ક્યારેય પણ સ્થિર જોવા મળતા નથી કે હોઈ શકે પણ નહીં. આથી સતત ચાલતા અર્થતંત્રમાં ઉત્પાદન ખર્ચ અને કિંમત માં પણ ફેરફાર જોવા મળે જ છે તેથી જ આ ફેરફાર નફો જન્માવે છે.

અર્થતંત્રમાં આવતા સતત પરિવર્તનો બે સ્વરૂપે જોવા મળે છે.



- (१) आंतरिक परिवर्तनो :- एटले के नियोजक समय, संजोगो अने परिस्थितिने ध्यानमां राखीने उत्पादननी प्रक्रियामां उत्पादननां साधनोनां विविध संयोजनोमां बदलाव करतो रहे छे. तेथी उत्पन थती चीज वस्तुनी मांग अने पुरवठामां पाण बदलाव आवे छे. जो उत्पादननो हेतु मांगमां वधारो करवो ऐम होय तो सतत विश्वापन खर्च ध्वारा तेनु वेचाण वधारी शके छे. ज्यारे जो नियोजक कोई नवी वस्तु बજारमां आपवा मांगतो होय तो योग्य व्यूहरचना आधारीत उत्पादन ध्वारा नवी शोधभोज के संशोधननी मददथी बजारमां ते वस्तु उपलब्ध करावी शके छे. नवा यंत्रोनां उपयोग करीने उत्पादन खर्च घटावानां प्रयत्नो पाण करी शके छे. आम, अही नझो उत्पादन एकम/ पेढी के नियोजक पोते आंतरिक परिवर्तनो ध्वारा कमाय छे.

- (2) બાધ્ય પરિવર્તનો :- એટલે કે એવા પરિબળો કે જે નિયોજકનાં હાથમાં નથી. સમગ્ર અર્થતંત્રમાં સમયનાં બદલાવની સાથે આધુનિકતાનાં સ્વરૂપે જોવા મળી શકે છે. જેમ કે લાંબાગાળે ગ્રાહકોની અભિરૂચ્યિમાં બદલાવ જોવા મળે છે કે આક્સિમેક કારણો જેવાં પરિસ્થિતિ બેકાબુ બનવી કે યુધ્ય જન્ય સ્થિતિ, અનિયંત્રિત ગતિનો ફુગાવો કે પછી વેપારચકમાં અવિરત ચાલતા તેજ કે મંદીના પરિબળો અથવા તો રાજકીય પરિબળોને લીધે ઔધોગિક

नीतिमां फेरफार के पछी દेशनી મધ્યस્થ બેંક ધ્વારા કરવામાં આવતા ટૂંકાગાળાનાં કે લાંબા ગાળા નાં નાણાંકીય નીતિનાં ફેરફાર વગેરે ને લીધે ચીજ વસ્તુની માંગ, તેની કિંમત અને ખર્ચમાં ફેરફાર આવી શકે છે.

ઉ.દા. વેપાર ચકમાં સર્વ સામાન્ય ચાર તબક્કા જેવા કે

૧) વિસ્તરણ, ૨) તેજી, ૩) સંકોચન ૪) મંદી

અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવા દેશની મધ્યસ્થ બેંક ધ્વારા ગુણાત્મક સાધનો કે પરિમાણાત્મક સાધનો જેવા કે બેંક દર, રેપો રેટ, રોકડ અનામત પ્રમાણ, વૈધાનિક તરલતા દર વગેરેમાં પરિવર્તનનો લાવી ને નિયોજકોની ઘિરાણ મેળવવાની અને ઉત્પાદકીય ક્ષમતામાં વધારો કરવામાં આવે છે. જેની સમગ્ર અર્થતંત્રને સ્થગિતતામાંથી બહાર લાવીને એક ધક્કા સ્વરૂપે ગતિશીલતા આપવામાં આવે છે. ઉત્પાદન ગ્રવૃત્તિ વધશે તો આવક સર્જન થશે આવક સર્જન થશે તો માંગ વધશે અને માંગ વધશે તો અર્થતંત્ર મંદી માંથી બહાર આવશે.

આમ, અર્થતંત્રમાં આંતરિક અને બાખ્ય પરિવર્તનો ધ્વારા નફાડુપી વળતરનો જન્મ થાય છે. આ ઉપરાંત અર્થતંત્રમાં અન્ય કેટલાક પરિબળો, ફેલાવાની અસર, દેખા-દેખીની અસર વગેરે પણ અવિરત પણે નફો ઉદ્ભવવાનું કારણ બનવા પામે છે.

જે.બી.કલાર્કનાં શબ્દોમાં કહીએ તો નિયોજક/ સાહસિક કે મૂડીપતિનું કામ પોતાનાં વ્યવસાયને ઉપરોક્ત પરિબળો ધ્વારા આવતા પરિવર્તનોનો લાભ ઉઠાવી ને આગળ વધવાનું છે, ઉપરાંત બિનજરરી ખર્ચ ઓ ઉપર અંકુશ મેળવીને ઈષ્ટતમ ખર્ચ કરવાનું છે અને મહત્તમ વેચાણ કરવાનું છે.

આમ, આંતરિક, બાખ્ય અને અન્ય પ્રકારનાં પરિવર્તનોને કારણે કેટલાક મૂડી સાહસિકો નવી-નવી શોધખોળ કરે છે. નવી ઉત્પાદન પદ્ધતિ અમલમાં મુકે છે તેના પરિણામ સ્વરૂપ ખર્ચ ઘટે છે અને ઉત્પાદન વધે છે. ઉ.દા. હેન્દલુમ ઉદ્યોગોથી પાવરલૂમ ઉદ્યોગો. આમ, જે નિયોજકો સંશોધન કાર્ય માં અગ્રતા ધરાવે છે તેઓ નફો પ્રાપ્ત કરે છે. ઉ.દા. ભારતમાં દુરસંચારક્ષેત્રે સેવા આપતી કંપનીનાં કોલ દર સૌ પ્રથમ ટાટા ડોકોમો નામની કંપનીએ પ્રતિ સેકંડ કોલ દર પ્રતિ પૈસા તરીકે વિકસાયો અને નફો પ્રાપ્ત કર્યો. ક્યારે તૈંત્રિક નામની કંપનીએ ઈન્ટરનેટની સુવિધાની ઝડપને મોબાઇલ ફોન સાથે સાંકળી નફો પ્રાપ્ત કર્યો.

આમ, જે નિયોજકો સંશોધન કાર્યમાં અગ્રતા મેળવે છે. તે સમયાંતરે તેમનાં હરિફ ઉદ્યોગો ધ્વારા પણ અપનાવવામાં આવે છે અને નફો ધીમે ધીમે ઓછો કે અદ્રશ્ય થઈ જવા પામે છે, આમ, આ નફો કાયમી ધોરણે ટકી શકતો નથી.

જે.બી.કલાર્ક નોંધે છે કે નફો એક છટકી જાય તેવી રકમ છે. તેને કાયમ માટે પકડી રાખી શકતો નથી. જો નિયોજક તેને પકડી રાખવા પ્રયત્ન કરે તો પણ તે મનુષ્યનાં હાથમાં પાણી પકડી એ અને આંગળીઓમાં ફેલાઈ જાય તેમ ફેલાઈ જવા પામે છે. અને ત્યાર બા તે અદ્રશ્ય થઈ જાય છે. એટલે કે સમયનાં પ્રવાહની સાથે સતત ગતિશીલતા જ નફો કમાવવાની તક પેદા કરે છે. એટલે કે આવા સમયે સાહસિક ફરી સંસોધન કરે, ઉત્પાદન ખર્ચ પર અંકુશ મેળવે અને નફો પ્રાપ્ત કરે.

અર્થશાસ્ત્ર વિષય અને તેના સિધ્યાંતોની રસપ્રદ અને મહત્વની બાબત એ છે કે કોઈ એક અર્થશાસ્ત્રી ધ્વારા આપવામાં આવેલા સિધ્યાંતો જે તે સમય અને સંજોગોનાં પરિપ્રેક્ષમાં ખુબ જ બહોળી પ્રસ્તિષ્ઠિ હાંસલ કરે છે પરંતુ ત્યાર બાદ અન્ય અર્થશાસ્ત્રીઓ ધ્વારા તેમાં રહેલ ગુટીઓ પ્રત્યે અસંતોષ પણ ઠાલવવામાં આવે છે અને તેને સિધ્યાંતની ટીકાનાં સ્વરૂપે રજુ કરવામાં આવે છે.

સિધ્યાંતની ટીકાઓ :-

જે.બી.કલાર્કનાં સિધ્યાંત મુજબ નફો ગતિશીલ અર્થતંત્રમાં જન્મે છે, પરંતુ અર્થશાસ્ત્રી જેવા કે નાઈટ, ટ્રીફીન, શુભીટર અને હોલી એમ માને છે કે નફો અનેક રીતે અન્ય કોઈ બાબતોથી પણ ઉદ્ભવી શકે છે. જે નીચે મુજબ છે.

- ૧) નફો ઈજારાશાહીને લીધે ઉદ્ભવી શકે છે. તે માટે અર્થતંત્રમાં ગતિશીલતા કે પરિવર્તનો આવવા જરૂરી નથી. ઈજારદાર પેઢી ચીજવસ્તુની કિંમત ઊંચી રાખીને નફો મેળવી શકે છે.
- ૨) પ્રો. નાઈટ નાં શબ્દોમાં કહીએતો અનિશ્ચિત પરિવર્તનો જ નફો ઉદ્ભવવામાટે જવાબદાર પરિબળ છે. કારણ કે જે પરિવર્તનનો અગાઉથી જ ધારી કે અનુમાની શકાય તેમ હોય તો તે નફો જન્માવવા માટે સક્ષમ બની શકતા નથી.
- ૩) પ્રો. ટ્રીઝીનનાં શબ્દોમાં કહીએ તો નફો ધાણી વાર ગ્રાહકોનાં શોષણ કે ગરજને લીધે પણ ઉદ્ભવી શકે છે. જેમ કે ઉનાળામાં પ્રવાસ કે મુસાફરી દરમ્યાન ઠંડા પાણીની કિંમત.
- ૪) જોસેફ શુભ્મીટર માને છે કે અર્થતંત્રમાં ગતિશીલતા નહિ પણ નવપ્રવર્તનને લીધે નફો ઉદ્ભવે છે. નવપ્રવર્તન મહદાંશો સંશોધન ને કારણે ઉદ્ભવે છે.

૨) **નફાનાં નવ પરિવર્તનનો સિધ્યાંત :- જોસેફ શુભ્મીટર Innovation theory of profit.**

જોસેફ શુભ્મીટર વર્ષ ૧૮૮૭માં ઓસ્ટ્રેલિયામાં જન્મેલ રાજકીય અર્થશાસ્ત્રી હતા. તેમનો સમયગાળો ૧૮૮૩ થી ૧૮૫૦ સુધીનો માનવામાં આવે છે. તેઓ વેપાર ચક્કો અને મૂડીવાદી વિકાસ અને નિયોજકીય જ્યાલ માટે વિશ્વભરમાં જાણીતા હતા.

નફાનાં નવ પરિવર્તનનો સિધ્યાંત જોસેફ શુભ્મીટર ધ્વારા આપવામાં આવ્યો હતો. તેમના માટે ઉત્પાદનની પ્રક્રિયામાં સંશોધન સતત ચાલતી કર્યા છે જે વસ્તુની વર્તમાન કિંમત અને ઉત્પાદન ખર્ચ વચ્ચેનાં તફાવતનું કારણ બને છે.

શુભ્મીટરનાં શબ્દોમાં કહીએ તો સંશોધન એટલે કે જે નિયોજકનાં ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરે અને ચીજ-વસ્તુની માંગમાં વધારો કરે તે.

નિયોજકનાં ઉત્પાદન ખર્ચમાં ઘટાડો નવા યંત્રો, ટેકનોલોજી, કાચા માલનાં અન્ય સ્વોતો વગેરેના ઈષ્ટતમ ઉપયોગ ધ્વારા થઈ શકે છે. જ્યારે ચીજ-વસ્તુની માંગમાં વધારો નવી વસ્તુ, આકર્ષક વિજ્ઞાપનો, નવા બજારની પ્રાપ્તિ વગેરે ધ્વારા હાંસલ કરી શકાય છે.

આમ, અર્થતંત્રમાં નફો નીચે દર્શાવેલા મુખ્ય પાંચ પરિવર્તનો ધ્વારા પેદા થાય છે.

- ૧) અવનવી ચીજ વસ્તુનું ઉત્પાદન કરીને.
- ૨) ઉત્પાદન પદ્ધતિમાં સંશોધન ધ્વારા નવી પદ્ધતિ વિકસાવીને
- ૩) નવું બજાર પ્રાપ્ત કરીને કુલ વેચાણમાં વધારો કરીને
- ૪) કાચામાલની પ્રાપ્તિનાં નવા સ્વોતો શોધીને કે વિકસાવીને
- ૫) ઉત્પાદન એકમનું માળખું બદલીને.

❖ **પાંચ પરીવર્તનોની વિગતવાર સમજૂતી :-**

- ૧) **અવનવી ચીજવસ્તુનું ઉત્પાદન :-** પ્રવર્તમાન બજારમાં ઉપલબ્ધ ચીજ-વસ્તુઓનો અભ્યાસ કરીને જે ચીજ-વસ્તુઓ અસ્તિત્વમાં જ નથી તેવી વસ્તુનું ઉત્પાદન અને તેના લાભ દર્શાવીને કોઈ નિયોજક કે ઉત્પાદન એકમ નફો પ્રાપ્ત કરે છે.  
૩.૬. ભારતમાં ટેલિવિજન યુગની શરૂઆત, ભારતમાં દુરસંચાર કાંતિની શરૂઆતથી માંડીને અત્યાર સુધીમાં આવેલા વિવિધ પ્રકારનાં રંગ, રૂપ લાક્ષણિકતા અને ડીજાઈન વાળા ટેલિવિજન અને મોબાઇલ ફોન.

૨) સંશોધન ધ્વારા ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર :- ચીજ-વસ્તુનાં ઉત્પાદનમાં વર્તમાન ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર લાવીને નવી આધુનિક ટેકનોલોજીનાં માધ્યમ ધ્વારા ચીજ-વસ્તુનું ઉત્પાદન ગુણવત્તા અને વસ્તુનાં જીવનકાળમાં વધારો લાવે છે.

૩.૬. ટાઈપ રાઇટર મશીન થી કોમ્પ્યુટર

૩) નવા બજારની પ્રાપ્તિ ધ્વારા કુલ વેચાણમાં વધારો :- સામાન્ય રીતે ઉત્પાદક જે જગ્યાએ ઉત્પાદન કરે છે તેની નજીક બજાર પ્રાપ્ત કરે છે. આમ એ નવા બજારની શોધમાં અન્ય સ્થળ કે જગ્યા એ ઉત્પાદિત ચીજ-વસ્તુનું વેચાણ કરેતો નવું બજાર મેળવે છે અને તેની કુલ આવકમાં વધારો કરી શકે છે.

૩.૭. વર્ષ ૧૯૮૧ પહેલાનું ભારતીય અર્થતંત્ર બજાર ઉપર નિયંત્રણ વ્યવસ્થા ધરાવતું હતું, જેથી ભારતની અમુક જ વસ્તુઓ અને અન્ય દેશોની પણ મર્યાદીત વસ્તુઓ જ એકબીજા દેશમાં વેચાણ પામતી હતી. આમ, ૧૯૮૧ પછી મુક્ત અર્થતંત્ર તરીકે વેપારની શરતો સુધરવાને લીધે આજે એવી તમામ વસ્તુઓ જે ભારતમાં બને છે તે અન્ય દેશોમાં પણ બજાર મેળવે છે જ્યારે અન્ય દેશોમાં બનતી વસ્તુઓ ભારતમાં પણ બજાર મેળવે છે.

૪) કાચામાલની પ્રાપ્તિનાં નવા સ્વોતો :- નિયોજક જો કાચામાલની પ્રાપ્તિમાં કોઈ એકજ સ્વોત ઉપર આધાર રાખેતો સમયાંતરે તેને ઊંચી કિંમત પણ ચૂકવવી પડી શકે છે, આમ, કાચામાલની પ્રાપ્તિનાં નવા સ્વોતો એકજ વેચાણકર્તા ઉપર નિર્ભરતા ઘટાડીને હરીફાઈનું સર્જન કરે છે, અને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો પણ કરે છે જેથી નફો પ્રાપ્ત કરી શકાય છે.

૫) ઉત્પાદન એકમનું માળખું :- નિયોજક સમયની સાથે તેનાં આંતરીક માળખામાં શ્રમિકો, મૂડી કે ટેકનોલોજી ની સંખ્યામાં વધારો કે ઘટાડો કરે છે, તેઓને વધારે સક્ષમ બનાવવા તાલીમ આપે છે જેથી ગુણવત્તાયુક્ત ચીજવસ્તુ ઉત્પન્ન થઈ શકે અને બજારમાં અસ્તિત્વ ટકાવી શકાય. આ ઉપરાંત કોઈ કર્મચારીને તેનાં કામની ગુણવત્તા અને અનુભવને આધારે બઢતી કે બઢતી કરીને સમગ્ર ઉત્પાદન એકમનું માળખું કાર્યક્ષમતા વધારવાનાં ઉદ્દેશથી બઢતીને નફો પ્રાપ્ત કરી શકે છે.

આમ, જોસેફ શુમ્પીટર નફાનાં નવ પરિવર્તનનો સિધ્યાંત રજૂ કરે છે. અને દ્રઘપણે એવું માને છે કે જો નિયોજક ને નફો કમાવવો હોય તો પરિવર્તનો કરવા જ પડશે, સંશોધનો કરવા જ પડશે, આમ નફો એ સંશોધનનું કારણ અને પરિણામ બને છે.

### મર્યાદાઓ :- ટીકાઓ :-

- ૧) શુમ્પીટર માત્ર સંશોધન ધ્વારા આવતા પરિવર્તનોને ન ઉદ્ભવવાનું કારણ માને છે, જ્યારે વાસ્તવીક પરિસ્થિતિમાં અર્થતંત્રનાં પરિવર્તનો ને લીધે પણ નફો ઉદ્ભવી શકે છે.
- ૨) શુમ્પીટર માને છે કે નિયોજક માત્ર સંશોધન કાર્ય થકી પરિવર્તનો લાવે છે જ્યારે વાસ્તવમાં જોખમ, અનિશ્ચિતતા, સંકલન, વ્યૂહરચના નિર્ણયીકરણ પણ નિયોજક ધ્વારા કરવામાં આવે છે.
- ૩) આંતરાધ્રીય કે આંતરીક પરિબળોને કારણે નવ પ્રવર્તનો કે પરીવર્તનો થવા છતાં નફો ઉદ્ભવી શકતો નથી.
- ૪) સંશોધનાત્મક પરિવર્તન થકી ઈજારો ઉદ્ભવે છે તેથી તેને ઈજારાશાહી ને લીધે મળતી આવક માનવી કે નિયોજકનો નફો તે ચર્ચાનો વિષય છે.
- ૫) પ્રો. નાઈટ માને છે કે નફો પરિવર્તનોને લીધે નહિ પણ અનિશ્ચિતતાઓ ઉઠાવવાને કારણે પ્રાપ્ત થાય છે.

### ૩) સંયુક્ત મૂડી કંપની અને નફો :-

પ્રો. એફ.બી.હોલી સંયુક્ત મૂડી કંપનીઓ જોખમ ઉઠાવવાનાં વળતર સ્વરૂપે નફારૂપી આવક પ્રાપ્ત કરે છે. તેઓએ તેમના પુસ્તક 'ઈલોજી કંહદ્વારી' માં આ સિધ્યાંત વિશે સમજુતી આપી હતી.

તેમના માટે નફો સંયુક્ત મૂડી કંપનીઓ જે જોખમ વહોરે છે તેના બદલામાં પ્રામ થાય છે. એટલે કે સંયુક્ત મૂડી કંપનીનાં નિયોજકો માત્ર જોખમ ઉઠાવે છે, પરંતુ તેઓ જોખમ ઉઠાવવાને બદલે અન્ય કાર્યો પણ કરી શકે છે, પરંતુ તેઓ જોખમ ઉઠાવી ને વ્યવસાયને આગળ વધારવાનું પસંદ કરે છે તેથી જોખમની બદલા-કમાડી નફો છે.

સંયુક્ત મૂડી કંપનીઓ જ્યારે ધંધો વ્યવસાયમાં રોકાણ કરે છે ત્યારે અનેક અને અસંખ્ય પ્રકારનાં જોખમો ઉઠાવે છે. જેમ કે ગ્રાહકની અભિરૂચી બદલાવાને કારણો માંગમાં ઘટાડો થવો, મૂંગામાથે લીધે ડિમતમાં વધારો થવો, વેપાર ચકમાં પરિવર્તનો આવવા વાગે.

આમ, પ્રો. હોલી માને છે કે જે ધંધા વ્યવસાયમાં જોખમ નું પ્રમાણ વધારે તેમ નફાનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે.

પ્રો. હોલી માને છે કે નફો અને જોખમ કારણ-પરિણામ દર્શક સંબંધ દર્શાવે છે. જોખમ ઉઠાવવું કારણ હોયતો નફો તેનું પરિણામ છે અને જો નફો કારણ હોય તો જોખમ તેનું પરિણામ હોઈ શકે છે.

### સંયુક્ત મૂડી કંપનીનું મૂડી રોકાણ :-

આધુનિક યુગમાં ઘણી બધી સંયુક્ત મૂડી કંપનીઓ જોખમ સામે વીમા રૂપે રક્ષણ મેળવે છે અને નફો મેળવે છે, તેથી વધારે મૂડી રોકાણે કરવાથી પણ નફો પ્રામ કરી શકાય છે.

### ટીકાઓ :-

- ૧) ધંધા વ્યવસાય અને ઉદ્યોગોમાં જોખમ વહિવટ હોવા છતાં પણ નફો મેળવવામાં આવે છે.
- ૨) પ્રો. નાઈટ જણાવે છે કે અનિશ્ચિત જોખમો કે જે વીમા રૂપે ટાળી કે ઓછા કરી શકતા નથી તેવા જોખમોનું વળતર નફો છે.
- ૩) પ્રો. કાર્વર નાં શબ્દોમાં કહીએ તો નિયોજકને જોખમ ઉઠાવવાનું નહીં પણ પોતાની કાર્યક્ષમતાનો બુધ્ધિપૂર્વક ઉપયોગ કરીને જોખમ ઘટાડવાનું વળતર નફારૂપે પ્રામ થાય છે.

### પ્રકરણ સારાંશ :- ચાવી રૂપ શબ્દો :-

- ૧) પ્રસ્તાવના :- ઉત્પાદનનાં સાધનો અને આર્થિક પ્રવૃત્તિઓ, ઉત્પાદનનાં સાધનોને પ્રામથી બદલા કમાડી.
- ૨) નફો શા માટે ? :- નફો નિયોજકની બુધ્ધિક્ષમતા, તર્કબધ્યતા, જોખમ, અનિશ્ચિતતાઓ, ને લીધે પ્રામ થાય છે. તે માત્ર મૂડી સાહસિક/નિયોજકને જોખમ ઉઠાવવાનું નહીં પણ પોતાની કાર્યક્ષમતાનો બુધ્ધિપૂર્વક.
- ૩) નફાનાં લક્ષણો :- અચોક્કસ, ફેરફાર જન્ય, અધિશેષ, અનિશ્ચિત તેમજ નકારાત્મક પણ હોઈ શકે છે.
- ૪) નફાનાં લક્ષણો :- અર્થશાસ્ત્રી એફ.આ.વોકર, જે.બી.કલાર્ક, એફ.બી.હોલી, ફેક નાઈટ, જી.જી.સ્ટીગલર, શ્રીમતી જોન રોબીન્સન.
- ૫) નફાનો અર્થ :- નફો સતત ચાલતી પ્રક્રિયા – જોખમ અને અનિશ્ચિતતા ઉઠાવવા બદલ, સંશોધન અને કુશળતા કરવા માટેનું નિયોજકનું વળતર છે.
- ૬) નફો ઉદ્ભવવાનાં કારણો :- ઈજારાશાહી, પરિવર્તનો, સંશોધનો, કુશળતા અને જોખમનું સંયોજન, અનિશ્ચિતતાઓ ઉઠાવવાનું પરિણામ.
- ૭) નફાનાં પ્રકારો :- નફાનાં બે પ્રકારો :- ૧) કાચો નફો અને શુધ્ય નફો. ૨) સાધારણ નફો અને અસાધારણ નફો.
  - ૧) કાચો નફો :- કુલ આવક-કુલ ખર્ચ
  - ૨) શુધ્ય નફો :- કાચો નફો – વ્યવસ્થાપનનું વળતર-મૂડીનું વ્યાજ-જમીનનું ભાંસું-ધસારા ખર્ચ.

- ૩) સાધારણ નફો :- પોતાનાં ધંધામાં આપેલ નિયોજકીય સેવા અને અન્ય કોઈનાં ધંધામાં આપેલ નિયોજકીય સેવાનું વળતર નો તફાવત.
- ૪) અસાધારણ નફો :- ઈજારા કે કિમત વધારાને કારણે પ્રામ થતો નફો.
- ૮) નફો અને અન્ય સાધનોની આવક :-  
ઉત્પાદનનાં ચાર સાધનો :- જમીન, મૂડી, શ્રમ, નિયોજક  
તેમને મળતું વળતર :- ભાડું, વ્યાજ, વેતન, નફો
- ૯) નફાનાં સિધ્યાંતો :-
- ૧) ગતિશીલ અર્થતંત્ર અને નફો :- જે.બી.કલાર્ક, અર્થતંત્ર હંમેશા ગતિશીલ, માંગ અને પુરવણાની અસ્થિરતા, કિમત અસ્થિરતા, ખર્ચમાં ફેરફાર, આંતરીક અને બાહ્ય પરિવર્તનો, નફો, સિધ્યાંતની ટીકાઓ.
  - ૨) નફાનાં નવ પરિવર્તનનો સિધ્યાંતો :- જોસેફ શુભ્પીટર, નવી ચીજ-વસ્તુનું ઉત્પાદન, નવી ઉત્પાદન પણતિ નવું બજાર, કાચામાલનાં નવા ખોત, ઉત્પાદન એકમનું માળખું, નફો સિધ્યાંતની ટીકાઓ
  - ૩) સંયુક્ત મૂડીકંપની અને નફો :- એફ.બી.હોલી, જોખમ, વીમા રૂપે રક્ષણ, જોખમ ઘટાડવાનું વળતર નફો, સિધ્યાંતની ટીકાઓ.

#### સ્વાધ્યાય :-

- પ્રશ્ન :- ૧ નફો એટલે શુ ? તે અન્ય ઉત્પાદનનાં સાધનોથી કેવી રીતે અલગ પડે છે.?
- પ્રશ્ન :- ૨ નફાની વિવિધ વ્યાખ્યાઓ સમજાવો.
- પ્રશ્ન :- ૩ નફાનાં લક્ષણો વિગતે ચર્ચો
- પ્રશ્ન :- ૪ નફો ઉદ્ભવવાનાં કારણોની વિગતે સમજૃતી આપો.
- પ્રશ્ન :- ૫ નફાનાં પ્રકારો વિશે ટૂંકનોંધ લાખો.
- પ્રશ્ન :- ૬ ગતિશીલ અર્થતંત્ર અને નફાનો સિધ્યાંત સમજાવો.
- પ્રશ્ન :- ૭ નફાનાં નવ પરિવર્તનનો સિધ્યાંત સમજાવો.
- પ્રશ્ન :- ૮ સંયુક્ત મૂડી કંપની અને નફાનો સિધ્યાંત સમજાવો.

#### ટેકા પ્રશ્નો :-

- પ્રશ્ન :- ૧ નફો એટલે શુ ?
- પ્રશ્ન :- ૨ નિયોજકને તેની કામગીરી બદલ શું મળે ?
- પ્રશ્ન :- ૩ નફો ઉત્પાદનનાં ક્યાં સાધનને મળે છે ?
- પ્રશ્ન :- ૪ કાચો નફો કેવી રીતે મેળવી શકાય ?
- પ્રશ્ન :- ૫ શુદ્ધ નફો એટલે શું ?
- પ્રશ્ન :- ૬ ક્યા અર્થશાસ્ત્રીએ ગતિશીલ અર્થતંત્ર અને નફાનો સિધ્યાંત આપ્યો છે ?
- પ્રશ્ન :- ૭ ક્યા અર્થશાસ્ત્રીએ નફાનાં પરિવર્તનનો સિધ્યાંત આપ્યો છે ?
- પ્રશ્ન :- ૮ ક્યા અર્થશાસ્ત્રીએ સંયુક્ત મૂડી કંપની અને નફાનો સિધ્યાંત આપ્યો છે ?
- પ્રશ્ન :- ૯ નફાનાં લક્ષણો જણાવો.
- પ્રશ્ન :- ૧૦ નફાને કુલ કેટલા પ્રકારમાં વેહેચી શકાય ? ક્યા ક્યા ?

### હેતુલક્ષી પ્રશ્નો :-

૧) ઉત્પાદનનાં કુલ \_\_\_\_\_ સાધનો હોય છે.

(અ) એક (બ) ચાર (ક) ત્રણ (ડ) બે

જવાબ : (બ) ચાર

૨) નફો \_\_\_\_\_ ને પ્રામ થાય છે ?

(અ) જમીન (બ) મૂડી (ક) નિયોજક (ડ) શ્રમ

જવાબ : (ક) નિયોજક

૩) નફો અન્ય સાધનોની આવક કરતાં વધારે \_\_\_\_\_ હોય છે.

(અ) અસ્થિર (બ) સ્થિર (ક) સમતોલ (ડ) ઉપરોક્ત માંથી એક પણ નહિ.

જવાબ : (અ) અસ્થિર

૪) શુધ્ય નફો હંમેશા કાચા નર્દા કરતાં \_\_\_\_\_ જ હોય છે.

(અ) વધારે (બ) બરાબર (ક) સ્થિર (ડ) ઓછો

જવાબ : (ડ) ઓછો

૫) નફાનો ગતિશીલતાનો સિધ્યાંત \_\_\_\_\_ નામનાં અર્થશાસ્ત્રીઓ આપ્યો હતો.

(અ) એકમ સ્થિર (બ) હોલી (ક) જે.બી.કલાર્ક (ડ) નાઈટ

જવાબ : (ક) જે.બી.કલાર્ક

૬) ગ્રાહકની અભિરુચી, માંગ, વસ્તી, ઉત્પાદન ખર્ચ માં થતો ફેરફાર \_\_\_\_\_ ને જન્મ આપે છે.

(અ) ભાડું (બ) નફો (ક) વ્યાજ (ડ) વેતન

જવાબ : (બ) નફો

૭) પરિવર્તનો અને નફાનો સિધ્યાંત \_\_\_\_\_ નામનાં અર્થશાસ્ત્રીએ આપ્યો હતો.

(અ) જે.બી.કલાર્ક (બ) નાઈટ (ક) કેઈન્સ (ડ) શુમ્પીટર

જવાબ : (ડ) શુમ્પીટર

૮) શુમ્પીટરનાં મટે નવા સંશોધનોને કારણે જે \_\_\_\_\_ ઉદ્ભવે છે તેનાથી નફો ઉત્પન્ન થાય છે.

(અ) ફેરફાર (બ) સંશોધનો (ક) ભાડું (ડ) પરિવર્તનો.

જવાબ : (ડ) પરિવર્તનો

૯) સંયુક્ત મૂડીકંપની અને નફોનો ઘ્યાલ \_\_\_\_\_ એ આવ્યો હતો.

(અ) નાઈટ (બ) જે.બી.કલાર્ક (ક) એફ.બી.હોલી (ડ) શુમ્પીટર

જવાબ : (ક) એફ.બી.હોલી

૧૦) \_\_\_\_\_ નાં માટે નફો ઉદ્ભવવાનું કારણ જોખમો છે.

(અ) એફ.બી.હોલી (બ) જે.બી.કલાર્ક (ક) એકમ સ્થિર (ડ) નાઈટ

જવાબ : (ક) એકમ સ્થિર

યુનિટ 13	કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર
-------------	-------------------------

## : રૂપરેખા :

- 13.0 પ્રસ્તાવના**
- 13.1 ઉદ્દેશો**
- 13.2 કલ્યાણલક્ષી/કલ્યાણકારી અર્થશાસ્ત્રનો અર્થ**
  - 13.2.1 વ્યક્તિગત કલ્યાણ અને સામાજિક કલ્યાણ**
- 13.3 કલ્યાણકારી અર્થશાસ્ત્ર અને મૂલ્યનિર્ણયો**
- 13.4 પ્રશિષ્ઠ વિચારધારાઓ**
  - 13.4.1 પિગુનું કલ્યાણલક્ષણી અર્થશાસ્ત્ર**
  - 13.4.2 પેરેટોનો ઈષ્ટ અવસ્થાનો સિદ્ધાંત**
- 13.5 બાધ્ય અસરો**
  - 13.5.1 ઉત્પાદનની બાધ્ય અસરો**
  - 13.5.2 ઉપભોગની બાધ્ય અસરો**
- 13.6 નવપ્રશિષ્ઠ અર્થશાસ્ત્રી**
  - 13.6.1 વળતરનો સિદ્ધાંત**
  - 13.6.2 સિટોવ્સકી કોયડો**
- 13.7 કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રનું મહત્વ**
- 13.8 સારાંશ**
- ચારી રૂપ શબ્દો
- તમારી પ્રગતિ ચકાસો
- સ્વાધ્યાય

**13.1 પ્રસ્તાવના**

કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં મૂલ્ય કે ડિંમત કરતાં આર્થિક કલ્યાણ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રનો વિકાસ સમાજનું આર્થિક કલ્યાણ વધારવા માટેની આર્થિક નીતિઓની શોધમાંથી થયો છે. મહત્તમ સામાજિક કલ્યાણનાં માપદંડ દ્વારા અર્થકારણની કાર્યક્રમતાનું વિશ્લેષણ કરવામાં આવે છે. આ અર્થશાસ્ત્રના વિકાસમાં પ્રો. માર્શલ, પ્રો. પીગુ, સ્કીટોવર્સ્કી, સેમ્યુલસન, જે.આર. હિક્સ, કાલ્ડોર, પેરેટો, નટ વિકસેલ વગેરેનો સમાવેશ થાય છે.

અર્થશાસ્ત્ર એક વાસ્તવદર્શી વિજ્ઞાન છે અને તેથી વાસ્તવદર્શી અર્થશાસ્ત્રમાં કઈ આર્થિક સ્થિતિ સમાજ માટે ઈચ્છનીય છે, તે અંગેમાં વિધાનોની ચર્ચા હોઈ શકે નહીં. પરંતુ અર્થશાસ્ત્રની એક એવી શાખાનો વિકાસ થયો છે જેમાં વૈકલ્પિક આર્થિક પરિસ્થિતિઓ પૈકી કઈ પરિસ્થિતિ સમાજનાં હિતમાં છે તે દર્શાવવા માટેની વૈજ્ઞાનિક કસોટીઓ રજૂ

કરે છે. તેનો મુખ્ય હેતુ સમાજનું આર્થિક કલ્યાણ વધારવાનો છે. તેને આપણે આદર્શલકી અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ.

કલ્યાણકારી અર્થશાસ્ત્રમાં રજૂ થતાં વિધાનોની કસોટી કરવી મુશ્કેલ છે. જેમ કે વસ્તુની કિંમત ઘટતાં, અમુક સંજોગોમાં, માંગ વધે છે. એ વિધાનની યથાર્થતા બજારની માહિતીનાં આધારે ચકાસી શકાય છે. દા.ત., અનાજનાં ભાવો ઘટવાથી લોકોની આર્થિક સુખાકારી (કલ્યાણ) વધે છે. ભાવો ઘટવાથી અનાજ વાપરનારા લોકોનાં કલ્યાણમાં અવશ્ય વધારો થાય છે. પરંતુ અનાજ ઉત્પાદક બેડૂતને કિંમત ઘટવાથી નુકસાન થશે. જે તેનાં કલ્યાણને ઘટાડે છે. આ બે સ્થિતિ એક કલ્યાણ વધારે છે તો બીજી સ્થિતિ કલ્યાણ ઘટાડે છે. આ બે સ્થિતિમાંથી કઈ સ્થિતિ સમગ્ર સમાજનાં કલ્યાણમાં વધારો કરશે? કેવી રીતે કરશે? અને તેને કેવી રીતે જાણવું? એ માટે બજારની માંગ અને માંગની જેમ લોકોનું આર્થિક કલ્યાણ જુદા જુદા અર્થશાસ્ત્રીઓ દ્વારા માપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

### 13.1 ઉદ્દેશો :

1. કલ્યાણલકી અર્થશાસ્ત્રનો ખ્યાલ સમજાવો.
2. આર્થિક કલ્યાણ અને કુલ કલ્યાણ વચ્ચેનો ભેદ તપાસવો.
3. કલ્યાણલકી અર્થશાસ્ત્ર મૂલ્યનિર્ણયોનું મહત્વ તપાસવું.
4. કલ્યાણલકી અર્થશાસ્ત્ર વિવિધ કસોટીનો અભ્યાસ કરવો.
5. કલ્યાણકારી અર્થશાસ્ત્રનું મહત્વ જાણવું.

### 13.2 કલ્યાણલકી અર્થશાસ્ત્રની વિભાવના :

1. પ્રો. રેડર : “કલ્યાણલકી અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રની એવી શાખા છે. જે આર્થિક નીતિઓના માટે ઔચિત્યનાં માપદંડની સ્થાપના તથા પ્રયોગ કરવાનો પ્રયત્ન કરે છે.” સામાજિક અને આર્થિક સુધારા માટેનાં સમૃદ્ધિનાં માપદંડોને આર્થિકનીતિઓનું ઘડતર કરવું.
2. પ્રો. ઓસ્કર લૈગ : “કલ્યાણકારી અર્થશાસ્ત્ર એ બાબતો સાથે સંબંધ ધરાવે છે કે કોઈ એક સમાજનાં કલ્યાણને નક્કી કરે છે.”
3. પ્રો. સ્કીટોવર્સ્કી : “કલ્યાણકારી અર્થશાસ્ત્ર આર્થિક સિદ્ધાંતનું એક અંગ છે જે મુખ્યત્વે નીતિ સાથે સંબંધ ધરાવે છે.”

#### 13.2.1 વ્યક્તિગત કલ્યાણ અને સામાજિક કલ્યાણ :

જો વ્યક્તિ A વસ્તુની સરખામણીમાં B ને પસંદ કરે, તો તેને B માંથી વધારે સંતોષ મળે છે તેમ કહી શકાય એટલે કે, વ્યક્તિનું કલ્યાણ તેને ઉપભોગ દ્વારા પ્રાપ્ત થતા સંતોષ પર છે. તે આત્મલકી બાબત છે. પરંતુ વ્યક્તિ દ્વારા થતી પસંદગી દ્વારા તેને શામાંથી વધારે સંતોષ મળે છે. તે જાણી શકાય છે.

કલ્યાણકારી અર્થશાસ્ત્રમાં વ્યક્તિગત કલ્યાણની ચર્ચા થતી નથી પરંતુ સામાજિક કલ્યાણની ચર્ચા થાય છે. તેથી આ સંદર્ભમાં જોઈએ તો કલ્યાણલકી અર્થશાસ્ત્રીએ મૂળભૂત રીતે સામાજિક કલ્યાણનું અર્થશાસ્ત્ર છે. વ્યક્તિ પોતાનો તુષ્ટિગુણ કલ્યાણને માપવાનો કોઈ ચોક્કસ વૈજ્ઞાનિક માપદંડ નથી.

પ્રો. પીગુનાં મત મુજબ “કલ્યાણ એ માનસિક અવસ્થા છે.” જો બીજા શબ્દોમાં કહીએ તો કલ્યાણનું તત્ત્વ એ સભાનતાની પરિસ્થિતિ છે.

વ્યક્તિલક્ષી કલ્યાણની પરિસ્થિતિને અનેક આર્થિક અને બિનઆર્થિક પરિબળો અસર કરે છે. જ્યારે સામાજિક કલ્યાણ એ સમગ્ર સમાજનાં કલ્યાણ સાથે સંકળાયેલ બાબત છે. જ્યારે બધી વ્યક્તિઓ તેઓની જરૂરિયાતો સંતોષવા માટે અરસપરસ સહકાર સાથે અથવા મદદ કરે તો તેને સામાજિક પ્રક્રિયા કહી શકાય.

સમાજ કલ્યાણ એટલે સામાજિક જરૂરિયાતોનો સંતોષ, જો બીજા શબ્દોમાં કહીએ તો સમાજની બધી જ વ્યક્તિઓના કુલ સંતોષનો કુલ સરવાળો.

સમગ્ર સમાજ એક વ્યક્તિની જેમ વિચારી શકતો નથી. વ્યક્તિ જે રીતે સંતોષ અંગે વિચાર કરીને બુદ્ધિપૂર્વકનો નિશ્ચય લેતે રીતે સમાજ લઈ શકે નહીં. તેનું કારણ એ છે કે સમાજ અસંખ્ય વ્યક્તિઓનો બનેલો છે. જેમનાં હિતો પરસ્પર વિરોધી પણ હોઈ શકે. સામાન્ય રીતે સામાજિક પસંદગી વ્યક્તિઓની પસંદગીઓનાં આધારે તારવવામાં આવે છે. પણ જો પસંદગી સર્વાનુભતે ન થયેલી હોય તો તે આધારભૂત કેવી રીતે ગણી શકાય? સામાજિક કલ્યાણની હીએ સપાટી માટેની શરતોનો નિર્દેશ કરવાનાં પ્રયાસો પેરોટો બર્ગસન અને અન્ય અર્થશાસ્ત્રીઓએ કર્યા છે. પરંતુ મુખ્ય સમસ્યા આંતરવૈયક્તિક સરખામણીની છે.

આમ, જો આંતરવૈયક્તિક સંતોષની સરખામણી થઈ શકે તેમ ન હોય તો સમાજનાં આર્થિક કલ્યાણમાં વધારો કે ઘટાડો થયો છે તે કેવી રીતે જાણી શકાય?

### 13.3 કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર અને મૂલ્યનિર્ણયો :

કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં સમાજનાં આર્થિક કલ્યાણમાં થતા વધારા કે ઘટાડા માટેની સ્વીકાર્ય કસોટીઓ રજૂ કરવાનો પ્રયત્ન થાય છે. વ્યક્તિઓના કલ્યાણનાં આધારે સામાજિક કલ્યાણ તારવવામાં આવે છે પરંતુ સામાજિક કલ્યાણ તારવવાની આ પ્રક્રિયામાં ‘મૂલ્યનિર્ણયો’નો આશ્રય લેવો પડે છે. નોંબેલ પ્રાઇઝ વિજેતા અર્થશાસ્ત્રી અમત્યસેન મૂલ્યનિર્ધારણના મહત્વને સ્વીકારે છે.

‘મૂલ્યનિર્ણયો’ એ કેટલાંક સ્વિકૃત વિધાનો છે. આ વિધાનો હકીકતોને એવી રીતે વર્ણવે છે કે જેથી લોકોનું તે હકીકતો તરફનું વલણ બદલાઈ જાય છે અને તેથી લોકોનાં વર્તન પર પ્રભાવ પડે છે. બુદ્ધિ કરતાં વધારે તે લાગણીને સ્પર્શતાં વિધાનો હોય છે. તેમને નીતિશાસ્ત્ર કે સારાનરસાનાં ઘાલો સાથે સંબંધ હોય છે. આવા મૂલ્યનિર્ણયો વગર કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર ટકી શકે નહીં.

આજે ઘણાં અર્થશાસ્ત્રીઓ કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં ‘મૂલ્ય નિર્ણયો’ને આવશ્યક જ નહીં, અનિવાર્ય માને છે. કોઈનાં પણ સંતોષમાં ઘટાડો કર્યા વગર જો એકનાં સંતોષમાં વધારો થઈ શકે તો તે સારી બાબત છે.’ આ એક મૂલ્યનિર્ધારણ છે. આના માટે કોઈ સાબિતી નથી.

### 13.4 કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર અંગે પ્રશ્ન વિચારધારાઓ :

પ્રો. એડમ સ્મિથ, ડેવિડ રિકાર્ડો, જહોન સુઅર્ટ ગિલ જેવા અર્થશાસ્ત્રીઓના મતે ભૌતિક સંપત્તિનું સર્જન કરવા માટે કુદરત સામે માનવીનાં પ્રયાસોનું યુદ્ધ એટલે જ કોઈપણ સમાજનો પ્રશ્ન. એડમ સ્મિથનાં લખાણોમાંથી એ સ્પષ્ટ થાય છે કે તે આર્થિક કલ્યાણ

માટે કુલ ઉત્પાદનને માપદંડ માને છે. દેશમાં જેમ જેમ ઉત્પાદન વધતું હોય તેમ તે દેશ સમૃદ્ધ અને તે દેશનાં લોકોનું કલ્યાણ વધારવામાં મદદરૂપ થાય છે. ઉત્પાદન વધારવા માટે શ્રમની ભૌતિક ઉત્પાદકતા વધારવાનાં નીતિવિષયક સૂચનો આપણાને જોવા મળે છે. આર્થિક પ્રવૃત્તિમાં સતત વધારો કરવા માટે એડમ સ્મિથ મુક્ત અર્થતંત્રની હિમાયત કરે છે. તેનું કારણ તે છે કે આમ કરવાથી વ્યક્તિને બચત, મૂડીરોકાણ અને પરિશ્રમ કરવા માટે ગ્રોસ્સાઇન મળી શકે છે.

પ્રશિષ્ટ વિચારધારામાં જેવોન્સ, વોલરાસ મેન્જર વગેરેએ ‘તુષ્ટિગુણ વિશ્લેષણ’ દાખલ કર્યું. આ વિશ્લેષણનો પાછળથી માશલી વ્યાપક ઉપયોગ કર્યો. સંપત્તિનાં ભૌતિક ઘ્યાલના સ્થાને તેમણે ઉપભોક્તાઓને જરૂરિયાતોનાં સંતોષનો ઘ્યાલ રજૂ કર્યો. તેઓ માનતા કે સંતોષને નાણાંનાં માપદંડથી માપી શકાય છે. એક સફરજન ખાવાથી કેટલો તુષ્ટિગુણ મળે તે દર્શાવાનો પ્રયત્ન થયો. આના લીધે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની ચર્ચા ભૌતિક સપાટી પરથી વ્યક્તિગત સંતોષની સપાટી પર આવી અને સંતોષની ઈષ્ટ સપાટીની શોધ શરૂ થઈ. સામાજિક કલ્યાણ વધારવા વિશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ નીચેના ઉપાયો દર્શાવ્યા છે. (1) અર્થતંત્રમાં મુક્ત હરીફાઈ હોય તો બચત અને મૂડી રોકાણ વધે અને તેથી ઉત્પાદન વધે. (2) ડૉ. મીન્ટના મતે મૂડીસંચયને વેગ આપવાથી શ્રમની ભૌતિક ઉત્પાદકતા વધે છે.

#### 13.4.1 પીગુનું કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર :

નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓમાં કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની ચર્ચા કરનારમાં પ્રો. પીગુનું સ્થાન મોખરે છે. તેઓના મતે પ્રત્યેક માણસનું કલ્યાણ આર્થિક, સામાજિક, રાજકીય વગેરે પરિબળોથી સાધી શકાય છે. તેઓ માને છે કે દરેક વ્યક્તિ તેને મળતા સંતોષ કે તુષ્ટિગુણને મહત્તમ બનાવવાનો પ્રયાસ કરે છે. પ્રો. પીગુ સંઘ્યાવાચક તુષ્ટિગુણનાં ઘ્યાલને સ્વીકારતા નથી. પણ ગુણવાચક તુષ્ટિગુણને સ્વીકારે છે. આ માટે તેમની એક ધારણા છે કે સરખી વાસ્તવિક આવક ધરાવતી અલગ અલગ વ્યક્તિ સરખો સંતોષ અનુભવે છે. આનો અર્થ એવો થાય છે કે જેમની વાસ્તવિક આવક વધારે છે તે ઓછી આવકવાળા કરતાં વધારે સંતોષ અનુભવશે. શ્રીમંતો પાસેથી આવક લઈને ગરીબો વચ્ચે વહેંચવાથી કુલ સામાજિક કલ્યાણમાં વધારો થશે. આમ, પીગુની ધારણામાંથી આવકની પુનઃવહેંચણીને લગતી નીતિનું તારણ કાઢી શકાય.

જો વાસ્તવિક આવક અસંખ્ય બિન્ન બિન્ન વસ્તુઓની બનેલી હોય, તો એક વ્યક્તિની વાસ્તવિક આવકની સરખામણી અન્ય વ્યક્તિની વાસ્તવિક આવક સાથે થઈ શકે નહીં. તેથી તેઓ વાસ્તવિક આવકને નાણાંકીય મૂલ્યમાં દર્શાવે છે. નાણાંકીય આવકની સરખામણી કરે છે. પીગુની ધારણા પ્રમાણે નાણાંકીય આવકની પુનઃવહેંચણી કરી સંપૂર્ણ સરખી આવક પ્રાપ્ત કરવાથી જ મહત્તમ સામાજિક કલ્યાણ પ્રાપ્ત થાય છે. દરેક વ્યક્તિની નાણાંકીય આવક સરખી થતાં નાણાંનો સીમાન્ત તુષ્ટિગુણ સરખો થઈ જશે અને તે સ્થિતિમાં મહત્તમ સામાજિક કલ્યાણ પ્રાપ્ત થશે.

પીગુના આવકની પુનઃવહેંચણીનાં અમલથી સમાજની ઉત્પાદનશક્તિ પર વિપરીત અસર કરે અને કુલ ઉત્પાદનમાં ઘટાડો થાય તો કુલ સામાજિક કલ્યાણમાં વધારો થયો એમ કેવી રીતે કહી શકાય? આ પ્રશ્ન ‘ઉત્પાદન વિરુદ્ધ’ વહેંચણીને લગતો છે. જો વ્યક્તિની કમાયેલી આવકનો મોટોભાગ કરવેરા દ્વારા સરકાર લઈ લે અને તેનો ઉપયોગ ગરીબોના વિકાસ માટે

કરે તો સમાજિક કલ્યાણ વધે ખરું? પણ આ આવક પરિવર્તનને કારણે રાખ્યી પેદાશમાં ઘટાડો થાય તો લાંબાગાળે તે લાભદાયી બની શકે નહીં. પ્રો. પીગુ જાણાવે છે કે આવકની પુનઃવહેંચણીનો અમલ એવી રીતે થવો જોઈએ કે કુલ રાખ્યી ઉત્પાદન પર વિપરીત અસર થાય નહીં અને સામાજિક કલ્યાણ મહત્તમ બની શકે. પીગુની ‘માનવીની સરખો સંતોષ મેળવવાની શક્તિની ધારણા વૈજ્ઞાનિક નથી પણ એક મૂલ્યનિષ્ઠય છે.’ એવી ટીકા રોબિન્સ નામના અર્થશાસ્ત્રી દ્વારા કરાઈ છે. આમ, છતાં નીતિના ઘડતર માટેના માર્ગદર્શક સિદ્ધાંતો દર્શાવતા વૈજ્ઞાનિક અભ્યાસ તરીકે પ્રો. પીગુના કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રનું મહત્વ આધુનિક અર્થશાસ્ત્રી સ્વીકારતા નથી.

#### 13.4.2 પેરેટોનાં ઈષ અવસ્થાનો સિદ્ધાંત :

પેરેટોએ પોતાના સિદ્ધાંતમાં તુષ્ટિગુણને નાણાના માધ્યમથી માપી શકાય છે તે ધારણાનો ત્યાગ કરી તટસ્થ રેખા દ્વારા માત્ર સરખામણી કરી શકાય તેમ માને છે. પેરેટોના મત મુજબ, “કોઈ સમાજમાં સીમાંત શરતોનું પાલન થાય તો સમાજ ઈષ અવસ્થાએ પહોંચે અને ઈષ અવસ્થાએ રાખ્યાનું ઉત્પાદન મહત્તમ હોય છે માટે સમાજનું કલ્યાણ સિદ્ધ થાય છે. તેમ કહી શકાય.”


#### સમાજની ઈષ અવસ્થાનો ખ્યાલ

પેરેટોના મતે “ઈષ સંતોષ એક એવી સપાટી છે. જ્યાં સમાજની કોઈ એક વ્યક્તિનાં સંતોષમાં ઘટાડો કર્યા સિવાય અન્ય વ્યક્તિનાં સંતોષમાં વધારો કરી શકાય નહીં.” બીજી રીતે કહીએ તો સાધન ફાળવણીમાં ફરજાર કરીને એક વ્યક્તિ કે સમુહને વધારે સારી સ્થિતિમાં લઈ જતાં અન્ય વ્યક્તિ કે સમુહને વધારે ખરાબ સ્થિતિમાં મૂકવો પડે.

આમ, પેરેટોની ઈષ સપાટી સમાજ માટે સંતોષની સર્વોચ્ચ સપાટી છે. પેરેટોનાં મતે “કોઈ વ્યક્તિ પોતાને પસંદ હોય તેવી સ્થિતિએ જાય છે. ત્યારે અન્ય વ્યક્તિઓને તેની ઓછી પસંદગીની સ્થિતિએ ખસેડ્યા વિના જઈ શકતી નથી. આવી સ્થિતિને સમાજની ઈષ અવસ્થા કહેવામાં આવે છે.” ટૂંકમાં સમાજની ઈષ અવસ્થા પ્રાપ્ત થઈ ગયા પછી કોઈ પણ વ્યક્તિ અન્ય વ્યક્તિનાં સંતોષના ભોગે જ વધુ સંતોષ પ્રાપ્ત કરે છે. પેરેટોની ઈષ સપાટી એક જ હોય તેવું નથી. મહત્તમ સંતોષ દર્શાવતી જુદી જુદી અનેક ઈષ સપાટી હોઈ શકે. આ દરેક સપાટીએ સમાજને પ્રાપ્ત થતો સંતોષ મહત્તમ હોય, પણ સરખો જ હોય એવું નહીં. આ જુદી જુદી સપાટીઓ વચ્ચેની સરખામણી શક્ય નથી, કારણ કે પેરેટોએ આંતરવૈયક્તિક સરખામણીનો પ્રશ્ન ટાયો છે. આથી જ કોઈ એક અને અદ્વિતીય સામાજિક કલ્યાણની ઈષ સપાટી પેરેટોની શરત દ્વારા દર્શાવી શકતી નથી. પેરેટોની બિન્ન બિન્ન ઈષ સપાટીઓ જુદી જુદી આવકવહેંચણી સાથે સંકળાયેલી છે.

પેરેટોનાં ખ્યાલમાં રહેલો નૈતિક મૂલ્યનિષ્ઠય એ છે કે આપેલી વહેંચણીની સ્થિતિમાં કોઈનેથી નુકસાન કર્યા સિવાય જો એક પણ વ્યક્તિનું કલ્યાણ વધારી શકતું હોય તો તે ઈષનીય છે. એવી સ્થિતિએ પહોંચી જવાય અથવા જ્યારે આમ કરતું અશક્ય બને ત્યારે તેવી ઈષ સંતોષની સપાટી ગણાય.

એજવર્થ બાઉલીનાં બોક્સ ડાયેગ્રામની મદદથી પેરેટોનો ઈધતમ અવસ્થાનો સિદ્ધાંત સમજાવવામાં આવ્યો છે.



આકૃતિમાં જાડી રેખાઓ D1 વ્યક્તિની X અને Y ની સમપેક્ષતા રેખા દર્શાવે છે. આકૃતિમાં ગુટક રેખાઓ D2 વ્યક્તિની સમપેક્ષતાની રેખાઓ દર્શાવે છે.

D1 અને D2 ની રેખાઓ એકબીજાને સ્પર્શ તે રીતે આલેખ ગોઠવવામાં આવ્યો છે. આ તમામ બિંદુઓને જોડતાં SS1 રેખા માપન થાય છે. જે એજવર્થનાં Contract તરીકે ઓળખવામાં આવે છે. સ્પર્શબિંદુઓ આગળ D1 અને D2 નો સીમાંત અવેજ્ઞનો દર સરખો હોવાથી Contract Curve વિનિમયની દર્શાવે ઈધ સ્થિતિનો નિર્દેશ કરે છે. Contract Curve સિવાયનાં અન્ય બિંદુએ હોય તો બે વ્યક્તિઓનો સીમાંત અવેજ્ઞનો દર સરખો હોવાથી તે ઈધ સ્થિતિ નથી. વિનિમય દ્વારા તે ઈધ સ્થિતિએ જઈ શકે છે. આકૃતિમાં D1, X, D2, Y ચોરસ એ D1 અને D2 બે વ્યક્તિઓ પાસેની X અને Y બે વસ્તુઓનું કુલ પ્રમાણ દર્શાવે છે.

ધારોકે શરૂઆતમાં D1 અને D2 બંને વ્યક્તિઓ K બિંદુએ છે. D1 વ્યક્તિ પાસે X વસ્તુનું પ્રમાણ PK જેટલું છે. અને Y વસ્તુનું પ્રમાણ JK જેટલું છે. D2 પાસે X નું પ્રમાણ KQ અને Y નું પ્રમાણ QY K બિંદુએ બંને વ્યક્તિઓનો X અને Y વસ્તુઓ માટેનો સીમાંત અવેજ્ઞનો જુદી જુદી છે. જો K થી “a” બિંદુએ વિનિમય દ્વારા જઈએ તો D1 ઊંચી સપાટીએ પહોંચે છે. જો “b” બિંદુએ જઈએ તો D2 ઊંચી સપાટીએ પહોંચે છે. જો “c” બિંદુએ જઈએ તો D1 અને D1 બંને સંતોષની જશે.

### 13.5 બાધ્ય અસરો :

(ઉત્પાદન અને ઉપભોગમાં બાધ્ય અસરો અથવા બાધ્ય લાભ અને ગેરલાભ)

પૂર્ણ હરીફાઈની સ્થિતિમાં જો દરેક વ્યક્તિની નાણાંકીય આવકમાંથી પ્રાપ્ત થતો સીમાંત તુષ્ટિગુણ સરખો હોય તો વસ્તુનો ખાનગી સીમાંત ખર્ચ અને સામાજિક સીમાંત ખર્ચ સરખા થશે અને ખાનગી સીમાંત તુષ્ટિગુણ અને સામાજિક તુષ્ટિગુણ સરખા થશે. આથી સામાજિક કલ્યાણ સર્વોચ્ચ સપાટી પર પહોંચશે. પરંતુ જો ઉત્પાદન અને અથવા ઉપભોગમાં ‘બાધ્ય અસરો’ ઉદ્ભવતી હશે તો ખાનગી સીમાંત ખર્ચ અને સામાજિક સીમાંત ખર્ચ વચ્ચે તેમજ ખાનગી સીમાંત તુષ્ટિગુણ અને સામાજિક તુષ્ટિગુણ વચ્ચે તફાવત ઉભો થશે.

‘બાધ અસરોને’ બાધ લાભ કે ગેરલાભ પણ કહે છે. તે બાધ છે, કારણ કે બજારમાં થતા મૂલ્યાંકનોમાં આવા લાભ કે ગેરલાભ ગણતરીમાં લેવાતા નથી. આપણે તેને એકમ વિકાસના લાભ કે ગેરલાભ તરીકે ભાગ્યા હતાં. જેનાં એક પેઢીની વિકાસ થવાથી તેનો લાભ અન્ય પેઢીને પણ મળે છે. આવા લાભોને નાણાંકીય મૂલ્યમાં સમાવેશ કરવામાં આવતો નથી. કારણ કે તેની ઓળખ કરવી મુશ્કેલ છે.

### 13.5.1 ઉત્પાદનની બાધ અસરો :

કોઈ એક પેઢીનાં ઉત્પાદનમાં વધારો થવાથી અન્ય પેઢીને લાભ કે ગેરલાભ થાય તેવું જોવા મળે છે. દા.ત., સફરજનની વાડીનો વિકાસ થવાથી તેની બાજુમાં આવેલા ‘મધમાખી કેન્દ્ર’નું ઉત્પાદન વધે છે. સફરજનની વાડીનો માલિક તેનાં ઉત્પાદનમાં માત્ર સફરજનનાં વધારાનાં ઉત્પાદનને જ લક્ષમાં લે છે. પણ સમાજને તો સફરજન ઉપરાંત મધનું પણ વધુ પ્રમાણમાં ઉત્પાદન મળે છે. સફરજનનાં માલિકની ખર્ચની ગણતરી વધારે થાય છે. કારણ કે પોતાના ખાનગી ખર્ચની સામે જે વધારાનું મધનું ઉત્પાદન થયું તેને તે લક્ષમાં લેતો નથી. મધમાખી કેન્દ્રનો માલિક સફરજનની વાડીનાં માલિકને કાંઈ ચૂકવણી કરતો નથી. આ ડિસ્ટ્રિક્ટમાં સફરજનનું સીમાન્ત સામાજિક ખર્ચ તેનાં સીમાન્ત ખાનગી ખર્ચ કરતા ઓછું છે. આવા ઉત્પાદનમાંથી બાધ લાભ થાય છે. તેવી જ રીતે કોઈ ફેટરીનું ઉત્પાદન વધતાં તેમાંથી નીકળતાં ઘુમાડાથી આજુબાજુનાં લોકોનાં આરોગ્ય પર પ્રતિકૂળ અસર થાય છે. આ ગેરલાભોને પેઢી તેના ખર્ચની ગણતરીમાં લેતા નથી પરિણામે તેનું ખાનગી સીમાન્ત ખર્ચ સામાજિક સીમાન્ત ખર્ચ કરતાં ઓછું જણાય છે.

### 13.5.2 ઉપભોગની બાધ અસરો :

ઉત્પાદન જેમ બાધ અસરો જોવા મળે છે તેમ ઉપભોગમાં પણ જોવા મળે છે. જેમકે પોતાના ધરની આજુબાજુમાં સુંદર બગીચો બનાવનાર વ્યક્તિના પડોશીને પણ બગીચાનો લાભ મળે છે. આ ઉપભોગને બાધ લાભ તરીકે ગણાવી શકાય. આવા ડિસ્ટ્રિક્ટમાં સીમાન્ત સામાજિક સંતોષ સીમાન્ત ખાનગી સંતોષ કરતાં વધારે હોય છે. વધારનો સંતોષ મેળવવા માટે કોઈ વધારાની કિંમત ચૂકવવી પડતી નથી. જે વસ્તુઓના કે સેવાઓનાં ઉપભોગમાંથી ‘બાધ લાભ’ થતો હોય તે વસ્તુઓ કે સેવાઓનો સામાજિક સીમાન્ત સંતોષ બજારમાં વ્યક્ત થતી કિંમતોમાં દેખાતો નથી. આવી વસ્તુઓ કે સેવાઓનું પ્રમાણમાં ઓછું મૂલ્ય અંકાય છે. જો તેમના સામાજિક સંતોષનાં ફાળાને લક્ષમાં લેવામાં આવે તો તેમનું વધારે મૂલ્ય અંકાય છે.

ઉપભોગમાં જેમ લાભો જોવા મળે છે તેમ ગેરલાભો પણ જોવા મળે છે. જેમ કે પોતાની પડોશમાં રહેતા દાર્દુદિયા કે મોટે અવાજથી રેડિયો વગાડનાર પોતાના પાડોશીઓ માટે કેવી આફત સર્જે છે તે આપણે જાણી છીએ. આવા ડિસ્ટ્રિક્ટમાં સીમાન્ત ખાનગી સંતોષ સીમાન્ત સામાજિક સંતોષ કરતાં વધારે હોય છે.

આમ, જો ઉત્પાદન અથવા ઉપભોગમાં બાધ અસરો થતી હોય તો સામાજિક કલ્યાણ મહત્તમ બનાવવા માટે સરકારી હસ્તક્ષેપ જરૂરી બને છે. પૂર્ણ હરિઝાઈની સ્થિતિમાં પણ જો ‘બાધ અસરો’ હોય તો સામાજિક કલ્યાણની ઈષ્ઠ સપાટી પ્રાપ્ત થઈ શકતી નથી. જે ઉત્પાદનનાં ક્ષેત્રમાં ‘બાધ લાભો’ થતા હોય તેમને આર્થિક સહાય અને જ્યાં ‘બાધ ગેરલાભો’ થતા હોય

તેમનાં પર કર નંખાવા જોઈએ. આમ, કરવાથી ઉત્પાદનનાં સાધનોની ફાળવણી પણ બદલાશે અને સામાજિક કલ્યાણમાં વધારો થશે.

### **13.6 નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીની વિચારધારાઓ :**

#### **13.6.1 વળતરનો સિદ્ધાંત :**

કોઈ આર્થિક ફેરફારથી અમુક વ્યક્તિઓને લાભ થતો હોય અને બીજું વ્યક્તિઓને ગેરલાભ થતો હોય તો તે ફેરફાર કરવા યોગ્ય છે કે નહીં? તે પ્રશ્નનો જવાબ પેરેટો વિશ્લેષણમાં જોવા મળતું નથી. કાલ્ડોર અને હિક્સ નામનાં અર્થશાસ્ત્રી આ સમસ્યાનાં સમાધાન માટે કેટલાક અનુમાનોનાં આધારે કસોટી રજૂ કરેલ છે. તેને આપણે વળતરનાં સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે.

#### **સિદ્ધાંતની ધારણાઓ :**

1. ઉપભોક્તાઓની અભિરૂચિ સ્થિર છે.
2. ઉત્પાદન અને ઉપભોગમાં બાધ્ય અસરોને અભાવ.
3. તુષ્ટિગુણને માપી શકાય નહીં. પણ સરખામણી કરી શકાય.
4. વ્યક્તિનું વર્તન તર્કબદ્ધ છે.
5. ઉત્પાદન અને વહેંચણીની કલ્યાણ પરની અસરો અલગ પાડી શકાય છે. અને ઉત્પાદનમાં ફેરફારની કલ્યાણ પર થતી અસરો પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

ઉપરની ધારણોનાં આધારે કાલ્ડોરે રજૂ કરેલી કસોટી નીચે મુજબ છે :

આર્થિક સ્થિતિ A, આર્થિક સ્થિતિ B કરતાં ત્યારે સુધારારૂપ ગણાય, જ્યારે A સ્થિતિમાં લાભ મેળવનારાઓ જેમને ગેરલાભ થયો હોય તેમને વળતર ચૂકવી આપ્યા પછી પણ અગાઉ કરતાં વધારે સારી સ્થિતિમાં હોય. આવા સંજોગોમાં B સ્થિતિમાંથી A સ્થિતિમાં સમાજને લઈ જવાથી સામાજિક કલ્યાણ વધી શકે.

હિક્સે રજૂ કરેલી કસોટી કાલ્ડોરની કસોટીના જેવી જ છે. પણ તે જુદી રીતે રજૂ થયેલી છે.

“આર્થિક સ્થિતિ A, આર્થિક સ્થિતિ B કરતાં ત્યારે સુધારારૂપ ગણાય, જ્યારે A સ્થિતિમાં જેમને ગેરલાભ થાય છે તેઓ જેમને લાભ થયો હોય તેમને લાંચ આપીને B સ્થિતિમાંથી A સ્થિતિમાં થતા ફેરફારને અટકાવવામાં સફળ ન થાય.”

કાલ્ડોર અને હિક્સની કસોટીઓ એક જ કસોટીના બે પાસાંઓ છે. આથી તેને આપણે કાલ્ડોર-હિક્સની કસોટી તરીકે ઓળખીએ છીએ.

આ કસોટીમાં ખરેખર ‘વળતર’ ચૂકવવાની આવશ્યકતા સ્વીકારવામાં આવી નથી. જો લાભ મેળવનારાઓ વળતર ચૂકવ્યા પછી પણ અગાઉ કરતાં સંતોષની ઊંચી સપાટી પર રહી શકતા હોય અથવા ગેરલાભ થાય છે તે લોકો લાભ મેળવનારાઓને કંઈક આપીને ફેરફારોને અટકાવવા અસમર્થ હોય ત્યારે આ ફેરફાર સુધારો સૂચવે છે.

### 13.6.2 સિટોલ્કી કોયડો :


કાલ્ડોર હિક્સ કસોટીનાં પરસ્પર વિરોધી પરિણામોનો નિર્દેશ સિટોલ્કીએ કર્યો. એવું બની શકે કે આપેલી B સ્થિતિમાંથી A સ્થિતિમાં આવવું. કાલ્ડોર હિક્સ કસોટી પ્રમાણે સુધારારૂપ ગણાય, પણ એ જ કસોટી મુજબ A સ્થિતિમાંથી B સ્થિતિમાં જવું પણ સુધારારૂપ ગણાય. આનું કારણ એ છે કે A અને B સ્થિતિમાં વાસ્તવિક આવકનું ચિત્ર બદલાઈ જશે અને વાસ્તવિક આવકની બદલાયેલ વહેંચણીની સ્થિતિમાં સાપેક્ષ મૂલ્યાંકનનો બિન્ન હશે. સિટોલ્કીએ દર્શાવ્યું કે જો ‘વળતો ફેરફાર’ પણ સુધારારૂપ ગણાતો હોય તો કાલ્ડોર હિક્સ કસોટી અધૂરી છે. આથી તેમણે કલ્યાણની દસ્તિ આર્થિક ફેરફાર સુધારારૂપ છે કે તેમ તે દર્શાવવા માટે દ્વિમુખી કસોટી રજૂ કરી.

1. કાલ્ડોર હિક્સ કસોટીનો અમલ
2. ‘વળતો ફેરફાર’નાં અમલનો ભાવ.

આને સિટોલ્કીની દ્વિમુખી કસોટી તરીકે ઓળખવામાં આવે છે. આ કસોટી મુજબ B સ્થિતિમાંથી A સ્થિતિમાં આવવું જો સુધારારૂપ હોય તો ફરીને પાછું A સ્થિતિમાંથી B સ્થિતિમાં જવાનું સુધારારૂપ ન હોઈ શકે.

#### આકૃતિ દ્વારા રજૂઆત :

પેરેટોએ રજૂ કરેલ કસોટીને સેમ્યુઅલ્સનની તુટિગાણ શક્યતા રેખા દ્વારા સંજ્ઞાવી શકાય. સમગ્ર સમાજની બધી જ વસ્તુઓ બે જ વ્યક્તિઓ કે વર્ગો વચ્ચે વહેંચાય છે. તેમ માનીને બે વ્યક્તિઓ X અને Y નાં કમવાચક તુટિગુણને અનુકૂમે X અને Y ધરી પર દર્શાવીએ. તુટિગુણ શક્યતા રેખા પરનું દરેક બિંદુ પેરેટોની ઈષ્ટ સપાટી દર્શાવે છે. બે વ્યક્તિઓ (X અને Y) નાં તુટિગુણ જુદાં જુદાં સંયોજનો સંભવી શકે.



આકૃતિમાં જોઈ શકાય છે કે જ્યારે X નો તુટિગુણ વધે ત્યારે Y નો તુટિગુણ ઘટે છે. અને Y નો તુટિગુણ વધે ત્યારે X નો તુટિગુણ ઘટે છે. બે પૈકી એકનાં તુટિગુણમાં ઘટાડો કર્યા સિવાય બીજાના તુટિગુણમાં વધારો કરી શકતો નથી. આથી તુટિગુણ શક્યતા રેખા (MN) પરનું દરેક બિંદુ પેરેટો ઈષ્ટ સપાટી દર્શાવે છે. MN રેખા પર જમણી બાજુએ ખસતાં X ને વધારે

તુણ્ણુણ મળે છે અને Y ને ઓછો, ડાબી બાજુએ ખસતાં Y ને વધારે અને X ને ઓછો તુણ્ણુણ મળે છે.

C બિંદુ MN રેખાની નીચે આપવામાં આવેલ છે. CA અને CB અનુક્રમે Y અને X ધરીને દોરેલી સમાંતર રેખાઓ છે. ધારો કે X અને Y વ્યક્તિઓ C બિંદુએ છે. C બિંદુથી ખસીને તે A બિંદુએ આવે તો શું થાય?

A બિંદુએ Y નો તુણ્ણુણ વધારે છે અને X નો તુણ્ણુણ અગાઉ જેટલો જ રહે છે. આથી C ની સરખામણીમાં A બિંદુ બન્ને વ્યક્તિઓ માટે સુધારો સૂચવે છે. આવુ જ B બિંદુ વિશે કહી શકાય. આમ, A અને B ની વચ્ચે આવેલું કોઈ પણ બિંદુ C ની સરખામણીમાં સુધારો દર્શવિ છે. આવો કોઈ પણ ફેરફાર પેરેટોની દાખિએ કલ્યાણમાં વધારો કરનાર છે. આ ફેરફાર કાર્યક્રમતા વધારનાર ફેરફાર છે.

C બિંદુએથી ખસીને X અને Y વ્યક્તિઓ D બિંદુએ જાય તો તે સુધારાડ્રૂપ છે ખરું? આ પ્રશ્નોનો જવાબ પેરેટોનાં વિશ્વેષણનાં આધારે આપી શકાશે નહીં. D બિંદુએ, C બિંદુની સરખામણીમાં Y વ્યક્તિને વધારે સંતોષ મળે છે. પણ X વ્યક્તિનો મળતા સંતોષમાં ઘટાડો થાય છે.

એક વ્યક્તિનાં સંતોષમાં વધારો થયો હોય અને બીજી વ્યક્તિના સંતોષમાં ઘટાડો થયો હોય તો ચોખ્ખો વધારો કે ઘટાડો માપવા માટે કોઈ કસોટી પેરેટોનાં વિશ્વેષણમાં મળતી નથી. વળી, તુણ્ણુણ શક્યતારેખા પરની A, B કે D બિંદુમાંથી ક્રયું બિંદુ પસંદ કરવું તે તો કહી શકાય તેમ જ નથી.

પેરેટોની કસોટીનાં આધારે કલ્યાણની ઈષ્ટ દર્શવિતી ‘સીમાન્ત શરતો’ રજૂ કરવામાં આવી. જો ઉત્પાદન અને ઉપભોગમાં ‘કેટલાંક બાધ્ય લાભ કે ગેરલાભ’ ન થતાં હોય તો પૂર્ણ હરીફાઈમાં લાંબે ગાળે સ્થપાતી સમતુલ્ય પેરેટોની ઈષ્ટ સપાઠી દર્શવિ છે. આમ, પૂર્ણ હરીફાઈ સામાજિક કલ્યાણ માટેની આદર્શ સ્થિતિ છે એવી રજૂઆત થઈ.

### 13.7 કલ્યાણલકી અર્થશાસ્ત્રનું મહત્વ :

કલ્યાણલકી અર્થશાસ્ત્રની ઉપયોગિતા છેલ્લા પાંચ દાયકાથી ખૂબ વધી ગઈ છે. આથી કલ્યાણ રાજ્યની ભાવનાવાળા તમામ દેશો અને રાજ્યોએ કલ્યાણલકી આર્થિક પ્રવૃત્તિનું વલાણ અપનાવ્યું છે. આર્થિકનીતિનાં એક અગત્યના ભાગ તરીકે કલ્યાણલકી અર્થશાસ્ત્રનો આજે બધા દેશો સ્વીકાર કરે છે. કલ્યાણલકી અર્થશાસ્ત્રનું મહત્વનું કાર્ય જોઈએ તો તે વૈકલ્પિક આર્થિક નીતિઓમાંથી સામાજિક કલ્યાણ મહત્વમ બનાવી શકે તેવી નીતિની પસંદગીમાં ઉપયોગી બનવાનું છે. કલ્યાણલકી અર્થશાસ્ત્ર આધુનિક સરકારોને આર્થિક નીતિનાં ઘણી મદદરૂપ થાય છે. આ ઉપરાંત સામાજિક લાભ અને ગેરલાભ કે સામાજિક ખર્ચનાં ઘ્યાલોનાં આધારે કરવેરા અને આર્થિક સહાયની નીતિઓની પસંદગીમાં જરૂરી માર્ગદર્શન પણ મળી રહે છે.

કેળવણી, સંશોધન, પ્રાકૃતિક સાધનોનો વિકાસ, કલ્યાણલકી પેન્શન યોજના વગેરેનો અમલ જો ખાનગી સાહસ પર છોડી દેવામાં આવે તો કદાચ પૂરતા પ્રમાણમાં તેમનાં પર ખર્ચ થાય નહીં અને લાંબા ગાળે સમાજની પ્રગતિ અટકે તથા નુકસાનકારક નીવડે. આથી, કેટલાંક ક્ષેત્રોમાં થતો જાહેર ખર્ચ વ્યાપક ‘બાધ્ય લાભ’ સર્જતો હોવાથ સામાજિક કલ્યાણની દાખિએ ઈષ્ટ ગણાય.

સરકારનાં આર્થિક પ્રશ્નોનાં ઉકેલ માટે પણ કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રનો ઉપયોગ થવા માંડ્યો છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ જોઈએ તો તે ‘લાભ-ખર્ચનું વિશ્લેષણ’ છે. જીહેર સાહસોની ભાવનીની ઘડવામાં, ઈજારાનાં તત્ત્વોને લીધે સામાજિક કલ્યાણની સપાટી પર થતી અસરો તપાસવામાં કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર મહત્વનો ભાગ ભજવે છે.

કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર આંતરરાષ્ટ્રીય વ્યાપારનાં પરિણામે દેશનાં લોકોનાં કલ્યાણ પર થતી અસરોનો અભ્યાસ કરવામાં મદદરૂપ થાય છે.

અર્થતંત્રમાં હુગાવો તીવ્ર દરે વધી રહ્યો હોય ત્યારે હુગાવો અટકાવવા માટેની વિવિધ વૈકલ્પિક નીતિઓ પૈકી કઈ નીતિ વધુ ઈષ્ટ ગણાશે તે અંગે અર્થશાસ્ત્રીનો અભિગ્રાય ઉપયોગી બની શકે.

### 13.8 સારાંશ :

પ્રસ્તુત એકમમાં આપણે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રનાં વિવિધ પાસાંઓનો અભ્યાસ કર્યો. જેમાં આર્થિક નિર્ણયોની સાથે મૂલ્યનિર્ણયોને સાંકળીને માનવીના મહત્તમ કલ્યાણને માપવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ ઉપરાંત કલ્યાણ લક્ષી અર્થશાસ્ત્ર વર્તમાન સમયમાં સરકારને નીતિ નિર્ધારણમાં માર્ગદર્શક સિદ્ધાંતો પૂરા પાણ્યા છે. ટૂંકમાં એટલું કહી શકાય કે ઉત્પાદનનાં સાધનો આવકની વહેંચણી અને ઉપભોગમાં એવા ફેરફારો કરવા જોઈએ કે જેથી સમાજનાં કુલ કલ્યાણમાં વધારો થઈ શકે. જે કલ્યાણલક્ષી રાજ્યનો હેતુ સિદ્ધ કરવામાં કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રનો ફાળો મહત્વનો છે.

#### ચારીરૂપ શબ્દો :

##### આર્થિક કલ્યાણ :

આર્થિક કલ્યાણ એ કુલ કલ્યાણનો એવો ભાગ છે કે નાણાંના માધ્યમથી અભ્યાસ કરી શકાય.

##### બાહ્ય લાભ :

કોઈ પેઢીનાં વિસ્તાર થવાથી તેનો લાભ આડકતરી રીતે અન્ય કોઈ પેઢીને કિંમત ચૂકવ્યા વિના થાય તેને.

##### પેરેટોની ઈષ્ટ સપાટી :

જ્યાં સમાજની કોઈ એક વ્યક્તિનાં સંતોષમાં ઘટાડો કર્યા સિવાય અન્ય વ્યક્તિનાં સંતોષમાં વધારો કરી શકાય નહિ તેવી સ્થિતિ.

##### મૂલ્ય નિર્ણયો :

આ એક આત્મલક્ષી જ્યાલ છે જેમાં બુદ્ધિ કરતાં વધારે લાગણીને સ્પર્શતા સારા નરસાનાં જ્યાલો સાથે સંબંધ ધરાવતા વિધાનોને.

દા.ત., પ્રેમ, દ્યા, ક્ષમા.

##### સ્વાધ્યાય :

##### તમારી પ્રગતિ ચકાસો :

##### પ્રશ્ન-1 નીચેનાં પ્રશ્નોનાં વિસ્તારથી જવાબ આપો.

- વૈયક્તિક કલ્યાણમાંથી સામાજિક કલ્યાણ કેવી રીતે તારવી શકાય?
- પ્રો.પીગુનાં કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની ચર્ચા કરો.
- પેરેટોને દર્શાવેલી ઈષ્ટ સપાટી સમજાવો.

4. કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રનું મહત્વ જણાવો.
5. કાલ્ડોર હિક્સની વળતર માટેની કસોટીની ચર્ચા કરો.

**પ્રશ્ન-2 નીચેનાં પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો.**

1. “આર્થિક કલ્યાણ એ કુલ કલ્યાણનો એક ભાગ છે.” સમજાવો.
2. સીટોવસ્કીનો કોયડો સમજાવો.
3. બાધ્ય અસરો એટલે શું? ઉત્પાદન અને ઉપભોગની બાધ્ય અસરો સમજાવો.

**પ્રશ્ન-3 નીચેનાં વિધાનો ખરા છે કે ખોટા જણાવો**

1. વ્યક્તિનાં કલ્યાણને આર્થિક અને બિનઆર્થિક પરિબળો અસર કરે છે.
2. સામાજિક કલ્યાણને ‘મૂલ્યનિર્ણયો’ અસર કરતાં નથી.
3. પેરેટોની ઈછ અવસ્થાની શરત અનુસાર કોઈ એક વ્યક્તિનાં કલ્યાણમાં ઘટાડો કર્યા વિના અન્યનાં કલ્યાણમાં વધારો કરી શકતો નથી.
4. પેરેટોની ઈછ અવસ્થાનો સિદ્ધાંત માર્શલનાં કમવાચક નિર્ધારણમાં ઉપયોગી થાય છે.

**જવાબ :**

1. ખરું
2. ખોટું
3. ખરું
4. ખોટું
5. ખરું

**પ્રશ્ન-4 ખાલી જગ્યા પૂરો**

1. કોઈ વ્યક્તિ પોતાને પસંદ હોય તેવી સ્થિતિએ જાય છે ત્યારે અન્ય વ્યક્તિને તેની ઓછી પસંદગીની સ્થિતિ ખસેડ્યા વિના જઈ શકતા નથી. આ વિધાન ..... અર્થશાસ્ત્રનું છે.
 

A. પેરેટો	C. કાલ્ડોર
B. પ્રો.પીગુ.	D. માર્શલ
2. ..... અસરોના કારણે ખાનગી સીમાંત ખર્ચ અને સીમાંત સામાજિક ખર્ચ વચ્ચે તફાવત ઉભો થાય છે.
 

A. અવેજી અસર	C. પુરક અસરો
B. બાધ્ય અસરો	D. આંતરિક અસરો
3. વળતરનો સિદ્ધાંત ..... અર્થશાસ્ત્ર દ્વારા વિકસાવવામાં આવ્યો.
 

A. કાલ્ડોર	C. પેરેટો
B. માર્શલ	D. રિકર્ડો.

4. કલ્યાણ એ વ્યક્તિની માનસિક અવસ્થા છે. આ વિધાન .....  
અર્થશાસ્ત્રિનું છે.
- A. પ્રો.પીગુ                            C. રિકાર્ડો  
B. માલ્થસ                            D. એડમ સ્મિથ
5. સમાજનાં બધા જ વ્યક્તિઓના કુલ કલ્યાણના સરવાળાને .....  
કહે છે.
- A. સામાજિક કલ્યાણ                    C. બિન-સામાજિક કલ્યાણ  
B. આર્થિક કલ્યાણ                    D. બિન આર્થિક કલ્યાણ
6. મુક્ત અર્થતંત્રની હિમાયત ..... દ્વારા કરવામાં આવી.  
A. જે.એમ. કેઈન્સ                    C. પીગુ  
B. એડમ સ્મિથ                            D. માર્શલ
7. પેરેટોએ પોતાની કસોટીનાં આધારે કલ્યાણની ઈઝ સપાટી દર્શાવવા .....  
શરતો દર્શાવિલ છે.
- A. સીમાન્ત શરતો                            C. કુલ શરતો  
B. સરેરાશ શરતો                            D. સ્થિર શરતો
8. સફરજનની વાડીનો વિકાસ થવાથી મધમાખી કેન્દ્રમાં ઉત્પાદનમાં વધારો થાય છે તેને .....  
કહે છે.
- A. બાધ્ય ગેરલાભ                            C. સીમાન્ત લાભ  
B. બાધ્ય લાભ                                    D. સીમાન્ત ગેરલાભ
9. એક ફેક્ટરીના ઉત્પાદનમાં વધારો થતાં તેમાંથી નીકળતો ધૂમાડો આજુભાજુનાં લોકોના  
આરોગ્ય પર પ્રતિકૂળ અસર થાય છે. તેને ..... કહે છે.
- A. બાધ્ય ગેરલાભ                            C. સીમાન્ત લાભ  
B. બાધ્ય લાભ                                    D. સીમાન્ત ગેરલાભ
10. ઉત્પાદનમાં જે ક્ષેત્રમાં બાધ્ય ગેરલાભ થતા હોય તેનાં પર .....  
નાખવાથી કલ્યાણમાં વધારો થાય છે.
- A. આર્થિક સહાય                            C. સામાજિક સહાય  
B. આર્થિક કર                                    D. સામાજિક કર
11. કાલોર-હિક્સ કસોટીનાં પરસ્પર વિરોધ પરિણામોનો નિર્દેશ .....  
અર્થશાસ્ત્ર દ્વારા કરવામાં આવ્યો.
- A. પ્રો. પીગુ                                    C. સ્મિથ  
B. સિટોબ્ઝી                                    D. પેરેટો
12. પ્રો. પીગુનાં વિચારો અનુસાર ધનિકો પાસેથી કર દ્વારા આવક લઈ તે આવક ગરીબોની  
પાછળ ખર્ચવાથી સમાજનાં કુલ કલ્યાણમાં ..... થાય છે.
- A. કલ્યાણમાં વધારો                            C. કલ્યાણમાં સ્થિરતા  
B. કલ્યાણમાં ઘટાડો                            D. કલ્યાણમાં અસ્થિરતા

જવાબો :

1. (A) પેરેટો
2. (B) બાધ્ય અસરો
3. (C) કાદળોર
4. (A) પ્રો.પીગુ
5. (A) સામાજિક કલ્યાણ
6. (B) એડમ સ્મિથ
7. (C) સીમાંત શરતો
8. (B) બાધ્ય લાભ
9. (A) બાધ્ય ગેરલાભ
10. (B) આર્થિક કર
11. (B) સિટોલ્કી
12. (A) કલ્યાણમાં વધારો.

યુનિટ 14	જોખમ અને અચોક્કસતાનું અર્થશાસ્ત્ર
-------------	-----------------------------------

## : રૂપરેખા :

- 14.0 ઉદ્દેશો
- 14.1 પ્રસ્તાવના
- 14.2 અચોક્કસતાનો અર્થ
- 14.3 અચોક્કસતાની અસરો
- 14.4 અચોક્કસતાનું અર્થશાસ્ત્ર
- 14.5 જોખમ પ્રત્યે વ્યક્તિનું વર્તન
- 14.5.1 તટસ્થ જોખમ
  - 14.5.2 જોખમ પ્રિય
  - 14.5.3 જોખમ અપ્રિય
- 14.6 અપેક્ષિત તુષ્ટિગુણ અને અચોક્કસતા સમધારણા અભિગમો
- 14.7 જોખમ ઘટાડવાના ઉપાયો
- 14.7.1 વીમો
  - 14.7.2 વિવિધીકરણ
  - 14.7.3 ભાવિ બજાર
  - 14.7.4 વાયદા બજાર
  - 14.7.5 પૂર્ણ સૂચના / માહિતી
- 14.8 જોખમ અણગમો
- 14.9 જુગાર અને વીમો
- 14.10 જોખમ અને અનિશ્ચિતતા
- 14.11 જોખમ અણગમો અને વીમો
- 14.12 વાજબી રમતો અને અપેક્ષિત તુષ્ટિગુણ
- 14.12.1 અપેક્ષિત તુષ્ટિગુણ
  - 14.12.2 વોન ન્યુમેન અને મોંગનસ્ટર્ન સિદ્ધાંત
- 14.13 સારાંશ
- 14.14 ચાવી રૂપ શબ્દો
- 14.15 ઉપયોગી પુસ્તકો

**14.0 અભ્યાસના ઉદેશો :**

1. જોખમ પ્રત્યે વ્યક્તિગત વર્તન સમજવું.
2. જોખમના આણગમો અને વીમા વિશે જાણકારી મેળવવી.
3. જુગાર અને વીમાના જ્યાલો સમજવા
4. અચોક્કસ અને અનિશ્ચિત પરિસ્થિતિમાં ગ્રાહકની વર્તણૂક સમજવી.

**14.1 પ્રસ્તાવના :**

અર્થશાસ્ત્રમાં માનવીની આર્થિક પ્રવૃત્તિ, તેમાંથી સર્જતી સમસ્યાઓ, આર્થિક સમસ્યાઓ હલ કરીને આર્થિક વિકાસ સિદ્ધ કરવા માટેની આર્થિક પદ્ધતિઓ અને આર્થિકનીતિઓનો અભ્યાસ કરવામાં આવે છે. જ્યાં પણ અચોક્કસતા છે ત્યાં જોખમ છે. તો વળી તમામ આર્થિક પ્રવૃત્તિઓનો આધાર જે પરિબળો પર છે તેમાં અચોક્કસતા રહેલી છે. જેવી કે રોકાણ, ઉત્પાદન, માંગ, પુરવઠો, આયાત, નિકાસ વગેરેમાં અચોક્કસતા જોવા મળે છે. આવી સ્થિતિમાં લોકો કેવા નિષ્ણયો લે છે તેનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે.

અર્થકારણના મુખ્ય બે અંગો છે. પહેલું ઉત્પાદકો જે વસ્તુનું ઉત્પાદન કરે છે. બીજું ગ્રાહક જે વસ્તુઓનું ઉપભોગ કરે છે. બસે આ અચોક્કસ સ્થિતિમાં એવી રીતે નિષ્ણયો લે છે. કે જેથી વધારેમાં વધારે લાભ થાય અને ઓછામાં ઓંધું નુકશાન થાય. તેથી બસે અચોક્કસતા ઘટાડવાનો પ્રયાસ કરે છે. અચોક્કસતાનાં સંદર્ભમાં થતી આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ અચોક્કસતાના અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે.

**14.2 અચોક્કસતાનો અર્થ :**

જેના અંગો અગાઉથી રૂપે ધારણાઓ, અનુમાનો કે આગાહી ન થઈ શકતી હોય તેને આપણે અચોક્કસતા તરીકે ઓળખીએ છીએ અથવા વ્યક્તિ કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરે ત્યારે તેના પરિબળો વિશે જાણકારી ન મેળવી શકતી હોય તેને અચોક્કસતા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વ્યક્તિ લોટરી ખરીદ, કોઈ રમત રમે કે જુગાર રમે ત્યારે તેના પરિણામો અંગે જાણકારી હોતી નથી. તેના કારણે તેને અમુક વખતે હારનો સામનો કરવો પડે છે.

અમુક અચોક્કસતા એવા પ્રકારની હોય છે કે જેના સંભવિત પરિણામોનું અગાઉથી અનુમાન કરી શકાય છે. પરંતુ ચોક્કસ પરિણામ જાણી શકતું નથી. દા.ત. કોઈ સિક્કો ઉછાળીએ તો કાં તો Head હોઈ શકે અથવા Tail હોય શકે. પરંતુ માત્ર Head હોય શકે તે જાણકારી મેળવી શકતી નથી.

**14.3 અચોક્કસતાની અસરો :**

અચોક્કસતાની અસર એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે જે વર્તન કરે છે તેના પર થાય છે. બીજી વ્યક્તિ કેવી રીતે વર્તન કરશે તેના આધારે જ વ્યક્તિને પરિણામ મળે છે. તેથી એક વ્યક્તિની કામગીરીના પરિણામનો આધાર અન્ય વ્યક્તિના વર્તન પર આધાર રાખે છે. બે વ્યક્તિઓના વર્તન અને પ્રતિવર્તનને આધારે પરિણામ નક્કી થાય છે. તેથી એક વ્યક્તિને અનુકૂળ પરિણામ મળતા અન્ય વ્યક્તિને પ્રતિકૂળ પરિણામ મળે છે. પરંતુ બસે વ્યક્તિને અનુકૂળ પરિણામો મળતા નથી. જે આપણે અલ્ફ-હસ્ત ઈજારાવાળા બજારમાં ઉત્પાદક કેવી રીતે વર્તન કરે છે, તેના આધારે સમજી શકાય. રમતમાં પણ આ પ્રકારના વલણો જોવા મળે છે. જેમાં એકને હાર મળે છે તો બીજાને જત મળે છે.

કેટલીક વખત વ્યક્તિ પાસે કઈ રીતે સમસ્યા હલ કરી શકાય તેની માહિતી કે સમજણ હોતી નથી જેના કારણે પણ અચોક્કસતા ઉદ્ભવે છે. કોઈ વસ્તુની ખરીદી કરી હોય ત્યારે તે વસ્તુનું ટકાઉપણું, ઉપયોગિતા કે ગુણવત્તા વિશે અગાઉથી આગાહી ન કરી શકાય. આ માટે વ્યક્તિ પાસે અપૂરતી માહિતી જવાબદાર છે.

રમતો, લોટરી, વીમો, શેરબજાર, સંડો વગેરેમાં અગાઉથી તેના પરિણામોની આગાહી કરી શકતી નથી. આ સંદર્ભમાં લોકો કઈ રીતે વર્તન કરશે તેનો અભ્યાસ અચોક્કસતાના અર્થશાસ્ત્રમાં કરવામાં આવ્યો છે.

#### **14.4 અચોક્કસતાનું અર્થશાસ્ત્ર :**

અચોક્કસ આર્થિક પરિસ્થિતિમાં ઉત્પાદક અને ઉપભોક્તા/વપરાશકર્તા કેવી રીતે વર્તન કરશે તેમાંથી કયા પ્રશ્નો સર્જય છે તે કેવી રીતે ઉકેલી શકાય, તે કેવી રીતે અચોક્કસતા અથવા તેમાંથી થતા નુકસાનને કેવી રીતે ઘટાડી શકાય કે ટાળી શકાય તેનો અભ્યાસ કરવામાં આવે છે. તેને અચોક્કસતાનું અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. તેમાં રોકાણ, ઉત્પાદન અને ઉપભોગ વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. અચોક્કસતાનું નુકસાન વીમા દ્વારા ઘટાડે છે. કેટલાંકમાં માહિતી કે સલાહ મેળવી નુકસાન ઘટાડી મહત્વમાં લાભ કેવી રીતે મેળવી શકાય તેનો અભ્યાસ કરવામાં આવે છે.

#### **14.5 જોખમ પ્રત્યે વ્યક્તિનું વર્તન :**

અચોક્કસતાની સાથે જ જોખમો સંકળાયેલાં છે. જ્યાં અચોક્કસતા છે ત્યાં જોખમો હોય છે. જેનાં પરિણામો અંગે અગાઉથી ચોક્કસ અનુમાન કે આગાહી થઈ શકતી નથી તેને જોખમી બાબત કહેવામાં આવે છે.

જોખમ પ્રત્યે વ્યક્તિનો વ્યવહાર તેનાથી પ્રાપ્ત થતા લાભ પર આધાર રાખે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જેમ જોખમનું પ્રમાણ ઊંચું તેમ તેમાંથી પ્રાપ્ત થતો લાભ પણ વધારે હોય છે. દરેક વ્યક્તિની જોખમ કે નિર્ણય લેવાની શક્તિ અલગ અલગ હોય છે. તે નિર્ણય શક્તિ એક વ્યક્તિને અન્ય વ્યક્તિથી અલગ પાડે છે. કેટલાંક લોકો જોખમ લેવાનું પસંદ કરે છે. તો કેટલાંક લોકો તેનો વિરોધ કરે છે. જ્યારે કેટલાંક જોખમ પ્રત્યે તટસ્થ રહે છે. જે લોકો જોખમ ઉઠાવે છે તે તેના બદલામાં લાભ, નાણાંકીય આવક કે સંતોષના સ્વરૂપમાં ઈનામ મેળવે છે. જોખમ પ્રત્યે વ્યક્તિનો વ્યવહાર દર્શાવવા એક જુગારનું ઉદાહરણ આપી શકાય. જુગારમાં એક સિક્કો ઉછાળીને લાભ કે ગેરલાભની ચુકવણી કરવામાં આવે છે. આપણે શરત ખાતર માની લઈ કે એક વ્યક્તિ પાસે રૂ. 10,000 છે, અને તે આ જુગારમાં લગાવે છે. અને તે દાવને જીતી લે તો તેને વધારાના રૂ. 10,000 મળશે. અને હારે તો પોતાના લગાવેલા રૂ. 10,000 ગુમાવી દે છે. તેને જીતવાની અને હારવાની સંભાવના સરખી હોય છે. એટલે પ્રત્યેક પરિણામની સંભાવના સરખી (50 ટકા) રહે છે. આ રમતનું અપેક્ષિત પરિણામ કે મૂલ્ય આ પ્રમાણે છે.

અપેક્ષિત મૂલ્ય (Expected Value) = EU :

$$EU = 0.5 (10,000) + 0.5 (-10,000) = 5,000 - 5,000 = 0$$

આ એક ઈમાનદાર રમત કહી શકાય કે જેના પરિણામનું અપેક્ષિત મૂલ્ય શૂન્ય હોય છે. જોખમ પ્રત્યે વ્યક્તિના વ્યવહારને દર્શાવવા નાણ પ્રકારો પાડવામાં આવ્યા છે.

#### **14.5.1 જોખમ તટસ્થ (Risk Neutral) :**

જોખમ તટસ્થ એટલે વ્યક્તિ જીતની સંભાવના પોતાના પક્ષમાં હોય તો જ તો રમતમાં ભાગ લે છે અને જો સંભાવના પોતાના પક્ષમાં ન હોય તો ભાગ લેતો

નથી. એટલે કે ઈમાનદાર રમત પ્રત્યે કે જેમાં હારની અને જીતની સંભાવના સરખી હોય તેવા જુગારમાં ભાગ લેતો નથી. તેના પ્રત્યે તે તટસ્ય રહે છે.

#### **14.5.2 જોખમ પ્રિય (Risk Loving) :**

જોખમ પ્રિય વ્યક્તિ જીત કે હારની સંભાવના પોતાના પક્ષમાં ન હોય તો પણ તે જુગારમાં ભાગ લેવા તત્પર રહે છે. તે રૂ. 10,000 ગુમાવીને માત્ર રૂ. 1,000 જીતવાની સંભાવના હોય તો પણ ભાગ લે છે. તે કોઈ પણ કક્ષાના જોખમને ઉઠાવવા હંમેશા તત્પર રહે છે.

#### **14.5.3 જોખમ અપ્રિય (Risk Averse) :**

જોખમ અપ્રિય વ્યક્તિ હંમેશા જીતની સંભાવના પોતાના પક્ષમાં હોય તો જ રમતમાં ભાગ લેતો હોય છે. પરંતુ જો જીતની સંભાવના પોતાના પક્ષમાં ન હોય તો ભાગ લેતો નથી, એટલે કે જીતની સંભાવના સંપૂર્ણ પણે પોતાના પક્ષમાં હોય તો જ જોખમ ઉઠાવે છે. તે ઈમાનદાર ખેલ પણ રમવા માટે તૈયાર થતો નથી.

#### **14.6 અપેક્ષિત તુષ્ટીગુણ અને અચોક્કસતા સમધારણાનાં અભિગમો :**

ધારણાં બધા વ્યક્તિઓ વધારે સંપત્તિ કે ધન મેળવવા માટે જુગાર રમતા હોય છે કે રેસમાં શરત લગાવતા હોય છે. જેનાથી તેને સંતોષ મળતો હોય છે. અર્થશાસ્ત્રી આ સંતોષ કે ઉપયોગિતાને માપવાનો પ્રયત્ન કરે છે. તે ત્રણ પ્રકારનાં વ્યક્તિઓને જોખમ પસંદગીને સંતોષ સાથે જોડીને ઉપયોગિતા માપવાનો પ્રયત્ન કરેલ છે.

##### **ધારણાઓ :**

- વ્યક્તિનો સંતોષ ધન સાથે જોડાયેલ છે.
- તુષ્ટીગુણ તેના સંતોષનું એક માપ છે.
- વ્યક્તિ પાસે એક નિશ્ચિત આવક છે.
- તે એક ઈમાનદાર રમત રમે છે કે જેમાં જીત અને હારની સરખી સંભાવના છે.
- તે તમામ પ્રકારની સંભાવનાથી પરિચિત છે.
- તે પોતાનો અપેક્ષિત તુષ્ટીગુણ મહત્તમ કરવા સતત પ્રયાસ કરે છે.


ઉપરોક્ત ધારણાઓને ધ્યાનમાં રાખીને જુગાર રમવામાં આવે છે. જેમાં આપણે આગળ જોયું તેમ એક સિક્કો ઉછાળીને હાર કે જીતને નક્કી કરવામાં આવે છે. સરળતા ખાતર એવું માની લેવામાં આવે છે કે વ્યક્તિ પાસે આવક રૂ. 10,000 છે, અને તે રૂ. 5,000 દાવ પર લગાવે છે. સિક્કો ઉછાળી જો Head આવે તો 5,000 જીતે છે અને Tail આવે તો રૂ. 5,000 હારે છે અને જો શરત ન લગાવે તો તેની પાસેનાં રૂ. 10,000માં કોઈ વધારો-ઘટાડો થતો નથી. આને નિશ્ચિત સંભાવના તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જો તે શરત લગાવે તો તે 0.5 જીતવાની સંભાવના પર રૂ. 15,000 મેળવે છે.  $(10,000 + 5,000)$  અથવા 0.5 સંભાવના પર હારવાથી રૂ. 5,000 ગુમાવે છે.  $(10,000 - 5,000)$  આવી સ્થિતિને અનિશ્ચિત સ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં પ્રત્યેક પરિણામની સંભાવના 50 ટકા છે. હવે આપણે આ વિશ્લેષણને તુષ્ટીગુણના સંદર્ભમાં પ્રત્યેક રૂપિયાનાં અપેક્ષિત મૂલ્યને ત્રણ પ્રકારનો જોખમોનાં અનુસંધાન જોઈએ છે.

### જોખમ તટસ્થ વ્યક્તિ :

જોખમ પ્રત્યે તટસ્થ વ્યવસ્થાને નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. જેમાં આડી ધરી OX પર આવક અને ઉભી ધરી OY પર કુલ તુષ્ટિગુણને દર્શાવવામાં આવેલ છે, જ્યારે રૂ.10,000 ની નિશ્ચિત સંભાવના સાથે અપેક્ષિત તુષ્ટિગુણ 16 છે. અનિશ્ચિત સંભાવના સામે અપેક્ષિત તુષ્ટિગુણ...


$$EU = 0.5 (8) + 0.5 (24) = 4 + 12 = 16$$

આપણને ખબર છે કે જોખમ તટસ્થ બાબતોમાં નિશ્ચિત સંભાવનાનો તુષ્ટિગુણ અને અનિશ્ચિત સંભાવનાનો તુષ્ટિગુણ બને સરખા હોય છે. એટલે કે  $16 = 16$  એ અપેક્ષિત મૂલ્ય સરખું છે. જે આપણે આકૃતિ દ્વારા જોઈએ.



આકૃતિમાં TU રેખા કુલ તુષ્ટિગુણ રેખા છે, જે એક વ્યક્તિની નિશ્ચિત આવક દર્શાવે છે. TU રેખા મૂળમાંથી ઉદ્ભવતી ઉપર જતી એક સીધી રેખા છે જે સ્થિર સીમાંત તુષ્ટિગુણ દર્શાવે છે. જેમાં AB અને BC બિન્હનું અંતર એક સમાન હોય છે.

### જોખમ પ્રિય વ્યક્તિ :




આ આકૃતિમાં OX ધરી પર આવક અને OY ધરી પર તુષ્ટિગુણ દર્શાવવામાં આવેલ છે. જ્યારે TU વક્ત તુષ્ટિગુણ દર્શાવે છે. જે ઉપર જતી એક સરળ રેખા છે. રૂ. 10,000 ની નિશ્ચિત સંભાવનાએ અપેક્ષિત તુષ્ટિગુણ 10 છે. અનિશ્ચિત સંભાવનાએ અપેક્ષિત તુષ્ટિગુણ ...

$$EU = 0.5 (4) + 0.5 (20) = 2 + 10 = 12$$

જ્યારે રૂ. 5,000 ના પરિણામનું તુષ્ટિગુણ સ્તર 8 છે અને 15,000 તે 20 છે. અનિશ્ચિત સંભાવનાએ (12) માટે અપેક્ષિત તુષ્ટિગુણ જ્યારે નિશ્ચિત સંભાવનાએ (10) ની અપેક્ષિત તુષ્ટિગુણ વધારે છે, એટલે  $12 > 10$  આ વ્યક્તિની અનિશ્ચિત સંભાવનાવાળો જુગાર નિશ્ચિત સંભાવનાવાળા જુગારથી વધારે પસંદ કરે છે. TU વક્ત પર જોખમ પ્રિય વ્યક્તિ પોતાની નિશ્ચિત સંભાવના (10,000) થી વધારે 2,000 સુધી ( $= 12,000 - 10,000$ ) જુગાર માટે જોખમ ઉદાવવા તૈયાર છે.

#### જોખમ અપ્રિય વ્યક્તિ : (Risk Averse) :

જોખમ અપ્રિય વ્યક્તિના વર્તનને નીચેની આકૃતિ દ્વારા દર્શાવવામાં આવેલ છે જેમાં OX ધરી પર આવક અને OY ધરી તુષ્ટિગુણ દર્શાવવામાં આવેલ છે. જ્યારે TU વક્ત એ કુલ તુષ્ટિગુણને દર્શાવે છે, જે આવકનો ઘટતો સીમાંત તુષ્ટિગુણ દર્શાવે છે.



જેવી રીતે આવક 5,000 થી 10,000 અને 10,000 થી 15,000 થાય છે ત્યારે સીમાંત તુષ્ટિગુણ 10 થી 8 ( $= 18 - 10$ ) અને 8 થી 4 ( $= 22 - 18$ ) થાય છે. 10,000 ની નિશ્ચિત સંભાવનાથી અપેક્ષિત તુષ્ટિગુણ 18 છે. અનિશ્ચિત સંભાવનાએ અપેક્ષિત તુષ્ટિગુણ 16 છે. જ્યારે 5,000 ના પરિણામે તુષ્ટિગુણ સ્તર 10 છે અને 15,000 નું 22 છે જે

$$EU = 0.5 (10) + 0.5 (22) = 5 + 11 = 16$$

આ ઉદાહરણમાં અનિશ્ચિત સંભાવનાએ અપેક્ષિત તુષ્ટિગુણ (16) અને નિશ્ચિત સંભાવનાએ અપેક્ષિત તુષ્ટિગુણ (18) થી ઓછો છે, એટલે કે  $16 < 18$  જોખમ અપ્રિય વ્યક્તિ ઉંચી તુષ્ટિગુણ વાળી નિશ્ચિત સંભાવનાને ઓછી તુષ્ટિગુણવાળી અનિશ્ચિત સંભાવનાથી વધારે પસંદ કરશે. તેથી જુગારી બચીને 1,500 રૂ. દેવા તૈયાર થશે; જો

10,000 ની નિશ્ચિત આવક તથા 8,500 ની અનિશ્ચિત આવક વચ્ચેનું અંતર છે જેને જોખમ પ્રિમિયમ તરીકે ઓળખમાં આવે છે. આકૃતિમાં 13 થી D સુધીના ભાગની જોખમ પ્રિમિયમ તરીકે ઓળખાય છે.

#### **14.7 જોખમ ઘટાડવાનાં ઉપાયો :**

જોખમ પ્રિય વ્યક્તિ સિવાય મોટાભાગના જોખમને દૂર કરવાના અથવા તેને ઘટાડવાના વિવિધ પ્રયાસો કરે છે તે આ પ્રમાણે છે.

##### **14.7.1 વીમો (Insurance) :**

વ્યક્તિ પોતે જે જોખમોનો સામનો કરે છે તેની સામે રક્ષણ મેળવવા માટે વીમો ખરીદે છે. શરૂઆતના સમયમાં પ્રીમિયમ ભરે છે તેના બદલામાં જે કાંઈ નુકસાન થાય તે બધું જ સરભર કરવાની ખાતરી વીમા કંપનીઓ આપતી હોય છે. અમુક ચુકવણીથી તે પોતાની જાતને નિશ્ચિત બનાવી શકે છે. દા.ત. એક વ્યક્તિ પોતાના ઘરને આગ સામે રક્ષણ મેળવવા વીમો કરાવે છે. તે ઘરની કિંમત રૂ. 2 લાખ છે તથા એક વર્ષમાં આગ લાગવાની સંભાવના 1/400 છે. એટલે કે 400 માંથી એક છે. તેની પાસે બે વિકલ્પો છે. એક તે વીમો નહિ કરાવે તેવા સમયે જો આગ લાગશે તો મકાનની કિંમત શૂન્ય થઈ જશે અને આગ નહીં લાગે તો મકાનની કિંમત એમજ રૂ. બે લાખ રહેશે. બીજો વિકલ્પ એ છે કે તે પોતાના મકાનનો વીમો કરાવે છે તે રૂ.5,000 નો વીમો કરાવે છે અને તેને આઈ વર્ષનો છે. જો આઈ વર્ષની અંદર આગ લાગે તો વીમા કંપની મકાન માલિક રૂ. 2 લાખ આપશે અને આગ ન લાગે તો આઈ વર્ષના અંતે તેનું મૂલ્ય  $2,00,000 - 5,000 = \text{રૂ. } 1,95,000$  થાય છે.

##### **14.7.2 વિવિધીકરણ (Diversification) :**

જોખમમાં વિવિધીકરણ દ્વારા પણ ઘટાડો થઈ શકે છે. પેઢી માત્ર એક પ્રકારનું રોકાણ કરવાના બદલે અનેક પ્રકારનાં રોકાણો કરે છે. એટલે કે તેનું વિસ્તરણ કરે છે. વીમા કંપની પણ પોતાનો લાભ મહત્તમ કરવા અને જોખમ ઘટાડવા વિવિધ પ્રકારના વિમાઓ ઉતારે છે. જેવા કે ઘર, જીવન, કાર, સ્વાસ્થ્ય વગેરે પ્રકારનો વિમાઓ ઉતારે છે. વિભિન્ન પ્રકારના વિમાનું વિવિધીકરણ કરે છે. એવી જ રીતે રોકાણકાર પણ સ્ટોક બજારમાં વ્યાપાર કરીને વિવિધીકરણથી જોખમ ઘટાડી શકે છે. તે બજારમાં પોર્ટફોલિયો દ્વારા જોખમવાળા સ્ટોકથી અપેક્ષિત નુકસાન ઘટાડી શકે છે.

##### **14.7.3 ભાવિ બજાર (Futures Market) :**

વ્યક્તિ પોતાની વસ્તુને ભાવિ બજારમાં સોઢો કરીને પણ જોખમ ઘટાડી શકે છે. મોટા ભાગે ભાવિ બજાર ફૂઝિ-ઉત્પાદનને લગતી ચીજ-વસ્તુઓમાં વધારે જોવા મળે છે. ઉદાહરણ તરીકે કોઈ ખેડૂત જ્યારે ઘઉંનું વાવેતર કરે ત્યારે તે જાણતો નથી કે ઘઉંનું બજાર કેવું રહેશે. ભાવ વધશે કે ઘટશે. જો તે ભાવ ઘટવાની અપેક્ષા રાખતો હોય તો તે ભવિષ્યની એક વિશેષ તારીખે અને વિશેષ કિંમતે તે સોઢો કરે છે અને બજારના જોખમ સામે રક્ષણ મેળવે છે.

##### **14.7.4 વાયદા બજાર (Forward Market) :**

વાયદા બજારમાં ભવિષ્યની એક નક્કી તારીખે માલનું વેચાણ કરવાનું હોય છે પણ તેની કિંમત કે સોઢો વર્તમાન હાજર કિંમત મુજબ કરવામાં આવે છે. તેને

વાયદા બજાર તરીકે ઓળખવામાં આવે છે. વાયદા બજારમાં અનેક વસ્તુઓ અને સાધનો જેવી કે ઘઉં, ચા, સોનુ, ચાંદી અને વિદેશી મુક્રા વગેરેનો વેપાર કરવામાં આવે છે.

સોનાના વાયદા બજારના એક ઉદાહરણથી સમજાયે. 10 ગ્રામ સોનાની વર્તમાન કિંમત રૂ. 5,000 છે. તેને હાજર કિંમત તરીકે ઓળખવામાં આવે છે. તે સોનાની એક વર્ષ બાદ તેને રૂ. 5,500 મળવાની અપેક્ષા છે. તેને ભાવિ હાજર કિંમત તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ તે જોખમ લેવાના બદલે વાયદા બજારમાં રૂ. 5,300 માં સોટો કરે છે. એટલે તેને એક વર્ષ બાદ રૂ. 5,300 કિંમત મળશે. જે રૂ. 200 જોખમ પ્રિમિયમ ભરીને જોખમને ટાળે છે.

#### **14.7.5 પૂર્ણ સૂચના (Complete Information) :**

લોકો અપૂર્ણ માહિતીના કારણે નિઃખ્યા લેવામાં જોખમ તથા અસ્થિરતાનો સામનો કરે છે. તેનાથી તે અધિક નરો મેળવવા માટે નિઃખ્યા લઈ શકતા નથી. કોઈ પણ વસ્તુને વેચવા કે ખરીદવા માટે તેના વિશેની સંપૂર્ણ માહિતીની જરૂર પડે છે. તે વિવિધ પ્રકારની જાહેરાતોથી માહિતી મળે છે. અર્થશાસ્ત્રમાં માહિતીને એક વસ્તુ ગાડાવામાં આવે છે જે વેચી પણ શકાય છે અને ખરીદી પણ શકાય છે. પૂર્ણ માહિતીનું મૂલ્ય અને અપૂર્ણ માહિતીનું મૂલ્ય અલગ-અલગ હોય છે. ઉદાહરણ તરીકે કોઈ એક પેઢી પોતાનું વેચાણ વધારવા માટે જાહેરાત ખર્ચ કરે છે. જેનાથી ગ્રાહકોને સંપૂર્ણ માહિતી મળી શકે. જેનાથી તેના વેચાણ તથા નફાનાં વધારો થવાની સંભાવના છે. આપણે માની લઈએ કે પૂર્ણ માહિતી તેનો સંભવિત લાભ રૂ. 25,00,000 છે. પરંતુ અપૂર્ણ માહિતી સાથે તેનો લાભ રૂ. 13,00,000 છે. પૂર્ણ માહિતીનાં સંભવિત લાભ અને અપૂર્ણ માહિતીનાં સંભવિત લાભ વચ્ચે અંતર  $(25,000 - 13,00,000 = 12,00,000)$  છે. જે પૂર્ણ માહિતી મૂલ્ય છે. આમ પેઢી પૂર્ણ માહિતી મેળવીને રૂ. 12,00,000 આવક મેળવી શકે છે.

---

#### **14.8 જોખમ અણગમો (Risk Aversion) :**

---

બે ઈમાનદાર રમતોનું અપેક્ષિત નાણાકીય મૂલ્ય સમાન હોય છે. પણ તે બસે રમતોનાં જોખમનું પ્રમાણ અલગ-અલગ હોય છે. દા.ત. રૂ. 100 ની રમત માટે સિક્કો ઉછાળવો અને રૂ. 1,00,000ની રમત માટે સિક્કો ઉછાળવો. બસે રમતો વાજ્બી અને ઈમાનદાર છે અને બસેનું અપેક્ષિત મૂલ્ય પણ એક સરખુ છે. પરંતુ એક લાભ રૂપિયાની રમતમાં જોખમનું પ્રમાણ વધારે છે. તેના કારણે તેમાં ભાગ લેનાર લોકોની સંખ્યા ઓછી હોય છે.

જેમ કોઈ પણ કાર્યના પરિણામોમાં અચોક્કસતા અને વિવિધતાની કક્ષા વધારે તેમ જોખમનું પ્રમાણ વધારે હોય છે અને જેમાં વિવિધતા ઓછી તેમ જોખમ ઓછું અને ચોક્કસતા વધારે હોય છે.

જો આપણે ઉદાહરણ મુજબ એક લાભ રૂપિયાની રમત માટે સિક્કો ઉછાળવામાં આવે અને તે રમત જીતે તો તેમાંથી મળતાં તુષ્ટિગુણમાં ઓછો વધારો થાય છે. પણ જો ધારે તો નુકસાનના કારણે થતાં તુષ્ટિગુણમાં થતો ઘટાડો વધારે હોય છે. જ્યારે રૂ. 100 ની રમત માટે સિક્કો ઉછાળવાથી જીતથી પ્રાપ્ત થતો તુષ્ટિગુણ વધારે હોય છે અને હારના કારણે નુકસાનથી થતાં તુષ્ટિગુણમાં ઘટાડો ઓછો હોય છે. આ ઉદાહરણ એમ દર્શાવે છે કે લોકોને જોખમો પ્રત્યે અણગમો છે અને બિનજોખમી અથવા ઓછા જોખમવાળા વિકલ્પોની વધારે પસંદગી કરે છે. તેને જોખમ અણગમો તરીકે ઓળખાય છે.

#### **14.9 જુગાર અને વીમો :**

વ્યક્તિ પોતે જે જોખમોનો સમાનો કરે છે તેની સામે રક્ષણ મેળવવા વીમો કરાવે છે. શરૂઆતમાં પ્રિમિયમ ભરે છે તેના બદલામાં જે કંઈ નુકસાન થાય તે ભરપાઈ કરવાની ખાતરી વિમા કંપની તેના ગ્રાહકોને આપે છે. અમુક રકમ ભરીને તે પોતાની જાતને નિશ્ચિત બનાવવાનો પ્રયત્ન કરે છે.

પરંતુ પ્રશ્ન એ છે કે તે ઓછામાં ઓછુ કેટલું વિમાનું પ્રિમિયમ ભરશે? કોઈ પણ વ્યક્તિ એટલું પ્રિમિયમ ભરવા તૈયાર થશે કે તેને લાભ-નુકસાન કંઈ જ ન થાય. એટલે કે નુકસાનની રકમ જેટલું પ્રિમિયમ ભરવા તૈયાર થશે, એટલે કે નુકસાનની રકમ જેટલું પ્રિમિયમ ભરશે અને નુકસાની રકમ વિમા દ્વારા સરભર થશે. તો જ વીમો ખરીદશે. નુકસાનની રકમ જેટલું ઓછામાં ઓછુ વિમા વળતર મળે તો તે વીમો ખરીદશે.

વિમા કંપનીનો પણ મુખ્ય ઉદ્દેશ નફાનો હોય છે. તે ગ્રાહક પાસેથી નાની રકમ લઈને નુકસાનની મોટી રકમની ચુકવણી કરતી હોય છે. પરંતુ જેવી રીતે વ્યક્તિ જોખમ અપ્રિય હોય તેમ કંપની પણ જોખમ અપ્રિય હોય છે. તેથી તે જોખમને ટાળવા અને મહત્વમાં લાભ મેળવવા માટે જોખમને ટાળવાનો પ્રયત્ન કરે છે. જેના માટે તે જોખમ એકત્રિકરણ (Risk Pooling) અને જોખમ પ્રસાર (Risk Spreading) ને અપનાવે છે.

વ્યક્તિ મોટા જોખમો સામે વીમો કરાવે છે અને નાના જોખમો સામે પણ વીમો કરાવે છે. જે પોતાના મકાનને પણ વિમા નીચે આવરી લે છે અને વાહનને પણ વિમા નીચે આવરી લે છે. વિમા એજન્ટો વીમો વેચે છે ત્યારે તેને અમુક ખર્ચ થાય છે. આ ખર્ચને આપણે વહીવટી ખર્ચ તરીકે ઓળખીએ છીએ. પ્રિમિયમની આવકમાંથી તે ખર્ચને આવરી લેવા પ્રયાસ કરે છે. પરંતુ વાજબી પ્રિમિયમમાં આ વહીવટી ખર્ચને ધ્યાનમાં લેવામાં આવતું નથી.

#### **14.10 જોખમ અને અનિશ્ચિતતા :**

વ્યક્તિ “અનિશ્ચિત” પરિસ્થિતિને અને “જોખમી” પરિસ્થિતિમાં કર્દી રીતે વર્તન કરે છે તે સમજવા માટે “જોખમ” અને “અનિશ્ચિતતા” વચ્ચેનો બેદ સમજવો અતિ આવશ્યક છે. જોખમમાં તમામ સંભવિત પરિણામોની સંભાવનાઓ વિશે વ્યક્તિને જાણકારી હોય છે, અને તેથી આપણે વ્યક્તિના નિર્ણયની તપાસ કરવા માટે અપેક્ષિત તુટિગુણના સિદ્ધાંતોનો ઉપયોગ કરીએ છીએ. કેટલીક પદ્ધતિઓ અને તકનિક વિકસાવીને જોખમી પરિસ્થિતિને પહોંચી વળવા માટેના પ્રયાસો કરવામાં આવે છે.

આર્થિક સાહિત્યમાં “અનિશ્ચિતતા” નો ખ્યાલ વ્યાપક ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે સંભવિત પરિણામોની સંભાવનાઓને ચોક્કસ રીતે વ્યક્તિ જાણી ન શકે અથવા તો જ્યાં સંભાવનાનો ખ્યાલ અપ્રસ્તુત હોય તેવી પરિસ્થિતિને સમજણ માટે “અનિશ્ચિતતા” ના ખ્યાલનો ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તવિક જગતમાં આપણને આવા અનેક પ્રસંગો જોવા મળે છે. જેની આપણે વિસ્તૃત તપાસ કરી શકતા નથી.

#### **14.11 જોખમ અણગમો અને વીમો :**

કોઈપણ વ્યક્તિ જોખમ પ્રતે અણગમો દાખવતો હોય છે. તે અનિશ્ચિત પરિસ્થિતિના બદલે નિશ્ચિત અને બિનજોખમી રહેવાનું પસંદ કરે છે. તેથી વ્યક્તિ વાજબી રમતો દ્વારા મળતી સંપત્તિની વૃદ્ધિ કરતાં વર્તમાન ચાલુ સંપત્તિને જ વધારે પસંદ કરે છે. આવી જ રીતે લોકો મોટી રકમોની રમતો કરતાં નાની રકમોની રમતોને પસંદ કરતા હોય છે.

વાજબી રમતોની જીતથી તેને જે આનંદ મળશે તેના કરતાં તેના હારથી મળતી નિરાશા અને દુઃખ વધારે હશે. નાણાંના સંદર્ભમાં સમાન ઈનામો હોય તો પણ વ્યક્તિને મળતા સંતોષના સંદર્ભમાં તેને થતું નુકસાન વધારે હશે. તેથી વ્યક્તિ આવી રમતોથી છુટવા માટે અમુક રકમ આપવા પણ તૈયાર હશે. તે પ્રથમ પ્રકારની રમતમાં ભાગ લે તો W સંપત્તિમાંથી મળતો એક સમાન તુષ્ટિગુણ પ્રાપ્ત થશે. પરંતુ આવા પ્રકારની રમતોમાં ભાગ ન લેવા વ્યક્તિ W - W સુધીની રકમ આપવા તૈયાર થશે. તેથી લોકો શા માટે વીમો ખરીદે છે તેની સમજૂતી પણ આપી શકાય.

#### **14.12 વાજબી રમતો અને અપેક્ષિત તુષ્ટિગુણ :**

આપણે ઘડી વખત જોયું હશે કે લોકો વાજબી રમતો રમવા ઈચ્છા ધરાવતા નથી. તેનું કારણ વાજબી રમત માટેની નક્કી કરેલ રકમ મોટી હોવાથી લોકો વાજબી રમતમાં પણ રમવાની ઈચ્છા ધરાવતાં નથી. આનાથી ઉલંટું જો નાની રકમની રમત હોય તો લોકો રમત રમવાની સંમતિ આપે છે.

આપણે વાજબી રમતો અને અપેક્ષિત તુષ્ટિગુણ એ સિક્કો ઉછાળવાની રમતનાં ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું. તો આપણા આ કિસ્સામાં સિક્કો ઉછાળવાની રમતમાં રા. એક લાખ નક્કી કરવામાં આવે છે. રકમ મોટી હોવાને કારણે મગન કે છગન બને આ રમતમાં ભાગ ન લે તે શક્ય છે.

આ ઉદાહરણ સમજતાં પહેલાં આપણા માટે ખુબ જરૂરી છે તે જાણવું કે આની રજૂઆત ક્યારે અને કોણે કરી. તો આની શરૂઆત અઠારમી સદીમાં વિશ્વના મહાન ગણિતશાસ્ત્રી તેનીયલ બનોલીએ પ્રથમ વખત “બર્ગરા પેરેટેકરા” અંગે રજૂઆત કરી હતી.

પીટરબર્ગસ પેરેડોક્સમાં રમતની આ રીતે રજૂઆત કરવામાં આવે છે. જ્યાં સુધી સિક્કો ઉછાળતાં ઉપર Head ન આવે ત્યાં સુધી સતત સિક્કો ઉછાળવામાં આવશે.

ધારો કે,  $n$  વખત સિક્કો ઉછાળતાં Head સૌ પ્રથમ વખત આવ્યું તો ખેલાડીને  $2n$  ડોલર આપવામાં આવે છે. આમાં એવું પણ બની શકે કે આ રમત ઘડા લાંબા સમય સુધી ચાલુ રહે જેના લીધે તે જેટલીવાર ઉછાળવામાં આવે તેટલાં પરિણામ આપણને મળે. જેથી આ રમતમાં અગણિત પરિણામો પણ હોઈ શકે.

બે દિવસ સુધી સતત સિક્કો ઉછાળવામાં આવે તો પણ Head ન આવે તેવી શક્યતા છે. જ્યારે એવું પણ બની જાય છે કે સિક્કો ઉછાળતાં પ્રથમવારમાં જ તાત્કાલિક Head આવી જાય.

આ કારણથી જ્યારે પ્રથમ વખત Head આવે ત્યારે જ ઈનામ મળે તેને આપણે  $X_1$ , જ્યારે બીજી વખત Head આવતાં ઈનામ મળે તેને  $X_2$ , ત્રીજી વખત Head આવતાં  $X_3$ , આજ રીતે  $n$  વખતનાં ઈનામને આપણે  $X_n$  તરીકે લઈએ તો તેને નીચેની દર્શાવેલ રીત મુજબ રજૂ કરી શકાય.

$$X_1 = \$_2$$

$$X_2 = \$_4$$

$$X_3 = \$_8$$

હવે આપણે એવી ઘારણા કરીએ કે જો  $i^{th}$  પ્રયાસે પ્રથમ વખત Head આવવાની શક્યતા  $1/2$  છે. એટલે કે  $i - 1$  પ્રયાસે તે આપણને મળવાની સંભાવના છે તેમ માની કહી શકાય. જેથી આગળ જે સમીકરણો રજૂ કર્યા છે તેમાં ઈનામો મળવાની અલગ

અલગ સંભાવનાને આપણે ઉપરની ધારણાને ધ્યાનમાં રાખીને આ મુજબ રજૂ કરી શકીએ.

$$\pi_1 = \frac{1}{2}$$

$$\pi = \frac{1}{4}$$

$$\pi = \frac{1}{8}$$

:

:

$$\pi_n = \frac{1}{2^n}$$

આ ઉપરની દર્શાવિલ બધી જ સંભાવનાઓનો સરવાળો જ્યારે એક (1) થાય ત્યારે કોઈ પરિણામ મળે છે. જો આ આપણે સમજવું હોય તો તેને નીચેની રીતે સમીકરણમાં રજૂ કરીને સમજી શકાય.

$$\sum_{i=1}^{\infty} \pi_i = \frac{1}{2} \left( 1 + \frac{1}{2} + \frac{1}{4} + \dots \right)$$

$$= \frac{1}{2} \left( \frac{1}{1 - \frac{1}{2}} \right)$$

$$= \frac{1}{2} \times 2 = 1$$

આપણે ઉપરનાં સમીકરણમાં જોયું કે બધી જ સંભાવનાઓનો સરવાળો એક થાય ત્યારે જ આપણને કોઈ પરિણામ મળે છે. હવે તેને જો આપણે અપેક્ષિત મૂલ્યનાં સંદર્ભમાં સમજવું હોય તો નીચેનાં સમીકરણ દ્વારા તેને સમજી શકાય.

$$\text{અપેક્ષિત મૂલ્ય} = \sum_{i=1}^{\infty} \pi_i \times 1$$

$$= \sum_{i=1}^{\infty} 2^1 \frac{1}{2^1}$$

$$= 1 + 1 + 1 + \dots + 1 = \infty$$

આથી, ઉપરોક્ત સમીકરણમાં આપણે જોઈ શકીએ છીએ કે પીટરબર્ગસ પેરેડોક્સ ગેરીમનું અપેક્ષિત મૂલ્ય અગણિત (૦૦) છે.

આ સમીકરણ દ્વારા આપણને જાગ્રત્તા મળે છે કે ગમે તેટલી મોટી રકમ લેવામાં આવશે તો પણ ખેલાડી રમત રમવા તૈયાર નહીં થાય. તેનું કારણ છે કે જો એક બીલીયન ડોલર પણ લેવામાં આવશે તો પણ તે રમતનાં અપેક્ષિત મૂલ્ય કરતાં ઘણી જ ઓછી રકમ હશે. પણ જે આપણે બન્નોલીની રમતની વાત કરીએ તો તે રમતમાં અગણિત અપેક્ષિત મૂલ્ય નથી. જ્યારે પીટરબર્ગસ પેરેડોક્સ ગેરીમ અપેક્ષિત મૂલ્ય અગણિત છે.

#### 14.12.1 અપેક્ષિત તુષ્ટિગુણ :

આ કોયડાને ઉકેલવા બનોલી એવી દલીલ કરે છે કે વ્યક્તિને રસ ડોલર જીતવામાં નથી, પરંતુ તેમાંથી મળતો તુષ્ટિગુણ મહત્વનો છે, એટલે કે અમુક પ્રકારની રમત રમવાથી કેટલાં નાણાં મળશે તેના આધારે રમત રમવાનો કે ન રમવાનો નિર્ણય લેવામાં આવતો નથી. પરંતુ તે નાણાંમાંથી કેટલો તુષ્ટિગુણ મળશે તેનો નિર્ણય કરવામાં આવે છે.

જો આપણે એવું ધારવાથી કે વ્યક્તિની આવકમાં જેમ વધારો થાય તેમ તેમાંથી મળતો ચીમાંત તુષ્ટિગુણ ઘટે છે તો પીટરબર્જસ ગેઈમને ચોક્કસ અપેક્ષિત તુષ્ટિગુણ મૂલ્યમાં પરિવર્તિત કરવી પડે જેના માટે બેલાડી રમવાનો અધિકાર મેળવવા માટે નાણાં ચૂકવવા ઈચ્છે છે.

બનોલીએ અપેક્ષિત મૂલ્યને રમતનાં ‘‘નૈતિક મૂલ્ય’’ તરીકે પણ ઓળખાવે છે. તે વ્યક્તિ માટે તે રમતનું કેટલું મહત્વ છે તેના આધારે નક્કી થાય છે. કોઈ પણ રમતનું ડોલર મહત્વમાં વધારો થાય પણ જો તુષ્ટિગુણ મૂલ્યમાં ઘટાડો થતો હોય તો તે રમતનું નૈતિક મૂલ્યમાં પણ ઘટાડો થતો હોય છે. તેથી તે અપેક્ષિત તુષ્ટિગુણ મૂલ્ય અને રમતનું નૈતિક મૂલ્યનું એકબીજા સાથે ધન સંબંધ જોવા મળે છે તો તે વધે તો નૈતિક મૂલ્ય પણ વધે છે અને જો ઘટે તો નૈતિક મૂલ્યમાં ઘટાડો થાય છે.

ટૂકમાં એટલું કહી શકાય કે વ્યક્તિ અચોક્કસ સ્થિતિમાં વ્યક્તિનું વર્તન તપાસતા વ્યક્તિ નાણાંના બદલે તેમાંથી મળતાં તુષ્ટિગુણમાં રસ હોય છે.

બનોલીએ પણ પીટર બર્જસનાં કોયડાને પૂર્ણ રીતે ઉકેલી શક્યા નથી. પરંતુ તેઓ અચોક્કસ અને અનિશ્ચિત પરિસ્થિતિમાં ગ્રાહક કેવી રીતે વર્તન કરશે તે સમજાવે છે. લોકોને ડોલરમાં નહીં પણ ડોલરમાંથી મળતા અપેક્ષિત તુષ્ટિગુણમાં જ વધારે રસ હોય છે.

પરંતુ આ અભિગમની મુખ્ય ખાસીયત એ છે કે તેમાં તુષ્ટિગુણને માપી શકાય છે. પરંતુ વાસ્તવમાં તુષ્ટિગુણને માપી શકતો નથી. લોકો રમતો રમે છે, કારણ કે તેમાંથી નાણાં મળે છે. પણ તે નાણાંમાંથી કેટલો તુષ્ટિગુણ મળશે તે કહી શકાય નહિ. આ ખામીને દૂર કરવાનો પ્રયત્ન 1944માં વોન ન્યુમેન અને મોંગનસ્ટર્ન દ્વારા અચોક્કસ પરિસ્થિતિમાં ગ્રાહકના વર્તન સમજાવવા અલગ અભિગમ રજૂ કરેલ છે.

#### 14.12.2 વોન ન્યુમેન - મોંગનસ્ટર્ન સિદ્ધાંત :

જે વોન ન્યુમેન અને એ મોંગનસ્ટર્ન નામના વિધાનોએ 1944માં પોતાના પુસ્તકમાં The Theory of Games and Economic Behaviour માં અચોક્કસ પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવા માટે એક ગાણિતિક મોડેલ રજૂ કરવામાં આવ્યું. તેઓ જણાવે છે કે વ્યક્તિઓ અચોક્કસ પરિસ્થિતિમાં જે વિવિધ પસંદગીઓ કરે છે. તેનો આધાર તેમાંથી મળતા અપેક્ષિત તુષ્ટિગુણ પર રહેલો છે. આ અપેક્ષિત તુષ્ટિગુણનો ખ્યાલ ગ્રાહકના વર્તન અભિગમોમાંથી જ ઉત્તરી આવ્યો છે.

ગ્રાહકનું સુસંગત બુદ્ધિપૂર્વકનું વર્તન એટલે વસ્તુમાંથી મહત્તમ લાભ મેળવવાની અપેક્ષા. કોઈ પણ કાર્યમાંથી મહત્તમ લાભ અને ન્યુનતમ નુકસાન થાય તેવું વર્તન સુસંગત બુદ્ધિપૂર્વકનું વર્તન તરીકે ઓળખવામાં આવે છે.

આ સિદ્ધાંતમાં તુષ્ટિગુણને માપવા માટેનાં માપદંડેને રજૂ કરવામાં આવ્યા છે. આ

બાબતને આપણે એક ઉદાહરણ દ્વારા સમજું.

ધારો કે રમતમાં ભાગ લેવાથી  $n$  જેટલાં સંભવિત ઈનામો મળી શકે તેમ છે. આ ઈનામોને આ રીતે રજુ કરી શકાય.

$X_1, X_2, \dots, X_n$

અપેક્ષા પ્રમાણે આ ઈનામોને ચડતાં કમમાં ગોઠવવામાં આવ્યા છે. એટલે કે  $X_1$  સૌથી ઓછું પસંદ કરે છે. ત્યાર બાદ  $X_2$  તેમાં  $X_n$  સૌથી વધારે પસંદ કરે છે. કારણ કે  $X_n$  રમતમાંથી સૌથી વધારે અપેક્ષિત તુષ્ટિગુણ મળે છે અને  $X_1$  માંથી સૌથી ઓછો તુષ્ટિગુણ મળે છે. તેથી  $X_1$  સૌથી ઓછો પસંદ કરવામાં આવે છે. આ ઈનામોને આપણે પસંદગીના આધારે આવી રીતે ગોઠવી શકાય.

$$u(X_1) = 0$$

$$u(X_n) = 1$$

વોન ન્યુમેન- મોંગસ્ટન એવું દર્શાવે છે કે બસે અપેક્ષિત તુષ્ટિગુણના વિકલ્પને સંખ્યા કે કમ આપીને ગ્રાહકની પસંદગીને દર્શાવી શકાય છે.

આમ વોન ન્યુમેન-મોંગસ્ટન અભિગમનાં કમબદ્ધતા તુષ્ટિગુણ વિધેય તરીકે કામ કરતું હોય તેમ જણાય છે. જેમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે વ્યક્તિ પોતાના અપેક્ષિત તુષ્ટિગુણને મહત્તમ કરવા તુષ્ટિગુણના આધારે વિકલ્પોની પસંદગી કરે છે અને મહત્તમ કલ્યાણ કરવાનો પ્રયાસ કરે છે અને અપેક્ષિત તુષ્ટિગુણના આધારે વ્યક્તિ અનિશ્ચિત પરિસ્થિતિમાં કઈ રીતે વર્તન કરે છે. તેની સમજૂતી આપે છે. તેને આધારે અપેક્ષિત તુષ્ટિગુણને મહત્તમ કરવાનો પ્રયત્ન કરે છે. તે બાબત સમજાવી શકાય.

#### 14.13 સારાંશ :

આજના અત્યંત ગતિશીલ અને પરિવર્તનશીલ યુગમાં બજારમાં અને આર્થિક જગતમાં સતત ફેરફારો થાય છે. તેથી બજાર અનિશ્ચિત તથા આર્થિક અનિશ્ચિતતાના કારણે કોઈ પણ આર્થિક, વ્યાપારિક અને ઔદ્યોગિક કામગીરી કરવામાં જોખમો સર્જાય છે. વળી દરેક જોખમો પ્રત્યે દરેક વ્યક્તિનું વર્તન અલગ-અલગ હોય છે. જે વ્યક્તિની માનસિકતા પર આધાર રાખે છે. કેટલાંક લોકો જોખમ લેવાનું પસંદ કરે છે તો કેટલાંક તેનો વિરોધ કરે છે. આવી પરિસ્થિતિમાં લોકો કેવી રીતે વર્તન કરે છે તે દર્શાવવાનો તથા વિવિધ જોખમ કેવી રીતે ઘટાડી શકાય તે રજૂ કરવા પ્રયત્ન પ્રસ્તુત એકમમાં કરવામાં આવ્યો છે.

#### 14.14 ચાવીરૂપ શબ્દો :

વીમો : “વીમો એટલે પોલીસી ધારકોને આર્થિક સલામતીનું વચ્ચન આપતો કરાર.”

વાજબી રમતો : “જે રમતોમાં જીતની અને હારની સંભાવના સરખી હોય તેને વાજબી રમતો કહે છે.”

જોખમ : જેના પરિણામો અંગે અગાઉથી ચોક્કસ અને નક્કર રીતે અનુમાન કે આગાહી ન થઈ શકે તેને જોખમ કહે છે.

સંભાવના : કોઈ પણ બાબત બનવાની સંભવિત શક્યતાઓને સંભાવના તરીકે ઓળખવામાં આવે છે.

**જોખમ પ્રિય વ્યક્તિ :** જોખમ પ્રિય વ્યક્તિ એટલે એવી વ્યક્તિ કે જીતની સંભાવના પોતાના પક્ષમાં ન હોવા છતાં પણ રમતોમાં ભાગ લે તેવું માનસ ધરાવતી વ્યક્તિ.

**જોખમ અપ્રિય વ્યક્તિ:** જોખમ અપ્રિય વ્યક્તિ એટલે એવી વ્યક્તિ જીતની સંભાવના પોતાના પક્ષમાં હોવા છતાં પણ રમતમાં ભાગ ન લે તેવું વર્તન ધરાવતી વ્યક્તિ નીચેના પ્રશ્નોનાં સવિસ્તાર જવાબ આપો.

- (1) અચોક્કસતાનો અર્થ આપો અસરો જણાવો.
- (2) જોખમ એટલે શું ? જોખમ પ્રત્યે વ્યક્તિનું વર્તન જણાવો.
- (3) અપેક્ષિત તુષ્ટિગુણ અને અચોક્કસતા અસાધારણાનો અભિગમ વિગતે સમજાવો.
- (4) જોખમ ઘટાડવાના વિવિધ ઉપાયો જણાવો.
- (5) વોન ન્યૂમેન અને રોંગરટનનો સિદ્ધાંત સમજાવો.
- (6) વાજબી રમતો અને અપેક્ષિત તુષ્ટિગુણ વચ્ચેનો સંબંધ સમજાવો.

નીચેના પ્રશ્નોનાં ટૂંકમાં જવાબ આપો.

- (1) જુગાર અને વીમો
- (2) જોખમ અને અનિશ્ચિતતા
- (3) જોખમ અણગમો અને વીમો
- (4) અપેક્ષિત તુષ્ટિગુણ એટલે શું ?
- (5) વાજબી રમત અને અપેક્ષિત તુષ્ટિગુણ

#### ● સ્વાધ્યાય :

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો.

- (1) સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જેમ જોખમનું પ્રમાણ ઊંચું તેમ તેમાંથી મળતો લાભ વધુ હોય છે.
- (2) જુગારમાં ખેલાડીને સિક્કો ઉછાળીને ચુકવણી કરવામાં આવે છે.
- (3) જોખમ પ્રિય વ્યક્તિ સંભાવના પોતાના પક્ષમાં ન હોય તો રમતમાં ભાગ લેતો નથી.
- (4) વીમો એ પોલીસી ધારકોને આર્થિક સુરક્ષા આપતો એક કરાર છે.
- (5) વાજબી રમતોમાં હારની અને જીતની સંભાવના સરખી હોય છે.
- (6) વ્યક્તિ વસ્તુને વાયદા બજારમાં વેચાડા કરીને જોખમ ઘટાડી શકે છે.
- (7) વીમો એ જુગારથી વિરુદ્ધ છે.

**જવાબ :** (1) ખરું (2) ખોરું (3) ખરું (4) ખરું (5) ખરું (6) ખરું (7) ખરું  
યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.

- (1) વીમાનું પણ એક બજાર છે. કારણ કે લોકો ..... અપ્રિય હોય છે.

- |              |                  |
|--------------|------------------|
| A. બિન જોખમી | B. જોખમ          |
| C. અવિશ્વાસુ | D. અંધશ્રદ્ધાળું |

## એકમલક્ષી અર્થશાસ્ત્ર

- (2) જોખમને ..... દ્વારા ઘટાડી શકાય છે.
- A. વીમો
  - B. વાયદા બજાર
  - C. સંપૂર્ણ માહિતી
  - D. ઉપરોક્ત બધા જ
- (3) વીમા કંપનીઓ ..... દ્વારા મહત્તમ નફો મેળવી શકે છે.
- A. જોખમ એકત્રીકરણ અને જોખમ પ્રસાર
  - B. વાયદા બજાર
  - C. અપૂર્ણ માહિતી
  - D. ઉપરોક્ત બધા જ
- (4) બધાં જ પ્રકારની આર્થિક લેવડ-દેવડમાં ..... સામેલ હોય છે.
- A. ખોટ
  - B. લાભ
  - C. જોખમ
  - D. ઉપરોક્ત કોઈ નહીં
- (5) જોખમ પ્રત્યે વક્તિનો વ્યવહાર ..... પ્રકારો છે.
- A. પાંચ પ્રકારનો
  - B. ત્રણ પ્રકારનો
  - C. બે પ્રકારનો
  - D. એક પ્રકારનો
- (6) એક જોખમ પ્રિય વ્યક્તિની જીતની સંભાવના પોતાના પક્ષે ન હોવા છતાં રમવા.....હોય છે.
- A. તત્પર
  - B. નિર્ભર
  - C. બેચેન
  - D. ઉપરોક્ત કોઈ નહીં
- (7) અનિશ્ચિતા માનવ જીવનું એક ..... તથ્ય છે.
- A. મૌલિક
  - B. લેખિત
  - C. અલૌકિક
  - D. ઉપરોક્ત બધાં જ
- (8) જોખમ તથા ..... માં આંતર જાણવું આવશ્યક છે.
- A. અનિશ્ચિતતા
  - B. વાસ્તવિકતા
  - C. અચોક્કસતા
  - D. બિનવાસ્તવિકતા
- (9) અનિશ્ચિતતા એ એક એવી સ્થિતિ છે કે જેની સંભાવના ..... તેમ નથી.
- A. માપી શકાય
  - B. દર્શાવી શકાય
  - C. ઓળખી શકાય
  - D. ઉપરોક્ત કોઈ નહીં
- (10) કોઈ પણ પેઢી એક પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરવાના બદલે અનેક પ્રકારની વસ્તુ ઉત્પાદન કરે તેને ..... કરે છે.
- A. વાયદા બજાર
  - B. વિવિધીકરણ
  - C. લિન્ઝ બજાર
  - D. એકરૂપ બજાર

### જવાબ :

- (1) B - જોખમ (2) D - ઉપરોક્ત બધા જ (3) A - જોખમ એકત્રીકરણ અને જોખમ પ્રસાર  
 (4) C - જોખમ (5) B - તત્પર (6) A - મૌલિક (7) A - અનિશ્ચિતતા  
 (9) A - માપી શકાય (10) B - વિવિધીકરણ

**14.15 ઉપયોગી પુસ્તકોની યાદી :**

- (1) એકમલકી અર્થશાસ્ત્ર - 2, પ્રિ. આર. જોધી, ડૉ. પી.પી. પ્રજાપતિ, ડૉ. કિરણ પંડ્યા,  
પ્રા. જે.પી. ભણ, પોષ્યુલર પ્રકાશન, સુરત
- (2) વ્યાણ અર્થશાસ્ત્ર કે સિદ્ધાંત : લક્ષ્મી પબ્લિકેશન્સ, દિલ્હી
- (3) માઇક્રો કોનોમિક્સ : પ્રિસિપલ્સ, એપ્લીકેશન્સ એંડ ટૂલ્સ, સંબંધ બાસોલિયા, ડીએનડી  
પબ્લિકેશન્સ

### युनिवर्सिटी गीत

स्वाध्यायः परमं तपः

स्वाध्यायः परमं तपः

स्वाध्यायः परमं तपः

शिक्षण, संस्कृति, सद्भाव, दिव्यबोधनुं धाम  
 डॉ. बाबासाहेब आंबेडकर ओपन युनिवर्सिटी नाम;  
 सौने सौनी पांख मणे, ने सौने सौनुं आभ,  
 दशे दिशामां स्मित वहे हो दशे दिशे शुभ-लाभ.

अभाण रही अज्ञानना शाने, अंधकारने पीवो ?  
 कहे बुद्ध आंबेडकर कहे, तुं था तारो दीवो;  
 शारदीय अज्वाणा पहोंच्यां गुर्जर गामे गाम  
 धुव तारकनी जेम झगडणे एकलव्यनी शान.

सरस्वतीना मयूर तमारे फिये आवी गहेके  
 अंधकारने हडसेलीने उजासना फूल महेके;  
 बंधन नहीं को स्थान समयना जवुं न घरथी दूर  
 घर आवी भा हरे शारदा दैन्य तिभिरना पूर.

संस्कारोनी सुगंध महेके, मन मंदिरने धामे  
 सुखनी टपाल पहोंचे सौने पोताने सरनामे;  
 समाज केरे दरिये हांडी शिक्षण केंद्रुं वहाण,  
 आवो करीये आपण सौ  
 भव्य राख्य निर्माण...  
 दिव्य राख्य निर्माण...  
 भव्य राख्य निर्माण